



डॉ. बाबासाहेब आंबेडकर  
ओपन युनिवर्सिटी

ES-111

विज्ञाननुं अध्यापन  
(Teaching of Science)

विभाग

1

विज्ञान शिक्षणनुं स्वरूप, नुतन प्रवाळो अने सळायक प्रवृत्तियो

---

अेकम-1 विज्ञान शिक्षण : भूमिका

---

अेकम-2 विज्ञान शिक्षणमां नुतन प्रवाळो

---

अेकम-3 विज्ञान शिक्षणमां सळायक प्रवृत्तियो

---

अेकम-4 विज्ञान शिक्षणनी प्रयोगशाळा

---

## ES-111, વિજ્ઞાનનું અધ્યાપન (વિભાગ-1)

<b>લેખક</b>	
ડૉ. કેતન ગોહિલ	શ્રી સી. એચ. શાહ મૈત્રી વિદ્યાપીઠ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશન, સુરેન્દ્રનગર
<b>પરામર્શક (વિષય)</b>	
ડૉ. રાજેશ રાઠોડ	આઈ. આઈ. ટી. ઈ., ગાંધીનગર.
<b>પરામર્શક (ભાષા)</b>	
કુ. ઉમા ઠક્કર	વિજ્ઞાન કોલેજ ઓફ એજ્યુકેશન, અમદાવાદ.
<b>સંપાદન અને સંયોજન</b>	
પ્રો. (ડૉ.) અજીતસિંહ પી. રાણા	નિયામકશ્રી (શિક્ષણશાસ્ત્ર) ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. અમદાવાદ.
<b>સંયોજન સહાય</b>	
ડૉ. મીના આઈ. રાજપૂત	ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. અમદાવાદ.

પ્રકાશક : કુલસચિવ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ-382481

આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ-2020, નકલ : 600

દ્વિતીય આવૃત્તિ-2021, નકલ : 600

**ISBN : 978-93-5598-055-7**

Copyright © Registrar, Dr. Babasaheb Ambedkar Open University, Ahmedabad.  
December 2020

While all efforts have been made by editors to check accuracy of the content, the representation of facts, principles, descriptions and methods are that of the respective module writers. Views expressed in the publication are that of the authors, and do not necessarily reflect the views of Dr. Babasaheb Ambedkar Open University. All products and services mentioned are owned by their respective copyrights holders, and mere presentation in the publication does not mean endorsement by Dr. Babasaheb Ambedkar Open University. Every effort has been made to acknowledge and attribute all sources of information used in preparation of this Self Learning Material. Readers are requested to kindly notify missing attribution, if any.

---

**ES-111 વિજ્ઞાનનું અધ્યાપન**

---

**વિભાગ-1 વિજ્ઞાન શિક્ષણનું સ્વરૂપ, નુતન પ્રવાહો અને સહાયક પ્રવૃત્તિઓ**

- એકમ-1 વિજ્ઞાન શિક્ષણ : ભૂમિકા
- એકમ-2 વિજ્ઞાન શિક્ષણમાં નુતન પ્રવાહો
- એકમ-3 વિજ્ઞાન શિક્ષણમાં સહાયક પ્રવૃત્તિઓ
- એકમ-4 વિજ્ઞાન શિક્ષણની પ્રયોગશાળા

**વિભાગ-2 વિજ્ઞાન શિક્ષણ અધ્યાપનનું આયોજન**

- એકમ-5 માર્કોટીચિંગ
- એકમ-6 સિમ્યુલેશન
- એકમ-7 ઉદ્દેશ્ય અને હેતુઓ
- એકમ-8 તાસ પાઠ / એકમ આયોજન

**વિભાગ-3 વિજ્ઞાન શિક્ષણની અધ્યાપન પદ્ધતિઓ, અભિગમો અને પ્રતિમાનો**

- એકમ-9 વિજ્ઞાન શિક્ષણની અધ્યાપન પદ્ધતિઓ-1
- એકમ-10 વિજ્ઞાન શિક્ષણની અધ્યાપન પદ્ધતિઓ-2
- એકમ-11 વિજ્ઞાન શિક્ષણના અધ્યાપન અભિગમો
- એકમ-12 વિજ્ઞાન શિક્ષણના અધ્યાપન પ્રતિમાનો

**વિભાગ-4 વિજ્ઞાન શિક્ષણમાં મૂલ્યાંકન, અનુબંધ, નિદાન અને ઉપચાર, શૈક્ષણિક સાધનો અને ક્રિયાત્મક સંશોધન**

- એકમ-13 વિજ્ઞાન શિક્ષણમાં મૂલ્યાંકન, પ્રશ્નપત્ર સંરચના અને અનુબંધ
- એકમ-14 વિજ્ઞાન શિક્ષણમાં નિદાનાત્મક મૂલ્યાંકન અને ઉપચારાત્મક શિક્ષણ
- એકમ-15 વિજ્ઞાન શિક્ષણના અધ્યાપન માટે શૈક્ષણિક સાધનો
- એકમ-16 વિજ્ઞાન શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધન

## દૂરવર્તી અધ્યયનમાં સ્વ-અધ્યયન અભ્યાસ-સામગ્રીની ભૂમિકા

દૂરવર્તી શિક્ષણ પ્રણાલીમાં અસરકારક સ્વ-અધ્યયન અભ્યાસ-સામગ્રી અનિવાર્ય છે. આ અભ્યાસ-સામગ્રીના લેખકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ એકબીજાથી ઘણાં દૂર અને ક્યારેક તો ક્યારેય ન મળી શકે તેવી સ્થિતિમાં હોવાથી આવી અધ્યયન સામગ્રી સુગમ અને અસરકારક હોવી જરૂરી છે. દૂરવર્તી શિક્ષણ માટેની અભ્યાસ-સામગ્રીમાં વિદ્યાર્થીના બૌદ્ધિક ચિંતનને ઉદ્દીપ્ત કરવાની ક્ષમતા તથા આવશ્યક તમામ અધ્યયન પ્રવૃત્તિઓ હોવી જોઈએ. આ સામગ્રી પાઠ્યક્રમના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓના અનુસંધાને વિદ્યાર્થીને પર્યાપ્ત માર્ગદર્શન આપવા સક્ષમ હોવી જોઈએ. સ્વ-અધ્યયન સામગ્રીમાં અભ્યાસક્રમમાં સૂચિત તમામ બાબતોનો સમાવેશ થાય તે જરૂરી છે.

અસરકારક અધ્યયન સિદ્ધ કરવા માટે અનેક પ્રકારના આયોજનનો ઉપયોગ કરવામાં આવે છે; જેનાથી વિદ્યાર્થી જ્ઞાનોપાર્જન કરી શકે. બૌદ્ધિક અને મનોશારીરિક કૌશલ્યો કેળવી શકે અને વર્તન તથા અભિગમમાં આવશ્યક પરિવર્તનો સાધી શકે. આથી જ વિદ્યાર્થીનું મૂલ્યાંકન પણ પાઠ્યસામગ્રીમાં આવરી લેવામાં આવ્યું છે.

દૂરવર્તી શિક્ષણની સ્વ-અધ્યયન અભ્યાસ સામગ્રીમાં ઉપયોગમાં લેવામાં આવેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સ્વરૂપ તે શિક્ષણના જ્ઞાનાત્મક, ભાવાત્મક કે મનોશારીરિક હેતુમાંથી કયા હેતુને સંલગ્ન છે? તેના પર આધારિત છે. આ હેતુઓ ભવિષ્યમાં અનુક્રમે જ્ઞાન, બૌદ્ધિક કૌશલ્યો અને મનોશારીરિક કૌશલ્યોની ઉપલબ્ધિમાં પરિણમે છે. વિદ્યાર્થીએ મેળવેલ જ્ઞાનની પ્રાપ્તિ, ઉપયોગ અને અભિવ્યક્તિ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય. વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનનો અને અનુભવોનો આધાર લઈને રચવામાં આવેલ શિક્ષણ સામગ્રી દ્વારા બૌદ્ધિક કૌશલ્યના હેતુને સિદ્ધ કરી શકાય છે અને તેના દ્વારા નવીન જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત થાય છે.

અભ્યાસ-સામગ્રીમાં સ્વાધ્યાય પ્રોજેક્ટ અને પ્રતિપૂષ્ટિ(Feedback)ના સ્વરૂપે અભ્યાસનું આયોજન જરૂરી છે. શારીરિક કૌશલ્ય સંબંધિત શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ચિત્રાત્મક રજૂઆત હોવી જોઈએ અને ત્યારબાદ ઊચિત અભ્યાસનું આયોજન હોવું જોઈએ. વર્તન અને અભિગમમાં પરિવર્તન માટે આયોજિત શિક્ષણ પ્રવૃત્તિઓ રસ જન્માવે તેવી તથા આ પરિવર્તન દ્વારા થતાં લાભ અને તેની જરૂરિયાતને પ્રતિબિંબિત કરે તેવી હોવી જોઈએ. ત્યાર પછી નવાં અભિગમોને અપનાવવાની અને તે સંબંધિત પ્રક્રિયાના યોગ્ય અભ્યાસનું ઊચિત આલેખન થવું જોઈએ.

## દૂરવર્તી શિક્ષણની ભૂમિકા.

પ્રત્યક્ષ અધ્યાપનમાં જોવા મળતી પ્રત્યાયનની વિશેષતાઓ; જેવી કે અંતરાલાપ, પૂર્વઅભિસંધાન, યોગ્ય સ્થાને વિરામ, આરોહ-અવરોહ, ભાવ-ભંગીમાં, સ્વરભાર વગેરે દૂરવર્તી અધ્યયનમાં ઉપલબ્ધ નથી. આ ઉણપ વિશેષતઃ મુદ્રિત સાહિત્યમાં (લેખિત સાહિત્યમાં) જોવા મળે છે. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના વ્યવહારની આ ખૂટતી કડીને જોડવા માટે જ દૂરવર્તી સ્વ-અધ્યયન સામગ્રીમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. માટે જ આવી પ્રવૃત્તિઓનું આયોજન વૈકલ્પિક નહીં; પરંતુ અનિવાર્ય છે.

સ્વ-અધ્યયન અભ્યાસ-સામગ્રીને નાના એકમોમાં વિભાજિત કરીને શિક્ષણના ઉત્તમ સાધન તરીકે વિકસાવવાની સંકલ્પના છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વૈવિધ્ય દ્વારા શિક્ષણના વિવિધ ક્ષેત્રના હેતુઓ સિદ્ધ થાય તેવો પ્રયત્ન કરવાનો છે.

દૂરવર્તી શિક્ષણની સ્વ-અધ્યયન સામગ્રીનું આયોજન પૂર્વનિશ્ચિત શૈક્ષણિક નીપજને ધ્યાનમાં લઈને કરવાનું હોવાથી તેના હેતુઓ અને ધ્યેયો નિશ્ચિત હોય છે. વળી અધ્યેતાઓ દૂરસ્થ હોવાથી આ સામગ્રી દ્વારા તેઓ નિશ્ચિત અધ્યયન પ્રવૃત્તિઓમાં સંલગ્ન રહે તેવું આયોજન કરવામાં આવે છે. જેથી અધ્યેતાઓ સંબંધિત સંકલ્પનાઓને બરાબર સમજી શકે. સ્વ-અધ્યયન સામગ્રીમાં સાથે સંકળાયેલ સ્વાધ્યાયો, પ્રાયોગિક કાર્યો, પ્રવૃત્તિઓ અને પ્રકલ્પોનો પણ આ જ હેતુ છે. આ સામગ્રી માટે ઊચિત શૈક્ષણિક પ્રવૃત્તિઓની ઉદાહરણરૂપ સૂચિ ઘણી મોટી હોઈ શકે. આ સંદર્ભે શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીને અભિપ્રેરિત કરે છે, માર્ગદર્શન આપે છે અને વિદ્યાર્થીની પ્રગતિ અને પ્રદર્શનનું સતત માપન-મૂલ્યાંકન પણ કરે છે.





એકમ  
1

## વિજ્ઞાન શિક્ષણ : ભૂમિકા

: રૂપરેખા :

- 1.1 પ્રસ્તાવના
- 1.2 ઉદ્દેશ્યો
- 1.3 વિજ્ઞાન એટલે શું ? અર્થ, વ્યાખ્યા
- 1.4 માનવજીવન અને વિજ્ઞાનનો અનુબંધ
- 1.5 વિજ્ઞાનનું મહત્ત્વ
- 1.6 ભારતમાં વિજ્ઞાન શિક્ષણ
- 1.7 વિજ્ઞાન શિક્ષકના કૌશલ્ય
- 1.8 ભારતીય અને પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોનું વિજ્ઞાનમાં પ્રદાન
- 1.9 સારાંશ
- 1.10 તમારી પ્રગતિ ચકાસો
- 1.11 સ્વાધ્યાય

---

### 1.1 પ્રસ્તાવના (Introduction) :

---

વિજ્ઞાન વિષય પ્રથમથી જ માનવ માટે જીજ્ઞાસા યુક્ત વિષય રહ્યો છે. વિજ્ઞાનના અવનવા આવિષ્કારો અને તેમાં નવીનીકરણને કારણે મનુષ્ય સુખાકારી જીવન જીવી રહ્યો છે. વિજ્ઞાન વિષયના પ્રશિક્ષણાર્થી તરીકે આપણે જ્યારે શાળાના બાળકોને વિજ્ઞાન વિષયવસ્તુમાં તૈયાર કરવાના છે ત્યારે વિજ્ઞાન શિક્ષણની કેટલીક મહત્વની અને પાયાની બાબતો જાણવી અત્યંત મહત્વની બની જાય છે. પ્રસ્તુત એકમમાં વિજ્ઞાનનો અર્થ, વિજ્ઞાન શિક્ષણની ભૂમિકા, વિજ્ઞાન શિક્ષણમાં નુતન પ્રવાહો, વિજ્ઞાન શિક્ષણમાં સહાયક પ્રવૃત્તિઓ અને વિજ્ઞાન શિક્ષણની પ્રયોગશાળા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. પ્રસ્તુત એકમના અભ્યાસ બાદ તમો વિજ્ઞાન શિક્ષણના સ્વરૂપ, પાશ્ચાત્ય, વિજ્ઞાન શિક્ષણનું વર્તમાન અને તેમાં સહાયક પ્રવૃત્તિથી માહિતગાર થશો. આગળના એકમોનો અભ્યાસ કરવા તેને સમજવા પ્રસ્તુત એકમ આપને સહાયરૂપ થશે.

---

### 1.2 ઉદ્દેશ્યો (Objectives)

---

- આ એકમના અભ્યાસ પછી તમે આટલું કરી શકશો.
- વિજ્ઞાનનો અર્થ સ્પષ્ટ કરી શકશો.
  - માનવજીવન અને વિજ્ઞાન વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરી શકશો.
  - વિજ્ઞાનનું મહત્વ તમારા શબ્દોમાં વર્ણવી શકશો.
  - ભારતમાં વિજ્ઞાનના ઇતિહાસ વિષે જણાવી શકશો.
  - વિજ્ઞાન શિક્ષકના કૌશલ્યો જણાવી શકશો.
  - કેટલાક ભારતીય અને કેટલાક પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોનું પ્રદાન વિશે માહિતી આપી શકશો.

---

### 1.3 વિજ્ઞાન એટલે શું ? અર્થ, વ્યાખ્યા

---

“વિજ્ઞાન એટલે શું ?” સામાન્ય રીતે આ પ્રશ્નના ઉત્તરમાં અનેક ઉત્તરો મળતા હોય છે. થર્બર (Thurber, W.A.) ના મત અનુસાર વિજ્ઞાનના અનુભવી અધ્યાપકો કે નિષ્ણાંતો જ્યારે વિજ્ઞાન એટલે શું ? તેનો ઉત્તર આપે છે ત્યારે ઘણા બધા ઉત્તર મળે છે અને તે બધાં મોટે ભાગે સાચા હોય છે. વિજ્ઞાનની સર્વ સામાન્ય વ્યાખ્યા આપવી અઘરી છે. આમ છતાં વિજ્ઞાનને સમજવા કેટલીક વ્યાખ્યાઓ જોઈએ.

“માનવીના દૈનિક જીવનને સ્પર્શતું જ્ઞાન એ જ વિજ્ઞાન.”

વિજ્ઞાનની પ્રસ્તુત વ્યાખ્યા સર્વ સામાન્ય છે. આમ છતાં ઊંડાણથી સમજવાનો પ્રયાસ કરીએ તો જણાશે કે, માનવી સવારથી સાંજ સુધી અનેક પ્રવૃત્તિઓ કરે છે, જેમાં તેને દરેક પ્રવૃત્તિને અંતે/દરમિયાન ક્યાંક તો રાસાયણિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન કે ભૌતિક વિજ્ઞાનનો સ્પર્શ કરવો જ પડે છે. આમ શુદ્ધ વિજ્ઞાનનો ત્રણ મુખ્ય શાખાઓ રસાયણ, ભૌતિક અને જીવવિજ્ઞાન એ જ મુખ્ય વિજ્ઞાન છે.

“જ્ઞાનને જીવંત, ક્રિયાશીલ અને ચેતનવંત રાખનાર પાસુ એ તેની પ્રક્રિયા છે. - જે વિજ્ઞાન છે, વૈજ્ઞાનિક પદ્ધતિ છે.”

- કાર્લ પિયર્સન

કાર્લ પિયર્સન વિજ્ઞાનને એક પ્રક્રિયાના સ્વરૂપમાં રજૂ કરી વૈજ્ઞાનિક પ્રક્રિયાનું મહત્વ સ્વીકારે છે.

“વિજ્ઞાન એટલે નિરીક્ષણ અને અનુભવ ઉપરથી વ્યવસ્થા પ્રમાણે અને નિયમ શોધનની દૃષ્ટિએ ગોઠવેલું જ્ઞાન.”

- ભાવસાર, લવિંગીયા અને ત્રિવેદી

ઉપરોક્ત વ્યાખ્યામાં એવું સમજાવાયું છે કે, પરિસ્થિતિ, સમાજ અને વાતાવરણમાંથી વ્યક્તિને અનુભવો મળતા જ રહે છે. આ અનુભવોમાંથી, વ્યવસ્થિત અને ચકાસાયેલા અનુભવોને જીવન-જીવનવ્યવહારની આજુબાજુ ગોઠવીએ અને જે તંત્ર બને તે વિજ્ઞાન.

ડિક્નેરી ઓફ સાયન્સ ચેમ્પમેન વિજ્ઞાનનું અર્થઘટનની નીચે મુજબ કરે છે.



“વિજ્ઞાન એ સફળતાને વરેલા અગણિત, શ્રેણીબદ્ધ અવલોકનની નીપજ છે, જેના પરિણામે સંકલ્પનાઓ અને સિદ્ધાંતો મળે છે. પ્રયોગશાળામાં થતા વર્તમાન અને ભાવિ પ્રયોગ આંકડાકીય અને ગૃહિતાત્મક પરીણામોયુક્ત અવલોકનો આપે છે.”

રેમ્પનેનની પ્રસ્તુત વ્યાખ્યા કોઈપણ વાત / સિદ્ધાંત / નિયમને સીધુ જ સ્વીકારવાને બદલે તેના પ્રયોગો, અવલોકનો અને તેમાંથી મળતી નીપજના પરિણામોનું પૃથક્કરણ બાદ સ્વીકારવાની વાત કરવામાં આવી છે. ઉપરાંત આ મળેલ સિદ્ધાંત કે પરિણામ ભવિષ્યમાં કોઈ સંશોધનો માટે ઉપયોગી થશે. એવી ચોક્કસ વાત રજૂ કરવામાં આવી છે.

આજે શાળાઓમાં વિજ્ઞાનના જ્ઞાનને એક વિશિષ્ટ પ્રકારનો જથ્થો અને જડ માનવામાં આવે છે. પરંતુ સત્યતો એ છે કે વિજ્ઞાનના જ્ઞાનનો જથ્થો એટલો બધો છે કે તેમાં અતિ અલ્પાંશ પણ પુસ્તકમાં વિજ્ઞાનરૂપે આપવાનો પ્રયત્ન સફળ થઈ શકતો નથી માટે “વિજ્ઞાન એ એક પ્રક્રિયા છે.” એજ વધારે ઉપયોગી સંકલ્પના છે. કારણ કે વિજ્ઞાનની અવનવી માહિતીના જાણનાર આ માહિતી કેવી રીતે તૈયાર થાય છે એ ન જાણે તો તે માત્ર આંશિક જ્ઞાન વહન કરનારો ચાલતો શબ્દકોષ જ બની રહે છે. જ્યારે વિજ્ઞાનની માહિતી, નિયમો, સિદ્ધાંતો વગેરે જ પ્રક્રિયા દ્વારા ઊભા થયા છે અને થતાં રહે છે તે પ્રક્રિયા દ્વારા જ વ્યક્તિ વિજ્ઞાનને ઝડપથી સમજશે અને આગળ વધી શકશે.

વિજ્ઞાનનો સાદામાં સાદો અર્થ કરીએ તો વિજ્ઞાન એટલે વિ-જ્ઞાન અર્થાત્ વિશેષ જ્ઞાન પરંતુ આ અર્થ પણ એકપક્ષી છે. કેટલાક નિષ્ણાંતોએ વિજ્ઞાનના અર્થ નીચે મુજબ આપવાના પ્રયાસો કર્યા.

- મનુષ્ય જીવન અને તેની સામાજિક જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને રચેલ અનુભવજન્ય બાબતોનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે વિજ્ઞાન.
- નૈસર્ગિક વર્તનના પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરેલ વર્ગીકૃત જ્ઞાન એ વિજ્ઞાન છે.
- વિજ્ઞાન એ કુદરતી શક્તિઓના નિયંત્રણથી થયેલ માનવ સંસ્કૃતિની પ્રગતિનો ઇતિહાસ છે. આમ, ઉપરોક્ત વ્યાખ્યા અને અર્થ પરથી વિજ્ઞાન અંગે કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે જે નીચે મુજબ છે.
- વિજ્ઞાન કુદરત અને માનવી વચ્ચે સમન્વય સાધે છે.
- માનવીના રોજબરોજના જીવનને સ્પર્શતું જ્ઞાન એટલે જ વિજ્ઞાન.
- વિજ્ઞાન એટલે સમસ્યા અને તદ્દનુરૂપ અન્વેષણ.
- વિજ્ઞાન એ પ્રયોગ, નિરીક્ષણ અને અનુભવ પરથી મળેલું જ્ઞાન છે.
- વિજ્ઞાન એ જુદી જુદી શાખાઓનો સરવાળો નથી. એ તો પ્રત્યેક માનવીના જીવનની રોજિંદી પ્રવૃત્તિઓનું સ્પષ્ટીકરણ અને કાર્યકારણ છે.
- વિજ્ઞાન એ જ્ઞાનનો દેહ છે અને જ્ઞાન પ્રાપ્ત કરવાની તેમજ તેને વિશુદ્ધ બનાવવાની પ્રક્રિયા છે.

આમ, વિજ્ઞાન અને માનવજીવનનો સંબંધ અતિ મહત્વનો અને અતુટ છે. આપણે ન ઈચ્છવા છતાં વિજ્ઞાનને મનુષ્યથી અળગુ કરી શકતા નથી.

#### 1.4 માનવજીવન અને વિજ્ઞાનનો અનુબંધ

વિજ્ઞાનની બે પ્રમુખ શાખાઓ છે. નૈસર્ગિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. ઉપરોક્ત પૈકી નૈસર્ગિક વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન જ્યારે સામાજિક વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર, સંગીત, શિક્ષણ શાસ્ત્ર, ગણિત વગેરે. આમ, શાળામાં વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષા આ ત્રણ વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે. જેમાં વિજ્ઞાન વિશે આમ કહી શકાય, “મનુષ્ય જીવન અને તેની સામાજિક જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને રચેલ અનુભવજન્ય બાબતોનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે વિજ્ઞાન.” આ બાબતમાં મનુષ્યજીવન અને તેની જરૂરિયાતોની વાત કરવામાં આવી છે. મનુષ્યને અનેક ઈચ્છાઓ ઉદભવે છે અને તે સંતોષવા તે રાત-દિવસ કાર્ય કરે છે. જે કોઈ મુશ્કેલી અનુભવે તેના ઉપાય સ્વરૂપે તે સજીવને માટે ઉપયોગી અને જરૂરી ચીજવસ્તુ, પદાર્થ, સાધનનો આવિષ્કાર કરે છે અને આ પ્રક્રિયામાં વિજ્ઞાન અતિ મહત્વનો રોલ ભજવે છે કહેવાય છે ને કે

“જરૂરિયાત એ સંશોધનની જનની છે.” વર્તમાન સમયમાં આપણે આપણી આસપાસ જે કંઈ, સામાન, ચીજ વસ્તુઓ કે અન્ય વસ્તુઓ તરફ નજર દોડવીએ તો ખ્યાલ આવશે કે મનુષ્ય અને વિજ્ઞાન વચ્ચે કેટલો જુનો અનુબંધ છે. મનુષ્ય એ પોતાની શારીરિક જરૂરિયાત સંતોષવા ઉપાયો શોધી કાઢ્યા મનુષ્યએ પોતાની આર્થિક જરૂરિયાત સંતોષવા વિજ્ઞાનનો ઉપયોગ કરી અનેક સંશોધનો બનાવ્યા. વાહનવ્યવહારના સાધનો, સંદેશાવ્યવહારના સાધનો, આનંદદાયક પ્રવૃત્તિ અને મોજશોખના સાધનો વગેરે માનવજીવન અને વિજ્ઞાન વચ્ચેના સંબંધો મહત્વના છે એવું બતાવે છે.

સમાજમાં સમયાંતરે પરિવર્તન આવતું જ રહ્યું છે. યુગ પરિવર્તનની પરિસ્થિતિનું તારણ કાઢીએ તો એલવિન ટોફલરના મતે પ્રથમ મોજું કૃષિ ક્રાંતિનું હતું. બીજું મોજું ઔદ્યોગિક ક્રાંતિ અને વિજ્ઞાનનું છે. આ વિજ્ઞાનનું મોજું એટલું પ્રબળ રહ્યું છે કે તેણે આખા યુગને વિશ્વને વિજ્ઞાનમય કરી નાખ્યું. આજે સૌ કોઈ જાણે છે કે આ વિજ્ઞાનનો યુગ છે, જો કે વિજ્ઞાન માનવજીવન આવ્યું ત્યારથી જ છે. પ્રાચીન કાળથી લોકોએ મનુષ્ય સુખાકારી જીવનના રસ્તાઓ વિજ્ઞાનની મદદથી શોધી કાઢ્યા છે. માનવજીવનનો જેમ જેમ ઉત્તરોત્તર વિકાસ થતો ગયો તેમ તેમ વિજ્ઞાનનું સ્થાન પ્રબળ બનતું ગયું.

છેલ્લા સો એક વર્ષમાં વિજ્ઞાને અદ્ભૂત વિકાસ કર્યો છે. વિજ્ઞાનની અવનવી શોધોથી માનવીના રહેણીકરણી, શિક્ષણ, ઉદ્યોગ ધંધા વગેરેમાં મોટું પરિવર્તન આવ્યું છે. વિજ્ઞાનની આગેકુચે માનવીના જીવનવ્યવહાર, ભૌતિક સુખસમૃદ્ધિ, અવનવા વ્યવસાયો અને તેને કારણે રોજગારીની વિપુલ તકો, ઉદ્યોગ ધંધાને કારણે ઉત્પાદન ક્ષમતામાં ક્રાંતિકારી વધારો, ઉદ્યોગમાં સ્વયંસંચાલનપણું વગેરે બાબતે નાવીન્ય બક્ષ્યું છે.

વિજ્ઞાને માનવજાતને જેટલી ઉન્નત બનાવી છે તેટલી જ નુકસાનકારક પણ બનાવી છે. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધના ભયંકર પરિણામો આપણી સામે જ છે. અને તેમાં જે વિજ્ઞાનના ઉપયોગથી અણુબૉમ્બ બનાવ્યા અને તેની વિઘાતક અસરથી સમગ્ર માનવજાત સારી રીતે પરિચિત છે. આમ માનવજીવન અને વિજ્ઞાનનો સંબંધ અતુટ રહ્યો છે.

### 1.5 વિજ્ઞાનનું મહત્વ :

આધુનિક યુગમાં કોઈપણ દેશની પ્રગતિ, સમૃદ્ધિ, સંરક્ષણ અને તેનો વિકાસ તે દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું શું સ્થાન છે. તેના પર વિશેષ આધારિત છે. કોઈપણ દેશને પ્રગતિશીલ, સદ્ધર અને સમૃદ્ધ બનાવવો હોય તો તેને માટે તેનો આર્થિક વિકાસ જરૂરી છે. આર્થિક વિકાસ થવા માટે ઔદ્યોગિક વિકાસ જરૂરી છે અને ઔદ્યોગિક વિકાસ વિજ્ઞાનના વિકાસ પર આધારિત છે. માનવીની ઉત્પત્તિથી તે આજ સુધી માનવ સંસ્કૃતિ અત્યંત પરિવર્તનશીલ રહી છે. ઝડપી પરિવર્તનો આવતા જ્ઞાનની સીમાઓ વિસ્તરી છે. જ્ઞાન વિશિષ્ટ બન્યું છે. જ્ઞાનનો વિસ્ફોટ થયો છે. આમ, માનવજીવન સંદર્ભે વિજ્ઞાન એક અતિ મહત્વનું પરિબળ રહ્યું છે. હવે આપણે વિજ્ઞાનનું જીવનના વિવિધ ક્ષેત્રોમાં શું મહત્વ છે. તે જોઈએ.

#### (A) વિજ્ઞાનનું વ્યક્તિ માટે મહત્વ

##### (a) વિજ્ઞાન - વ્યક્તિનો નિર્ધારક

દિનપ્રતિદિન કુદરત પર નિયંત્રણ રાખવા માટે વ્યક્તિ નવાં-નવાં સંશોધનો કરી તેનો નવીન પરિસ્થિતિમાં ઉપયોગ કરે છે. વિજ્ઞાનના જ્ઞાનના વિકાસની સાથે જ નવા પુસ્તકો, સામયિકો અને પત્રિકાઓનો વિકાસ થાય છે. વ્યક્તિ વિજ્ઞાનના અવનવા જ્ઞાન સાથે પોતાનો વિકાસ કરે છે. તેથી શાળાના અભ્યાસક્રમમાં અધ્યેતાની વય, બુદ્ધિ અને કક્ષા અનુસાર વિજ્ઞાનના નવાં સંશોધનોનો સમાવેશ થતો રહેવો જોઈએ. જેથી અધ્યેતાઓમાં વિશ્વમાં થતી વિજ્ઞાનની પ્રગતિથી અજ્ઞાત નહીં રહે અને શાળામાંથી જ્યારે સમાજમાં પ્રવેશ કરશે ત્યારે સમાજના વિકાસમાં પોતાનો સહયોગ આપી શકશે.

##### (b) વિજ્ઞાન-વ્યક્તિના ગુણોનો અન્વેષક :

વિજ્ઞાનના વિદ્યાર્થીઓની રીત, વિચારવાની શક્તિ, વલણો અન્ય વિષયના અધ્યેતાઓ કરતા ભિન્ન જોવા મળે છે. વિદ્યાર્થી પાસે જે જ્ઞાન છે. તે કેવી રીતે મેળવ્યું તે જાણવું આવશ્યક / મહત્વનું

છે. વિજ્ઞાન તેના જ્ઞાન કરતા વિચારવાની એક નવી દિશા આપે છે. માટે વિજ્ઞાનના જ્ઞાન કરતા તેની પ્રક્રિયા પર વધુ ધ્યાન આપવું જોઈએ. તેના વિકાસથી વ્યક્તિમાં છુપાયેલી વિશિષ્ટ શક્તિઓ બહાર આવે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે છે અને અનેક સમસ્યાના ઉકેલ માટે દિવાદાંડી રૂપ સાબિત થાય છે.

## (B) વિજ્ઞાનનું સમાજ માટે મહત્ત્વ

વિજ્ઞાનનું સમાજ માટે મહત્ત્વ નીચે વર્ણવેલ છે.

### (a) સમાજની વ્યક્તિઓના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવતું વિજ્ઞાન :

આસપાસ કે વાતાવરણમાં બનતી પ્રત્યેક ઘટના કાર્ય-કારણના સંબંધથી થાય છે તેવું સમજાય તેને જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કહે છે. જે દૃષ્ટિકોણથી અંધશ્રદ્ધા નાબુદ થાય છે અને સમાજનો પરીપક્વ વિકાસ થાય છે. સમાજના પ્રત્યેક સભ્ય વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવે એ જરૂરી છે. જે કેટલાક અંશે સિદ્ધ થયું છે. વિજ્ઞાને સમાજના આધુનિકીકરણ દ્વારા સમાજને અથાગ સેવા આપી છે. આપણા આજના વિચારો, જીવનના ઉદ્દેશ્યો, મનોરંજન, સંદેશાવ્યવહાર, જીવનમૂલ્યો, ચિકિત્સાક્ષેત્ર, મુસાફરી અને ખેતી ક્ષેત્રે વગેરે ક્ષેત્રોમાં વિજ્ઞાને તેનું પ્રભુત્વ સ્થાપિત કર્યું છે.

વિજ્ઞાનના હકારાત્મક દૃષ્ટિકોણથી સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા, ખોટા રિવાજો, પૌરાણિક મૂલ્યો, સમાજજીવન, પરિવાર નિયોજન, શિક્ષણ અંગેના ખ્યાલો, લગ્નપ્રથા વગેરે માટેની અઘતન દૃષ્ટિ વિજ્ઞાન શિક્ષણને કારણે જ બદલાઈ છે.

### (b) વિજ્ઞાન અને આર્થિક વિકાસ:

આઝાદીના કેટલાક વર્ષો સુધી ભારતે ગણનાપાત્ર વિકાસ કર્યો ન હતો. પરંતુ લગભગ નેવું ના દાયકાથી આજદિન સુધી શાળા અને ઉચ્ચ શિક્ષણમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષણનો દૃષ્ટિકોણ બદલાતા તથા તેમાં વિકાસ થતા ઘણો આર્થિક વિકાસ થયો છે. ભારત આર્થિક મહાસત્તા તરીકે ઉભરી રહેલ દેશોની ગણનામાં સામેલ થયો છે.

### (c) વિજ્ઞાન અને વાહનવ્યવહાર :

આજે સમગ્ર વિશ્વમાં માનવને એકબીજાની નજીક ઝડપી વાહનવ્યવહારે લાવવાનું કામ કર્યું છે અને તેમાં સિંહ ફાળો વિજ્ઞાન અને ટેકનોલોજીનો રહ્યો છે. અવાજની ગતિથી પણ વધુ ઝડપે ઉડતા વિમાનો શોધાયા છે અને દરિયામાં તરતા મહેલ જેવા આધુનિક કુઝે સ્થાન લીધું છે. તો ઝડપી અને આધુનિક રેલવે અને અન્ય વાહનો દ્વારા વ્યક્તિ સુખાકારી રીતે મુસાફરી કરતો થયો છે.

### (d) વિજ્ઞાન અને કૃષિ વિકાસ :

ઘણા વર્ષો પછી આપણે કૃષિ ઉત્પાદનો બાબતે સ્વાવલંબી બન્યા છે. વિજ્ઞાનની આધુનિક ટેકનોલોજીની મદદથી પાક ઉત્પાદન વધ્યું છે, વનસ્પતિ કે પાક ઉત્પાદનના રોગ પર નિયંત્રણ આવ્યા છે. કૃષિ ક્ષેત્રે યંત્રો, વિજળી, સુધારેલી જાતના બિયારણો, યોગ્ય અને સારા ખાતરો, જરૂરી સિંચાઈ યોજનાઓ, કૃત્રિમ વરસાદના પ્રયોગો, કલમ દ્વારા ગુણવત્તા સુધારણા, સંગ્રહ અને હેરફેરના પૂરતા ઝોતોને કારણે કૃષિ વિકાસમાં અનેક ચીજોની આપલે નિકાસ કરીએ છીએ. જે વિજ્ઞાનના વિકાસને કારણે શક્ય બન્યું છે.

### (e) વિજ્ઞાન અને ઔદ્યોગિક વિકાસ :

ઔદ્યોગિક ક્ષેત્રે આજે ભારત અમેરિકા, ચીન, જાપાન, રશિયા જેવા વિકસિત દેશોની હરોળમાં આવી ગયું છે. અનેક દેશોના બજારને આપણે હંફાવી રહ્યા છીએ. કમ્પ્યુટર, હાર્ડવેર અને સોફ્ટવેરમાં ભારતનું આગવું સ્થાન છે. ઘણા મોટા ઔદ્યોગિક એકમોએ વિશ્વના અનેક દેશોમાં પોતાનું જંગી રોકાણ કરી દેશને ફાયદો કરાવ્યો છે.

ઔદ્યોગિક યંત્ર સામગ્રી, આધુનિક સ્વયં સંચાલિત યંત્રો, યંત્ર માનવ, કુડ ઓઈલનું ઉત્પાદન પર આધારિત પેટ્રોકેમેકલ્સ ઉદ્યોગનો વિકાસ કરી મહા ઉદ્યોગની રચના કરેલ છે. આમ ઉદ્યોગોમાં વિજ્ઞાને જ ક્રાંતિ આણી છે.

**(f) અવકાશક્ષેત્રે વિજ્ઞાન :**

છેલ્લી સદીમાં અને વર્તમાન સદીમાં અવકાશક્ષેત્રે વિજ્ઞાનને કારણે અકલ્પનીય વિકાસ થયેલો છે. 1969 માં ચંદ્ર પર સમાનવ અવકાશયાન મોકલવામાં આવ્યું. માનવે ચંદ્ર પર પગ મૂકી વિજય સાબિત કર્યો. માનવ રહિત અવકાશ યાન મંગળ પર મોકલવામાં આવ્યા જેમાં ભારતનો પણ સિંહ ફાળો રહ્યો છે. રોકેટો, કૃત્રિમ ઉપગ્રહો, સ્પેશશટલ, અવકાશ પ્રયોગ શાળા જેવી બાબતોમાં પણ ખૂબ જ પ્રગતિ થઈ છે. કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં મોકલી તેના દ્વારા મનુષ્યે અન્ય ગ્રહો, ઉપગ્રહો તથા બીજા અવકાશી પદાર્થોનો અભ્યાસ શક્ય બનાવ્યો છે. તાજેતરમાં ભારતે અવકાશના સૌથી પણ વધુ કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં મોકલી વિશ્વમાં પોતાનો ડંકો વગાડી દીધો. આ તમામ બાબતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે શક્ય બન્યું છે.

**(g) ચિકિત્સાક્ષેત્રે વિજ્ઞાન :**

શરીરશાસ્ત્રનું રહસ્ય પામવાના વિજ્ઞાનના ઘણા પ્રયાસો સફળ નિવડ્યા છે. એક સમયના અસાધ્ય ગણાતા રોગો જેવા કે, ટી.બી., કોલેરા, ઓરી, પોલીયો જેવા રોગો સહજ સાધ્ય બની ગયા છે.

એઈડ્સ, કેન્સર જેવા રોગોની સારવાર પણ આપણા નજીકના સ્થળે વિજ્ઞાનને કારણે શક્ય બની છે. શરીરના અંગોનું પ્રત્યારોપણ અને કૃત્રિમ અંગોનું આરોપણ વિજ્ઞાનને કારણે જ શક્ય બન્યા છે.

ભારત દેશની આઝાદી સમયે લોકોનું સરેરાશ આયુષ્ય 32 વર્ષનું હતું જે 1980ના દાયકામાં 54 વર્ષ અને 2010ની સાલમાં વધીને 75 વર્ષ સુધીનું થયું છે. માનવ વિજ્ઞાનના અભ્યાસને લીધે શરીર પ્રત્યેની સભાનતા ધરાવતો થયો છે. તેમજ સામાજિક આરોગ્યનો ખ્યાલ રાખતો થયો છે. આમ, ચિકિત્સા ક્ષેત્રે વિજ્ઞાનને લીધે અશક્ય જણાતી બાબતોનો ઉકેલ શોધી શકાયો છે.

**(h) ભૌતિક સુવિધાઓમાં વિજ્ઞાન :**

વૈજ્ઞાનિક સંશોધનોએ આપણને અનેક સુવિધાઓ પુરી પાડી છે. મનુષ્યને શિયાળામાં ગરમવસ્ત્રો, હીટર, શુદ્ધ પાણી માટે RO સિસ્ટમ, અવનવા ડિઝાઈનવાળા મકાનો, ટેલીગ્રામ, તાર-ટપાલ, ટેપેરકોર્ડર, રેડિયો, ટીવી, વોર્શીંગ મશીન, ગીઝર, મિક્સર, કુકર, એરકંડીશનર, ફ્રીઝ, કમ્પ્યુટર મોબાઈલ ફોન વગેરે સુવિધાઓ મનુષ્યના જીવનમાં ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ છે. મોબાઈલ ફોન વિનાનો એક દિવસ પણ ન ચાલે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કૃત્રિમ ઉપગ્રહો દ્વારા માનવ સંદેશાવ્યવહાર ઝડપી કરી શકે છે. આમ વિજ્ઞાન સમાજનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે.

**(i) વ્યવસાયલક્ષી શિક્ષણમાં વિજ્ઞાન :**

માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને તે પછી આગળના મેડીકલ, એન્જિનિયરીંગ, કૃષિ, મેનેજમેન્ટ, ખગોળશાસ્ત્ર, અવકાશવિજ્ઞાન વગેરે જેવા વ્યવસાયલક્ષી શિક્ષણમાં વિજ્ઞાનની અવનવી પદ્ધતિ, પ્રયુક્તિ, શોધખોળો અને સંભાવનાઓ વિશેષનું શિક્ષણ આપવામાં આવે છે. આમ, વ્યવસાયલક્ષી શિક્ષણને સંપૂર્ણ સજ્જ બનાવવા માટે વિજ્ઞાન શિક્ષણનો ફાળો અગત્યનો રહ્યો છે.

આમ, વિજ્ઞાન એ આજના સમાજનું અભિન્ન અંગ બની ગયું છે. આમ છતાં જેમ વિજ્ઞાનની સુખાકારી બાજુનું આપણે મહત્વનું જોયું એ જ રીતે વિજ્ઞાનની બીજી બાજુ વિનાશકારી છે જેનો સમગ્ર વિશ્વ એ બીજા વિશ્વયુદ્ધમાં પરીચય મેળવ્યો. વિજ્ઞાનરૂપી શોધો અને સાધનોનો સાધ્યની પ્રાપ્તિ માટે ઉચિત ઉપયોગ કરવો એ જ માનવનું કાર્ય છે. શ્રેયકર્તા અને હિતકારક રીતે વિજ્ઞાનને ઉપયોગ એ માનવીના હાથની વાત છે. આધુનિક જીવનમાં વિજ્ઞાનનું સ્થાન એ માનવીની બુદ્ધિપૂર્વકની શોધ છે. તેનો બુદ્ધિપૂર્વક હકારાત્મક અને સર્જનાત્મક ઉપયોગ જ મનુષ્ય માટે હિતકારક છે.

---

**1.6 ભારતમાં વિજ્ઞાન શિક્ષણ :**

ભારતમાં શિક્ષણક્ષેત્રે નૂતન શિક્ષણની યોજનાનો આરંભ 18મી સદીના ઉત્તરાર્ધમાં થયો. 1854ના વુડના ખરીતાથી આની શરૂઆત થઈ. તે સમયે શાળાકક્ષાએ વિજ્ઞાન શિક્ષણનું યોજનાબદ્ધ રીતે સ્થાન હતું નહીં. કારણ 1857માં ભારતમાં માત્ર ત્રણ જ યુનિવર્સિટી હતી. મુંબઈ, મદ્રાસ અને

કલકત્તા. વિજ્ઞાનની શાખા મેડીકલ સાયન્સ અને સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસક્રમો તેમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. વિજ્ઞાનના મોટાભાગના વિષયોનું અધ્યાપન વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા થતું હતું. પ્રયોગશાળામાં પૂરતા સાધનો પણ ન હતા.

19 મી સદીની શરૂઆતમાં શાળા કક્ષાએ વિજ્ઞાન શિક્ષણનું આગમન થયું. જો કે ત્યારે શાળાકક્ષાએ વિજ્ઞાન વિષય ફરજિયાત ન હતો. શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હતું. 1937માં વિજ્ઞાન શિક્ષણ માતૃભાષામાં આપવાનું શરૂ થયું સાથો સાથ તેના પરીક્ષણની જોગવાઈ પણ થઈ. પરંતુ યોગ્ય આયોજનના અભાવે જોઈએ તેટલો વિજ્ઞાન શિક્ષણનો વિકાસ થયો ન હતો.

1950થી એસ.એસ.સી. એકઝામિનેશન બોર્ડ દ્વારા સામાન્ય વિજ્ઞાનને અભ્યાસક્રમ સ્થાન મળ્યું. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, શરીર વિજ્ઞાન, આરોગ્યશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્રના કેટલાક સંકલિત અભ્યાસક્રમના વિષયો સામાન્ય વિજ્ઞાનમાં સમાવેશ થતો હતો. પાઠ્યપુસ્તકો માતૃભાષામાં હતા પણ પ્રયોગશાળા સમૃદ્ધ ન હતી. 1955થી જૂના મુંબઈ રાજ્યનો પાઠ્યક્રમ લગભગ દોઢ દાયકા સુધી કશા જ સુધારા વિના ચાલ્યો. આ અભ્યાસક્રમમાં સુધારણાની જોગવાઈ 1970 થી શરૂ થઈ. 1970ના ધોરણ પાંચના નવીન પાઠ્યક્રમને અનુસરી ને 1973, 1974 અને 1975માં ક્રમશઃ ધોરણ 8, 9 અને 10માં વિજ્ઞાનનો નવીન પાઠ્યક્રમ આવ્યો.

1970 પછી જેમ જેમ વિજ્ઞાન પાઠ્યક્રમનો સુધારા દાખલ થયા તેમ તેમ વિજ્ઞાનના નવા અભ્યાસક્રમોથી શિક્ષક પરિચિત થાય તે અર્થે ગુજરાત રાજ્યના રાજ્ય શિક્ષણ ભવન દ્વારા NCERT ના સહયોગથી કેટલાક સેમિનારો , ચર્ચાઓ અને વર્કશોપ શરૂ થયા. વિજ્ઞાનનું શિક્ષણ કાર્ય કરતા શિક્ષકો માટે આ જ સમયગાળા દરમિયાન સેવાકાલિન તાલીમવર્ગોની જોગવાઈ શરૂ થઈ . NCERT દ્વારા વિજ્ઞાન શિક્ષણ માટેની આવશ્યક સાધન સહાય શાળાઓને આપવાની શરૂ થઈ. દેશના મોટા ભાગની શિક્ષક-પ્રશિક્ષણ આપતી સંસ્થાઓમાં વિજ્ઞાન શિક્ષણને અનુલક્ષીને પ્રાથમિક કક્ષાના પ્રત્યેક ધોરણને અનુરૂપ સાધનોની કીટ્સ આપી, જેનો કેટલીક પ્રશિક્ષણ કોલેજોએ બહોળો ઉપયોગ તાલીમ માટે કર્યો તો કેટલીક કોલેજોએ આ સાધનોનો ગ્રામ્ય વિસ્તારની શાળાઓને ફાળવ્યા. સાથે સાથે વિજ્ઞાન શિક્ષક હાથપોથી અને કાર્યપોથીની શરૂઆત થઈ. 1976ના જૂનથી અમલી બને તે રીતે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના ક્ષેત્રે ધોરણ - 11 અને ધોરણ - 12 ના વર્ગોની ગુજરાત રાજ્ય એ શરૂઆત કરી. શરૂઆતના સમયમાં (વર્ષોમાં) પ્રયોગશાળામાં સાધનો અપૂરતા રહ્યા. પરંતુ બહુજ ઝડપથી આ કક્ષાની શાળાઓ આ ક્ષેત્રે સમૃદ્ધ થઈ. ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણવિજ્ઞાન જીવવિજ્ઞાન એમ પ્રત્યેક શાખાઓનું મહત્ત્વ સ્વીકારાયું અને શાખાને અનુરૂપ વિજ્ઞાન પ્રયોગશાળા પણ શરૂ થઈ. ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક કક્ષાના ધોરણ 11 અને ધોરણ - 12ના વર્ગો શાળા કક્ષાએ જ અપાયા પરિણામે શાળાઓનું વાતાવરણ વિજ્ઞાન શિક્ષણની જરૂરિયાત અને તદ્દનુરૂપ સમૃદ્ધિને સ્વીકારતું થયું.

રાજ્ય કક્ષાએ તેમજ કેન્દ્ર કક્ષાએ વૈજ્ઞાનિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના પ્રયાસો થયા. જિલ્લાકક્ષા, રાજ્યકક્ષા, રાષ્ટ્રકક્ષાએ વિજ્ઞાન મેળા યોજાવા શરૂ થયા. આ વિજ્ઞાન મેળાઓના કાર્યક્રમોએ તેમજ ખાનગી સાહસ દ્વારા ચાલતા વિજ્ઞાનકેન્દ્રોએ વિજ્ઞાન શિક્ષણને સમૃદ્ધ કર્યું.

વિજ્ઞાન શિક્ષણની શરૂઆત જેટલી ધીમી અને બેદરકારી ભરી હતી તેનાથી તદ્દન વિપરિત પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામી છે. પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધી વિજ્ઞાન અને તેની અનેક શાખાઓને સ્વીકૃતિ મળી છે. શાળા કક્ષાએ પૂરતા પાઠ્યપુસ્તક, સંદર્ભ સાહિત્ય, જરૂરી સાધનો છે. દેશમાં અનેક ઉચ્ચકક્ષાની વિજ્ઞાન ભણાવતી અને તેની સાથે તેની પેટાશાખા તથા ટેકનોલોજીનો અભ્યાસ કરાવતી સંસ્થાઓ છે. વિજ્ઞાનના જ્ઞાનને કારણે યુવા વિદ્યાર્થીઓ અનેક સર્જનાત્મક શોધખોળ પ્રત્યે આકર્ષાયા છે.

વિજ્ઞાનની કેળવણી વિષયક કરાઈ રહેલા વિકાસને કારણે સામાન્ય પ્રજાજન માટે પણ આજે વિજ્ઞાનનું સામાન્ય જ્ઞાન મેળવવાનું અનિવાર્ય થઈ પડ્યું છે. ભારતમાં આજે પણ વિજ્ઞાન શિક્ષણના વિકાસ માટે અથાગ પ્રયત્નો ચાલુ છે. આ સતત પ્રયાસોને કારણે નીચે મુજબ લાભો પ્રાપ્ત થયા છે.

- (1) વૈજ્ઞાનિક સંશોધનોને વેગ મળ્યો છે.
- (2) વિજ્ઞાનની નૂતન ક્ષિતિજો તરફના વિશ્વના ડગમાં ભારત પણ પોતાનો સાથ પૂરી શક્યો છે.
- (3) રાષ્ટ્રીય વિકાસના ધ્યેયો સિદ્ધ કરવા વિજ્ઞાન મદદરૂપ થઈ રહ્યું છે. માનવીય સાધનોના અદ્યતનીકરણ, ઉત્પાદન વૃદ્ધિ, રાષ્ટ્રીય ઐક્યની ભાવના, પરંપરાગત સમાજનું અદ્યતનીકરણ વૈજ્ઞાનિક વિચારસરણીમાં ખીલવણી વગેરેમાં વિજ્ઞાન મદદરૂપ થઈ રહ્યું છે.
- (4) માનવધન વિજ્ઞાન કેળવણી પ્રાપ્ત કરી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવી રહ્યું છે. પરિણામે તેના કાર્યમાં વ્યવસાયમાં અને જીવનરીતિમાં વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ કેળવાયેલું જોવા મળે છે.
- (5) વિજ્ઞાન સાથે જોડાયેલી અનેક શાળા અને શાસ્ત્રોને પૂરતું ઉત્તેજન મળે છે. પરિણામે તેઓની વચ્ચેનું સંકલન અને તલસ્પર્શી અભ્યાસ માનવજીવનને અનેક ઊંચાઈ તરફ લઈ ગયું છે અને ભવિષ્યમાં આગળ લઈ જશે.

## 1.7 વિજ્ઞાન શિક્ષકના કૌશલ્યો :

### પ્રસ્તાવના :

કોઠારી કમિશનના રિપોર્ટમાં શિક્ષક વિશે જે કહેવામાં આવ્યું છે તે વિજ્ઞાન શિક્ષકને પણ એટલું જ લાગુ પડે છે.

“શિક્ષણની ગુણવત્તા અને શિક્ષણના રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન પર જે વિવિધ પરીબળો અસર કરે છે તે બધામાં નિઃશંક શિક્ષકની ગુણવત્તા, કાબેલિયત અને ચારિત્ર્ય એ સૌથી વધારે મહત્ત્વ ધરાવે છે.”

- કોઠારી શિક્ષણ

### પંચ

ઉપરોક્ત વાક્યને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે શાળામાં એક સારા વિજ્ઞાન શિક્ષકની આવશ્યકતા અનિવાર્ય છે. આજે એન્જિનિયરીંગ, મેડિકલ, કૃષિ, અવકાશ વગેરે વિવિધ ક્ષેત્રોમાં વિજ્ઞાન સંબંધી શોધખોળોએ એક નવું જ પરિવર્તન લાવી દીધું છે. આપણી સંસ્કૃતિના વિકાસમાં વૈજ્ઞાનિક સંશોધનોનો મોટો ફાળો છે.

સારો વિજ્ઞાન શિક્ષક વૈજ્ઞાનિક ક્રાંતિનો પ્રેરણાદાતા છે તે અધ્યેતાઓમાં વિજ્ઞાન પ્રત્યે સાચી શ્રદ્ધા ઉત્પન્ન કરી શકે છે.

એટલું જ નહીં પરંતુ તેમને વાસ્તવિક રીતે વૈજ્ઞાનિક સંસ્કૃતિનો પરિચય પણ કરાવી શકે છે. આજના વિજ્ઞાન યુગમાં તો વિજ્ઞાન શિક્ષકનું વિશિષ્ટ સ્થાન છે. કારણકે દેશના વિકાસમાં વિજ્ઞાનનો ફાળો મહત્તમ છે. તેથી જો વિજ્ઞાન શિક્ષકો યોગ્ય હશે તો આ વિકાસ તેની આગેકુચ જાળવી શકશે.

### ◆ વિજ્ઞાન શિક્ષકના કૌશલ્યો :

વિજ્ઞાન શિક્ષકના કૌશલ્યો આપણે ત્રણ વિભાગમાં અભ્યાસ કરીશું.

#### (A) શૈક્ષણિક લાયકાત :

- (1) માધ્યમિક વિભાગ માટે વિજ્ઞાન શિક્ષક થવા માટે શિક્ષક પાસે વિજ્ઞાનના વિષયમાં સ્નાતક (B.Sc.) હોવો જોઈએ. તથા શિક્ષણ વિદ્યાશાખાનો સ્નાતક (B.Ed.) પણ હોવો જોઈએ.
- (2) ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક થવા માટે વિજ્ઞાન શિક્ષક સ્નાતક કક્ષાએ જે વિજ્ઞાનની શાખા પસંદ કરી હોય તેમાં અનુસ્નાતક (M.Sc.) ની ઉપાધિ ધરાવતો હોવો જોઈએ. ઉપરાંત તેણે શિક્ષણ વિદ્યાશાખાના સ્નાતકની ઉપાધી (B.Ed) પણ પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.
- (3) વિજ્ઞાન શિક્ષકે ધોરણ 6થી 8 ઉચ્ચ પ્રાથમિક શાળા કક્ષાએ શિક્ષક થવા માટે ગુજરાત રાજ્ય સરકારના વખતોવખતના નિયમ અનુસાર TET - 2 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. માધ્યમિક શાળામાં વિજ્ઞાન શિક્ષક તરીકે જોડવા TAT (S) અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિજ્ઞાન શિક્ષક તરીકે જોડવા TAT(HS) પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

ટૂંકમાં B.Sc. + B.Ed. + TET/TAT (S)

M.Sc., + B.Ed. + TET / TAT (HS)

**(B) વિષયનું જ્ઞાન:**

વિજ્ઞાન શિક્ષકમાં પોતાના વિજ્ઞાન વિષયનું ઊંડું અને તલસ્પર્શી જ્ઞાન હોવું અતિ આવશ્યક છે. માધ્યમિક કક્ષાએ વિજ્ઞાન શિક્ષક તરીકે જોડાનાર શિક્ષક પાસે રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાન દરેક શાખાનું હોવું અતિ આવશ્યક છે. કારણ કે તેણે તમામ વિષયો ત્યાં શીખવવાના થાય છે. ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ કોઈપણ વિજ્ઞાનની પેટાશાખા રસાયણશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન કે જીવવિજ્ઞાનના શિક્ષક તરીકે જોડાય તો તેને જે - તે વિજ્ઞાનનું તલસ્પર્શી અને ઊંડું જ્ઞાન, સમજ હોવી અતિ આવશ્યક છે. જરૂર પડે શિક્ષકે તેની સજ્જતા માટે યોજાતા ગ્રીષ્મવર્ગો, તાલીમવર્ગો, પરિસંવાદ, સેમિનાર કાર્યશિબિર, ટૂંકાગાળાના તાલીમ વર્ગ, અભ્યાસ કે ચિંતનશિબિર વગેરેમાં જોડાઈ પોતાના વિષયમાં પારંગત થવાના પ્રયાસો હાથ ધરવા. ઉપરાંત તેણે વિજ્ઞાન શિક્ષણ અંગેની છેલ્લામાં છેલ્લી માહિતી, ખ્યાલ, અધ્યાપન પદ્ધતિ તથા વર્તમાન ઘટનાઓથી જ્ઞાત થઈ જવું જોઈએ.

આમ વિજ્ઞાન શિક્ષકે સતત પોતાની જ્ઞાન સમૃદ્ધિમાં ઉમેરો કરતા રહેવું જોઈએ અને તેનો લાભ પોતાના અધ્યેતાઓને આપવો જોઈએ.

**(C) અન્ય કૌશલ્યો :**

શૈક્ષણિક લાયકાત ઉપરાંત વિજ્ઞાન શિક્ષકના અન્ય કૌશલ્યો નીચે મુજબ છે.

**સ્વભાવ :** વિજ્ઞાન શિક્ષક હસમુખો, રમૂજી સ્વભાવનો અને મિલનસાર હોવો જોઈએ. જેથી અધ્યેતાને અઘરા લાગતા વિજ્ઞાનના મુદ્દાઓને રસપ્રદ બનાવી સ્પષ્ટ કરી શકે. વિજ્ઞાનના કેટલાક સ્પષ્ટીકરણ ધરાવતા મુદ્દાઓને જ્ઞાન સાથે ગમ્મતને જોડી હળવાકુલ બનાવી દે એવો સ્વભાવ ધરાવતો હોવો જોઈએ.

**રીત ભાત :** વિજ્ઞાન શિક્ષકની રીતભાત આદર્શ અને વિનય વિવેકપૂર્ણ હોવી જોઈએ. અધ્યેતાને ક્યારેય ઉતારી ન પાડે પરંતુ તેની સાથે સહાનુભૂતિ પૂર્ણ વર્તાવ રાખે તેવો હોવો જોઈએ.

**શિક્ષક વ્યવસાયમાં રસ :** તેણે શિક્ષક વ્યવસાય શોખથી સ્વીકરેલો હોવો જોઈએ. તે ફક્ત પાઠ્યપુસ્તક પર આધારિત ન રહેતા સંદર્ભ પુસ્તકો, સામયિકો, વિજ્ઞાન સમાચારો, વિજ્ઞાનનાં અદ્યતન સંશોધનો વગેરેથી સતત માહિતગાર રહી પોતાના અધ્યેતાઓમાં પણ વાંચનનો શોખ કેળવી શકતો હોવો જોઈએ. પ્રયોગો કરાવવા તે હમેશાં તત્પર રહેવો જોઈએ.

**ગુણ :** તેને પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠા હોવી જોઈએ. વિજ્ઞાન શિક્ષકમાં ખંત, ધીરજ, ઉત્સાહ, ચપળતા, ઝીણવટપૂર્વક કામ કરવાની ટેવ, તીવ્ર અવલોકનશક્તિ, સ્વચ્છતા, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, નિષ્પક્ષતા વગેરે ગુણો જરૂરી છે. વિજ્ઞાન શિક્ષકમાં લોકમાનસમાંથી વહેમો, અંધશ્રદ્ધા દૂર કરી તેમને કાર્યકારણના સંબંધો સમજાવી તેમના મનનું સમાધાન કરી શકવાની ક્ષમતા હોવી જોઈએ.

**બહિર્મુખતા :** વિજ્ઞાનનો શિક્ષક બહિર્મુખ વ્યક્તિત્વ ધરાવતો હોવો જોઈએ તો જ તે વિદ્યાર્થી સાથે તન્મયતા સાધી શકે અને વિદ્યાર્થીને ન સમજાતા અટપટા પ્રશ્નોનું સમાધાન કરી શકે. વિદ્યાર્થીમાં વિજ્ઞાનવાંચન, વિજ્ઞાનમંડળ, વિજ્ઞાનમેળા, વિજ્ઞાન પ્રદર્શન વગેરેનો શોખ પોતાના સ્વભાવથી જ કેળવી શકે. તે એક આદર્શ શિક્ષકનો નમૂનો પૂરો પાડી શકે તેવો હોવો જોઈએ.

**સ્વાશ્રય :** વિજ્ઞાન શિક્ષકને ઘણી બધી બાબતો જાતે કરી લેવાની ધગશ હોવી જોઈએ. આ માટે બાગાયત, સુથારીકામ, લુહારીકામ, વિદ્યુત અને તેના સાધનો વગેરે અંગેનું વ્યાવહારુ જ્ઞાન તેણે પ્રાપ્ત કરેલ હોવું જોઈએ.

**અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં રસ :** શિક્ષણની સહાયક પ્રવૃત્તિ જેવી કે વિજ્ઞાન મંડળ, ચલાવવા, વિજ્ઞાન અંગેના પરિસંવાદો અને પ્રવચનો ગોઠવવા, વિજ્ઞાનમેળા ભરવા, વિજ્ઞાન પ્રદર્શન યોજવા વગેરે જેવી અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં શિક્ષકને રસ હોવો જોઈએ.

**વિષયની આંતરિક સુઝ :** વિજ્ઞાન શિક્ષકમાં વિષયની આંતરિક સુઝ હોવી જોઈએ. જેથી તે પોતાના વિષયની આંટીઘુંટી સમજી શકે. અને અઘરા મુદ્દા પણ સરળતાથી સમજી શકે અને અઘરા મુદ્દા પણ સરળતાથી સમજી શકે અને અધ્યેતાઓને યોગ્ય માર્ગે દોરી શકે.

**સંશોધનવૃત્તિ :** વિજ્ઞાનના શિક્ષકમાં અન્ય શિક્ષકોની તુલનામાં સંશોધનવૃત્તિ વધારે હોય છે. વિજ્ઞાન શિક્ષકો આ સંશોધનવૃત્તિનો ઉપયોગ વિજ્ઞાન શીખવાની પદ્ધતિઓ અંગેના સંશોધનમાં અને વિજ્ઞાનમાં સંશોધનાત્મક પ્રોજેક્ટ હાથ ધરવામાં કરવો જોઈએ.

**પુસ્તકાલય સભાનતા :** વિજ્ઞાન પુસ્તકાલય અથવા પુસ્તકાલયમાં વિજ્ઞાનના પુસ્તકો વિશે વિજ્ઞાન શિક્ષક સભાન હોવો જોઈએ. તે અવનવા વિજ્ઞાનના પુસ્તકોના વાંચનનો શોખીન હોવો જોઈએ તથા પુસ્તકાલયમાં વિજ્ઞાન વિષયના પુસ્તકો વસાવે તેવો દૃષ્ટિકોણ ધરાવતો હોવો જોઈએ. વિદ્યાર્થીને તે વાંચન માટે પ્રોત્સાહિત કરે તેવો હોવો જોઈએ.

**દૃશ્ય શ્રાવ્ય સાધનોના ઉપયોગમાં કુશળતા :** વિજ્ઞાનના શિક્ષકને સામાન્ય રીતે દૃશ્ય, શ્રાવ્ય અને દૃશ્ય-શ્રાવ્ય સાધનો અંગે પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ. તે પ્રોજેક્ટર, ટીવી, કમ્પ્યુટર, ચાર્ટ, ચિત્રો, નકશા, મોડેલ વગેરે જેવા સાધનોના ઉપયોગ અંગે કુશળતા ધરાવતો હોવો જોઈએ ઉપરાંત નાની મોટી તેમાં આવતી ખામી શોધી તેને દૂર કરી શકવા સક્ષમ હોવો જોઈએ.

**શૈક્ષણિક કૌશલ્યમાં નિપૂણતા :** વિજ્ઞાન શિક્ષકમાં વિષયાવિમુખ, પ્રશ્નપ્રવાહિતા, કા.પા.કાર્ય, ઉદાહરણ કૌશલ્ય, સ્પષ્ટીકરણ, સુદૃઢીકરણ, પ્રશ્નઉંડાણ, કૌશલ્ય, ઉત્તેજના પરીવર્તન જેવા મુખ્ય શૈક્ષણિક કૌશલ્ય અંગેનું પૂરું જ્ઞાન તથા તેના સમાયોજનની પુરી માહિતી હોવી જોઈએ.

**સર્જનાત્મકતા :** વિજ્ઞાન શિક્ષકમાં સર્જનાત્મકતાનો ગુણ હોવો જોઈએ. જેથી ચાર્ટ્સ, ચિત્રો, મોડેલ્સ, આકૃતિઓ વગેરે તૈયાર કરવામાં તેમજ હસ્તે બનવાના સાધનો સર્જવામાં તેની સર્જનાત્મકતાનો ઉપયોગ થઈ શકે. જુદા જુદા વિજ્ઞાન વિષયક પ્રોજેક્ટ વિચારી અને તેને અમલી બનાવી શકે તેવો હોવો જોઈએ. પોતાના અધ્યેતામાં સર્જનશક્તિ વિકસાવી શકે તેવા ગુણો / કૌશલ્ય વિજ્ઞાન શિક્ષકમાં હોવી જોઈએ.

**ઉપસંહાર :** વિજ્ઞાન શિક્ષક ભલે સર્વગુણ સંપન્ન હોય, પરંતુ તેનામાં પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠા ન હોય, વર્ગ સમક્ષ ઊભા રહેવાની ક્ષમતા ન હોય, નિયમિતતા ન હોય, અને તેના વિદ્યાર્થીઓ પાંગળા બની જાય છે. પોતાના વ્યવસાયમાં તે નિષ્ફળતાને વરે છે. ખરેખર શિક્ષક પોતાના વર્તન અને કાર્યના કારણે અધ્યેતામાં કેવા વર્તન પરિવર્તન લાવી શકે છે. તેના આધારે વિજ્ઞાન શિક્ષકની સફળતાનું માપન થાય છે.

આમ સફળ વિજ્ઞાન શિક્ષકના કૌશલ્યમાં અધ્યાપનકાર્ય અને અભ્યાસેત્તર પ્રવૃત્તિ દ્વારા શાળાને ધમધમતી રાખવી, અણીશુદ્ધ, નિર્મણ ચારિત્ર્ય, નિતિમતતા જાળવવી, નમ્રતા, વિવેક અને પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠા બનાવવી તથા અધ્યેતાઓમાં સર્વદેશીય વિકાસને પ્રોત્સાહિત કરવા તત્પરતા દાખવવી એનો સમાવેશ થાય છે.

## 1.8 ભારતીય અને પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોનું વિજ્ઞાનમાં પ્રદાન :

### ◆ પ્રસ્તાવના :

એકવીસમી સદી એટલે જ્ઞાન-વિજ્ઞાનનો યુગ, ટેકનોલોજીનો યુગ, સુખ - એશ - આરામનો યુગ, કમ્પ્યુટર તથા ઇન્ટરનેટનો યુગ અને વિજ્ઞાનનો યુગ. આજે માનવ જે વિચારે તે કરી શકે છે, ધારે તેમાં કાર્ય પાર પાડી શકે છે. અને તે પણ સરળતાથી આ વાત વિશે વર્ષો પહેલા વિચારવું એ પણ અઘરુ કાર્ય હતું. આદિમાનવથી આજનો કહેવાતો આધુનિક માનવ સુધી સંસારમાં થયેલા પરિવર્તનો માનવીની જરૂરિયાતને જ આભારી છે.

માનવની જરૂરિયાત, તર્ક, વિચારશક્તિ, મહેનત અને અથાગ પરીશ્રમનું પરીણામ આજનો આધુનિક માનવ સુખ અને આરામના સ્વરૂપે ભોગવી રહ્યો છે. અને આ સર્વે આજના વિજ્ઞાન યુગને આભારી છે.

આજનો વિજ્ઞાનયુગ આજ સુધીના તમામ વૈજ્ઞાનિકોને આભારી છે. આ વૈજ્ઞાનિકોની શોધ, અભિગમ, તર્ક, વિચારશક્તિ, સંશોધનવૃત્તિ, જીજ્ઞાસા, અવિરત જ્ઞાન મીમાંસા અને સંસારને કંઈક નવીનતમ ભેટ આપવાની વૃત્તિને લીધે આજે જીવન આરામદાયી બન્યું છે. આ વૈજ્ઞાનિકોમાં આઈનસ્ટાઈન, જગદીશચંદ્ર બોઝ, મેડમ ક્યુરી, થોમસ આલ્વા એડીસન, ડૉ. વિક્રમ સારાભાઈ, રોજન્ટ ગેલેલીયો, ફેરડે, ડાર્વિન, પાર્થર, ગ્રેહામબેલ, આર્કીમિડીઝ, ન્યુટન, રૂથરફોર્ડ, નિલ બોહર, થોમસન, અબ્દુલ કલામ વગેરેના નામો મુકી શકાય.



પ્રસ્તુત પ્રકરણમાં આપલે બે ભારતીય વૈજ્ઞાનિકોનું વિજ્ઞાનમાં પ્રદાન (1) ડૉ. વિક્રમ સારાભાઈ (2) ડૉ. જગદીશચંદ્ર બોઝ અને બે પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોનું વિજ્ઞાનમાં પ્રદાન (1) આલ્બર્ટ આઈન્સ્ટાઈન (2) થોમસ આલ્વા એડિસન એમ કુલ ચાર વૈજ્ઞાનિકોની ચર્ચા કરીશું.

### (1) ડૉ. વિક્રમ સારાભાઈ :

અંતરિક્ષ સંશોધન કરી બ્રહ્માંડમાં પોતાના અસ્તિત્વની છાપ સ્થાપિત કરનારા મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં થયો હતો. તેમના પિતા શેઠશ્રી અંબાલાલ સારાભાઈ અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ હતા. તેમની માતાનું નામ સરલાદેવી હતું સરલાદેવી એક સંનિષ્ઠ અને પ્રગતિશીલ સમાજસેવિકા હતા.

**શિક્ષણ :** વિક્રમસારાભાઈના કુટુંબમાં એમના સહિત આઠ-ભાઈ બહેનો હતા. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ખાનગી શાળામાં થયું હતું. વિક્રમ સારાભાઈ મેઘાવી અને કુતુહલવૃત્તિ ધરાવતા હતા. તેમને ગણિત, ભૌતિક વિજ્ઞાન અને વિજ્ઞાનમાં રસ હતો પરંતુ સૌથી વધારે રસ તેઓ ભૌતિક વિજ્ઞાનમાં ધરાવતા હતા. 1937માં ઈન્ટર સાયન્સ પાસ કરી તેઓએ કેમ્બ્રિજ સેન્ટ જહોન કોલેજમાં પ્રવેશ મેળવ્યો. 1940માં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન અને ગણિત વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી.



**કાર્ય :** કોસ્મિક કિરણોના સંશોધન કાર્યને કારણે તેમણે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સંબંધો, આંતરગ્રહીન અવકાશ અને ભૂ-ચુંબકત્વ પ્રત્યેના રસ અને જિજ્ઞાસા વધવા લાગી તેમણે Time Distribution of Cosmic Rays પર સંશોધન લેખ પ્રસિદ્ધ કર્યો.

- તેઓ એ યુરેનિયમ શુક, ના ફોટો વિભાજન માટે આડછેદનું ચોક્કસ માપન કરવાનું કાર્ય હાથ ધર્યું.

- તેમણે કિરણ માપકની મદદથી બ્રહ્માંડ - કિરણોની ઉત્પત્તિનું રહસ્ય શોધી કાઢવા માટે મથામણ કરવાની શરૂઆત કરી. તેઓએ બ્રહ્માંડ - કિરણોની તીવ્રતા અને તેમની દિશા અને સમય સાથે માપવાનો પ્રયાસ શરૂ કર્યો. આ કાર્ય માટે તેમણે કાશ્મીરના ગુલમર્ગ પાસે 3962 મીટરની ઊંચાઈવાળા શિખર પર 1943માં બ્રહ્માંડ કિરણોની તીવ્રતાનું માપન કર્યું. આ સંશોધનમાં તેમણે બ્રહ્માંડમાં કિરણોની તીવ્રતામાં થતા ફેરફારોની જાણકારી મેળવી લેખ પ્રસિદ્ધ કર્યો.
- વિક્રમ સારાભાઈએ અનેક મહત્વની સંસ્થાઓ સ્થાપી અને ભારતને વિકસિત રાષ્ટ્રોની શ્રેણીમાં લાવવાના અનેક પ્રયાસો કર્યો.
- 1950 થી 1966ના સમયગાળા દરમિયાન વડોદરાનાં સારાભાઈ કેમિકલ્સ, સારાભાઈ ગ્લાસ વર્ક્સ, સિમ્બાયોટિક લિમિટેડ, સારાભાઈ એન્જિનિયરીંગ ગ્રુપ, સુહદ ગાયત્રી લિમિટેડ, સારાભાઈ વર્ક લિમિટેડ વગેરે ઉદ્યોગો સ્થાપ્યા.
- ઈ.સ. 1957માં તેમણે અમદાવાદ મેનેજમેન્ટ એશોસિયેશન (AMA) અને 1960માં વડોદરાના સારાભાઈ રિસર્ચ સેન્ટર અને ઓપરેશન રિસર્ચ ગ્રુપ (ORG) ની સ્થાપના કરી.

બ્રહ્માંડમાં કિરણોની તીવ્રતા માટે પ્રયોગો ખીણોમાં, દરિયાની સપાટીની ઊંચાઈએ તથા પર્વતો પર કરવામાં આવે છે. આ માટે તેઓએ કશ્મીરમાં ગુલમર્ગ, માઉન્ટ આબુ અને ઉદેપુરમાં સૌર પ્રયોગશાળા અને દક્ષિણમાં તેના પેટા મથકો ઉભા કરવામાં આવ્યા.

વિક્રમ સારાભાઈને પોતાના અનુભવને આધારે અનુભવી વ્યક્તિઓની જરૂર જણાતા IIMની સ્થાપના કરવામાં આવી.

ગણિત, ભૌતિક જૈવ, રસાયણ વિજ્ઞાનના પાસાના ખ્યાલોની સમજૂતી આપી દરેક વ્યક્તિને પ્રોત્સાહન, પૂરૂ પાડે અને તેઓને મદદ કરે ઉપરાંત તેમણે અમદાવાદમાં કમ્પ્યુનિટી સાયન્સ સેન્ટરની સ્થાપના કરી.

**સિદ્ધિઓ :** વિક્રમ સારાભાઈની અંતરિક્ષ-ક્ષેત્રે ઉપલબ્ધિએ તેમને આંતરરાષ્ટ્રીય મોભો અપાવ્યો

અને “Cosmic Ray Commission” ના સભ્ય બન્યા. 1969માં પરમાણુ ઊર્જા વિભાગ અંતર્ગત ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના તેઓ અધ્યક્ષ બન્યા. તેમણે દેશમાં અવકાશ સંશોધન માટે 20 જેટલી સંસ્થાઓ સ્થાપિત કરી તેઓ અવકાશયુગના જનક બન્યા. ત્યારબાદ ત્રિવેન્દ્રમમાં આવેલી ઉપગ્રહ પ્રણાલી વિભાગ (Satellite System Division - SSD) ને વિક્રમ સારાભાઈ અવકાશ સંશોધન કેન્દ્ર (VSSC) નામ આપવામાં આવ્યું. પરમાણુ ઊર્જા પંચના અધ્યક્ષ ડૉ. હોમીભાભાનું આકસ્મિક નિધન થયું. ડૉ. ભાભાના નિધન બાદ પરમાણુ ઊર્જા પંચના અધ્યક્ષ પદ પર વિક્રમ સારાભાઈને બિરાજમાન કરવામાં આવ્યા. આ પદ પર ફરજ બજાવતા તેમણે 40 પેટા કેન્દ્રો અને જુદી જુદી સંસ્થાની સ્થાપના કરી.

વિક્રમ સારાભાઈને ઈ.સ 1962માં ભૌતિકવિજ્ઞાન ક્ષેત્રે ઉત્તમ વૈજ્ઞાનિક સેવાઓ માટે ડૉ. શાંતિ સ્વરૂપ ભટનાગર સ્મૃતિ પુરસ્કાર આપવામાં આવ્યો. આ ઉપરાંત 1966માં ભારત સરકાર દ્વારા ‘પદ્મ ભૂષણ’ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને 1972માં મરણોપરાંત સરકાર દ્વારા તેમને ‘પદ્મવિભૂષણ’ની ઉપાધીથી નવાજિત કર્યા.

1961-62 સમય દરમિયાન ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં તેઓએ ભૌતિક વિજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ઈ.સ. 1968માં સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા (UNO) ની કોન્ફરન્સમાં ઉપપ્રમુખ અને અધ્યક્ષપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આમ, ડૉ. વિક્રમ સારાભાઈ એક કર્મનિષ્ઠ અને પ્રતિબદ્ધ વૈજ્ઞાનિક હતા. ડૉ. અબ્દુલ કલામ તેઓને પોતાના ગુરુ માનતા ડૉ. વિક્રમ સારાભાઈ એ આ જીવન વિજ્ઞાનની અવિરત સેવા કરી ભારત દેશને સિદ્ધિના શીખરો તરફ લઈ જવા મોટું યોગદાન આપેલ છે.

## (2) સર જગદીશચંદ્ર બોઝ :

### ◆ પ્રસ્તાવના :

વનસ્પતિની સંવેદનશીલતાના શોધક ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝનો જન્મ 30 મી નવેમ્બર, 1858માં બંગાળના મેમનસિંગ જિલ્લામાં થયો હતો. જે હાલ બાંગ્લાદેશમાં આવેલ છે. તેમના પિતા ભગવાનચંદ્ર બોઝ ફરીદપુર જિલ્લાના ડેપ્યુટી મેજિસ્ટ્રેટ હતા. શ્રી બોઝનું બાળપણ ભારતીય પરંપરા અને સંસ્કૃતિમાં થયું તેઓ માનતા કે સાચા વિજયનો જન્મ પરાજયમાંથી થાય છે.

**શિક્ષણ :** કલકત્તાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. પ્રારંભિક કોલેજ શિક્ષણ પણ કલકત્તામાં જ મેળવ્યું. ત્યારબાદ 1879 માં બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસ.સી.ની ઉપાધી લંડન યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી. ડોક્ટરની ઉપાધી મેળવવા માટે તેઓ ઈંગ્લેન્ડ ગયા ત્યાં તેમની મુલાકાત પ્રખર ભૌતિક વૈજ્ઞાનિક લોર્ડ રેલેની સાથે થઈ. તેનાથી પ્રભાવિત થઈ જગદીશચંદ્ર બોઝ મેડેસીન ક્ષેત્રનો ત્યાગ કરી ભૌતિક વિજ્ઞાન તરફ વળ્યા અને કેમ્બ્રિજની કાઈસ્ટ ચર્ચ કોલેજમાં તેઓએ પ્રવેશ મેળવ્યો અને અંતે લંડન યુનિવર્સિટીમાંથી ડી.એસ.સી.ની ડીગ્રી પ્રાપ્ત કરી.



**નોકરી અને કાર્ય :** લંડન યુનિવર્સિટીમાંથી ડી.એસ.સી. ની ડીગ્રી મેળવ્યા બાદ તેઓ કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં ભૌતિક વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકેનો કાર્યભાર સંભાળ્યો. અહીંયા 1915 સુધી આ પદ પર કાર્ય કર્યું. આવા ઊંચા પદ પર કાર્યકરનાર તેઓ પ્રથમ ભારતીય હતા. પ્રેસિડેન્સી કોલેજમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે 1937 સુધી નિયામક તરીકે કાર્ય કર્યું.

શ્રી જગદીશચંદ્ર બોઝે દ્વિ-વકીભવન પર સંશોધન હાથ ધર્યું. તેણે સંશોધનમાં જણાવ્યું કે, કોઈ સ્ફટિકમાંથી પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે તેમાંથી પસાર થતા કિરણો પોતાનો માર્ગ બદલી નાખે છે. કેટલાક સ્ફટિકો બે વકીભૂત કિરણો હોવાનું જણાવ્યું. અને આ પ્રમાણે બનતી ઘટનાને તેણે દ્વિ-વકીભવન કહ્યું “જર્નલ ઓફ એશિયાટીક સોસાયટી ઓફ બંગાળમાં તેના દ્વિ-વકીભવન પરનાં સંશોધન પેપર પ્રકાશિત કરવામાં આવ્યા.”

તેમણે વિદ્યુત વિકિરણોનો પણ ઊંડો અભ્યાસ કરી નિયમો સ્થાપિત કર્યા. તેમણે “કોરિહર” તંત્રની શોધ કરી કે જે બિન તારી સંદેશા વ્યવહારમાં કામ લાગતા હતા. આ સંશોધન 27 એપ્રિલ 1899 ના રોજ લંડનના “Proceeding of Royal Society” માં પ્રકાશિત કરવામાં આવ્યો. માર્કની શ્રી જગદિશચંદ્ર બોઝની શોધ “Mercury Coherer with telephone” નો ઉપયોગ કરી વાયરલેસના શોધક તરીકે ઘણા વિદેશી પુસ્તકોમાં પોતાનું નામ નોંધાવ્યું. પરંતુ તેના જનક તો ખરેખર શ્રી જગદીશ ચંદ્ર બોઝ જ હતા.

શ્રી બોઝે વિદ્યુતચુંબકીય તરંગોના ઉત્પાદન, પ્રસારણ અને અભિગ્રહણ પર સંશોધન કરવાનું પસંદ કર્યું. આ વિદ્યુત ચુંબકીય તરંગોની લંબાઈ 1 મિલિ મિટરથી 1 સેન્ટિમીટર સુધીની હતી. આ સંશોધન કરવા માટે ઉપકરણો ઉપલબ્ધ ન હોવાને કારણે તેમણે સ્વખર્ચ ઉપકરણો તૈયાર કર્યા. તેમણે સૌ પ્રથમ સુક્ષ્મ તરંગોનો ઉપયોગ પદાર્થની સંરચના સમજવા માટે કર્યો. તેમના દ્વારા નિયમિત ઉપકરણને ‘વેવ ગાઈડ’ તરીકે ઓળખવામાં આવે છે. ઈ.સ. 1895માં શ્રી બોઝે રેડિયો તરંગોનું દિવાલમાંથી પ્રસરણનું નિદર્શન કર્યું. ત્યારબાદ લોર્ડ કેલ્વિન અને અન્ય વૈજ્ઞાનિકોની સમક્ષ “રોયલ ઈન્સ્ટીટ્યૂટ”માં આ પ્રયોગ ફરીથી બતાવવામાં આવ્યો.

ઈ.સ. 1900 પછી તેમણે બિનતારી પ્રણાલીનું સંશોધન પડતું મૂકી. વનસ્પતિની સંવેદના અંગે અભ્યાસ કરવાનું શરૂ કરવામાં આવ્યું. 10 મે 1901 ના રોજ તેમણે વૈજ્ઞાનિકોની જાહેર સભામાં વનસ્પતિની સંવેદનશીલતા અંગેના પ્રયોગ કરીને બતાવ્યા. આ પ્રયોગ માટે શ્રી બોઝે વનસ્પતિની સંવેદનશીલતા માપવા માટે એક સંવેદનશીલ યંત્રનું નિર્માણ કર્યું હતું. જે વનસ્પતિના સ્પંદનોનું માપન માટે સક્ષમ હતા. આ યંત્રને વનસ્પતિ સાથે સંબંધિત કરી વનસ્પતિને બ્રોમાઈડ ઝેરથી ભરેલા પાત્રમાં ડુબાડવામાં આવ્યું. યંત્રની સામે પડદા પર વનસ્પતિની સંવેદનશીલતા સ્પષ્ટ જોઈ શકાતી હતી. ધીરે ધીરે વનસ્પતિની નસની ધડકનો ધીમી પડતી ગઈ એક સમયે અનિયમિત થઈ અટકી ગઈ. બધા વૈજ્ઞાનિકો આશ્ચર્ય થી જોઈ રહ્યા. શ્રી બોઝે સાબિત કરીને બતાવ્યું કે વનસ્પતિમાં પણ જીવિત પ્રાણીઓની જેમ જ જીવનના લક્ષણો છે. આ ઉપરાંત તેણે વનસ્પતિની નિંદર, શ્વાસ્થ્યોસ્વાસ, ભોજન વગેરે ઔષધી પ્રભાવ જાણવા માટેના ઉપકરણો તૈયાર કર્યા અને જણાવ્યું કે વનસ્પતિ સુખદુઃખમાં પોતાની પ્રતિક્રિયા આપે છે.

બે વર્ષ બાદ તેમણે એક મોનો ગ્રાફ ‘Response in the Living and Non-living’ પ્રકાશિત કર્યું. આ ગ્રાફના પ્રકાશનથી શ્રી જગદીશચંદ્ર બોઝ વિશ્વવિખ્યાત મોભો વૈજ્ઞાનિક બની ગયા હતા.

એમના મહત્વના પુસ્તકો - સજીવ તથા નિર્જીવની અભિક્રિયાઓ (1902), વનસ્પતિની અભિક્રિયા (1906), પાદ્યોની ચેતા - વ્યવસ્થા (1926), છોડવાની પ્રેરક યાંત્રિકી (1928) વગેરે છે.

**સિદ્ધાંતો:** ઈ.સ. 1917માં તેમના વનસ્પતિની સંવેદનશીલતા જગવિખ્યાત કાર્યને આધારે ‘સર’ની ઉપાધીથી સન્માનિત કરવામાં આવ્યા. 1920ની સાલમાં તેઓને ઈંગ્લેન્ડની રોયલ સોસાયટીના ફેલો’ તરીકે ચૂંટવામાં આવ્યા.


આ ઉપરાંત તેઓએ ફિલ્મી જગતમાં પણ પોતાની હુનરની સાબિતિ આપી અને 1956માં તેઓને સંગીત નાટક એકાદમીનો પુરસ્કાર મળ્યો. 1958માં તેમને ભારત સરકારે ‘પદ્મશ્રી’ ના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

**મૃત્યુ :** 23 નવેમ્બર 1937ના રોજ શ્રી જગદીશચંદ્ર બોઝનું અવસાન થયું.

### (3) આલ્બર્ટ આઈન્સ્ટાઈન :

**જન્મ :** 14 માર્ચ, 1879 જર્મનીમાં ઉલ્મ ખાતે વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક વિજેતા જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આઈન્સ્ટાઈનનો જન્મ થયો હતો. તેઓ જન્મે યહુદી હતા. ઉલ્મથી તેઓએ મ્યુનિચમાં સ્થળાંતર કર્યું અને ત્યાં તેઓ સ્થાયી થયા હતા. મોડું બોલતા શીખેલ આલ્બર્ટનું જીવન સામાન્ય હતું. પણ તેની રીતભાત વિશિષ્ટ હતી. સમવયસ્કો સાથે ક્યારેય હળતા ભળતા નહીં અને અલગ જ રહેવાનું પસંદ કરતા. માતામાં સંગીત પ્રત્યે અભિરુચી હોવાથી આલ્બર્ટમાં પણ વાયોલિન વગાડવાનો શોખ જાગ્યો હતો અને જે આજીવન તેઓ માણતા રહ્યા.

શિક્ષણ : માતા પિતા યહુદી હોવાથી અને મ્યુનિચમાં વસવાટ કરતા હોવાથી આઈનસ્ટાઈનને કેથલિક શાળામાં ભરતી કરવામાં આવ્યા પણ આઈનસ્ટાઈનને ભણવામાં મજા નહોતી આવતી.



દસ વર્ષની વયે તેમને “જીમ્નેશિયમ” શાળામાં દાખલ કરવામાં આવ્યા. જીમ્નેશિયમ એટલે એવી માધ્યમિક શાળા ઓ જ્યાં પૂર્વ યુનિવર્સિટી અને ધર્મની તાલીમ અપાતી. શાળાની શિક્ષણ પદ્ધતિઓ અને ફરજિયાતપણાએ તેમણે શાળામાંથી વિમુખ કર્યા.

આલ્બર્ટના કાકાને બીજ ગણિત અને ભૂમિતિમાં રસ હોવાથી આલ્બર્ટને ગણિતમાં રસ પડવા લાગ્યો.

15 વર્ષની વયે આર્થિક મુશ્કેલીને કારણે તેમના પિતા મ્યુનિચથી ઈટલીના મિલાન શહેરમાં રહેવા ગયા. પણ આલ્બર્ટ જીમ્નેશિયમમાં રિપ્લોમાં પૂરો કરવા મ્યુનિચમાં જ રોકાઈ ગયા. માત્ર ગણિત વિષય પ્રત્યેની અભિરુચિ, બીજા વિષયો પ્રત્યેનો અણગમો અને શિક્ષકો અને શાળાની જોહુકમી અને ફરજિયાતપણાના લીધે આલ્બર્ટ ભણવામાં ઘણા પાછળ હતા. જેને લીધે તેને શાળામાંથી બરતરફ કરવામાં આવ્યા.

ત્યારબાદ તેઓએ સ્વીટ્ઝરલેન્ડની સ્વીસ ફેડરલ પોલિટેક્નિક શાળાની પ્રવેશ પરીક્ષામાં ગણિત સિવાય કોઈ વિષયમાં સારો દેખાવ ન હોવાથી તેઓ નાપાસ થયા. પરંતુ નસીબજોગે પોલિટેક્નિક શાળાના આચાર્યશ્રીની નજરે તેમણે ગણિતના સારા દેખવાને લીધે ખાસ કિસ્સામાં શાળામાં દાખલ કર્યા. અહીં તેઓએ પ્રથમવાર અભ્યાસ આનંદ સાથે સારી રીતે કર્યો તેઓ ભૌતિકશાસ્ત્રના શિક્ષક જ બનવા માંગતા હતા. તેથી તે વિષય સાથે તેમણે યુનિવર્સિટીની તાલીમ ઝયુરિચમાં પુરી કરી.

1902થી 1909 સમય દરમિયાન ઝયુરિચ યુનિવર્સિટીમાંથી તેમણે ડોક્ટરની ઉપાધી મેળવી.

કાર્ય : અગ્રીમ કક્ષાના વિદ્વાન હોવા છતા તેમને શિક્ષક તરીકેની નોકરી ન મળી. તેથી તેઓ બર્ન ખાતે સ્વિસ પેટન્ટ ઓફિસમાં નોકરી શરૂ કરી અને ફાજલ સમયમાં ભૌતિક વિજ્ઞાનમાં સંશોધન આગળ ધપાવ્યું. તેમણે ઈ.સ. 1905માં સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો જે પરમાણુ બોમ્બ બનાવવાનો નિમિત્ત બન્યા. તેમણે ગતિના નિયમો આપ્યા જે પણ સર્વસ્વીકૃત થયા.

વિજ્ઞાન સામાન્ય સિદ્ધાંત પ્રમાણે દ્રવ્યનું નિર્માણ થતું નથી કે નાશ પણ કરી શકાતો નથી. આઈનસ્ટાઈન આ સામાન્ય સિદ્ધાંતને આધારે જાણી લીધું કે દ્રવ્યને ઊર્જામાં કે ઊર્જાને દ્રવ્યમાં રૂપાંતરીત કરી શકાય છે. જે  $E = MC^2$  સૂત્ર વડે દર્શાવ્યું. જ્યાં  $M =$  પદાર્થનું દ્રવ્ય અને  $C =$  પ્રકાશનો વેગ  $= 3 \times 10^{10} \text{ m/s}$  અને  $E =$  ઊર્જા છે. સૂત્ર દ્વારા સ્પષ્ટ થાય છે કે, યોગ્ય પ્રક્રિયાથી થોડું લીધેલ દ્રવ્ય પણ પ્રચંડ ઊર્જા આપે છે. ક્વૉન્ટમવાદના સિદ્ધાંત આધારે આઈનસ્ટાઈનને ફોટોઈલેક્ટ્રીક અસર / ઘટના સમજાવી, સાથે સાથે તેઓએ કરેલા સંશોધન પણ પ્રકાશિત કરતા ગયા. વૈજ્ઞાનિકો તેની ચકાસણી કરી પુષ્ટિ આપતા ગયા અને વિશ્વને એક વિખ્યાત વૈજ્ઞાનિકનો પરચો કરાવ્યો.

1909માં તેઓ ઝયુરિચની યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિયુક્ત થયા. ત્યાંથી પ્રેગની જર્મન યુનિવર્સિટી અને ફરી પાછા ઝયુરિચ યુનિવર્સિટીમાં જોડાયા. બર્લિન યુનિવર્સિટીના આમંત્રણથી તેઓ ત્યાં ગયા વિવિધ સંસ્થાઓ અને યુનિવર્સિટીના આમંત્રણ મળતા તેઓ અમેરિકા અને લંડન પણ ગયા.

જર્મનમાં નાઝીઓ સત્તા સ્થાને આવતા આઈનસ્ટાઈનને ખૂબ મુશ્કેલી સહન કરવી પડી હતી. આથી કંટાળી તેઓ અમેરિકાની ન્યુજર્સી પ્રિસ્ટન ખાતે ગણિતના અભ્યાસ માટેન સંસ્થાના નિયામક તરીકે જોડાયા અને અમેરિકાનું નાગરિકત્વ સ્વીકાર્યું.

1950 માં તેમણે યુનિફાઈડ સિદ્ધાંત જાહેર કર્યો જેમાં ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત અને વિદ્યુત ચુંબકીયક્ષેત્રોને લગતાં ભૌતિક નિયમોનું સંયોજન છે.

સિદ્ધિઓ : ફોટો ઈલેક્ટ્રીક અસરના સંશોધન માટે આઈનસ્ટાઈન ને 1921 માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું.

- વસ્તુસ્થિતિનો ઊંડો વિચાર કરી તેમણે પ્રકાશ ગતિનો અપવાદ આપી ગતિવિજ્ઞાનના ત્રણ વિષયો તારવ્યા.
- પદાર્થનું દ્રવ્યમાન સાપેક્ષ હોય છે.
- ઊર્જા અને દ્રવ્યમાન વચ્ચે સીધો સંબંધ હોય છે.
- 1905 માં અનાલે, ધ ફિઝિક્સમાં આઈનસ્ટાઈનના પાંચ સંશોધન લેખો પ્રગટ થયા.
- પ્રથમ લેખ એ ડિટરમિનેશન ઓફ મોલેક્યુલર ડાયમેન્સન્સ દ્વારા ઝ્યુરિચ યુનિવર્સિટી તરફથી ડૉક્ટરની ઉપાધી પ્રાપ્ત થઈ.
- પ્રાગ અને ઝ્યુરિચ, યુનિવર્સિટી પછી તેઓ બર્લિનની વિલહેમ કેસર ઇન્સ્ટીટ્યુટમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા.
- 1924માં તેઓ બર્લિનની પ્રશિયન એકેડેમી ઓફ સાયન્સિઝમાં પ્રોફેસર તરીકે જોડાયા.

તેમણે ગુરુત્વાકર્ષણ વર્ણન ન્યુટોનિય પદ્ધતિ પ્રમાણે ન કરતા તે પદાર્થોના વચ્ચેના આકર્ષણથી નહીં. પરંતુ તેને કારણે ઊભી થતી નવી ભૂમિતિના વર્ણનથી કરવાનું કહ્યું.


**મૃત્યુ :** શાંતિ અને સાદું જીવન, બે કોટ અને લાકડીનો ઉપયોગ કરનાર ધર્મ અને વિજ્ઞાનને એકબીજાના પૂરક ગણનાર અને તેને માનવ માટે કલ્યાણકાર સમજનાર શાંતિના આ દૂતનો 76 વર્ષે 18 એપ્રિલ 1955ના રોજ જીવનદીપ બુઝાઈ ગયો.

#### (4) થોમસ આલ્વા એડિસન

**જન્મ :** વીજળીના બલ્બ અને બીજી અનેક કુલ 1048 શોધો કરનાર મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનનો જન્મ અમેરિકાના ઓહ્યો રાજ્યના મિલનગરમાં ફેબ્રુઆરી 11, 1847ના રોજ થયો હતો.

**શિક્ષણ :** થોમસ આલ્વા એડિસન એક ગરીબ મા-બાપના પુત્ર હતા. તેઓ સમજણા થયા અને તેમના માતા-પિતાએ સ્થાનિક શાળામાં તેમણે દાખલ કરાવ્યા. કુતુહલથી ભરપૂર આ વિદ્યાર્થી શાળામાં શિક્ષકોને અનેક પ્રશ્નો પૂછતા. પરંતુ શિક્ષકો તેમને ઉત્તર આપવાને બદલે મૂર્ખ ગણતા અને ધુત્કારતા હતા. અંતે સ્વમાની માતાની મંજૂરીથી તેઓએ શાળાએ જવાનું બંધ કરી દીધું હતું અને ઘરે રહીને જ સ્વશિક્ષણ લીધું હતું.

**જીવન :** એડિસનને વિજ્ઞાનના પ્રયોગ કરવાનો ઘણો શોખ હતો. જે વસ્તુ મળે તેના વડે જાતજાતના પ્રયોગ કરતા રહેતા. બાર વર્ષની વયે પિતાજીની મંજૂરી લઈ એડિસન રેલગાડીમાં છાપા વેચવાનું ચાલુ કર્યું. ત્યાં હુરોન બંદરથી મિસિગન સુધી ના 16 કિલોમિટરનો રેલપ્રવાસ કરતા હતા અને તેઓ છાપા વેચતા આ કામ તેમને મનપસંદ હતું. ઉપરાંત તેમાં પૈસા પણ મળતા હતા. ઈ.સ. 1869માં તેમણે એક છાપખાનું ખરીદ્યું. રેલના ડબ્બામાં જ તે અનેક જાતના પ્રયોગ કરતા હતા.



એકવાર પ્રયોગ દરમિયાન ફોસ્ફોરસ સળગી ઉઠ્યો. ડબ્બામાં આગ લાગી. રેલગાડીનો ગાર્ડ ગુસ્સે થઈ ગયો અને એડિસનનો તમામ માલ રેલગાડીની બહાર ફેંકી દીધો. ગુસ્સે થયેલા ગાર્ડે એડિસનના ગાલે એક જોરદાર તમાચો માર્યો. તેનાથી એડિસનને કાયમી બહેરાશ આવી ગઈ હતી. છતાં ગભરાઈ પ્રયોગ બંધ કરવાને

બદલે એડિસને વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી પ્રયોગકાર્ય શરૂ જ રાખ્યું.

**શોધ :** થોમસ આલ્વા એડિસને એક સ્વયં સંચાલિત યંત્રની શોધ કરી જે ઓટોમેટીક સિગ્નલો મોકલતી હતી. રેલવેમાં તાર માસ્તરનું કાર્ય કરતા ત્યારે તેમણે વીજળીથી ચાલતા એક મત ગણતરી યંત્રની રચના કરી હતી.

ઈ.સ. 1876માં એડિસન મેનેલો પાર્ક ગયા ત્યાં તેમણે ગ્રેહામ બેલે બનાવેલા ટેલિફોનમાં

સુયોગ્ય સુધારા વધારા કર્યા. જેથી ટેલિફોનનો અવાજ વધુ સુસ્પષ્ટ સંભળાવવા લાગ્યો. આ જ ગાળા દરમિયાન તેમણે “ફોનોગ્રાફ” નામનું એક બોલતું યંત્ર બનાવ્યું. ફોનોગ્રાફની શોધથી પણ એડિસનને સારી પ્રતિષ્ઠા મળી. પણ તેની વધુ મહત્વની શોધ વિજળીના બલ્બની છે. 30 જેટલા સહાયકની મદદથી ઈ.સ. 1879માં મનેલો પાર્કના અમુક વિસ્તારને વિજળીના દીવાઓથી સજ્જ કર્યો હતો. આના ઉદ્ઘાટનમાં રાત્રીના હાજર રહેલા ત્રણ હજાર લોકો એ સમગ્ર વિસ્તારને વીજળીના ગોળાઓથી પ્રકાશિત થતો નિહાળ્યો ત્યારે તે અંચબાના સાક્ષી બન્યા હતા. અને તે વિશ્વ વિખ્યાત બની ચુક્યા હતા.

તેમણે એક નવા પ્રકારના કેમેરાની રચના કરી હતી. જેનું નામ તેમણે “કિન્ટોગ્રાફ” રાખ્યું હતું. તે મુવી કેમેરો હતો. તેમણે 1300 જેટલી નાની - મોટી શોધ કરી હતી અને 1069 શોધોની પેટેન્ટ કરાવી હતી. આ તમામની નોંધ તેમણે 3500 નોટબુકમાં નોંધ કરી હતી. આટલી બધી શોધ કરી હોવા છતા તેઓ નોબેલ પારિતોષિકથી વંચિત રહ્યા હતા.

એડિસનને વિશ્વના મહાન આવિષ્કારક તરીકે ગણવામાં આવે છે. ઈ.સ. 1908માં જ્યારે એડિસન 61 વર્ષના હતા ત્યારે તેમણે 1069 પેટેન્ટ પોતાના નામે મેળવી હતી. ઈ.સ. 1914માં 67 વર્ષના હતા. ત્યારે બીજી ચાલીસ જેટલી શોધ કરી હતી. અને પ્રથમ વિશ્વયુદ્ધના લશ્કરને અર્પણ કરી. જેથી અમેરિકન સેવાને ખૂબ જ લાભ થયો હતો.

**મૃત્યુ :** ઓક્ટોબર 18, 1931 માં 84 વર્ષની વયે વિશ્વના આ મહાન વૈજ્ઞાનિકનું અવસાન થયું હતું. ન્યુજર્સીમાં વેસ્ટ ઓરેન્જ ખાતે તેમની દફનવિધિ કરવામાં આવી હતી. આ સમયે સમગ્ર અમેરિકામાં વીજળીની બત્તીઓ એક મિનિટ માટે બંધ કરી તેમનું સન્માન કર્યું હતું.

- એડિસન ધૂની હતા પણ દૃઢ સંકલ્પબળ વાળા હતા તે પોતે માનતા કે તેમની પ્રતિભામાં નસીબનો 1 ટકા અને તેમની મહેનત કે પસીનાનો 99 ટકા હિસ્સો હતો.
- તે પ્રયોગશાળામાં સતત કાર્યરત રહેતા અને પોતાનું ખાવા-પીવાનું પણ ભૂલી જઈ લગનથી કામ કરતા હતા.

## 1.9 સારાંશ

વિજ્ઞાનએ માનવજીવનનો અનિવાર્ય ભાગ બની ચુક્યું છે. વિશ્વમાં આજે પ્રતિક્ષણે વિજ્ઞાનનો વ્યાપ વધતો જાય છે. આપણો પણ વિજ્ઞાન સાથે ટેકોલોજીના અનુબંધથી અનેક ક્ષેત્રોમાં સ્વાવલંબી બન્યો છે. મેડીકલ, અવકાશ, કૃષિ, ટેકોલોજી, રમતગમત વગેરે ક્ષેત્રે આપણે વિશ્વના ટોચના દેશોમાં સ્થાન પામી શક્યા છે. ભારતીય વૈજ્ઞાનિકો અને વિશ્વના અન્ય દેશોના વૈજ્ઞાનિકો માનવજાતને વધુ સુખાકારી બનાવવા વિજ્ઞાનના સદ્ઉપયોગની ક્ષિતિજો વધારતા રહ્યા છે. વર્ગખંડમાં પણ આજનો વિદ્યાર્થી આવતીકાલે દેશનું કોઈને કોઈ ક્ષેત્રમાં સુકાન સંભાળે ત્યારે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારતો થાય તે મહત્વનું છે. માટે સરકાર શિક્ષકોને પણ વિભાગની પૂરતી તાલીમ અને લાયકાત વાળા શિક્ષકો શાળાને મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં તો ISRO અને Science city જેવા પ્રોજેક્ટ દ્વારા સામાન્ય નાગરીક પણ વિજ્ઞાનના મહત્વને સમજી શક્યો છે. આમ વિજ્ઞાનના જ્ઞાનનો સમજણપૂર્વકનો ઉપયોગ માનવજાતને ઉચ્ચતી તરફ દોરી જશે એમાં કોઈ શંકા નથી.

## 1.10 તમારી પ્રગતિ ચકાસો

(1) વિજ્ઞાન એટલે શું ? તેનો અર્થ જણાવી કોઈ બે વ્યાખ્યાની વિસ્તૃત ચર્ચા કરો.

.....

.....

.....

.....

.....

.....

.....

(2) વિજ્ઞાન અને માનવજીવનનો અનુબંધ સ્પષ્ટ કરો.

.....  
.....  
.....  
.....  
.....  
.....

(3) ટૂંકનોંધ લખો :વિજ્ઞાન માનવજીવન માટે ઉપકારક  
વિજ્ઞાન માનવજીવન માટે વિઘાતક

.....  
.....  
.....  
.....  
.....

(4) વિજ્ઞાન શિક્ષકના મહત્વના કૌશલ્યની ચર્ચા કરો.

.....  
.....  
.....  
.....  
.....

(5) કોઈ બે ભારતીય અને કોઈ પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોનું વિજ્ઞાનમાં પ્રદાન જણાવો.

.....  
.....  
.....  
.....  
.....

(6) “વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિકોની કદર કરતા થાય” આ વિશિષ્ટ હેતુની વિષદ છણાવટ આપો.

.....  
.....  
.....  
.....  
.....

(7) ભારતમાં વિજ્ઞાન શિક્ષણની પાશ્ચદ્ ભૂ જણાવો.

.....

.....

.....

.....

.....

.....

---

### 1.11 સ્વાધ્યાય

---

પ્રશ્ન - ૧ નીચેના પ્રશ્નોના અતિ ટૂંકમાં ઉત્તર આપો.

- 1.1 વિજ્ઞાન એટલે શું ?
- 1.2 માનવજીવન અને વિજ્ઞાનનો અનુબંધ દર્શાવતા બે ઉપયોગો લખો.
- 1.3 ગુજરાત રાજ્યમાં ધો.૯ થી ૧૨ માં વિજ્ઞાન શિક્ષક થવા માટેની શૈક્ષણિક લાયકાત લખો.
- 1.4 વિજ્ઞાનની વર્તમાન સમયમાં બે ઉપયોગીતા લખો
- 1.5 કોસ્મિક કિરણ પર કયા વૈજ્ઞાનિકે કાર્ય કર્યું હતું.

પ્રશ્ન - ૨ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ( ત્રણ થી પાંચ વાક્યોમાં ) ઉત્તર આપો.

- 2.1 થોમસ આલ્વા એડિસનનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન લખો.
- 2.2 વિજ્ઞાન શિક્ષકના કોઈ ત્રણ કૌશલ્ય સમજાવો.
- 2.3 વિજ્ઞાનનું સજાજ માટે મહત્વપર નોંધ લખો.
- 2.4 વિજ્ઞાનની કોઈ બે વ્યાખ્યા લખી સમજાવો.
- 2.5 વિજ્ઞાનનો ઉપયોગ અવકાશક્ષેત્રે અને ચિકિત્સાક્ષેત્રે કેવી રીતે થાય છે ? સમજાવો.

પ્રશ્ન - ૩ નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો.

- 3.1 ભારતમાં વિજ્ઞાન શિક્ષકના વિકાસ પર નોંધ લખો.
- 3.2 વિજ્ઞાન શિક્ષકની માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને જરૂરી કૌશલ્ય પર નોંધ લખો.
- 3.3 વિજ્ઞાનનો ઉપયોગ થતો હોય તેવા ત્રણ ક્ષેત્રો વિશે નોંધ લખો.
- 3.4 કોઈ ત્રણ વૈજ્ઞાનિકોનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રધાન લખો.
- 3.5 “માનવીના દૈનિક જીવનને સ્પર્શનું જ્ઞાન એ જ વિજ્ઞાન ” વાક્ય સાથે તમે સહમત છો ? જો હા તો તમારા ઉત્તર માટે અભિકરણ આપો.





## વિજ્ઞાન શિક્ષણમાં નુતન પ્રવાહો

: રૂપરેખા :

- 2.1 પ્રસ્તાવના
- 2.2 ઉદ્દેશ્યો
- 2.3 વિજ્ઞાન મંડળ
- 2.4 આકાશ દર્શન
- 2.5 ક્ષેત્ર પર્યટન
- 2.6 કૃત્રિમ નભોમંડળ
- 2.7 સાયન્સ સિટી, અમદાવાદ : પરીચય
- 2.8 સારાંશ
- 2.9 તમારી પ્રગતિ ચકાસો
- 2.10 સ્વાધ્યાય

## 2.1 પ્રસ્તાવના

વિજ્ઞાન અને માનવજીવનનો સંબંધ વર્ષોથી ચાલ્યો આવે છે. જેમ જેમ વિજ્ઞાનમાં નવિન આવિષ્કારો થતા થાય છે. તેમ તેમ મનુષ્ય પોતાની શક્તિ, અને મર્યાદા અનુસાર તેને સ્વીકારતો જાય છે. માનવીનું વિજ્ઞાન પ્રત્યેનું કુતુહલ કે જીજ્ઞાસા ક્યારેય ઓછા થયા નથી. ઉલટાનું વધ્યા છે. આમ વિજ્ઞાન તરફના આ કુતુહલને સંતોષવા તથા સામાન્ય નાગરીકોને વિજ્ઞાન વિશેની ઊંડી સમજ આપવા કેટલાક પ્રકલ્પો શોધ્યા છે. જે અતિ મહત્વના પૂરવાર થયા છે. શાળાના વિદ્યાર્થીને વિજ્ઞાનમંડળની રચના અને કાર્યોથી લઈ આકાશ દર્શન, ક્ષેત્ર પર્યટન, કૃત્રિમ નભો મંડળ, સાયન્સ સિટી જેવા માધ્યમો એ વિદ્યાર્થીનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની ખીલવણી કરી છે. જે યોગ્ય છે. આમ પ્રસ્તુત એકમમાં આપણે વિજ્ઞાન શિક્ષણમાં નૂતન પ્રવાહો જેવા કે વિજ્ઞાન મંડળ, આકાશ દર્શન, ક્ષેત્ર પર્યટન, કૃત્રિમ નભોમંડળ અને સાયન્સ સિટી વિશે વિષદ્ ઇણાવટ કરીશું.

## 2.2 ઉદ્દેશ્યો

- આ એકમની અભ્યાસ પછી તમે આટલું કરી શકશો
- વિજ્ઞાન શિક્ષણમાં નૂતન પ્રવાહો જેવાકે વિજ્ઞાન મંડળ, આકાશ દર્શન, ક્ષેત્ર પર્યટન, કૃત્રિમ નભોમંડળ, વિજ્ઞાન પ્રતિભા શોધ, સાયન્સ સિટીની વિશે ઉડાણથી માહિતગાર થઈ શકશો.

## 2.3 વિજ્ઞાનમંડળ (Science Club) :

“Science teachers should make use of science clubs to improve the standard of science education in schools and make them necessary for the future scientists of India.”

“વિજ્ઞાન શિક્ષણના સ્તરને સુધારવા માટે વિજ્ઞાન શિક્ષકોએ શાળાઓમાં વિજ્ઞાનમંડળો શરૂ કરવાં જોઈએ અને એમને ભારતના ભાવિ વૈજ્ઞાનિકોનાં પોષણસ્થળ બનાવવાં જોઈએ.”

“The science club offers the pupil an opportunity for specification which he does not have in the class-room. In short, the club represents freedom and expression whereas the class-room represents conformity and repression.” - McKnown

“વર્ગખંડમાં જે પારંગતતા પ્રાપ્ત થઈ શકતી નથી તેને પ્રાપ્ત કરવા માટે વિજ્ઞાનમંડળ અધ્યેતાને તક આપે છે. ટૂંકમાં વિજ્ઞાનમંડળ સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ પૂરી પાડે છે, જ્યારે વર્ગખંડમાં અનુવર્તન અને દબાણ હેઠળ અધ્યેતાએ કામ કરવાનું હોય છે.”

વર્ગખંડમાં ક્યારેક અધ્યેતાને મૂંઝવતા પ્રશ્નોના જવાબ મળતા નથી, તો પ્રયોગશીલ અધ્યેતાને મુક્ત પ્રયોગની તક મળતી નથી. વિજ્ઞાનનું વિશેષ વાચન, પ્રોજેક્ટ કાર્ય, સંભાષણ વગેરે વર્ગમાં ભાગ્યે જ થઈ શકે છે. વળી વિજ્ઞાનમાં તેજસ્વી કે રસ ધરાવતા અધ્યેતાને ચીલાચાલુ વર્ગશિક્ષણમાં પારખી શકાતો નથી, કદાચ શોધી શકાય તો પણ તેને વર્ગમાં તેની બુદ્ધિ અને જિજ્ઞાસાને પોષે તેવું કશું આપી શકાતું નથી. આ બધા માટે વિજ્ઞાનમંડળ જ તકો પૂરી પાડી શકે છે.

### ◆ વિજ્ઞાનમંડળના હેતુઓ :

- વર્ગશિક્ષણમાં જેમના માટે વધુ સમય જાય તેમ હોય તેવા પ્રયોગ વિજ્ઞાનમંડળના ઉપક્રમે અધ્યેતા પોતે કરી શકે અને વધુ જ્ઞાન મેળવી શકે.
- વિજ્ઞાનમંડળમાં અધ્યેતાઓ મુક્ત પરિણામી પ્રયોગો તરફ વળે.
- વિજ્ઞાનમંડળમાં અધ્યેતાઓમાં તેમના જિજ્ઞાસાયુક્ત પ્રશ્નોના જવાબો શોધવાનું કૌશલ્ય કેળવાય અને તે દ્વારા સ્વઅધ્યયન માટે વાચન ટેવ કેળવાય.
- આજુબાજુમાં અને વિશ્વમાં થતાં વૈજ્ઞાનિક સંશોધનો, વિજ્ઞાનના વ્યવહારુ ઉપયોગો અને વિજ્ઞાન વિષયક પ્રવૃત્તિઓથી અધ્યેતા પરિચિત થાય.
- વિદ્યાર્થી અવસ્થામાં તેમજ ત્યારબાદ પણ કુરસદની ક્ષણોનો સદુપયોગ વિજ્ઞાન વિષયક પ્રવૃત્તિઓની હોબીથી કરવા માટે અધ્યેતા ટેવાય.

- અધ્યેતા સ્વૈચ્છિક રીતે વિજ્ઞાનમંડળ વિજ્ઞાનના સિદ્ધાંતો પર આધારિત નાના - મોટા પ્રયોગો કરે, નમૂના બનાવે અને તે દ્વારા અધ્યેતાની અવલોકન શક્તિ કેળવાય. રચનાત્મક વૃત્તિ પોષાય તેમજ તેમને વૈજ્ઞાનિક ઢબે વિચારતા કરી શકાય.
- અધ્યેતાની વિજ્ઞાન પ્રતિભા ખોજ થઈ શકે છે અને પોષવાના માર્ગો વિચારી શકાય છે.
- ચર્ચા, પ્રશ્નોત્તરી, વાર્તાલાપ વગેરે દ્વારા વિજ્ઞાનની બાબતોને સ્પષ્ટ સમજાવવાની અભિવ્યક્તિ અધ્યેતાઓમાં કેળવાય અને તેમને વિજ્ઞાનમાં રસ લેતા કરી શકાય.
- વિજ્ઞાનના નિષ્ણાત વ્યક્તિઓનાં પ્રવચનોનો અધ્યેતાઓને લાભ મળે.
- અધ્યાપકને વર્ગશિક્ષણમાં મદદરૂપ થાય એવા ચાર્ટ, મોડેલ જેવાં ઉપયોગી સાધનો અધ્યેતાઓ વિજ્ઞાનમંડળના ઉપક્રમે બનાવી શકે.
- અધ્યેતાઓમાં વૈજ્ઞાનિક વલણ અને સંશોધનવૃત્તિ કેળવાય.
- વિજ્ઞાનમંડળમાં વર્ગશિક્ષણને પૂરક પ્રવૃત્તિઓની અજમાયશ થઈ શકે.
- વિજ્ઞાનવિષયક પ્રવૃત્તિઓ માત્ર શાળા પૂરતી મર્યાદિત ન રહેતાં સમસ્ત સમાજમાં પ્રસરી જાય તેમ કરવું. વર્ણી સમાજમાં વિજ્ઞાનનો ફાળો અને તેની અગત્ય વિશે જાગૃતિ આવે.
- અધ્યેતાઓ બિનઉપયોગી અને નકામી વસ્તુઓમાંથી નવીન સાધનો બનાવીને પોતાની સર્જનશક્તિનો વિકાસ કરે. વિજ્ઞાન શિક્ષણ માટે ઉપયોગી હસ્ત બનાવટનાં સાધનો બનાવે.
- અધ્યેતાઓ વિજ્ઞાનને કારણે ભવિષ્યમાં સમાજમાં આવનારા ફેરફારોથી પરિચિત થાય.
- અધ્યેતાઓ વિચારવામાં વૈજ્ઞાનિક પદ્ધતિ અને વૈજ્ઞાનિક વિચારસરણી કેળવે, અર્થાત્ તેઓ અંધશ્રદ્ધાથી દૂર રહે, ઘટના કે પ્રક્રિયાને તપસ્યા વગર ન સ્વીકારે, માહિતી પ્રાપ્તિની પ્રવિધિ અને સાધનોનું મૂલ્યાંકન કરી શકે અને તેમના અભિપ્રાયો અને સમાપનો ચોક્કસ પુરાવા પર આધારિત હોય.
- અધ્યેતાની કલ્પનાશક્તિ, તર્કશક્તિ અને નિર્ણયશક્તિ વિકસે.
- વિજ્ઞાનમાં, વિજ્ઞાન શિક્ષણમાં અને વિજ્ઞાનની પ્રવૃત્તિઓમાં અધ્યેતાઓ વધુને વધુ પ્રમાણમાં ભાગ લેતા થાય.
- અધ્યેતાઓમાં શિસ્ત, શ્રદ્ધા, ધીરજ, ચોક્કસાઈ, આત્મવિશ્વાસ, સ્વચ્છતા, ઉત્સાહ નિયમિતતા વગેરે જેવા ગુણોનો વિકાસ થાય.
- પ્રગતિ માટે અનુકરણ પૂરતું નથી પણ પોતાના સ્વતંત્ર અને મૌલિક વિચારોનો વિકાસ આવશ્યક છે તે અધ્યેતાઓ સમજે.
- વિજ્ઞાન શિક્ષણની ગુણવત્તા સુધરે તેમજ તેને માટેની પ્રાયોગિક તાલીમ માટે કારખાનાદારો, ઉદ્યોગપતિઓ, વિજ્ઞાનની વિશિષ્ટ સંસ્થાઓ વગેરે સાથે શાળાનું અનુસંધાન સધાય.

#### ◆ વિજ્ઞાનમંડળના પ્રકાર :

વિજ્ઞાનમંડળના પ્રકાર નીચે મુજબ પાડી શકાય :

- ધોરણવાર વિજ્ઞાનમંડળ : ધોરણ 5, 6, 7 માટે ધોરણ - 8, 9, 10 માટે તેમજ ધોરણ -11, 12 માટેનાં અલગ-અલગ વિજ્ઞાનમંડળો રચી શકાય.
- વિષયવાર વિજ્ઞાનમંડળ : વનસ્પતિશાસ્ત્ર અંગેનું વિજ્ઞાનમંડળ, પ્રાણીશાસ્ત્ર અંગેનું વિજ્ઞાનમંડળ, ભૂસ્તર, ખગોળ, અવકાશ, ભૌતિક, રસાયણ, દરિયાઈ જીવસૃષ્ટિ વગેરે વિષયો માટેનાં અલગ અલગ વિજ્ઞાનમંડળો રચી શકાય.
- ખાસ હેતુલક્ષી વિજ્ઞાનમંડળ : આવાં વિજ્ઞાનમંડળો કાયમી પણ હોય અને ટૂંકાગાળાનાં પણ હોય. દા.ત. વર્ષા વિજ્ઞાનમંડળ, દરિયાઈ જીવસૃષ્ટિ અંગેનું વિજ્ઞાનમંડળ.

ડૉ. વી. કે. કોહલી વિજ્ઞાનમંડળના પ્રકારો નીચે મુજબ જણાવે છે :

- **વિશેષ અભિરુચી વિજ્ઞાનમંડળ (Specilised interest club) :** જેમ કે, રેડિયો ક્લબ, ફોટોગ્રાફી ક્લબ, પ્રકૃતિ ક્લબ, કૃષિ ક્લબ, જ્યોતિષિક ક્લબ, વાયુભ્રમણ ક્લબ વગેરે.
- **સાધારણ ક્લબ (The general type club) :** જેમ કે વિજ્ઞાન ક્લબ, રસાયણસભા, ભૌતિકવિજ્ઞાન સંસ્થા, જીવવિજ્ઞાન ક્લબ વગેરે.

◆ **વિજ્ઞાનમંડળનું બંધારણ અને હોદ્દાદારો :**

વિજ્ઞાનમંડળનું બંધારણ લેખિત સ્વરૂપનું હોય તે જરૂરી છે. બંધારણની રૂએ નીચે મુજબના હોદ્દાદારો વિજ્ઞાનમંડળ માટે રાખી શકાય :

**સંરક્ષક (Patron) :** શાળાના આચાર્ય કે કોઈ અતિ ઉત્સાહી અને વિજ્ઞાનમાં વિદ્વતા ધરાવતા એવા વાલીને આ હોદ્દો આપી શકાય. સંરક્ષકનું કાર્ય મંડળનું સંચાલન કરવાનું, સલાહસૂચન આપવાનું, રોકડ સિલક રાખવાનું, મંડળને આર્થિક બળ પૂરું પાડવાનું અને સંચાલકની નિયુક્તિ કરવાનું છે.

**પ્રેરક અથવા નિયામક (Sponsor) :** તેને પ્રવર્તક પણ કહેવાય. આ હોદ્દો ખૂબ જ સક્રિય હોય એવા વિજ્ઞાન શિક્ષકને આપી શકાય. તેનું કાર્ય નિરીક્ષણ, માર્ગદર્શન અને નેતૃત્વ કરવાનું અને સલાહસૂચનો આપવાનું છે. વળી પ્રસંગોપાત ઊભી થતી સમસ્યાઓનો ઉકેલ લાવવાની પણ તેની ફરજ છે. તેણે આદેશો આપવાના નથી, પણ પ્રેમથી કામ લેવાનું છે.

**પ્રમુખ અથવા સભાપતિ (President or Chairman) :** આ પદે આચાર્ય, ઉપાચાર્ય કે દીર્ઘઅનુભવી વિજ્ઞાન શિક્ષકને મૂકી શકાય. દર મહિને એકવાર મંડળની સભા બોલાવીને તેનું સંચાલન કરવું, પ્રેરક સાથે વિચાર વિનિમય કરી આયોજન અંગેની બાબતો સભા સમક્ષ મૂકવી, મંડળનાં કાર્યો કે પ્રવૃત્તિઓનો અહેવાલ મેળવવો વગેરે કાર્યો તેણે કરવાનાં હોય છે.

**ઉપપ્રમુખ કે ઉપ-સભાપતિ (Vice - President or Vice - Chairman) :** વિજ્ઞાનમાં રસ ધરાવનાર શ્રેષ્ઠ અધ્યેતાને આ હોદ્દો આપી શકાય. તેનું કાર્ય પ્રમુખની ગેરહાજરીમાં પ્રમુખની ફરજો બજાવી તે છે.

**મંત્રી (Secretary) :** વિજ્ઞાનમાં રસ ધરાવનાર કોઈપણ અધ્યેતાને હોદ્દો આપી શકાય. તેનું કાર્ય સભ્ય ફી ઉઘરાવવી, પ્રમુખના સૂચનથી સભા બોલાવવાની નોટિસ કાઢવી, સભામાં પસાર થયેલા ઠરાવોની નોંધ રાખવી વગેરે છે.

**સહમંત્રી (Joint Secretary) :** વિજ્ઞાનમાં રસ ધરાવનાર અધ્યેતાને આ હોદ્દો આપી શકાય. મંત્રીનાં તમામ કાર્યોમાં મદદ કરવી તેમજ મંત્રીની ગેરહાજરીમાં મંત્રીની તમામ ફરજો બજાવવી એ તેનાં કાર્યો છે.

**બજાનથી (Treasurer) :** વિજ્ઞાન શિક્ષક, કારકૂન કે વિજ્ઞાનમાં રસ ધરાવનાર અધ્યેતાને આ હોદ્દો આપી શકાય તેનું કાર્ય છે - નાણાંકીય હિસાબો રાખી થયેલા ખર્ચ અંગે વાર્ષિક સભામાં મંજૂરી મેળવવી તથા મંડળે નક્કી કરેલી સિલક હાથ પર રાખી વધારાની સિલક પેટ્રન પાસે જમા કરાવવી.

**ગ્રંથપાલ (Librarian) :** વિજ્ઞાનમાં રસ લેનાર અધ્યેતાને આ હોદ્દો આપવો. તેનું કાર્ય મંડળને ઉપયોગી પુસ્તકોની નોંધ રાખવાનું, મંડળના પુસ્તકાલયમાંથી સભ્યોને પુસ્તકોની આપલે કરવાનું તથા હસ્તલિખિત અંકો કે સામયિકોની વ્યવસ્થા કરવાનું છે.

**જાહેરાત મંત્રી (Publicity Officer) :** વિજ્ઞાનમાં રસ ધરાવનાર વિદ્યાર્થીને આ હોદ્દો આપવો. મંડળની પ્રવૃત્તિઓની જાહેરાત કરી તેનાથી મંડળના સભ્યોને વાકેફ રાખવા. મંડળે કરેલી કોઈ વિશિષ્ટ પ્રવૃત્તિઓ જેવી કે ઉજવેલા દિવસો કે ઉજવેલા સપ્તાહનો અહેવાલ વર્તમાનપત્રોમાં આપવો.

**ભંડારી કે સામગ્રી નિયામક (Store - keeper) :** વિજ્ઞાનમંડળનો સભ્ય હોય અને વિજ્ઞાનમાં રસ ધરાવતો હોય એવા અધ્યેતાને આ હોદ્દો આપી શકાય. તેનું કાર્ય છે વિજ્ઞાનમંડળના સભ્યો એ તૈયાર કરેલાં સાધનો, ચિત્રો, પ્રતિકૃતિઓ સંગ્રહેલા નમૂનાઓ, વર્કશોપનાં સાધનો વગેરેની દેખભાળ રાખવી.

**સભ્યો (Members) :** વ્યવસ્થાપક મંડળ અને અન્ય બધા જ વિજ્ઞાનમંડળના સભ્યો ગણાય. મંડળનો દરેકે દરેક સભ્યા નીતિ નિર્માણ માટે કાર્યકારિણી સભાઓમાં સક્રિય ભાગ લે અને નવા સભ્યો બનાવે તેવી અપેક્ષા તેની પાસે છે.

◆ **વિજ્ઞાનમંડળની રચના :**

વિજ્ઞાનમંડળની રચના માટે હોદ્દદારોની વરણી ઉપરાંત અન્ય જરૂરી બાબતો નીચે મુજબ છે :

◆ **મંડળનું નામ :**

વિજ્ઞાનમંડળનું નામ બે રીતે આપી શકાય :

- (1) **હેતુ પરથી :** વિજ્ઞાનમંડળ જે હેતુ માટે રચવામાં આવ્યું હોય તે પરથી તેનું નામ આપી શકાય. દા.ત. ખગોળશાસ્ત્રના વિજ્ઞાનમંડળને તારક વિજ્ઞાનમંડળ કે આકાશ વિજ્ઞાનમંડળ એવું નામ આપી શકાય. પક્ષીઓના અભ્યાસ માટેના વિજ્ઞાનમંડળને વિહંગ વિજ્ઞાનમંડળ, ચોમાસાની જીવસૃષ્ટિના અભ્યાસ માટેના વિજ્ઞાનમંડળને વર્ષા વિજ્ઞાનમંડળ એવું નામ આપી શકાય છે.
- (2) **વ્યક્તિ વિશેષના નામ પરથી :** વનસ્પતિશાસ્ત્રના અભ્યાસ માટેના વિજ્ઞાનમંડળને જગદીશચંદ્ર બોઝ વિજ્ઞાનમંડળ, રસાયણશાસ્ત્રના અભ્યાસ માટેના વિજ્ઞાનમંડળને સર પ્રફુલ્લચંદ્ર રોય વિજ્ઞાનમંડળ કે ત્રિભુવનદાસ ગજજર વિજ્ઞાનમંડળ, પ્રાણીશાસ્ત્રના વિજ્ઞાનમંડળને ડાર્વિન વિજ્ઞાનમંડળ કે રૂબીન ડેવિડ વિજ્ઞાનમંડળ અને ભૌતિકશાસ્ત્રના વિજ્ઞાનમંડળને સર સી. વી. રામન વિજ્ઞાનમંડળ કે ડૉ. વિક્રમ સારાભાઈ વિજ્ઞાનમંડળ વગેરે જેવા નામ આપી શકાય.

◆ **વિજ્ઞાનમંડળના હેતુઓ :**

અગાઉ દર્શાવેલી હેતુઓની લાંબી યાદીમાંથી યોગ્ય હેતુઓને પસંદ કરવા અને લેખિત સ્વરૂપમાં તેમને તૈયાર કરવા.

◆ **સભ્યપદ :**

શાળાના અધ્યેતાઓ કે અધ્યાપકો મંડળના સભ્ય થઈ શકે.

◆ **અધ્યેતાની પસંદગી :**

પ્રતિભા શોધ મુજબ, વિજ્ઞાનમાં સર્જનાત્મકતાની કસોટીઓ દ્વારા, પરીક્ષાના ગુણાંક પરથી અને તેમના વિજ્ઞાનવિષયક રસ, કૌશલ્ય વગેરે પરથી સભ્યોની પસંદગી થઈ શકે.

◆ **સભ્ય ફી :**

જો શાળાની આર્થિક સદ્વરતા સારી હોય તો સભ્ય ફી રાખવી જ ન જોઈએ, પરંતુ જો ફી રાખવામાં આવે તો તે અધ્યેતાઓને પોષાય તેવી હોવી જોઈએ. હોંશિયાર અને પ્રતિભાવંત પણ ગરીબ અધ્યેતાઓને સભ્ય ફી લીધા વગર પણ મંડળના સભ્ય બનાવવા જોઈએ.

◆ **વિજ્ઞાનમંડળના નિયામક (Sponsor) ની લાયકાતો :**

- તેને વિજ્ઞાનમાં વિશેષ રસ હોય તથા તેનું વાંચન વિશાળ હોય.
- તેને પ્રયોગ કરવામાં અને સાદાં સાધનો બનાવવામાં રસ હોય.
- તેનામાં અધ્યેતાઓને વિચાર કરતા કરી શકવાની આવડત હોય.
- કઈ સાધનસામગ્રી અને એ ચીજવસ્તુઓ ક્યાંથી મળશે, કઈ માહિતી ક્યાંથી મળશે તેનું તેને જ્ઞાન હોવું જોઈએ.
- દેશમાં અને રાજ્યમાં વિકસેલા જુદા જુદા ઉદ્યોગો અને તેમના દ્વારા બનતી વિવિધ વસ્તુઓનું પણ તેને જ્ઞાન હોવું જોઈએ.
- પોતાના શહેરના રાજ્યના, દેશના કે વિશ્વના વિજ્ઞાન સાથે સંકળાયેલા પ્રશ્નો અને સમસ્યાઓ અંગે તે માહિતગાર હોવો જોઈએ.
- વિજ્ઞાનના વિષયમાં તે ખૂબ જ બહોળું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

- શાળા સમય ઉપરાંતના વધારાના સમયનો ભોગ આપવાની તેની તૈયારી હોવી જોઈએ.
- અધ્યેતાઓમાં રસ અને કામ અંગેની ધગશ જળવાઈ રહે તે રીતે કામ કરવાની તેનામાં તમન્ના હોવી જોઈએ. નિયામક ઉપરાંત શાળાના અધ્યાપકોની સલાહકાર સમિતિ નીમવી જોઈએ, જેના વડા શાળાના આચાર્ય હોવા જોઈએ.

◆ **વિજ્ઞાનમંડળની પ્રવૃત્તિઓ :**

પ્રવૃત્તિઓ એ વિજ્ઞાનમંડળનો આત્મા છે. પ્રવૃત્તિઓનો આધાર વિજ્ઞાનમંડળના નિયામકની શક્તિ અને સૂઝ પર અવલંબિત છે.

- **પુસ્તકાલય :** વિજ્ઞાનમંડળ માટે આગવું પુસ્તકાલય રાખવું, જેમાં વિજ્ઞાનનાં વિવિધ પુસ્તકો, મેગેઝીનો, સામયિકો વગેરે રાખવામાં આવે અને નક્કી કરેલા દિવસે અને સમયે સભ્યોના વાંચન માટે ગ્રંથપાલ પુસ્તકોની લેવડદેવડ કરે.
- **પુસ્તકોનું અવલોકન (Book review) :** અધ્યેતાઓ વાંચવા પ્રેરાય તે માટે કોઈ પુસ્તકની ટૂંકી માહિતી અધ્યેતા સમક્ષ રજૂ કરવી જોઈએ. આ પ્રકારની રજૂઆત અધ્યાપક કે અધ્યેતા દ્વારા થઈ શકે.
- **સામયિક વાંચન :** વિજ્ઞાનમંડળના સભ્યો તેમજ અન્ય અધ્યેતાઓ શાળામાં આવતાં વિજ્ઞાન અંગેના સામયિકો વાંચે તેમજ અન્ય સામયિકોમાંથી વિજ્ઞાન લેખો વાંચે તે માટે ‘આ અઠવાડિયાનું અવનવું’ એ શીર્ષક હેઠળ શાળાના બુલેટિન બોર્ડ પર સામયિકોમાંથી વાંચવા જેવી વિગતો પસંદ કરીને મૂકવી જોઈએ.
- **પ્રોજેક્ટ :** વિજ્ઞાનમંડળના ઉપક્રમે વિવિધ પ્રકારના પ્રોજેક્ટ હાથ ધરી શકાય. દા.ત. સુથારી-લુહારી કામનો મહાવરો, શક્તિનાં ઉદ્ગમો, અવકાશયાત્રી, સસ્તી પ્રયોગશાળા વિદ્યુતપ્રવાહનો અભ્યાસ વગેરે.
- **બુલેટિન બોર્ડ :** શાળામાં કે લેબોરેટરીમાં વિજ્ઞાનના વિષય માટે એક ખાસ બુલેટિન બોર્ડ રાખવામાં આવે જેમાં વિજ્ઞાનની શોધખોળ, ફોટા, ચિત્રો, નોવેલ છાપાંઓ, સામયિકો વગેરેનાં કટિંગ્સ વગેરે મૂકી શકાય. બુલેટિન બોર્ડ સજાવવાની જવાબદારી વિજ્ઞાનમંડળના કોઈ વિદ્યાર્થી સભ્યને સોંપી શકાય.
- **અભ્યાસેતર બાબતોનો અભ્યાસ :** પાણીના વિવિધ સ્ત્રોતો, પાણીનું શુદ્ધિકરણ, પાણીની વહેંચણી, ગંદા પાણીનો નિકાલ, પાણીનું મલિનીકરણ, મલિન પાણીથી ફેલાતા રોગો, ઉંદર - મચ્છર વગેરેનો ત્રાસ દૂર કરવાના પ્રયોગો, શહેરના ઉદ્યોગો, રાજ્યની કે દેશની વિદ્યુત ઉત્પાદનની યોજનાઓ, બરફ બનાવવાનું કારખાનું વગેરે જેવી બાબતોનો અભ્યાસ હાથ ધરી શકાય.
- **ચર્ચા સભા :** વિજ્ઞાનના ખાસ વિષય પર તેમજ વિવાદાસ્પદ કે સમસ્યાત્મક બાબતો પર ચર્ચાસભા યોજી શકાય. અધ્યેતાઓ આ ચર્ચા કરે. બહારના કોઈ નિષ્ણાતને પ્રમુખ તરીકે આમંત્રણ આપી શકાય.
- **પ્રશ્નપેટી :** શાળાના અધ્યેતાઓ વિજ્ઞાનને લગતા પ્રશ્નો કે વિજ્ઞાનના કોયડા આ પેટીમાં મૂકે. સપ્તાહમાં એકવાર કે મહિને એકવાર વિજ્ઞાનમંડળની સભામાં કે સમગ્ર શાળાની સભામાં મંડળના ઉત્સાહી વિદ્યાર્થી સભ્યો કે અધ્યાપક સભ્યો તેના નવા ઉત્તરો આપે એવી વ્યવસ્થા કરવી જોઈએ.
- **અધ્યેતાઓનાં વક્તવ્યો :** કોઈ એક વિષય પસંદ કરી તેના પર સંપૂર્ણ તૈયારી કરી અધ્યેતાઓ વક્તવ્યો આપે, જેમ કે સંરક્ષણમાં વિજ્ઞાન, અણુવિજ્ઞાન - આશીર્વાદ કે શાપ જેવા વિષયો પર દ્વિપક્ષી વિવાદ ગોઠવાય. અધ્યેતાઓ દ્વારા સંવાદ રચના કે લઘુ નાટ્યીકરણ સ્ટેજ પર રજૂ કરવામાં આવે.
- **શિક્ષકો અને નિષ્ણાંતોનાં વક્તવ્યો અને પરિસંવાદો - વ્યાખ્યાન માળાઓ :** શિક્ષકોની ચર્ચાસભાઓ, શૈક્ષણિક સાધનો બનાવવાની રીતો અંગેનાં વક્તવ્યો, રોગ અને તેનું નિવારણ

એ અંગે ડોક્ટરનું પ્રવચન, વિજ્ઞાનના જુદા જુદા વિષયો માટે તેના ખાસ નિષ્ણાત વૈજ્ઞાનિકોનાં પ્રવચનો ગોઠવી શકાય.

- **પ્રવાસ-પર્યટન :** ટેલિફોન એક્સચેન્જ ઓફિસ, શહેરની કોલેજોની કે અન્ય ખ્યાતનામ, પ્રયોગશાળાઓ, વીજળીનું કારખાનું, ગ્લાસ ફેક્ટરી, ખાતરનું કારખાનું, દવાની ફેક્ટરીઓ, મોટાં દવાખાનાં, ઉદ્યોગો, રેડિયો સ્ટેશન વગેરે સ્થળોની મુલાકાત માટે પ્રવાસ-પર્યટનો ગોઠવવાં જોઈએ.
- **પ્રશ્નોત્તરી અને કોયડા :** નિષ્ણાંત વ્યક્તિઓને વિજ્ઞાનમંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવે, જેના દ્વારા અધ્યેતાઓ તેમના પ્રશ્નો અને કોયડાઓ કે સમસ્યાઓના ઉત્તરો મેળવી શકે. આ રીતે અધ્યેતાઓ પ્રશ્નો પૂછાતા થાય છે.
- **પૂરક પ્રયોગો :** સરકારના કેળવણી ખાતાએ નક્કી કરેલા ફરજિયાત કરવાના પ્રયોગો ઉપરાંત અન્ય પૂરક પ્રયોગો, લઘુપ્રયોગો અને નવીન પ્રયોગો અધ્યેતાઓ પાસે કરાવી શકાય.
- **લેખવાંચન :** કોઈ એક વિષય પર અધ્યેતા સ્વપ્રયત્ને માહિતી ભેગી કરી લેખ તૈયાર કરે અને શાળાસભા સમક્ષ વાંચે. લેખવાંચન બાદ તેના પર પ્રશ્નોત્તર થાય. જેમાં લેખવાંચન કરનાર તેના ઉત્તરો આપે.
- **ચલચિત્ર - ફિલ્મસ્ટ્રીપ :** વિજ્ઞાન વિષયક ફિલ્મો કે ફિલ્મ સ્ટ્રીપો ક્યાંથી મળી શકે તેની માહિતી શિક્ષક પાસે હોવી જોઈએ. આવી ફિલ્મો મેળવી તેનો લાભ શાળાના બધા જ અધ્યેતાઓને આપવો જોઈએ.
- **વિજ્ઞાન અંક :** વિજ્ઞાનનો હસ્તલિખિત અંક તૈયાર કરવામાં આવે જેમાં દરેક અધ્યેતાને પોતાની કૃતિ રજૂ કરવાની તક મળે. આ અંક હસ્તલિખિત, સાઈકલોસ્ટાઈલ કે મુદ્રિત સ્વરૂપમાં હોઈ શકે.
- **હવામાન કેન્દ્ર :** તેનું સંચાલન પણ વિદ્યાર્થીઓને સોંપી શકાય. તેઓ દરરોજના તાપમાનની નોંધ કરે, લઘુત્તમ - મહત્તમ તાપમાન, હવાનો ભેજ, પવનની દિશા, પવનનો વેગ, જ્યાં જરૂર પડે તે વિગતોના આલેખ વગેરે જેવી બાબતો વિજ્ઞાનના ખાસ બુલેટિન બોર્ડ પર આ હવામાન કેન્દ્ર દ્વારા પ્રદર્શિત કરવામાં આવે.
- **વિજ્ઞાનમેળો અને પ્રદર્શન :** આમાં વિદ્યાર્થીઓની કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવે, સાથે વિજ્ઞાનમંડળની અન્ય પ્રવૃત્તિઓ અંગેના કાર્યક્રમો પણ રાખવામાં આવે તો તેને વિજ્ઞાનમેળો કહે છે. તેમાં ચર્ચા સભાઓ, નિષ્ણાંતોનાં પ્રવચનો, વૈજ્ઞાનિકો સાથે ખુલ્લી ચર્ચા, નમૂના, સાધનો, ચાર્ટ્સ વગેરેની હરીફાઈ પણ રાખી શકાય.
- **વિજ્ઞાન-દિનોની ઉજવણી :** વૈજ્ઞાનિકોની જન્મ જયંતિઓ કે મૃત્યુ તિથિઓની ઉજવણી થઈ શકે. દા.ત. મેડમ ક્યુરી, લુઈ પાશ્ચર, ડૉ. જેનર વગેરે. વિજ્ઞાનના અધ્યાપકે તે માટે સમય કમાનુસાર યાદીઓ બનાવવી જોઈએ. આવી લાંબી યાદીમાંથી દર વર્ષે ચાર-પાંચ વિજ્ઞાન દિનો ઉજવવા જોઈએ.
- **પ્રાથમિક સારવાર કેન્દ્ર :** શાળામાં કે શાળા બહાર બનતા સામાન્ય અકસ્માતો વખતે સારવાર આપી શકાય એ હેતુથી વિજ્ઞાનમંડળના ઉપક્રમે આવું કેન્દ્ર કાયમી ધોરણે ચલાવી શકાય, જેની જવાબદારી વિજ્ઞાનમંડળના કોઈ સભ્યને સોંપી શકાય. આ માટે પ્રાથમિક સારવાર પેટી શાળામાં વસાવવી. રેડક્રોસ સોસાયટીની મદદથી પ્રાથમિક સારવારના વર્ગો પણ ચલાવી શકાય. તેમાં છોકરીઓ પણ જોડાઈ શકે એ તેની વિશેષતા છે. આ કેન્દ્રે સમાજમાં રક્તદાન, ચક્ષુદાન, કીડની, દાન, દેહદાન વગેરે માટે લોકમત કેળવવો જોઈએ.
- **સંગ્રહો તૈયાર કરવા :** વિજ્ઞાનને લગતી માહિતીના સંગ્રહો તૈયાર કરી શકાય. આવું વિજ્ઞાનનું અલગ નાનકડું સંગ્રહાલય વિકસાવી શકાય અને દર વર્ષે તેમાં અવનવી વસ્તુઓના સંગ્રહો બનાવી તેમનો ઉમેરો કરી શકાય. આવા સંગ્રહોમાં પતંગિયા, છીપલાં, પીછાં, મૂળ, પ્રકાંડ, પર્ણ વગેરે સાચવીને રાખી શકાય.

- **વૈજ્ઞાનિક સાધનોનાં મોડેલ્સ અને નમૂના તૈયાર કરવા :** વિવિધ વૈજ્ઞાનિક સાધનોનાં મોડેલ્સ અને નમૂના તૈયાર કરાવી શકાય. સાધનોનાં જરૂર મુજબ મોટાં કે નાનાં મોડેલ બનાવી તેની સૈદ્ધાંતિક સમજ, આંતર-રચના કાર્ય વગેરેની સમજ મેળવી શકાય. કેટલાંક સાધનોના ફેરફાર સાથેનાં મોડેલ્સ બનાવી શકાય. આકૃતિ પરથી સાધન બનાવી શકાય અને કેટલાક મૌલિક નમૂનાઓનું સર્જન પણ થઈ શકે.
- **આકાશદર્શન :** અધ્યેતા ગ્રહો, તારામંડળો, તારાઓ, નક્ષત્રો વગેરેથી પરિચિત થાય તે માટે આવો કાર્યક્રમ ગોઠવી શકાય, જેમાં અધ્યાપક માર્ગદર્શન આપે. શાળાએ આ માટે શક્તિશાળી દૂરબીન વસાવવું. ખગોળના કોઈ નિષ્ણાંતને પણ આકાશદર્શન કરાવવા માટે બોલાવી શકાય.
- **અભ્યાસવર્તુળ :** આવા અભ્યાસવર્તુળના ઉપક્રમે વિજ્ઞાનમાં નબળા અધ્યેતાઓને મદદ કરી શકાય.
- **જાદુઈ પ્રયોગો :** વિજ્ઞાનને લગતા અતિશય રસપ્રદ એવા જાદુઈ પ્રયોગો હાથ ધરવા અને તેના દ્વારા લોકોની અંધશ્રદ્ધા દૂર કરવી. આવા પ્રયોગોમાં ચમત્કારો બતાવતા પ્રયોગો લીબું નીચોવવું, દાણા ચણતો પોપટ, હાથમાંથી કંકુ ખરવું, કંકુ પગલાં પડવાં વગેરેનો સમાવેશ થઈ શકે.
- **આલબમ્સ - ચિત્રસંગ્રહ :** વિજ્ઞાનમંડળના સભ્યો ચિત્રો, ફોટાઓ વગેરેનો સંગ્રહ કરી તેમનાં આલબમ્સ બનાવી શકે. પર્યટનના ફોટા, ગુજરાતના, ભારતના અને વિશ્વના ખ્યાતનામ વૈજ્ઞાનિકો, ભારતની રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ, તબક્કાવાર વિકાસ પામેલી વસ્તુઓ વગેરેના ફોટાઓનાં પણ આલબમ્સ બનાવી સુરક્ષિત રાખી શકાય.
- **પ્રયોગશાળાનાં સાધનોની મરામત :** શાળાના વિજ્ઞાન શિક્ષકો અને અધ્યેતાઓ કામ કરી શાળાને આર્થિક ફાયદો કરી આપી શકે અને સાથે સાથે પોતાનાં જ્ઞાન અને કૌશલ્ય વધારી શકે.
- **વિજ્ઞાન વિષયક ટૂંકા અભ્યાસવર્ગો ચલાવવા :** વિજ્ઞાનમંડળ દ્વારા ટૂંક સમયના આવા અભ્યાસવર્ગો રાત્રિના સમયે કે વેકેશન દરમ્યાન ગોઠવી શકાય. આવા વર્ગોમાં પ્રાથમિક સારવાર, ફોટોગ્રાફી, પ્રક્ષેપણ માટેનાં દ્રશ્ય-શ્રાવ્ય સાધનોનાં પ્રોજેક્ટરોનું સંચાલન, વાયરમેન, રેડિયો, ટી.વી. રીપેરીંગ વગેરેનો સમાવેશ કરી શકાય, જેને માટે તજજ્ઞ વ્યક્તિઓની સવેતન સેવા લઈ શકાય.
- **ઘરગથ્થુ ઉપયોગી પદાર્થો બનાવવા :** શાહી, સાબુ, દંતમંજન, ડીટર્જન્ટ પાવડર, બામ, વિક્સ, ફેસ પાવડર વગેરે જેવા પદાર્થો વિજ્ઞાનમંડળના ઉપક્રમે બનાવી શકાય.
- **રચનાકાર્ય :** શાળામાં શાળાભાગ, જંતુગૃહ, માછલીગૃહ સંગ્રહાલય વગેરેની રચના કરવાનું અને તેમની જાળવણીનું કાર્ય વિજ્ઞાનમંડળ દ્વારા કરી શકાય.
- **કુરસદના સમયનો સદુપયોગ :** નકામી વસ્તુઓમાંથી વિવિધ સાધનો, રમકડાં કે મોડેલ તૈયાર કરી શકાય.
- **વિવિધ કસોટીઓની તૈયારી માટે વર્ગ :** વિજ્ઞાન પ્રતિભાશોધ, શાળાની સામયિક કસોટીઓ વગેરેની તૈયારી માટેના વર્ગો શાળા સમય ઉપરાંત વધારાના સમયમાં પ્રયોજી વિદ્યાર્થીઓ તેમાં વધુને વધુ સિદ્ધિ મેળવી શકે તે માટે તેમને તૈયાર કરી શકાય.
- **દ્વિમાગ કસોટી (Quiz) :** પખવાડિયે કે મહિને એકવાર શાળા સભામાં વિજ્ઞાન અંગેનો Quiz નો કાર્યક્રમ ગોઠવી શકાય. આનાથી અધ્યેતાઓમાં શીઘ્ર ઉત્તરો આપવાનું કૌશલ્ય કેળવાશે.
- **રેડિયો વાર્તાલાપ :** વિજ્ઞાનમંડળના સભ્યો દ્વારા અવારનવાર વિજ્ઞાનને લગતા રેડિયો કાર્યક્રમો શાળાના ટેપરેકોર્ડર પર ઝીલી અનુકૂળ સમયે વર્ગોમાં તે સંભળાવી શકાય.
- **ક્રિયાશીલ (Working) નમૂના બનાવવા :** પિચકારી, જળશોષક પંપ, વાયુશોષક પંપ, દ્રવતુલા, ચુંબકીય રાક્ષસ વગેરે જેવા નમૂના ચાલુ હાલતમાં જોઈ અધ્યેતાઓ પ્રત્યક્ષ જ્ઞાન મેળવી શકે છે.



- **સંશોધન :** કોઈ નાનકડા સંશોધનનો પ્રોજેક્ટ લઈ, તેના પ્રયોગો કરી રીપોર્ટ તૈયાર કરી શકાય. દા.ત. એકને બદલે બે દોરી, ત્રણ દોરી, બે આધાર પર બે દોરી, ચાર દોરીથી લટકતા હીંચકા પ્રકારના લોલકનાં આંદોલનોનો અભ્યાસ, વિવિધ પ્રવાહીઓનાં ઉત્કલન બિંદુ પર દ્રવ્ય ઘન પદાર્થો અને મિશ્ર થતા પ્રવાહીની અસરો તપાસવી વગેરે.

## 2.4 આકાશ દર્શન

- **ભૂમિકા :** વિજ્ઞાનના અભ્યાસક્રમમાં ખગોળશાસ્ત્રને ઓછું મહત્વ આપવામાં આવે છે. વિજ્ઞાનનો ઈતિહાસ જોઈશું તો તેમાં ખગોળશાસ્ત્રને ઘણું જ મહત્વ આપવામાં આવેલ છે. આજનો યુગ તો અવકાશ યુગ છે. માનવી ચંદ્ર પર પહોંચ્યો છે અને મંગળ પર જવાની તૈયારી કરી રહ્યો છે. માનવે પોતાના ઉપયોગ અને સગવડ માટે કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં તરતા મૂક્યા છે. તરતી પ્રયોગશાળાઓ પણ તેણે અવકાશમાં બનાવી છે. શાળા કક્ષાએ ખગોળશાસ્ત્રમાં સૂર્ય, સૂર્યમંડળ, ધૂમકેતું, નક્ષત્રો, રાશિઓ, ચંદ્ર, તારા, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કા વગેરેનો અભ્યાસ કરવાનો હોય છે. હજી આજે પણ વિજ્ઞાનના અધ્યાપકો ખગોળશાસ્ત્રની આ બધી બાબતો ચાર્ટની મદદથી કે કા.પા. પર આકૃતિઓ દોરીને શીખવે છે. તેનાથી તેમને તેનો વાસ્તવિક ખ્યાલ મેળવવા અને તે અંગેના પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડવા માટે અધ્યાપકે અધ્યેતાઓને યોગ્ય સમયે આકાશદર્શન કરાવવું જ જોઈએ. વિજ્ઞાનમંડળના ઉપક્રમે પણ આ કાર્યક્રમ પણ યોજી શકાય.

### ◆ આકાશદર્શનનું મહત્વ :

- અધ્યેતાઓને આકાશી પદાર્થોનો વાસ્તવિક ખ્યાલ આવે છે. તેઓ વિવિધ આકાશી પદાર્થોની ઓળખ મેળવે છે અને તેમને પ્રથમદર્શી અને પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડી શકાય છે.
- પૃથ્વી પર બનતી વિવિધ ઘટનાઓ જેવી કે રાત-દિવસ, ઋતુઓ, ભરતીઓટ, ચુંબકીય તોફાન, ગ્રહણ વગેરે જે માનવજીવન પર ઊંડી અસર કરે છે તે ઘટનાઓ અવકાશી પદાર્થોની ગતિના કારણે જ બને છે તેની અધ્યેતાઓ સમજ કેળવે છે.
- દરિયામાં નાવિકો અને પ્રવાસીઓ, રણપ્રદેશમાં વસતા લોકો તેમ જ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો દિશા અને સમય અવકાશી પદાર્થોના આધારે જ નક્કી કરી તેની સમજ મેળવે છે.
- અધ્યેતાઓને વિશ્વની અને બ્રહ્માંડની વિશાળતાનો અનુભવ થાય છે.
- વિવિધ પદાર્થોના સ્પર્શથી તેમના વિષેનો વાસ્તવિક ખ્યાલ અધ્યેતાઓને આવે છે, જેથી તેઓ કુદરતી ઉત્તેજના અનુભવી વધારે જ્ઞાન પ્રાપ્તિ કરે છે. વળી તેમનામાં જૂથમાં કામ કરવાની તાલીમ, સંઘભાવના, સાહસવૃત્તિના ગુણો વગેરે વિકસે છે.
- અધ્યેતાઓ ખગોળશાસ્ત્રનું મહત્વ સમજે છે, જુદા જુદા ખગોળ શાસ્ત્રીઓના પ્રદાનથી તેઓ પરિચિત બને છે અને ખગોળશાસ્ત્રમાં રસ લેતા થાય છે.
- પ્રવાસ દરમ્યાન કે અજાણ્યા સ્થળે આકાશી પદાર્થોનું જ્ઞાન સમયસૂચક અને દિશાસૂચક નકશાની ગરજ સારે છે.
- જ્યોતિષશાસ્ત્ર અને પંચાંગમાં પણ અવકાશી પદાર્થોની ગતિ અને અભ્યાસ ખૂબ જ ઉપયોગી નીવડે છે.
- આકાશી પદાર્થોના માનવીના મન પર પણ અસર કરે છે. તેમના નિરીક્ષણથી વ્યક્તિનું મન પ્રસન્નતા અનુભવે છે અને અધ્યેતાઓની કલ્પનાશક્તિનો પણ વિકાસ થાય છે.
- આકાશદર્શનથી અધ્યેતાઓને ખગોળશાસ્ત્ર સમજવું સહેલું પડશે તેમજ વિશ્વના અગાધ ઊંડાણમાં ડોકિયું કરવાનું તેમને મન થશે.
- શાળા આયોજિત આકાશદર્શન કર્યા પછી ઘેર પણ રાત્રે આકાશનું નિરીક્ષણ કરવાની તેમને ટેવ પડશે અને ખગોળશાસ્ત્રનું વધુને વધુ જ્ઞાન પ્રાપ્ત કરતા થશે.

◆ આકાશદર્શન કાર્યક્રમનું આયોજન :

- **પૂર્વતૈયારી :** અધ્યાપકે પોતે જ આ કાર્યક્રમનું આયોજન કરવું. એ માટે તેણે પોતે અધ્યેતાઓને ખગોળશાસ્ત્રના પોતે જે મુદ્દાઓ શીખવવાના છે તે અંગે પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત કરી લેવી જોઈએ. એટલું જ નહિ, પણ તેણે ખગોળશાસ્ત્રનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અધ્યાપક પોતે અભ્યાસ માટે આવશ્યક એવો દરેકે દરેક તારો, નક્ષત્ર, રાશિ, તારામંડળો, ગ્રહો, ઉપગ્રહો વગેરેથી પરિચિત હોવો જોઈએ, તેને તેનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ અને આકાશમાં તેમને ઓળખી બતાવવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. તો જ તે અધ્યેતાઓને ખગોળશાસ્ત્રનું સચોટ જ્ઞાન આપી શકે. કયા માસમાં ક્યારે કયા સમયે આકાશનું ચિત્ર કેવું હોય તેનો તેણે સંદર્ભગ્રંથોમાંથી અભ્યાસ કરી લેવો જોઈએ. તથા આકાશનું વાસ્તવિક દર્શન કરી લેવું જોઈએ. આકાશદર્શન માટેના નકશાઓ તેમજ ચાર્ટ પણ તેણે તૈયાર કરી લેવા જોઈએ. ક્યારે કઈ કઈ બાબતોનું નિરીક્ષણ શક્ય બનશે તે પણ તેણે નક્કી કરી લેવું જોઈએ. વર્ગમાં તે અંગે પ્રાથમિક માહિતી તેણે અગાઉથી આપવી.
- **સ્થળ :** આજુબાજુમાં પણ નજીકમાં કોઈ ટેકરી, ખુલ્લું મેદાન કે કોઈ ઊંચી ઈમારત હોય તે સ્થળ પસંદ કરવું. ચાલીને જઈ શકાય એટલા અંતરે આ સ્થળ હોવું જોઈએ. સ્થળ દૂર હોય તો વાહનની વ્યવસ્થા કરવી જોઈએ. સ્થળની આજુબાજુ મોટાં કારખાનાં, મોટા ઉદ્યોગો, મિલો વગેરે ન હોવાં જોઈએ, કારણ કે તેમની લાઈટનો પ્રકાશ બધે ફેલાઈ જાય છે, જે આકાશદર્શનમાં અવરોધરૂપ બને છે. આકાશદર્શનનું સ્થળ ગામ કે શહેરથી થોડુંક દૂર હોવું જોઈએ કે જેથી સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ પણ અવરોધ રૂપ ન બને. વાહનોની અવરજવર પણ ન હોવી જોઈએ, કારણ કે વાહનોની લાઈટ પણ અવરોધરૂપ બને છે. આકાશ પૂરેપૂરું ખુલ્લુ દેખાય એવું સ્થળ પસંદ કરવું.
- **સમય :** અધ્યાપક રાત્રે બધા જ અધ્યેતાઓને બોલાવે. છોકરીઓની સાથે કે છોકરાઓની સાથે વાલીઓ આવવા માગતા હોય તો તેમને પણ મંજૂરી આપવી. કૃષ્ણપક્ષની સાતમ કે આઠમનો સમય આકાશદર્શન માટે પસંદ કરવો, કારણ કે આ દિવસો દરમિયાન આકાશમાં માપસરનો પરાવર્તિત સૂર્યપ્રકાશ આવતો હોય છે તેથી ખૂબ જ વધારે પણ નહિ અને ખૂબ જ ઓછા પણ નહિ એવા માપસરના તારાઓ દેખાતા હોય છે. અન્ય સમયે જરૂર કરતાં વધુ કે ઓછા તારાઓ દેખાય છે જે પણ આકાશદર્શન માટે અવરોધરૂપ છે. આકાશ વાદળાળું હોય તેવો સમય પસંદ ન કરવો. ચોમાસા સિવાયનો સમય વધુ અનુકૂળ છે. રાત્રે 9 થી 10 વાગ્યાનો સમય વધુ અનુકૂળ એટલા માટે છે કે ત્યારે વાતાવરણ શાંત થઈ જાય છે.
- **અધ્યેતાઓની સંખ્યા :** વર્ગના બધા અધ્યેતાઓ જોડાઈ શકે છે, પરંતુ રસ ધરાવનારા અને વિજ્ઞાનમંડળના સભ્યો હોય તેવા અધ્યેતાઓ માટે પણ આકાશદર્શનનો અલગ કાર્યક્રમ યોજી શકાય.
- **મંજૂરી :** આ કાર્યક્રમમાં જોડાનાર અધ્યેતાઓની, તેમના વાલીઓની, શાળાના આચાર્યોની અને સ્થળના માલિકની પૂર્વ મંજૂરી લેવી જોઈએ.
- **સાધનસામગ્રી :** આકાશદર્શન માટે નીચેની સાધનસામગ્રી આવશ્યક છે :
  - (i) **દૂરબીન :** આ માટે સરળતાથી ફેરવી શકાય તેવું શક્તિશાળી દૂરબીન જરૂરી બને છે. જો આવું દૂરબીન શાળામાં ન હોય તો બીજા શાળામાંથી કે અન્ય જગ્યાએથી મેળવી લેવું.
  - (ii) **બાયનોક્યુલર :** શક્ય હોય તો બધા અધ્યેતાઓ બાયનોક્યુલર લઈને આવે તેવી સૂચના આપવી. આ શક્ય ન બને તો શક્ય બને એટલા બાયનોક્યુલરની વ્યવસ્થા શાળાએ કરવી.
  - (iii) **ટોચ :** ચાર સેલની લાંબી અને શક્તિશાળી ટોચનો ઉપયોગ કરવો. આંખે જોઈ શકાય તેવા આકાશી પદાર્થો તરફ આ ટોચ ધરવાથી આકાશમાં તેનો લીસોટો પડશે, જે

માર્ગદર્શકની ગરજ સારશે. આ લિસોટો જેમ ફરે તેમ પોતાની આંખ ફેરવી અધ્યેતાઓ જુદા જુદા આકાશી પદાર્થો જોઈ શકશે. જુદા જુદા તારા, ગ્રહો તારામંડળો, ઉપગ્રહો સાથે જોડાયેલી પૌરાણિક વાર્તાઓ પણ સાથે સાથે અધ્યાપક કહેતા જશે તો અધ્યેતાઓને વધારે રસ પડશે અને કાર્યક્રમ તેમને માટે કંટાળાજનક નહીં બને.

◆ આકાશદર્શન માટે ધ્યાનમાં રાખવાની બાબતો :

- નિશ્ચિત સમયે બધા અધ્યેતાઓ સ્થળ પર પહોંચે પછી કાર્યક્રમ શરૂ થયાની જાહેરાત કરવી, જેથી બધા શાંત થઈ જાય.
- અગાઉથી નિષ્ણાત વ્યક્તિનો સંપર્ક કરી તેમનું માર્ગદર્શન અને મદદ મેળવવાં. જો અધ્યાપક પોતે અભ્યાસક્રમના મુદ્દાઓ પૂરતું આકાશદર્શન કરાવે અને પછી વધુ રસ પડે અને જો અધ્યેતાઓ વધુ જાણવાની ઈચ્છા ધરાવે તો તેવા અધ્યેતાઓ માટે ખગોળશાસ્ત્રના નિષ્ણાતને બોલાવી ફરીથી આવો કાર્યક્રમ ગોઠવી તેમને અભ્યાસક્રમ સિવાયનું વધારે જ્ઞાન આપવું.
- આ કાર્યક્રમ પછી ક્યારેક કૃત્રિમ નભોમંડળ (Planetarium) કે વેદશાળા (Observatory)ની મુલાકાત ગોઠવવી.
- આકાશદર્શનની શરૂઆત પૂર્વ દિશાથી કરવી અને સૌપ્રથમ ઊગતા તારા, નક્ષત્રો વગેરેનો અભ્યાસ કરાવવો. પૂર્વ દિશાથી આઠ અંશમાં ક્રાંતિવૃત્તમાં નક્ષત્રો જોવાનો પ્રયત્ન કરવો. ઉત્તર દિશામાં ધ્રુવ દર્શન કરાવવું. ધ્રુવનો સપ્તર્ષિ અને શર્મિષ્ઠા નક્ષત્ર સાથેનો સંબંધ સ્પષ્ટ કરવો.
- બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ વગેરે ગ્રહોનું તેમના રંગ, સપાટી, ઉપગ્રહો વિશે માહિતી આપીને અવલોકન કરાવવું.
- અધ્યાપક ચોક્કસ વસ્તુનો નિર્દેશ કરે ત્યારે અધ્યેતાઓ આકાશમાં આડું-અવળું ન જોતાં તે જ વસ્તુ જુએ અને સમજે તેવી સૂચના તેમને આપવી.
- વિવિધ તારાઓ, આકાશગંગાનો પટ્ટો, રાશિઓ, નક્ષત્રો, તારક જૂથો વગેરેનું અધ્યેતાઓને અવલોકન કરાવવું અને તે અંગે સમજ આપવી.

◆ આકાશદર્શનના કાર્યક્રમમાં પડતી મુશ્કેલીઓ :

- વિજ્ઞાન શિક્ષકોમાં ખગોળશાસ્ત્રના જ્ઞાનનો અભાવ હોય છે. ઘણાને આકાશદર્શનના કાર્યક્રમમાં રસ હોતો નથી. શિક્ષિકાઓ આવો રાત્રિનો કાર્યક્રમ ગોઠવવા માટે તૈયારી બતાવતી નથી.
- આકાશદર્શન માટે અધ્યાપકો એ કોઈ તાલીમ મેળવેલી હોતી નથી.
- અભ્યાસક્રમમાં અને તેથી પરીક્ષાઓમાં ખગોળશાસ્ત્રને વિશેષ મહત્ત્વ આપવામાં આવતું નથી. તેથી પરીક્ષાલક્ષી માનસ ધરાવતા અધ્યાપકો અને અધ્યેતાઓને તેમાં રસ પડતો નથી.
- રાત્રે કાર્યક્રમ યોજવાનો હોવાથી બધા વાલીઓ સંમતિ ન પણ આપે.
- અધ્યાપક નિર્દેશ કરે તે જ વસ્તુ અધ્યેતાઓ જુએ છે કે નહિ તે જાણી શકાતું નથી.
- ખગોળશાસ્ત્રના જાણકાર શિક્ષકો, અન્ય કોઈ નિષ્ણાતો કે માર્ગદર્શક વ્યક્તિઓનો અભાવ વર્તાય છે.
- આકાશદર્શન માટે જરૂરી કિંમતી સાધનો બધી શાળાઓ પાસે હોતાં નથી.
- બધા અધ્યેતા પાસે બાયનોક્યુલર જેવાં સાધનો નહીં હોવાથી તેઓ વારાફરતી તેમાં જુએ છે તેથી સમયનો પુષ્કળ વ્યય થાય છે. આમ કરવાથી અવ્યવસ્થા પણ સર્જાય છે.
- આવા કાર્યક્રમો માટે મોટેભાગે શાળા મેનેજમેન્ટ, આચાર્ય, અન્ય અધ્યાપકો અને વાલીઓ તરફથી પ્રોત્સાહન આપવામાં આવતું નથી.

◆ ઉપસંહાર :

વિજ્ઞાન શિક્ષણ એ માત્ર સરકાર દ્વારા પ્રકાશિત અભ્યાસક્રમ કે તેના આધાર પર રખાયેલ

પાઠ્યપુસ્તક પૂરતું જ મર્યાદિત હોઈ શકે નહિ. વિજ્ઞાન શિક્ષણ દ્વારા અધ્યેતાઓમાં વિજ્ઞાનને લગતા વિશિષ્ટ ગુણો ખીલવવાનો પણ હેતુ તેમાં રહેલો છે. અધ્યેતા તેની સમક્ષ ઉદ્ભવેલી કોઈ સમસ્યાના ઉકેલ માટે વિશિષ્ટ પ્રક્રિયા અપનાવે તે તરફ વિજ્ઞાન અધ્યેતાનું ધ્યાન દોરે છે. માટે જ વર્ગ અધ્યાપનકાર્ય ઉપરાંત સહાયક પ્રવૃત્તિઓનું વિશેષ મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. વળી પર્યટન, આકાશદર્શન, પ્રદર્શન, વિજ્ઞાનમંડળ અને તેની પ્રવૃત્તિઓ વગેરે જેવી વિજ્ઞાન શિક્ષણને સહાયક પ્રવૃત્તિઓ દ્વારા વિજ્ઞાનની વિશિષ્ટ પ્રક્રિયા એટલે કે વલણ ઘડતરનું કાર્ય કરી શકાય છે. વિવિધ પ્રવૃત્તિઓ વિજ્ઞાનના અધ્યાપનમાં વિવિધ મહત્ત્વ ધરાવે છે અને વિશિષ્ટ પ્રદાન કરે છે તેથી જો વિજ્ઞાનના અધ્યાપનને સમૃદ્ધ, રસસભર, શ્રેષ્ઠ અને અસરકારક બનાવવું હશે તો તેમાં પ્રસંગોપાત્ત વિજ્ઞાન શિક્ષણનો સહાયક પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવો જ રહ્યો.

## 2.5 ક્ષેત્ર પર્યટન

### ◆ ભૂમિકા :

શિક્ષણનું કાર્ય વર્ગખંડમાં જ થઈ શકે અને ત્યાં શિક્ષક ભણાવે એ ખ્યાલ હવે જૂનો થઈ ગયો છે. શિક્ષણને જીવંત બનાવવા અને અધ્યેતાઓને પૂરતા પ્રમાણમાં અધ્યયન અનુભવો પૂરા પાડવા જુદી જુદી શૈક્ષણિક પદ્ધતિઓ અને શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. જેની મદદથી મર્યાદિત અધ્યયન અનુભવો જ પૂરા પાડી શકાય છે. વર્ગખંડની ચાર દીવાલોની બહાર, અધ્યેતાઓ જાતે અનુભવો મેળવીને ઘણું શીખે છે. આમ.....

- “વર્ગખંડની ચાર દીવાલોની બહાર અધ્યેતાઓ સ્વાનુભવે અધ્યયન કરી શકે તેવું એક માધ્યમ એટલે ક્ષેત્ર પર્યટન.”
- “ક્ષેત્ર પર્યટન એટલે અધ્યેતાઓના અનુભવોને સમૃદ્ધ બનાવે તેવું અધ્યાપક દ્વારા આયોજિત, અધ્યાપકના માર્ગદર્શન હેઠળનું પર્યટન.”
- “વર્ગ બહારના કોઈ સ્થળનું સહેતુક આયોજનબદ્ધ નિરીક્ષણ એટલે ક્ષેત્રે પર્યટન.”
- “First hand experience however are so important that well-planned trips should be frequent in all schools.”
- “પ્રથમદર્શી અનુભવો એટલા બધા અગત્યના છે કે તે મેળવવા માટે બધી જ શાળાઓમાં વારંવાર સુઆયોજિત પર્યટનો ગોઠવવાં જોઈએ.”

- **ફ્રીમેન અને બીજો**

આપણા ઋષિ મુનિઓ પણ પોતાના આશ્રમવાસી શિષ્યોના જ્ઞાનમાં વધારો થાય તે માટે પરિભ્રમણને મહત્ત્વ આપતા. આમ આપણા દેશમાં પ્રાચીનકાળથી જ પર્યટનને શિક્ષણ સાથે જોડવામાં આવેલ છે. આજે પણ અધ્યેતા ને જો મૂળભૂત બાહ્ય અનુભવોની સાથે સીધેસીધો જ મૂકવામાં આવે તો શિક્ષણ વધારે દૃઢ અને સુગમ થાય.

“બાહ્યજીવનના વાસ્તવિક અનુભવો અધ્યેતાને સીધેસીધા આપવાની યોજના એટલે પર્યટનો.”

વિજ્ઞાન શિક્ષણમાં કેટલાક વિષયાંગો એવા હોય છે કે જેમાં પ્રત્યક્ષ અનુભવો આપવા માટે અધ્યેતાઓને શાળાની બહાર લઈ જવા પડે અને શક્ય એટલા હેતુલક્ષી અનુભવો આપવા જોઈએ. વર્ગમાં શીખવતી વખતે કેટલીકવાર ચિત્રો, મોડેલ્સ વગેરેનો ઉપયોગ કરવા છતાં કેટલીક બાબતો બરાબર સમજાતી નથી. તેવી બાબતો પ્રવાસે લઈ જઈ પ્રત્યક્ષ જોવાની તક આપતાં સરળ રીતે સમજાય છે. જેમ કે વર્ગમાં થર્મલ વિદ્યુતની વાત કરીએ અને પછી સાબરમતી પાવર હાઉસની મુલાકાતે લઈ જઈએ તો વાસ્તવિક સ્થિતિનો સચોટ ખ્યાલ આપી શકાય. ટી.વી. કાર્યક્રમો કેવી રીતે પ્રસારિત થાય છે તેનો આકૃતિઓ દ્વારા ખ્યાલ આપીએ એને બદલે ટી.વી. સ્ટેશનની મુલાકાતે લઈ જઈએ તો તેની રચના અને કાર્યપદ્ધતિ તે નજરે નિહાળી સચોટ ખ્યાલ મેળવી શકે છે. વર્ગમાં અધ્યાપક - અધ્યેતાઓને નિરપેક્ષ શૂન્ય તાપમાનની વાત કરે છે, પરંતુ જો તેને PRL જેવી રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળાની મુલાકાતે લઈ જઈએ તો તે ત્યાં પ્રત્યક્ષ જોઈ શકે કે ક્યાં વૈજ્ઞાનિક સાધનો કે પદ્ધતિઓથી ન્યૂનતમ તાપમાન -296°C પ્રાપ્ત કરવામાં આવે છે. વળી તે જોઈને અધ્યેતાઓ સ્પષ્ટપણે જાણી શકશે કે આટલું નીચું તાપમાન વાસ્તવમાં શું છે. આવી જ રાષ્ટ્રીય રસાયણ પ્રયોગશાળા પૂનામાં છે અને રાષ્ટ્રીય ધાતુ સંબંધી પ્રયોગશાળા જમશેદપુરમાં છે.

◆ ક્ષેત્ર પર્યટનના લાભ :

- અધ્યેતાઓને જીવંત, મૌલિક અને વાસ્તવિક અનુભવો પૂરા પાડી શકાય છે.
- અધ્યેતાઓને શાળા જીવનના એકધારા વાતવરણમાંથી કંઈક અંશે મુક્તિ મળે છે, કંટાળો દૂર થાય છે અને તાજગી મળે છે.
- વર્ગખંડમાં જે અનુભવો આપવા અનુકૂળ ન હોય તેવા સીધા અને પ્રથમદર્શીય અનુભવો પૂરા પાડી શકાય છે.
- જૂથમાં રહેવાથી અને જૂથમાં કાર્ય કરવાથી અધ્યેતાઓમાં જૂથભાવના પેદા થાય છે.
- વસ્તુને મૂળ સ્વરૂપમાં નિહાળવાની તક પૂરી પાડી શકાય છે.
- કૃત્રિમ ઉત્તેજનાને બદલે કુદરતી ઉત્તેજના દ્વારા જ્ઞાનપ્રાપ્તિ થાય છે.
- જુદા જુદા વિષયો અનુબંધ બાંધવામાં મદદ કરે છે.
- કુદરતી અને સામાજિક વાતાવરણમાંથી વ્યક્તિગત કે સમૂહમાં ઊભા થતાં પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય છે.
- અધ્યેતાઓમાં સામાજિક જવાબદારી સભાનતા તથા નાગરિક મૂલ્યોનો વિકાસ થાય છે.
- અધ્યેતાઓમાં વ્યાવસાયિક સમજ અને માનવીય સંબંધોનો વિકાસ થાય છે.
- અવલોકન કરવું, પોતાની જાતે માહિતી મેળવવી, માહિતીની વ્યવસ્થિત નોંધ કરવી વગેરે ગુણો અધ્યેતાઓમાં ખીલે છે.
- અધ્યેતામાં અવલોકનશક્તિ, કલ્પનાશક્તિ, તર્કશક્તિ, સર્જનશક્તિ, ખોજવૃત્તિ, જિજ્ઞાસાવૃત્તિ વગેરે સંતોષાય છે અને વિકસે છે.
- સ્વઅધ્યયન અને સ્વશોખ માટે અધ્યેતાઓને ઉત્તમ તક પૂરી પાડી શકાય છે.
- વૈજ્ઞાનિક કે વિશેષ વ્યક્તિઓની સ્થળ ઉપર જ મુલાકાત, પરિચય તથા તેમનું કાર્ય નિહાળવાની તક પૂરી પાડી શકાય છે.
- અધ્યેતાઓના વિચારો, લાગણીઓ અને મૂલ્યોમાં પરિવર્તન લાવી શકાય છે.
- પર્યટનને લીધે અધ્યાપક - અધ્યેતા તથા શાળા - સમાજ વચ્ચેના સંબંધો વધારે આત્મીય બને છે.
- પર્યટનથી શિક્ષણના ઘણા હેતુઓ સિદ્ધ થઈ શકે છે.
- પ્રાણીવિજ્ઞાન, વનસ્પતિવિજ્ઞાન, ભૂસ્તરવિજ્ઞાન વગેરેનું જ્ઞાન પ્રવાસના માધ્યમ દ્વારા સરળ, રસપ્રદ, રોચક અને આકર્ષક બનાવી શકાય છે.
- અધ્યેતાઓ વાસ્તવિક અનુભવ દ્વારા જાતે જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરી જ્ઞાન પ્રાપ્ત કરે છે, તેથી જ્ઞાન કાયમી અને ચિરંજીવ બને છે તથા તેઓ વિજ્ઞાનમાં રસ લેતા થાય છે.
- વિજ્ઞાનની શોધો, પ્રગતિ, ઉપયોગિતાનાં પ્રત્યક્ષ દર્શન કરાવી શકાય છે.
- અધ્યેતાઓને વિજ્ઞાનનાં જોખમો અને ભયસ્થાનોથી પરિચિત કરી શકાય છે.
- વનસ્પતિજીવન અને પ્રાણીજીવન વિશેના ખ્યાલો જે વર્ગખંડમાં સ્પષ્ટ રીતે આપી શકતા નથી. તે ક્ષેત્ર પર્યટન દ્વારા આપી શકાય છે.
- અધ્યેતાઓની વિજ્ઞાન વિષયક જિજ્ઞાસા સંતોષી શકાય છે. અને તેમને નવું જાણવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે.
- વર્ગની ચીલાચાલુ શિક્ષણ પદ્ધતિથી થતા નીરસ કાર્યને બદલે નાવીન્ય પ્રેરક રસપ્રદ પ્રવૃત્તિ મળે છે.

- અધ્યેતાઓની વિજ્ઞાન વિષયક પ્રતિભા અને વલણોનો વિકાસ કરી શકાય છે.
- પ્રવાસ પર્યટન દ્વારા અધ્યેતાઓમાં વૈજ્ઞાનિક વસ્તુઓનો સંગ્રહ કરવાની વૃત્તિ વિકસાવી શકાય છે તેમજ વિજ્ઞાન સંગ્રહાલય માટેના નમૂના અને શાળાબાગ માટેના વનસ્પતિના નમૂના એકત્ર કરી શકાય છે.
- કેટલીક વસ્તુઓ કાર્યાન્વિત સ્વરૂપે નિહાળીને શાળામાં તેમના મોડેલ બનાવી શકાય છે.
- શાળાપ્રદર્શન, વિજ્ઞાનમેળો તથા વિજ્ઞાનમંડળ માટે ચિંતનનું ભાથું મળી રહે છે.
- અધ્યાપકને અધ્યેતાઓની વિવિધ પ્રકારની શક્તિઓનો ખ્યાલ આવે છે.
- અધ્યેતાઓની લાગણીઓ અને મૂલ્યોમાં ઈચ્છિત ફેરફારો લાવી શકાય છે, જેમ કે હોસ્પિટલની મુલાકાત દ્વારા અધ્યેતાઓમાં સમાજસેવાની ભાવના, માંદાઓની સારવાર કરવી, દેહદાન, ચક્ષુદાન, રક્તદાન, કિડનીદાન વગેરે પ્રકારની ભાવના જન્મે છે. આમ અધ્યેતાઓમાં સમાજની અન્ય વ્યક્તિઓ પ્રત્યે પ્રેમ અને સદ્ભાવ જન્મે છે.
- વર્ગશિક્ષણ દરમિયાન અધ્યાપકે શીખવેલી બાબતોમાં કોઈ અસ્પષ્ટતા રહી ગઈ હોય તો તેને પ્રવાસ દરમિયાન સ્પષ્ટ કરી શકાય છે.

#### ક્ષેત્ર પર્યટનનાં સ્થળો :

- બરફની ફેક્ટરી, હાથસાળ, બેકરી, સોમિલ, પાવર લુમ્સ, ઓઈલ મિલ, ઘાણી, સાબુ અને ડિજરન્ટની ફેક્ટરીઓ, ચૂનાની ભઠ્ઠી, હીરાના પહેલ પાડવાની ઘંટી, ઈંટો બનાવવાનો ભઠ્ઠો, સિરેમિક્સની ફેક્ટરી-ભઠ્ઠી, તબેલો, નાની ડેરીઓ વગેરે જેવા નાના ઉદ્યોગોની મુલાકાત.
- મિલો, મોટી ફેક્ટરીઓ, પ્રોસેસ હાઉસીંગ, કાપડની મિલ, રંગ બનાવવાના કારખાનાં, દવાઓ, ખાંડ વેજીટેબલ ઘી, વગેરેની ફેક્ટરીઓ, ઈફકો જેવા મોટા ખાતરનાં કારખાનાં, એલેમ્બીક જેવી મોટી કાયની ફેક્ટરીઓ, રિફાઈનરી, તેલના કૂવા, તેલના સ્ટોરેજ પ્લાન્ટ, સિમેન્ટનાં કારખાનાં, ખાણોની મુલાકાત, દૂધની મોટી ડેરીઓ લોખંડનું કારખાનું, સ્ટીલ પ્લાન્ટ, રાસાયણિક પદાર્થો બનાવતાં કારખાના વગેરે જેવા મોટા ઉદ્યોગોની મુલાકાત.
- ટી.વી.ની દુકાન, કમ્પ્યુટરની દુકાન, રેડિયોની દુકાન, સંગીતનાં સાધનોની તથા રીપેરીંગની દુકાન, મિક્સર- ગ્રાઈન્ડર, પ્રેશર કૂકર વગેરેની તથા તેના રીપેરીંગની દુકાન, વેલ્ડીંગની દુકાન, ગેરેજ, ઓઈલ, એન્જિન, વિદ્યુતનાં સાધનોની દુકાન, વર્કશોપ, બેટરી ચાર્જિંગની દુકાન વગેરે જેવી નાની દુકાનો અને ધંધાઓની મુલાકાત.
- ટ્યુબવેલ, પાણીની વ્યવસ્થા અને શુદ્ધિકરણ, રેડિયો સ્ટેશન, ટી.વી.સ્ટેશન, વિદ્યુત સ્ટેશન, ફાયર સ્ટેશન, તાર-ટેલિફોન ઓફિસ, પ્રિન્ટિંગ પ્રેસ, વગેરે જેવી સમાજોપયોગી સંસ્થાઓની મુલાકાત.
- બાંધકામનાં સ્થળોની મુલાકાત જેવાં કે પુલ કે મકાનનું બાંધકામ, કોન્ક્રીટની બનાવટ, ઓફિસ કે મકાનમાં વીજળીનું જોડાણ, એરકન્ડીશનીંગ વગેરે.
- આ ઉપરાંત અગાઉ જણાવેલ સમાજમાં ઉપલબ્ધ સાધનોનો પણ આમાં સમવોશ કરી શકાય.

#### ◆ પ્રવાસ -પર્યટનના પ્રકાર :

- (i) અતિ ટૂંકા પ્રવાસ :** એક કે બે તાસમાં પતી જાય તેવી ફિલ ટ્રીપ્સનો આમાં સમાવેશ થાય છે. જેમ કે શાળાની નજીકની નર્સરી ખેતર, નાની હોસ્પિટલ વગેરે.
- (ii) ટૂંકા પ્રવાસ :** જેમાં આખો દિવસ જાય તેવા પ્રવાસનો આમાં સમાવેશ થાય છે. જેમ કે મિલ કે મોટી ફેક્ટરીની મુલાકાત.
- (iii) લાંબા પ્રવાસ :** દૂરના સ્થળોએ જવાનું હોય અથવા એક કરતાં વધારે સ્થળોની મુલાકાત લેવાની હોય ત્યારે એક કરતાં વધારે દિવસો તેમાં થાય છે, તેથી તેમને લાંબા પ્રવાસ કહેવામાં આવે છે.

◆ પ્રવાસનું આયોજન :

જો પ્રવાસનું અગાઉથી આયોજન કરી તેનો ચિતાર આપી દેવામાં ન આવે તો અધ્યેતાઓ તેની ગંભીરતા સમજતા નથી અને તેને સહેલગાહ સમજી બેસે છે. પરિણામે તેઓ તેમાંથી લેવો જોઈએ એટલો લાભ લઈ શકતા નથી. પ્રવાસના આયોજન માટે નીચેના તબક્કાઓ વિશે વિચારવું જોઈએ, .

- હેતુઓ નક્કી કરવા : અધ્યાપક તેમજ અધ્યેતાઓએ હેતુઓ બાબતમાં સ્પષ્ટ થઈ જવું જોઈએ જેથી પ્રવાસ કરવાની પ્રવૃત્તિઓનું ઘનિષ્ઠ આયોજન કરી શકાય. સામાન્ય રીતે પ્રવાસ-પર્યટન પાછળ નીચેના જેવા હેતુઓ હોઈ શકે :
- વર્ગની ચાર દીવાલોમાંથી કંટાળેલા અધ્યેતાઓ મુક્તિ અને તાજગી મેળવે અને મોકળાશથી બહાર આવે.
- વસ્તુઓના સીધા સંપર્કમાં આવે.
- વિજ્ઞાનની વિવિધ પ્રક્રિયાઓ રૂબરૂ જોઈને તેમનો પ્રત્યક્ષ ખ્યાલ મેળવે.
- વિજ્ઞાનના પાઠો શીખવવા માટે આવશ્યક માહિતી એકઠી કરે.
- પાઠના વિષય પ્રવેશ માટેની ભૂમિકા તૈયાર કરવી.
- પાઠ શીખવ્યા બાદ વિહંગાવલોકન કરવું.
- વિજ્ઞાન અને વિજ્ઞાન શિક્ષણમાં અધ્યેતાઓનો રસ જાગૃત થાય, વલણો કેળવાય અને વિજ્ઞાનની કદર થાય.
- અધ્યાપક અધ્યેતા સંબંધો ઘનિષ્ઠ બને, અધ્યાપકની શક્ય એટલી વધુ મદદ મેળવી શકે.
- અધ્યેતાઓમાં સંઘભાવના અને સહકારની ભાવના વિકસે.
- હેતુઓના સ્પષ્ટીકરણને લીધે શું જોવાનું છે, કઈ રીતે જોવાનું છે તેનો ખ્યાલ અધ્યેતાઓને આવે.
- વિજ્ઞાનનાં નવાં સંશોધનોની સમાજ પરની અસર જોઈ જાણી શકે.
- સ્વઅધ્યયન માટે કૃત્રિમ ઉત્તેજનાઓને બદલે કુદરતી ઉત્તેજનાઓ જગાડવી.
- અવલોકન કરવું, આકૃતિઓ દોરવી, માહિતીની વ્યવસ્થિત નોંધ કરવી, ચર્ચા કરવી, નોંધ પરથી અહેવાલ કરવો વગેરે જેવા ગુણો અધ્યેતાઓમાં ખીલવવા.

પૂર્વ તૈયારી : આ માટે બે બાબતોની વિચારણા કરવી : (અ) ભૌતિક બાબતો (બ) શૈક્ષણિક બાબતો.

(અ) ભૌતિક બાબતો :

- (i) મુલાકાતનાં સ્થળોની પસંદગી : પુસ્તકો, અન્ય અનુભવી શિક્ષકો, અગાઉના પ્રવાસ રીપોર્ટસ અને અન્ય લાગતાં વળગતાં સ્થળેથી પ્રવાસ અંગે અગાઉથી માહિતી એકઠી કરવી, જેથી કયા સ્થળે પહેલાં જવું અને કયા સ્થળે પછી જવું અર્થાત્ કયો રૂટ લેવો તે નક્કી થઈ શકે. આનાથી બિનજરૂરી સમય બગાડશે નહિ અને સમયનો બચાવ થશે.
- (ii) સમય : શાળા બહાર ગામમાં કે ગામથી દૂર પ્રવાસે જવાનું હોય તો નીકળ્યા પછી પાછા આવતાં કેટલો સમય લાગશે તે અંગે વિચારી લેવું જોઈએ.
  - પગે ચાલીને જવાનું છે કે વાહનમાં જવાનું અને તેમાં કેટલો સમય લાગશે તે અંગે વિચારી લેવું.
  - સ્થળની મુલાકાતમાં કેટલો સમય થશે તે અંગે પણ વિચારી લેવું.
  - શાળાએથી નીકળીને શાળાએ પાછા આવતાં કુલ કેટલો સમય લાગશે તે વિચારવું.
  - આ પરથી કયા નિયત સમયે ઉપડવું, કયા સ્થળે ક્યારે પહોંચાશે, દરેક સ્થળે કેટલું રોકાણ થશે, પાછા ક્યારે ફરી શકાશે આ બધી જ બાબતોના સમયનું આયોજન તૈયાર કરવું જોઈએ.

(iii) જરૂરી મંજૂરીઓની વ્યવસ્થા :

- સ્થળના માલિક કે જવાબદાર અધિકારી સાથે અગાઉથી પત્રવ્યવહાર કરી તારીખ, સમય, લઈ જવાની સંખ્યા વગેરે અંગે મંજૂરી મેળવી લેવી. સ્થળની સમજૂતી અંગે જરૂરી સાધનો લઈ જવા જેવાં લાગે તો તેની પણ વ્યવસ્થા કરવી.
- શાળાના આચાર્ય તેમજ સંચાલકોની મંજૂરી પણ અધ્યાપકે અગાઉથી જ મેળવી લેવી.
- અધ્યેતાઓના વાલીઓની લેખિત મંજૂરી પણ અગાઉથી વિજ્ઞાનના અધ્યાપકે મેળવી લેવી.

આ માટે નીચે નમૂનામાં દર્શાવેલ પર્યટન પત્ર ભરાવી તેમાં વાલીઓની સહી મેળવી લઈ આ પર્યટનપત્રોને ફાઈલ કરવા.

**પર્યટન પત્ર**

- વિદ્યાર્થીનું નામ : \_\_\_\_\_
- ધોરણ : \_\_\_\_\_ વર્ગ : \_\_\_\_\_
- પર્યટનનું સ્થળ કે સ્થળો : (1)  
(2)  
(3)
- તારીખ : \_\_\_\_\_ થી \_\_\_\_\_
- ઉપાડવાનો સમય \_\_\_\_\_ પાછા ફરવાનો સમય \_\_\_\_\_
- પર્યટનના હેતુઓ : (1)  
(2)  
(3)
- અભ્યાસ પ્રશ્નો : (1)  
(2)  
(3)
- પર્યટનમાં સાથે લઈ જવાની ચીજો (નોંધપોથી, સોય-દોરો, પેન્સિલ, રબર, કેમેરા, કપડાં અને અન્ય જરૂરિયાતો)
- પર્યટન પછીની પ્રવૃત્તિઓ (પર્યટન નોંધ તૈયાર કરવી, આકૃતિઓ દોરવી, વાચન કરવું, ચર્ચા કરવી.)

**વાલીની સહી :** \_\_\_\_\_

આવો પર્યટનપત્ર તૈયાર કરતાં પહેલાં વિજ્ઞાનના અધ્યાપકે સ્થળની મુલાકાત લેવી જોઈએ. અધ્યાપકો પણ અધ્યેતા સાથે પહેલીવાર સ્થળ જોતા હોય તો તેનું શૈક્ષણિક મૂલ્ય ઘટી જાય છે અને તે અધ્યેતાઓને શું અને કેવી રીતે જોવાનું છે તે અંગે માર્ગદર્શન આપી શકતા નથી. ઘણા મોટાં કારખાનાં તેમના સ્ટાફમાંથી કોઈક ગાઈડ પણ આપતા હોય છે તેથી અધ્યાપકે આ ગાઈડને શું અને કેવી રીતે બતાવવું તે અંગેની નોંધ અગાઉથી આપી રાખવી જોઈએ. પર્યટનપત્ર સાઈકલોસ્ટાઈલ કે છાપેલું આપી શકાય. તેની સાથે સ્થળ કે સ્થળો વિશેની માહિતી અને સ્થળોના નકશા પણ આપવા. સાથે સાથે પ્રવાસ દરમિયાન અધ્યેતાઓએ પાળવાના શિસ્તના નિયમો પણ આપવા.

**વાહન-વ્યવહાર સત્તાવાળાઓની મંજૂરી :** રેલવે, બસ, પ્લેન વગેરે જે કોઈ પ્રકારની મુસાફરી હોય તેના સત્તાવાળાઓ સાથે પત્રવ્યવહાર કરી કન્સેશન માટેના પ્રયત્નો કરવા અને અધ્યેતાઓને ઓછા દરનો લાભ અપાવવો. લાંબી મુસાફરી હોય અને સંખ્યા પૂરતી હોય તો રેલવેનો ખાસ ડબ્બો



અથવા 'વર્ધાની ખાસ બસ' મેળવી લેવી.

**ઉતારા અંગેની મંજૂરી :** જે - તે સ્થળે રાત્રિરોકાણ હોય ત્યાં કાર્યક્રમનાં સ્થળ અને તારીખ નક્કી હોવાથી ધર્મશાળા કે હોટેલ માલિકની ઉતારવાની વ્યવસ્થા અંગે સંમતિ મેળવી લેવી. આમ કરવામાં ન આવે અને ગિર્દી હોય તો ઉતારાની જગ્યા ન મળે અને અધ્યેતાઓને ગરમી, ઠંડી વગેરેમાં હેરાનગતી થાય. ખાસ કરીને પ્રવાસમાં બહેનો હોય ત્યારે વધારે મુશ્કેલી પડે.

**(iv) અધ્યેતાઓએ સાથે લઈ જવાની વસ્તુઓ :** પ્રવાસ દરમિયાન વ્યક્તિગત જરૂરિયાત માટે બનતા સુધી અધ્યેતાઓ પૈસા ન લાવે તેવી સૂચના આપવી. પરંતુ તેમ છતાં જો તેઓ પૈસા લાવે તો તે પોતાની પાસે ન રાખતાં ગમે તે એક શિક્ષકને અધ્યેતાઓના પૈસા રાખવાની જવાબદારીઓ સોંપવી. જો એક દિવસનું પર્યટન હોય તો ભાથું સાથે લેવા કહેવું. લાંબો પ્રવાસ હોય તો બિછાનું, જરૂરી વાસણો સાથે લેવા કહેવું. જો ઠંડા પ્રદેશમાં જવાનું હોય તો પૂરતાં ગરમ કપડાં લેવા અંગે અગાઉથી ખ્યાલ આપવો. આ ઉપરાંત બેટરી, સોય-દોરો, નોંધપોથી, પેન્સિલ, રબર, કેમેરો, બાયનોક્યુલર, ગ્રાફપેપર, મીટરપટ્ટી, નમૂના ભેગા કરવા માટેના સાધનો, મીણબત્તીઓ, દીવાસળી, ગુડનાઈટ કે મચ્છરો ભગાવવાની અન્ય વસ્તુઓ વગેરે સાથે લેવા કહેવું અથવા તેમાંથી જે વ્યવસ્થા શાળા કરી શકે તેમ હોય તે શાળાએ કરવી.

**(v) અન્ય બાબતો :** પ્રવાસના માર્ગોનું અને સમયનું પાકું આયોજન કરવું. કયા ટૂંકા માર્ગે ઓછામાં ઓછા સમય અને ખર્ચ દ્વારા જઈ શકાય, કયા માર્ગે જવાથી નિયત સમય અને નિયત ખર્ચે પહોંચાય અને સમય ન બગડે, કયો માર્ગ જોખમી છે અને ત્યાંના જોખમો સામે શી સાવચેતીઓ લેવી, અકસ્માત વખતે સારવાર આપી શકાય તે માટે ફર્સ્ટ એઈડ બોક્સ, અચાનક માંદગી માટેની સામાન્ય દવાઓ વગેરે લઈ જવાની શાળાએ વ્યવસ્થા કરવી.

**(બ) શૈક્ષણિક બાબતો :**

પ્રવાસે જતાં પહેલાં થોડા દિવસ અગાઉ અધ્યેતાઓને પ્રવાસ અંગેના કેટલાક ખ્યાલો આપવામાં આવે તો અધ્યેતાઓ કેટલીક માહિતી પુસ્તકોમાંથી, સામાયિકોમાંથી, જે-તે સ્થળે જઈ આવેલાં મિત્રો કે સગાંસંબંધીઓ પાસેથી એકત્ર કરશે. પ્રવાસ ઉપાડવાના બે દિવસ અગાઉ પ્રવાસ અંગે ચર્ચા ગોઠવવી, જેથી અધ્યેતાઓ જે માહિતી લાવ્યા હોય તેની ચર્ચા થાય અને તે ચર્ચા પ્રવાસમાં મદદરૂપ થાય. જો પ્રવાસ લાંબો હોય તો પ્રવાસે જતાં અગાઉ આવી ચર્ચા બે ત્રણ વખત ગોઠવવી. આ ચર્ચાને અંતે છેવટે આખી યોજના તૈયાર થાય. આવી ચર્ચાઓમાં અધ્યાપકોએ અધ્યેતાઓને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. અધ્યાપકે નીચેની બાબતોની ચર્ચામાં માર્ગદર્શન આપવું.

**(i) અધ્યેતાઓના પ્રશ્નો :** અધ્યેતાઓને પ્રવાસ અંગે કોઈ અનુભવ નહીં હોવાથી તેઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના અધ્યાપકે સંતોષપ્રદ ઉત્તરો આપવા.

**(ii) અધ્યેતાઓને માનસિક રીતે તૈયાર કરવા :** જે વિશિષ્ટ મુદ્દાઓનું પર્યટન દ્વારા શિક્ષણ આપવાનું હોય તે માટે વર્ગને તૈયાર કરવો જોઈએ. પર્યટન પર જવાના હેતુઓ, શિક્ષણના મુદ્દા, ત્યાં ખાસ કઈ કઈ બાબતો જોવાની છે અને તે દ્વારા કઈ કઈ માહિતી ભેગી કરવાની છે વગેરે અંગેની સૂચનાઓ આપીને તેમને માનસિક રીતે તૈયાર કરવા. પ્રવાસ દરમિયાન પડી શકે તેવી વિવિધ મુશ્કેલીઓનો પણ તેમને ખ્યાલ આપવો.

**(iii) અધ્યેતાઓની સમિતિઓ રચવી :** સામાન્ય રીતે ચાળીસ અધ્યેતાઓનો વર્ગ એ અવલોકન માટેનું મોટું એકમ ગણી શકાય. તેથી વર્ગને અગાઉથી જ ત્રણ ચાર સમિતિઓમાં વહેંચી દેવો અને દરેક સમિતિએ કઈ કઈ માહિતી એકત્ર કરવાની છે તેનો તેમને ખ્યાલ આપી દેવો. આમ કરવાથી પર્યટનનો કાર્યક્રમ વધારે વ્યવસ્થિત થશે. દરેક સમિતિના નેતાનું નામ અને તેના સભ્યોના નામની યાદીઓ તૈયાર કરવી જોઈએ. આ યાદીઓ અને પ્રત્યેક સમિતિના સભ્યોને સોંપેલ કાર્યની માહિતી પર્યટનપત્રની સાથે અવશ્ય આપવી જોઈએ.

**(iv) અધ્યેતાઓએ પ્રવાસ દરમિયાન લેવાની નોંધ :** અગાઉથી આ અંગેની ચર્ચા પણ કરી

લેવી જોઈએ. અધ્યેતાઓએ શું જોયું? તે અંગે કયા કયા પ્રશ્નો તેમના મનમાં ઉદ્ભવ્યા? તે અંગે તેમણે પોતાની નોંધપોથી સૂચના તેમને પ્રવાસે જતાં અગાઉ આપી દેવી જોઈએ. પ્રવાસને લગતી અન્ય માહિતી જેવી કે ઉતરવાનું સ્થળ, ત્યાં પડેલી અગવડો, ત્યાં મળેલી સગવડો, ત્યાંના પોતાના અંગત અનુભવો વગેરે પણ નોંધી શકાય.

(v) **પ્રવાસ દરમિયાનનું કાર્ય :** અધ્યેતાઓએ પ્રવાસમાં શું શું જોવું તે અંગેની સૂચના અગાઉથી આપેલી હોવા છતાં પ્રવાસ દરમિયાન પ્રસંગોપાત્ત અધ્યાપકે સૂચના આપવી પડે છે. ‘હવે આ વસ્તુ જુઓ’ એમ જ્યારે અધ્યાપક કહે છે ત્યારે અધ્યેતાઓનું ધ્યાન તે બાબત તરફ વિશિષ્ટ રીતે ખેંચાય છે. અને તેઓ ત્યારે વધારે રસપૂર્વક તે તરફ જુએ છે, તે વસ્તુની નોંધ લે છે અને કેમેરાથી ફોટો પણ લે છે. આમ, તેઓ તે અંગે કંઈક વિચારતા થાય છે અને તેમનું નિરીક્ષણ હેતુલક્ષી બને છે.

પ્રવાસ અંગેની નીચેની બાબતો વિશે પણ વિચારવું જોઈએ :

- પ્રવાસમાં ઉપડતાં અગાઉ પ્રવાસમાં આવવા માટે નોંધાયેલા અધ્યેતાઓ નિયત સમયે અને નિયત સ્થળે આવ્યા છે કે કેમ તેની ચકાસણી કરી લેવી અર્થાત્ માથાં ગણી લેવાં.
- પ્રવાસની શરૂઆત કરતાં પહેલાં અધ્યેતાઓને જે જે વસ્તુઓ લાવવા માટે કહેલું તે વસ્તુઓ તેઓ લાવ્યા છે કે કેમ તે જોઈ લેવું.
- પ્રવાસમાં ટુકડીઓ પાડેલી હોય તો તેઓ તેમને સોંપ્યા મુજબનું કામ પ્રવાસ દરમિયાન કરે છે કે નહિ તે અવારનવાર જોતા રહેવું.
- ટુકડીઓ પ્રવાસના સ્થળે ફરે ત્યારે ત્યાંની કોઈ ચીજવસ્તુને અડકે નહિ તે અંગે પણ તેમને અગાઉથી સૂચના આપવી.
- જો ત્યાંથી નાના-મોટા નમૂના એકઠા કરવાના હોય તો તે માટે ત્યાંના અધિકારીની મંજૂરી લેવી આવશ્યક છે.
- પ્રવાસ દરમિયાન જોવાની, જાણવાની બાબતમાં અધ્યેતાઓ મુશ્કેલીઓ અનુભવે છે કે કેમ તે જોતા રહેવું જોઈએ અને જો તેમ હોય તો તેમની મુશ્કેલીઓમાં તેમને શક્ય એટલા મદદરૂપ થવું જોઈએ.
- નિયત સમયક્રમ મુજબ પ્રવાસ થતો રહે અને નિયત સમયે જ પૂર્ણ થાય તેની કાળજી સતત રાખવી જોઈએ.
- બધી ટુકડીઓ પોતાની કામગીરી પૂર્ણ કરી લે ત્યારે જે તે સ્થળે આખો વર્ગ એક જગ્યાએ એકઠો થાય અને દરેક ટુકડીને પોતાને જોઈતી માહિતી અને નમૂના મળ્યા છે કે કેમ તેની ચકાસણી કરી લેવી. જો ન મળેલ હોય તો તે મેળવવાની તજવીજ કરવી.
- પ્રવાસ દરમિયાન અધ્યેતાઓને સ્વચ્છ ખોરાક, પાણી મળે છે કે કેમ તે જોવું અને તે અંગે સતત તકેદારી રાખવી. નહિંતર માંદગી જેવી મુશ્કેલીઓ આવી પડશે. અને સંવાહકોની પરેશાની વધશે. વળી અધ્યેતાઓને ખાવાપીવાનું પ્રમાણભાન જાળવવા અંગેની સૂચના પણ આપવી.

(i) **પ્રવાસ પછીનું કાર્ય :** પ્રવાસ પછીના કાર્યનું આયોજન પણ હેતુઓને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. કયા પ્રકારનું કાર્ય પ્રવાસ પછી કરી શકાય તેના કેટલાક મુદ્દા નીચે આપ્યા છે :

- પ્રવાસેથી પાછા આવ્યા પછી પ્રવાસમાં શું શું જોયું તેની ચર્ચા ગોઠવવી જોઈએ. ઉપરાંત પર્યટનમાં મળેલી માહિતીનું ચર્ચા દ્વારા સંકલન થવું જોઈએ. દરેક સમિતિનો નેતા પોતે મેળવેલી માહિતીનો અહેવાલ રજૂ કરે, આકૃતિઓ, ચિત્રો, નમૂનાઓ, ચર્ચાઓ દ્વારા અહેવાલને સ્પષ્ટ બનાવી શકાય. અધ્યેતાઓ પ્રશ્નો પૂછે, ચર્ચા થાય. બધી સમિતિઓના અહેવાલોની ચર્ચા થઈ જાય તે પછી સમગ્ર અહેવાલ તૈયાર કરવાનું કાર્ય યોગ્ય અધ્યેતાને સોંપી શકાય. અધ્યેતાઓ પ્રશ્નો પૂછે, ચર્ચા થાય. બધી સમિતિઓના અહેવાલોની ચર્ચા થઈ જાય તે પછી સમગ્ર અભ્યાસ કર્યા બાદ બીજી બેઠકમાં સમગ્ર પ્રવાસ પર અધ્યાપક સંકલિત

પ્રવચન આપે, જેમાં પ્રવાસની સિદ્ધિઓ, ક્ષતિઓ અને મુશ્કેલીઓની વાત કરે તેમજ પ્રવાસમાં અધ્યેતાઓએ જે કંઈ જોયું, જાણ્યું, અનુભવ્યું, નોંધ્યું તેને શૈક્ષણિક દૃષ્ટિબિંદુથી સમજાવે. આમ કરવાથી પર્યટનનો મહત્તમ ફાયદો ઊઠાવી શકાશે. આ બીજી બેઠકમાં અધ્યેતાઓ પણ અધ્યાપકને કેટલીક બાબતો વિશે પૂછી શકે અને અધ્યાપક તેના ખુલાસાઓ કરે, જરૂર પડે તો આકૃતિ દોરીને અધ્યાપક ફેકટરીના કે અન્ય સ્થળના કયા વિભાગમાં કઈ પ્રક્રિયા થાય છે તે સમજાવે. તેથી અધ્યેતાઓને કારખાનામાં જુદાં જુદાં યંત્રો દ્વારા થતાં કાર્યોનો ખ્યાલ આવશે.

- જો કોઈ પ્રયોગ કરી બતાવવાથી ફેકટરીમાં થતું કાર્ય વધારે સરળતાથી સમજાય તેમ હોય તો અધ્યાપકે તેવો પ્રયોગ પણ કરી બતાવવો જોઈએ.
- સમિતિના નેતા અને અન્ય અધ્યેતાઓ પણ આ બેઠકમાં પ્રવચનો આપી શકે અને પ્રવાસના પોતાના અનુભવો વર્ણવે.
- પ્રવાસથી થયેલા ફાયદા, પ્રવાસની મર્યાદાઓ, પ્રવાસમાં નડેલી મુશ્કેલીઓ વગેરેની મુક્ત ચર્ચા કરવામાં આવે.

**(ii) પ્રવાસનું અનુકાર્ય :** પ્રવાસ પૂર્ણ થયા પછી કેટલીક ઈતર પ્રવૃત્તિઓ અધ્યેતાઓએ કરવાની હોય છે, જેને પ્રવાસનું અનુકાર્ય ગણાવી શકાય.

- અધ્યેતાઓ જે નમૂના પ્રવાસમાંથી લાવ્યા હોય તેમનું વર્ગીકરણ કરી લાવનારના નામ સાથે શાળાના વિજ્ઞાન સંગ્રહાલયમાં તેમનો સમાવેશ કરી શકાય.
- અધ્યેતાઓ મોડેલ્સ બનાવે, ચિત્રો દોરે, આકૃતિઓ દોરે.,
- અધ્યેતાઓ તેમણે લીધેલા ફોટોગ્રાફ્સ બુલેટિન બોર્ડ પર રજૂ કરે.
- અધ્યેતાઓ શાળાના મુખપત્ર કે વાર્ષિક અંકમાં પ્રવાસ અંગે લેખો લખે.
- અધ્યેતાઓ અન્ય સામયિકોમાં પણ આવા લેખો લખી મોકલાવે.
- વર્ગમાં સમય આપીને દરેક અધ્યેતા પાસે પ્રવાસ અંગેનો નિબંધ લખાવવો.
- અધ્યેતાઓ આવા નિબંધો, ફોટોગ્રાફ્સ, આકૃતિઓ વગેરે એકત્ર કરી પ્રવાસ અંગેનો વિશિષ્ટ હસ્તલિખિત અંક તૈયાર કરે અને ભવિષ્યમાં તે સ્થળોએ જનારા મુલાકાતીઓ માટે તેમાં ઉપયોગી અને કિંમતી સૂચનો કરે.
- અધ્યેતાઓએ તૈયાર કરેલા લેખો, નિબંધો, પ્રવાસમાંથી મેળવેલા નમૂના, તેમણે લીધેલા ફોટોગ્રાફ્સ, અનુકાર્યમાં તેમણે તૈયાર કરેલાં મોડેલ્સ આકૃતિઓ અને અન્ય સામગ્રીનું તેઓ એક નાનકડું પ્રદર્શન યોજે.
- બધા અહેવાલો, સમગ્ર અહેવાલ, અધ્યાપકનું સંકલિત પ્રવચન, અધ્યેતાઓનાં પ્રવચનો, લેખો, નિબંધો વગેરેના બનાવેલા હસ્તલિખિત અંકને ચિત્રો, આકૃતિઓ, નમૂનાઓથી વધારે રસમય બનાવી શકાય.
- તેઓ જરૂરી અન્ય સંબંધિત સાહિત્ય, પુસ્તકો વગેરે લાવીને વાંચે.
- અધ્યેતાઓએ પ્રવાસ અંગે દોરેલાં ચિત્રો, આકૃતિઓ વગેરેને બુલેટિન બોર્ડ પર મુકવામાં આવે.
- પ્રવાસના સુખદ-દુઃખદ પ્રસંગો નાટકના સ્વરૂપે રજૂ કરવામાં આવે.
- આ અંગે જો શક્ય હોય તો અધ્યાપક કે અધ્યેતાઓનો રેડિયો વાર્તાલાપ ગોઠવી શકાય તો તે માટે પ્રયત્નો કરવા.

**(iii) પ્રવાસનું મૂલ્યાંકન :** પ્રવાસનું મૂલ્યાંકન નીચે મુજબ કરી શકાય :

- પ્રવાસ અંગેની ટૂંકી કસોટી તૈયાર કરી તે અધ્યેતાઓને આપવી જોઈએ. આથી અધ્યેતાઓ પ્રવાસ દરમિયાન અપેક્ષિત બાબતો જાણી શક્યા કે નહિ તેની માહિતી મળી શકશે અને પ્રવાસે જવાનો હેતુ કેટલે અંશે સર્વો છે. તેનો અધ્યાપકને ખ્યાલ આવશે.
- પ્રવાસની યોજનામાં કઈ કઈ વિશિષ્ટતાઓ હતી, જેને લીધે પ્રવાસ સફળ થયો અને તેમાં કઈ

કઈ ખામીઓ રહી ગઈ હતી. જેથી પ્રવાસ દરમિયાન મુશ્કેલીઓ પડી તે અંગે નોંધ લેવામાં આવે તો તેથી ભવિષ્યમાં તે સ્થળોના પ્રવાસો સારી રીતે યોજ શકાશે.

- પ્રવાસ માટે સમય પૂરતો હતો કે કેમ તેની વિચારણા કરવી.
- પ્રવાસમાં માર્ગની પસંદગી, પ્રવાસમાં પડેલી મુશ્કેલીઓ, પ્રવાસે ઉપડવાનો અને પરત આવવાનો સમય, પ્રવાસની ઋતુ વગેરે અંગેનો એક અલગ અહેવાલ અધ્યાપકે તૈયાર કરવો જેમાં તેનાં પોતાનાં સૂચનોનો પણ સમાવેશ કરવો.
- અધ્યેતાઓને લક્ષમાં લઈને પણ પ્રવાસનું મૂલ્યાંકન કરવું જોઈએ. જેમ કે જે જોવા જેવું હતું તે બધું અધ્યેતાઓ જોઈ શક્યા છે કે કેમ, અધ્યેતાઓને શું ગમ્યું, તેમને કઈ કઈ મુસીબતો નડી. એ મુસબતો કઈ રીતે નિવારી શકાય વગેરે બાબતો ધ્યાનમાં રાખીને પણ પ્રવાસનું મૂલ્યાંકન કરવું જોઈએ.
- પ્રવાસની અધ્યાપકની નોંધ આચાર્ય પાસે કે લાયબ્રેરીમાં સુરક્ષિત રાખે તો ભવિષ્યમાં ગોઠવવાના પ્રવાસો અંગે તેમાંથી માર્ગદર્શન મળી રહે.
- અધ્યેતાઓમાં પ્રવાસ દ્વારા અપેક્ષિત વૈજ્ઞાનિક ગુણો ખીલ્યા છે કે નહિ તેનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે અને તેનું મૂલ્યાંકન અધ્યાપક માત્ર અધ્યેતાઓના સંપર્કથી જ કરી શકે. આમ છતાં નમૂનાઓ, ચિત્રો, આકૃતિઓ, ફોટોગ્રાફ્સ, અહેવાલોની પુસ્તિકા, મોડેલ્સ, પ્રદર્શન વગેરે સમગ્ર વર્ગનું મૂલ્યાંકન તો પૂરું પાડે જ છે.

ઉપર વર્ણવેલા પર્યટનના આયોજનમાં ક્યારેક હેતુ અને સ્થળ પ્રમાણે ફેરફાર પણ કરવો પડે. જેમ કે નદી કે દરિયાની રેતીમાંથી જુદા જુદા પથ્થરો, શંખલાં, છીપલાં વગેરે એકઠાં કરવાં હોય, તળાવ કે સરોવરમાંથી નાના જીવો ને એકત્ર કરવા હોય, નર્સરી, ખેતર કે ફાર્મમાંથી ફળફુલ, બીજ, પાન, મૂળ કે પ્રકાંડનો સંગ્રહ કરવો હોય કે જંગલમાંથી ઉડતા જીવજંતુને પકડવા હોય તો ક્યારેક ઘણી રાહ જોવી પડે છે અને સમયનું બંધન અનુકૂળ આવતું નથી. તેથી આયોજનનો યુસ્ત અમલ ન કરી શકતાં તેમાં ફેરફાર કરવો પડે છે.

## 2.6 કૃત્રિમ નભોમંડળ (Planetarium) :

અવકાશી ગ્રહો, પદાર્થો, ઉલ્કા, તારા, સૂર્યમંડળ, રાત્રી આકાશ વગેરે જેવી ખગોળીય માહિતી સંગીત, આનંદ અને શૈક્ષણિક હેતુથી નિહાળવા માટે કૃત્રિમ રીતે તૈયાર કરેલ થિએટરને કૃત્રિમ નભોમંડળ કહેવામાં આવે છે.

કૃત્રિમ નભોમંડળ નિહાળવું એ એક અજાયબ અનુભવ છે. કારણ કે તેના આધારે આપણે સાચુ આકાશ, તારીખો, ગ્રહો વગેરે સન્મુખ નિહાળતા હોય એવું લાગે છે.

કૃત્રિમ નભોમંડળની ઉપરની છત ધુમ્મટ આકારની હોય છે.

John Theophilus Desaguliers એ પ્રથમ કૃત્રિમ નભોમંડળ બનાવ્યું હોવાનું કહેવાય છે.

ભારતમાં પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુ નામથી નહેરુ પ્લેનેટોરીયમ બનાવવામાં આવ્યું છે. જે મુંબઈ, ન્યુ દિલ્હી, પુના, બેંગલોર અને અલ્હાબાદમાં આવેલ છે. આ સિવાય ઘણી બધી ખાનગી સંસ્થાઓ દ્વારા પણ પ્લેનેટોરીયમ તૈયાર કરવામાં આવેલા છે. ભારતમાં B. M. Birla Planetarium, Chennai અને Birla Planetarium, Hyderabad આ બંને પ્લેનેટોરીયમ સૌથી મોટા તારામંડળ તરીકે ગણવામાં આવે છે.

ગુજરાતમાં આવેલ કૃત્રિમ નભોમંડળની માહિતી નીચે આપવામાં આવેલી છે.

- (1) સરદાર પટેલ પ્લેનેટોરિયમ - વડોદરા
- (2) સરદાર વલ્લભભાઈ પટેલ પ્લેનેટોરીયમ - સુરત
- (3) કમ્યુનીટી સાયન્સ સેન્ટર એન્ડ પ્લેનેટોરીયમ - રાજકોટ
- (4) નહેરુ પ્લેનેટોરીયમ - પોરબંદર

◆ **રચના :**

કૃત્રિમ નભોમંડળમાં ખાસ પ્રકારના પ્રોજેક્ટર્સની મદદથી ફરતા ઘુમ્મટમાં તારાઓ, સૂર્ય, ચંદ્ર, ગ્રહો નક્ષત્રો, ચંદ્રની કળા, વગેરે જોઈ શકાય છે. કેટલાક પ્લેનેટોરીયમમાં અવકાશી પદાર્થોની સાથે સાથે સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ નિહાળી શકાય એવી વ્યવસ્થા ગોઠવી હોય છે. ઓરડાને અંધારો કરી ઘુમ્મટને તેજસ્વી બનાવી સાચુ આકાશ નિહાળતા હોઈએ એવો અનુભવ થાય છે.

◆ **મહત્ત્વ :**

ખૂબ જ મોંઘા અવકાશી પદાર્થોને નિહાળવાના સાધનો, હજારો માઈલની મુસાફરી કરીને પણ આપણે જે ખગોળીય પદાર્થોની માહિતી ન લઈ શકીએ એ માહિતી સરળતાથી કૃત્રિમ નભોમંડળ દ્વારા સહેલાઈથી પ્રાપ્ત કરી શકીએ છીએ. આધુનિક કૃત્રિમ નભોમંડળમાં તો આપણે ચંદ્ર પરથી પૃથ્વી કેવી દેખાય છે ? અન્ય અવકાશી પદાર્થો અને બ્રહ્માંડ કેવું છે ? તે વિગતો પણ સહેલાઈથી મેળવી શકીએ છીએ. વિજ્ઞાનમાં આકાશી પદાર્થોનું જ્ઞાન મેળવવા માટે તેને વાસ્તવિક સ્વરૂપે જોવા માટે કૃત્રિમ નભોમંડળ ખૂબ જ ઉપયોગી છે. આવા કૃત્રિમ નભોમંડળ જ્ઞાન સાથે આનંદ, જીજ્ઞાસા, કુતુહલ તથા રમતનો બહોળો અનુભવ આપી જાય છે.

શાળામાંથી વર્ષમાં કોઈ ખાસ ખગોળીય ઘટના કે અન્ય સમયે વિદ્યાર્થીઓને આવા પ્લેનેટોરીયમની મુલાકાત ફરજિયાત લેવડાવી જોઈએ. જેથી વિજ્ઞાન પ્રત્યે હકારાત્મક દષ્ટિકોણ વિકસે છે.

**2.7 ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ :**

પશ્ચિમ કિનારે આવેલ ગુજરાત દેશના સૌથી વધારે સમૃદ્ધ અને પ્રગતિશીલ રાજ્યોમાંનું એક છે. મુંબઈ રાજ્યનું વિભાજન થતાં 1960માં તે અસ્તિત્વમાં આવ્યું. તે 1,60,000 ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની વસતિ આશરે 6 કરોડ છે.

ગુજરાત સરકારે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી નામની એક રજીસ્ટર્ડ સોસાયટીની સ્થાપના ગુજરાત સાયન્સ સિટીનો મેન્ડેટ હાંસલ કરવા માટે કરેલ છે. સરકાર 107 હેક્ટર જેટલી જમીન ધરાવે છે. સાયન્સ સિટીના ભાવિ વિસ્તરણ અને સંબંધિત યોજનાઓ માટે વધારાની 300 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે.

◆ **તેના વિકાસનાં વિશિષ્ટ પાસાઓ :**

- મોટા પાયે ઔદ્યોગિક રોકાણ
- ઉદ્યોગ સાહસિક પ્રકૃતિ
- સુવિકસિત માળખાકીય સુવિધાઓ
- કાયદો અને વ્યવસ્થાની જાળવણી
- રાજકીય સ્થિરતા

- બિનનિવાસી ગુજરાતીઓની નોંધપાત્ર સંખ્યા, ખાસ કરીને અમેરિકા અને ઈંગ્લેન્ડમાં જનસમુદાયમાં વૈજ્ઞાનિક પ્રકૃતિ વિકસાવવા વિજ્ઞાનનો પ્રસાર એ જ્ઞાન આધારિત આર્થિક વૃદ્ધિના આ ઊભરતા વાતાવરણમાં પ્રાથમિકતા છે.

ગુજરાત સાયન્સ સિટી એ ગુજરાત સરકારની પ્રાથમિકતાને સાકાર કરવા માટેની એક હિમ્મતભરી પહેલ છે.

- ગુજરાત સાયન્સ સિટી વિજ્ઞાનને સરળ અને રસપ્રદ બનાવવા હેતુથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓને સમાવતી શક્ય તેટલી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરતું રહે છે. સાયન્સ સિટીમાં ચાલતી આ વૈજ્ઞાનિક તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓનું મુખ્યત્વે પાંચ ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવામાં આવેલ છે, જે નીચે મુજબ વર્ણવવામાં આવેલ છે.

◆ **વિજ્ઞાન પ્રસાર કાર્યક્રમો: વિજ્ઞાનની ઉજવણી :**

મહત્ત્વની વૈજ્ઞાનિક ઘટનાઓને સંબંધિત દિવસો, વિજ્ઞાન સપ્તાહ, વિગેરેની ઉજવણી અને

બને તેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, સામાન્ય જનતા તેમજ મીડિયા અને નીતિ નિર્માતાઓને સાંકળીને વિવિધ થીમ સાથેની ઉજવણી. આના કારણે સ્થાનિક પ્રશ્નો વૈશ્વિક સ્તરે ઉઠાવવામાં આપણને મદદ મળે છે. શિક્ષકો, વિજ્ઞાન સંચારકો તથા સાયન્સ ક્લબના સભ્યો અને સંયોજકો માટે તાલીમ કાર્યક્રમો અને વર્કશોપનું આયોજન વિજ્ઞાનમેળાઓ અને મોડેલ બનાવવાનાં વર્કશોપ, લોકપ્રિય વૈજ્ઞાનિક ફિલ્મ સમારોહ, લોકપ્રિય વિજ્ઞાન પુસ્તકોનું પ્રદર્શન વિગેરેનું આયોજન. શાળા સુધી પહોંચતો કાર્યક્રમ.

◆ **વિજ્ઞાન અને ગણિત પર શૈક્ષણિક કાર્યક્રમ :**

શિક્ષકો તથા વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ગણિતના પ્રતિભા પ્રકૃતિ કાર્યક્રમોનું આયોજન 'વૈજ્ઞાનિકને મળો' કાર્યક્રમ : વિખ્યાત વૈજ્ઞાનિક સાથે વાર્તાલાપ. ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કારકિર્દી પરામર્શ. ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસને વિજ્ઞાન સંચારના ટૂંકા ગાળાના ટ્રેનિંગ વર્કશોપનું આયોજન. શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે પ્રકૃતિ કાર્યક્રમો અને મેથ્સ ઓલમ્પિયાડ જેવા કાર્યક્રમોનું આયોજન.

◆ **મટીરીયલ ડેવલપમેન્ટ :**

કઠપૂતળી, પ્રચલિત વિજ્ઞાન લેખન, ચિત્રણ અને પત્રકારત્વ, પ્રકૃતિ શિબિરોનું આયોજન, ઓરિગામિ દ્વારા ગણિતનું જ્ઞાન, હાઈડ્રોપોનિક્સ (જળકૃષિ) નાં ટ્રેનિંગ મોડ્યુલ - માટી વગરના છોડની મજા, રોકેટનાં મોડેલ, ટેલિસ્કોપ નિર્માણ, રાત્રીના આકાશનું અવલોકન વિગેરે દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રવૃત્તિનાં મોડ્યુલો તૈયાર કરવા. થીમ આધારિત પોસ્ટરો તૈયાર કરવાં, જેવા કે સાતત્યપૂર્ણ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી, પાણી એ જ જીવન, આપણું આકાશ બચાવો, વિશ્વશાંતિ માટે અણુપ્રયોગ વિગેરે આ ઉપરાંત થીમ આધારિત પ્રવૃત્તિઓ, પ્રદર્શન લેખન, રમતો અને કાર્યપત્રકો. સ્ટાન્ડર્ડ રેફરન્સ લાઈબ્રેરી અને ઇન્ટરેક્ટિવ વેબસાઈટ તૈયાર કરવી.

◆ **વિદ્યાર્થી સ્વયંસેવકોની તાલીમ :**

વિદ્યાર્થી સ્વયંસેવકોનો ઇન્ટર્ન તરીકે સમાવેશ અને તેમના વ્યાવસાયિક વિકાસ માટે જરૂરી તાલીમ તથા માર્ગદર્શન પૂરું પાડવું. હોનહાર વિજ્ઞાન લેખકો તથા સંચારકોનું કૌશલ્ય વર્ધન. વિજ્ઞાન પ્રસાર પ્રવૃત્તિઓનાં વિવિધ મોડ્યુલોનો પરિચય.

◆ **મીડિયા રિસોર્સ સેન્ટર :**

મહત્વની વૈજ્ઞાનિક ઘટનાઓ અને પ્રવૃત્તિઓ માટેની મીડિયા ક્રીટ જેવી જરૂરી પાથ સામગ્રી તૈયાર કરવી. પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો તથા ટેકનોક્રેટના ઇન્ટરવ્યૂ ગોઠવવા. ઓડિયો-વિડ્યુઅલ સીડી તૈયાર કરવી - વિડ્યુઅલ સીડી, મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન તથા વિષય આધારિત સ્લાઈડ શો, વિગેરે સ્થાનિક અખબારોમાં સામાહિક વિજ્ઞાન કોલમ માટે યોગદાન આપવું.

◆ **સાયન્સ ક્લબ :**

ગુજરાત સાયન્સ સિટી વિજ્ઞાન, પ્રસાર, સાયન્સ ક્લબ વિભાગના સહયોગથી તમામ સાયન્સ ક્લબ સોસાયટીઓ તથા સંસ્થાઓને રાજ્યવ્યાપી નેટવર્ક સાથે વણી લેવા માટે કાર્યક્રમોનું વ્યવસ્થિત આયોજન કરે છે. લગભગ 500 જેટલી સાયન્સ ક્લબોની સ્થાપના કરવામાં આવેલ છે. અથવા ફરી ચાલુ કરવામાં આવી છે તથા ક્લબના સભ્યોને વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ છે.

◆ **પ્રસાર કાર્યક્રમ :**

ગુજરાત સાયન્સ સિટી નિયમિત રીતે રાજ્યની અલગ-અલગ શાળાઓમાં વિવિધ વિજ્ઞાન પ્રસાર કાર્યક્રમોનું આયોજન કરે છે અને દેશના અન્ય ભાગોની મુલાકાત પણ લે છે જ્યાં વિજ્ઞાન હજુ સુધી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું નથી. જીસીએસસીના કર્મચારીગણે દેશના વિવિધ ભાગોમાં વિવિધ પરિષદો તથા વર્કશોપમાં પણ ભાગ લે છે તથા આ ઉમદા કાર્ય માટે પોતાના અનુભવો શેર કરે છે.

◆ સાયન્સ ઓલમ્પિયાડ : સમાનતા અને શ્રેષ્ઠતા લાવવી :

ગુજરાત સાયન્સ સિટીએ ભારતમાં પ્રથમ વખત ધો. 8 અને 9ના વિદ્યાર્થીઓ માટે જુનિયર સાયન્સ એન્ડ મેથ્સ ઓલમ્પિયાડ શરૂ કરેલ છે. આ જુનિયર સાયન્સ એન્ડ મેથ્સ ઓલમ્પિયાડનો હેતુ નાનાં બાળકોને ઉપરના વિષયોમાં તેજસ્વી બનાવવાનો તેમજ તેમને ધો. 9 અને 10 માટેના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના સાયન્સ ઓલમ્પિયાડ માટે તૈયાર કરવાનો છે. આ કાર્યક્રમમાં શિક્ષકો તથા અભ્યાસક્રમની અંદર વ્યાવસાયિક વિકાસ લાવવાની અપાર સંભાવનાઓ રહેલી છે. જીસીએસ આ અંગેની જાગૃતિ લાવવાના તથા રાજ્યના વધારેને વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સામેલ કરવાના હેતુથી સાયન્સ ઓલમ્પિયાડ પરનાં દિશાસૂચન માટેના કાર્યક્રમોનું આયોજન કરે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના અધ્યાપકો અને શિક્ષકોને પણ મૂળભૂત વિજ્ઞાનમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

◆ સાયન્સ :

ગુજરાત સાયન્સ સિટીએ 'સાયન્સ મેટર' નામની એક લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાનમાળા શરૂ કરેલ છે. આ વ્યાખ્યાનમાળા વિજ્ઞાન અને ટેકનોલોજીના મહત્વનાં ક્ષેત્રોને ઉજાગર કરે છે તથા વિદ્યાર્થીઓ અને પ્રજાની અંદર આધુનિક જ્ઞાન તથા જાગૃતિ ફેલાવે છે.

ગુજરાત સાયન્સ સીટીની મુલાકાત લેવા જતાં પહેલાં કયા પ્રકારની પૂર્વતૈયારી કરશો.

1. ગુજરાત સાયન્સ સીટી ક્યાં આવેલું છે ?

જ. ગુજરાત સાયન્સ સીટી એસ.જી હાઈવેની નજીક અને સદ્ભાવના સર્કલ, એસ.પી.રીંગ રોડથી 0.5 કી.મીના અંતરે અમદાવાદ, ગુજરાત, ભારત ખાતે આવેલું છે.

2. ગુજરાત સાયન્સ સિટી કેવી રીતે પહોંચી શકાય ?

જ. તમે તમારા ખાનગી વાહન તેમજ શહેર બસ દ્વારા અથવા તો તમે કેબની મદદથી પણ મુસાફરી કરી તમે ગુજરાત સાયન્સ સિટી પહોંચી શકો છો.

3. ગુજરાત સાયન્સ સિટી શું છે ?

જ. ગુજરાત સાયન્સ સિટી એ અમદાવાદમાં એક સ્થળ છે, જ્યાં વિજ્ઞાનનું સંશોધન કરવામાં આવે છે, પ્રયોગો વ્યક્ત થાય છે, જિજ્ઞાસા સંતોષાય છે, કુશળતામાં વધારો થાય છે, વિચારોનો ઉછેર થાય છે, શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવે છે, જ્ઞાન સહભાગીતા થાય છે, વિજ્ઞાનનો સંચાર કરવામાં આવે છે.

4. ગુજરાત સાયન્સ સિટીમાં ફેઝ - 1માં કુલ કેટલા વૈજ્ઞાનિક પેવેલિયનો આવેલા છે અને ક્યા ક્યા ?

જ. 11.

(1) એફિથિયેટર, (2) આઈમેક્સ થ્રીડી થિયેટર, (3) એનર્જી એજ્યુકેશન પાર્ક, (4) સીમ્યુલેટર રાઈડ, (5) હોલ ઓફ સ્પેશ, (6) હોલ ઓફ સાયન્સ, (7) મ્યુઝીકલ ફાઉન્ટેઈન, (8) લાઈફ સાયન્સ પાર્ક, (9) પ્લેનેટ અર્થ, (10) ચિલ્ડ્રન એક્ટીવિટી સેન્ટર, (11) ઈલેક્ટ્રોડ્રોમ

5. ગુજરાત સાયન્સ સીટીમાં મુલાકાતીઓ માટે મુલાકાતનો સમય કેટલો છે ?

જ. સવારે : 10:00 થી રાત્રે 08:00 સુધી.

6. શું મારે અગાઉથી ઓનલાઈન ટિકીટ ખરીદવાના જરૂર છે. અથવા મને ટિકીટ બારીથી મળશે ?

જ. ઓનલાઈન પણ ઉપલબ્ધ છે, અને ટિકીટ બારીથી પણ મેળવી શકો છો.

7. ગુજરાત સાયન્સ સીટી મુલાકાતનો આદર્શ સમયગાળો શું છે ?

જ. ગુજરાત સાયન્સ સીટી 365 દિવસ કાર્યરત છે. પણ શિયાળાનો સમય ગુજરાત સાયન્સ સીટીની મુલાકાત માટે યોગ્ય છે.

8. ગુજરાત સાયન્સ સીટીની મુલાકાત માટે આદર્શ સમય શું છે ?  
જ. આદર્શ સમય બપોરે 12:00 કલાકથી સાંજના 08:00 કલાક
9. શું ગુજરાત સાયન્સ સીટીમાં અઠવાડિક રજા હોય છે ?  
જ. ના
10. કયા વય જૂથના લોકોને ગુજરાત સાયન્સ સીટીની મુલાકાતથી સૌથી વધુ ફાયદો થાય છે ?  
જ. 8થી 40 વર્ષના વય જૂથના
11. ગુજરાત સાયન્સ સીટીની સંપૂર્ણ મુલાકાત માટે કેવો સમય પુરતો છે ?  
જ. એક આખો દિવસ, ઓછામાં ઓછા 8 કલાક
12. શું ગુજરાત સાયન્સ સીટીમાં ખાણીપીણીની વસ્તુઓ લઈ જવાની પરવાનગી છે ?  
જ. ગુજરાત સાયન્સ સીટીના પેવેલીયનોમાં ખાણીપીણીની વસ્તુઓ લઈ જવાની પરવાનગી નથી.
13. ગુજરાત સાયન્સ સીટીમાં મુલાકાતીઓ માટે કલોક રૂમ / સામાન રૂમ છે ?  
જ.
14. ગુજરાત સાયન્સ સીટીમાં મનોરંજન સાથે જ્ઞાન પૂરા પાડતા આકર્ષણો કયા કયા છે ?  
જ. આઈમેક્સ 3ડી, થ્રીલ રાઈડ, મીશન ટુ માર્શ રાઈડ, કોલમાઈન, અર્થક્વેક રાઈડ, 4ડી થિયેટર, પ્લેનેટોરિયમ, મ્યુઝીકલ ફાઉન્ટેન વગેરે.
15. ગુજરાત સાયન્સ સીટી સાથે હું કેવી રીતે જોડાઈ શકું ?  
જ. વર્ષભરના વિવિધ વૈજ્ઞાનિક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા આપ જોડાઈ શકો.
16. શું સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓ માટે કોઈ ખાસ ડિસ્કાઉન્ટ છે ?  
જ. હા
17. કયા પેવેલિયનમાં પ્રવેશ ફી છે ?  
જ. આઈમેક્સ 3ડી, થ્રીલ રાઈડ, મ્યુઝીકલ ફાઉન્ટેન
18. શું વિકલાંગ વ્યક્તિ માટે કોઈ વિશેષ સુવિધા છે ?  
જ. હા
19. સાયન્સ સીટીમાં વાર્ષિક કેટલા મુલાકાતીઓ મુલાકાત લે છે ?  
જ. આશરે દસ લાખ
20. ગુજરાત સાયન્સ સિટીના દરેક પેવેલિયનની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે ?  
જ.

◆ આઈસમેક્સ થ્રીડી :

આઈમેક્સ ફિલ્મનો અનુભવ અદ્ભૂત છે ! આઠ માળ જેટલી સ્ફટિક જેવી ચોખ્ખી અને ભવ્ય ડિજિટલ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ છે, આઈમેક્સ માત્ર તમે કલ્પનામાં જ જોઈ હોય તેવી દુનિયામાં તમને લઈ જાય છે. ટેક્નિકલ સુસજ્જ અને જોવામાં આકર્ષક, આઈમેક્સ અનુભવ વિશ્વનો સૌથી તાકાતવર અને ગળાડૂબ ઓતપ્રોત કરે તેવો મુવી અનુભવ છે અને તેની પાછળ કામ કરતી ટેક્નોલોજી પણ અદ્ભૂત અને અજોડ છે. આઈમેક્સનો અનુભવ વિદ્યાર્થીઓને વિજ્ઞાનના સિદ્ધાંતો અને રહસ્યો શીખવા માટે મંચ પૂરું પાડે છે, જે રસપ્રદ તેમજ આકર્ષક છે.

◆ હોલ ઓફ સાયન્સ :

હોલ ઓફ સાયન્સ એક મોટી ખુલ્લી પ્રયોગશાળા છે. “જ્યાં મુલાકાતીઓ પ્રદર્શિત થયેલ વસ્તુનો જાત અનુભવ કરી તેની સાથે સંકળાઈ સમજ મેળવે છે. અહીં મુલાકાતીઓ શોધ પ્રક્રિયા દ્વારા



વિજ્ઞાન વિશે જાણી શકે છે. પ્રકાશ, દૃષ્ટિ, અરીસા, ગતિશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, અવાજ, તરલતા ઊર્જા જેવા જુદા જુદા વિભાગોમાં ફરતાં તેઓ પ્રદર્શિત થયેલી વસ્તુનો સ્પર્શ દ્વારા અનુભવ પણ કરી શકે છે.”

#### ◆ હોલ ઓફ સ્પેશ :

ગુજરાત સાયન્સ સીટીમાં સર્જવામાં આવેલા અવકાશ ખંડ તમારી કલ્પનાશક્તિ જાગ્રત કરીને આશ્ચર્યમાં મુકી દેશે. વિવિધ નમુનાઓ, કોમ્પ્યુટર મલ્ટીમીડિયા, મલ્ટી સ્ક્રીન પેનારોમિક પ્રોજેક્શન, એનિમાટ્રોનિક્સ, મોશન સિમ્યુલેટર, ઈવેન્ટ સિમ્યુલેટર અને ક્વિઝ વગેરે તમે ત્યાં ઓતપ્રોત થઈ જશો. આ ખંડમાં તમને સુર્યમાળાની મુસાફરીનો અનુભવ કરાવવામાં આવે છે અને તમારા મનમાં એક પ્રશ્ન અચુક ઉદ્ભવે છે કે શું આટલા મોટા બ્રહ્માંડમાં આપણે એકલા જ છીએ ?

#### ◆ લાઈફ સાયન્સ પાર્ક :

જેનો હેતુ વિજ્ઞાન અને પ્રકૃતિને જીવનમાં લાવવાનો છે. આ સંવાદી અને ખુલ્લામાં પથરાયેલા પાર્કનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં પૃથ્વી પરના જીવનની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને સાહિત્યની સમજણ મેળવવા માટે પ્રકૃતિ અભ્યાસ કેળવવાની અભિરુચિ જગાવવાનો છે. લાઈફ સાયન્સ પાર્કમાં જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં તેમની આસપાસ જોવા મળતી જીવ સૃષ્ટિ જેવી કે ફુલ - છોડો અને પ્રાણીઓ પ્રત્યે કાળજી અને આદર રાખવાની સમજ કેળવી શકશે.

#### ◆ એનર્જી એજ્યુકેશન પાર્ક :

આ પાર્કનો હેતુ વિવિધ પ્રકારની ઊર્જાનું ઉત્પાદન અને સંરક્ષણ વિષે જાગરૂકતા ફેલાવવાનો છે. મુલાકાતીઓ વિવિધ પ્રકારના બિન - પારંપારિક ઊર્જા સ્ત્રોતના મહત્ત્વ વિષે તેમજ તેના સંવર્ધન - સંરક્ષણ વિષે સમજે છે. પાર્કમાં પ્રદર્શનની વસ્તુઓને પ્રાચીન ભારતીય તત્ત્વજ્ઞાન મુજબ, ઊર્જાના પાંચ મૂળભૂત તત્ત્વોમાં વહેંચવામાં આવેલી છે. (1) તેજ, (2) માૃત, (3) આપ, (4) ક્ષિતિ, (5) વ્યોમ.

#### ◆ બાળ-પ્રવૃત્તિ કેન્દ્ર :

ગુજરાત સાયન્સ સીટીમાં આખું વર્ષ મહત્ત્વના વૈજ્ઞાનિક દિવસો અને ઘટનાની ઉજવણી ચાલતી જ રહે છે અને તેમાં વિવિધ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો, કોમ્યુનિટી અને પ્રચાર માધ્યમો સંકળાયેલા હોય છે. આવી વૈજ્ઞાનિક ઘટનાઓ દર્શાવતું ભરચક અને સુયોજિત કેલેન્ડર એ પ્રકારનું પ્રથમ જ છે અને તમામ પ્રકારની વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને માહિતી માટે નોડલ રિસોર્સ સેન્ટર તરીકેની માન્યતા પ્રાપ્ત છે.

અહીંનો અભિગમ અને પદ્ધતિ કોમ્યુનિટી આધારિત શિક્ષણ પર આધારિત છે, જે શિક્ષણ પદ્ધતિથી અલગ પડે છે. તમામ કાર્યક્રમોનો હેતુ એ જ છે કે યુવા માનસમાં કલ્પનાશક્તિ જાગૃત કરવી, સર્જનાત્મકતાને પોષવી અને પ્રશ્નો પૂછવાનો અભિગમ કેળવવો.

કોઈ પણ પ્રકારના સામાજિક સ્તર, શિક્ષણ કે વયજૂથના બાળકોને તેમની મુલાકાત દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજીના આશ્ચર્યો જોવા મળે છે અને તમામ પ્રકારના ઉત્તેજક અને સમસામાયિક આનંદના સાધનો માણવા મળે છે અને જ્ઞાન પ્રાપ્તિથી સંસ્કૃતિને પોષવામાં આવે છે. એ માટે સાયન્સ સિટી નિયમિત રીતે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ કાર્યક્રમો અને વર્કશોપનું આયોજન કરતી રહે છે.

#### ◆ પ્લેનેટ અર્થ :

ગુજરાત સાયન્સ સિટીનું પ્લેનેટ અર્થ એવું અજોડ પ્રદર્શન છે. જેમાં મુલાકાતીઓને આપણા ગ્રહ, પૃથ્વી, તેની જૈવ સમૃદ્ધ, પ્રાકૃતિક સમસ્યાઓ અને ટેકનોલોજીની પ્રગતિની માહિતી આપવામાં આવે છે. તેનો હેતુ છે લોકોમાં વિવિધ પ્રકારની પ્રાકૃતિક આપદાઓ, જેમ કે ભૂકંપ, જ્વાળામુખી, ધરતી ખસવી વગેરે વિશે જાગરૂકતા ફેલાવવી અને તેનું શિક્ષણ તેમજ જ્ઞાન આપવું. સાથે - સાથે જ આપણા ગ્રહ પૃથ્વીની અદ્ભૂત સુંદરતા અને અઢળક માહિતીથી લોકોને માહિતગાર કરવા.

◆ મ્યુઝીકલ ફાઉન્ડેશન :

ગુજરાત સાયન્સ સિટી ખાતે આવેલ ડાન્સિંગ મ્યુઝીકલ ફાઉન્ડેશન ભારતનો સૌથી વિશાળ મ્યુઝીકલ ફાઉન્ડેશન છે. અહીં હાઈડ્રોસ્ટેટિક્સ, હાયડ્રોડાયનેમિક્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનું અદ્ભૂત પ્રદર્શન જોવા મળે છે. પાણીના ફુવારામાંથી નીકળતી પાણીની ધાર પ્રવાહીના તમામ ગુણધર્મો દર્શાવે છે. જેમાં પાસ્કલનો નિયમ અને બર્નોલીનો નિયમ પણ જોવા મળે છે. સાયન્સ સિટીનો મ્યુઝીકલ ફાઉન્ડેશન એટલે સંગીત અને વિજ્ઞાનનો માનવીય સર્જનાત્મકતા સાથે થયેલો સુભગ સમન્વય.

◆ એમ્ફિથિયેટર :

જેમાં 1200 જણા બેસી શકે છે. તેમાં વૈજ્ઞાનિક નાટકો, જાદુગરીના ખેલો અને અન્ય મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કલ્પનાશક્તિ કામે લગાડીને, વિદ્યાર્થીઓ અને સમાજનાં સભ્યો એક એવું વાતવરણ સર્જી શકે છે. જેમાં વિજ્ઞાનના તથ્યો અને આંકડાઓનો ઉત્તેજના, ઊર્જા અને આનંદ સાથેનો સમન્વય થયેલો જોવા મળી શકે.

21. ગુજરાત સાયન્સ સીટીના આઈમેક્સ થ્રીડી થિયેટરમાં કઈ ફિલ્મો દર્શાવવામાં આવે છે ?

જ. બોર્ન ટુ બી વાઈલ્ડ, પેંગ્વિન, આઈલેન્ડ ઓફ લેમૂર - મડાગાસ્કર, વોકિંગ ઓન ધ મુન, ટી-રેક્સ

22. ગુજરાત સાયન્સ સીટીના આઈમેક્સ થ્રીડી થિયેટરમાં કેટલા સમયગાળાની ફિલ્મો દર્શાવવામાં આવે છે ?

જ. 40 થી 45 મિનિટની

23. ગુજરાત સાયન્સ સીટીના આઈમેક્સ થ્રીડી થિયેટરની કુલ બેઠક ક્ષમતા કેટલી છે ?

જ. કુલ 647 સીટ

24. ગુજરાત સાયન્સ સીટી ખાતે વર્ષ દરમિયાન કયા કયા વૈજ્ઞાનિક દિવસોની ઉજવણી કરવામાં આવે છે ?

જ. વર્ષ દરમિયાન ગુજરાત સાયન્સ સીટી દ્વારા આરોગ્ય, પર્યાવરણ, હવામાન અંગેની જાગૃતિ દર્શાવતા, વિવિધ વિજ્ઞાનની સિદ્ધિઓ અંગેના કાર્યક્રમ તેમજ વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકોના જન્મદિવસની ઉજવણી વગેરે.

25. સાયન્સ સીટી ખાતે વર્ષ દરમિયાન કયા કયા શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ?

જ. વેકેશન ટ્રેનિંગ પ્રોગ્રામ, સાયન્સ ઓલમ્પિયાડ, સમર સાયન્સ પ્રોગ્રામ વગેરે સાયન્સ સીટી ગાંધીનગર ખાતે થતી વિજ્ઞાનિક પ્રવૃત્તિઓની યાદી

ક્રમ પ્રવૃત્તિઓ

1 નૂતન વર્ષ અને સત્યેન્દ્ર નાથ બોઝની જન્મદિવસની ઉજવણી

2 સ્ટીફન હોકિંગના જન્મદિવસની ઉજવણી

3 બેન્જામિન ફ્રેન્કલિનના જન્મદિવસની ઉજવણી

4 પ્રજાસત્તાક દિન

5 વર્લ્ડ વેટલેન્ડ્ઝ ડે

6 વિશ્વ કેન્સર દિવસ

7 થોમસ આલ્વા એડિસનના જન્મદિવસની ઉજવણી

8 સાયન્સ કાર્નિવલ

9 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

- 10 વર્લ્ડ ફોરેસ્ટ્રી ડે
- 11 વર્લ્ડ વોટર ડે
- 12 વિશ્વ હવામાન દિવસ
- 13 વેકેશન તાલીમ કાર્યક્રમ
- 14 વિશ્વ આરોગ્ય દિવસ
- 15 વિશ્વ પૃથ્વી દિવસ
- 16 રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ
- 17 વિશ્વ દૂરસંચાર દિવસ
- 18 કેરીયર એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી તકો ધોરણ - 12 સાયન્સ પછી
- 19 જૈવિક વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય ડે ની ઉજવણી
- 20 જી.સી.એસ.સી. ફાઉન્ડેશન ડે
- 21 વિશ્વ પર્યાવરણ દિવસ
- 22 વોટસન અને ક્રિક-ડીએનએ મોડેલના જન્મદિવસની ઉજવણી
- 23 ચાર્લ્સ કોલંબના જન્મદિવસ ઉજવણી
- 24 વર્ષના સૌથી લાંબો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
- 25 એબ્યુઝ અને ગેરકાયદે હેરફેરને સામે આંતરરાષ્ટ્રીય દિવસ
- 26 વિજ્ઞાન પર હાથ
- 27 વર્લ્ડ પોપ્યુલેશન ડે
- 28 આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઓલિમ્પીયાડ પર ઓરિએન્ટેશન પ્રોગ્રામ
- 29 જન્મદિવસ ઉજવણી સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ હિરોશિમા દિવસ
- 30 ઈન્ટરનેશનલ યુથ ડે રોક શો
- 31 ડૉ. વિક્રમ સારાભાઈ જંયતિ
- 32 સ્વતંત્રતા દિવસ
- 33 વર્લ્ડ ફોટોગ્રાફી ડે
- 34 અર્નેસ્ટ રૂથરફોર્ડના જન્મદિવસની ઉજવણી
- 35 શિક્ષક દિવસ
- 36 આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ
- 37 ઈજનેર ડે
- 38 વિશ્વ ઓઝોન દિવસ ઉજવણી
- 39 માઈકલ ફેરાડે જન્મદિવસ ઉજવણી
- 40 વર્લ્ડ હાર્ટ ડે
- 41 વન્યજીવન અઠવાડિયું
- 42 વર્લ્ડ પોસ્ટ ડે
- 43 વર્લ્ડ સ્પેશ વીક
- 44 કુદરતી હોનારતના ઘટાડા માટે આંતરરાષ્ટ્રીય દિવસ
- 45 રાષ્ટ્રીય પોષણ ડે

- 46 ડૉ. એ. પી. જે અબ્દુલ કલામ જન્મદિવસ ઉજવણી
- 47 યુનાઈટેડ નેશન્સ દિન
- 48 હોમી જહાંગીર ભાભા જન્મદિવસ ઉજવણી
- 49 સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ
- 50 સર ચંદ્રશેખર વેંકટ રમનના જન્મદિવસની ઉજવણી
- 51 વિશ્વ વિજ્ઞાન દિવસ
- 52 બાળદિન (રાજ્ય કક્ષા પેઈન્ટીંગ સ્પર્ધા)
- 53 વિશ્વ ડાયાબિટીસ દિવસ
- 54 જગદીશચંદ્ર બોઝના જન્મદિવસની ઉજવણી
- 55 વિશ્વ એડ્સ દિન
- 56 રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ
- 57 વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ
- 58 શ્રીનિવાસ રામાનુજના જન્મદિવસની ઉજવણી.
- 59 સર આઈઝેક ન્યૂટનના જન્મદિવસની ઉજવણી.

ગુજરાત સાયન્સસીટી વિદ્યાર્થી, વાલી અને સમાજમાં વિજ્ઞાન પ્રત્યેની જાગૃતતા ફેલાવવા માટેની સુંદર અને પ્રશંસનીય કામગીરી કરી રહી છે. દર વર્ષે હજારોની સંખ્યામાં શાળા અને વિદ્યાર્થીઓ તથા સમાજના લોકો તેની પ્રવૃત્તિઓ નિહાળવા આવે છે. સાયન્સસીટી, અમદાવાદ એ ગુજરાતની યશ કલગીનું એક છોગું ગણી શકાય.

#### સાયન્સસીટી અમદાવાદ

#### સંપર્ક :

Web Site : URL

<https://scity.gujarat.gov.in>

E-mail : [bookscity@gujarat.gov.in](mailto:bookscity@gujarat.gov.in)

Phone : 079 - 29703122

079 - 65 222127 - 128 - 130

Fax No : 079 - 29703121

Address : Gujarat Council of Science City,

Science city Rd., S.G Highway

Ahmedabad - 380060

## 2.8 સારાંશ

શાળામાં બાળકોને વિજ્ઞાન પ્રત્યે હકારાત્મક વલણ કેળવવા માટે વિજ્ઞાન વિષયને રસપ્રદ બનાવવો જરૂરી છે. વિજ્ઞાન વિષયને રસપ્રદ બનાવવા તેમાં ફળદાયી ભાગીદારીના, પ્રયોગ તથા સક્રિય રીતે બધા વિદ્યાર્થીઓ સંમેલીત થાય તે મહત્વનું છે. પ્રસ્તુત એકમમાં વિજ્ઞાન વિષયમાં નુતન પ્રવાહોની વાત કરવામાં આવી છે. જેમકે વિજ્ઞાન મંડળ, આકાશ દર્શન, ક્ષેત્ર પર્યટન, કૃત્રિમ નભોમંડળ, સાયન્સ સિટી જેવી બાબતો આવરી લેવામાં આવી એ પણ અગત્યની બાબત છે. વિજ્ઞાનમાં આવી પ્રવૃત્તિ બાળકમાં વિજ્ઞાન અંગેનો સંચાર કરે છે અને વિજ્ઞાન વિષયક દૃષ્ટિકોણ બિલવવામાં ભાગીદાર બને છે.

---

## 2.9 તમારી પ્રગતિ ચકાસો

---

(1) શાળામાં વિજ્ઞાનમંડળની રચના પ્રક્રિયાના સોપાનો જણાવો.

.....

.....

.....

.....

.....

.....

(2) વિજ્ઞાનમંડળની પ્રવૃત્તિઓ ઉપર વિશેષ નોંધ લખો.

.....

.....

.....

.....

.....

.....

(3) આકાશદર્શનનું મહત્ત્વ : આયોજન અને વિદ્યાર્થીને થતા લાભો વિશે ટૂંકમાં નોંધ લખો.

.....

.....

.....

.....

.....

.....

(4) “ક્ષેત્ર પર્યટનથી વિજ્ઞાનના વાસ્તવિક અનુભવો વિદ્યાર્થીને પૂરા પાડી શકાય” આ વિધાનની ચર્ચા તમારી શબ્દોમાં કરો.

.....

.....

.....

.....

.....

.....

(5) કૃત્રિમ નભોમંડળની ઉપયોગિતા ચર્ચો.

.....

.....

.....

.....

.....

.....

(6) ભારતમાં અને ગુજરાતમાં સ્થાપિત કૃત્રિમ નભોમંડળ વિશેની માહિતી આપો

.....  
.....  
.....  
.....  
.....  
.....

(7) અમદાવાદમાં આવેલ સાયન્સસિટીની પ્રવૃત્તિ તથા તેના મહત્ત્વ વિશે નોંધ લખો.

.....  
.....  
.....  
.....  
.....  
.....

---

## 2.10 સ્વાધ્યાય

---

પ્રશ્ન - ૧ નીચેના પ્રશ્નોના અતિ ટૂંકમાં ઉત્તર આપો.

- 1.1 વિજ્ઞાન મંડળના કોઈ બે કાર્યો લખો.
- 1.2 આકાશ દર્શન ક્યારે કરવામાં આવે છે.
- 1.3 ગુજરાતમાં આવેલા કૃત્રિમ નભોમંડળની યાદી આપો.
- 1.4 વિજ્ઞાનની જાણકારી આપતા અલગ-અલગ ક્ષેત્રપર્યટનની યાદી બનાવો
- 1.5 પ્રવાસનું મૂલ્યાંકન કરતા કોઈ બે વિધાનો લખો

પ્રશ્ન - ૨ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો.

- 2.1 આકાશ દર્શન કરવા માટેની તૈયારીના સોપાનો લખો.
- 2.2 ક્ષેત્રપર્યટનના પ્રકાર જણાવી આયોજન કરવાના સોપાનો લખો.
- 2.3 વિજ્ઞાન મંડળની કોઈ ૧૦ પ્રવૃત્તિ લખો.
- 2.4 ગુજરાત - સાયન્સ સીટી ની સ્થાપના અને તેની વિશેષ બાબતો પર નોંધ લખો.
- 2.5 પ્રવાસનું મૂલ્યાંકન કેવી રીતે કરાય ? સમજાવો

પ્રશ્ન - ૩ નીચેના પ્રશ્નોના વિસ્તૃત નોંધ લખો.

- 3.1 વિજ્ઞાન મંડળની રચના અને તેના કાર્યો પર વિસ્તૃત નોંધ લખો.
- 3.2 સાયન્સ સીટી અમદાવાદના કાર્યો તથા તેમાં જોવાલાયક વિભાગો વિશે નોંધ લખો.
- 3.3 તમે યોજેલા શાળાકીય પ્રવાસ અથવા ક્ષેત્ર પર્યટન વિશેનો વિસ્તૃત અહેવાલ લખો.
- 3.4 કૃત્રિમ નભોમંડળ વિદ્યાર્થીને કેવી રીતે ઉપયોગી થાય ? સમજાવો.
- 3.5 આકાશ દર્શન પર નીચેના મૂદ્દા ધ્યાને લઈ વિસ્તૃત નોંધ તૈયાર કરો.

(I) આકાશ દર્શનનું મહત્ત્વ.

(II) આકાશ દર્શનના કાર્યક્રમનું આયોજન

(III) આકાશ દર્શન કાર્યક્રમમાં પડતી મુશ્કેલીઓ



## વિજ્ઞાન શિક્ષણમાં સહાયક પ્રવૃત્તિઓ

: રૂપરેખા :

- 3.1 પ્રસ્તાવના
- 3.2 ઉદ્દેશ્યો
- 3.3 વિજ્ઞાન મેળો
- 3.4 વિજ્ઞાન સામયિકો
- 3.5 GUJCOST : સામાન્ય પરીચય
- 3.6 સારાંશ
- 3.7 તમારી પ્રગતિ ચકાસો
- 3.8 સ્વાધ્યાય

### 3.1 પ્રસ્તાવના

શાળાનું મુખ્ય ધ્યેય બાળકોનો સર્વાંગી વિકાસ કરવો એ છે. બાળકો તેના પાઠ્યક્રમને સમજતા થાય અને તેનો વ્યવહારમાં ઉપયોગ કરે એ મહત્વનું છે. વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં સંદર્ભોનું ખૂબ જ મહત્વ છે. વિદ્યાર્થીઓ ને વિષયવસ્તુનું જ્ઞાન ઉપરાંત અન્ય સંદર્ભો આપવામાં આવે તો તેનો વિકાસ પ્રવેગીત બને છે. પ્રસ્તુત એકમમાં વિજ્ઞાન જોઓ, વિજ્ઞાન સમન્યકો, GUJCOST જેવી સહાયક પ્રવૃત્તિઓનો પરીચય આપવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ લેતા કરશે, તથા તેના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની ખીલવણીમાં મહત્વનો ભાગ ભજવશે.

### 3.2 ઉદ્દેશ્યો

પ્રસ્તુત એકમના અભ્યાસ બાદ તમે

- વિજ્ઞાન મેળાની સમજણ આપી શકશો.
- વિજ્ઞાન સામયિકો વિશે વિસ્તૃત સમજ આપી શકશો.
- GUJCOST સંસ્થાનો પ્રાથમિક પરીચય મેળવી શકશો.

### 3.3 વિજ્ઞાન શિક્ષણમાં સહાયક પ્રવૃત્તિઓ

#### વિજ્ઞાનમેળો (Science Fair) :

વિજ્ઞાનમંડળમાં અધ્યેતાઓએ કરેલાં કાર્યોને પ્રદર્શિત કરવા માટે વિજ્ઞાનમેળો એ એક મહત્વપૂર્ણ માધ્યમ છે. વ્યક્તિ અને રાષ્ટ્રના વિકાસમાં વિજ્ઞાનમેળાનો ફાળો નોંધપાત્ર છે. અધ્યેતાઓના કાર્યની કદર કરી તેમને પ્રોત્સાહન આપવાનું મહત્વનું કાર્ય વિજ્ઞાનમેળા દ્વારા થાય છે.

#### ◆ વિજ્ઞાનમેળાની અગત્ય :

વિજ્ઞાનમેળાની અગત્ય નીચે મુજબ છે:

- અધ્યેતાઓએ વિજ્ઞાનના ક્ષેત્રે કરેલી પ્રવૃત્તિઓની નોંધ લઈ તેમની કદર કરી તેમને પ્રોત્સાહિત કરવા.
- અધ્યેતાઓને વિજ્ઞાનમૂલક પ્રવૃત્તિઓ પૂરી પાડી તેમનામાં રહેલી સુષુપ્ત વૈજ્ઞાનિક દૃષ્ટિને બહાર લાવી વિકસાવવી.
- વિજ્ઞાન પ્રત્યે ખાસ રુચિ ધરાવતા તેજસ્વી અધ્યેતાઓને પ્રોત્સાહન આપી તેમના વિકાસની મનોવૈજ્ઞાનિક અને સામાજિક જરૂરિયાતો સંતોષવી.
- વિજ્ઞાનના ક્ષેત્રે થયેલા કાર્યથી અન્ય શાળાઓ, વાલીઓ અને વિજ્ઞાનમંડળોને માહિતગાર કરવા.
- આમ જનતાનો વિજ્ઞાન પ્રત્યે રસ કેળવવો.
- અધ્યેતાઓએ મેળવેલા વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ તેઓ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં કરવામાં કરે તે માટે પ્રેરણા અને તકો પૂરી પાડવી તેમજ તેમની રસવૃત્તિને પોષવી.
- અધ્યેતાઓને તેમના સહકાર્યકર મિત્રોની તેમજ અન્ય વિજ્ઞાનમંડળોની પ્રવૃત્તિઓ જોવાની તેમજ અરસપરસ વિચાર વિનિમય કરવાની તક તેમને પૂરી પાડવી.
- સમાજના પ્રતિભાશાળી બાળકોને અને ભાવિ વૈજ્ઞાનિકોને ઓળખી તેમને યોગ્ય સગવડો અને તાલીમ આપી ઉત્તમોત્તમ પ્રગતિ થાય તે અંગે કાળજી લેવી.
- જે - તે વિસ્તારના લોકોને શાળા, અધ્યાપકો અને અધ્યેતાઓના કાર્યથી પરિચિત કરી તેમને એકબીજાની નજીક લાવવા.
- વ્યક્તિ તેમજ અધ્યેતાઓનો જીવન તરફનો દૃષ્ટિકોણ બદલાય, સૌ વૈજ્ઞાનિક ઢબે વિચારતા થાય અને તેમનામાં વૈજ્ઞાનિક ખ્યાલોની ભૂમિકા બંધાય એ માટે પ્રયત્નો કરવા.
- અધ્યેતાઓને તક, માર્ગદર્શન અને સગવડો પૂરી પાડી તેમને સ્વકીય પ્રવૃત્તિઓ દ્વારા સ્વતંત્ર



પ્રોજેક્ટ અને નેતાગીરીનું કાર્ય ઉપાડી શકવા સમર્થ બનાવવા.

- સમાજમાં વિજ્ઞાનનો ફેલાવો કરવો અને વૈજ્ઞાનિક પ્રયોગો, ચમત્કારી પ્રયોગો વગેરે રજૂ કરીને અભણ માણસોની અંધશ્રદ્ધા દૂર કરવી.

#### ◆ વિજ્ઞાનમેળાના પ્રકાર :

ગ્રામકક્ષાનો વિજ્ઞાનમેળો કે શાળાકક્ષાનો વિજ્ઞાનમેળો :

વિજ્ઞાનમેળાનો આ નાનામાં નાનો પ્રકાર છે. એક શાળાના મકાનમાં તે શાળા અથવા ગામની બે - ત્રણ શાળાઓ ભેગી મળીને આવો વિજ્ઞાનમેળો યોજે છે. જિલ્લા કક્ષાએ ભરાતા વિજ્ઞાનમેળામાં રજૂ કરવાના પ્રોજેક્ટ અને કૃતિઓની પસંદગી થઈ શકે તે આનો હેતુ છે. આમાં ખાસ લાભ એ છે કે દરેક અધ્યેતાને પોતાની કૃતિ રજૂ કરવાની વ્યક્તિગત તક છે. આ પ્રકારના વિજ્ઞાનમેળાની જવાબદારી વિજ્ઞાનમંડળ કે અધ્યેતાઓ સંભાળી શકે છે.

#### ◆ જિલ્લા કક્ષાનો વિજ્ઞાનમેળો :

જિલ્લાનાં ગામોની બધી શાળાઓ માટે આ મેળો ખુલ્લો હોય છે. આ મેળાનો લાભ અધ્યેતાઓ, અધ્યાપકો, વાલીઓ અને સ્થાનિક જનતાને મળે છે તેથી તે ખૂબ જ ઉપયોગી અને કિંમતી છે. આ મેળાનું સંચાલન શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવે છે. આ વિજ્ઞાનમેળાનો હેતુ પ્રાદેશિક કક્ષાના વિજ્ઞાનમેળા માટે સર્વોત્તમ કૃતિઓની પસંદગી કરવાનો છે.

#### ◆ પ્રાદેશિક કક્ષાને વિજ્ઞાનમેળો :

સેવા વિસ્તરણ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા જિલ્લાઓનો પ્રાદેશિક કક્ષાનો વિજ્ઞાનમેળો યોજવામાં આવે છે જેમાં સેવા વિસ્તરણના કાર્યક્ષેત્રના દરેક જિલ્લાઓ ભાગ લે છે. જિલ્લા કક્ષાના વિજ્ઞાનમેળાઓમાં પસંદ થયેલી શ્રેષ્ઠ કૃતિઓ આ મેળામાં રજૂ કરવામાં આવે છે. પ્રાદેશિક વિજ્ઞાનમેળામાં પસંદગી પામેલ સર્વશ્રેષ્ઠ કૃતિઓને રાજ્યકક્ષાના વિજ્ઞાનમેળામાં મોકલવામાં આવે છે.

#### ◆ રાજ્યકક્ષાનો વિજ્ઞાનમેળો :

પ્રાદેશિક કક્ષાના વિજ્ઞાનમેળાઓની શ્રેષ્ઠ કૃતિઓ અને પ્રોજેક્ટ અહીં રજૂ થાય છે. આથી આ મેળાઓ થોડાક મર્યાદિત બને છે.

દર વર્ષે આવા વિજ્ઞાનમેળાઓ રાજ્યમાં જુદાજુદા સ્થળોએ ભરાય છે અને તે દરેક રાજ્યમાં ભરાય છે. આ વિજ્ઞાનમેળાઓ ઘણા જ માર્ગદર્શનરૂપ બને છે, કારણ કે વિજ્ઞાન શિક્ષણના કાર્યની સફળતા રાજ્યકક્ષાના વિજ્ઞાનમેળા પરથી માપી શકાય છે. ગુજરાત રાજ્યમાં રાજ્યકક્ષાનો વિજ્ઞાનમેળો સૌપ્રથમ ફેબ્રુઆરી, 1966માં યોજાયો હતો.

#### ◆ રાષ્ટ્રીય કક્ષાનો વિજ્ઞાનમેળો :

રાષ્ટ્રભરમાંથી વિવિધ રાજ્યોના વિજ્ઞાનને લગતા સર્વોત્તમ નમૂના, શ્રેષ્ઠ પ્રોજેક્ટ અને વૈજ્ઞાનિક સાધનો આ પ્રકારના વિજ્ઞાનમેળામાં રજૂ થાય છે. આ પ્રકારના વિજ્ઞાનમેળાનો તમામ ખર્ચ NCERT ભોગવે છે. આ પ્રકારના વિજ્ઞાનમેળામાં પ્રથમ સ્થાન પામતી કૃતિની પસંદગી અને ચકાસણીનું ધોરણ ખૂબ જ કડક હોય છે. વળી આ મેળાને વધુમાં વધુ બાળભોગ્ય બનાવવામાં આવે છે. ક્યારેક બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ આવા રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાનમેળા યોજે છે.

#### ◆ આંતરરાષ્ટ્રીય કક્ષાનો વિજ્ઞાનમેળો :

આ વિજ્ઞાનમેળાનું કોઈ ચોક્કસ સ્વરૂપ નથી, પરંતુ દેશ-વિદેશની શાળાઓને જાપાન આમંત્રણ આપે છે અને પસંદગી પામેલ કૃતિનું તમામ ખર્ચ જાપાન ભોગવે છે. ત્યાંના સમાચારપત્રોએ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સ્પર્ધા યોજેલી જેમાં ભારતને પણ આમંત્રણ હતું. વિજ્ઞાનનાં વિવિધ, શોધ સંશોધનનું પ્રદર્શન પણ જાપાન યોજે છે જેમાં વિવિધ દેશોની સંસ્થાઓ ભાગ લે છે. આ પ્રકારના વિજ્ઞાનમેળાનું જો ચોક્કસ સ્વરૂપ બંધાય તો વિવિધ દેશો એકબીજા સાથે પરસ્પર સહકારથી જોડાય

અને વિજ્ઞાનની પ્રગતિનો પરિચય મેળવે અને સહિયારા પ્રયાસોથી વિજ્ઞાનને લોકહિત માટે વધુ ઉપયોગી બનાવવામાં સહયોગી બને. ક્યારેક અન્ય દેશો પણ આ પ્રકારના આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનમેળો યોજે છે.

◆ **વિજ્ઞાનમેળાના વિભાગો :**

વિજ્ઞાનમેળામાં સામાન્ય રીતે બે વિભાગો હોય છે :

- (i) ઉપલી કક્ષાના વિદ્યાર્થીઓ માટેનો વિભાગ : જેમાં ધોરણ - 8, 9, 10, 11, 12નો સમાવેશ થાય છે.
- (ii) નીચલી કક્ષાના વિદ્યાર્થીઓ માટેનો વિભાગ : જેમાં ધોરણ 5, 6, 7 નો સમાવેશ થાય છે. આ વિભાગમાં મૂલ્યાંકન કક્ષા મુજબ થવું જોઈએ.

◆ **વિજ્ઞાનમેળાનું આયોજન અને સમયપત્રક :**

વિજ્ઞાનમેળાના આયોજનમાં નીચેની બાબતોનો વિચાર કરવો :

- વિજ્ઞાનમેળા માટે યોગ્ય સ્થળની પસંદગી કરવી, જ્યાં પ્રદર્શન માટે પૂરતા ઓરડા, મેદાન, પાણી વીજળી વગેરેની સુવિધા મળી રહે અને તેમાં ભાગ લેનારા માટે રહેવા-જમવાની વ્યવસ્થા થઈ શકે.
- બધી જ શાળાઓને એક મહિના અગાઉ પરિપત્ર મોકલી તેનો પૂરતો પ્રચાર કરવો તેમજ તેમાં ભાગ લેવાની શરતો અંગે ચોખવટ કરવી.
- અંદાજ ખર્ચ, અંદાજ આવક અંગે વિચારણા કરી ખર્ચને પહોંચી વળવા માટેની યોજના કરવી.
- મુખ્ય મહેમાનો, નિષ્ણાતો, નિર્ણાયકો વગેરેની પસંદગી કરી તેમને નિમંત્રણો મોકલવાં.
- ઈનામ, પ્રમાણપત્રો, મૂલ્યાંકન યોજના, અહેવાલ, ફોટોગ્રાફી વગેરે અંગેની વ્યવસ્થા વિચારવી.
- વિજ્ઞાનમેળામાં ભાગ લેનારાનાં નામ, અગાઉથી મંગાવવા જેથી કેટલી જગ્યા જોઈશે, કેટલાં ઈનામ આપવાં પડશે વગેરે બાબતોનો ખ્યાલ આવે.
- ગ્રામકક્ષાનો વિજ્ઞાનમેળો જિલ્લા કક્ષાના વિજ્ઞાનમેળા કરતાં બે અઠવાડિયાં અગાઉ યોજવા અને તે જ પ્રમાણે દરેક ઉપલી કક્ષાના વિજ્ઞાનમેળા બબ્બે અઠવાડિયાનો ગાળો રાખીને યોજવા, કે જેથી નૂમના અને પ્રોજેક્ટમાં યોગ્ય સુધારાવધારા કરવા માટે પૂરતો સમય મળી રહે.

◆ **વિજ્ઞાનમેળાના વિવિધ કાર્યક્રમો :**

વિજ્ઞાનમેળામાં નીચેના કાર્યક્રમોનો સમાવેશ થઈ શકે :

- ઉદ્ઘાટન સમારોહ
- પ્રદર્શન અને તેને માટેની કૃતિઓ, પ્રયોગો, પ્રોજેક્ટ
- નિબંધ લેખન (અધ્યાપકો તેમજ અધ્યેતાઓ બંને માટે) અને નિબંધવાચન
- પેપર રીડીંગ - શિક્ષકો દ્વારા થયેલાં કોઈ નાનાં - મોટાં સંશોધનો કે અનુભવને આધારે તૈયાર કરેલ પેપરનું વાંચન
- વક્તૃત્વ સ્પર્ધા
- શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા
- પરિસંવાદ - વિજ્ઞાનના તજજ્ઞોને અગાઉથી વિષય આપી દઈ આ કાર્યક્રમ પણ યોજી શકાય.
- તજજ્ઞોનાં પ્રવચન - વાર્તાલાપ
- ફિલ્મ દર્શન કે નાટ્ય કાર્યક્રમ
- સ્થળ મુલાકાત - વિજ્ઞાનમેળાના સ્થળની નજીકનાં સ્થળોની મુલાકાતનો કાર્યક્રમ પણ ગોઠવી શકાય.
- વિજ્ઞાન શિક્ષણ - સાહિત્ય પ્રદર્શન

◆ **વિજ્ઞાનમેળામાં મૂલ્યાંકન :**

- કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરવાનું છે તેનો ભાગ લેનારાઓને તેમજ નિરીક્ષકોને સ્પષ્ટ ખ્યાલ આપવો.
- ત્રણ નિર્ણાયકો દરેક વિભાગ માટે રાખવા જેમાં અનુભવી વિજ્ઞાન શિક્ષકો, યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના પ્રાધ્યાપકો, તાલીમી સંસ્થાઓના વિજ્ઞાન વિષયના પ્રાધ્યાપકો તેમજ ખાનગી ઈજનેરોનો સમાવેશ કરી શકાય.
- મૂલ્યાંકન વખતે ભાગ લેનારાને હાજર રાખવા કે જેથી નિર્ણાયકો તેમને પ્રશ્નો પૂછી તેમની કૃતિનું યોગ્ય મૂલ્યાંકન અને ગુણવત્તા નક્કી કરી શકે. મૂલ્યાંકન થયા પછી જ વિજ્ઞાનમેળો આમ જનતા માટે ખુલ્લો મૂકી શકાય.
- વિજ્ઞાનમેળાની કૃતિઓના મૂલ્યાંકન માટે NCERT ની પુસ્તિકા Organising Science Fair માં નીચેની યોજના દર્શાવેલી છે.

**(i) વૈજ્ઞાનિક અભિગમ (Scientific Approach) :**

આ મુદ્દામાં કૃતિમાં વૈજ્ઞાનિક દષ્ટિબિંદુ, કાર્યકારણ સંબંધ, સિદ્ધાંતો કે હકીકતોની સ્પષ્ટ સમજ, સમસ્યા, પ્રશ્ન સિદ્ધાંતનું ક્રમિક પૃથક્કરણ વગેરે છે કે કેમ તે જોવામાં આવે છે.

**(ii) મૌલિકતા (Originality) :**

કૃતિની મૌલિક રચના, તેમાં નવા અને સુધારાયેલા વિચારો તેમજ નવા સર્જનાત્મક ચિંતનની રજૂઆત વિશે વિચારવામાં આવે છે.

**(iii) તાંત્રિક કૌશલ્ય અને કુશળતા (Technical skill and workmanship) :**

આમાં કૃતિની રચના, દેખાવ, સુશોભન, યોગ્ય લેબલ વગેરેની ધ્યાનાકર્ષકતા, કૌશલ્ય અને કુશળતા છે કે કેમ તે જોવામાં આવે છે.

- વિજ્ઞાનમેળાઓમાં પ્રદર્શિત થતી કૃતિઓને વિભાગવાર ઈનામો આપી અધ્યેતાઓની તર્કશક્તિ, સર્જનશક્તિ વગેરે વિકસાવવાની તકો પૂરી પાડવી.
- નિષ્ણાંતો, વિદ્વાનો, શિક્ષણકારો, તજજ્ઞો વગેરેનાં પ્રવચનો, સંમેલનો કે ચર્ચાસભાઓ આવા મેળાઓમાં યોજી તે દ્વારા વિજ્ઞાનમેળો જોવા આવનાર સૌને વિજ્ઞાનનું કાર્યકારી જ્ઞાન આપવું અને પરસ્પર વિચારોની આપ-લે નવી તકો પૂરી પાડવી.
- વિજ્ઞાનને લગતાં પુસ્તકો, સામયિકો પ્રદર્શિત કરી તેના વેચાણ દ્વારા વિજ્ઞાનના સાહિત્યના ઉત્પાદકો અને વિતરકોને આર્થિક લાભ કરાવી આપી આવા સાહિત્યના વધુ ઉત્પાદન અને વિતરણ માટે તેમને પ્રોત્સાહિત કરવા.
- વિજ્ઞાનમેળાઓમાં તંદુરસ્ત સ્પર્ધા દ્વારા અધ્યેતાઓમાં સંઘભાવના તથા નવી નવી વૈજ્ઞાનિક બાબતોનું સર્જન કરવાની વૃત્તિ વિકસાવવી.
- જુદાં જુદાં વિજ્ઞાનમંડળો પ્રવૃત્તિઓ અને વ્યક્તિગત કાર્યોના તુલનાત્મક અભ્યાસ માટે વિજ્ઞાનમંડળોના સભ્યોને તક પૂરી પાડવી.
- વિજ્ઞાનમેળા દ્વારા અધ્યાપકો અને અધ્યેતાઓને આવેલા નવીન વિચારોનો પ્રચાર કરવો.
- આયોજન, સંયોજન, મૂલ્યાંકનની પ્રક્રિયા દ્વારા આયોજક સમૂહમાં જવાબદારીની ભાવના પ્રગટે અને અન્ય જોનાર અધ્યેતાઓમાં પણ સામૂહિક જવાબદારીની ભાવના પ્રગટે.
- વિજ્ઞાનમેળાની મુલાકાત અને નોંધમાંથી વિજ્ઞાનમંડળની પ્રવૃત્તિઓ માટે પુષ્કળ ભાથું મળી રહે.
- વિજ્ઞાનક્ષેત્રે વિકાસ માટે જરૂરી સ્પર્ધાત્મક તત્ત્વ પૂરું પાડવું,
- નવાં નવાં શૈક્ષણિક સાધનો અને ઉપકરણો અન્ય શાળાઓ તેમજ ઉત્પાદકોના ધ્યાન પર લાવવાં.

- વિજ્ઞાન શિક્ષણની પદ્ધતિઓનું મૂલ્યાંકન કરવું.
- અધ્યેતાઓની સર્જનશક્તિ, તર્કશક્તિ, નિરીક્ષણશક્તિ, પ્રયોગશક્તિ, વિચારશક્તિ વગેરેને ઉત્તેજવી અને પોષવી, તેમજ તેમના વ્યક્તિગત તફાવતોને પોષવા.
- પ્રતિભાશાળી અધ્યેતાઓને પડકારરૂપ કાર્ય પૂરું પાડવું અને તેમને કંઈ વિશેષ કાર્ય કરવાની પ્રેરણા આપવી.
- વિજ્ઞાનમેળા દ્વારા વિજ્ઞાન શિક્ષકને પણ વર્ગ શિક્ષણકાર્યને પૂરક લાભ થાય છે.
- વિજ્ઞાનમેળાની તૈયારી માટે તેમાં ભાગ લેનાર અધ્યેતાઓને વિશેષ વાચનની પ્રેરણા મળે છે.

**(iv) સમગ્રતા (Thoroughness) :**

કૃતિમાં હકીકતની સંપૂર્ણતા, ચોક્કસાઈ, યોગ્ય વસ્તુ પર મૂકેલો યોગ્ય ભાર વગેરે છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે.

**(v) સૌંદર્યમૂલક (Dramatic Value) :**

કૃતિમાં ધ્યાનાકર્ષકતા, સુંદરતા, પૂરતા વર્ણન સાથેનાં મોટાં લેબલ છે કે કેમ તે જોવામાં આવે છે.

**(vi) વ્યક્તિગત મુલાકાત (Personal Interview) :**

કૃતિના રચનારની મુલાકાત લઈ તેમને પ્રશ્નો પૂછી તેઓ તેના સિદ્ધાંત બરાબર સમજ્યા છે કે કેમ, કૃતિની રચના તેમણે જ કરી છે કે કેમ, કૃતિની રચના તેમણે જ કરી છે કે કેમ, તેમના જ્ઞાનમાં આનાથી વધારો થયો છે કે કેમ, કૃતિ સંબંધી સંદર્ભ વાચન કર્યું છે કે કેમ વગેરે બાબતો જોવામાં આવે છે.

આમ, વિજ્ઞાનમેળો એ એ વિદ્યાર્થીઓમાં અને વિજ્ઞાન શિક્ષકોમાં રહેલી છુપી સર્જનશક્તિ કે વૈજ્ઞાનિક વિચારસરણીને બહાર લાવવા માટેનું મહત્ત્વનું પ્લેટફોર્મ છે. શાળા કક્ષાએ થતા વિજ્ઞાન મેળામાં શિક્ષકે ચોક્કસ ભાગ લઈ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારતા કરવા જોઈએ. તો જ ભવિષ્યમાં દેશને સારા વૈજ્ઞાનિકો મળી રહેશે.

**3.4 વિજ્ઞાન સામયિકો (Science Magazine)**

આજના સમયમાં વિજ્ઞાનનું મહત્ત્વ દિનપ્રતિદિન વધતું જાય છે. વિજ્ઞાન માત્ર વિજ્ઞાનના વિદ્યાર્થીઓ પૂરતું મર્યાદિત ન રહેતા સૌને માટે મહત્ત્વનું છે.

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રત્યે હકારાત્મક દૃષ્ટિકોણ વિકસે વિજ્ઞાનમાં રસ લેતા થાય તે માટે વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં આવતી માહિતીને સંદર્ભ સાથે રજૂ કરવામાં આવે તો તે રસપ્રદ અને માહિતીસભર બની રહે છે. આમ, પ્રવર્તમાન સમયમાં માત્ર પાઠ્યપુસ્તકો પર આધાર ન રાખતા વિજ્ઞાનને લગતું સંદર્ભ વાંચન જરૂરી છે. સંદર્ભવાંચન માટે ઘણા વિજ્ઞાનના પુસ્તકો બજારમાં પ્રાપ્ત છે. સાથે કેટલાક વિજ્ઞાનના સામયિકો પણ સરકારશ્રી દ્વારા કે ખાનગી પ્રકાશકો દ્વારા નિશ્ચિત સમયે પ્રકાશિત થતા હોય છે. શાળામાં આવા મેગેઝીન વિદ્યાર્થીઓ વાંચે તો તેનાથી તેઓને વિજ્ઞાનની અવનવી માહિતી પ્રાપ્ત થાય છે. જેનો ઉપયોગ એ પોતાની રોજબરોજની દૈનિક ક્રિયાઓ અને શિક્ષણની અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા જેવી કે વિજ્ઞાનમેળા, વિજ્ઞાનપ્રદર્શન, સેમિનાર, વર્કશોપ, સિમ્પોઝિયમ વગેરેમાં કરી શકતા હોય છે

નીચે વિજ્ઞાન અને ટેકનોલોજીના કેટલાક સામયિકોના નામ તેના પ્રકાશકો સાથે આપેલા છે.

**(1) Science Reporter**

Monthly Publication

Publication CSIR - National Institute of Science

Communication and Information Resources

Council of Scientific & Industrial Research

Editor : Hasan Jawaid Khan

Printed and Published by : NISCAIR, CSIR, New Delhi

Annual Subscription : 300 Rs.

(2) **विज्ञान प्रगति**

मासिक

संपादक : डॉ. बालक राम

प्रकाशक : वैज्ञानिक तथा औद्योगिक अनुसंधान परिषद, न्यु दिल्ली

वार्षिक लवाजम : ३०० Rs.

नकल किंमत : ३० Rs.

(3) **School Science**

Quarterly Journal

Publication : NCERT

(4) **सङ्गरी**

संपादक : लक्ष्मणपुष्करा, अमदावाद

तंत्री मुद्रक અને પ્રકાશક : નગેન્દ્ર વિજય

સામયિકનો પ્રકાર : માસિક

(5) **Resonance (A Journal of Science Education)**

Monthly Publish Magazine

Publisher : Indian Academy Of Science, Bangaluru

Subscription : 1000 Rs. for Institute Per Year

500 Rs. For Student Per Year

**3.5 GUJCOST : સામાન્ય પરીચય**

કોઈપણ દેશના વિકાસનો આધાર તેના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને પર સામાન્ય રીતે રહેલો હોય છે. માનવ ઉત્ક્રાંતિ અને માનવજાતના વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મહત્વનો ફાળો રહ્યો છે. સતત વિકસતી જતી ટેકનોલોજી અને હાલની પરિસ્થિતિનો સમન્વય કરીને રાજ્યના વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય તે હેતુથી સપ્ટેમ્બર 1986માં ગુજરાત સરકારે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીની સ્થાપના કરી (GUJCOST)

રાજ્યમાં વિકાસ કાર્યોને પ્રોત્સાહન આપવા તથા સમાજના ઘણા ક્ષેત્રોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી વિકાસના કાર્યોને વેગ આપવાના કાર્યમાં GUJCOST સતત પ્રયત્નશીલ રહે છે.

ફેબ્રુઆરી 2000થી GUJCOST ને સ્વાયત સંસ્થા તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ગાંધીનગર સેક્ટર 11માં GUJCOST નું વડુ મથક આવેલું છે. ભારત સરકારના Department of Science & Technology અંતર્ગત GUJCOST કામ કરે છે.

◆ **GUJCOST : Vision**

- જનસમુહના જીવનધોરણમાં વિજ્ઞાનના સંશોધન અને વિકાસ દ્વારા સુધારો કરવો. લોકોના કલ્યાણ અર્થે સંશોધનો કરવા તેમાં ગુણવત્તા લઈ આવવી. વિજ્ઞાન ટેકનોલોજી અને આર્થિક બાબતોને કુદરતી રીતે જોડી સમાજના ઉત્થાનના કાર્યો કરવા.

◆ **GUJCOST : MISSION**

- વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધન અને વિકાસના કાર્યો દ્વારા સમાજના શિક્ષિત યુવાનો, શિક્ષકો અને સામાન્ય નાગરિકોનું સાચું દિશા શોધન કરવું.

◆ **GUJCOST : હેતુ / ફરજો :**

- (1) વિજ્ઞાન અને ટેકનોલોજી વિકાસ માહિતી પ્રસરણ, વૈજ્ઞાનિક વાર્તાલાપના ઉપયોગ માટેના વિવિધ ક્ષેત્રો શોધવા અને તેનો ઉપયોગ વિકસિત વૈજ્ઞાનિકો અને રાજ્યના સામાજિક ક્ષેત્રના વિકાસમાં કરવો.
- (2) સમાજના બધા ક્ષેત્રે વિજ્ઞાન અને તકનીકીની ભાવના પોષવા કે જે તેના ઉપયોગને વધારે તે માટે તે માટે તકનીકી, વહીવટી, અને કાયદાકીય બાબતો સહિત વિવિધ નીતિનો અને પગલાઓ અંગે સરકારશ્રીને સલાહ આપવી.
- (3) રાજ્યની વિકાસની જરૂરિયાત પ્રમાણે વિજ્ઞાન અને તકનીકી યોજનાઓ તૈયાર કરવી અને આ યોજનાઓને રાજ્યની વાર્ષિક યોજના સાથે સાંકળવી.
- (4) મહત્વના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે વિકાસ અને સંશોધનના પ્રોજેક્ટ અને કાર્યક્રમો તેમજ પાયલોટ પ્રોજેક્ટનું નિદર્શન શરૂ કરવું, વિકાસ કરવો સહકાર આપવો સંકલન કરવું તેમજ રાજ્યના કુદરતી સ્ત્રોતોને સફળ અન્વેષણ માટે મદદ કરવી.
- (5) કેન્દ્ર/ રાજ્ય સરકાર કે અન્ય સંસ્થાની વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતી યોજનાનું અમલીકરણ કરવું.
- (6) વિજ્ઞાન અને ટેકનોલોજીના વૈજ્ઞાનિક માહિતીના પ્રસારને લોકપ્રિય બનાવવા ખાસ ઉદ્દેશ્ય સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં દસ્તાવેજી પુરાવા કેન્દ્રો અને પ્રયોગશાળા ઊભી કરવી અને તેનો વહીવટ કરવો.
- (7) વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પ્રવૃત્તિને પૂરક બનાવવા રાજ્ય સરકાર માટે નોડલ એજન્સી તરીકે કાર્ય કરવું. તેમજ સરકારી સંસ્થાઓ સાથે સંકલન કરવું વિજ્ઞાન અને તકનીકીના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓનું સંકલન કરવું, જેવા કે શિક્ષણ, તાલીમ, પ્રસિદ્ધિ અથવા જે કોઈ માહિતી કે બાબત સરકારશ્રી તરફથી સોંપવામાં આવે છે.
- (8) સંબંધિત ક્ષેત્રમાં ખાસ સંશોધનને નાણાકીય સહાય પૂરી પાડવી અને વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા પેપર્સ, જર્નલ્સ, સામયિકો, સમાચારપત્રો, પુસ્તકો પ્રસિદ્ધ કરવા.
- (9) પ્રિન્ટ મિડિયા અને ઈલેક્ટ્રોનિક મિડિયા બંને દ્વારા વિજ્ઞાન, તકનીકી ઊર્જા અને પર્યાવરણને લગતી માહિતી એકઠી કરવી અને પ્રસિદ્ધ કરવી.
- (10) કોઈપણ જાતની જ્ઞાતિ, ધર્મ, જાતિ, સામાજિક મોભો ધ્યાને લીધા વગર સ્વતંત્ર રીતે કે અન્ય એજન્સી સાથે મળીને વિજ્ઞાન અને ટેકનોલોજીના તાલીમ કોર્ષ, કાર્યશાળા, સેમીનાર કોન્ફરન્સ, ચર્ચા, વિસ્તૃત વિવરણ કન્સલ્ટન્સી, પ્રદર્શનો ગોઠવવા અથવા મદદ કરવી.
- (11) પરદેશી વૈજ્ઞાનિક એજન્સીઓ ટેકનોલોજીકલ મ્યુઝીયમ, કેન્દ્રો તથા વિજ્ઞાનને લગતા વ્યવસાયમાં આપ-લે, અભ્યાસ, પ્રવાસો, તાલીમ, સંયુક્ત પ્રોજેક્ટ વગેરે બાબતોને વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના હેતુ સાથે સુસંગત હોય તે બાબત અંગે કરાર કરવા.
- (12) “GUJCOST” ની કામગીરીના અમલ માટે જરૂરી ગણાય તેવી સમિતિઓ, અભ્યાસ જૂથો, કાર્યકારી જૂથોની રચના કરવી.
- (13) વિજ્ઞાન અને તકનીકીના વિકાસ હેતુને હાંસલ કરવા માટે જરૂર જણાય એવી નવી સંસ્થાની સ્થાપના કરવી અથવા સ્થાપવામાં મદદ કરવી.
- (14) વિવિધ સંસ્થાઓ, ટ્રસ્ટો કે કોઈ ખાનગી કોર્પોરેટ સાથે વિજ્ઞાન અને તકનીકીની લગતી કાઉન્સિલની કામગીરીમાં મદદ કરવી અને સંકલન કરવું. તેમજ તેમની વચ્ચે સહકાર સાધવો કે જેથી તેમના સમાન ઉદ્દેશ્યોને તે અનુરૂપ બની રહે.
- (15) વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રમાં સામાજિક અને કાયદાકીય ન્યાયની વૃદ્ધિ કરવી.

## ◆ GUJCOST ના કાર્યો

- Patent Information Centre ચલાવવું. જરૂર જણાય ત્યાં પેટેન્ટ હક્કો વગેરેની જાણકારી આપવી.
  - Centre for excellence (COE) ચલાવવું. જે અંતર્ગત સંશોધન ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવું.
  - વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા વણખેડાયેલા ક્ષેત્રોમાં શૈક્ષણિક સંસ્થાઓને Minor Research Project માટે આમંત્રિત કરવા અને તેના માટે પૂરતું અનુદાન આપવું.
  - જિલ્લા કક્ષાએ લોકવિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવી, તેને માર્ગદર્શન પૂરું પાડવું જરૂરી તાલીમ કાર્યક્રમો હાથ ધરવા અને તેના માટે પુરતા અનુદાનની વ્યવસ્થા કરવી.
  - GUJCOST અંતર્ગત દરેક જિલ્લામાં એક Community Science Center ની સ્થાપના કરવામાં આવી છે. જેને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર કહે છે. સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં વિજ્ઞાનના પ્રસાર અને પ્રચાર માટે એક જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર આવેલ છે. જેની સંપૂર્ણ દેખરેખ GUJCOST રાખે છે.
  - Department of Science & Technology અંતર્ગત GUJCOST 6 National Children Science Congress કાર્યક્રમ પણ ચલાવે છે. જે અંતર્ગત બાળકોને વિજ્ઞાન વિષયક ક્વિઝ, પ્રોજેક્ટ, પરીસંવાદ, કાર્યશાળા જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
  - વિજ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે GUJCOST Science Club તરફથી અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. જેમાં ગણિત વિભાગના પ્રયોગો, પ્રશ્નોત્તરી વિડીયો લેકચર વગેરે જેમાં અનેક બાળકો, અને સામાન્ય નાગરિકોએ ભાગ લીધો છે.
  - બાળરોગના માધ્યમથી નિયમિત પણે ગણિત-વિજ્ઞાન એપિસોડ પ્રસારિત થાય છે.
- આમ GUJCOST એ ગુજરાત સરકારશ્રી દ્વારા ચાલતી મહત્વની સ્વાયત સંસ્થા છે. જે વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર પ્રસાર માટે કાર્ય કરે છે. તેના logo માં જ

Invensting in Science

Insrersting in the future એવું સુત્ર પ્રદર્શિત થયેલ છે.

એક શિક્ષક તરીકે GUJCOST ના માધ્યમથી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના તમામ કાર્યક્રમોના આપણા વિદ્યાર્થીને ભાગ લેવડાવવો અને વિજ્ઞાન પ્રત્યે હકારાત્મક અભિગમથી જોતા કરવા એ આપણી નૈતિક ફરજ છે.

### 3.6 સારાંશ

પ્રસ્તુત એકમમાં આપણે વિજ્ઞાન શિક્ષણમાં સહાયક પ્રવૃત્તિઓ અંતર્ગત વિજ્ઞાનમેળો, વિજ્ઞાન સામયિકો અને GUJCOST વિશે વિસ્તૃત ચર્ચા કરી. શિક્ષકોને વિજ્ઞાન સામયિકો અને GUJCOST વિષેની ઊંડાણ માહિતિ મળી રહેશે અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન મેળામાં રસ લેતા કરવા તથા તેનામાં વિજ્ઞાન વિષયક વલણ કેળવવા આ મોડ્યુલ અત્યંત ઉપયોગી નિવડશે.

### 3.7 તમારી પ્રગતિ ચકાસો.

(1) વિજ્ઞાન મેળાના જુદા જુદા પ્રકારો વિશે નોંધ લખો.

.....

.....

.....

.....

.....

.....

(2) વિજ્ઞાન શિક્ષણમાં ઉપયોગી એવા બે દ્રશ્ય, બે શ્રાવ્ય અને બે દ્રશ્ય-શ્રાવ્ય સાધનો વિશે ઉદાહરણ દ્વારા સમજૂતી આપો, જરૂર જણાય ત્યાં આકૃતિ આપો.

.....  
.....  
.....  
.....  
.....  
.....

(3) તમે વાંચેલ કોઈ બે વિજ્ઞાન સામયિકોની વિશેષ ચર્ચા કરો.

.....  
.....  
.....  
.....  
.....  
.....

(4) વિજ્ઞાન સામયિકોનું મહત્ત્વ સ્પષ્ટ કરો.

.....  
.....  
.....  
.....  
.....  
.....

(5) GUJCOST નો સામાન્ય પરિચય આપી તેની પ્રવૃત્તિઓ વિશે નોંધ લખો.

.....  
.....  
.....  
.....  
.....  
.....

---

### 3.8 સ્વાધ્યાય

---

પ્રશ્ન - ૧ નીચેના પ્રશ્નોના અતિ ટૂંકમાં ઉત્તર આપો.

- 1.1 વિજ્ઞાન મેળાના પ્રકાર લખો.
- 1.2 વિજ્ઞાન મેળાનો ખર્ચ કોણ ભોગવે છે ?
- 1.3 વિજ્ઞાનના કોઈ બે સામયિકનું નામ તેમાં પ્રકાશન અને સંપાદક સાથે જણાવો.
- 1.4 GUJCOST પૂર્ણ નામ લખો
- 1.5 GUJCOST નું VISION લખો



પ્રશ્ન - ૨ નીચેના પ્રશ્નોના ટુંકમાં ઉત્તર આપો.

- 2.1 GUJCOST ના કોઈ છ કાર્યો લખો
- 2.2 વિજ્ઞાન સામયિકનું મહત્વ લખો.
- 2.3 વિજ્ઞાનમેળામાં થતા વિવિધ કાર્યક્રમોની ચર્ચા કરો.
- 2.4 વિજ્ઞાનમેળાની અગત્યતા દર્શાવતા આઠ મુદ્દા લખો.
- 2.5 આંતરરાષ્ટ્રીય કક્ષાનો વિજ્ઞાનમેળા વિશે ટુંકમાં લખો.

પ્રશ્ન - ૩ નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો.

- 3.1 વિજ્ઞાનમેળામાં મૂલ્યાંકન કયા પાસાંને ધ્યાને રાખીને કરવામાં આવે છે? સમજાવો.
- 3.2 ટૂંકનોંધ લખો : વિજ્ઞાનમેળાની અગત્યતા અને તેના પ્રકાર.
- 3.3 ટૂંકનોંધ લખો : વિજ્ઞાન સામયિકો અને તેના ઉદાહરણ
- 3.4 વિસ્તૃત નોંધ લખો : GUJCOST
- 3.5 વિજ્ઞાનમેળામાં તમોએ રજૂ કરેલ કૃતિ વિશે ૫૦૦ શબ્દોમાં અહેવાલ તૈયાર કરો.

## : રૂપરેખા :

- 4.1 પ્રસ્તાવના
- 4.2 ઉદ્દેશ્યો
- 4.3 વિજ્ઞાન શિક્ષણની પ્રયોગશાળાનો અર્થ અને સંકલ્પના
- 4.4 પ્રયોગશાળાનું મહત્વ
- 4.5 પ્રયોગશાળાનું આયોજન
- 4.6 માધ્યમિક શાળાની પ્રયોગશાળા
- 4.7 ઉચ્ચતર માધ્યમિક શાળાની પ્રયોગશાળા
- 4.8 પ્રયોગશાળાનું સંચાલન, જાળવણી અને સલામતી
- 4.9 સારાંશ
- 4.10 તમારી પ્રગતિ ચકાસો
- 4.11 સ્વાધ્યાય
- 4.12 સૂચિત સંદર્ભ વાચન

---

#### 4.1 પ્રસ્તાવના :

વિજ્ઞાન માત્ર પુસ્તકોમાંથી જ વાંચીને શીખી શકાતું નથી. તેને માટે અધ્યેતાએ જાતે પ્રયોગ કરવો પડે છે, નિરીક્ષણ, અવલોકન કરવું પડે છે. એ સિવાય અધ્યેતાઓ સાચા અર્થમાં વિજ્ઞાનના વિષયને સમજી શકશે નહિ. વીસમી સદીના આરંભ સુધી કોલેજોમાં પણ વિજ્ઞાન મોટે ભાગે વ્યાખ્યાન દ્વારા જ શીખવવામાં આવતું. કેટલીક કોલેજોમાં ઉત્સાહી અધ્યાપકો પ્રયોગોનું માત્ર નિદર્શન બતાવતા. ધીમે-ધીમે માધ્યમિક કક્ષાએ જેમ-જેમ વિજ્ઞાનનું મહત્ત્વ વધતું ગયું તેમ તેમ શાળાઓ એકાદ કબાટમાં વિજ્ઞાનનાં સાધનો વસાવતી થઈ અને વિજ્ઞાન શિક્ષકો તેમને આવડે એવા પ્રયોગો કરીને વિજ્ઞાન શીખવતા. 1940ની સાલ સુધી આ પરિસ્થિતિ રહી. ત્યાર પછી કેટલીક પ્રગતિશીલ શાળાઓમાં પ્રયોગશાળાના નામે ઓળખાતો એક જુદો ઓરડો રાખવાની શરૂઆત થઈ, જેમાં અધ્યેતાઓને જૂથમાં પ્રયોગો આપવામાં આવતા. ત્યારબાદ સમય જતા સ્વીકારવામાં આવ્યું કે જો વિજ્ઞાન શિક્ષણને રસપ્રદ અને આત્મસાત થઈ શકે તેવું બનાવવું હોય તો અધ્યેતાની આસપાસ વિજ્ઞાનમય વાતાવરણ ઊભું કરવું જરૂરી છે. અને તેને પ્રયોગશાળામાં લઈ જઈ ત્યાં પ્રયોગના હેતુથી લઈ તારણ સુધીની ક્રિયાવિધિ અનુસરવામાં આવે તો વિજ્ઞાન શિક્ષણ આત્મસાત થઈ શકે.

આમ, સમય જતા વિજ્ઞાનની પ્રયોગશાળાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું અને તેને લઈને આજે વિજ્ઞાન શિક્ષણ પ્રયોગમય થઈ ગયું છે.

---

#### 4.2 ઉદ્દેશ્યો :

પ્રસ્તુત એકમના અભ્યાસબાદ તથા..

- વિજ્ઞાન શિક્ષણની પ્રયોગશાળાનો અર્થ અને સંકલ્પના રજૂ કરી શકશો.
- પ્રયોગશાળાનું શિક્ષણમાં મહત્ત્વ સમજાવી શકશો.
- પ્રયોગશાળાનું આયોજન કેવું હોય ? તેની સમજણ આપી શકશો.
- પ્રયોગશાળાનું સંચાલન, જાળવણી અને સલામતી વિશે માહિતિ આપી શકશો.

---

#### 4.3 વિજ્ઞાન શિક્ષણની પ્રયોગશાળાનો અર્થ અને સંકલ્પના :

“સામાન્ય રીતે પ્રયોગ સાધનો ધરાવતા અને અધ્યાપક તેમજ અધ્યેતાઓ પ્રયોગો કરી શકે એવી સુવિધા ધરાવતા ખંડને પ્રયોગશાળા કહી શકાય.” .

પ્રારંભમાં જ્યારે વિજ્ઞાનમાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર એમ બે જ શાખાઓ શીખવવામાં આવતી પરંતુ સામાન્ય વિજ્ઞાનનો ખ્યાલ અમલમાં મુકાતાં વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર વગેરે માટે શાળાના બોટેનીકલ ગાર્ડનમાં અથવા તો બહાર ખુલ્લા આકાશ નીચે અનુક્રમે વનસ્પતિશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર અંગેના પ્રયોગો કરવાના હોય છે. તેથી પ્રયોગશાળાની સંકલ્પના અત્યંત વિશાળ બની જાય છે. તેથી પ્રયોગશાળાનો અર્થ સમજાવતી ઉપરોક્ત વ્યાખ્યા પરિપૂર્ણ નથી. આથી પ્રયોગશાળાની વિશાળ સંકલ્પનાને સમાવતું વિધાન કરવું હોય તો એમ કહી શકાય કે, જ્યાં જ્યાં પ્રયોગ ત્યાં ત્યાં પ્રયોગશાળા. આમ પ્રયોગશાળા માટે ઉપરોક્ત અર્થ વધારે બંધબેસતો છે. જો કે પ્રયોગશાળાની વિશાળ સંકલ્પનાને અનુરૂપ પ્રયોગશાળાઓ આપણા દેશની શાળાઓમાં હાલમાં જોવા મળતી નથી. અહીં આપણે આ જ કારણથી પ્રયોગો કરી શકવાની સુવિધાવાળો ખંડ એટલે પ્રયોગશાળા એવો સંકુચિત અર્થ જ લઈશું. વળી પ્રયોગો અને ખાસ સંજોગોમાં વિજ્ઞાનના સામાન્ય શિક્ષણનું કાર્ય એમ બંને કાર્ય જે એક જ ખંડમાં કરી શકાય તેવી બેવડી સગવડવાળા ખંડને પણ આપણે પ્રયોગશાળા કહીશું.

---

#### 4.4 પ્રયોગશાળાનું મહત્ત્વ :

આપણા દેશમાં શિક્ષણ સુધારણા માટે એક પછી એક પંચો નિમાતાં ગયાં. દરેક પંચે વિજ્ઞાનના શિક્ષણ પર ભાર આપ્યો અને તેના શિક્ષણની અગત્ય સ્વીકારી. વિજ્ઞાનનું શિક્ષણ પ્રાયોગિક કાર્ય સિવાય અધૂરું ગણાય તે પણ સ્વીકાર્યું. છતાં પણ આજે આપણી ખૂબ જ ગણીગાંઠી શાળાઓમાં અધ્યેતાઓ પ્રયોગો સાથે વિજ્ઞાન શીખે છે. ખરેખર તો પ્રયોગો સિવાય વિજ્ઞાન શીખવવું એ તદ્દન અયોગ્ય છે. કોઠારી કમિશને પણ નોંધ્યું છે કે,

“To learn science is to do science. There is no other way of learning science.”

જાતે પ્રયોગો કરવાની જે અસર અધ્યેતાઓના મન પર પડે છે, તેવી અસર બીજી રીતે ઉદ્ભવી શકે નહિ. મૂર્ત વસ્તુઓ સાથે કામ કરવાથી જ અમૂર્ત ખ્યાલોનો સારો વિકાસ થઈ શકે.

પ્રયોગશાળાનું મહત્ત્વ દર્શાવતા મુદ્દાઓ નીચે મુજબ છે :

- અધ્યેતાઓમાં આત્મસૂઝ અને સર્જનશીલતા જેવા ઉચ્ચ ગુણોનો વિકાસ પ્રયોગશાળામાં જ શક્ય છે.
- અધ્યેતાઓમાં ઉત્સાહ, ધીરજ, ખંત, ચપળતા, ચોક્કસાઈ જેવા ગુણો પ્રયોગશાળામાં કરવામાં આવતા પ્રયોગો દ્વારા જ સારી રીતે ખીલી શકે.
- પ્રયોગશાળામાં કરેલા પ્રાયોગિક કાર્ય વડે જ અધ્યેતાઓની ઊંડું અવલોકન કરવાની શક્તિ, પ્રાયોગિક કૌશલ્યો અને તે દ્વારા તર્ક અને નિર્ણય શક્તિ વિકસી શકે.
- પ્રયોગશાળામાં પ્રયોગો કરતાં કરતાં જ અધ્યેતાઓમાં પ્રયોગનાં સાધનો પસંદ કરવાનું, સાધનો વાપરવાનું, સાધનો ગોઠવવાનું તેમજ વૈકલ્પિક સાધનો પસંદ કરવાનું કૌશલ્ય વિકસે છે અને તે દ્વારા જ વિજ્ઞાનના સિદ્ધાંતોની સચોટ સમજ તેમનામાં વિકસે છે.
- પ્રયોગશાળામાં કરેલા પ્રયોગો દ્વારા જ અધ્યેતાઓ રચનાત્મક શક્તિ અને વૈજ્ઞાનિક વલણો કેળવી શકે છે.
- પ્રયોગશાળામાં જૂથમાં પ્રયોગો કરીને અધ્યેતાઓ સહકારની ભાવના અને સંઘભાવના કેળવે છે.
- પ્રયોગ દ્વારા અધ્યેતાઓ ‘સ્વ’નો આનંદ મેળવે છે અને તેમનામાં આત્મવિશ્વાસ પેદા થાય છે.
- પ્રયોગ કરતાં જ અધ્યેતાઓ ધીરજવાળા અને ખંતીલા બને છે.
- પ્રયોગશાળાના કાર્ય વડે જ અધ્યેતાઓ બનાવો કે ઘટનાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને તેના પરથી જે તે ઘટના કે બનાવ અંગે અનુમાન કરવાની શક્તિ વિકસાવે છે.
- પ્રયોગશાળામાં પ્રયોગો કરીને અધ્યેતાઓ પોતે સમજેલ જ્ઞાનનો જીવનમાં અન્ય ક્ષેત્રે સારી રીતે ઉપયોગ કરી શકે છે.
- અધ્યેતાઓને માધ્યમિક કક્ષાએ શક્ય એટલા વધારે પ્રયોગો પ્રયોગશાળામાં કરવા દઈને દેશ ટેકનીકલ ક્ષેત્રે સારો વિકાસ સાધી શકશે તેમજ દેશ આધુનિકીકરણ માટે આત્મનિર્ભર બનશે.
- અધ્યેતાઓને પ્રયોગશાળામાં મહત્તમ પ્રયોગો કરતા કરવાથી ભવિષ્યમાં તેમનામાંથી જ દેશને સારા વૈજ્ઞાનિકો મળી રહેશે. તદુપરાંત દેશને યંત્ર-તંત્ર વિદ્યાની આયાત કરવી પડશે નહિ.
- અધ્યેતાઓને પ્રયોગશીલ બનાવીને બીજાં સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રોની જેમ આપણે પણ સમૃદ્ધિનાં સોપાનો એક પછી એક સર કરી શકીશું.
- સમૃદ્ધ પ્રયોગશાળાઓની સુવિધાઓ ઊભી કરીને આપણે અધ્યેતાઓને પ્રયોગશીલ અને સક્ષમ બનાવી શકીશું કે જેથી તેમને આપણા દેશમાં જ ઉત્તમ કારકિર્દી ઘડવાની તકો પ્રાપ્ત થશે અને તેમને પરદેશ તરફ નજર નહીં નાખવી પડે.
- શાળામાં જો પ્રયોગશાળાનો ખંડ અલગ હોય તો વિજ્ઞાનને લગતી સઘળી સાધનસામગ્રી તેમાં એક જ જગ્યાએ રાખવામાં આવે છે, તેથી તે જ્યાં ત્યાં શોધવી પડતી નથી, જરૂર પડે ત્યારે તે તરત જ હાથ લાગે છે અને તેથી સમયની બચત થાય છે.
- પ્રયોગશાળાનો અલગ ખંડ વિજ્ઞાનના અધ્યયનના હેતુસર અધ્યેતાઓ માટે એક પ્રકારનો માહોલ ઊભો કરે છે, વાતાવરણ ઊભું કરે છે, જેથી અધ્યેતાઓ રસપૂર્વક અને વધારે ધ્યાનપૂર્વક વિજ્ઞાન શીખે છે.
- જો શાળામાં અલગ પ્રયોગશાળા ન હોય તો વિજ્ઞાનનાં સાધનો વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાં પડે છે તેથી તૂટફૂટ વધારે થાય છે અને શાળાને આર્થિક નુકસાન ખમવું પડે છે.

◆ વિજ્ઞાનખંડની સંકલ્પના અને સજાવટ :


વિજ્ઞાનનો મુખ્ય ઓરડો જ્યાં વર્ગના બધા જ અધ્યેતાઓ એક સાથે બેસી શકે અને વિજ્ઞાનના અધ્યાપક પોતાનું અધ્યાપન કાર્ય કરી શકે, તેમને એકસાથે ભણાવી શકે, વળી જરૂર પડ્યે આ જ ખંડમાં અધ્યાપક પ્રયોગનું નિદર્શન પણ કરી શકે, શાળાના આવા ખંડને વિજ્ઞાનખંડ તરીકે ઓળખવામાં આવે છે. આ ખંડને વિજ્ઞાન પ્રવચન ખંડ (Science Lecture Room) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અગાઉ આપણે શાળાના પ્રયોગશાળા ખંડની સંકલ્પના સમજ્યા છીએ. વિજ્ઞાનખંડ અને વિજ્ઞાન પ્રયોગશાળાએ બંનેમાં મૂળભૂત ભેદ એ છે કે વિજ્ઞાનખંડમાં વિજ્ઞાનનું અધ્યાપનકાર્ય તથા અધ્યાપક દ્વારા પ્રયોગ નિદર્શન કરી શકાય છે, પણ તેમાં અધ્યેતાઓ જાતે પ્રયોગો કરી શકે તેવી સુવિધા હોતી નથી. જ્યારે વિજ્ઞાન પ્રયોગશાળામાં વિજ્ઞાનના પ્રયોગોનું અધ્યાપક દ્વારા નિદર્શન કરવાની તેમજ અધ્યેતાઓને જાતે પ્રયોગ કરવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આપણે ત્યાં શાળાઓમાં મોટેભાગે આવા બે અલગ ખંડો હોતા નથી. પરંતુ જો શાળા આર્થિક રીતે સદ્ગર હોય અને શાળા પાસે જગ્યાની છૂટ હોય તો પ્રયોગશાળા અને વિજ્ઞાનખંડ અલગ હોવા જોઈએ. જો તે શક્ય ન હોય તો બંને ખંડો ભેગા રાખવા જોઈએ.

4.5 પ્રયોગશાળાનું આયોજન :

શાળાઓમાં મોટે ભાગે બે તબક્કાઓ માટે પ્રયોગશાળાઓ હોય છે. માધ્યમિક શાળાની પ્રયોગશાળા - ઉચ્ચતર માધ્યમિક શાળા માટેની પ્રયોગશાળાઓ. આપણે આ બંને પ્રકારની પ્રયોગશાળાઓ માટેનાં આયોજનો વિશે જોઈએ.

4.6 માધ્યમિક શાળાની પ્રયોગશાળા :

માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાનની અલગ અલગ પ્રયોગશાળાઓ બનાવવી કોઈપણ શાળાને આર્થિક રીતે પરવડે નહિ. તેથી એવી એક પ્રયોગશાળા બનાવવી જોઈએ કે જેથી વિજ્ઞાનની બધી શાખાઓ માટે પર્યાપ્ત બની રહે. આવી પ્રયોગશાળાનો એક પ્લાન નીચે આપેલ છે.



આકૃતિ : પ્રયોગશાળાનું આયોજન

ઉપરોક્ત પ્રયોગશાળા 40 અધ્યેતાઓને પ્રયોગ કરવા માટે પૂરતી છે. તેમાં વપરાયેલી સંજ્ઞાઓની સમજૂતી નીચે આપી છે.

- |                            |                    |
|----------------------------|--------------------|
| D.T. = Demonstration table | B.B. = Black board |
| Bl.B = Bulletin board      | S = Sink           |
| D = Door                   | W = window         |

Cup B. = Cupboard	G.B = Germination bed
E.T. = Experimental table	T.T = Teacher's table
T.H. = Top head	S.B. = Switch board

### દાર્શનિક ટેબલ (D.T.)

દાર્શનિક ટેબલ 3 મીટર લાંબું, 1 મીટર પહોળું અને 1.5 મીટર જેટલી ઊંચાઈ ધરાવતું હોવું જોઈએ. તેની બરાબર પાછળના ભાગમાં દીવાલ પર 4 મીટર લાંબું અને 1.5 મી. પહોળાઈ ધરાવતું કાળું પાટિયું (B.B.) હોવું જોઈએ. કાળા પાટિયા અને દાર્શનિક ટેબલ વચ્ચેનું અંતર 1 મીટર હોય. દાર્શનિક ટેબલને અડીને અધ્યાપકનું ટેબલ (T.T.) હોય છે, જેના પર અને તેનાં ખાનાંઓમાં અધ્યાપકનાં પુસ્તકો, કેટલાંક નાના કદનાં શૈક્ષણિક સાધનો, સામયિકો વગેરે રાખી શકાય છે. કા.પા. આંખને અનુકૂળ આવે તેવા રંગનું હોવું જોઈએ. કા.પા.ની બંને બાજુ બે બુલેટિન બોર્ડ (BI.B.) રાખવામાં આવે છે. જે બૂચનાં બનાવેલાં હોવાં જોઈએ. તેમાં વિજ્ઞાનને લગતા સમાચારો, સામયિકોમાં પ્રગટ થતા ફોટાઓ અને વિજ્ઞાન અંગેની અન્ય જરૂરી માહિતી મૂકી શકાય. બુલેટિન બોર્ડની પાસેની ખાલી રહેતી જગ્યામાં બેરોમીટર, લઘુત્તમ -મહત્તમ તાપમાન માપકો, ભેજમાપકો વગેરે રાખવાં અને તેમનાં રોજબરોજનાં અવલોકનોની નોંધ લેવાનું કાર્ય અધ્યેતાઓને સોંપવું તથા તેમની ગ્રાફીકલ રજૂઆત બુલેટિન બોર્ડ પર થાય તેવી વ્યવસ્થા કરવી, દાર્શનિક ટેબલ અને અધ્યાપકના ટેબલનાં ખાનાઓમાં વિજ્ઞાનને લગતાં પુસ્તકો પણ રાખી શકાય જે પુસ્તકોનો ઉપયોગ વિજ્ઞાનના અધ્યાપકો તેમજ અધ્યેતાઓ સંદર્ભ માટે કરી શકે. D.T. ની પાછળ B.B. અને BI.B. ની વચ્ચેની જગ્યામાં સ્વિચ બોર્ડ રાખવું, જેથી અધ્યેતાઓને દાર્શનિક પ્રયોગો બતાવતી વખતે જેમાં જરૂર હોય તેવા પ્રયોગોમાં વીજપ્રવાહ પૂરો પાડી શકાય. દીવાલમાં વાંકિયાં લગાવીને તેના પર ચારે બાજુ લીન્ટલથી ઉપરના ભાગમાં કાચવાળાં કબાટ બનાવી શકાય, જેમાં વિજ્ઞાનનાં પુસ્તકો અથવા વિજ્ઞાનની અન્ય સાધનસામગ્રી રાખી શકાય. દાર્શનિક ટેબલ 1.5 મીટર ઊંચું હોવું જોઈએ કે જેથી બધા જ અધ્યેતાઓ સહેલાઈથી પ્રયોગો જોઈ શકે. દાર્શનિક ટેબલના વચ્ચેના ભાગમાં ઘરોમાં ડાઈનિંગ ટેબલ પર હોય છે. તેવા ગોળ પરિભ્રમણ કરતા ટેબલની વ્યવસ્થા પણ થઈ શકે, જેની મદદથી મોડેલ, નમૂના વગેરે ગોળ ફેરવીને ચારે બાજુથી અધ્યેતાઓને સરળતાથી બતાવી શકાય. વળી આ પ્રયોગશાળામાં અધ્યેતાઓને બેસવાની વ્યવસ્થા અર્ધગોળાકારમાં કરેલી હોવાથી દાર્શનિક પ્રયોગો કે અન્ય દાર્શનિક રજૂઆતો દૂરથી જોવામાં તેમને જરાયે તકલીફ પડશે નહિ. દાર્શનિક ટેબલ લાકડાનું બનેલું હોય, પરંતુ તેના ઉપરના ભાગમાં સિમેન્ટ કે એસ્બેસ્ટોસનું શીટ લગાડેલું હોય કે જેથી તેના પર એસિડ કે આલ્કલીની અસર ન થાય, નહીંતર ટેબલ થોડા જ સમયમાં બગડી જશે અને બિનઉપયોગી બની જશે. D.T. પર એક ખૂણા પર સિન્ક રાખવામાં આવે જેમાં પાણી મેળવવાની અને વપરાયેલ પાણીના નિકાલની વ્યવસ્થા હોય. ટેબલમાં નીચેના ભાગમાં એવાં બે ખાના રાખવામાં આવે, જે પૈકી એકમાં બતાવેલા વૈજ્ઞાનિક સાધનો અને બીજામાં બતાવવાનાં બાકી વૈજ્ઞાનિક સાધનો અલગ અલગ રાખી શકાય. આ જગ્યામાં તૂટે ફૂટે નહિ એવાં સાધનો જેવાં કે સ્ટેન્ડ, જાળી, લિટમસ પેપરો, ફિલ્ટર પેપરો અને અન્ય સાધનો રાખવા માટેનું પણ અલગ ખાનું હોવું જોઈએ. વળી જે તે ખાનામાં જે સાધનો રાખેલા હોય તેની યાદી બનાવી ખાનાની બહાર ચોંટાડવી.

### ◆ અધ્યાપકનું ટેબલ (T.T)

આ ટેબલ 1 મી. × 0.75 મી.ના માપનું હોવું જોઈએ. તેની નીચે ડ્રોઅર ટાઈપનાં ત્રણથી ચાર ખાનાઓ રાખી શકાય જે પૈકના એકમાં ફાઈલો રાખી શકાય. આ ફાઈલોમાં ડેડ સ્ટોક ફાઈલ, વિજ્ઞાનનાં સાધનો બનાવતી કંપનીઓનાં નામ, સરનામાં અને ક્યાં સાધનો તેઓ બનાવે છે તે દર્શાવતી ફાઈલ વગેરે રાખી શકાય, જે નવાં સાધનો ખરીદતી વખતે કામ લાગે અને અલગ અલગ કંપનીઓમાંથી ખરીદી માટે પસંદગીની તક રહે. તેમાં લેવાનારી પરીક્ષાની કસોટીઓની ફાઈલ, ભૂતકાળની પરીક્ષાઓનાં પેપરોની ફાઈલ વગેરે પણ રાખી શકાય. આ ખાનાને તાળું મારવું જેથી પરીક્ષાની ગુપ્તતા જળવાય.

### ◆ અધ્યેતાઓનાં પ્રયોગ ટેબલો (E.T.) :

અધ્યેતાઓને પ્રયોગ કરવા માટે 2 મી × 1 મી × 1 મી. ના માપનાં ટેબલો યોગ્ય છે. આ ટેબલોનું ઉપરનું પડ પણ એસિડ અને આલ્કલીથી સુરક્ષિત રહે તેવું હોવું જોઈએ. આ ટેબલોનો ઉપયોગ જ્યારે અધ્યેતાઓ પ્રયોગ ન કરતા હોય ત્યારે લખવામાં કરતા હવાથી લખવામાં અનુકૂળ પડે તેવું લીસું હોવું જોઈએ. આવાં કુલ 10 ટેબલો રાખવાં, જે એકી સાથે 40 અધ્યેતાઓ ને પ્રયોગ કરવાની અનુકૂળતા આપી શકશે. વર્ગની સંખ્યા વધારે હોય તો દસેક વધારે અધ્યેતાઓનો સમાવેશ કરી કુલ 50 અધ્યેતાઓને પ્રયોગ કરવાની સગવડ આપી શકાશે. આ ટેબલો D.T. ની આસપાસ અર્ધવર્તુળાકારમાં ગોઠવવાં કે જેથી સૌથી વધારે દૂરના ટેબલનું અંતર પણ ઓરડાના ખૂણાઓ પરના અંતર કરતાં ઓછું થાય અને બધા અધ્યેતાઓને નિદર્શનો બરાબર જોઈ શકે. આ ટેબલોનાં નીચેનાં ખાનાંઓને બારણાં હોય જે D.T. તરફ પડતાં હોય અને બેસવાની વ્યવસ્થા તેની સામેની બાજુએ હોય કે જેથી અધ્યેતાઓ લખવા બેસે ત્યારે આ બારણાંને કારણે ખલેલ ન પહોંચે અને તેમાંથી જરૂરી ચીજવસ્તુ લઈ શકાય. વળી પ્રયોગ કરતી વખતે તે અધ્યેતાઓ આ ટેબલ ફરતે ઊભા હશે જેથી સરળતાથી તેમાંથી સાધનો લઈ શકે અને પાછાં મૂકી શકે. વળી પ્રયોગ કરતી વખતે અધ્યેતાઓ પોતાની બેઠકો પાસપાસેનાં એક જ હરોળનાં બે E.T. ની વચ્ચેની 1 મીટરની જગ્યામાં ખસેડી દઈ શકે. E.T. ની નીચેના ખાનાંઓમાં એવાં સાધનો રાખવાં કે જે સાધનો મૂકવા માટે કોઈ ક્રમ અપનાવવો જોઈએ. જેમ કે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર વગેરે. તેમાં પણ ઉષ્મા, વિદ્યુત, પ્રકાશ ચુંબકત્વ જેવો પેટાક્રમ અપનાવી શકાય. E.T. નાં કબાટોનાં ખાનાંની ઊંચાઈ એકસરખી રાખવાને બદલે સાધનોનાં માપ અનુસાર ઓછીવત્તી રાખવી જોઈએ. વળી જુદાં જુદાં ખાનાઓમાં જુદી જુદી સગવડ કરવી જોઈએ. જેમ કે બ્યુરેટો અને પીપેટો આડી મૂકી શકાય, જેમને માટે ઓછી ઊંચાઈવાળાં ખાનાં રાખવાં. લાંબી ડોકવાળા ચંબુને ડોકથી પકડીને ઊભા રાખી શકાય એવાં સ્ટેન્ડમાં ભરાવવા જોઈએ. આમાં અધ્યેતાઓએ કરવાના પ્રયોગોનાં સાધનો તેમના E.T. ની નીચે જ હોવાથી અધ્યેતાઓમાં આ સાધનોને સંભાળપૂર્વક લેવા - મૂકવાની કાળજી, ધોઈને વાપરવાની કાળજી વગેરે જેવા ગુણ કેળવાશે. અધ્યેતાઓ માટે પ્રયોગશાળાના ચારે ખૂણામાં સિન્ક (S) રાખવામાં આવે છે.

જ્યારે અધ્યેતાઓ પ્રયોગ કરતા હોય છે ત્યારે તો તેઓ ઊભા જ રહે છે, પણ નિદર્શનનો દરમ્યાન તેમને બેસવાની જરૂર પડે છે, તે માટે બંધ કરીને દીવાલને અડીને મૂકી શકાય તેવી લોખંડની ખુરશીઓ રાખવી.

### ◆ સિમેન્ટનાં ટેબલો :

B.B. ની સામેની દીવાલો પાસે સિમેન્ટના બે ટેબલો હોય છે, જેમાંના એક ટેબલનો ઉપયોગ તેના પર ક્યારીઓ બનાવી તેમાં છોડ વાવી શકાય. આમ એક ટેબલનો ઉપયોગ Germination bed (G.B.) તરીકે કરી શકાય, જ્યારે બીજા ટેબલ પર એકવેરિયમ, વિવેરિયમ વગેરે બનાવી શકાય. આ બંને ટેબલો પર પાણીનો ઉપયોગ થતો હોવાથી તે સિમેન્ટનાં હોવા જરૂરી છે. E.T. ટેબલોની અધ્યેતાઓને બેસવાની લોખંડની ખુરશીઓ વાળીને આ સિમેન્ટના ટેબલોની નીચેનાં ખાનાંઓમાં પણ મૂકી શકાય.

### ◆ કબાટો :

અધ્યેતાઓ માટેનાં પ્રયોગ સાધનો રાખવાનાં કબાટો E.T. ની નીચે રાખવામાં આવે છે. આ ઉપરાંત પ્રયોગશાળામાં બીજા ઘણાં સાધનો રાખવાના હોય છે, જેને માટે છ થી આઠ કબાટો રાખવાં પૂરતાં ગણાશે. આ કબાટો (Cup. B.) અડધા દીવાલમાં અને અડધા બહાર રાખવાથી જગ્યાનો બચાવ થઈ શકે. આ કબાટોનાં બારણા જમણે - ડાબે હડસેલીને ખોલી - બંધ કરી શકાય તેવાં (Sliding) હોવાં જોઈએ, જેથી ત્યાંથી ચાલતી વખતે આ બારણાં ખુલ્લાં હોય તો પણ ચાલનારને ખલેલ ન પહોંચાડે. કબાટોનાં ખાનાની ઊંચાઈ સાધનોની ઊંચાઈના પ્રમાણમાં હોવી જોઈએ. આ માટે તેમાં મૂકવાના સાધનોની ખાનાવાર યાદી બનાવીને મુજબ જરૂરી સગવડવાળાં ખાનાંઓનું આયોજન અગાઉથી કરીને કબાટો બનાવવાં જોઈએ. કબાટમાં હૂક ભરાવીને ટાંગી શકાય તેવાં સાધનો રાખી શકાય. આ કબાટોમાં સાધનોની ગોઠવણી બે રીતે કરી શકાય : ધોરણવાર અને વિજ્ઞાનની શાખાઓ અનુસાર. ગોઠવણી બંનેમાંથી ગમે તે રીતે કરી હોય, પરંતુ સાધનોની ગોઠવણી

અનુસારની યાદી કબાટના બહારના ભાગમાં ચોંટાડવી જોઈએ કે જેથી કબાટોના કયા ખાનામાં શું છે તે નો ખ્યાલ આવે. રસાયણશાસ્ત્રના કબાટને એસિડ, આલ્કલી અને અન્ય રસાયણોની અસર ન થાય એવા રંગથી રંગવું જોઈએ. આ માટે રંગ નિષ્ણાતની સલાહ લઈ શકાય. વર્ણી ઝડપથી એકબીજા સાથે રાસાયણિક ક્રિયા કરતાં હોય એવાં રસાયણોને એકબીજાની નજીક ન મૂકવાં. દા.ત.  $KClO_3$ , Na, P વગેરેને એકબીજાથી અલગ રાખવાં. એક કબાટ વિજ્ઞાનનાં પુસ્તકો માટે અલગ રાખવું જોઈએ. ભૂસ્તરશાસ્ત્ર માટે 10 સેમીથી 15 સેમી ઊંચી ચારે બાજુ કાચવાળી પેટી બનાવી આ કબાટમાં રાખવી. આ પેટીમાં 40 થી 50 ખાનાંઓ રાખવાં અને આ ખાનાંઓમાં ખડકોના નમૂના રાખી શકાય.

બેરોમીટર માટે પણ ખાસ પેટી બનાવવી, જે તેની સાર્જન અનુસારની હોય. સુથારી-લુહારી કામનાં સાધનો તેમજ અન્ય સાધનો રાખવા માટે કબાટમાં વર્કશોપ વિભાગનું અલગ ખાનું રાખવું. ચાર્ટ રાખવા માટે પણ કબાટમાં હૂકની વ્યવસ્થા કરવી અથવા દીવાલ પર ચાર્ટનું સ્ટેન્ડ રાખવું. એક ખાનામાં ફિલ્મપટ્ટીઓ, ફિલ્મસ્ટ્રીપ, સ્લાઈડો વગેરે રાખવાની સગવડ રાખવી. પ્રોજેક્શન માટેનાં સાધનો જેવાં કે ફિલ્મસ્ટ્રીપ, પ્રોજેક્ટર, સ્લાઈડ પ્રોજેક્ટર, ફિલ્મ પ્રોજેક્ટર, એપિસ્કોપ, એપિડાયોસ્કોપ, ઓવર હેડ પ્રોજેક્ટર રાખવાની પણ લેબોરેટરીમાં ખાસ વ્યવસ્થા કરવી.

કબાટોને તાળા મારી શકાય તેવી વ્યવસ્થા કરવી અને એ બધી ચાવીઓ રાખવા માટેનું લાકડનું એક નાનું બંધ કબાટ બાજુમાં રાખવું, બધી જ બારીઓ, બારણાં તેમજ કબાટોની ઉપરના ભાગમાં હવાબારીઓ રાખવી.

#### ◆ મધ્યસ્થ ટેબલ (T.H.) :

લેબોરેટરીમાં બરાબર વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મધ્યસ્થ ટેબલ રાખવું. આ ટેબલનાં ખાનાંઓમાં બધા જ અધ્યેતાઓને પ્રયોગ વખતે જરૂર પડે એવી વસ્તુઓ અને રસાયણો રાખવાં, જેવા કે લીટમસ પેપર, ફિલ્ટર પેપર, હલદીપત્ર, મિથાઈલ ઓરેન્જ, ફિનોલ્ફથેલીન વગેરે. અધ્યેતાઓના પ્રયોગો ચાલુ હોય ત્યારે આ બધી વસ્તુઓ T.H. ની નીચેનાં કબાટોનાં ખાનાંઓમાં મૂકી દેવી. પ્રક્ષેપણ કરવાનું હોય ત્યારે જે સાધનથી પ્રક્ષેપણ કરવાનું હોય તે સાધન આ ટેબલ પર મૂકવું અને કા.પા.ની આગળ સફેદ પડદો (Screen) રાખવો, જે કામ ન હોય ત્યારે વીંટાળીને ત્યાં જ નજીકમાં દીવાલ સરસો મૂકી શકાય.

#### ◆ ડાર્કરૂમ :

પ્રક્ષેપણ વખતે ડાર્કરૂમ બનાવવા માટે બારીઓ અને હવાબારીઓ તથા બારણાંના કાચ પર માપસરના કાળા પડદા રાખવા જે અન્ય સમયે ગોળ વિંટાળીને દોરીથી બાંધી જે - તે સ્થળે બારી, બારણાં, હવાબારીઓની ઉપરના ભાગમાં ખીટી પર ટીંગાડવા અને આવી ડાર્કરૂમ બનાવવાની કાયમી સગવડ ઊભી કરવી. અધ્યેતાઓ દરેક પડદા પાસે જઈ દોરી છોડે એટલે બે જ મિનિટમાં આખી લેબોરેટરી ડાર્કરૂમમાં ફેરવાઈ જાય તેવી કાયમી વ્યવસ્થા ઊભી કરવી.

### 4.7 ઉચ્ચતર માધ્યમિક શાળાની પ્રયોગશાળા :

ઉચ્ચતર માધ્યમિક શાળા માટે એક નહીં પણ ઓછામાં ઓછી ત્રણ અલગ-અલગ પ્રયોગશાળાની સુવિધા ઊભી કરવી પડશે, જે નીચે મુજબ છે :

#### ◆ ભૌતિકશાસ્ત્રની પ્રયોગશાળા :

આ પ્રયોગશાળામાં એક મોટું દાર્શનિક ટેબલ હોવું જોઈએ જેમાં ગેસ, લાઈટ, પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. અધ્યેતાઓને પ્રયોગ કરવા માટે 2 મી × 1.5 મી. × 1 મી.ની સાર્જનનાં મોટાં ટેબલો હોવાં જોઈએ. દાર્શનિક ટેબલ સિવાયની દીવાલો સાથે પ્લેટફોર્મ હોવું જોઈએ. પ્લેટફોર્મ પર લાઈટની સુવિધા માટે થોડે થોડે અંતરે પ્લગ હોવા જોઈએ. અધ્યેતાઓ માટે નાનાં-મોટાં બે પ્રકારના સ્ટૂલ હોવાં જોઈએ. સાધનો રાખવા માટે પૂરતા પ્રમાણમાં અભરાઈઓ હોવી જોઈએ. વધુમાં ડાર્કરૂમની સગવડ હોવી જોઈએ.

#### ◆ રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા :

ભૌતિકશાસ્ત્રની જેમ જ સુવિધાઓવાળું એક મોટું દાર્શનિક ટેબલ હોવું જોઈએ. વર્ણી ખંડની



પહોળાઈને ધ્યાનમાં રાખીને ખંડની મધ્યમાં જ સળંગ ટેબલોની ગોઠવણી કરવી જોઈએ. દરેક ટેબલની પહોળાઈ 1.2 મીટરથી 1.4 મીટર જેટલી રાખવી કે જેથી તેના પર સામસામે ઊભા રહી બે અધ્યેતાઓ પ્રયોગો કરી શકે. અધ્યેતાઓને બેસવા માટે સ્ટૂલ હોવા જોઈએ. ટેબલની નીચે સરકાવી શકાય તેવાં બારણાવાળાં કબાટ અને ટેબલની મધ્યમાં રસાયણોની બાટલીઓ રાખવા માટેની હારબંધ ઘોડીઓ હોવી જોઈએ. દરેક ટેબલ પર ગેસની વ્યવસ્થા રાખવી અને ચાર અધ્યેતાઓ વચ્ચે એક એસિડપ્રૂફ સિન્કની વ્યવસ્થા કરવી. પ્રયોગશાળામાં પૂરતા પ્રમાણમાં અભરાઈઓ રાખવી. નિદર્શન ટેબલ સિવાયની દીવાલો સાથે એસિડપ્રૂફ પ્લેટફોર્મ પર કેમિકલ બેલેન્સ, ઓવન અને રસાયણો મૂકવા માટેની ઘોડીઓ રાખવી, સતત પાણીની સુવિધા માટે ધાબા પર પાણીની એક મોટી ટાંકી રાખવી. બે ખૂણામાં મોટી સાઈઝની સિન્ક રાખવી, પૂરતા પ્રમાણમાં વેન્ટિલેશન વ્યવસ્થા તથા એક્ઝોસ્ટ પંખાઓની વ્યવસ્થા કરવી. પ્રાથમિક સારવાર પેટી રાખવી જેમાં કેમિકલ બર્ન માટેની ખાસ દવાઓ રાખવી.

#### ◆ જીવશાસ્ત્રની પ્રયોગશાળા :

જીવશાસ્ત્ર માટે પૂરતા હવા ઉજાસવાળી લેબોરેટરી જોઈએ. જો બારીઓ ઓછી હોય તો વધારાની ટ્યૂબલાઈટોની વ્યવસ્થા રાખવી. નિદર્શન ટેબલ સિન્કની વ્યવસ્થાવાળું રાખવું. દીવાલો સાથે અડધો મીટર ઊંચાઈવાળાં પ્લેટફોર્મની નીચે સરકાવી શકાય એવાં બારણાંવાળાં કબાટ રાખવાં. દરેક પ્લેટફોર્મ પર સિન્કની વ્યવસ્થા રાખવી, દરેક પ્લેટફોર્મ પર રસાયણની બાટલીઓવાળી એક ટ્રે રાખવી. દરેક અધ્યેતા માટે ડિસેક્શન માટેની ટ્રે રાખવી. અધ્યેતાઓ માટે નાનાં-મોટાં બે પ્રકારનાં સ્ટૂલ રાખવાં. બારીઓ પાસે માઈક્રોસ્કોપની ગોઠવણ કરવી. જરૂરી ચીજવસ્તુઓ અને નમૂના રાખવા માટે અભરાઈઓની પૂરતી વ્યવસ્થા કરવી. એક ખૂણામાં દેડકા સંગ્રહ માટેની વ્યવસ્થા રાખવી.

#### 4.8 પ્રયોગશાળાનું સંચાલન, જાળવણી, અને સલામતી :

આ માટે નીચે મુજબની કેટલીક વિશેષ વ્યવસ્થા હોવી જોઈએ :

- પ્રયોગશાળાના સંચાલન, જાળવણી અને સલામતીમાં અધ્યાપકને મદદરૂપ થાય એવો એક પ્રયોગ કર્મચારી (Laboratory co-ordinator કે Laboratory Attendant) શાળાએ રાખવો જોઈએ. આ કર્મચારીને પ્રયોગશાળાના ડેડ સ્ટોકની જવાબદારી સહિત પ્રયોગશાળાની સંપૂર્ણ જવાબદારી સોંપવી જોઈએ. વળી ઉચ્ચતર માધ્યમિક શાળાની પ્રત્યેક લેબોરેટરી માટે અલગ એમ કુલ ચાર આવા કર્મચારીઓ હોવા જોઈએ. આ કર્મચારીઓ તૂટેલાં કે વપરાઈ ચૂકેલા સાધનો કે પદાર્થોનો નિકાલ કરે, સાધનોની યોગ્ય ગોઠવણી અને માવજત કરે તેમજ લેબોરેટરીમાં થયેલી નવી ખરીદીની ડેડ સ્ટોક રજિસ્ટરમાં નોંધ કરે. અધ્યાપકના નિદર્શન વખતે કે અધ્યેતાઓના પ્રયોગો વખતે આ કર્મચારી અધ્યાપકની કે અધ્યેતાની પ્રયોગ વિષયક જરૂરિયાતો પૂરી પાડે.
- પ્રયોગશાળા માટે સ્વતંત્ર પટાવાળાની સગવડ શાળાએ પૂરી પાડવી. ઉચ્ચતર માધ્યમિક શાળા માટે આવા ત્રણ પટાવાળાઓની સુવિધા આપવી. અધ્યેતાઓને આપવા માટેની સામાન્ય સુવિધાઓ, ગેસ, વીજળી, પાણી અને ગરમીની સુવિધાઓ પૂરી પાડવાની, ક્યારેક તાત્કાલિક જરૂરિયાતો પૂરી પાડવાની અને રોજબરોજની સાફસૂફીની અને સ્વચ્છતા જાળવવાની જવાબદારી આ પટાવાળાઓને માથે હોય છે.
- વિજ્ઞાનના અધ્યાપકને માથે વર્ગ અધ્યાપનની જવાબદારી પૂરતા પ્રમાણમાં હોય છે. તેથી તે અધ્યેતાઓને પ્રયોગો કરાવવા માટે સમય કાઢી શકતા નથી અને પ્રયોગશાળા પર પણ પૂરતું ધ્યાન આપી શકતા નથી. તેથી પ્રયોગશાળાની જાળવણી, સંચાલન અને સલામતી માટે એક અલગ પ્રયોગ શિક્ષકની (Tutor-cum -demonstrator) ની પણ આવશ્યકતા હોય છે, જે શાળાએ પૂરી પાડવી જોઈએ.
- પ્રયોગશાળામાં પ્રયોગકાર્ય દરમિયાન અધ્યેતાની શિસ્તને ખૂબ જ મહત્ત્વ અપાવું જોઈએ. નિશ્ચિત સમય દરમિયાન નિયમિત અને સમયસર આવવું અને જવું, નિશ્ચિત સ્થાને જ પ્રયોગ કરવો, સાધનસામગ્રીનો ચાર્જ લેવો અને દેવો, તેમજ પ્રયોગ કરતી વખતે પ્રયોગ સાધન તૂટી

જા્ય, સામગ્રી ખોટી રીતે વપરાઈ જા્ય કે ઢોળાઈ જા્ય, સાધન બગડે વગેરે જેવી પરિસ્થિતિઓમાં દરેક સંબંધિત અધ્યેતાઓ તરત જ પ્રયોગ શિક્ષકનું ધ્યાન દોરવું જોઈએ. અધ્યેતાની શિસ્તને પ્રયોગ શિક્ષકે લોકશાહી ઢબે અમલમાં મૂકવી જોઈએ અને પ્રયોગશાળા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જોઈએ. આમ થશે તો જ પ્રયોગકાર્યને અંતે પૂર્વનિર્ધારિત હેતુઓ સિદ્ધ થઈ શકશે.

- લેબોરેટરીનો ઉપયોગ વધે અને અધ્યેતાઓ જાતે વધુને વધુ પ્રયોગ કરતા થા્ય તેમ તેમ તેના પ્રયોગો માટેના પદાર્થો અને રસાયણો ખલાસ થઈ જા્ય છે. તેમજ કેટલાંક સાધનો કાચના પ્રયોગ સાધનો તૂટી જા્ય છે તો વળી અન્ય કેટલાંક સાધનો બગડી પણ જા્ય છે. આવે વખતે નવી ખરીદી આવશ્યક બને છે, ખરીદી વિભાગનો ચાર્જ જે વિજ્ઞાન શિક્ષકને સોંપવામાં આવ્યો હોય, ખરીદી માટે કમિટી બનાવી હોય તો તેને ખરીદ કરેલ સાધનસામગ્રી, પદાર્થો, રસાયણો કે અન્ય ખર્ચની રકમ તાત્કાલિક મળી જા્ય તેવી સુવિધા હોવી જોઈએ. નહીંતર આયોજનબદ્ધ અને નિયમિત રીતે કામ કરતી પ્રયોગશાળાનું કામ ખોરંભે પડી જવાની પૂરી શક્યતા છે.
- લેબોરેટરીમાં ડેડ સ્ટોક રજિસ્ટર, નવી ખરીદીનું રજિસ્ટર, જૂની અને નકામી સાધનાસામગ્રીના નિકાલનું રજિસ્ટર, અધ્યેતાઓ માટે પ્રત્યેક પ્રયોગદીઠ તૈયાર કરેલ પ્રયોગકાર્ડ તેમજ દરેક કબાટની અંદર રહેલી સાધનસામગ્રીની યાદીઓ હોય છે. આ બધા સંદર્ભો લેબોરેટરી માટે અત્યંત આવશ્યક છે, તેથી તેમની યોગ્ય જાળવણી પણ લેબોરેટરી કર્મચારીએ યોગ્ય રીતે કરવી જોઈએ. જો પ્રયોગકાર્ડ જૂનાં થઈ જા્ય, ખોવાઈ જા્ય કે ફાટી જા્ય તો તરત જ તેમને સ્થાને નવાં કાર્ડ તૈયાર કરીને મૂકવાં જોઈએ. આમ કરવાથી અધ્યેતાઓને પ્રયોગ દરમિયાન કરવાના કાર્યની માહિતી વ્યવસ્થિત રીતે મળશે નહીંતર કરવાના કાર્યની માહિતી વ્યવસ્થિત રીતે મળશે નહીંતર આવા કાર્ડના અભાવમાં તેમણે કરવાના પ્રયોગ અંગે અધ્યેતાઓ અપાર મૂંઝવણ અનુભવશે
- આદર્શ પરિસ્થિતિમાં પ્રયોગશાળા શાળાના મકાનથી અલગ હોવી જોઈએ અથવા તો મકાનમાં એવા સ્થાને હોવી જોઈએ કે જેથી શાળા છૂટ્યા બાદ પણ અધ્યેતાઓ તેનો ઉપયોગ કરી શકે. હાનિકારક વસ્તુઓ અને અકસ્માતરહિત પ્રયોગશાળા હોવી જોઈએ.
- પ્રયોગ દરમિયાન અધ્યેતાઓની સલામતી જાળવાય અને કોઈ ગંભીર અકસ્માત ન સર્જાય તેની અધ્યાપકે કાળજી લેવી જોઈએ. અકસ્માતની શક્યતાવાળા જોખમી પ્રયોગોનું નિદર્શન અધ્યાપકે જાતે જ કરવું. આવા પ્રયોગો અધ્યેતાઓને કરવા માટે આપવા નહિ. સામાન્ય રીતે પ્રયોગશાળામાં ઘા પડવો, આંગળી કપાવી, દાઝવું, આંખમાં કંઈક પડવું, ઝેરી ગેસ સંઘવાથી બેભાન થઈ જવું, ઝેરી પદાર્થ ચાખવાથી શરીર પર ઝેરની અસર થવી, વીજળીનો કરંટ લાગવો, પ્રયોગશાળામાં આગ લાગવી વગેરે જેવી દુર્ઘટનાઓ અને અકસ્માતો થવાની સંભાવના હોય છે. આ દરેક અકસ્માત માટે અધ્યાપકે સ્પષ્ટ સૂચનાઓ તેમને આપવી, જેથી આવા અકસ્માત ન થા્ય, કાચનાં સાધનો તૂટવાથી આંગળી કપાય છે, અથવા ઘા પડે છે. તેથી આવાં સાધનો કાળજીપૂર્વક વાપરવાની સૂચના આપવી. અધ્યેતાઓ ઝેરી ગેસ ન સૂંઘે અને ઝેરી પદાર્થો કે ખરેખર તો લેબોરેટરીના કોઈપણ પદાર્થો ન ચાખે તેવી સૂચના તેમને આપવી. ઘણીવાર ધક્કામુક્કીમાં એસિડ જેવાં દ્રવ્યો આંખમાં પડતાં આંખની દષ્ટિ પર અસર પડે છે તેથી આવાં દ્રવ્યો સાથે ખૂબ જ સંભાળપૂર્વક કામ કરવાની સૂચના આપવી. વીજળીનો કરંટ લાગવાની શક્યતાઓવાળા પ્રયોગોમાં અને આગ લાગી શકે તેવા પ્રયોગોમાં લેવાની કાળજી અંગે અધ્યાપકે અધ્યેતાઓને અગાઉથી સ્પષ્ટ સૂચના આપવી. ઝેરી દ્રવ્યો પિપેટ દ્વારા મોથી નહીં ખેંચવાની પણ તેમને સૂચના આપવી. ખરેખર તો પોટેશિયમ સાઈનાઈડ જેવાં ઝેરી દ્રવ્યો કબાટમાં અલગ ખાનામાં તાળાકૂચીમાં રાખવાં કે જેથી તે અધ્યેતાઓને હાથ ન લાગે. બર્નરની પાસે કોઈ જવનલનશીલ પદાર્થો ન રાખવા. તેમ છતાં કોઈ અધ્યેતા અકસ્માતનો ભોગ બને તો તરત જ તેને પ્રાથમિક સારવાર આપી ડોક્ટરની મદદ લેવી. શાળાની લેબોરેટરીમાં ફર્સ્ટ એઈડ બોક્સ, અગ્નિશામક યંત્ર વગેરે જેવાં સાધનો રાખવાં. આમ પ્રયોગશાળામાં સલામતી માટેનાં પૂરતાં પગલાં અધ્યાપકે લેવાં.

---

#### 4.9 સારાંશ :

---

પ્રવર્તમાન સમયમાં શાળાઓમાં વિજ્ઞાનનો અભ્યાસ કરનારા અધ્યેતાઓની સંખ્યા વધતી જાય છે, પરંતુ તેના પ્રમાણમાં પ્રયોગશાળામાં સાધનસામગ્રીની સુવિધા વધતી નથી. ખરેખર તો સારી, સુવિધાયુક્ત અને સમૃદ્ધ પ્રયોગશાળાઓ એ કોઈપણ દેશની વૈજ્ઞાનિક પ્રગતિની પારાશીશી છે. ઘણીવાર તો વસાવેલાં સાધનો બગડી ગયાં હોય તો તેમને દુરસ્ત કરાવવા જેટલી જાગૃતિ પણ શાળાઓમાં અને વિજ્ઞાન શિક્ષકોમાં હોતી નથી અને તેથી ઘણી શાળાઓમાં પ્રયોગશાળાઓ બિસ્માર હાલતમાં હોય છે. ખરેખર તો તેને પ્રયોગશાળા (School of experiment) એવું નામ આપીને શાળા જેટલો જ દરજ્જો અને મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેથી પ્રયોગશાળાઓ અદ્યતન રહે, તેની પૂરતી સારસંભાળ લેવાય, અધ્યેતાઓ તેમાં પ્રયોગો કરતા હોય અને પ્રયોગશાળા પ્રવૃત્તિથી ધમધમતી રહે એ બાબતોનો ખ્યાલ રાખવાની વિજ્ઞાનના પ્રત્યેક અધ્યાપકની ફરજ છે. જો અધ્યાપકો આ ફરજ બજાવશે તો વિજ્ઞાનમાં વિશિષ્ટ ક્ષમતા ધરાવતા અધ્યેતા પેદા કરી શકાશે અને તેથી વિજ્ઞાન શિક્ષકોએ રાષ્ટ્રના ઉત્થાનમાં સારું પ્રદાન કર્યું છે એમ ગણાશે.

---

#### 4.10 તમારી પ્રગતિ ચકાસો.

---

(1) વિજ્ઞાનની પ્રયોગશાળાનો અર્થ અને સંકલ્પના સ્પષ્ટ કરો.

.....

.....

.....

.....

.....

.....

.....

(2) માધ્યમિક ક્ષેત્રે વિજ્ઞાન પ્રયોગશાળાનું આયોજન, મહત્ત્વ અને જાળવણીના સંદર્ભે ટૂંકનોંધ લખો.

.....

.....

.....

.....

.....

.....

.....

(3) ઉચ્ચતર માધ્યમિક શાળાની વિજ્ઞાન પ્રયોગશાળામાં કઈ પ્રયોગશાળાનો સમાવેશ થાય છે. તેનાં માટે જરૂરી સાધનો અને પદાર્થોની યાદી બનાવો.

.....

.....

.....

.....

.....

.....

.....

(4) “પ્રયોગશાળામાં સલામતી રાખવી એ જરૂરી છે.” વિધાન ચર્ચો.

.....

.....

.....  
.....  
.....  
.....

(5) પ્રયોગશાળા એ વિદ્યાર્થીના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે શી રીતે ? વિધાનની વિષદ છણાવટ કરો.

.....  
.....  
.....  
.....  
.....

---

#### 4.11 સ્વાધ્યાય

---

પ્રશ્ન - ૧ નીચેના પ્રશ્નોના અતિ ટૂંકમાં ઉત્તર આપો.

- 1.1 ડાર્કરૂમ એટલે શું ?
- 1.2 પ્રયોગશાળામાં અધ્યાપક ટેબલનું માપ લખો.
- 1.3 પ્રયોગશાળા એટલે શું ?
- 1.4 વિજ્ઞાન પ્રયોગશાળાની સંકલ્પના સમજાવો.
- 1.5 વિજ્ઞાન પ્રયોગ શાળામાં કઈ કઈ શાખાઓના પ્રયોગ કરવામાં આવે છે ?

પ્રશ્ન - ૨ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો.

- 2.1 સમજાવો : To learn science is to do Science
- 2.2 પ્રયોગશાળાનું મહત્વ દર્શાવતા છ મુદ્દા લખો.
- 2.3 માધ્યમિક શાળાની પ્રયોગશાળા નો પ્લાન દર્શાવો.
- 2.4 ઉચ્ચતર માધ્યમિક શાળાની ત્રણ વિભાગની પ્રયોગ શાળા વિશે નોંધ લખો.
- 2.5 પ્રયોગશાળામાં સલામતી માટેના કોઈ પાંચ સૂચનો લખો.

પ્રશ્ન - ૩ નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો.

- 3.1 વિજ્ઞાનની પ્રયોગશાળાનું આયોજન વિસ્તૃત ચર્ચા કરો.
- 3.2 ટૂંકનોંધ લખો પ્રયોગ શાળાનું આયોજન : વિસ્તૃત ચર્ચા કરો
- 3.3 સમજાવો : પ્રયોગશાળાનું સંચાલન, જાળવણી અને સલામતી.
- 3.4 તમારા ઉત્તર માટે કારણ આપી સમજાવો :  
“ વિદ્યાર્થીના વૈજ્ઞાનિક વલણના વિકાસ માટે પ્રયોગશાળા મહત્વનો ભાગ ભજવે છે.”
- 3.5 (A) વિજ્ઞાનપ્રવાહ ધો. ૧૨માં વિદ્યાર્થીઓને પ્રાયોગિક કાર્ય શા માટે કરાવવું જોઈએ ?  
(B) ધો. ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ (વિજ્ઞાન પ્રવાહ)ને મળી પ્રયોગશાળા તેઓને કેવી રીતે ઉપયોગી છે.? તેના સૂચનો આધારે વિસ્તૃત નોંધ લખો.

---

## 4.12 સંદર્ભ સૂચિ

---

### પુસ્તકો

- Das, R.C. (1985). Science Teaching in School. New Delhi : Sterling Publishers Private Limited.
- Waston Natuan, S. (1967). Teaching Science Creatively. London : W.B. Sanders Company.
- કોહલી, બી. કે. (૧૯૮૬). વિજ્ઞાન કૈસે પઢાણ ? હરિયાણા : વિવેક પબ્લિશર્સ.
- મહેશ્વરી, બી. કે. (૧૯૮૩). વિજ્ઞાન શિક્ષણ. મેરઠ : મોર્ડન પબ્લિકેશન.
- રાવત, ડી. ઇસ. (૧૯૭૨). વિજ્ઞાન શિક્ષણ. આગરા: વિનોદ પુસ્તક મંદિર.
- ઢેસાઈ, દવે અને મહેતા. (1972). વિજ્ઞાનનું અભિનવ અધ્યાપન. મુંબઈ : એ. આર. શાહ કંપની.
- ભાવસાર, લવિંગીયા અને ત્રિવેદી. (1973). વિજ્ઞાન શિક્ષણ પદ્ધતિ. અમદાવાદ : અનડા બુક ડીપો.
- જોષી, લિખિયા, શાહ અને ભટ્ટાચાર્ય. (2007 - 08). વિજ્ઞાન અધ્યાપનનું પરિશીલન. અમદાવાદ : બી. એસ. શાહ પ્રકાશન.
- ગોહેલ, કે. ડી. અને સોલંકી, એમ.એમ. (2016). વિજ્ઞાન પદ્ધતિ સત્ર - I. અમદાવાદ : નીરવ પ્રકાશન.
- ગોહેલ, કે. ડી. અને સોલંકી, એમ.એમ. (2016). વિજ્ઞાન પદ્ધતિ સત્ર - II. અમદાવાદ : નીરવ પ્રકાશન.
- ફફલ, એલ. રાવલ, સી. એચ., પંચાલ એ. એસ. અને પટેલ, આર.એસ. (2007). વિજ્ઞાનનું અધ્યાપન. અમદાવાદ : કુલ સચિવશ્રી ડો. બા.આ. ઓ. યુ.
- [www.gujcost.gujarat.gov.in](http://www.gujcost.gujarat.gov.in)
- [www.scity.gujarat.gov.in](http://www.scity.gujarat.gov.in)
- [www.guj.safari-india.com](http://www.guj.safari-india.com)
- [www.nopr.niscuir.rer.in](http://www.nopr.niscuir.rer.in)
- [www.ias.ac.in](http://www.ias.ac.in)
- [www.touristlink.com](http://www.touristlink.com)



डॉ. बाबासाहेब आंबेडकर  
ओपन युनिवर्सिटी

ES-111

विज्ञाननुं अध्यापन  
(Teaching of Science)

विभाग

2

विज्ञान शिक्षण अध्यापननुं आयोजन

---

अेकम-5 माईकोटीयिंग (Microteaching)

---

अेकम-6 सिम्युलेशन (Simulation)

---

अेकम-7 उदेश्य अने हेतुओ

---

अेकम-8 तास पाठ / अेकम आयोजन

---

## ES-111, વિજ્ઞાનનું અધ્યાપન (વિભાગ-2)

<b>લેખક</b>	
ડૉ. હિતેશ એમ. સોલંકી	શ્રીમતી એમ. એમ. શાહ કોલેજ ઓફ એજ્યુકેશન, વઢવાણ
<b>પરામર્શક (વિષય)</b>	
ડૉ. રાજેશ રાઠોડ	આઈ. આઈ. ટી. ઈ., ગાંધીનગર.
<b>પરામર્શક (ભાષા)</b>	
કુ. ઉમા ઠક્કર	વિજ્ઞાન કોલેજ ઓફ એજ્યુકેશન, અમદાવાદ.
<b>સંપાદન અને સંયોજન</b>	
પ્રો. (ડૉ.) અજીતસિંહ પી. રાણા	નિયામકશ્રી (શિક્ષણશાસ્ત્ર) ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. અમદાવાદ.
<b>સંયોજન સહાય</b>	
ડૉ. મીના આઈ. રાજપૂત	ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. અમદાવાદ.

પ્રકાશક : કુલસચિવ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ-382481

આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ-2020, નકલ : 600

દ્વિતીય આવૃત્તિ-2021, નકલ : 600

**ISBN : 978-93-5598-069-4**

Copyright © Registrar, Dr. Babasaheb Ambedkar Open University, Ahmedabad.  
December 2020

While all efforts have been made by editors to check accuracy of the content, the representation of facts, principles, descriptions and methods are that of the respective module writers. Views expressed in the publication are that of the authors, and do not necessarily reflect the views of Dr. Babasaheb Ambedkar Open University. All products and services mentioned are owned by their respective copyrights holders, and mere presentation in the publication does not mean endorsement by Dr. Babasaheb Ambedkar Open University. Every effort has been made to acknowledge and attribute all sources of information used in preparation of this Self Learning Material. Readers are requested to kindly notify missing attribution, if any.

---

**ES-111 વિજ્ઞાનનું અધ્યાપન**

---

**વિભાગ-1 વિજ્ઞાન શિક્ષણનું સ્વરૂપ, નુતન પ્રવાહો અને સહાયક પ્રવૃત્તિઓ**

- એકમ-1 વિજ્ઞાન શિક્ષણ : ભૂમિકા
- એકમ-2 વિજ્ઞાન શિક્ષણમાં નુતન પ્રવાહો
- એકમ-3 વિજ્ઞાન શિક્ષણમાં સહાયક પ્રવૃત્તિઓ
- એકમ-4 વિજ્ઞાન શિક્ષણની પ્રયોગશાળા

**વિભાગ-2 વિજ્ઞાન શિક્ષણ અધ્યાપનનું આયોજન**

- એકમ-5 માર્કેટીંગિંગ
- એકમ-6 સિમ્યુલેશન
- એકમ-7 ઉદ્દેશ્ય અને હેતુઓ
- એકમ-8 તાસ પાઠ / એકમ આયોજન

**વિભાગ-3 વિજ્ઞાન શિક્ષણની અધ્યાપન પદ્ધતિઓ, અભિગમો અને પ્રતિમાનો**

- એકમ-9 વિજ્ઞાન શિક્ષણની અધ્યાપન પદ્ધતિઓ-1
- એકમ-10 વિજ્ઞાન શિક્ષણની અધ્યાપન પદ્ધતિઓ-2
- એકમ-11 વિજ્ઞાન શિક્ષણના અધ્યાપન અભિગમો
- એકમ-12 વિજ્ઞાન શિક્ષણના અધ્યાપન પ્રતિમાનો

**વિભાગ-4 વિજ્ઞાન શિક્ષણમાં મૂલ્યાંકન, અનુબંધ, નિદાન અને ઉપચાર, શૈક્ષણિક સાધનો અને ક્રિયાત્મક સંશોધન**

- એકમ-13 વિજ્ઞાન શિક્ષણમાં મૂલ્યાંકન, પ્રશ્નપત્ર સંરચના અને અનુબંધ
- એકમ-14 વિજ્ઞાન શિક્ષણમાં નિદાનાત્મક મૂલ્યાંકન અને ઉપચારાત્મક શિક્ષણ
- એકમ-15 વિજ્ઞાન શિક્ષણના અધ્યાપન માટે શૈક્ષણિક સાધનો
- એકમ-16 વિજ્ઞાન શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધન



## દૂરવર્તી અધ્યયનમાં સ્વ-અધ્યયન અભ્યાસ-સામગ્રીની ભૂમિકા

દૂરવર્તી શિક્ષણ પ્રણાલીમાં અસરકારક સ્વ-અધ્યયન અભ્યાસ-સામગ્રી અનિવાર્ય છે. આ અભ્યાસ-સામગ્રીના લેખકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ એકબીજાથી ઘણાં દૂર અને ક્યારેક તો ક્યારેય ન મળી શકે તેવી સ્થિતિમાં હોવાથી આવી અધ્યયન સામગ્રી સુગમ અને અસરકારક હોવી જરૂરી છે. દૂરવર્તી શિક્ષણ માટેની અભ્યાસ-સામગ્રીમાં વિદ્યાર્થીના બૌદ્ધિક ચિંતનને ઉદ્દીપ્ત કરવાની ક્ષમતા તથા આવશ્યક તમામ અધ્યયન પ્રવૃત્તિઓ હોવી જોઈએ. આ સામગ્રી પાઠ્યક્રમના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓના અનુસંધાને વિદ્યાર્થીને પર્યાપ્ત માર્ગદર્શન આપવા સક્ષમ હોવી જોઈએ. સ્વ-અધ્યયન સામગ્રીમાં અભ્યાસક્રમમાં સૂચિત તમામ બાબતોનો સમાવેશ થાય તે જરૂરી છે.

અસરકારક અધ્યયન સિદ્ધ કરવા માટે અનેક પ્રકારના આયોજનનો ઉપયોગ કરવામાં આવે છે; જેનાથી વિદ્યાર્થી જ્ઞાનોપાર્જન કરી શકે. બૌદ્ધિક અને મનોશારીરિક કૌશલ્યો કેળવી શકે અને વર્તન તથા અભિગમમાં આવશ્યક પરિવર્તનો સાધી શકે. આથી જ વિદ્યાર્થીનું મૂલ્યાંકન પણ પાઠ્યસામગ્રીમાં આવરી લેવામાં આવ્યું છે.

દૂરવર્તી શિક્ષણની સ્વ-અધ્યયન અભ્યાસ સામગ્રીમાં ઉપયોગમાં લેવામાં આવેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સ્વરૂપ તે શિક્ષણના જ્ઞાનાત્મક, ભાવાત્મક કે મનોશારીરિક હેતુમાંથી કયા હેતુને સંલગ્ન છે? તેના પર આધારિત છે. આ હેતુઓ ભવિષ્યમાં અનુક્રમે જ્ઞાન, બૌદ્ધિક કૌશલ્યો અને મનોશારીરિક કૌશલ્યોની ઉપલબ્ધિમાં પરિણમે છે. વિદ્યાર્થીએ મેળવેલ જ્ઞાનની પ્રાપ્તિ, ઉપયોગ અને અભિવ્યક્તિ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય. વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનનો અને અનુભવોનો આધાર લઈને રચવામાં આવેલ શિક્ષણ સામગ્રી દ્વારા બૌદ્ધિક કૌશલ્યના હેતુને સિદ્ધ કરી શકાય છે અને તેના દ્વારા નવીન જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત થાય છે.

અભ્યાસ-સામગ્રીમાં સ્વાધ્યાય પ્રોજેક્ટ અને પ્રતિપૂષ્ટિ(Feedback)ના સ્વરૂપે અભ્યાસનું આયોજન જરૂરી છે. શારીરિક કૌશલ્ય સંબંધિત શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ચિત્રાત્મક રજૂઆત હોવી જોઈએ અને ત્યારબાદ ઊચિત અભ્યાસનું આયોજન હોવું જોઈએ. વર્તન અને અભિગમમાં પરિવર્તન માટે આયોજિત શિક્ષણ પ્રવૃત્તિઓ રસ જન્માવે તેવી તથા આ પરિવર્તન દ્વારા થતાં લાભ અને તેની જરૂરિયાતને પ્રતિબિંબિત કરે તેવી હોવી જોઈએ. ત્યાર પછી નવાં અભિગમોને અપનાવવાની અને તે સંબંધિત પ્રક્રિયાના યોગ્ય અભ્યાસનું ઊચિત આલેખન થવું જોઈએ.

## દૂરવર્તી શિક્ષણની ભૂમિકા.

પ્રત્યક્ષ અધ્યાપનમાં જોવા મળતી પ્રત્યાયનની વિશેષતાઓ; જેવી કે અંતરાલાપ, પૂર્વઅભિસંધાન, યોગ્ય સ્થાને વિરામ, આરોહ-અવરોહ, ભાવ-ભંગીમાં, સ્વરભાર વગેરે દૂરવર્તી અધ્યયનમાં ઉપલબ્ધ નથી. આ ઉણપ વિશેષતઃ મુદ્રિત સાહિત્યમાં (લેખિત સાહિત્યમાં) જોવા મળે છે. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના વ્યવહારની આ ખૂટતી કડીને જોડવા માટે જ દૂરવર્તી સ્વ-અધ્યયન સામગ્રીમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. માટે જ આવી પ્રવૃત્તિઓનું આયોજન વૈકલ્પિક નહીં; પરંતુ અનિવાર્ય છે.

સ્વ-અધ્યયન અભ્યાસ-સામગ્રીને નાના એકમોમાં વિભાજિત કરીને શિક્ષણના ઉત્તમ સાધન તરીકે વિકસાવવાની સંકલ્પના છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વૈવિધ્ય દ્વારા શિક્ષણના વિવિધ ક્ષેત્રના હેતુઓ સિદ્ધ થાય તેવો પ્રયત્ન કરવાનો છે.

દૂરવર્તી શિક્ષણની સ્વ-અધ્યયન સામગ્રીનું આયોજન પૂર્વનિશ્ચિત શૈક્ષણિક નીપજને ધ્યાનમાં લઈને કરવાનું હોવાથી તેના હેતુઓ અને ધ્યેયો નિશ્ચિત હોય છે. વળી અધ્યેતાઓ દૂરસ્થ હોવાથી આ સામગ્રી દ્વારા તેઓ નિશ્ચિત અધ્યયન પ્રવૃત્તિઓમાં સંલગ્ન રહે તેવું આયોજન કરવામાં આવે છે. જેથી અધ્યેતાઓ સંબંધિત સંકલ્પનાઓને બરાબર સમજી શકે. સ્વ-અધ્યયન સામગ્રીમાં સાથે સંકળાયેલ સ્વાધ્યાયો, પ્રાયોગિક કાર્યો, પ્રવૃત્તિઓ અને પ્રકલ્પોનો પણ આ જ હેતુ છે. આ સામગ્રી માટે ઊચિત શૈક્ષણિક પ્રવૃત્તિઓની ઉદાહરણરૂપ સૂચિ ઘણી મોટી હોઈ શકે. આ સંદર્ભે શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીને અભિપ્રેરિત કરે છે, માર્ગદર્શન આપે છે અને વિદ્યાર્થીની પ્રગતિ અને પ્રદર્શનનું સતત માપન-મૂલ્યાંકન પણ કરે છે.



: રૂપરેખા :

- 5.1 પ્રસ્તાવના
- 5.2 ઉદ્દેશો
- 5.3 માઈક્રોટીચિંગનો ઇતિહાસ
- 5.4 માઈક્રોટીચિંગની સંકલ્પના
  - 5.4.1 વ્યાખ્યાઓ
  - 5.4.2 માઈક્રોટીચિંગના લક્ષણો
- 5.5 માઈક્રોટીચિંગનાં સોપાનો
- 5.6 અધ્યાપન કૌશલ્યો
  - 5.6.1 વિવિધ અધ્યાપન કૌશલ્યો
- 5.7 વિષયાભિમુખ કૌશલ્ય
  - 5.7.1 વિષયાભિમુખ કૌશલ્યનો અર્થ
  - 5.7.2 વિષયાભિમુખ કૌશલ્યનાં હેતુઓ
  - 5.7.3 વિષયાભિમુખ કૌશલ્યનાં ઘટકો
  - 5.7.4 ઇચ્છનીય વર્તનો
  - 5.7.5 અનિચ્છનીય વર્તનો
  - 5.7.6 વિષયાભિમુખ કૌશલ્યનો માઈક્રોપાઠ
  - 5.7.7 વિષયાભિમુખ માઈક્રોપાઠનું નિરીક્ષણ પત્રક
- 5.8 પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય
  - 5.8.1 પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનો અર્થ
  - 5.8.2 પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનું મહત્ત્વ
  - 5.8.3 પ્રશ્ન કૌશલ્યના પ્રકારો
  - 5.8.4 પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યના ઘટકો
  - 5.8.5 પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનો માઈક્રોપાઠ
  - 5.8.6 પ્રશ્ન પ્રવાહિતા માઈક્રોપાઠનું નિરીક્ષણ પત્રક
- 5.9 સુદૃઢીકરણ કૌશલ્ય
  - 5.9.1 સુદૃઢીકરણ કૌશલ્યનો અર્થ
  - 5.9.2 સુદૃઢીકરણ કૌશલ્યનું મહત્ત્વ
  - 5.9.3 સુદૃઢીકરણ કૌશલ્યનાં ઘટકો
  - 5.9.4 સુદૃઢીકરણના ઉપયોગ વખતે લેવાની કાળજી
  - 5.9.5 સુદૃઢીકરણ કૌશલ્યનો માઈક્રોપાઠ
  - 5.9.6 સુદૃઢીકરણ કૌશલ્યનું નિરીક્ષણ પત્રક

- 5.10 ઉદાહરણ કૌશલ્ય
    - 5.10.1 ઉદાહરણ કૌશલ્યનો અર્થ
    - 5.10.2 ઉદાહરણ કૌશલ્યનું મહત્ત્વ
    - 5.10.3 સારા ઉદાહરણનાં લક્ષણો
    - 5.10.4 ઉદાહરણની રજૂઆત
    - 5.10.5 ઉદાહરણ કૌશલ્યના ઘટકો
    - 5.10.6 ઉદાહરણ કૌશલ્ય માટે ધ્યાનમાં રાખવાની બાબતો
    - 5.10.7 ઉદાહરણ કૌશલ્યનો માઈકોપાઠ
    - 5.10.8 ઉદાહરણ માઈકોપાઠનું નિરીક્ષણ પત્રક
  - 5.11 કા.પા. કાર્ય કૌશલ્ય
    - 5.11.1 કા.પા. કાર્ય કૌશલ્યનો અર્થ
    - 5.11.2 કા.પા. કૌશલ્યનું મહત્ત્વ
    - 5.11.3 કા.પા. કૌશલ્યનાં ઘટકો
    - 5.11.4 કા.પા. કાર્ય કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
    - 5.11.5 કા.પા. કાર્ય કૌશલ્યનો માઈકોપાઠ
    - 5.11.6 કા.પા. કાર્ય માઈકોપાઠનું નિરીક્ષણ પત્રક
  - 5.12 સ્પષ્ટીકરણ કૌશલ્ય
    - 5.11.1 સ્પષ્ટીકરણ કૌશલ્યનો અર્થ
    - 5.11.2 સ્પષ્ટીકરણ કૌશલ્યનું મહત્ત્વ
    - 5.11.3 સ્પષ્ટીકરણ કૌશલ્યનાં ઘટકો
    - 5.11.4 સ્પષ્ટીકરણ કૌશલ્યમાં ધ્યાનમાં રાખવાની બાબતો
    - 5.11.5 સ્પષ્ટીકરણ કૌશલ્યનો માઈકોપાઠ
    - 5.11.6 સ્પષ્ટીકરણ માઈકોપાઠનું નિરીક્ષણ પત્રક
  - 5.13 સારાંશ
  - 5.14 સ્વાધ્યાય
-

---

## 5.1 પ્રસ્તાવના :

---

વિજ્ઞાન શિક્ષણ એટલે વિજ્ઞાન અને શિક્ષણનો શિક્ષણનાં જુદા-જુદા સ્તરે સમન્વય. અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં જુદા-જુદા વિષયોને પોતાનું આગવું મૂલ્ય છે તેમ વિજ્ઞાનને પણ પોતાનાં આગવાં મૂલ્યો છે. વિજ્ઞાનનાં મૂલ્યોને જીવનમાં પ્રસ્થાપિત કરવા માનસ ઘડતર કરવા અને સર્વાંગી વિકાસ કરવાની અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા એટલે વિજ્ઞાનનું અધ્યાપન.

કોઈપણ વિષયનાં પ્રભાવી અધ્યાપન માટે બે મુખ્ય બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. 1. શા માટે શીખવવું? (Why to teach?) કે જેમાં ઉદ્દેશોનો નિર્દેશ હોય છે અને 2. શું શીખવવું? (What to teach?) કે જેમાં વિષયવસ્તુનો નિર્દેશ હોય છે. શું શીખવવું, (વિષયવસ્તુ) એ તો નિષ્ણાતોની મદદથી રાજ્ય સરકાર નક્કી કરે છે. અને તેને અમલમાં મૂકવા માટે શિક્ષકો દ્વારા વિવિધ પદ્ધતિઓ પ્રયુક્તિઓ અને નિશ્ચિત અભિગમો અપનાવવામાં આવે છે અને તે મુજબનું શિક્ષક વર્ગ શિક્ષણ કાર્ય માટેનું આયોજન કરે છે. જેમાં વર્ગ શિક્ષણ માટેની જરૂરી પાયાની બાબતોની તાલીમ મેળવીને વર્ગ શિક્ષક શિક્ષણ કાર્ય માટે સજ્જ બને છે. આ સજ્જતા કેળવવા માટે કેળવણીનું આયોજન એ પાયાનું આયોજન છે આથી શૈક્ષણિક આયોજનનું મહત્ત્વ અનેક ગણું છે. પરિણામે શિક્ષણની દરેક કક્ષાએ, તબક્કાએ શિક્ષણનું આયોજન કાળજીપૂર્વક કરવામાં આવે છે. આમ અધ્યાપનનાં સંદર્ભે આયોજન સાથે સંકળાયેલ કૌશલ્યોની ચર્ચા અહીં કરીશું.

---

## 5.2 ઉદ્દેશો :

---

પ્રસ્તુત એકમનો અભ્યાસ કર્યા બાદ તમે

- માઈક્રોટીચિંગનાં ઇતિહાસથી પરિચિત થશો.
- માઈક્રોટીચિંગ કૌશલ્યની સંકલ્પના સમજી શકશો.
- વિવિધ માઈક્રોટીચિંગ કૌશલ્યોથી પરિચિત થશો.
- માઈક્રોકૌશલ્ય પાઠ આયોજનનાં સોપાનો જાણશો.
- વિવિધ માઈક્રોટીચિંગ કૌશલ્યોનાં પાઠનું આયોજન કરી શકશો.
- માઈક્રોટીચિંગનું મહત્ત્વ જાણશો.
- વિવિધ માઈક્રોટીચિંગ કૌશલ્યોનો વર્ગશિક્ષણમાં વિનિયોગ કરી શકશો.

---

## 5.3 માઈક્રોટીચિંગનો ઇતિહાસ :

---

વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની સાથે શિક્ષણમાં પણ ઘણા પરિવર્તનો આવ્યા છે. શિક્ષણક્ષેત્રે શૈક્ષણિક ટેકનોલોજીનો પ્રવેશ થયો. આ ટેકનોલોજીની શિક્ષણક્ષેત્રે વ્યાપક અસર જોવા મળી. વર્ગશિક્ષણ કાર્ય માટે ટેકનોલોજીના પ્રદાનરૂપ વિવિધ ટેકનિકો કે પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રયુક્તિઓને લીધે વર્ગખંડમાં શિક્ષણને અસરકારક બનાવવા માટે દિન-પ્રતિદિન નૂતન પ્રવિધિઓનું નિર્માણ થતું જાય છે. શિક્ષણવિદોએ સંશોધનો કરીને વિવિધ પ્રયુક્તિઓ વિકસાવી શિક્ષણ જગતને અનેરી ભેટ આપી છે. શિક્ષણક્ષેત્રે જે વિવિધ સંશોધનનાં પરિણામ સ્વરૂપ જે પ્રવિધિઓ અસ્તિત્વમાં આવી તેમાંની એક પ્રવિધિને માઈક્રોટીચિંગ (Microteaching) કે સૂક્ષ્મ અધ્યાપન કહેવામાં આવે છે.

માઈક્રોટીચિંગ અંગેના ખ્યાલનો ઉદ્ભવ સને 1961માં કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં થયો. આ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ક્વાઈટ એલને સને 1963માં સૌ પ્રથમ વખત માઈક્રોટીચિંગ શબ્દનો પ્રયોગ કર્યો. તેમણે પોતાના સહકાર્યકરોની મદદથી 1964-65માં માઈક્રોક્લિનીક ઊભું કર્યું. 1966 થી 1969 સુધીમાં માઈક્રોટીચિંગના વિચારને વિકસાવવામાં આવ્યો. તેમણે સિદ્ધ કર્યું કે માઈક્રોટીચિંગ (સૂક્ષ્મ અધ્યાપન) એ ભણાવવાની કોઈ પદ્ધતિ નથી પણ કૌશલ્ય પ્રાપ્ત કરવાની એક પ્રક્રિયા છે.

સૂક્ષ્મ અધ્યાપન (Microteaching) શિક્ષણ પ્રશિક્ષણ માટેની અઘતન પ્રયુક્તિ છે. પ્રશિક્ષણ

સંસ્થાઓમાં તાલીમ લેતાં શિક્ષકો માટે પ્રાયોગિક પરિસ્થિતિમાં પ્રશિક્ષણ કૌશલ્ય પ્રાપ્ત કરવા માટેની એક પ્રવૃત્તિ છે. ટૂંકમાં માઈક્રોટીચિંગ એટલે શીખવવાનું શીખવા માટેનું શિક્ષણ. આ કોઈ શિક્ષણ પદ્ધતિ નથી. પણ શીખવવા માટે શિક્ષકને કાર્યક્ષમ બનાવવા માટે સજ્જ કરવાની એક તાલીમ પ્રયુક્તિ છે. ઈ.સ. 1963માં સ્ટેન ફોર્ડ યુનિવર્સિટીમાં માઈક્રોટીચિંગનો ઉદ્ભવ થયો અને ત્યારબાદ આ ખ્યાલ વિકાસ પામતો ગયો. વિશ્વના અનેક શિક્ષણકારો, સંશોધકો, અધ્યાપકો તેમજ વિવિધ સંસ્થાઓએ આ ખ્યાલને વિકસાવવામાં રસ લીધો છે. શિક્ષણ-પ્રશિક્ષણ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી આ પ્રવિધિ પ્રશિક્ષણાર્થીઓને વ્યાવસાયિક દક્ષતા પ્રાપ્ત કરવામાં ઉપયોગી નીવડી છે.

આ પ્રયુક્તિ એમ.એસ. યુનિવર્સિટી, બરોડાના સેન્ટર ઓફ એડવાન્સ સ્ટડીઝ ઈન એજ્યુકેશન (C'ASE) માં એક વર્ષ અને પ્રશિક્ષણ કોલેજ, અબોહર (પંજાબ)માં બે વર્ષ માટે પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકવામાં આવી. આ સંસ્થાઓના માઈક્રોટીચિંગનાં સુખદ અનુભવોને લીધે દેશભરની અન્ય યુનિવર્સિટીઓમાં 1976થી પ્રશિક્ષણ મહાવિદ્યાલયોએ પ્રશિક્ષણ કાર્યક્રમ અંતર્ગત પ્રાયોગિક કાર્યમાં માઈક્રોટીચિંગના પાઠનો સમાવેશ કર્યો છે.

#### 5.4 માઈક્રોટીચિંગની સંકલ્પના :

માઈક્રોનો અર્થ સૂક્ષ્મ અથવા નાનું એવો કરવામાં આવે છે. આથી માઈક્રોટીચિંગનો અર્થ સૂક્ષ્મ અધ્યાપન થશે. એટલે કે માઈક્રોટીચિંગ પાઠનું પાઠ્યવસ્તુ ઓછું હોય, જૂથમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય, પાઠનો સમયગાળો ઓછો હોય તેને માઈક્રોટીચિંગ કહેવામાં આવે છે. માઈક્રોટીચિંગ એ નાના પાયાનો શિક્ષણનો પ્રયોગ છે. માઈક્રોટીચિંગના અર્થ અને સંકલ્પના સમજવા માટે આપણે માઈક્રોટીચિંગની વિવિધ વ્યાખ્યાઓ જોઈએ.

##### 5.4.1 વ્યાખ્યાઓ :

*Microteaching is a scaled down teaching encounter in a class size and class time.*

વર્ગના કદ અને સમયની દૃષ્ટિએ માઈક્રોટીચિંગ એ માપી શકાય એવી અધ્યાપન પ્રક્રિયા છે.

- Ellen Dwite

“માઈક્રોટીચિંગ એ વર્ગશિક્ષણ માટેના શિક્ષકના વર્તનમાં ફેરફાર લાવવા માટેની અસરકારક પ્રયુક્તિ છે.”

- કેલનબેક અને અન્ય (1967-69)

“માઈક્રોટીચિંગ નિયંત્રિત પરિસ્થિતિમાં વિશિષ્ટ શિક્ષણ વ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને એક અધ્યાપન કૌશલ્યમાં પ્રાવિણ્ય મેળવી બીજા કૌશલ્યમાં આગળ વધવા શિક્ષણ વ્યવહાર કરાવે છે. માઈક્રોટીચિંગમાં શિક્ષણની પ્રક્રિયાઓ, સમય, પાઠની લંબાઈ અને વર્ગનું કદ નાના માપના હોય છે.

- એલન અને ઈવ (1968)

“માઈક્રોટીચિંગ એ એક એવી શિક્ષણ આપવાની પ્રયુક્તિ છે કે જે શિક્ષકોને સુવ્યાખ્યાયિત કરાયેલા અધ્યાપન કૌશલ્યોને પાંચથી દસ મિનિટમાં કાળજીપૂર્વક આયોજન પામેલા પાઠોની શ્રેણીમાં નાના વિદ્યાર્થીઓના જૂથ સમક્ષ વિનિયોગ કરવાની અને બહુધા પાઠનાં પરિણામો વીડિયો ટેપ પર જોવાની તક પૂરી પાડે છે.”

- બ્રુસ (1968)

*“Microteaching is a system of controlled practice which makes it concentrate on specific teaching behaviour and practice teaching under controlled conditions so that competence is acquired in one skill at a time before*

proceeding to another.

- એલન અને રાયને (1969)

માઈકોટીચિંગ એ એક એવી પ્રયુક્તિ છે કે જે નિયંત્રિત પરિસ્થિતિમાં વિશિષ્ટ પ્રકારના શિક્ષણ વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેથી એક વખતે એક કૌશલ્યમાં ક્ષમતા પ્રાપ્ત કર્યા પછી બીજા કૌશલ્ય તરફ જઈ શકાય.

“માઈકોટીચિંગ એ રૂઢિગત શિક્ષણ પ્રણાલીમાં પ્રવેશતાં પહેલાં શિક્ષક તેનાં વર્ગવ્યવહારનાં કૌશલ્યોમાં પ્રાવિણ્ય મેળવવામાં સહાય કરનાર કાર્યક્રમ છે.”

- મેકોલમ અને લોડ (1970)

“માઈકોટીચિંગ એ અધ્યાપન કૌશલ્યના વિકાસને સરળ બનાવવા વીડિયો રેકોર્ડર વાપરી પ્રતિપોષણ સાથે વિશિષ્ટ અધ્યાપન કૌશલ્યોને સંક્ષિપ્ત રીતે સમજવાની પ્રયુક્તિ છે.”

- પેક અને ટુકર (1973)

“કેટલાંક અધ્યાપન કૌશલ્યો જેવાં કે પ્રશ્નકૌશલ્ય, સુદૃઢીકરણ કૌશલ્ય, મૂડ તેમજ અશાબ્દિક સંજ્ઞાઓ અને ઉદાહરણ કૌશલ્ય વિકસાવવા માઈકોટીચિંગ એક અસરકારક પ્રયુક્તિ છે.”

- પાસી અને શાહ

માઈકોટીચિંગની વ્યાખ્યા આપતા એક કેળવણી નિષ્ણાતે જણાવ્યું છે કે

“*Microteaching is a teacher training technique in which the complexities of normal classroom teaching are simplified. It is considered as a miniaturised classroom teaching.*”

“માઈકોટીચિંગ એ શિક્ષકો માટેની પ્રશિક્ષણ પ્રયુક્તિ છે કે જે વર્ગખંડનાં અધ્યાપન કાર્યને સરળ બનાવે છે. તે વર્ગ શિક્ષણની લઘુ આવૃત્તિ છે.”

ઉપરની વ્યાખ્યાઓ પરથી ફલિત થાય છે કે માઈકોટીચિંગ એ વર્ગ અધ્યાપનની કોઈ પદ્ધતિ નથી, પરંતુ એ પ્રશિક્ષણ કાર્યક્રમને અસરકારક બનાવવા માટેનો પુષ્ક અભિગમ છે.

#### 5.4.2 માઈકોટીચિંગનાં લક્ષણો :

માઈકોટીચિંગ એ અધ્યાપન માટેની પ્રયુક્તિ છે. કૌશલ્યકેન્દ્રી તાલીમ છે. આવા કૌશલ્યથી અભિગમનાં મહત્વનાં લક્ષણો જહોન એચ. મીરે નીચે મુજબ રજૂ કર્યા છે.

જહોન એચ. મીરેની દૃષ્ટિએ માઈકોટીચિંગના લક્ષણો :

- નાના પાયા પરનો શિક્ષણનો નમૂનો
- તે દ્વારા અવલોકન ધારદાર બને.
- એકાદ નાની સંકલ્પના કે મુદ્દાનું શિક્ષણ
- એકાદ શિક્ષણ કૌશલ્યને વિકસાવે.
- પાંચ કે સાત વિદ્યાર્થીઓને જ શિક્ષક ભણાવે.
- પાંચ થી સાત મિનિટ શિક્ષણ કાર્ય થાય.
- શિક્ષણમાં વર્તનનું વસ્તુલક્ષી, સંખ્યાત્મક અને ગુણાત્મક વિશ્લેષણ શક્ય બને.

આમ, માઈકોટીચિંગ એ તાલીમાર્થી શિક્ષકો અને સેવારત શિક્ષકોમાં અધ્યાપન કૌશલ્યોને સચોટ રીતે વિકસાવવાની પ્રયુક્તિ છે માઈકોટીચિંગ પ્રશિક્ષણાર્થી માટે વર્ગ-અધ્યાપનને લગતા ઉપયોગી વર્તન ફેરફારોને સમજપૂર્વક, અને શુદ્ધ સ્વરૂપે વિકસાવવાની ઉપયોગી પ્રયુક્તિ છે.



- તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : (અ) તમારા ઉત્તરો નીચે આપેલી ખાલી જગ્યામાં લખો.

1. માઈક્રોટીચિંગનો અર્થ જણાવો.

.....

.....

.....

.....

.....

.....

2. માઈક્રોટિંગની કોઈપણ બે વ્યાખ્યા જણાવો.

.....

.....

.....

.....

.....

.....

3. માઈક્રોટીચિંગનાં લક્ષણો જણાવો.

.....

.....

.....

.....

.....

.....

### 5.5 માઈક્રોટીચિંગનાં સોપાનો :

પ્રશિક્ષણાર્થી વાસ્તવિક વર્ગખંડમાં અધ્યાપન શરૂ કરે તે પહેલાં વર્ગસંચાલનની વિવિધ વર્તનતરાહનાં સંદર્ભમાં અપેક્ષિત કૌશલ્યો અંગેનું પ્રાવિણ્ય મેળવી લે તે ખૂબ જરૂરી છે. પરંતુ આ કૌશલ્યો શીખવા માટે વર્ગની ગોઠવણી માઈક્રોટીચિંગને અનુરૂપ ઊભી કરવી જરૂરી છે. અર્થાત્ સર્જિત પરિસ્થિતિ (Simulation) ઊભી કરવી જરૂરી છે. માઈક્રોટીચિંગ દ્વારા કોઈ પણ કૌશલ્ય નીચે દર્શાવેલા પાંચ તબક્કાઓ દ્વારા વિકસાવી શકાય છે. જો કે વધુ સ્પષ્ટ રીતે આ તબક્કાઓને સાત વિભાગમાં વહેંચી શકાય છે.

સૂક્ષ્મ અધ્યાપનનું આયોજન નીચેનાં સોપાનને અનુસરે છે.

- કૌશલ્યની પસંદગી કરવી.
- કૌશલ્ય અંગે સૈદ્ધાંતિક માહિતી મેળવવી.
- કૌશલ્યદર્શી પાઠનું નિરીક્ષણ કરવું.
- સૂક્ષ્મ-પાઠનું આયોજન કરવું.
- સૂક્ષ્મ-પાઠ આપવો. (કૌશલ્યનો મહાવરો કરવો.)
- સૂક્ષ્મ પાઠનું મૂલ્યાંકન કરવું. (પ્રતિપોષણ)
- પુનઃ સૂક્ષ્મ-પાઠનું આયોજન કરવું.

- પુનઃ સૂક્ષ્મ-પાઠ આપવો.
- સૂક્ષ્મ-પાઠનું પુનઃ મૂલ્યાંકન કરવું. (પુનઃ પ્રતિપોષણ)

**સૂક્ષ્મ અધ્યાપનનાં પાંચ તબક્કાઓ / સોપાનો :**

સૂક્ષ્મ અધ્યાપનનાં પાંચ તબક્કાઓ / સોપાનો નીચે પ્રમાણે છે. સામાન્ય રીતે આ તબક્કાઓને આધારે શિક્ષણકાર્ય કરવામાં આવે છે.

- (1) શિક્ષણનો તબક્કો (Teaching Session)
- (2) પ્રતિપોષણનો તબક્કો (Feedback or Critique Session)
- (3) પુનઃ આયોજનનો તબક્કો (Replan Session)
- (4) પુનઃ શિક્ષણનો તબક્કો (Reteach Session)
- (5) પુનઃ પ્રતિપોષણનો તબક્કો (Refeedback Session)

ઉપરના તબક્કાઓને માઈક્રોટીચિંગ પાઠ પ્રક્રિયાનાં સંદર્ભે વિગતે સમજાવે.

**(1) શિક્ષણનો તબક્કો (Teach Session) :**

માઈક્રોટીચિંગનો આ પ્રથમ તબક્કો છે. આ તબક્કામાં પ્રશિક્ષણાર્થીઓને વિશિષ્ટ કૌશલ્યો અંગેની સૈદ્ધાંતિક અને વ્યાવહારિક સમજ આપવામાં આવે છે. વિવિધ કૌશલ્યમાં નિપૂણતા મેળવવામાં સહાયક તેમજ અવરોધક પરિબલોની ચર્ચા કરવામાં આવે છે. ત્યારબાદ અધ્યાપક નિદર્શન પાઠ આપે છે. પ્રશિક્ષણાર્થીઓ આ નિદર્શન પાઠનું ઝીણવટભર્યું અવલોકન કરે છે. ત્યારબાદ પ્રશિક્ષણાર્થી કક્ષા અને એકમની પસંદગી જે તે કૌશલ્યને અનુરૂપ અધ્યાપકની મદદથી કરે છે. હવે પ્રશિક્ષણાર્થી અધ્યાપકના માર્ગદર્શન હેઠળ માઈક્રોપાઠનું આયોજન તૈયાર કરશે.

માઈક્રોપાઠનું આયોજન કરી પ્રશિક્ષણાર્થી વર્ગ સમક્ષ અધ્યાપન કરવા તૈયાર થશે. પ્રથમ તો તે 5 થી 10 વિદ્યાર્થીઓનાં જૂથને પસંદ કરે છે. અથવા પ્રશિક્ષણાર્થી જૂથનાં વિદ્યાર્થીઓને પસંદ કરે છે. બીજા બાબત માઈક્રોપાઠનું વિષયવસ્તુ ખૂબ જ ટૂંકું એટલે કે એકાદ ખ્યાલ કે સંકલ્પનાને લગતું પસંદ કરે છે. ત્રીજા બાબત પ્રશિક્ષણાર્થી શીખવવાનો સમય ગાળો 5 થી 10 મિનિટનો રાખે છે.

**પ્રશિક્ષણાર્થી માઈક્રોપાઠ આપે ત્યારે તેનું નિરીક્ષણ :**

કોલેજના અધ્યાપક તેમજ પ્રશિક્ષણાર્થી જૂથના સહઅધ્યાપીઓ કરે છે. પાઠનું નિરીક્ષણ કરવામાં આવે ત્યારે શક્ય હોય તો તફનીકી સાધનો જેવા કે વીડિયો ટેઈપ રેકોર્ડર (VTR) કે ટેઈપ રેકોર્ડર (TR) નો ઉપયોગ કરવામાં આવે છે. એવું શક્ય ન બને તો અગાઉથી તૈયાર કરેલ નિરીક્ષણ પત્રક પ્રમાણે પાઠનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પાઠ પૂરો થવાની એક મિનિટ પહેલાં નિરીક્ષક આંગળી ઊંચી કરીને સમયની ચેતવણી આપે છે. આમ, શિક્ષણનો પ્રથમ તબક્કો પૂરો થાય છે.

**(2) પ્રતિપોષણનો તબક્કો (Feedback or Critique Session) :**

માઈક્રોટીચિંગનો આ બીજો તબક્કો છે. આ તબક્કામાં પ્રશિક્ષણાર્થી સાથે ચર્ચા અને માર્ગદર્શન થાય છે. પ્રશિક્ષણાર્થી અને નિરીક્ષક અધ્યાપક માઈક્રોપાઠના જે તે કૌશલ્ય અંગે ચર્ચા કરે છે. જો પાઠનું નિરીક્ષણ વીડિયો ટેઈપ રેકોર્ડર કે ટેઈપ રેકોર્ડર દ્વારા કરવામાં આવેલું હોય તો પ્રશિક્ષણાર્થી જાતે જ અલગ રૂમમાં જઈ માઈક્રોપાઠનું નિરીક્ષણ કરે છે અને પાઠ વિશે સ્વમૂલ્યાંકન કરી પુનઃ શિક્ષણમાં સુધારણા વિશે સમજ કેળવે છે. જો પાઠનું નિરીક્ષણ કોલેજમાં અધ્યાપક કે પ્રશિક્ષણાર્થી જૂથ દ્વારા કરવામાં આવેલું હોય તો નિરીક્ષક સાથે પ્રશિક્ષણાર્થી 8 થી 10 કે 12 મિનિટ મુક્ત મને ચર્ચા કરે છે અને જરૂરી સૂચનોને ધ્યાનમાં લઈ પ્રશિક્ષણાર્થીને પાઠનું પુનઃ આયોજન કરવાનું કહેવામાં આવે છે. પ્રતિપોષણ વિવિધ પ્રકારે આપી શકાય છે જેમ કે :

- (1) તૂર્ત જ અથવા થોડા સમય બાદ
- (2) લેખિત કે મૌખિક સ્વરૂપે

- (3) નિશ્ચિત પ્રમાણમાં કે વ્યાપક પ્રમાણમાં
- (4) ઉપચારાત્મક કે વર્ણનાત્મક
- (5) વ્યક્તિગતરૂપે કે સામૂહિક રૂપે

**(3) પુનઃ આયોજનનો તબક્કો (Replan Session) :**

માઈકોટીચિંગનો આ ત્રીજો તબક્કો છે. તેનો સમયગાળો 12 થી 15 મિનિટનો હોય છે. આ તબક્કામાં પ્રશિક્ષણાર્થી માઈકો પાઠ દરમિયાન અધ્યાપક દ્વારા મળેલ પ્રતિપોષણનાં મુદ્દાઓને ધ્યાનમાં લઈ જરૂરી સુધારા સાથે માઈકોપાઠનું પુનઃ આયોજન કરે છે. આ 12 થી 15 મિનિટમાં નિરીક્ષક અધ્યાપક બીજા પ્રશિક્ષણાર્થી સાથે માઈકોપાઠનો પહેલો અને બીજો તબક્કો પૂરો કરે છે.

**(4) પુનઃ શિક્ષણનો તબક્કો (Reteach Session) :**

માઈકોટીચિંગનો આ ચોથો તબક્કો છે. આ તબક્કામાં પ્રશિક્ષણાર્થી પુનઃ આયોજન કરેલ પાઠને અન્ય જૂથ સમક્ષ તે જ કૌશલ્ય અજમાવીને શીખવે છે. પ્રશિક્ષણાર્થી જો અલગ એકમ (વિષયવસ્તુ) પસંદ કરે તો તે જ જૂથને તે જ કૌશલ્ય અજમાવીને પુનઃ પાઠનું શિક્ષણ કાર્ય કરાવી શકે છે.

**(5) પુનઃ પ્રતિપોષણનો તબક્કો (Refeedback Session) :**

માઈકોટીચિંગનો આ પાંચમા તબક્કો છે. આ તબક્કાનો સમયગાળો 6 થી 8 મિનિટનો હોય છે. પુનઃ શિક્ષણને ધ્યાનમાં રાખી નિરીક્ષક અધ્યાપક માઈકોપાઠનાં સંદર્ભમાં ફરીથી પ્રતિપોષણ આપે છે.

આમ, શિક્ષણ-ચર્ચા, માર્ગદર્શન, પુનઃ આયોજન, પુનઃશિક્ષણ, પુનઃ ચર્ચાનું માઈકોટીચિંગનું આખું ચક્ર (Cycle) પાંચ તબક્કામાં પૂર્ણ થાય છે. પ્રશિક્ષણાર્થીમાં અપેક્ષિત કૌશલ્ય જ્યાં સુધી ન વિકસે ત્યાં સુધી આ ચક્ર પુનરાવર્તિત થાય છે.

● તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી ખાલી જગ્યામાં લખો.

1. સૂક્ષ્મ અધ્યાપનનાં પાંચ તબક્કાઓનાં નામ જણાવો.

.....

.....

.....

.....

.....

.....

.....

2. સૂક્ષ્મ અધ્યાપનનો શિક્ષણનો તબક્કો સમજાવો.

.....

.....

.....

.....

.....

.....

.....

3. સૂક્ષ્મ અધ્યાપનનો પ્રતિપોષણનો તબક્કો સમજાવો.

.....

.....

.....  
.....  
.....  
.....

## 5.6 અધ્યાપન કૌશલ્યો :

શિક્ષક વર્ગમાં શિક્ષણકાર્ય કરે છે ત્યારે તે વિદ્યાર્થીઓનાં વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે. આ પરિવર્તન લાવવા તે અનેક પ્રકારની ક્રિયાઓ તેમજ પ્રતિક્રિયાઓ ઉપયોગમાં લે છે. આ પ્રત્યેક ક્રિયાઓના અને પ્રતિક્રિયાઓને આપણે વર્તન કહીએ છીએ. શિક્ષક વર્ગમાં કથન કરવું, પ્રશ્નો પૂછવા, શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો, કાળા પાટિયા પર લખવું, ઉત્તરો સ્વીકારવા જેવા અનેક પ્રકારના વર્તનો કરે છે. કેટલાક વર્તનો ભાષાની અભિવ્યક્તિ દ્વારા તો કેટલાંક વર્તનો અશાબ્દિક રીતે કરે છે આ બધા વર્તનો પાછળનો હેતુ વિદ્યાર્થીઓમાં અપેક્ષિત પરિવર્તનો લાવવાનો હોય છે. આ બધા જ વર્તનોને એક રીતે કૌશલ્યોમાં સમાવેશ કરવામાં આવે છે.

### 5.6.1 વિવિધ અધ્યાપન કૌશલ્યો :

અધ્યાપન એ વિવિધ અધ્યાપન કૌશલ્યોનો સંપુટ છે અને પ્રત્યેક કૌશલ્ય એ વિવિધ પ્રકારના વર્તનોનો સમૂહ છે, જેનાં દ્વારા વિદ્યાર્થીઓનું અધ્યયન સરળ બને છે. આ પ્રકારનાં કૌશલ્યોને વ્યાખ્યાયિત કરી શકાય છે. અમલમાં લાવી શકાય છે. અવલોકન કરી શકાય છે અને તેમનું મૂલ્યાંકન પણ થઈ શકે છે. માઈક્રોટીચિંગ પ્રયુક્તિનાં સંદર્ભમાં વડોદરાની CASE દ્વારા તારવેલ વિવિધ પ્રકારના અધ્યાપન કૌશલ્યોની સંખ્યા બાવીસ ગણાવવામાં આવી છે. આ કૌશલ્યો નીચે મુજબ છે.

- (1) પ્રસ્તાવના કે વિષયાભિમુખ (Set Induction)
- (2) પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય (Fluency in Questioning)
- (3) સુદૃઢીકરણ કૌશલ્ય (Skill of Reinforcement)
- (4) ઉદાહરણ કૌશલ્ય (Skill of illustrating)
- (5) કા. પા. કાર્ય કૌશલ્ય (Skill of using blackboard)
- (6) સ્પષ્ટીકરણ કૌશલ્ય (Skill of Explaining)
- (7) ઉત્તેજના પરિવર્તન (Stimulus Variation)
- (8) પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય (Skill of probing Questions)
- (9) પુનરાવર્તન કે મુદ્દાની સંલગ્નતા (Skill of achieving closure)
- (10) શાંતિ અને અશાબ્દિક સંજ્ઞા કૌશલ્ય (Skill of silence & non verbal cues)
- (11) ધ્યાનયુક્ત વર્તન ઓળખ કૌશલ્ય (Skill of Recognising Attending behaviour)
- (12) વ્યાખ્યાન કૌશલ્ય (Skill of lecturing)
- (13) પાઠગતિ કૌશલ્ય (Skill of Pacing the lesson)
- (14) દૃશ્ય-શ્રાવ્ય સાધનો વાપરવાનું કૌશલ્ય (Skill of using Audio visual Aids)
- (15) સ્વાધ્યાય આપવાનું કૌશલ્ય (Skill of giving assignments)
- (16) ઉચ્ચ કક્ષાના પ્રશ્નો પૂછવાનું કૌશલ્ય (Skill of using Higher order Questions)
- (17) વર્ગ વ્યવસ્થા કૌશલ્ય (Skill of Classroom Management)
- (18) બહુવિધ પ્રશ્ન કૌશલ્ય (Skill of Divergent Questions)
- (19) આયોજિત પુનરાવર્તન કૌશલ્ય (Skill of Planned repetition)

- (20) પૂર્ણ અભિવ્યક્તિ કૌશલ્ય (Skill of Completeness of Communication)  
 (21) અધ્યાપન હેતુલેખન કૌશલ્ય (Skill of Writing instructional objectives)  
 (22) વિદ્યાર્થી સહયોગ વૃદ્ધિ કૌશલ્ય (Skill of Increasing Pupil's Participation)

ઉપરોક્ત અધ્યાપન કૌશલ્યો જો યોગ્ય રીતે વિકસાવવામાં આવે તો શિક્ષણકાર્ય અસરકારક બની શકે. પ્રશિક્ષણાર્થીએ અસરકારક શિક્ષણકાર્ય માટે પ્રત્યેક કૌશલ્યને આત્મસાત્ કરવું જરૂરી છે. અહીં અભ્યાસક્રમમાં મુખ્ય સાત અધ્યાપન કૌશલ્યોનો સમાવેશ કરેલ હોય તેને આગળ ઉપર વિગતે સમજાવું.

● તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી ખાલી જગ્યામાં લખો.

1. અધ્યાપન કૌશલ્યો એટલે શું ? વડોદરાની CASE દ્વારા કુલ કેટલા અધ્યાપન કૌશલ્યો તારવવામાં આવ્યા છે ?

.....  
 .....  
 .....  
 .....  
 .....

2. કોઈપણ દસ અધ્યાપન કૌશલ્યોની યાદી જણાવો.

.....  
 .....  
 .....  
 .....  
 .....

**5.7 વિષયાભિમુખ કૌશલ્ય :**

સામાન્ય રીતે શિક્ષક વર્ગમાં જે કોઈ વિષયાંગ શીખવવા ઇચ્છતો હોય તેની શરૂઆત સરળ રીતે થવી જોઈએ. જે કંઈ શીખવવા માંગતો હોય તેની શરૂઆત તદ્દન સાહજિક અને રસમય રીતે થાય તો શિક્ષણકાર્ય સરળ અને રસપ્રદ બને છે. આ શરૂઆત માટે વિદ્યાર્થીઓનાં પૂર્ણજ્ઞાન અને પૂર્વાનુભવો ધ્યાનમાં રાખીને નવા વિષયાંગની શરૂઆત કરવી જોઈએ. વિદ્યાર્થી નવું જ્ઞાન મેળવવા તત્પર બને, તેની જિજ્ઞાસાવૃત્તિ પ્રબળ બને તેવું વાતાવરણ વર્ગખંડમાં ઊભું કરવું જોઈએ જેથી શિક્ષણ રસપ્રદ બને અને વિદ્યાર્થી વિષય પ્રત્યે અભિમુખ થાય. વિદ્યાર્થીઓ નવું જ્ઞાન પ્રાપ્ત કરવા તત્પરતા દાખવે તેવી પરિસ્થિતિના નિર્માણને વિષયાભિમુખતા કહેવામાં આવે છે. અને જે કૌશલ્ય દ્વારા આ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે તેને વિષયાભિમુખ કૌશલ્ય (Skill of set Induction) કહેવામાં આવે છે.

**5.7.1 વિષયાભિમુખ કૌશલ્યનો અર્થ :**

શિક્ષક જે વિષય, વિષયાંગ કે મુદ્દો શીખવવાના હોય તેના પ્રત્યે વિદ્યાર્થીઓને અભિમુખ કે અભિપ્રેરિત કરવાનાં કૌશલ્ય (યુક્તિ-પ્રયુક્તિ)ને વિષયાભિમુખ કૌશલ્ય કહેવામાં આવે છે.

વિષયાભિમુખ કૌશલ્ય હસ્તગત કરવામાં પ્રશ્નોત્તરી, સ્પષ્ટીકરણ, સુદૃઢીકરણ, ઉત્તેજના પરિવર્તન કૌશલ્યનો યોગ્ય રીતે ઉપયોગ કરતાં આવડવું જોઈએ.

### 5.7.2 વિષયાભિમુખ કૌશલ્યનાં હેતુઓ :

વિષયાભિમુખ કૌશલ્યનાં હેતુઓ નીચે મુજબ છે :

- (1) વિદ્યાર્થીઓને નવું જ્ઞાન મેળવવા તત્પર બનાવી શકાય.
- (2) વિષયાભિમુખ પ્રક્રિયા દ્વારા શિક્ષક જે પાઠ કે મુદ્દો શીખવવાના છે. તેના અનુસંધાનમાં વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનાત્મક સ્તરે સંબંધ બાંધી શકાય છે.
- (3) વિદ્યાર્થીનું અપેક્ષિત પૂર્વજ્ઞાન ચકાસી તેનું નવા જ્ઞાન સાથે અનુસંધાન કરી શકાય છે.
- (4) વિદ્યાર્થીએ કયું નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે.
- (5) વિદ્યાર્થીઓમાં પૂર્વજ્ઞાન અને નૂતન જ્ઞાન વચ્ચે અંતર ઘટાડી શકાય છે.
- (6) વિદ્યાર્થીઓને વર્ગવ્યવહારમાં ભાગ લેવાની તક સાંપડે છે.
- (7) વિદ્યાર્થી સરળતાથી નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.

આમ, વિષયાભિમુખ કૌશલ્યના હેતુઓ આ કૌશલ્યનું મહત્ત્વ દર્શાવે છે.

### 5.7.3 વિષયાભિમુખ કૌશલ્યનાં ઘટકો :

વિષયાભિમુખ કૌશલ્યના ઘટકોને અસરકારક રીતે હસ્તગત કરવા માટે ઈચ્છનીય વર્તનો અંગે જાણી તેનો મહાવરો કરવો જોઈએ. આ વર્તનોને વિષયાભિમુખ કૌશલ્યનાં ઘટકો કહે છે જેમ કે પૂર્વજ્ઞાનનો ઉપયોગ, યોગ્ય પ્રયુક્તિનો ઉપયોગ, હેતુ સાથેની સુસંગતતા આ વર્તનો ઈચ્છનીય ગણાશે. જ્યારે વિષયાભિમુખ કૌશલ્ય માટે અવરોધક વર્તનને અનિચ્છનીય વર્તન કરે છે. જેમાં સાતત્ય ભંગ અને કૃત્રિમ રીતે મથાળું કઢાવવું વગેરેનો સમાવેશ થાય છે. આવા વર્તનોને ટાળવા જોઈએ.

### 5.7.4 ઈચ્છનીય વર્તનો :

વિષયાભિમુખ કૌશલ્ય હસ્તગત કરવા માટે નીચેના ઈચ્છનીય વર્તનો કરવા જોઈએ :

- (1) પૂર્વજ્ઞાનનો ઉપયોગ
- (2) યોગ્ય પ્રયુક્તિનો ઉપયોગ
- (1) પૂર્વજ્ઞાનનો ઉપયોગ :

વિદ્યાર્થીઓ ઘણા પૂર્વાનુભવો કે અનુભવોથી સભર હોય છે. શાળા સિવાયના સમય દરમિયાન પણ તે ઘણુબધું શીખે છે કે અનુભવ પ્રાપ્ત કરે છે. તેથી તે અનુભવ સભર છે શિક્ષકે નવા જ્ઞાન કે અનુભવને વિદ્યાર્થીનાં પૂર્વજ્ઞાન કે પૂર્વાનુભવ સાથે સાંકળીને વિદ્યાર્થીને સભાન બનાવવાં જોઈએ. આ માટે શિક્ષકે નવા વિષયાંગની પૂરતી માહિતી મેળવી તેના વિશે સંપૂર્ણ સમજ કેળવીને તેને અનુરૂપ પૂર્વજ્ઞાન શોધી કાઢી, નવા જ્ઞાન અને પૂર્વજ્ઞાનનો યોગ્ય સંબંધ જાણીને તેનું યોગ્ય સંકલન કરવું જોઈએ. આ માટે શિક્ષકે વિદ્યાર્થીઓની ઉંમર કક્ષા, ધોરણ, માનસિક યોગ્યતા વગેરેને ધ્યાનમાં રાખવા જોઈએ. વિદ્યાર્થીઓ મુદ્દાની રજૂઆતમાં પૂર્વજ્ઞાન કે પૂર્વાનુભવનો ઉપયોગ કરે છે કે કેમ તેની ખાતરી તેમના સાચા ઉત્તરો પરથી થાય છે. કોઈકવાર નીચેનાં જેવા વિધાનોનો ઉપયોગ થાય છે.

1. આ અગાઉ આપણે શીખી ગયા છીએ કે...
2. જ્યારે આપણે પ્રદર્શનની મુલાકાતે ગયા ત્યારે આપણે જોવું હતું કે...
3. વિદ્યાર્થીનાં અનુભવની વસ્તુ બતાવી પૂછે છે કે આ શું છે? તેમાં શું દેખાય છે?... વગેરે...

### (2) યોગ્ય પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો :

શિક્ષક વિદ્યાર્થીઓનો પૂર્વજ્ઞાન કે પૂર્વાનુભવોની મદદથી નવા જ્ઞાન સાથે જોડવા માટે નીચેની પ્રયુક્તિઓનો ઉપયોગ કરી શકે છે.

1. પ્રશ્નોત્તરી
2. ઉદાહરણ કે દૃષ્ટાંત

3. કથન
4. વ્યાખ્યા કે વર્ણન
5. નાટ્યીકરણ કે રોલ પ્લે
6. વાર્તા, કાવ્ય પંક્તિનું જ્ઞાન
7. દૃશ્ય-શ્રાવ્ય સાધનોનો ઉપયોગ, પ્રયોગ

ઉપરની પ્રયુક્તિઓમાંથી વિષયાંગને અનુરૂપ તેમજ વિદ્યાર્થીની વયકક્ષા, તેમનું પૂર્વજ્ઞાન, પુખ્તતા અને અભિરૂચિને ધ્યાનમાં રાખી શિક્ષક ઉચિત હોય તેવી એક કે એકથી વધુ પ્રયુક્તિઓનો ઉપયોગ કરી શકે છે. સામાન્ય રીતે નીચલા ધોરણના વિદ્યાર્થીઓને કથન, પ્રશ્નોત્તરી ઉદાહરણ કે દૃષ્ટાંત વધુ અનુકૂળ આવે છે. આપણે વિષયાભિમુખ કૌશલ્ય કેળવવા કેવા ઈચ્છનીય વર્તનો કરવા જોઈએ તેની સમજ મેળવી હવે કયા પ્રકારના અનિચ્છનીય વર્તનો ટાળવા જોઈએ તે સમજીએ.

#### 5.7.5 અનિચ્છનીય વર્તનો :

વિષયાભિમુખ કૌશલ્ય હસ્તગત કરવા માટે નીચે દર્શાવેલા અનિચ્છનીય વર્તનો કરવાનું ટાળવું જોઈએ.

- (1) સાતત્યભંગનું વર્તન
- (2) કૃત્રિમ રીતે મથાળું કઢાવવું.

#### (1) સાતત્યભંગનું વર્તન :

કોઈ પણ માહિતી કે પ્રશ્નોત્તરીની રજૂઆતની તાર્કિકતાને અને ક્રમિકતાને સાતત્ય કહેવામાં આવે છે. ક્યારેક પાઠની પ્રસ્તાવનામાં સાતત્યભંગ થાય છે જ્યારે...

- (1) પાઠના પ્રારંભમાં શિક્ષક તાર્કિક ક્રમ વગરનાં વિધાનો કરે કે પ્રશ્નો પૂછે ત્યારે
- (2) જ્યારે શિક્ષક આગળના પ્રશ્નો કે વિધાનને સંબોધેલ તેને અનુરૂપ બીજો પ્રશ્ન કે વિધાન કરતા નથી ત્યારે
- (3) શિક્ષકે પૂછેલો પ્રશ્ન કે વિધાન પાઠના ધ્યેયને અનુલક્ષીને ન હોય અને અસંબંધિત હોય ત્યારે...

આ પ્રકારના વિધાનો અતાર્કિક લાગે છે. વિદ્યાર્થીઓ આ પ્રકારના વિધાનોને કારણે ગૂંચવાડામાં પડી જાય છે. આથી શિક્ષકનું વર્તન સાતત્યભંગ કરતું વર્તન બની રહે છે. જેવું કે

- વિચારોની ક્રમિકતાનો ભંગ કરતું વર્તન.
- માહિતીની ક્રમિકતાનો ભંગ કરતું વર્તન.
- વિષયાંગને ધ્યાનમાં રાખવા સિવાય કરેલ અસંબંધિત વિધાનો કે પ્રશ્નો.

#### (2) કૃત્રિમ રીતે મથાળું (શીર્ષક) કઢાવવું :

શિક્ષકના શીખવવાના નવા વિષયાંગ કે મુદ્દામાં રહેલા મધ્યવર્તી વિચાર, માહિતી કે હાર્દને ધ્યાનમાં રાખ્યા સિવાય માત્ર નવા વિષયાંગ કે મુદ્દાના મથાળાને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓને વિષયાભિમુખ કરવાના વર્તનને કૃત્રિમ રીતે મથાળું કઢાવવાનું વર્તન કહેવામાં આવે છે. શિક્ષકે આ પ્રકારનું વર્તન ટાળવું જોઈએ. જે નવો મુદ્દો શીખવવાનો હોય તેને અનુરૂપ પૂર્વજ્ઞાન કે પૂર્વાનુભવોનો ઉપયોગ કરી સાહજિક રીતે જ પાઠનાં વિષયાંગ તરફ દોરી જવા જોઈએ. તો જ વિદ્યાર્થીઓ વિષય કે વિષયાંગ પ્રત્યે અભિમુખ બને છે.

### 5.7.6 વિષયાભિમુખ કૌશલ્યનો માઈક્રોપાઠ :

તાલીમાર્થીનું નામ : .....	રોલ નં. ....
વિષય : .....	વિષયાંગ : .....
તારીખ : .....	તાસ : .....
સમય : ..... શિક્ષણ/પુન:શિક્ષણ	
હેતુઓ : (1) વિદ્યાર્થીઓ વિષયાભિમુખ કૌશલ્ય કેળવે.	
(2) વિદ્યાર્થીઓ તત્વોનું આવર્તનીય વર્ગીકરણ એકમથી અભિમુખ થાય.	
<p><b>વિદ્યાર્થી મિત્રો,</b></p> <p>નમસ્કાર (શિક્ષક વર્ગમાં પ્રવેશી વિદ્યાર્થીઓનું અભિવાદન કરશે અને પાઠ સંબંધી જરૂરી સૂચનાઓ આપશે. તથા R.B Chart પરનું લખાણ શિક્ષક વિદ્યાર્થી પાસે વંચાવીને નીચેના જેવા કેટલાક પ્રશ્નો પૂછી વિષયપ્રવેશ કરશે.)</p> <p>વિશ્વમાં અત્યાર સુધી 114 તત્વો શોધાયેલા છે. આ દરેક તત્વો જુદા-જુદા ગુણધર્મો ધરાવે છે. તેથી દરેક તત્વોનાં ગુણધર્મો અને ઉપયોગિતા એક સાથે સમજવા મુશ્કેલ છે. જો તત્વોને તેના ગુણધર્મને આધારે વર્ગીકરણ કરવામાં આવે તો અભ્યાસ સરળ થઈ શકે. તેના માટે ઘણા વૈજ્ઞાનિકોએ પોતાના ખ્યાલ રજૂ કર્યા. ઈ.સ. 1803માં ડાલ્ટને તત્વોના પરમાણ્વીય દળ અંગેની માહિતી આપી અને તે સમયે જાણીતા તત્વોને તેના પરમાણ્વીય દળના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. ઈ.સ. 1817માં જર્મન વૈજ્ઞાનિક ડોબરેનરે રાસાયણીક ગુણધર્મોને આધારે તત્વોના વર્ગીકરણની શરૂઆત કરી. ઈ.સ. 1864માં ન્યુલેન્ડે તત્વોના વર્ગીકરણની શરૂઆત કરી. ઈ.સ. 1864માં ન્યુલેન્ડે તત્વોના વર્ગીકરણ માટેનો ‘અષ્ટકનો નિયમ’ આપ્યો. મેન્ડેલીકે તેના સમયમાં જાણીતા તત્વોને તેના સમાન ગુણધર્મોને આધારે તત્વોનું વર્ગીકરણ કર્યું. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને તેના પરમાણ્વીય ક્રમાંકને આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.</p> <p><b>પ્રશ્નો :</b></p> <p>(1) ઈ.સ. 1803નાં સમયમાં તત્વોનું વર્ગીકરણ શેનાં આધારે થયું હતું ?</p> <p>(2) ડોબરેનરે શેના આધારે તત્વોના વર્ગીકરણની શરૂઆત કરી ?</p> <p>(3) ન્યુલેન્ડે તત્વોના વર્ગીકરણ માટે કયો નિયમ આપ્યો હતો ?</p> <p>(4) આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને શેના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું ?</p> <p style="text-align: right;">નિરીક્ષકશ્રીની સહી</p> <p style="text-align: right;">.....</p>	



5.7.7 વિષયાભિમુખ માઈક્રોપાઠનું નિરીક્ષણ પત્રક :

સૂચના : વિષયાભિમુખ કૌશલ્યમાં જે-જે પ્રકારના ઘટકો ઉપયોગ થયો હોય, તે દરેક પ્રકારના ઘટકો સામે જેટલી વાર ઉપયોગ થયો હોય તેટલી વાર 3 નું નિશાન કરો.				
ઘટકો	ઘટકોનો ઉપયોગ			
(1) પૂર્વજ્ઞાનનો ઉપયોગ				
(2) યોગ્ય પ્રયુક્તિઓનો ઉપયોગ પ્રશ્નોત્તરી ઉદાહરણ કે દૃષ્ટાંત કથન કે વ્યાખ્યાન વાર્તા રોલ પ્લે-નાટ્યીકરણ દશ્ય-શ્રાવ્ય સાધનોનો ઉપયોગ				
(3) સાતત્ય ભંગ				
(4) કૃત્રિમ રીતે મથાળું કઢાવવાનો બનાવ				

● તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી ખાલી જગ્યામાં લખો.

1. વિષયાભિમુખ કૌશલ્યનો અર્થ જણાવો.

.....

.....

.....

.....

.....

.....

2. વિષયાભિમુખ કૌશલ્યનાં હેતુઓ લખો :

.....

.....

.....

.....

.....

3. વિષયાભિમુખ કૌશલ્યનાં ઈચ્છનીય વર્તનોની સમજ આપો.

.....

.....

.....

.....

.....

#### 4. શિક્ષક તરીકે વિષયપ્રવેશ દરમિયાન તમે કયા વર્તનો કરવાનું ટાળશો ?

.....

.....

.....

.....

.....

.....

#### 5.8 પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય :

શિક્ષણની પ્રક્રિયા દ્વિધ્રુવી પ્રક્રિયા છે એટલે કે શિક્ષણ પ્રક્રિયાનાં બંને ધ્રુવો શિક્ષક અને વિદ્યાર્થી બંને સક્રિય રહે તે જરૂરી છે. શિક્ષક તો શિક્ષણ કાર્ય કરાવે છે માટે સક્રિય છે. પરંતુ વિદ્યાર્થીઓને સક્રિય રીતે ભાગ લેતા કરવા માટે પ્રશ્નો પૂછવા જોઈએ. કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જ્ઞાન પ્રાપ્તિનો મહત્વનો માર્ગ ‘પરિપ્રશ્નનેન સેવ્યા’ છે. સોક્રેટિસના જમાનાથી આજદિન સુધી પ્રશ્નોત્તરી પ્રયુક્તિનો મોટે ભાગે ઉપયોગ થઈ રહ્યો છે. અધ્યાપન ક્રિયામાં વિદ્યાર્થીને વધુ સક્રિય બનાવવામાં પ્રશ્નોનું આગવું મહત્ત્વ છે. પ્રશ્ન પ્રયુક્તિને અસરકારક બનાવવા માટે પ્રશ્નપ્રવાહિતા કૌશલ્ય અનિવાર્ય બને છે.

#### 5.8.1 પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનો અર્થ :

નિર્ધારિત સમય મર્યાદામાં શિક્ષક મહત્તમ સંખ્યામાં ટૂંકા સ્પષ્ટ, વિષયને સુસંગત અને ભાષાકીય દૃષ્ટિએ શુદ્ધ પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા દ્વારા યોગ્ય ઉત્તરો મેળવવાના પ્રાવિણ્યને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કહે છે.

#### 5.8.2 પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનું મહત્ત્વ :

આ કૌશલ્ય પ્રાપ્ત કરવાથી શિક્ષકનું અધ્યાપન અસરકારક અને આકર્ષક બને છે. શિક્ષણકાર્યમાં તેનું આગવું મહત્ત્વ છે.

- (1) પ્રશ્ન કૌશલ્ય કેળવવાથી વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન જાણી શકાય છે.
- (2) કોઈ બાબત કે મુદ્દા પરત્વે વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રીત કરી શકાય છે.
- (3) વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિ જાગૃત કરી શકાય છે; વિચાર કરવા પ્રેરી શકાય છે.
- (4) બાળકોએ શીખેલ વિષયવસ્તુનું મૂલ્યાંકન કરી શકાય છે.
- (5) વર્ગવ્યવહાર સુધારી શકાય.
- (6) વિદ્યાર્થીઓની તર્કશક્તિ અને વિશ્લેષણાત્મક શક્તિનો વિકાસ થાય.
- (7) વિદ્યાર્થીઓની મૌખિક અભિવ્યક્તિ કેળવી શકાય, અધ્યેતાની શિક્ષણકાર્યમાં સહભાગિતા વધારી શકાય છે.
- (8) કથનથી નીપજતો કંટાળો દૂર કરી શકાય.
- (9) અધ્યાપન અસરકારક બને છે.

#### 5.8.3 પ્રશ્ન કૌશલ્યના પ્રકારો :

પ્રશ્ન કૌશલ્યને ચાર પ્રકારોમાં વહેંચી શકાય.

- (1) પ્રશ્નપ્રવાહિતા કૌશલ્ય
- (2) પ્રશ્નઊંડાણ કૌશલ્ય
- (3) બહુવિધ પ્રશ્ન કૌશલ્ય
- (4) ઉચ્ચ પ્રકારના પ્રશ્નો પૂછવાનું કૌશલ્ય

ઉપરનાં પ્રકારોમાંથી આપણે (1) પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય વિગતે સમજીશું.

#### 5.8.4 પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનાં ઘટકો :

પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં ખાસ કરીને નીચેના ત્રણ ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે.

- (1) પ્રશ્નનું બંધારણ (Structure)
- (2) પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા (process)
- (3) પ્રશ્નનું ઉત્પાદન (product)

ઉપરના ત્રણે ઘટકોને આપણે ક્રમશઃ સમજીશું.

#### (1) પ્રશ્નનું બંધારણ (Structure) :

પ્રશ્નનાં બંધારણ અંગેનાં કેટલાંક લક્ષણો નીચે મુજબ છે.

- પ્રશ્નો વ્યાકરણ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ હોવા જોઈએ.
- પ્રશ્નો ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ.
- પ્રશ્નો જે મુદ્દાનું શિક્ષણ કાર્ય ચાલતું હોય તેને સુસંગત હોવા જોઈએ.
- પ્રશ્નોનો જવાબ સુનિશ્ચિત હોવો જોઈએ.
- પ્રશ્નો ક્રમિક અને પરસ્પર સંબંધિત હોવા જોઈએ.
- પ્રશ્નો તર્કબદ્ધ અને સચોટ હોવા જોઈએ.

#### ઉદાહરણો :

- (1) આઈન્સ્ટાઈનનો જન્મ ક્યા શહેરમાં થયો હતો ?
- (2) પદાર્થની અણુઓની દૃષ્ટિએ ત્રણ અવસ્થા જણાવો.
- (3) ઝડપનો એકમ શું થશે ?
- (4) સજીવનો પાયાનો એકમ કયો છે ?

આમ પ્રશ્નનાં બંધારણની દૃષ્ટિએ તેમજ ભાષાની દૃષ્ટિએ શુદ્ધ હોવા જોઈએ. પ્રશ્નોમાં બિનજરૂરી શબ્દો ટાળવા જોઈએ. બિનજરૂરી શબ્દો ઉમેરતાં પ્રશ્નો અસ્પષ્ટ બને છે જેમ કે

- આઈન્સ્ટાઈનનો જન્મ ક્યાં થયો હતો ?
- ઉ. ગોદડીમાં, મામાના ઘરે, બેડરૂમમાં, ઘરમાં, હોસ્પિટલમાં વગેરે જવાબો મળી શકે.
- તમારામાંથી કોણ જવાબ આપશે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હોય ?

ઉપરોક્ત પ્રશ્નમાં શરૂઆતમાં તમારામાંથી કોણ જવાબ આપશે કે... આ શબ્દો બિનજરૂરી છે. જેનાં કારણે પ્રશ્નનું લંબાણ વધે છે. અસ્પષ્ટ બને છે. આ ઉપરાંત વર્ગમાં હું જવાબ આપીશ, હું જવાબ આપીશ... તેવા શબ્દોનાં ઉચ્ચારણોથી વર્ગમાં ગેરશિસ્ત ઊભી થાય છે.

#### પ્રશ્ન વિષયવસ્તુને સુસંગત હોવો જોઈએ :

શિક્ષક જ્યારે વૃક્ષના અંગો વિશે વર્ગખંડમાં શીખવતા હોય ત્યારે નીચેનાં જેવા પ્રશ્નો પૂછે છે. તેમાં કેટલાક પ્રશ્નો સુસંગત છે અને કેટલાક પ્રશ્નો સુસંગત નથી તે નીચેના દ્વારા જોઈ શકાય છે :

- (1) વૃક્ષના મુખ્ય અંગો કેટલા છે ?
- (2) વૃક્ષનાં મુખ્ય અંગો ક્યા-ક્યા છે ?
- (3) પ્રકાંડનું કાર્ય શું છે ?
- (4) વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી થાય છે ?
- (5) વન મહોત્સવ ક્યારે ઉજવાય છે.

(6) આપણે વનમહોત્સવ શા માટે ઉજવીએ છીએ ?

ઉપરોક્ત ઉદાહરણ પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે વૃક્ષના અંગો એકમ માટે પ્રથમ ત્રણ પ્રશ્નો જ સુસંગત છે. જ્યારે બાકીનાં પ્રશ્નો એકમને સુસંગત નથી માટે તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ.

(2) પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા :

પ્રશ્ન પૂછવાની બાબતમાં શિક્ષકે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.

(1) પ્રશ્નની રજૂઆત

(2) પ્રશ્નનું પુનરાવર્તન ટાળવું

(3) પ્રશ્ન પૂછ્યા પછી થોડાક સમય શાંતિ મેળવવી.

(4) પ્રશ્નની રજૂઆત યોગ્ય ઝડપે કરવી.

(5) પ્રશ્ન સુશ્રાવ્ય અવાજે રજૂ કરવો.

(6) પ્રશ્ન પૂછતી વખતે મહત્વના શબ્દ પર ભાર મૂકવો.

(7) પ્રશ્નની રજૂઆત સાથે યોગ્ય હાવભાવ કરવા.

ઉપરોક્ત બાબતોની વિગતે ચર્ચા કરીશું.

(1) પ્રશ્નની રજૂઆત :

પ્રશ્નની રજૂઆત સમગ્ર વર્ગખંડ સમક્ષ કરવી. કોઈ એક તરફ નહીં. જેથી બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક વર્ગ ચર્ચામાં ભાગ લઈ શકે. કોઈ ચોક્કસ વિદ્યાર્થીને ઊભો કરીને પ્રશ્ન પૂછવાનું ટાળવું જોઈએ.

(2) પ્રશ્નનું પુનરાવર્તન ટાળવું :

શિક્ષક એકવાર વર્ગખંડમાં પ્રશ્ન રજૂ કરે ત્યારબાદ થોડોક સમય વિચારવા માટે આપવો જોઈએ. ઉતાવળમાં એનો એ જ પ્રશ્ન ફરીથી પૂછીને પ્રશ્નનું બિનજરૂરી પુનરાવર્તન વર્ગખંડમાં કરવું નહીં. આવું વારંવાર કરવાથી વિદ્યાર્થીઓ બેધ્યાન બની જાય છે.

(3) પ્રશ્ન પૂછ્યા પછી થોડોક સમય શાંતિ જાળવવી :

વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યા પછી તે પ્રશ્નનો ઉત્તર વિચારવા માટેનો પૂરતો સમય આપવો જોઈએ. પરંતુ આ સમય અડધી કે એકાદ મિનિટ સુધીનો જ યોગ્ય ગણાય.

(4) પ્રશ્નની રજૂઆત યોગ્ય ઝડપે કરવી :

કેટલાક શિક્ષકો અતિશય ઝડપથી અથવા અતિશય મંદ ગતિથી પ્રશ્નો પૂછતા હોય છે. પરિણામે પ્રશ્નોની સ્પષ્ટતા વિદ્યાર્થી સમક્ષ થતી નથી તેના કારણે બાળકો પ્રશ્નોનાં સાચા ઉત્તરો આપી શકતા નથી. પરિણામે શિક્ષકને વિદ્યાર્થીઓ તરફથી બિલકુલ પ્રોત્સાહન મળતું નથી.

(5) પ્રશ્ન સુશ્રાવ્ય અવાજે રજૂ કરવો :

કેટલાક શિક્ષકોનો અવાજ ખૂબ ધીમો તો કેટલાક શિક્ષકોનો અવાજ ખૂબ મોટો હોય છે. મોટા અવાજને કારણે વર્ગખંડમાં અવાજનું પ્રદૂષણ થાય છે. તેમજ બાળકોને ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી પડે છે જ્યારે અતિશય ધીમા અવાજથી પૂછાયેલા પ્રશ્નો વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકતા નથી પરિણામે વર્ગ વ્યવસ્થા ખોરવાય છે. શિક્ષકનો અવાજ માપસરનો હોવો જોઈએ. જેથી વર્ગખંડની અંદર બેઠેલા તમામ વિદ્યાર્થીઓ સુસ્પષ્ટ સાંભળી શકે. આ ઉપરાંત શિક્ષકે જરૂરી આરોહ-અવરોહ દ્વારા પ્રશ્નની રજૂઆત કરવી જોઈએ.

(6) પ્રશ્ન પૂછતી વખતે મહત્વનાં શબ્દ પર ભાર મૂકવો :

પ્રશ્ન પૂછતી વખતે દરેક પ્રશ્નમાં કેટલાક પ્રશ્ન સૂચક શબ્દો હોય છે. આવા શબ્દો પર યોગ્ય ભાર મૂકીને પ્રશ્નો પૂછવામાં આવે તો વિદ્યાર્થીઓ પ્રશ્નને બરાબર સમજી શકે છે. અને પોતાનું ધ્યાન

કેન્દ્રીત કરી શકે છે. પરિણામે પ્રશ્નનાં યોગ્ય ઉત્તરો આપવા પ્રેરાય છે.

**(7) પ્રશ્નની રજૂઆત સાથે યોગ્ય હાવભાવ કરવા :**

પ્રશ્ન પૂછતી વખતે શિક્ષકે વિદ્યાર્થીઓને સહેલાઈથી પ્રશ્ન સમજાય તે માટે કેટલાક અસરકારક હાવભાવ કરવા જરૂરી છે. યોગ્ય હાવભાવ સાથે રજૂ કરેલો પ્રશ્ન અસરકારક નીવડે છે.

**(3) પ્રશ્નનું ઉત્પાદન (product) :**

શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછેલા પ્રશ્નો બંધારણ અને પ્રક્રિયાની દૃષ્ટિએ યોગ્ય હોવા છતાં કેટલીકવાર અપેક્ષિત ઉત્તરો મળતાં નથી તેના માટે નીચેનાં કારણો જવાબદાર છે.

- પ્રશ્નનું કઠિનતામૂલ્ય ઊંચું હોય.
- પ્રશ્નમાં વિદ્યાર્થીને રસ પડ્યો ન હોય.
- પ્રશ્ન સમયે વિદ્યાર્થીનું ધ્યાન ન હોય.
- પ્રશ્ન પૂર્વ જ્ઞાન સાથે સુસંગત ન હોય.
- શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા ન સ્થપાઈ હોય.
- પ્રશ્ન ખામીયુક્ત હોય.

ઉપરોક્ત કારણોને દૂર કરવા શિક્ષકે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ જેથી પ્રશ્ન પ્રક્રિયાને અસરકારક બનાવી શકાય. આ ઉપરાંત શિક્ષકે નીચેનાં જેવા કેટલાક ખામીયુક્ત પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ.

● **‘હા’ કે ‘ના’માં ઉત્તરો મળે તેવા પ્રશ્નો :**

કેટલાક પ્રશ્નોનાં ઉત્તરો ‘હા’ કે ‘ના’માં મળતા હોય તેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ.

દા.ત., (વનસ્પતિ કોષની આકૃતિ બતાવી) આ આકૃતિ વનસ્પતિ કોષની છે ?

● **સૂચક પ્રશ્નો ન પૂછવા :**

કેટલાક પ્રશ્નોમાં જ તેના ઉત્તરો સમાયેલા હોય છે. તેથી વિદ્યાર્થીઓને કંઈ વિચારવાનું રહેતું નથી. આવા પ્રશ્નોની કોઈ જ ફલશ્રુતિ નથી. તેથી આવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. દા.ત., લીંબુ એસિડિક છે કે બેઝિક ?

● **પડઘા પ્રશ્નો ન પૂછવા :**

પ્રથમ વિધાન કરીને તૂર્ત જ તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે, તો આવા પ્રશ્નોનાં ઉત્તરો માટે વિદ્યાર્થીએ કશું જ વિચારવાનું થતું નથી, તો આવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ.

દા.ત., એસિડ સ્વાદે ખાટાં હોય છે. (વિધાન)

એસિડ સ્વાદે કેવા હોય છે ? (પ્રશ્ન)

● **અટકળ કે અનુમાન પોષક પ્રશ્નો ન પૂછવા :**

શિક્ષક કેટલીકવાર વિદ્યાર્થીઓને એવા પ્રશ્નો પૂછે છે કે વિદ્યાર્થીઓને અટકળ કે અનુમાન કરીને ઉત્તરો આપવા પડે આવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ.

દા.ત. વનસ્પતિનું આયુષ્ય કેટલું હોય ?

● **સમર્થન પ્રશ્નો ન પૂછવા :**

શિક્ષક કોઈ વિધાન કરે અને તે વિધાનનાં સમર્થનની જરૂર હોય ત્યારે તે બરોબરને ?, ખરુને ?, સાચું ને ? જેવા પ્રશ્નો પૂછે છે તે સમર્થન પ્રશ્નો કહેવાય. આવા પ્રશ્નો ટાળવા જોઈએ.

દા.ત., બેઈઝ સ્વાદે તૂરા હોય છે. બરાબરને ?

● છટાદાર પ્રશ્ન ન પૂછવા :

કેટલાક પ્રશ્નો વર્ગની સંવેદનશીલતાને સ્પર્શ કરે તેવા હોય છે, છટાદાર પ્રશ્નો હોય છે જે ક્યારેક અવરોધક બને છે તો તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ.

દા.ત., આપણે સૌ વૃક્ષો કાપીએ છીએ, વાતાવરણને નુકસાન કરીએ છીએ, હવાનું પ્રદૂષણ કરીએ છીએ. શું આપણે પર્યાવરણનાં ગુનેગાર નથી ?

વિદ્યાર્થી અનુત્તર રહે છે.

5.8.5 પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનો માઈક્રોપાઠ :

તાલીમાર્થીનું નામ : ..... રોલ નં. ....  
 વિષય : ..... વિષયાંગ : ..... ધોરણ : .....  
 તારીખ : ..... તાસ : ..... સમય : ..... શિક્ષણ/પુન:શિક્ષણ

- હેતુઓ : (1) વિદ્યાર્થીઓ પ્રશ્નપ્રવાહિતા કૌશલ્ય કેળવે.  
 (2) વિદ્યાર્થીઓ સૌરઊર્જા વિશે જાણે.

શિક્ષક વર્ગવ્યવસ્થા તપાસી જરૂરી સૂચનો આપી, સૌરઊર્જા વિશે સમજાવી નીચેનાં જેવા પ્રશ્નો પૂછશે :

શિક્ષક : ઊર્જાનો મૂળભૂત સ્ત્રોત કયો છે ?

વિદ્યાર્થી : ઊર્જાનો મૂળભૂત સ્ત્રોત સૂર્ય છે.

શિક્ષક : સૌરઊર્જા એટલે શું ?

વિદ્યાર્થી : સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઊર્જાને સૌરઊર્જા કહે છે.

શિક્ષક : લીલી વનસ્પતિ સૌરઊર્જાનો કેવી રીતે ઉપયોગ કરે છે ?

વિદ્યાર્થી : લીલી વનસ્પતિમાં સૌરઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે.

શિક્ષક : સૌરઊર્જાનું અન્ય ઊર્જામાં રૂપાંતર કરતાં સાધનો કયા-કયા છે ?

વિદ્યાર્થી : સૌરઊર્જાનું અન્ય ઊર્જામાં રૂપાંતર કરતાં સાધનો સૂર્યકુકર, સોલાર વોટરહીટર, સોલાર સેલ જેવા સાધનો છે.

શિક્ષક : સૌરઊર્જાનું અન્ય કઈ-કઈ ઊર્જામાં રૂપાંતર કરી શકાય છે ?

વિદ્યાર્થી : સૌરઊર્જાનું અન્ય રાસાયણિક ઊર્જા, ઉષ્મા ઊર્જા, વિદ્યુત ઊર્જા વગેરેમાં રૂપાંતર કરી શકાય છે.

શિક્ષક : સૌરઊર્જાનો ઉપયોગ થતો હોય તેવા સાધનોનાં નામ જણાવો.

વિદ્યાર્થી : સોલર વોટર હીટર, સોલર કુકર, સોલર પેનલ

5.8.6 પ્રશ્ન પ્રવાહિતા માઈક્રોપાઠનું નિરીક્ષણ પત્રક :

ઘટકો	ઘટકોનો ઉપયોગ			
	સૌથી ઉત્તમ	ઉત્તમ	વધુ સારું	સારું
<p>● પ્રશ્નનું બંધારણ :</p> <ol style="list-style-type: none"> <li>1. વ્યાકરણ અને રચનાની દૃષ્ટિએ શુદ્ધ પ્રશ્ન</li> <li>2. પ્રશ્નનું સંક્ષિપ્તપણું</li> <li>3. પ્રશ્નની સ્પષ્ટતા</li> <li>4. પ્રશ્નની મુદ્દા સાથે સુસંગતતા</li> </ol> <p>● પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા :</p> <ol style="list-style-type: none"> <li>1. પ્રશ્નની સમગ્ર વર્ગ સમક્ષ રજૂઆત</li> <li>2. પ્રશ્નનું પુનરાવર્તન</li> <li>3. પ્રશ્ન પૂછ્યા બાદ શાંતિ</li> <li>4. પ્રશ્નની રજૂઆત               <ul style="list-style-type: none"> <li>- ખૂબ ઝડપથી</li> <li>- ખૂબ ધીમી ઝડપથી</li> <li>- યોગ્ય ઝડપથી</li> </ul> </li> <li>5. પ્રશ્નની રજૂઆતમાં શિક્ષકનો અવાજ               <ul style="list-style-type: none"> <li>- ખૂબ જ મોટો અવાજ</li> <li>- ખૂબ જ ધીમો અવાજ</li> <li>- યોગ્ય અવાજ</li> </ul> </li> <li>6. પ્રશ્નના શબ્દો પર યોગ્ય ભાર</li> <li>7. હાવભાવ સાથે પ્રશ્નની રજૂઆત</li> </ol> <p>● પ્રશ્નનું ઉત્પાદન :</p> <ol style="list-style-type: none"> <li>1. 'હા' કે 'ના'માં ઉત્તર આવે તેવા પ્રશ્નો</li> <li>2. પડઘા પ્રશ્નો</li> <li>3. સૂચનશીલ પ્રશ્નો</li> <li>4. અટકળ પોષક પ્રશ્નો</li> <li>5. સમર્થન પ્રશ્નો</li> <li>6. શિક્ષકે કરેલ ઉત્તરનું પુનરાવર્તન</li> <li>7. વિદ્યાર્થીઓએ પ્રશ્નોનાં ઉત્તર ન આપ્યા હોય તેવી પરિસ્થિતિ</li> </ol>				

- તમારી પ્રગતિ ચકાસો :
- નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી ખાલી જગ્યામાં લખો.
1. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનો અર્થ જણાવો.

.....

.....

.....

.....

.....

2. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનું મહત્ત્વ જણાવો.

.....  
.....  
.....  
.....  
.....

3. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનાં ઘટકોનાં માત્ર નામ લખો.

.....  
.....  
.....  
.....  
.....

4. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનું 'પ્રશ્ન બંધારણ' ઘટકની સમજ આપો.

.....  
.....  
.....  
.....  
.....

5. પ્રશ્ન પૂછતી વખતે તમે કઈ-કઈ બાબતોને ધ્યાનમાં રાખશો ?

.....  
.....  
.....  
.....  
.....

6. શિક્ષક કેવા-કેવા ખામીયુક્ત પ્રશ્નો કરવાનું ટાળશે ?

.....  
.....  
.....  
.....  
.....

7. કોઈપણ એક મુદ્દા માટેનું પ્રશ્નપ્રવાહિતાના માઈકોપાઠનું આયોજન કરો.

.....  
.....  
.....  
.....  
.....



## 5.9 સુદૃઢીકરણ કૌશલ્ય :

વર્ગશિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે કેટલાંક વ્યવહારો થતા હોય છે જેને કારણે જ શિક્ષણની પ્રક્રિયા સંભવી શકે છે. શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓના વિચારોને સમર્થન કરે છે ત્યારે અધ્યયન અભિમુખતા વધે છે. પરિણામે વિદ્યાર્થી સ્વયં શિક્ષણ પ્રાપ્ત કરવા તત્પર બને છે અને વધુ સક્રિયતાથી શિક્ષણ પ્રક્રિયામાં જોડાય છે. આ માટે શિક્ષકે પોતાના વર્તનોમાં જરૂરી પરિવર્તનો કરવા જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ કે પ્રેરણા આપવી જોઈએ જેથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે અને શિક્ષણમાં રસ લેતા થાય. શિક્ષકે વિદ્યાર્થીને ક્યારેય હતોત્સાહ કે નિરાશ કરવો જોઈએ નહીં. વિદ્યાર્થી જ્યારે પ્રશ્નોનાં સાચા ઉત્તરો આપે ત્યારે તેને પૂરતું પ્રોત્સાહન આપવું જોઈએ. આ પ્રોત્સાહન વિવિધ સુદૃઢકો દ્વારા આપવું જોઈએ. પરંતુ વિદ્યાર્થી જ્યારે સાચો ઉત્તર આપતો નથી ત્યારે તેને ઉતારી પાડવાને બદલે, ઠપકો આપવાને બદલે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. આમ, વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રક્રિયામાં વિવિધ સુદૃઢકો દ્વારા પ્રોત્સાહન આપવાનાં કૌશલ્યને સુદૃઢીકરણ કૌશલ્ય કહે છે.

### 5.9.1 સુદૃઢીકરણ કૌશલ્યનો અર્થ :

વિદ્યાર્થીઓ વર્ગની પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ સક્રિય રીતે ભાગ લે તે માટે શિક્ષકે વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય તેવી પ્રક્રિયામાં વધારો કરવાનું તેમજ વિદ્યાર્થીઓ હતોત્સાહ થાય તેવી પ્રક્રિયા ઓછામાં ઓછી કરવાનું કૌશલ્ય એટલે સુદૃઢીકરણ કૌશલ્ય.

### 5.9.2 સુદૃઢીકરણ કૌશલ્યનું મહત્ત્વ :

સુદૃઢીકરણ કૌશલ્યના ઉપયોગનું મહત્ત્વ નીચે મુજબ છે.

- વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં સક્રિય થાય છે.
- વિદ્યાર્થીઓને શિક્ષણની પ્રક્રિયામાં વધુ ભાગીદાર બનાવી શકાય છે.
- વિષયવસ્તુ પરત્વે વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રીત કરી શકાય છે.
- યોગ્ય સુદૃઢકના ઉપયોગથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડી શકાય છે.
- વિદ્યાર્થીઓની વર્તણૂક પર નિયમન લાવી શકાય છે.
- વિદ્યાર્થીઓને યોગ્ય વર્તન માટે પ્રોત્સાહિત કરી શકાય છે.

### 5.9.3 સુદૃઢીકરણ કૌશલ્યનાં ઘટકો :

શિક્ષક વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા જે સુદૃઢકોનો ઉપયોગ કરે છે તેમને હકારાત્મક સુદૃઢકો કહે છે. અને વિદ્યાર્થીઓને નિરુત્સાહી કે હતોત્સાહી કરવા માટે જે સુદૃઢકોનો ઉપયોગ કરે છે. તેમને નકારાત્મક સુદૃઢકો કહે છે.

#### (અ) હકારાત્મક સુદૃઢકો :

હકારાત્મક સુદૃઢકો બે પ્રકારના છે.

1. શાબ્દિક 2. અશાબ્દિક

#### (1) હકારાત્મક શાબ્દિક સુદૃઢકો :

કોઈપણ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓના વર્તન, વ્યવહારો અને પ્રતિચારોને સુદૃઢ બનાવવા પ્રસંશા કે પ્રોત્સાહન આપતા શબ્દોનો ઉપયોગ હકારાત્મક શાબ્દિક સુદૃઢકો કહેવાય છે. જેમ કે સારું, સરસ, શાબાશ, ધન્યવાદ, હં... હં..., સુંદર, આગળ વધો, તમે તદ્દન સાચું કહ્યું, સરસ પ્રયાસ, વગેરે.

#### (2) હકારાત્મક અશાબ્દિક સુદૃઢકો :

કોઈપણ પ્રક્રિયા દરમિયાન જેવી કે પ્રશ્નોત્તરી સમયે જ્યારે વિદ્યાર્થી ઉત્તરો આપે ત્યારે શિક્ષક વિદ્યાર્થી સામે જુએ છે અને હકારમાં સ્મિત કરે છે. તે પોતાના ચહેરાના હાવભાવ, શારીરિક હલનચલન, હાથના હલનચલન વડે હકારાત્મક અશાબ્દિક કે હાવભાવાત્મક સુદૃઢીકરણ પૂરું પાડે

છે. શિક્ષક ક્યારેક આશ્ચર્યચકિત થાય છે. આંખનો પલકારો કરે છે, તે કેટલીકવાર માથું હલાવે છે. વિદ્યાર્થીની પીઠ થાબડે છે. કા.પા. પર વિદ્યાર્થીનો ઉત્તર નોંધે છે. આ તમામ અશાબ્દિક સુદ્ઢકો કહેવાય છે.

#### (બ) નકારાત્મક સુદ્ઢકો :

નકારાત્મક સુદ્ઢકોનાં બે પ્રકાર છે.

#### 1. શાબ્દિક 2. અશાબ્દિક

#### (1) નકારાત્મક શાબ્દિક સુદ્ઢકો :

શિક્ષક વિદ્યાર્થીને નિરુત્સાહી કે તેનું અપમાન કરવા કેટલીકવાર નિંદાયુક્ત શબ્દો, અર્થહીન વિધાનો કે અસ્પષ્ટ વિધાનો કરે છે. આ પ્રકારના સુદ્ઢકો નકારાત્મક શાબ્દિક સુદ્ઢકો કહેવાય છે. જેવા કે મૂર્ખ, ગધેડો, ઉલ્લુ, બહેરો, અક્કલ વગરનો, ડોબો, નંગ જેવો, નાલાયક વગેરે શબ્દોનો ઉપયોગ તેમજ કેટલાક અર્થહીન વિધાનો કરે જેવા કે બેસી જા, ઊભો રહે, આમ ન કર, ટક ટક બંધ કર, બુદ્ધિ વગરનો, વગેરે. કેટલાક કટાક્ષ વિધાનો પણ કરવામાં આવે છે જેવા કે બસ ફર્યા કરો, બાપાના બગીચામાં ફર્યા કરો, સાવ ગપ્પુ માર્યું, આવડતું નથી ને રોફ મારે છે, આ કોઈ તારો બાપ કરશે... વગેરે...

#### (2) નકારાત્મક અશાબ્દિક સુદ્ઢકો :

શિક્ષક વિદ્યાર્થીઓના ખોટા પ્રતિચારોનો અસ્વીકાર કરવા અશાબ્દિક હાવભાવ અને શારીરિક હલનચલનનો ઉપયોગ કરે છે.

જેવા કે,

- (1) અશાબ્દિક હાવભાવ સાથે આંખો કાઢવી.
- (2) હાથ પછાડી વિદ્યાર્થીને બેસાડી દેવો.
- (3) ટેબલ પર ડસ્ટર પછાડી બેસવા ઈશારો કરવો.
- (4) ઘુરકિયા કરવા.
- (5) ગુસ્સે થઈ વિદ્યાર્થી સામે જોવું.
- (6) વિદ્યાર્થીને ઊભો કરવો.
- (7) માથું ધુણાવવું.

#### 5.9.4 સુદ્ઢકીકરણના ઉપયોગ વખતે લેવાની કાળજી :

સુદ્ઢકીકરણ કૌશલ્યનાં ઉપયોગ દરમિયાન નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

- (1) જે તે પ્રસંગે જરૂરી અને યોગ્ય સુદ્ઢકોનો ઉપયોગ કરવો.
- (2) વારંવાર એકના એક સુદ્ઢકોનો ઉપયોગ કરી કૃત્રિમતા ન લાવવી.
- (3) જરૂર જણાય ત્યાં હકારાત્મક સુદ્ઢકોનો અવશ્ય ઉપયોગ કરવો.
- (4) સુદ્ઢકોની અસર ધ્યાનમાં રાખીને તેનો ઉપયોગ કરવો.
- (5) જરૂર ન જણાય ત્યાં સુદ્ઢકોનો ઉપયોગ ટાળવો.
- (6) બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી, શરમાળ કે નબળા વિદ્યાર્થીઓને ધીરે-ધીરે પ્રતિચારમાં લાવવા યોગ્ય સુદ્ઢકોનો ઉપયોગ કરવો.
- (7) કોઈપણ પ્રકારના સુદ્ઢકોની સંખ્યા ચોક્કસ કે નિર્ધારિત નહિ હોવાથી, જરૂર પ્રમાણે તેમાં ફેરફાર થતા રહે છે.

### 5.9.5 સુદેઢીકરણ કૌશલ્યનો માઈકોપાઠ :

તાલીમાર્થીનું નામ : .....	રોલ નં. ....
વિષય : .....	વિષયાંગ : .....
તારીખ : .....	તાસ : .....
સમય : ..... શિક્ષણ/પુન:શિક્ષણ	
હેતુઓ : (1) વિઢ્યાર્થીઓ પ્રશ્નપ્રવાહિતા કૌશલ્ય કેળવે. (2) વિઢ્યાર્થીઓ ભૂમિ વિશેની સમજ કેળવે.	
શિક્ષક : ખડકાવરણ ઁટલે શું ?	
વિઢ્યાર્થી : પૃથ્વીની સપાટી પરના પથરાળ બાહ્ય આવરણને ખડકાવરણ કહે છે.	
શિક્ષક : શાબાશ ! ભૂમિમાં કેટલા ટકા ઓક્સિજન હોય છે ?	
વિઢ્યાર્થી : ભૂમિમાં 47.3% ઓક્સિજન હોય છે.	
શિક્ષક : ખૂબ સરસ ! ભૂમિમાં અન્ય કયા-કયા તત્ત્વો હોય છે ?	
વિઢ્યાર્થી : ભૂમિમાં ઁલ્યુમિનિયમ, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ જેવા તત્ત્વો પણ હોય છે.	
શિક્ષક : વાહ ! સિલિકોનનું પ્રમાણ કેટલું હોય છે ?	
વિઢ્યાર્થી : સિલિકોનનું પ્રમાણ 27.7% હોય છે.	
શિક્ષક : સરસ ! ભૂમિના ત્રણ પ્રકારોનાં નામ જણાવો.	
વિઢ્યાર્થી : રેતાળભૂમિ, માટિયાળ ભૂમિ ઁને મિશ્ર ભૂમિ.	
શિક્ષક : અભિનંદન.	
નિરીક્ષકશ્રીની સહી	
.....	

### 5.9.6 સુદેઢીકરણ માઈકોપાઠનું નિરીક્ષણ પત્રક :

ઘટકો	ઉપયોગ					
(1) હકારાત્મક શાબ્ઢિક સુદેઢકો						
● હકારાત્મક શાબ્ઢિક સુદેઢકો હા, સરસ... વગેરે.						
● વિઢ્યાર્થીઓના જવાબો ફરી ઁ જ પ્રમાણે બોલી પુન: ઉપયોગ						
● વધારાનાં શાબ્ઢિક સંકેત હં... હં... વિચારો, આગળ બોલો.						
● અન્ય...						
(2) હકારાત્મક અશાબ્ઢિક સુદેઢકો						
● માથું હલાવવું, સ્મિત કરવું, વિઢ્યાર્થી તરફ ઢ્યાનપૂર્વક જોવું.						
● કા.પા. પર વિઢ્યાર્થીના ઉત્તરો લખવા.						
● અન્ય...						
(3) નકારાત્મક શાબ્ઢિક સુદેઢકો						
● તમારો જવાબ ખોટો છે ઁવું કહી						

<p>વિદ્યાર્થીની મજાક કરવી.</p> <ul style="list-style-type: none"> <li>● ઠોઠડો, ડોબો, બુદ્ધિ વગરનો, ઉલ્લુ... વગેરે</li> <li>● અન્ય...</li> </ul> <p>(4) નકારાત્મક અશાબ્દિક સુદૃઢકો</p> <ul style="list-style-type: none"> <li>● ઘુરકિયા, ગુસ્સા સાથે વિદ્યાર્થી સામે જોઈ રહેવું વગેરે...</li> </ul> <p>(5) સુદૃઢકનો ખોટો ઉપયોગ :</p> <ul style="list-style-type: none"> <li>● સુદૃઢક ન આપ્યો હોય તેવો બનાવ કે જ્યાં સુદૃઢક આપી શકાયો હોત.</li> <li>● સુદૃઢકનો અયોગ્ય ઉપયોગ (જરૂર ન હોય ને સુદૃઢક આપ્યો હોય.)</li> <li>● અન્ય...</li> </ul>						
---	--	--	--	--	--	--

- તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી ખાલી જગ્યામાં લખો.

1. સુદૃઢીકરણ કૌશલ્યનો અર્થ જણાવો.

.....

.....

.....

.....

.....

.....

2. સુદૃઢીકરણ કૌશલ્યનું મહત્ત્વ લખો.

.....

.....

.....

.....

.....

.....

3. સુદૃઢીકરણ કૌશલ્યનાં ઘટકોનાં નામ જણાવો.

.....

.....

.....

.....

.....

.....

4. હકારાત્મક શાબ્દિક તેમજ અશાબ્દિક સુદૃઢકો જણાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....

5. નકારાત્મક શાબ્દિક તેમજ અશાબ્દિક સુદૃઢકો જણાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....

6. એક શિક્ષક તરીકે વર્ગખંડમાં સુદૃઢકોનાં ઉપયોગ દરમિયાન કઈ કઈ કાળજી લેશો ?

.....  
.....  
.....  
.....  
.....  
.....

#### 5.10 ઉદાહરણ કૌશલ્ય :

શિક્ષણ કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓને અમૂર્ત ખ્યાલો કે સંકલ્પના કે વિચારોનું શિક્ષણ આપવાનું હોય છે. શિક્ષક આ અમૂર્ત ખ્યાલો કે વિચારોની શાબ્દિક રજૂઆત કરે છે ત્યારે વિદ્યાર્થીઓ આ બાબતને પૂર્ણ રીતે સમજી શકતા નથી તેવા સમયે શિક્ષકે આ બાબતોને સમજાવવા માટે વિવિધ ઉદાહરણોનો આશરો લેવો પડે છે. ઉદાહરણોનાં ઉપયોગથી વર્ગખંડમાં શિક્ષણકાર્ય જીવંત અને રસપ્રદ બને છે. વિદ્યાર્થી આવી અમૂર્ત બાબતોને સમજી શકે છે. ઉદાહરણને કારણે વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય છે. તેથી શિક્ષણકાર્યમાં તે પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી શકે છે. શિક્ષણ પણ સારી રીતે ઉદાહરણોનો વર્ગખંડમાં ઉપયોગ કરી પોતાના શિક્ષણકાર્યને અસરકારક બનાવી શકે છે.

#### 5.10.1 ઉદાહરણ કૌશલ્યનો અર્થ :

વર્ગખંડનાં શિક્ષણકાર્યમાં અમૂર્ત વિચારો કે અમૂર્ત વિષયવસ્તુને વિવિધ ઉદાહરણો દ્વારા રજૂ કરવાના કૌશલ્યને ઉદાહરણ કૌશલ્ય કહેવાય છે.

#### 5.10.2 ઉદાહરણ કૌશલ્યનું મહત્ત્વ :

શિક્ષણકાર્યમાં ઉદાહરણ કૌશલ્યનું મહત્ત્વ નીચે મુજબ છે.

- જે-તે વિષયમાં ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.
- ઉદાહરણોથી વિદ્યાર્થીઓને શિક્ષણકાર્યમાં રસ પડે છે.
- વિદ્યાર્થીઓને કોઈ પણ બાબત જ્ઞાતથી અજ્ઞાત તરફ લઈ જઈને શીખવી શકાય છે.
- ખૂબ જ કઠિન કે અઘરા લાગતા મુદ્દાઓને ઉદાહરણ દ્વારા સરળ બનાવી શકાય છે.
- વિદ્યાર્થીઓની સમજશક્તિ અને અર્થગ્રહણ શક્તિનો વિકાસ કરી શકાય છે.

- વિદ્યાર્થીઓ સક્રિય રીતે શિક્ષણકાર્યમાં જોડાય છે.
- વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ સારી રીતે કરી શકાય છે.
- ઉદાહરણ દ્વારા કથનને સરળ, સ્પષ્ટ અને રસપ્રદ બનાવી શકાય છે.

### 5.10.3 સારા ઉદાહરણોનાં લક્ષણો :

સારા ઉદાહરણોના લક્ષણો નીચે મુજબ છે.

#### (1) ઉદાહરણ સરળ હોવું જોઈએ.

ઉદાહરણો વિદ્યાર્થીઓનાં પૂર્વજ્ઞાન કે પૂર્વાનુભવ સાથે સંકળાયેલાં હોય તેવાં ઉદાહરણો હોવા જોઈએ. વિદ્યાર્થીઓને સ્પર્શતા ઉદાહરણોને ઉપયોગમાં લેતા અધ્યાપનકાર્ય વધુ રસપૂર્વકનું બને છે. ઉદાહરણો કે દૃષ્ટાંત સરળ હોવા જોઈએ જેથી વિદ્યાર્થીઓનો યોગ્ય પ્રતિચાર મળે.

#### (2) સિદ્ધાંત, નિયમ કે ખ્યાલ સાથે સુસંગત હોવું જોઈએ.

જે ઉદાહરણો સિદ્ધાંત, નિયમ કે ખ્યાલને સ્પષ્ટ કરવા માટે ઉપયોગમાં લેવાના હોય તે બરાબર સ્પષ્ટ રીતે જે-તે સિદ્ધાંત, નિયમ કે ખ્યાલ સાથે સુસંગત હોવા જોઈએ તો જ તે બાબતોનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. જો ઉદાહરણ સુસંગત ન હોય તો સ્પષ્ટીકરણમાં ગૂંચવાડો ઊભો થાય છે.

#### (3) ઉદાહરણ રસપ્રદ હોવું જોઈએ.

ઉદાહરણો સામાન્ય રીતે વિદ્યાર્થીઓને રસ પડે તેવા હોવા જોઈએ. વિદ્યાર્થીઓનું ધ્યાન આકર્ષી શકે તેવા ઉદાહરણો હોય તો વિદ્યાર્થીઓને તેમાં રસ પડે છે. શક્ય હોય તો વિદ્યાર્થીઓનાં આજુબાજુના પર્યાવરણ કે દૈનિક વ્યવહાર સાથે કે તેની જાળમાં હોય તેવા ઉદાહરણો આપવાથી તે ધ્યાનપૂર્વક સાંભળે છે અને ચર્ચામાં ભાગ લે છે. આ માટે ઉદાહરણો વિદ્યાર્થીઓની વય, જ્ઞાનકક્ષા અને રુચિને અનુરૂપ હોવા જોઈએ.

ટૂંકમાં ઉદાહરણો સરળ, સુસંગત અને રસપ્રદ હોય તો શિક્ષણકાર્ય સફળ બને છે.

### 5.10.4 ઉદાહરણની રજૂઆત :

ઉદાહરણની વર્ગખંડમાં રજૂઆત કરતી વખતે નીચેની બે બાબતોનું ધ્યાન રાખવું.

#### (1) ઉદાહરણની રજૂઆત માટેનું માધ્યમ

#### (2) ઉદાહરણની રજૂઆત કરવા માટેની પદ્ધતિ

#### (1) ઉદાહરણની રજૂઆત માટેનું માધ્યમ :

ઉદાહરણની રજૂઆત બે માધ્યમોથી થઈ શકે છે. (અ) અશાબ્દિક (બ) શાબ્દિક

(અ) અશાબ્દિક માધ્યમ : ઉદાહરણ આપની વખતે વસ્તુ, નમૂનો, ચાર્ટ, નકશો, ચિત્ર, આકૃતિ કે પ્રયોગ દ્વારા રજૂ કરીએ તે અશાબ્દિક માધ્યમ.

(બ) શાબ્દિક માધ્યમ : ઉદાહરણમાં શબ્દોનાં માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ટૂંકી વાર્તા, પ્રસંગ કે દ્રશ્યનું આબેહૂબ વર્ણન, તુલનાત્મક દૃષ્ટાંતો વગેરે.

#### (2) ઉદાહરણ રજૂ કરવાની પદ્ધતિ :

વર્ગખંડમાં ઉદાહરણની રજૂઆત અસરકારક બનાવવા માટે શિક્ષકે આગમન-નિગમન પદ્ધતિનો સંયુક્ત રીતે ઉપયોગ કરવો જોઈએ. શિક્ષકે સિદ્ધાંત, નિયમ કે ખ્યાલની તારવણી કે સ્પષ્ટીકરણ શરૂઆતમાં વિશિષ્ટ ઉદાહરણ આપી આગમન પદ્ધતિથી કરવી જોઈએ. આમ કરવાથી 'જ્ઞાતથી અજ્ઞાત' તરફ જવાનું, 'સરળથી સંકુલ' તરફ જવાનું અને 'મૂર્તથી અમૂર્ત' તરફ જવાનું અધ્યાપનસૂત્ર અમલી બને. આ ઉપરાંત સિદ્ધાંત, નિયમ કે ખ્યાલની તારવણી કર્યા પછી વિદ્યાર્થીઓ સિદ્ધાંત, નિયમ કે ખ્યાલને સ્પષ્ટ રીતે સમજ્યા છે કે નહીં તેની ચકાસણી તેમની પાસેથી વિવિધ ઉદાહરણો મેળવી નિગમન પદ્ધતિ દ્વારા કરવી જોઈએ.

### 5.10.5 ઉદાહરણ કૌશલ્યનાં મુખ્ય ઘટકો :

ઉદાહરણ કૌશલ્યનાં ઘટકો નીચે મુજબ દર્શાવી શકાય.

- (1) યોગ્ય અને સરળ ઉદાહરણોની રચના કરવી.
- (2) વિષયવસ્તુને સુસંગત ઉદાહરણની રચના કરવી.
- (3) રસપ્રદ ઉદાહરણની રચના કરવી.
- (4) ઉદાહરણની રજૂઆત માટે યોગ્ય માધ્યમની પસંદગી કરવી.
- (5) આગમન-નિગમન પદ્ધતિ દ્વારા જ ઉદાહરણની રજૂઆત કરવી.

### 5.10.6 ઉદાહરણ કૌશલ્ય માટે ધ્યાનમાં રાખવાની બાબતો :

વર્ગખંડમાં શિક્ષક ઉદાહરણ કૌશલ્યનો ઉપયોગ કરશે ત્યારે નીચેની કેટલીક બાબતોને ધ્યાનમાં રાખશે.

- (1) ઉદાહરણ વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાન કે પૂર્વાનુભવ પર આધારિત હોવું જોઈએ.
- (2) ઉદાહરણ સરળ અને સ્પષ્ટ હોવું જોઈએ.
- (3) કોઈ સંકલ્પના, વિચાર કે સિદ્ધાંત અને ખ્યાલ સાથે સુસંગત હોવું જોઈએ.
- (4) વિદ્યાર્થીઓની વયકક્ષા, જ્ઞાનકક્ષા, માનસિક કક્ષા તેમજ તેની રુચિને ધ્યાનમાં રાખી ઉદાહરણની રચના કરવી જોઈએ.
- (5) વિષયવસ્તુ કે એકમને ધ્યાનમાં રાખીને ઉદાહરણ આપવું જોઈએ.
- (6) શિક્ષકે ઉદાહરણની રજૂઆત માટેનું યોગ્ય માધ્યમ પોતાની વિવેકબુદ્ધિથી પસંદ કરવું જોઈએ.
- (7) આગમન પદ્ધતિથી જ ઉદાહરણ રજૂ કરવું જોઈએ.
- (8) ઉદાહરણ સ્પષ્ટ, ટૂંકું અને સમજાય તેવું હોવું જોઈએ.
- (9) અઘરાં ઉદાહરણો આપવાનું ટાળવું જોઈએ.
- (10) વિદ્યાર્થીના અધ્યયનમાં વિક્ષેપ કરે તેવા ઉદાહરણો આપવા નહીં.
- (11) ઉદાહરણોની રજૂઆત કમિક, તર્કબદ્ધ અને વિષયવસ્તુને અનુરૂપ હોવી જોઈએ.

### 5.10.7 ઉદાહરણ કૌશલ્યનો માઈક્રોપાઠ :

તાલીમાર્થીનું નામ : ..... રોલ નં. ....

વિષય : ..... વિષયાંગ : ..... ધોરણ : .....

તારીખ : ..... તાસ : ..... સમય : ..... શિક્ષણ/પુન:શિક્ષણ

હેતુઓ : (1) વિદ્યાર્થીઓ ઉદાહરણ કૌશલ્ય કેળવે.

(2) વિદ્યાર્થીઓ બાષ્પીભવનની ક્રિયા જાણે.

શિક્ષક ગેસ પર પાણી ભરેલી તપેલી મૂકીને ગેસને સળગાવે છે. પાણી ઉકળે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને નીચેનાં જેવા પ્રશ્નો પૂછે છે.

શિક્ષક : રાજુ, આ તપેલીનું પાણી કેવું છે ?

રાજુ : સાહેબ, પાણી ખૂબ ગરમ છે.

શિક્ષક : રાજુ, પાણીમાંથી શું નીકળતું દેખાય છે ?

રાજુ : પાણીમાંથી વરાળ નીકળતી દેખાય છે.

શિક્ષક : રાજુ, હવે કહે જોઈએ તપેલીમાં ભરેલા પાણીને ખૂબ ઉકાળીએ ત્યારે શું થાય છે ?

રાજુ : પાણીમાંથી વરાળ બહાર નીકળે છે.

શિક્ષક : વિશાલ પેલો ચમચો લાવ તેને સાણસીથી પકડીને ગેસ પર ગરમ કર.

વિશાલ : ચમચાને ગરમ કરે છે.

શિક્ષક : વિશાલ ચમચા પર પાણીનું ટીપું નાખ.

વિશાલ : ચમચા પર પાણીનું ટીપું નાખે છે.

શિક્ષક : પાણીનાં ટીપાનું શું થયું ?

વિશાલ : પાણીનું ટીપું ઊડી ગયું.

શિક્ષક : સાચું છે.

શિક્ષક : ઉનાળામાં નદીનું પાણી ઓછું કેમ થઈ જાય છે ?

નિધિ : ઉનાળામાં નદીનું પાણી ગરમ થઈ વરાળરૂપે ઊડી જાય છે તેથી.

શિક્ષક : આ બધા ઉદાહરણ પરથી શું તારવી શકાય ? શ્રેય તરફ જોઈને.

શ્રેય : પાણીની વરાળ બને છે.

શિક્ષક : પાણીની વરાળ બનવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહેવાય છે.

હવે વિદ્યાર્થી મિત્રો આ અંગેના બીજા કેટલાંક ઉદાહરણો તમે જણાવો.

રાહુલ : સ્નાન કર્યા પછી માથાના વાળ થોડા સમય પછી સૂકા થઈ જાય છે.

ફાગુન : આપણા શરીર પરનો પરસેવો થોડા સમય પછી અદૃશ્ય થઈ જાય છે.

દ્વિજ : ભીનાં કપડાં સૂકવ્યા પછી થોડા સમયમાં સૂકાઈ જાય છે.

શિક્ષક : સરસ, તો આ ઉદાહરણો પરથી નક્કી કરી શકીએ છીએ કે પાણીની વરાળ થઈ જવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે.

નિરીક્ષકશ્રીની સહી

.....

#### 5.10.8 ઉદાહરણ માર્કોપાઠનું નિરીક્ષણ પત્રક :

ઉદાહરણનો ક્રમ નંબર	સરળ	નિયમ કે ખ્યાલ સાથે સુસંગત	રસવાળું	રજૂઆતના માધ્યમની યોગ્યતા	અભિગમ	વિદ્યાર્થી સહયોગ	રિમાર્ક



● તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી ખાલી જગ્યામાં લખો.

1. ઉદાહરણ કૌશલ્યનો અર્થ જણાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....

2. ઉદાહરણ કૌશલ્યનું મહત્ત્વ જણાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....

3. સારા ઉદાહરણના લક્ષણો જણાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....

4. ઉદાહરણની રજૂઆત વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો ?

.....  
.....  
.....  
.....  
.....  
.....

5. ઉદાહરણ કૌશલ્યનાં ઘટકો જણાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....

6. એક શિક્ષક તરીકે તમે વર્ગખંડમાં ઉદાહરણ કૌશલ્યમાં ઉપયોગ દરમિયાન કઈ-કઈ કાળજી લેશો ?

.....

.....

.....

.....

.....

.....

### 5.11 કા.પા. કાર્ય કૌશલ્ય :

વર્ગ શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષણને અસરકારક અને રસપ્રદ બનાવવામાં કા.પા. કાર્યનો મહત્વનો ફાળો છે. કાળું પાટિયું (કા.પા.) એ શિક્ષકનું મહત્વનું ઉપકરણ છે. જેને શ્યામફલક પણ કહેવામાં આવે છે. કા.પા. (Chalk board) એ શિક્ષકને સરળતાથી ઉપલબ્ધ થતું મહત્વનું સાધન છે. શિક્ષકનો એ પરમ મિત્ર અને સહૃદયી સાથીદાર છે. વર્ગખંડનું એ આભૂષણ છે. વિદ્યાર્થીઓ માટે એ જ્ઞાનદાતા છે. શિક્ષકનાં વર્ગકાર્યનો એ લિખિત દસ્તાવેજ છે. તે વર્ગખંડમાં વિદ્યાર્થીઓનો દ્વિતીય શિક્ષક છે. શિક્ષણકાર્યને અસરકારક બનાવવામાં તેનો ફાળો મહત્વનો છે.

#### 5.11.1 કા.પા. કૌશલ્યનો અર્થ :

વર્ગખંડમાં કાળા પાટિયા પર શિક્ષક દ્વારા વિષયાંગને અનુરૂપ મહત્વનાં મુદ્દાઓને વ્યવસ્થિત રીતે મરોડદાર અક્ષરોથી, જે તમામ વિદ્યાર્થીઓ સહેલાઈથી વાંચી શકે તેવા અસરકારક કા.પા. નોંધ કરવાનાં શિક્ષકનાં કૌશલ્યને કા.પા. કૌશલ્ય કહેવામાં આવે છે.

કા.પા. કૌશલ્યને કૃષ્ણ ફલક, ચોક ફલક, ચોક બોર્ડ, કાળું પાટિયું, Black Board વગેરેનાં નામથી પણ ઓળખવામાં આવે છે.

#### 5.11.2 કા.પા. કૌશલ્યનું મહત્વ :

કા.પા. કૌશલ્યનું મહત્વ નીચે મુજબ છે.

- વિષયવસ્તુની સરળતાથી લેખિત સ્પષ્ટતા કરી શકાય છે.
- કા.પા. પર આકૃતિ, આલેખ, નકશા, રેખાચિત્ર વગેરેનું આલેખન કરી વિદ્યાર્થીઓને મુદ્દાની સ્પષ્ટ સમજ આપી શકાય છે.
- શિક્ષક બોલે, પછી પ્રશ્ન પૂછે, વિદ્યાર્થી ઉત્તર આપે, શિક્ષક નોંધ કરે, આથી વિદ્યાર્થીઓના જ્ઞાનનું ઝડપથી દઢીકરણ થાય છે.
- શિક્ષણકાર્ય મુદ્દાસર અને ક્રમિક બને છે.
- શિક્ષણકાર્યમાં સ્પષ્ટતા, ચોકસાઈ અને વૈવિધ્ય લાવી શકાય છે.
- મહત્વના મુદ્દાઓ કે બાબતો તરફ વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.
- વ્યાખ્યાઓ અને સિદ્ધાંતોનું આલેખન કરી અઘરા મુદ્દાઓને સહેલાઈથી સમજાવી શકાય છે.
- એમ કહેવાય છે કે વિદ્યાર્થીઓ બોલેલું જલ્દી ગ્રહણ કરી શકતા નથી જ્યારે લખેલું ત્વરિત ગ્રહણ કરે છે.
- કોઈપણ મુદ્દાની ચર્ચા દરમિયાન અગત્યના મુદ્દાઓની નોંધ કરી તેમના વિશે સ્પષ્ટતા કરી શકાય છે.
- ચર્ચા દરમિયાન રજૂ થતી માહિતીનું કોઠા કે સૂત્રાત્મક સ્વરૂપે વર્ગીકરણ કરી શકાય છે અને માહિતીની તુલના કરી શકાય છે.

- સમગ્ર પાઠના વિકાસ અંગે જાણી શકાય છે.
- શિક્ષણ કાર્યમાં વર્ગનાં વિદ્યાર્થીઓની સક્રિયતા વધારી શકાય છે.
- ગણતરીની વિવિધ રીતો ટૂંકમાં પદ્ધતિસર રજૂ કરી શકાય છે.

### 5.11.3 કા.પા. કૌશલ્યનાં ઘટકો

કા.પા. કાર્ય કૌશલ્યનાં ઘટકોમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.

- (1) હસ્તાક્ષરોની સુવાચ્યતા
  - (2) કા.પા. કાર્યની સ્વચ્છતા
  - (3) કા.પા. કાર્યની યોગ્યતા
- (1) હસ્તાક્ષરોની સુવાચ્યતા :

ખરાબ હસ્તાક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. આથી હસ્તાક્ષરો સપ્રમાણમાં અને નયનરમ્ય હોવા જોઈએ હસ્તાક્ષરો એ શિક્ષકના વ્યક્તિત્વનું પ્રતિબિંબ પાડે છે. અક્ષરો સરળતાથી વાંચી શકાય તેવા સુવાચ્ય હોવા જોઈએ તેથી,

- પ્રત્યેક અક્ષર સ્પષ્ટ (ભેદક) હોવો જોઈએ.
- કેટલાક અક્ષરો કે વર્ણો સામ્ય ધરાવતી દેહદૃષ્ટિ વાળા હોય છે.  
જેમ કે ધ-ઘ, ચ-થ, ય-પ વગેરે... આવા વર્ણોને યોગ્ય મરોડ સાથે લખવા જોઈએ.
- પ્રત્યેક અક્ષરો વચ્ચે એકસરખું યોગ્ય અંતર રાખીને અર્થવાહી શબ્દનું નિર્માણ કરવું જોઈએ.
- જુદા-જુદા શબ્દો વચ્ચે યોગ્ય અંતર જળવાય તે જોવું.
- પ્રત્યેક અક્ષર સીધી લીટીમાં હોવો જોઈએ ત્રાંસા લખાણથી સુવાચ્યતા ઘટે છે.
- દરેક અક્ષરનું કદ પ્રમાણ જાળવવું જોઈએ. ખૂબ મોટા કે ખૂબ નાના અક્ષરો હોવા જોઈએ નહીં. અક્ષરો સપ્રમાણમાં હોવા જોઈએ.
- અક્ષરો ઘૂંટાયેલા હોવા જોઈએ નહીં. લખાણ સીધી લીટીમાં હોવું જોઈએ. બે લીટીઓ વચ્ચે એક સરખી પહોળાઈની જગ્યા હોવી જોઈએ.

### (2) કા.પા. કાર્યમાં સ્વચ્છતા :

કા.પા. કાર્યમાં સ્વચ્છતા બાબતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

- લખાણ સીધી લીટીમાં લખાયેલ હોવું જોઈએ.
- હાથ ઊંચો કરી જ્યાં સુધી પહોંચી શકાય તેટલી ઊંચાઈએ જ. કા.પા. કાર્ય કરવું જોઈએ. જેથી સંપૂર્ણ ફલકનો ઉપયોગ થઈ શકે.
- લખાણમાં બે લીટીઓ વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ એટલે કે બે લીટીનું લખાણ ભેગું ન થાય.
- અક્ષર પર અક્ષર કે શબ્દ પર શબ્દ લખાઈ ન જાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ.
- કોઈપણ અક્ષર કે શબ્દને ઘૂંટીને લખવો જોઈએ નહીં.
- અગત્યના મુદ્દાઓ કે શબ્દો નીચે લીટી દોરવી જોઈએ.
- મુદ્દાઓ કે પેટા મુદ્દાઓ માટે રંગીન ચોકનો ઉપયોગ કરી જુદા પાડવા જોઈએ.
- લખાણને દૂર કરવા ડસ્ટરનો જ ઉપયોગ કરવો જોઈએ.

### (3) લખાણની યોગ્યતા :

- ફલક નોંધમાં લખાણ સ્પષ્ટ, મુદ્દાસર અને સંક્ષિપ્ત હોવું જોઈએ.
- લખાણ સરળ ભાષામાં હોવું જોઈએ. જેથી વિદ્યાર્થીઓ સરળ રીતે સમજી શકે.




- લખાણ તર્કબદ્ધ, ક્રમિક અને સાતત્યપૂર્ણ હોવું જોઈએ.
- પાઠની ચર્ચા દરમિયાન વિષયવસ્તુના શિક્ષણના વિકાસ સાથે કા.પા. નોંધ થવી જોઈએ.
- મુદ્દાઓ ટૂંકા હોવા જોઈએ.
- અગત્યના મુદ્દાઓ નીચે રેખાંકન કરવું જોઈએ આથી વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય.
- બિનજરૂરી લખાણ લખવું નહીં.
- લખાણમાં શબ્દોની જોડણી તેમજ વાક્ય રચનામાં ભૂલ ન હોવી જોઈએ.

#### 5.11.4 કા.પા. કાર્ય કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :

વર્ગશિક્ષણ કાર્ય દરમિયાન શ્યામફલક નોંધ કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

- કા.પા.નું સ્થાન વર્ગની મધ્યમાં હોવું જોઈએ કે જેથી બધા વિદ્યાર્થીઓ કા.પા. નોંધ જોઈ શકે.
- કા.પા. પર પ્રકાશની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. પ્રકાશનું પરાવર્તન ટાળવા પ્રયાસ કરવો જોઈએ.
- વર્ગમાં પ્રવેશની સાથે જ અગાઉનું લખાણ ભૂંસી નાખી, કા.પા.ને સ્વચ્છ બનાવવું જોઈએ.
- લખાણને ઉપરથી નીચેની બાજુ ભૂંસવું જોઈએ જેથી ચોકના રજકણો મોંમાં પ્રવેશે નહિ.
- તાસને અંતે ફલક સાફ કરવું જોઈએ.
- કા.પા. નોંધ કરીને શિક્ષકે કા.પા.ની વચ્ચે ઊભા રહેવું જોઈએ નહીં.
- લખતી વખતે ચોકનો બીનજરૂરી અવાજ ન થાય તે જોવું.
- સપ્રમાણ અક્ષરોમાં કા.પા. કાર્ય થવું જોઈએ.
- સામ્યતા ધરાવતા અક્ષરોનાં લેખનમાં કાળજી રાખવી.
- રંગીન ચોકનો યોગ્ય રીતે ઉપયોગ કરવો.

#### 5.11.5 કા.પા. કાર્ય કૌશલ્યનો માઈક્રોપાઠ :

તાલીમાર્થીનું નામ : .....	રોલ નં. ....	
વિષય : .....	વિષયાંગ : ..... ધોરણ : .....	
તારીખ : .....	તાસ : ..... સમય : ..... શિક્ષણ/પુન:શિક્ષણ	
<b>હેતુઓ :</b> (1) વિદ્યાર્થીઓ કા.પા. કાર્ય કૌશલ્ય કેળવે. (2) વિદ્યાર્થીઓ કા.પા. કાર્ય હસ્તગત કરે.		
<b>પરમાણુ ભાર :</b> પરમાણુભાર એટલે પરમાણુના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા		
<b>સમસ્થાનિકો :</b> પરમાણુના ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા જુદી-જુદી પરંતુ પ્રોટોનની સંખ્યા સમાન હોય તો તેવા પરમાણુ એકબીજાના સમસ્થાનિકો કહેવાય છે.		
<b>ઉદાહરણો :</b> હાઈડ્રોજનનો પરમાણુ ભારાંક એક, બે અને ત્રણ જોવા મળ્યો છે.		
 <p>હાઈડ્રોજન-H n = 0</p>	 <p>ડ્યુટેરિયમ-D n = 1</p>	 <p>ટ્રિટિયમ n = 2</p>

5.11.6 કા.પા. કાર્ય માઈક્રોપાઠનું નિરીક્ષણ પત્રક :

ઘટકો	નબળું	સાધારણ	મધ્યમ	સારું	ઉત્તમ
<p>1. હસ્તાક્ષરોની સુવાચ્યતા</p> <ul style="list-style-type: none"> <li>● પ્રત્યેક અક્ષર ભેદક છે.</li> <li>● બે અક્ષરો વચ્ચે યોગ્ય અંતર છે.</li> <li>● બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર છે.</li> <li>● અક્ષરોનું કદ યોગ્ય છે.</li> <li>● લીટીની જાડાઈ એક સરખી છે.</li> </ul> <p>2. શ્યામફલક કાર્યની સ્વચ્છતા</p> <ul style="list-style-type: none"> <li>● લખાણ સીધી લીટીમાં છે.</li> <li>● લીટીઓ વચ્ચે પૂરતું અંતર છે.</li> <li>● અક્ષર પર અક્ષર લખાઈ જતા નથી.</li> <li>● ચર્ચા સંબંધી વિગતો લખાઈ</li> </ul> <p>3. શ્યામફલક કાર્યની યોગ્યતા</p> <ul style="list-style-type: none"> <li>● રજૂ કરેલા મુદ્દાઓમાં સાતત્ય છે.</li> <li>● મુદ્દાઓ ટૂંકા અને સાદા છે.</li> <li>● મહત્વના મુદ્દાઓ અધોરેખિત છે.</li> <li>● રંગીન ચોકનો ઉપયોગ થયો છે.</li> <li>● આકૃતિઓ ઉદાહરણો પાઠની સાથે વિકસાવેલ છે.</li> <li>● આકૃતિઓ સાદી, મોટી, સ્પષ્ટ અને યોગ્ય કદની છે.</li> <li>● આકૃતિ/ઉદાહરણમાં સ્પષ્ટ છે.</li> </ul>					

તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી ખાલી જગ્યામાં લખો.

1. કા.પા. કૌશલ્યનો અર્થ જણાવો.

.....

.....

.....

.....

.....

.....

2. કા.પા. કૌશલ્યનું મહત્વ જણાવો.

.....

.....

.....

.....  
.....  
.....

3. કા.પા. કૌશલ્યનાં મુખ્ય ઘટકોની યાદી જણાવો.

.....  
.....  
.....  
.....  
.....

4. શિક્ષક તરીકે તમે વર્ગખંડમાં કા.પા. કાર્ય કરતી વખતે કઈ-કઈ કાળજી લેશો ?

.....  
.....  
.....  
.....  
.....

5.12 સ્પષ્ટીકરણ કૌશલ્ય :

શિક્ષણકાર્ય દરમિયાન શિક્ષક કેટલાક વિચારો, ખ્યાલો કે સંકલ્પનાઓની યોગ્ય સમજ આપવા માટે કેટલીક સ્પષ્ટતા કરવી પડે છે. આ માટે તેણે પોતાનાં વિધાનો કે દલીલો તાર્કિક ક્રમમાં રજૂ કરવા પડે છે. સામાન્ય રીતે શિક્ષક ખ્યાલ, ઘટના કે સંકલ્પનાનું કેમ, શા માટે, કે શું અને કેવી રીતે વિકસે તે સમજાવવા જે પ્રયત્નો કરે છે તેને સ્પષ્ટીકરણ કહે છે જેમ કે

- આપણે શિયાળામાં ગરમ કપડાં શા માટે પહેરીએ છીએ ?
- ગુરુત્વાકર્ષણ બળ એટલે શું ?

5.12.1 સ્પષ્ટીકરણ કૌશલ્યનો અર્થ :

શિક્ષણકાર્ય દરમિયાન શિક્ષક કેટલાક વિચારો, ખ્યાલો કે સંકલ્પનાઓની સ્પષ્ટ સમજ આપવા માટે વિદ્યાર્થી સમક્ષ કેટલીકવાર સ્પષ્ટતા કરવી પડે છે. આ માટે શિક્ષક પોતાના વિધાનોને કે દલીલોને તાર્કિક ક્રમમાં વિદ્યાર્થી સમક્ષ રજૂ કરે છે. સ્પષ્ટીકરણ એ વિદ્યાર્થીના મનમાં કોઈ સંકલ્પના, સિદ્ધાંત, ઘટના વગેરે અંગે સમજ પેદા કરનારી પ્રક્રિયા છે. સ્પષ્ટીકરણ એટલે નવી ઘટનાને પૂર્વાનુભવ સાથે સાંકળી, નવી ઘટના અંગે ખૂટતી કડીઓ જોડવી જોઈએ. આમ, સ્પષ્ટીકરણ એટલે પૂર્વાનુભવ અને નવી ઘટનાનું અનુસંધાન, વસ્તુ, ઘટના કે કાર્ય વચ્ચે નિયમો કે તર્ક દ્વારા સંબંધ જોડવાની પ્રક્રિયાને સ્પષ્ટીકરણ કૌશલ્ય કહેવાય.

5.12.2 સ્પષ્ટીકરણ કૌશલ્યનું મહત્ત્વ :

સ્પષ્ટીકરણ કૌશલ્યનું મહત્ત્વ નીચે મુજબ છે.

- (1) ઘટના, વિચાર કે ખ્યાલને અનુલક્ષીને આંતરસંબંધિત વિધાનો રજૂ કરી શકાય છે.
- (2) પૂર્વાનુભવ અને નવી ઘટના વચ્ચે અનુસંધાન કરી શકાય.
- (3) ઘટના, વિચાર કે ખ્યાલને સરળ બનાવવા સ્પષ્ટતા કરી શકાય.
- (4) વિદ્યાર્થીઓ સમક્ષ તાર્કિક ક્રમમાં રજૂઆત કરી શકાય. તેથી વિદ્યાર્થીઓની તર્કશક્તિનો વિકાસ કરી શકાય છે.
- (5) સ્પષ્ટતા કરતા કેટલાક શબ્દોનો ઉપયોગ કરી તેમની સમજને વિકસાવી શકાય છે.

### 5.12.3 સ્પષ્ટીકરણ કૌશલ્યના ઘટકો :

સ્પષ્ટીકરણ કૌશલ્યનાં વિકાસ માટે કેટલાક ઇચ્છનીય વર્તનો વિકસાવવા જોઈએ અને અનિચ્છનીય વર્તનો ટાળવા જોઈએ.

#### (1) ઇચ્છનીય વર્તનો :

વર્ગ શિક્ષણ કાર્યમાં અસરકારક સ્પષ્ટીકરણ કરવા માટે શિક્ષકે નીચેનાં જેવા ઇચ્છનીય વર્તનો કરવા જોઈએ.

#### [A] પ્રસ્તાવનારૂપ વિધાનોની રજૂઆત :

સામાન્ય રીતે સ્પષ્ટીકરણ કરતા પહેલા જે ઘટના, બાબતે કે સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ કરવાના હોય તે તરફ વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરવા તેનું પ્રસ્તાવનારૂપ વિધાન કરવું જરૂરી છે. જેમ કે આજે આપણે ગુરૂત્વાકર્ષણ વિશે શીખીશું.

આ પ્રક્રિયામાં શિક્ષક વિદ્યાર્થીઓનાં પૂર્વજ્ઞાનને નવા જ્ઞાન સાથે અભિસંધાન કરે છે.

#### [B] સમજ વિકસાવતા કડીરૂપ શબ્દસમૂહનો ઉપયોગ :

પ્રસ્તાવનારૂપ વિધાનને સ્પષ્ટ કરવા તેમજ વિસ્તૃતીકરણ કરવા વિધાનોને કડીરૂપ શબ્દો વડે તાર્કિક ક્રમમાં જોડવામાં આવે છે. સામાન્ય રીતે નીચેનાં જેવા કડીયુક્ત શબ્દો કે શબ્દસમૂહોનો ઉપયોગ કરવામાં આવે છે. દા.ત., તેથી, કારણકે, પરિણામે, આમ, જેથી, આ રીતે, શા માટે, પરંતુ, પછી, ત્યારબાદ વગેરે. આ પ્રકારના શબ્દો તેમજ શબ્દસમૂહના ઉપયોગ દ્વારા વિષયવસ્તુની સ્પષ્ટતા કરવામાં આવે છે.

#### [C] ઉપસંહારયુક્ત વિધાનોનો ઉપયોગ :

શિક્ષક દ્વારા વિષયવસ્તુની જે સ્પષ્ટતા કે વિસ્તૃતીકરણ કરેલ છે તેનાં સારાંશના ભાગરૂપે તેમજ વિદ્યાર્થીઓ સમજ અંગે મહત્વની બાબતો તારવે તે માટે શિક્ષક કેટલાંક વિધાનો રજૂ કરે છે. આમ કરવાથી મુદ્દાની સ્પષ્ટતાનો અંત આવે છે. વિદ્યાર્થીનાં મગજમાં સમજને એકત્ર કરવા, સુદૃઢ કરવા આ પ્રકારના વિધાનોનો ઉપયોગ કરવામાં આવે છે.

#### [D] વિદ્યાર્થીની સમજની ચકાસણી :

વિદ્યાર્થીઓમાં શિક્ષક દ્વારા શિક્ષણકાર્ય દરમિયાન જે તે ખ્યાલ, બનાવ કે સિદ્ધાંત અંગેની સમજ વિકસાવવા કરેલા પ્રયત્નોનું અપેક્ષિત પરિણામ આવ્યું છે કે નહીં તેની ચકાસણી કરવી જોઈએ. આ માટે શિક્ષક જે-તે મુદ્દાનાં સળંગ બે કે ત્રણ પ્રશ્નો વિદ્યાર્થીઓને પૂછે છે. જેના દ્વારા વિદ્યાર્થીઓની સમજ શક્તિનો ખ્યાલ આવે છે. જો વિદ્યાર્થીની સમજને તાર્કિક રીતે ચકાસવી હોય તો આમ કેમ થયું ?, શા માટે થયું ? વગેરે પ્રશ્નો પૂછવા જોઈએ.

#### (2) અનિચ્છનીય વર્તનો :

સ્પષ્ટીકરણ કરવામાં અવરોધક નીવડે, ગૂંચવાડો કે ગેરસમજ ઊભી કરે તેવા વર્તનો શિક્ષકે હંમેશાં ટાળવા જોઈએ. ખાસ કરીને સ્પષ્ટીકરણ કરવામાં ગૂંચવાડો, રૂકાવટ કે અસમજ પેદા કરે તેવા વર્તનોને અનિચ્છનીય વર્તનો કહે છે. જે નીચે મુજબ છે.

#### [A] અસંબંધિત વિધાનો કરવા :

જે ઘટના કે ખ્યાલ સંબંધિત વિધાનો કરવાના છે તે વિધાનો જ ગૂંચવાડો પેદા કરે અથવા સમજમાં કે સ્પષ્ટતામાં કોઈ ફાળો આપતા નથી તેવા વિધાનો અસંબંધિત વિધાનો કહેવાય છે. આવા વિધાનો વિદ્યાર્થીઓનું ધ્યાન વિચલિત કરે છે. તેથી શિક્ષકે આવા વિધાનો કરવાં જોઈએ નહિ.

#### [B] વિચારો કે માહિતીની રજૂઆત કરવામાં સાતત્ય ન જાળવવું :

વિચારો રજૂ કરવામાં ક્યારેક ક્રમબદ્ધતામાં ભંગાણ પડે છે. યોગ્ય ક્રમમાં કે ક્રમિક રીતે વિચારોની રજૂઆત થતી નથી. આને સાતત્યભંગ કહી શકાય તેથી સાતત્ય જાળવાતું નથી.

### [C] અયોગ્ય શબ્દનો ઉપયોગ :

વિદ્યાર્થીઓની વય-કક્ષા કે જ્ઞાન-કક્ષાને ધ્યાનમાં રાખી શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. અયોગ્ય કે અજાણ્યા શબ્દોના સ્પષ્ટીકરણ દરમિયાન ઉપયોગ ન કરવો જોઈએ. જેથી વિદ્યાર્થીઓને સમજવામાં મુશ્કેલી પડે. આમાં અનાત્મલક્ષિતા મહત્વનો ભાગ ભજવે છે.

### [D] ભાષાની પ્રવાહિતાનો અભાવ :

જ્યારે શિક્ષક અસ્પષ્ટ કે અધૂરા વાક્યોનો ઉપયોગ કરે અથવા અડધેથી વાક્યરચનામાં ફેરફાર કરે ત્યારે ભાષામાં પ્રવાહિતાનો ભંગ થાય છે. જેને ભાષાની પ્રવાહિતાનો અભાવ કહેવામાં આવે છે. આને લીધે વિદ્યાર્થીનું ધ્યાન બીજે દોરાય છે અને સમજવામાં અવરોધક નીવડે છે.

### [E] ફાલતુ કે બિનજરૂરી શબ્દો કે વિધાનોનો ઉપયોગ :

બિનજરૂરી શબ્દોને કારણે સ્પષ્ટીકરણમાં સંદિગ્ધતા ઊભી થાય છે. દા.ત., કેટલાંક, ઘટના, થોડા, કદાચ, ખરી રીતે, મોટે ભાગે મને લાગે છે કે આ શબ્દો સ્પષ્ટીકરણમાં અવરોધરૂપ બને છે.

### 5.12.4 સ્પષ્ટીકરણ કૌશલ્યમાં ધ્યાનમાં રાખવાની બાબતો :

સ્પષ્ટીકરણ કૌશલ્ય દરમિયાન નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.

- (1) વિધાનોની રજૂઆત તાર્કિક ક્રમમાં થવી જોઈએ.
- (2) વિધાનોનાં શબ્દો વિદ્યાર્થીઓથી પરિચિત હોવા જોઈએ.
- (3) અધૂરા વિધાનો કે વિધાનોનું પુનરાવર્તન ટાળવું જોઈએ.
- (4) પુરોગામી કે અનુગામી વિધાનોનો સંબંધ જળવાઈ રહેવો જોઈએ.
- (5) વિધાનોની રજૂઆતમાં પ્રવાહિતા હોવી જોઈએ.
- (6) બિનજરૂરી શબ્દો કે વિધાનોનો ઉપયોગ ટાળવો જોઈએ.
- (7) શિક્ષક શાનું સ્પષ્ટીકરણ કરે છે. તેનો સ્પષ્ટ નિર્દેશ કરવો જોઈએ.
- (8) સ્પષ્ટીકરણ માટેનું વિધાન જે તે ઘટના, ખ્યાલ કે સિદ્ધાંતને અનુરૂપ હોવું જોઈએ.
- (9) સ્પષ્ટીકરણ પૂર્ણ થયાનું સમાપન વિધાન દર્શાવવું જોઈએ.

### 5.12.5 સ્પષ્ટીકરણ કૌશલ્યનો માઈક્રોપાઠ :

તાલીમાર્થીનું નામ : .....	રોલ નં. ....	
વિષય : વિજ્ઞાન	વિષયાંગ : દરિયાઈ લહેરો	ધોરણ : .....
તારીખ : .....	તાસ : .....	સમય : ..... શિક્ષણ/પુન:શિક્ષણ

- હેતુઓ : (1) વિદ્યાર્થીઓ સ્પષ્ટીકરણ કૌશલ્ય કેળવે.  
(2) વિદ્યાર્થીઓ સ્પષ્ટીકરણ કૌશલ્ય હસ્તગત કરે.

#### (1) પ્રસ્તાવનારૂપ વિધાન :

દરિયાઈ લહેર એ એવો પવન છે જે દરિયા તરફથી જમીન તરફ વાય છે. આપણે આ લહેર કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજીએ.

#### (2) સાતત્યરૂપ, તર્કસંગત, કડીરૂપ વિધાનો દ્વારા સમજૂતી :

દિવસે સૂર્યના કિરણો જમીન ઉપર તથા પાણી ઉપર પડે છે. આપણે જાણીએ છીએ કે પાણી કરતાં જમીન વધારે ઝડપથી ગરમ થાય છે. તેથી દિવસ દરમિયાન દરિયા-કિનારાની નજીકની જમીન દરિયાના પાણી કરતાં વધારે ગરમ થાય છે. આમ, જમીન ઉપરની ગરમ થયેલી હવા ઊંચે ચડે છે, કારણ કે તે હલકી છે. પરિણામે જમીન ઉપર હવાનું હળવું દબાણ સર્જાય છે. જ્યારે દરિયા ઉપર તે વખતે ભારે દબાણ હોય છે. પવનો ભારે દબાણથી હળવા દબાણ તરફ વાય છે. જેથી દરિયા ઉપરની ઠંડી હવા દબાણ સરખું કરવા જમીન તરફ ધસે છે. આને દરિયાઈ લહેર કહે છે.



**(3) ઉપસંહારાત્મક વિધાન :**

આમ, દિવસ દરમિયાન જમીન ઉપર અને દરિયા ઉપર હવાના દબાણનો તફાવત સર્જવાને કારણે જે લહેરો ઉત્પન્ન થાય છે તેને દરિયાઈ લહેર કહે છે.

**(4) સમજ ચકાસતા પ્રશ્નો :**

પ્રશ્ન-1. જમીન ઉપરની હવા દરિયા ઉપરની હવા કરતાં શા માટે વધારે ગરમ થાય છે ?

પ્રશ્ન-2. જમીન ઉપર હળવું દબાણ શા માટે સર્જાય છે ?

પ્રશ્ન-3. દરિયાઈ લહેર કેવી રીતે ઉત્પન્ન થાય છે.

નિરીક્ષકની સહી

.....

**5.12.6 સ્પષ્ટીકરણ માઈક્રોપાઠનું નિરીક્ષણ પત્રક :**

ઘટકો	વર્તનનો ઉપયોગ				
	નબળું	સાધારણ	મધ્યમ	સારું	ઉત્તમ
(અ) ઈચ્છનીય વર્તનો					
(1) સમજ આપતી કડીઓ					
(2) પ્રસ્તાવનારૂપ વિધાનો					
(3) ઉપસંહારરૂપ વિધાનો					
(4) વિદ્યાર્થીઓની સમજ ચકાસતા પ્રશ્નો					
(બ) અનિચ્છનીય વર્તનો					
(1) અસંબંધિત વિધાનો					
(2) વિધાનોમાં સાતત્ય ન જાળવવું.					
(3) અયોગ્ય શબ્દનો ઉપયોગ					
(4) ભાષાની પ્રવાહિતાનો અભાવ					
(5) ફાલતુ શબ્દનો વપરાશ					

તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી ખાલી જગ્યામાં લખો.

1. સ્પષ્ટીકરણ કૌશલ્યનો અર્થ જણાવો.

.....

.....

.....

.....

.....

.....

2. સ્પષ્ટીકરણ કૌશલ્યનું મહત્ત્વ જણાવો.

.....

.....

.....

.....

.....

.....

3. સ્પષ્ટીકરણ કૌશલ્યનાં ઈચ્છનીય વર્તનો જણાવો.

.....

.....  
.....  
.....  
.....  
.....

4. સ્પષ્ટીકરણ કૌશલ્યનાં અનિચ્છનીય વર્તનો જણાવો.

.....  
.....  
.....  
.....  
.....

5. એક શિક્ષક તરીકે વર્ગખંડમાં સ્પષ્ટીકરણ કૌશલ્યનાં ઉપયોગ દરમિયાન કઈ-કઈ કાળજી લેશો ?

.....  
.....  
.....  
.....  
.....

---

**5.13 સારાંશ :**

આ એકમમાં આપણે શિક્ષક માટેનાં પાયાનાં મૂળભૂત કૌશલ્યો વિશે સમજ્યા. શિક્ષણ પ્રક્રિયા દરમિયાન વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે વિષયવસ્તુની મદદથી મજબૂત સેતુ બાંધવા આ કૌશલ્યો ખૂબ જરૂરી છે. અહીં આપણે આવા માઈક્રો કૌશલ્ય માઈક્રોટીચિંગની મદદથી હસ્તગત કર્યાં. માઈક્રોટીચિંગની વિગતે સમજ મેળવ્યા બાદ ખૂબ અગત્યના પણ સામાન્ય વર્ગશિક્ષણ કૌશલ્યો જેવા કે વિષયાભિમુખ કૌશલ્ય, પ્રશ્નપ્રવાહિતા કૌશલ્ય, સુદૃઢીકરણ કૌશલ્ય, ઉદાહરણ કૌશલ્ય, કા.પા. કૌશલ્ય અને સ્પષ્ટીકરણ કૌશલ્યની સ્પષ્ટતા મેળવી. હવે પછીના એકમમાં આપણે સિમ્યુલેશન અને સેતુ પાઠની વિગતે સમજ મેળવીશું.

**5.14 સ્વાધ્યાય :**

1. માઈક્રોટીચિંગનો અર્થ જણાવી તેનાં લક્ષણો લખો.
2. માઈક્રોટીચિંગનાં સોપાનો સવિસ્તાર સમજાવો.
3. વિષયાભિમુખ કૌશલ્યની સમજ આપો.
4. પ્રશ્નપ્રવાહિતાનાં કૌશલ્યનાં માઈક્રોપાઠનું આયોજન કરો. (વિજ્ઞાનનાં કોઈ એક મુદ્દા માટે)
5. પ્રશ્ન પૂછતી વખતે કઈ-કઈ બાબતોની કાળજી લેશો ?
6. સુદૃઢીકરણ કૌશલ્યનો અર્થ જણાવી સુદૃઢીકરણ કૌશલ્યના ઘટકો સમજાવો.
7. સુદૃઢીકરણનાં માઈક્રોપાઠનું આયોજન તૈયાર કરો.
8. સારા ઉદાહરણનાં લક્ષણો જણાવો.
9. કા.પા. કૌશલ્યનાં ઘટકો સમજાવો.
10. કા.પા. કાર્ય કૌશલ્યનાં માઈક્રોપાઠનું આયોજન કરો.
11. સ્પષ્ટીકરણ કૌશલ્યનો અર્થ જણાવો.
12. સ્પષ્ટીકરણ કૌશલ્યનાં ઇચ્છનીય વર્તનોની ચર્ચા કરો.

: રૂપરેખા :

- 6.1 પ્રસ્તાવના
  - 6.2 ઉદ્દેશો
  - 6.3 સિમ્યુલેશનનો અર્થ
  - 6.4 સિમ્યુલેશનનું મહત્વ
  - 6.5 સિમ્યુલેશન પ્રક્રિયા
  - 6.6 સિમ્યુલેશનનાં તબક્કાઓ
  - 6.7 સિમ્યુલેશનના લાભ
  - 6.8 સિમ્યુલેશનની મર્યાદા
  - 6.9 સેતુપાઠ
    - 6.9.1 સેતુ પાઠ અર્થ
    - 6.9.2 સેતુ પાઠ અને માઈક્રોટીચિંગનો તફાવત
    - 6.9.3 સેતુ પાઠનું મહત્વ
    - 6.9.4 સેતુ પાઠનો નમૂનો
    - 6.9.5 સેતુ પાઠનું નિરીક્ષણ પત્રક
  - 6.10 સારાંશ
-

---

## 6.1 પ્રસ્તાવના :

---

અગાઉના એકમમાં આપણે માઈક્રોટીચિંગ પ્રયુક્તિ પ્રશિક્ષણ કાર્યક્રમમાં કઈ રીતે અસરકારક બની શકે તેમ છે અને તેનાં દ્વારા અધ્યાપન કૌશલ્યો કઈ રીતે વિકસાવી શકાય તેની વિગતે ચર્ચા કરી. પ્રસ્તુત એકમમાં અધ્યાપન કૌશલ્યો સિમ્યુલેશન (સર્જિત પરિસ્થિતિ)માં કઈ રીતે વિકસાવી શકાય તે વિશે ચર્ચા કરીશું. સિમ્યુલેશન પાછળનો વિચાર એવો છે કે વ્યક્તિને એવી પરિસ્થિતિમાં મૂકવી કે જેમાં તે પોતાની વિશિષ્ટ પ્રકારની વિવિધ નિર્ધારિત વર્તન તરાહનો કે કૌશલ્યનો મહાવરો મેળવી શકે.

---

## 6.2 ઉદ્દેશો :

---

પ્રસ્તુત એકમનો અભ્યાસ કર્યા બાદ તમે-

- સિમ્યુલેશનનો અર્થ જાણી શકશો.
- સિમ્યુલેશનનું મહત્ત્વ સમજી શકશો.
- સિમ્યુલેશનની પ્રક્રિયા જાણી તેનું નિર્માણ કરી શકશો.
- સિમ્યુલેશનના વિવિધ તબક્કાઓ મુજબ કાર્ય કરી શકશો.
- સિમ્યુલેશનનો લાભ તેમજ મર્યાદાઓ જાણી શકશો.
- સેતુ પાઠ વિશેની સમજ મેળવી શકશો.
- સેતુ પાઠ અને માઈક્રોપાઠ વચ્ચેનો તફાવત જાણી શકશો.
- સેતુ પાઠનું મહત્ત્વ સમજી શકશો.
- વિવિધ એકમોનાં / મુદ્દાના સેતુ પાઠનું આયોજન તૈયાર કરી શકશો.
- સેતુ પાઠના વર્ગશિક્ષણમાં વિનિયોગ કરી શકશો.

---

## 6.3 સિમ્યુલેશનનો અર્થ :

---

સિમ્યુલેશન એટલે દેખાવ કરવો, તેને વાસ્તવિક પરિસ્થિતિ કરતાં બીજા નંબરની (વાસ્તવિક પરિસ્થિતિ જેવી) પરિસ્થિતિ કહી શકાય ખરેખર માઈક્રોટીચિંગનો વાસ્તવમાં દેખાવ કરીને તાલીમાર્થીઓને તાલીમ આપવી એટલે સિમ્યુલેશન. સિમ્યુલેશનમાં કૃત્રિમ પરિસ્થિતિનું સર્જન કરવામાં આવે છે. તેથી તે સર્જિત પરિસ્થિતિ છે.

પ્રશિક્ષણાર્થીઓ શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ પાઠ આપવાને બદલે પ્રશિક્ષણાર્થીઓના નાના જૂથ સમક્ષ પાઠ આપે છે, અને અધ્યાપન કૌશલ્ય વિકસાવે છે. અહીં એક પ્રશિક્ષણાર્થી શિક્ષકની ભૂમિકામાં જ્યારે જૂથના અન્ય પ્રશિક્ષણાર્થીઓ વિદ્યાર્થીની ભૂમિકામાં વ્યવહાર કરે છે. સિમ્યુલેશનમાં એક કે બે માર્ગદર્શકો કે નિરીક્ષકો વર્તન વ્યવહારની મૂલવણી કરે છે. ક્યારેક પ્રશિક્ષણાર્થી મિત્રો પણ મૂલવણી કરી માર્ગદર્શન આપે છે.

---

## 6.4 સિમ્યુલેશનનું મહત્ત્વ :

---

સિમ્યુલેશનનું મહત્ત્વ નીચે મુજબ છે.

- (1) પ્રશિક્ષણાર્થી શાળાનાં વાસ્તવિક વર્ગખંડમાં ગયા સિવાય વર્તન તરાહ કે કૌશલ્યના વિકાસના પરિણામથી પરિચિત થાય છે.
- (2) તાલીમાર્થીઓ સંકોચ કે ડર વગર કૌશલ્યો શીખી શકે છે.
- (3) કંટાળો ખૂબ ઓછો આવે છે.
- (4) સિમ્યુલેશનથી સમયનો બચાવ થાય છે. શાળાનો સમય બચે છે.
- (5) ટૂંકાં સમયમાં ઘણા કૌશલ્યો વિકસાવવાની તક મળે છે.

- (6) વાસ્તવિક વર્ગખંડની પરિસ્થિતિનો સામનો કર્યા વિના જ મુશ્કેલીઓ જાણી શકાય છે.
- (7) પાઠ દરમિયાન થનારી ભૂલોનો ગભરાટ વિના, સંકોચ કે ડર વગર જરૂરી કૌશલ્યો ખીલવી શકાય છે.
- (8) પ્રશિક્ષણાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે. તેમની લઘુતાઅંશિ દૂર થાય છે.
- (9) મર્યાદિત સમયમાં સંખ્યાબંધ પ્રશિક્ષણાર્થીઓને કૌશલ્યોની તાલીમ પૂરી પાડી શકાય છે.
- (10) તાલીમાર્થીઓ જાતે જ શીખે છે અને અનુભવ મેળવે છે.
- (11) તાલીમાર્થીઓનાં વર્તનોનું વિશદ્ પૃથક્કરણ કરી શકાય છે.
- (12) વાસ્તવિક વર્ગખંડમાં નવી અધ્યાપન પદ્ધતિઓ, પ્રયુક્તિઓ કે શૈક્ષણિક સાધનો અજમાવવા પૂર્વેનો અવકાશ પૂરો પાડે છે.
- (13) નિરીક્ષકો, માર્ગદર્શકો તેમજ અન્ય તાલીમાર્થીઓ દ્વારા અપાતું પ્રતિપોષણ તાલીમાર્થીઓ આત્મવિશ્વાસ વધારે છે.

### 6.5 સિમ્યુલેશન પ્રક્રિયા :

સિમ્યુલેશનની પ્રક્રિયાને નીચેનાં છ સોપાનોમાં વહેંચી શકાય છે.

- (1) તાલીમાર્થી જૂથનાં દરેક સભ્યને અ, બ, ક, ડ જેવા ટૂંકા અક્ષરોથી ઓળખો અને જૂથના દરેક સભ્યને શિક્ષક, વિદ્યાર્થી અને નિરીક્ષક બનવાની તક મળે તેવી પદ્ધતિ અપનાવો.
- (2) જે કૌશલ્યની તાલીમ આપવાની હોય તે અંગે વિશદ્ ચર્ચા કરો. ત્યારબાદ એક ટૂંકો મુદ્દો પસંદ કરો અને પછી વધારના મુદ્દા નિશ્ચિત કરો કે જેથી દરેક તાલીમાર્થીને પોતાને ફાળે આવતા મુદ્દાઓની યોગ્ય પસંદગી કરવાની તક મળે.
- (3) જૂથમાં વાતચીત કોણ શરૂ કરશે તે નક્કી કરો અને શિક્ષકે ક્યારે બોલવાનું છે. વાતચીત વ્યવહાર કોણ અને ક્યારે અટકાવે તે પણ નક્કી કરો.
- (4) વર્તનતરાહની મૂલ્યાંકન વિધિ માટે નિરીક્ષકોએ કેવી જાતની માહિતી પર નોંધ કરવાની છે તે અને શિક્ષકને તે માહિતી અંગે ઉત્તમ રીતે સૂચનો કેવી રીતે આપી શકાય તે પણ વિચારો.
- (5) પ્રથમ મહાવરા માટે તાસ ગોઠવો. તેના પ્રશિક્ષણાર્થીને તેના કાર્ય બદલ પ્રોત્સાહન આપો અને જરૂર પડે ત્યાં પુનઃશિક્ષણ માટે પ્રવિધિ બદલી પ્રશિક્ષણાર્થીને તૈયાર કરો આમ કહીને પ્રશિક્ષણાર્થીની વર્તન તરાહ સુધારો.
- (6) પ્રવિધિઓ બદલવા તૈયાર રહો. મુદ્દો પણ નવો લેવો કે જેથી દરેક શિક્ષક શિક્ષણ પ્રવિધિ માટે પડકારરૂપ બને અને સાથે તેની અભિરુચિ પણ જળવાઈ રહે.

### 6.6 સેમ્યુલેશનના તબક્કાઓ :

સિમ્યુલેશનમાં સામેલ તાલીમાર્થી માઈક્રો શિક્ષક વિદ્યાર્થીઓ અને અવલોકનકાર તરીકે ફાળો આપવાનો છે.

પ્રથમ તાલીમાર્થીઓને જે કૌશલ્ય હસ્તગત કરવાનું હોય તેની સૈદ્ધાંતિક સમજ આપવામાં આવે છે ત્યાર બાદ માઈક્રોપાઠનું અધ્યાપક દ્વારા નિદર્શન પૂરું પાડવામાં આવે છે. ત્યાર પછી છ થી દસ જેટલા તાલીમાર્થીઓ વર્ગનાં વિદ્યાર્થી બને છે. જેને માઈક્રોવર્ગ કહેવામાં આવે છે. ત્યાર પછી નીચે મુજબના તબક્કાઓ પ્રમાણે સિમ્યુલેશન દ્વારા માઈક્રોપાઠ આપવામાં આવે છે.

તબક્કો	સમય
(1) શિક્ષણકાર્ય	5 થી 8 મિનિટ
(2) પ્રતિપોષણ	10 મિનિટ
(3) પાઠનું પુનઃ આયોજન	10 મિનિટ

(4) પુનઃ શિક્ષણકાર્ય 5 થી 8 મિનિટ

(5) પુનઃ પ્રતિપોષણ 10 મિનિટ

આમ તાલીમાર્થી પાંચ થી આઠ મિનિટનાં સમયગાળાનો માઈકોપાઠ આપે છે. તાલીમાર્થીઓ નિશ્ચિત કૌશલ્યોનો તબક્કાવાર મહાવરો કરે છે. અધ્યાપકો માર્ગદર્શન પૂરું પાડે છે.

### 6.7 સિમ્યુલેશનનાં લાભ :

સિમ્યુલેશનથી નીચેનાં જેવા લાભ થાય છે.

- કોઈપણ પ્રવિધિને વ્યવસ્થિત રીતે ચકાસવામાં સિમ્યુલેશન સહાયભૂત થાય છે.
- શિક્ષક માટે જ્યારે કોઈ પડકાર ભરી સમસ્યા ઊભી થાય ત્યારે સિમ્યુલેશન દ્વારા તેનું પૃથક્કરણ કરીને તેનો નિષ્કર્ષ લાવવામાં આવે છે.
- સમયનું નિયંત્રણ કરી શકાય છે.
- નવા પ્રયોગો કે વિચારોથી ઉદ્ભવતી આકસ્મિક મુશ્કેલીઓ જાણી શકાય છે તેમજ તે નિવારવાના પ્રયત્નો કરી શકાય છે.
- સમયનો બચાવ થાય છે.
- તાલીમાર્થીનો ભય અને સંકોચ દૂર થાય છે.
- વર્ગખંડના શિક્ષણકાર્યની મુશ્કેલીઓ અગાઉથી જાણી શકાય છે પરિણામે તેમને દૂર કરવાના ઉપાયો વિચારી શકાય છે.

### 6.8 સિમ્યુલેશનની મર્યાદાઓ :

સિમ્યુલેશનની મર્યાદાઓ નીચે મુજબ છે.

- સફળતાનો આધાર જૂથના સભ્યોની ગુણવત્તા અને ક્ષમતા પર છે.
- વર્ગખંડની ભાષાનો ઉપયોગ સિમ્યુલેશનને અવાસ્તવિક બનાવે છે.
- કૌશલ્યોના વિકાસની પ્રક્રિયા લાંબી છે. આથી તાલીમાર્થીઓનો વિકાસ ટૂંકાગાળામાં થઈ શકતો નથી. લાંબાગાળે થાય છે.
- કેટલીકવાર તાલીમાર્થીઓ વધુ કૃત્રિમ બની જાય છે.
- તેમાં યાંત્રિકતા પ્રવેશી જવાથી નીરસ અને કંટાળાજનક બને છે.
- પ્રયોગો સાંકળવા મુશ્કેલ બને છે.
- યાંત્રિક સાધનો જેવા કે વીડિયો ટેપ અને ટેપરેકોર્ડરના અભાવમાં મુશ્કેલીઓ પડે છે.

તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી ખાલી જગ્યામાં લખો.

1. સિમ્યુલેશનનો અર્થ જણાવો.

.....

.....

.....

.....

2. સિમ્યુલેશનનું મહત્ત્વ જણાવો.

.....

.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....

3. સિમ્યુલેશન પ્રક્રિયાના છ સોપાનો વર્ણવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....

4. સિમ્યુલેશનનાં તબક્કાઓ જણાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....





### 6.9.1 સેતુપાઠ અર્થ :

સેતુપાઠને મિનિટીચિંગ અથવા તો સંક્ષિપ્ત અધ્યાપન પણ કહેવામાં આવે છે. સેતુપાઠનો ઉદ્ભવ માઈકોટીચિંગના વિશિષ્ટ અધ્યાપન કૌશલ્યની તાલીમ અને વર્ગખંડમાં તેના અસરકારક ઉપયોજન બાદ આવાં અનેક કૌશલ્યોનો છૂટા પાઠમાં એટલે કે ચાલીસ મિનિટની સમયમર્યાદામાં ઉપયોગ કરવા માટે થયો છે.

માઈકોટીચિંગના પાઠમાં પાંચ કે સાત મિનિટના સમયગાળામાં તાલીમાર્થી કોઈ એક જ અધ્યાપન કૌશલ્ય ઉપર સમયના સંદર્ભમાં થોડું વિષયવસ્તુ લઈને કૃત્રિમ વર્ગખંડ પરિસ્થિતિમાં પ્રયત્ન કરવામાં આવે છે. જ્યારે સેતુપાઠના વાસ્તવિક વર્ગખંડમાં તમામ અધ્યાપન કૌશલ્યોનાં સંકલિત ઉપયોજન કરીને વધુ વિષયવસ્તુ શીખવવામાં આવે છે. આ માટે 15 થી 22 મિનિટ જેટલો સમય પણ આપવામાં આવે છે.

માઈકોટીચિંગ દ્વારા શીખેલાં જે અધ્યાપન કૌશલ્યો છે તેનો વાસ્તવિક વર્ગખંડની પરિસ્થિતિમાં, યોગ્ય વાતાવરણમાં ઉપયોગ કરતાં શીખવવાનો પાઠ એટલે સેતુપાઠ.

સેતુપાઠ પણ માઈકોટીચિંગની માફક કૃત્રિમ વર્ગખંડ પરિસ્થિતિમાં પોતાના જ સહાધ્યાયી તાલીમાર્થીઓ સમક્ષ લેવાય છે. જેનો સમય અને વિષયવસ્તુ માઈકોટીચિંગના વિવિધ કૌશલ્ય કરતાં થોડું વધુ અને છૂટા પાઠ કરતાં ઓછું હોય છે.

### 6.9.2 સેતુપાઠ અને માઈકોટીચિંગ વચ્ચેનો તફાવત :

સેતુપાઠ અને માઈકોટીચિંગ વચ્ચેનો તફાવત નીચે મુજબ છે.

- માઈકોટીચિંગમાં શિક્ષણ પછી પુનઃશિક્ષણ કરવામાં આવે છે સેતુ પાઠમાં આ સોપાનનો ત્યાગ કરવામાં આવે છે.
- માઈકોપાઠ માટેનો સમયગાળો 5-7 મિનિટનો હોય છે. જ્યારે સેતુ પાઠ માટેનો સમયગાળો 15-22 મિનિટનો હોય છે.
- સેતુ પાઠમાં વિવિધ કૌશલ્યોના સુનિયોજિત સમાયોજન અને વિનિયોગ પર ભાર મૂકવામાં આવે છે. માઈકોટીચિંગમાં એક જ કૌશલ્યો અને ઘટક પર ધ્યાન આપવામાં આવે છે.
- માઈકોપાઠમાં વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત હોય છે. જ્યારે સેતુપાઠમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારી શકાય છે.
- માઈકોપાઠમાં કોઈ એક જ પ્રયુક્તિ કે પ્રવિધિનો ઉપયોગ થાય છે જ્યારે સેતુપાઠમાં એક કરતાં વધુ પ્રયુક્તિ કે પ્રવિધિનો ઉપયોગ થતો હોય છે.
- માઈકોપાઠ તાલીમાર્થીઓને તાલીમના શરૂઆતના સમયગાળામાં આપવામાં આવે છે, જ્યારે સેતુપાઠ માઈકોપાઠમાં નક્કી કરેલા કૌશલ્યો હસ્તગત કરે ત્યાર પછી જ આપવાના હોય છે. એટલે કે સેતુપાઠની સફળતા માટે માઈકો પાઠમાં પારંગતતા મેળવવી જરૂરી છે.

### 6.9.3 સેતુપાઠનું મહત્ત્વ :

સેતુપાઠનું મહત્ત્વ નીચે મુજબ છે.

- સેતુપાઠ એ માઈકોપાઠ અને મેકોપાઠ વચ્ચેનો સેતુ બને છે.
- માઈકોટીચિંગની કેટલીક મર્યાદાઓ જેવી કે ઓછો સમય, વિદ્યાર્થીની સંખ્યા ઓછી, ઓછું વિષયવસ્તુ વગેરેને દૂર કરી શકાય છે.
- એક સાથે વિવિધ કૌશલ્યનું સમાયોજન કરીને શિક્ષણાર્થી સેતુ પાઠનું આયોજન કરે છે.
- વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરવાની વાસ્તવિક વર્ગ અધ્યાપન કાર્ય કરવાની તાલીમ પર ભાર મૂકવામાં આવે છે.

- તાલીમાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે. વર્ગખંડમાં વાસ્તવિક અધ્યાપનકાર્યનો પ્રત્યક્ષ અનુભવ મેળવી શકે છે.

#### 6.9.4 સેતુપાઠનો નમૂનો :

તાલીમાર્થીનું નામ : ..... રોલ નં. ....		
ધોરણ : 8	વિષય : વિજ્ઞાન	વિષયાંગ : ઝડપ
તારીખ : .....	પાઠ ક્રમાંક : .....	તાસ :
હેતુઓ : વિદ્યાર્થીઓ ...		
<ul style="list-style-type: none"> <li>વિષયાભિમુખ કૌશલ્ય વિકસાવે (<math>S_1</math>)</li> <li>શ્યામફલક કૌશલ્ય વિકસાવે (<math>S_7</math>)</li> <li>પ્રશ્નપ્રવાહિતા કૌશલ્ય વિકસાવે (<math>S_2</math>)</li> <li>સુદૃઢીકરણ કૌશલ્ય વિકસાવે (<math>S_3</math>)</li> <li>ઉદાહરણ કૌશલ્ય કેળવે (<math>S_5</math>)</li> <li>સ્પષ્ટીકરણ કૌશલ્ય કેળવે (<math>S_4</math>)</li> <li>તમામ કૌશલ્યોનું સમાયોજન કરે.</li> </ul>		
શૈ. સોપાન	શિક્ષકની પ્રવૃત્તિ	વિદ્યાર્થીની પ્રવૃત્તિ
વિષયાભિમુખ	શિક્ષક વિદ્યાર્થીઓનું વર્ગ અભિવાદન કરી વિદ્યાર્થીઓને નીચેનાં જેવા પૂર્વજ્ઞાન આધારીત પ્રશ્નો પૂછશે. (1) કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા શું કરવું પડે છે ? (સરસ) (2) બળ એટલે શું ? (ખૂબ સરસ) (3) તમે સવારથી રાત્રિ સુધીમાં કયા-કયા કામ કરવા બળ વાપરો છો ? (Good) (4) વિવિધ પદાર્થો પર થતી બળની અસરો જણાવો. (સરસ) (5) ટેબલને બે વિદ્યાર્થી દ્વારા બંને બાજુથી સરખું બળ લગાડતા ટેબલની સ્થિતિમાં શું ફેરફાર જોવા મળે છે ?	- ધ્યાનથી પ્રશ્નો સાંભળશે - યોગ્ય ઉત્તરો આપશે.
હેતુ કથન	કૌશલ્યોનું સમાયોજન : $S_1, S_2, S_3$ વિદ્યાર્થીમિત્રો તમે 'બળ' વિશે માહિતી ધરાવો છો તો હવે બળના પ્રકારો વિશેની સમજ મેળવીશું એમ કહી શિક્ષક કા.પા. પર વિષયાંગની નોંધ કરશે.	- વિષયાંગની નોંધ નોંધપોથીમાં કરશે.
વિષય નિરૂપણ	શિક્ષક RB ચાર્ટ પર લાવેલ કોષ્ટક-1 અને કોષ્ટક-2ની માહિતી દ્વારા વિવિધ પ્રશ્નોત્તરી કરી ઝડપની સમજ સ્પષ્ટ કરશે. તેમજ સૂત્રની અને એકમની નોંધ કા.પા. પર કરી વિદ્યાર્થીઓને નોંધપોથીમાં નોંધવાનું કહેશે.	- વિદ્યાર્થી જરૂરી વિગતો કા.પા. પરથી નોંધપોથીમાં નોંધશે.

(1) બાઈકને 1000 મી. અંતર કાપવા કેટલો સમય લાગે છે ?	- અવલોકન કરશે.
(2) સરસ, બાઈક માટે અંતર અને સમયનો ગુણોત્તર કેટલો થાય ?	- ધ્યાનથી સાંભળશે.
(3) શાબાશ, કાર 2 મિનિટમાં કેટલું અંતર કાપે છે.	
(4) ખૂબ સરસ, કાર માટે અંતર અને સમયનો ગુણોત્તર કેટલો થાય ?	- ઉત્તરો આપશે.
(5) અભિનંદન મગન માટે અંતર અને સમયનો ગુણોત્તર કેટલો થાય ?	- ગણતરી કરશે.
(6) બરાબર, રમણ 800 મી. અંતર કેટલા સમયમાં કાપે છે ?	
(7) વાહ ! રમણ માટે અંતર અને સમયનો ગુણોત્તર મેળવો.	

### શ્યામફલક નોંધ

વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી

ધોરણ-7

વિષયાંગ : ઝડપ

તારીખ : 4-7-2018

- ઝડપ : એકમ સમયમાં પદાર્થ કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે.

સૂત્ર : ઝડપ  $\frac{\text{કાપેલ અંતર}}{\text{તે માટે લાગતો સમય}}$

એકમ : મીટર/મિનિટ, સે.મી./સેકન્ડ, કિમી/કલાક વગેરે

.....

.....

માર્ગદર્શકની સહી

નિરીક્ષકશ્રીની સહી

### 6.9.5 સેતુપાઠનું નિરીક્ષણ પત્રક :

ક્રમ	કૌશલ્ય અને તેના ઘટકો	વર્તનનો ઉપયોગ				
(1)	વિષયાભિમુખ કૌશલ્ય : <ul style="list-style-type: none"> <li>● યોગ્ય પ્રયુક્તિનો ઉપયોગ</li> <li>● સાતત્યભંગના બનાવો</li> <li>● કૃત્રિમ પ્રસ્તાવના</li> <li>● પૂર્વજ્ઞાનનો યોગ્ય ઉપયોગ</li> </ul>					
(2)	પ્રશ્નપ્રવાહિતા કૌશલ્ય : <p>(I) પ્રશ્નનું બંધારણ</p> <ul style="list-style-type: none"> <li>● વ્યાકરણ શુદ્ધ</li> <li>● સંક્ષિપ્તતા</li> <li>● વિષય સંબંધિત</li> </ul>					

	<p><b>(II) પ્રશ્ન પૂછવાની રીત</b></p> <ul style="list-style-type: none"> <li>● સમગ્ર વર્ગ સમક્ષ રજૂઆત</li> <li>● પ્રશ્નનું પુનરાવર્તન</li> <li>● ખૂબ જ ઝડપથી પ્રશ્નો પૂછાયા</li> <li>● ખૂબ જ ધીમેથી પ્રશ્નો પૂછાયા</li> <li>● યોગ્ય ઝડપથી પ્રશ્નો પૂછાયા</li> <li>● યોગ્ય અવાજે પ્રશ્નો પૂછાયા</li> <li>● પ્રશ્નોમાં યોગ્ય શબ્દ પર ભાર</li> <li>● હાવભાવ સાથેની પ્રશ્નોત્તરી</li> </ul> <p><b>(III) પ્રશ્નના પ્રકાર</b></p> <ul style="list-style-type: none"> <li>● ‘હા’ કે ‘ના’ વાળા પ્રશ્નો</li> <li>● પડઘા પ્રશ્નો</li> <li>● સૂચનશીલ પ્રશ્નો</li> <li>● અટકળ પોષક પ્રશ્નો</li> <li>● સમર્થન પ્રશ્નો</li> <li>● જવાબ ન મળ્યા હોય તેવા પ્રશ્નો</li> </ul> <p><b>(3) કા.પા. કાર્ય કૌશલ્ય :</b></p> <ul style="list-style-type: none"> <li>● કા.પા. કાર્યની સ્વચ્છતા</li> <li>● કા.પા. કાર્યની યથાર્થતા</li> <li>● આત્મવિશ્વાસ પૂર્ણ કા.પા. નોંધ</li> <li>● જોડણી કે વ્યાકરણ ભૂલો વિનાનું કા.પા.</li> </ul> <p><b>(4) સ્પષ્ટીકરણ કૌશલ્ય :</b></p> <p><b>(I) ઈચ્છનીય વર્તનો</b></p> <ul style="list-style-type: none"> <li>● પ્રસ્તાવનારૂપ વિધાન</li> <li>● સમજ આપતી કડીઓ</li> <li>● ઉપસંહારાત્મક વિધાન</li> <li>● વિદ્યાર્થીની સમજ ચકાસતા પ્રશ્નો</li> </ul> <p><b>(II) અનિચ્છનીય વર્તનો</b></p> <ul style="list-style-type: none"> <li>● અસંબંધિત વિધાનો</li> <li>● વિધાનોમાં અસાતત્યતા</li> <li>● અયોગ્ય શબ્દનો ઉપયોગ</li> <li>● ભાષાની પ્રવાહિતાનો અભાવ</li> <li>● બિનજરૂરી શબ્દો / વિધાનોનો ઉપયોગ</li> </ul> <p><b>(5) ઉદાહરણ કૌશલ્ય :</b></p> <ul style="list-style-type: none"> <li>● સરળ</li> </ul>				
--	---	--	--	--	--



.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....

4. કોઈ એક વિજ્ઞાનનો મુદ્દો પસંદ કરી તેનું સેતુપાઠનું આયોજન તૈયાર કરો.

.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....

---

#### 6.10 સારાંશ :

આ એકમમાં આપણે સિમ્યુલેશન દ્વારા અધ્યાપન કૌશલ્યો કેમ કેળવવા તે વિશે સમજ્યા. અગાઉના એકમમાં શીબેલ માઈક્રો કૌશલ્યોનું સંયોજન કરી સેતુ પાઠ આયોજન શીખ્યા. સેતુ પાઠ આયોજન દ્વારા વાસ્તવિક વર્ગખંડમાં જતા પહેલા જ વાસ્તવિક વર્ગખંડ જેવો કૃત્રિમ વર્ગખંડ તૈયાર કરી વાસ્તવિક અનુભવ જેવો જ અનુભવ લેવાનો પ્રયત્ન કર્યો. આ સમગ્ર એકમમાં સેતુ પાઠનું આયોજન કેમ તૈયાર કરવું તેમજ તેનું નિરીક્ષણ કેમ કરવું તે શીખ્યા. હવે, પછીનાં એકમમાં ઉદ્દેશો અને હેતુઓ વિશેનું અધ્યયન કરીશું.

: રૂપરેખા :

- 7.1 પ્રસ્તાવના
  - 7.2 ઉદ્દેશો
  - 7.3 ઉદ્દેશો અને હેતુઓનો અર્થ
  - 7.4 બેન્ઝામિન બ્લૂમનું વર્ગીકરણ
  - 7.5 હેતુઓના પ્રકાર
    - 7.5.1 સામાન્ય હેતુઓ
    - 7.5.2 વિશિષ્ટ હેતુઓ
  - 7.6 હેતુ કથનની સંરચનામાં ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો
  - 7.7 વિજ્ઞાન શિક્ષણનાં સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ
    - 7.7.1 જ્ઞાનના સામાન્ય હેતુઓ અને તેનાં વિશિષ્ટ હેતુઓ
    - 7.7.2 સમજનાં સામાન્ય હેતુઓ અને તેનાં વિશિષ્ટ હેતુઓ
    - 7.7.3 ઉપયોજનનાં સામાન્ય હેતુઓ અને તેનાં વિશિષ્ટ હેતુઓ
    - 7.7.4 કૌશલ્યનાં સામાન્ય હેતુઓ અને તેના વિશિષ્ટ હેતુઓ
  - 7.8 સારાંશ
-

## 7.1 પ્રસ્તાવના :

વિજ્ઞાન કાર્યક્રમનું સાચું મૂલ્યાંકન વ્યક્તિગત વિદ્યાર્થીઓ પરની અસર દ્વારા થઈ શકે. શિક્ષણમાં વિજ્ઞાન તેનું સ્થાન ત્યારે જ સાર્થક પુરવાર કરી શકે કે જ્યારે વિજ્ઞાન દ્વારા યુવાન વ્યક્તિમાં અગત્યના ફેરફાર થાય, તેની વિચારશીલતાને નવું પરિમાણ મળે, કાર્ય-આદતો-વર્તનો બદલાય અને પોતાની પાસે શું છે અને પોતે શું કરે છે તેનાં મૂલ્યોનો નક્કર વિચાર જન્મે. વિજ્ઞાન શિક્ષણનાં આ સ્થાનને મજબૂત બનાવવા નિશ્ચિત હેતુઓનું નિર્માણ પ્રથમ પગથિયું ગણાય. અભ્યાસક્રમનાં નિર્માણને હેતુઓની ગાઢ અસર રહે છે. તો હેતુઓના આધારે જ અધ્યાપન પદ્ધતિ કઈ પસંદ કરવી તે નક્કી થાય છે.

અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયામાં ગુરુ કે શિક્ષકનું સ્થાન વિષયવસ્તુએ લીધું. ત્યારબાદ અધ્યેતાનું કેન્દ્રસ્થાન ગણાતું, જે હવે તો અપેક્ષિત હેતુઓએ લીધું છે. એમ કહેવાય છે કે કેટલાક મનોવિજ્ઞાનીઓએ “શિક્ષણ શા માટે?” એવો જે પ્રશ્ન ઉઠાવેલો, તેના ફલસ્વરૂપે હેતુઓ જન્મ્યા. આ હેતુઓને ત્યારબાદ અધ્યેતાના વર્તનમાં થતાં પરિવર્તનનાં સંદર્ભમાં મૂલવવામાં આવ્યા.

વિજ્ઞાનનું શિક્ષણકાર્ય કરવામાં આવે ત્યારે વિજ્ઞાનના તે એકમ દ્વારા વિદ્યાર્થીઓની કઈ જરૂરિયાતો તરફ ધ્યાન આપવાનું છે. કઈ દિશામાં લઈ જવા છે, તેનો હેતુઓ કયા છે તે પ્રથમ નક્કી કરી લેવું જોઈએ. હેતુઓ નિર્ધારિત કર્યા પછી તે સિદ્ધ કરવા માટેની જરૂરી સામગ્રી નક્કી થઈ શકે. પરિણામે વિજ્ઞાન શિક્ષણના હેતુઓ કેટલે અંશે સિદ્ધ થઈ શક્યા તેનું પરીક્ષણ અને મૂલ્યાંકન થઈ શકે.

ઉદ્દેશ-હેતુઓ શિક્ષણનું આરંભબિંદુ છે. તે શિક્ષણની પ્રક્રિયા નથી પરંતુ ઈચ્છનીય પરિણામ છે. શિક્ષણ લીધા પછી વિદ્યાર્થી જે કાંઈ કરે છે તે છે. હેતુ-નિર્ધારણ બાદ શિક્ષક તેને સંબંધિત વર્તન નક્કી કરે છે. હેતુ નિર્ધારણ એ સરળ પ્રક્રિયા નથી. હેતુ-નિર્ધારણ માટે હેતુઓની આધારશિલા મદદરૂપ થાય છે. શિક્ષણની કક્ષા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાના સંદર્ભમાં હેતુઓનું નિર્ધારણ કરવાનું રહેશે.

## 7.2 ઉદ્દેશો :

પ્રસ્તુત એકમનો અભ્યાસ કર્યા બાદ તમે

- ઉદ્દેશો અને હેતુઓના અર્થ જાણી શકશો.
- બેન્ઝામિન બ્લૂમનાં હેતુઓના વર્ગીકરણથી પરિચિત થશો.
- હેતુઓનાં પ્રકારો વિશે જાણી શકશો.
- હેતુઓની સંરચના કરી શકશો.
- વિજ્ઞાન શિક્ષણનાં સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓની સમજ મેળવી શકશો.

## 7.3 ઉદ્દેશો અને હેતુઓનો અંશ :

જે સીમિત ન હોય, કોઈ એક વિષયાંગ કે પાઠ્યપુસ્તક સંદર્ભે ન હોય, તાત્કાલિક સિદ્ધ ન થઈ શકે અને માનવીનાં સમગ્ર જીવનમાં જે પ્રતિબિંબિત થાય તેને ધ્યેય કે ઉદ્દેશો કહે છે. ઉદ્દેશમાં જે શિક્ષણ પ્રક્રિયા થાય તેનાં અંતે વિદ્યાર્થીઓ પાસેથી શું અપેક્ષિત છે તે હેતુઓ દ્વારા દર્શાવાય છે. કે જે વિદ્યાર્થીની અપેક્ષિત વર્તન-પરિવર્તનની આગાહી છે શૈક્ષણિક ફલશ્રુતિ છે, પ્રવૃત્તિને અંતે મળનારાં પરિણામની પરિકલ્પના છે, શિક્ષકના કાર્યની આરસી છે.

ઉદ્દેશો દિશાસૂચક અને હેતુઓ પથસૂચક વિધાનો છે, તેથી વિદ્યાર્થીઓને કઈ દિશા તરફ આગળ દોરવા છે તે આપણે હેતુઓને આધારે નક્કી કરીએ છીએ આથી જો શિક્ષક હેતુઓને જ લક્ષમાં રાખી શિક્ષણકાર્ય કરે તો તે વિદ્યાર્થીઓને ધારેલા માર્ગે આગળ દોરી શકે.

ઉદ્દેશો અને હેતુઓ વચ્ચેનો ભેદ :

- (1) ઉદ્દેશો શિક્ષણનાં દિશાસૂચક છે. તેના વિના શિક્ષણ ઈચ્છિત દિશામાં પ્રગતિ કરી શકે નહિ જ્યારે હેતુઓ જે તે દિશામાં કેટલી પ્રગતિ કે સિદ્ધિ શક્ય બનશે તે દર્શાવે છે.



- (2) ઉદ્દેશો સિદ્ધ કરી શકાય નહિ. હેતુઓ સિદ્ધ થઈ શકે છે. શાળેય કાર્યક્રમોથી ધ્યેયોને પહોંચી શકાય નહીં. ધ્યેયની સિદ્ધિ ઘણો લાંબો સમય માગી લે છે, કદાચ તે માટે મનુષ્યનું જીવન પણ વીતી જાય.
- (3) વિષય-વિષયે ધ્યેયો જુદા હોતા નથી જ્યારે જુદા-જુદા વિષયોનાં શિક્ષણનાં હેતુઓમાં ફેરફારો હોઈ શકે છે. ધ્યેયો શાળાની તેમજ શાળા બહારની શૈક્ષણિક પ્રણાલીને માર્ગદર્શન આપે છે.
- (4) હેતુઓનું ઉદ્દગમસ્થાન ધ્યેયો છે. હેતુસિદ્ધિની સફળતા આપવાને શૈક્ષણિક ઉદ્દેશોની સિદ્ધિ તરફ એક સોપાન આગળ ધપાવે છે. જેમ-જેમ હેતુઓ ક્રમશઃ સિદ્ધ થતા જાય તેમ-તેમ કેળવણીનાં ઉદ્દેશો તરફ આપણે આગળ વધીએ છીએ.
- (5) ઉદ્દેશો વ્યાપક અને વિશાળ હોવાથી વિષયવસ્તુની પસંદગી માટે ઉચિત રીતે મદદરૂપ થતા નથી, જ્યારે હેતુઓ આ માટે મદદરૂપ થઈ શકે છે.
- (6) ઉદ્દેશો વિશાળ હોવાથી વર્ગશિક્ષકનાં દૈનિક કાર્ય માટે અર્થાત્ રોજબરોજની પ્રવૃત્તિઓ માટે અર્થહીન બની જાય છે. જ્યારે હેતુઓ વિશિષ્ટ અને ચોક્કસ હોવાથી શિક્ષકની દૈનિક પ્રવૃત્તિઓ માટે મદદરૂપ નીવડે છે. શાળેય કાર્યક્રમો નક્કી કરતી વખતે શિક્ષક હેતુઓને ધ્યાનમાં રાખે છે.

#### 7.4 બેન્ઝામિન બ્લૂમનું વર્ગીકરણ :

બેન્ઝામિન બ્લૂમ અને તેની શૈક્ષણિક ટુકડીએ વિવિધ શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ કર્યું. તેઓએ બધા શૈક્ષણિક હેતુઓને ત્રણ આધારરૂપ વિભાગોમાં વહેંચ્યા છે. જે નીચે મુજબ છે.

- (1) જ્ઞાનાત્મક ક્ષેત્ર (Cognitive Domain)
- (2) ભાવાત્મક ક્ષેત્ર (Affective Domain)
- (3) મનોશારીરિક ક્ષેત્ર / ક્રિયાત્મક ક્ષેત્ર (Psychomotor Domain)

##### (1) જ્ઞાનાત્મક ક્ષેત્ર (Cognitive Domain) :

આ ક્ષેત્રમાં સમાવિષ્ટ શૈક્ષણિક હેતુઓ દ્વારા અભ્યાસક્રમ વિકાસ અને મૂલ્યાંકન કસોટી સંરચના અંગેનું ઘણું કાર્ય થયું છે. આ ક્ષેત્ર હેઠળના હેતુઓ જ્ઞાનની પુનઃસ્મૃતિ અને ઓળખ સાથે સંબંધ ધરાવે છે. તેમજ બૌદ્ધિક શક્તિઓ અને બૌદ્ધિક કૌશલ્યોના વિકાસ સાથે પણ સંબંધ ધરાવે છે. આ ક્ષેત્રના હેતુઓ બહુ સ્પષ્ટતાપૂર્વક વર્ણવી શકાતા હોઈને પ્રવર્તમાન શિક્ષણ-પ્રશિક્ષણને હેતુઓ સવિશેષ આ ક્ષેત્રમાં જ વિચારાયા છે. જ્ઞાન, સમજ, ઉપયોજન, પૃથક્કરણ, સંયોગીકરણ અને મૂલ્યાંકનનો જ્ઞાનાત્મક ક્ષેત્રમાં સમાવેશ થાય છે.

##### (2) ભાવાત્મક ક્ષેત્ર (Affective Domain) :

આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓના વલણો, મૂલ્યો, અભિરુચિ અને રસદષ્ટિના વિકાસના પરિવર્તનને લગતા હેતુઓ આવે છે. આ હેતુઓ વિદ્યાર્થીના આંતરિક વર્તનને સ્પર્શે છે, તેથી સરળતાથી જાણી કે અવલોકી શકાતા નથી, તેથી જ્ઞાનાત્મક ક્ષેત્રનાં હેતુઓ જેટલા સ્પષ્ટ અને પરીક્ષણ યોગ્ય બનતા નથી. ધ્યાનમાં લેવું, પ્રતિચાર આપવો, મૂલ્ય ધારણ કરવું, મૂલ્યને વ્યવસ્થિત કરવા, અમુક મૂલ્ય દ્વારા ચારિત્ર્ય ગઠન કરવું તે ભાવાત્મક ક્ષેત્રમાં સમાવિષ્ટ છે.

##### (3) મનોશારીરિક ક્ષેત્ર / ક્રિયાત્મક ક્ષેત્ર (Psychomotor Domain) :

આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની ક્રિયાશીલતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. વિજ્ઞાનનાં પ્રયોગો કરવામાં, ચિત્રકળામાં, સંગીત અને નૃત્ય જેવા કલાવિષયક શૈક્ષણિક કાર્યમાં વિદ્યાર્થીઓની માનસિક અને શારીરિક ક્રિયાઓનો સમાવેશ થાય છે. માધ્યમિક તેમજ ઉચ્ચ કક્ષાએ આ ક્ષેત્રના હેતુઓ વિશે ઘણું ઓછું ધ્યાન અપાયું છે તેથી આ ક્ષેત્રના હેતુઓ ખાસ સ્પષ્ટ થયા નથી. અનુકરણ કરવું, ક્રિયા આપડવી, ચોકસાઈ, ક્રિયાનિપુણતા વગેરેનો મનોશારીરિક ક્ષેત્રમાં સમાવેશ થાય છે.

જે તે ક્ષેત્રનાં હેતુઓનું વર્ગીકરણ તૈયાર કરવામાં આ ક્ષેત્ર હેઠળના વિશિષ્ટ હેતુઓ નિશ્ચિત

કરવામાં આ ક્ષેત્ર હેઠળના વિશિષ્ટ હેતુઓ નિશ્ચિત કરવામાં આવે છે. એટલે કે શિક્ષણ હેતુને અનુરૂપ શિક્ષણ-પરિક્ષણ યોજવા માટે વિદ્યાર્થીનાં વર્તન અને તેના અપેક્ષિત પરિવર્તનની નોંધ તૈયાર કરવામાં આવે છે, જેને આધારે શિક્ષક તેનું શિક્ષણ પરિક્ષણ ગોઠવી અસરકારક શિક્ષણકાર્ય કરી શકે છે.

બેન્ઝામિન બ્લૂમે આપેલું હેતુઓનું વર્ગીકરણ નીચે મુજબ દર્શાવી શકાય.

### શૈક્ષણિક હેતુઓ

જ્ઞાનાત્મક ક્ષેત્ર	ભાવનાત્મક ક્ષેત્ર	મનોશારીરિક ક્ષેત્ર
● જ્ઞાન	● ગ્રહણ	● પ્રારંભીકરણ
● આકલન	● અનુક્રિયા	● કાર્ય કરવું
● ઉપયોજન	● મૂલ્ય સ્થાપન	● સૂક્ષ્મ નિશ્ચિતતા
● વિશ્લેષણ	● સંગઠન	● સ્પષ્ટ ઉચ્ચારણ
● સંશ્લેષણ	● મૂલ્ય સમૂહનું	● સ્વાભાવિકીકરણ
● મૂલ્યાંકન	વિશિષ્ટીકરણ	

#### 7.5 હેતુઓના પ્રકાર :

હેતુઓને બે પ્રકારમાં વિભાગવામાં આવે છે (1) સામાન્ય હેતુઓ (2) વિશિષ્ટ હેતુઓ આ હેતુઓની વિગતે સમજ મેળવીએ.

##### 7.5.1 સામાન્ય હેતુઓ :

તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી ખાલી જગ્યામાં લખો.

#### 1. ઉદ્દેશો અને હેતુઓનો અર્થ જણાવો.

.....

.....

.....

.....

.....

.....

.....

#### 2. ઉદ્દેશો અને હેતુઓ વચ્ચેનાં મુખ્ય ત્રણ તફાવત જણાવો.

.....

.....

.....

.....

.....

.....

.....

3. બેન્ઝામિન બ્લૂમે શૈક્ષણિક હેતુઓને કયા વિભાગોમાં વહેંચ્યા છે ?

.....  
.....  
.....

4. ભાવાત્મક ક્ષેત્ર એટલે શું ?

.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....

શિક્ષણના સામાન્ય હેતુઓ વધારે વ્યાપક હોય છે તે ઉદ્દેશ્ય કે ધ્યેય સુધી પહોંચવા માટે સિદ્ધ કરવા પડે છે. તે વિદ્યાર્થીનાં સર્વાંગી વિકાસ માટે હોય છે. તે ટૂંકાગાળાના નથી હોતા તે એક તાસ કે અમુક તાસ માટે નથી. પરંતુ વર્ષ કે અમુક વર્ષો માટેના હોય છે. આમ, અમુક વર્ષોમાં અંતે સિદ્ધ થાય છે અને તે ઉદ્દેશ્ય કે ધ્યેય પ્રાપ્તિ સુધી લઈ જાય છે. શિક્ષણના સામાન્ય હેતુ જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય, વલણ, રસ, કદર, અર્થગ્રહણ, અભિવ્યક્તિ રસાસ્વાદ વગેરે છે.

શિક્ષણના સામાન્ય હેતુઓ બધા જ વિષયોને લાગુ પડે છે સામાન્ય હેતુ દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક પાસુ વિકસે છે, તે ધ્યાનમાં રાખીને પાઠ્યક્રમ ઘડાય છે.

વર્ગશિક્ષણના વિશિષ્ટ હેતુઓની રચના કરતાં પહેલાં સામાન્ય હેતુઓને ધ્યાનમાં રાખવામાં આવે છે.

ઉદાહરણો :

જ્ઞાનનો સામાન્ય હેતુ :

- વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયક જ્ઞાન પ્રાપ્ત કરે.

સમજનો સામાન્ય હેતુ :

- વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયક સમજ પ્રાપ્ત કરે.

ઉપયોજનનો સામાન્ય હેતુ :

- વિદ્યાર્થીઓ વિજ્ઞાનના જ્ઞાનનો અન્ય પરિસ્થિતિમાં ઉપયોગ કરે.

કૌશલ્યનો સામાન્ય હેતુ :

- વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયક કેટલાક કૌશલ્ય પ્રાપ્ત કરે.

રસનો સામાન્ય હેતુ :

- વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયક બાબતોમાં રસ કેળવે.

વલણનો સામાન્ય હેતુ :

- વિદ્યાર્થીઓનું વિજ્ઞાન પ્રત્યે ધન વલણ કેળવાય.

### કદરનો સામાન્ય હેતુ :

- વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિકોની કદર કરતાં થાય.

### વિજ્ઞાન શિક્ષણના સામાન્ય હેતુઓનાં લક્ષણો :

- સામાન્ય હેતુઓ સ્પષ્ટ અને સંપૂર્ણ અર્થવાળા હોવા જોઈએ.
- દરેક સામાન્ય હેતુ બીજાથી સ્પષ્ટ જુદો તરી આવવો જોઈએ.
- સામાન્ય હેતુઓ અધ્યેતાકેન્દ્રી હોવા જોઈએ.
- હેતુઓ વિદ્યાર્થીઓની વયકક્ષા, વિકાસ કક્ષા અને જ્ઞાનકક્ષાને અનુરૂપ હોવા જોઈએ.
- અધ્યેતામાં કયા પ્રકારનાં પરિવર્તનોની અપેક્ષા રાખવામાં આવે છે. તેનો સ્પષ્ટ નિર્દેશ હેતુમાં થયેલો હોવો જોઈએ.
- સામાન્ય હેતુઓ સ્પષ્ટ અને અસંદિગ્ધ હોવા જોઈએ.
- વિજ્ઞાન શિક્ષણની અપેક્ષાઓ સાથે સુસંગત હોવા જોઈએ.
- વિષય શિક્ષણનાં અભ્યાસક્રમના વિશિષ્ટ પાસાને અનુરૂપ હોવા જોઈએ.
- અધ્યયનપ્રદ અનુભવોને માર્ગદર્શનરૂપ હોવા જોઈએ.
- હેતુઓ અધ્યાપન પદ્ધતિ કે પ્રવૃત્તિની પસંદગીનો ખ્યાલ આપી શકે તેવા હોવા જોઈએ.
- હેતુઓ સમાજની અપેક્ષા / આવશ્યકતાઓને અનુરૂપ હોવા જોઈએ.
- મૂલ્યાંકન પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં મદદરૂપ થાય તેવા હોવા જોઈએ.
- લાંબા ગાળાના હોય છે.
- વર્ષના અંતે સિદ્ધ થાય તેવા હોય છે.
- સામાન્ય હેતુઓની પ્રક્રિયા ધ્યેય / ઉદ્દેશ્ય તરફ લઈ જાય છે.

### 7.5.2 વિશિષ્ટ હેતુઓ :

શિક્ષણના સામાન્ય હેતુઓને સિમિત સ્વરૂપ આપવા માટે વિશિષ્ટ હેતુઓ રચવામાં આવે છે. વિશિષ્ટ હેતુઓને વર્ગશિક્ષણના હેતુઓ / તાસ શિક્ષણના હેતુઓ / સ્પષ્ટીકરણો / શૈક્ષણિક હેતુઓના નામે ઓળખવામાં આવે છે. તે ઓછા વ્યાપક છે અને વર્ગ પૂર્ણ થતા તેની સિદ્ધિનું મૂલ્યાંકન કરવામાં આવે છે. વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ સામાન્ય હેતુની સિદ્ધિ તરફ લઈ જાય છે. એક જ તાસમાં દરેક સામાન્ય હેતુના ઘણા બધા વિશિષ્ટ હેતુઓ હોઈ શકે.

વિશિષ્ટ હેતુઓને સિદ્ધ કરવા માટે કયા શૈક્ષણિક માધ્યમોની મદદ લઈ શકાય અને શૈક્ષણિક પદ્ધતિ-પ્રયુક્તિ, અભિગમોનો ઉપયોગ કરવો તે પણ નક્કી થઈ શકે છે. વિશિષ્ટ હેતુઓ દ્વારા શિક્ષક વિદ્યાર્થીઓમાં એક તાસ દરમિયાન કયા અપેક્ષિત ફેરફારો કે વર્તન-પરિવર્તનો લાવવા માગે છે તે નક્કી કરી શકાય છે.

### ઉદાહરણો :

#### ● જ્ઞાનનાં વિશિષ્ટ હેતુઓ :

વિદ્યાર્થીઓ વિજ્ઞાનના જુદા-જુદા તથ્યો, ઘટનાઓ, હકીકતો, ખ્યાલો, સિદ્ધાંતો, સંકલ્પનાઓ, પૂર્વધારણાઓ વગેરેનું જ્ઞાન મેળવે.

#### ● સમજનાં વિશિષ્ટ હેતુઓ :

વિદ્યાર્થીઓ હકીકતો, સાધનો, શબ્દો, પ્રક્રિયા તથા સિદ્ધાંતોનો પારસ્પરિક, આંતરસંબંધ સમજે.

વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક સિદ્ધાંતો, હકીકતો, ઘટનાઓ, નમૂનાઓ વગેરેના જાણીતા તેમજ નવીન ઉદાહરણો આપી શકે.

● ઉપયોજનનાં વિશિષ્ટ હેતુઓ :

વિદ્યાર્થીઓ પ્રયોગશાળામાં કરવામાં આવતી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓના કારણો શોધી શકે.  
વિદ્યાર્થીઓ સિદ્ધાંત કે નિયમ પરથી દાખલા ગણી શકે.

● કૌશલ્યનાં વિશિષ્ટ હેતુઓ :

વિદ્યાર્થીઓ આપેલી આકૃતિઓનાં વિવિધ ભાગોનું નામ નિર્દેશન કરી શકે.  
વિદ્યાર્થીઓ આપેલ આકૃતિ પરથી પ્રયોગના સાધનો ગોઠવી શકે.

● રસનાં વિશિષ્ટ હેતુઓ :

વિદ્યાર્થીઓ વિજ્ઞાન-વિષયક સાહિત્ય અને લખાણો રસપૂર્વક વાંચે.

● કદરનાં વિશિષ્ટ હેતુઓ :

વિદ્યાર્થીઓ જુદા-જુદા વૈજ્ઞાનિકોની કદર કરે.

**વિજ્ઞાન શિક્ષણના વિશિષ્ટ હેતુઓનાં લક્ષણો :**

વિજ્ઞાન શિક્ષણનાં વિશિષ્ટ હેતુઓનાં લક્ષણો નીચે મુજબ છે.

- વિશિષ્ટ હેતુઓ વાસ્તવિક હોવા જોઈએ.
- નિશ્ચિત સમય મર્યાદામાં સિદ્ધ થઈ શકે તેવા હોવા જોઈએ.
- હેતુઓ અપેક્ષિત - વર્તન - પરિવર્તનોની પરિભાષામાં લખાયેલા હોવા જોઈએ.
- વિજ્ઞાન શિક્ષણના શૈક્ષણિક મુદ્દાઓ સાથે સુસંગત હોવા જોઈએ.
- વિશિષ્ટ હેતુઓ શૈક્ષણિક પદ્ધતિઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને પસંદ કરવામાં માર્ગદર્શકરૂપ હોવા જોઈએ.
- વિશિષ્ટ હેતુઓ શૈક્ષણિક સાધનની પસંદગી અને તેના ઉપયોગની રીત નક્કી કરવામાં ઉપયોગી બની શકે તેવા હોવા જોઈએ.
- શૈક્ષણિક હેતુઓ અધ્યેતાઓની પરિપક્વતા અને તેમની વિકાસકક્ષાને અનુરૂપ હોવા જોઈએ.
- હેતુઓ ટૂંકા, સ્પષ્ટ અને અસંદિગ્ધ હોવા જોઈએ.
- વિશિષ્ટ હેતુઓ અધ્યાપન કાર્યને માર્ગદર્શક હોવા જોઈએ.
- વિશિષ્ટ હેતુઓ મૂલ્યાંકન કાર્યની પ્રયુક્તિની પસંદગી અને તેનાં ઉપયોગની રીત નક્કી કરી આપે તેવા હોવા જોઈએ.
- વિશિષ્ટ હેતુઓની સિદ્ધિને પરિણામે વર્ગશિક્ષણના સામાન્ય હેતુઓ સિદ્ધ થવા જોઈએ.
- વર્ગશિક્ષણનાં અંતે સિદ્ધ થાય છે.
- વિશિષ્ટ હેતુઓની પ્રાપ્તિ સામાન્ય હેતુની પ્રાપ્તિની દિશામાં લઈ જાય છે.
- વિશિષ્ટ હેતુઓની સંખ્યા કોઈ પણ પાઠમાં સામાન્ય હેતુઓની સરખામણીમાં વિશેષ હોવી જોઈએ.
- નિશ્ચિત કરેલા એક વિશિષ્ટ હેતુમાં એક કરતાં વધારે વિશિષ્ટ હેતુઓ સમાયેલા ન હોવા જોઈએ.
- દરેક વિશિષ્ટ હેતુનો અર્થ એવો સ્પષ્ટ હોવો જોઈએ કે જેથી તેનો બીજો અર્થ થઈ ન શકે.

**7.6 હેતુ કથનની સંરચનામાં ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો :**

હેતુકથનની રજૂઆત શાસ્ત્રીય રીતે હોવી જરૂરી છે. પાઠ-આયોજનમાં કે વિષયવસ્તુના સંદર્ભમાં કોઈ એકમ વિશે શિક્ષક અધ્યયનસામગ્રી તૈયાર કરે ત્યારે હેતુકથન કરે છે. હેતુકથનની રચના યોગ્ય

રીતે થાય તો જ હેતુ દ્વારા સ્પષ્ટપણે અભ્યાસક અભ્યાસને અંતે શું મેળવશે તે બાબતે સ્પષ્ટ બને છે. હેતુકથનની સંરચના દરમિયાન નીચેના જેવી કેટલીક કાળજીઓ લેવી જરૂરી છે.

(1) હેતુઓ શિક્ષકનાં કાર્યને બદલે વિદ્યાર્થીનાં વર્તન પરિવર્તન સ્પષ્ટ કરતી ભાષામાં લખાવા જોઈએ.

દા.ત. ● વિજ્ઞાનની મુખ્ય સંકલ્પનાઓના અર્થ સમજવા વિદ્યાર્થીઓને શક્તિમાન બનાવવા ( )

● વિદ્યાર્થીઓ વિજ્ઞાનની મુખ્ય સંકલ્પનાઓ સમજે (3)

પ્રથમ હેતુકથન શિક્ષકના વર્તનનું વર્ણન કરે છે, જ્યારે બીજું હેતુકથન વિદ્યાર્થીના વર્તન પર ભાર મૂકે છે.

(2) હેતુમાં અધ્યયન અનુભવ (પ્રક્રિયા)ને બદલે અધ્યયન નિષ્પત્તિ (પરિણામ) દર્શાવવી જોઈએ.

દા.ત. ● વિદ્યાર્થીઓ દાક્તરી થર્મોમીટરનો અભ્યાસ કરે. ( )

● વિદ્યાર્થીઓ દાક્તરી થર્મોમીટરનો ઉપયોગ કરતાં શીખે. (3)

પ્રથમ હેતુકથન અધ્યયન પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. જ્યારે બીજામાં અધ્યયન પ્રક્રિયાની નિષ્પત્તિ દર્શાવેલ છે.

(3) હેતુ દ્વારા વિષયવસ્તુ તેમજ વિદ્યાર્થીનું અંતિમ વર્તન-પરિવર્તનો સ્પષ્ટપણે દર્શાવવાં જોઈએ.

દા.ત. ● વિદ્યાર્થીઓમાં અવલોકન શક્તિ ખીલે. ( )

● વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક અવલોકન અંગેની અવલોકન શક્તિ ખીલે. (3)

પ્રથમ હેતુકથન અંતિમ વર્તન દર્શાવે છે પરંતુ વિષયવસ્તુ નહીં, જ્યારે બીજા હેતુ કથનમાં વિષયવસ્તુ અને અંતિમ વર્તન-પરિવર્તન બંને દર્શાવેલ છે.

(4) હેતુઓ સંયુક્ત રીતે લખાવા ન જોઈએ પણ ભિન્ન પ્રકારનાં વર્તનોની ભેળસેળ ન થાય તેમ એક જ હેતુને પ્રતિબિંબિત કરે તે રીતે લખાવા જોઈએ.

દા.ત. ● વિદ્યાર્થીઓ ચુંબકનાં પ્રકારો સમજે અને તેનો ઉપયોગ જાણે. ( )

● વિદ્યાર્થીઓ ચુંબકનાં પ્રકારો સમજે (3)

● વિદ્યાર્થીઓ સોયાકાર ચુંબકનો ઉપયોગ જાણે. (3)

પ્રથમ હેતુકથન સંયુક્ત સ્વરૂપનું છે. સમજ અને ઉપયોજનનાં વર્તનો સંયુક્ત રીતે એક જ હેતુકથન દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. જ્યારે બીજા બે હેતુકથનમાં સ્વતંત્ર રીતે હેતુઓને દર્શાવાયા છે.

(5) હેતુકથનમાં શિક્ષણના તબક્કા ધ્યાનમાં લેવાવા જોઈએ.

માપનક્ષમ્ય ન હોય, હેતુ જ અપ્રસ્તુત હોય, વિદ્યાર્થીઓ દ્વારા તે કક્ષા સુધી પહોંચવું જ અશક્ય હોય, શિક્ષણની અપ્રાપ્ય સાધનોને કારણે તે પરિવર્તન લાવી ન શકાય... વગેરે બાબતોની કાળજી લેવી જોઈએ.

દા.ત. ● વિદ્યાર્થી વિજ્ઞાનમાં રસ વિકસાવે. ( )

● વિદ્યાર્થીઓનો વિજ્ઞાનના શોધક-શોધમાં રસ વિકસે. (3)

પ્રથમ હેતુ કથન ચકાસવું મુશ્કેલ છે. જ્યારે બીજા હેતુકથનમાં તે જ વિગતો સ્પષ્ટ નિર્દેશ મળે છે.

તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : (અ) તમારા ઉત્તરો નીચે આપેલી ખાલી જગ્યામાં લખો.

(બ)

1. વિજ્ઞાન શિક્ષણનાં સામાન્ય હેતુઓ જણાવો.

.....

.....  
.....  
.....  
.....  
.....  
.....

2. વિજ્ઞાન શિક્ષણનાં સામાન્ય હેતુઓનાં લક્ષણો જણાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....

3. વિજ્ઞાન શિક્ષણમાં વિશિષ્ટ હેતુઓ જણાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....

4. વિજ્ઞાન શિક્ષણનાં વિશિષ્ટ હેતુઓનાં લક્ષણો જણાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....

5. હેતુકથનની રચના કરતી વખતે કઈ-કઈ કાળજી લેશો ?

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

7.7 વિજ્ઞાન શિક્ષણનાં સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ (ઉદાહરણ સાથે)

વિજ્ઞાન શિક્ષણનાં સામાન્ય હેતુઓનાં વિશિષ્ટ હેતુઓને ઉદાહરણ દ્વારા સમજાવે.

7.7.1 જ્ઞાનના સામાન્ય હેતુઓ અને તેના વિશિષ્ટ હેતુઓ :

વિશિષ્ટ બાબતો કે સર્વસામાન્ય બાબતોની પુનઃસ્મૃતિનો જ્ઞાનમાં સમાવેશ કરવામાં આવે છે.

(1) વિદ્યાર્થીઓ વિશિષ્ટ બાબતોની માહિતી યાદ કરે : આ વિશિષ્ટ હેતુના સંદર્ભમાં અપેક્ષિત વર્તન-પરિવર્તનો આ પ્રમાણે હોય.

- વિદ્યાર્થીઓ પદો, સંકલ્પનાઓ, વ્યાખ્યાઓ, તથ્યો, ખ્યાલો પારિભાષિક શબ્દો, સિદ્ધાંતો યાદ કરે.
- વિદ્યાર્થીઓ તારીખ, બનાવ, સ્થળ,... યાદ કરે.

(2) વિદ્યાર્થીઓ વિશિષ્ટ બાબતોને ઓળખે : આ વિશિષ્ટ હેતુના સંદર્ભમાં અપેક્ષિત વર્તન-પરિવર્તનો આ પ્રમાણે હોય.

- વિદ્યાર્થીઓ વિચારો અને બનાવોની યોગ્ય સ્વરૂપમાં રજૂઆત કરે.
- વિદ્યાર્થીઓ બનાવ કે ઘટનાઓનો ક્રમ ઓળખે.
- વિદ્યાર્થીઓ નિશ્ચિત વર્ગીકરણ કે વ્યવસ્થાને ઓળખે.

(3) વિદ્યાર્થીઓ અમુક ક્ષેત્રની સર્વસામાન્ય બાબતો અને નિયમો જાણે : આ વિશિષ્ટ હેતુના સંદર્ભમાં અપેક્ષિત વર્તન-પરિવર્તનો આ પ્રમાણે હોય.

- વિદ્યાર્થીઓ અમુક નિયમો ઓળખે.
- વિદ્યાર્થીઓ અમુક સિદ્ધાંત કે બંધારણને ઓળખે.

7.7.2 સમજના સામાન્ય હેતુઓ અને તેના વિશિષ્ટ હેતુઓ :

જ્ઞાન અથવા માહિતીની કક્ષાથી વધુ ઉચ્ચ સમજ અર્થગ્રહણ-અર્થબોધની છે. વિદ્યાર્થીએ મેળવેલ જ્ઞાનની જો કોઈ કોઈ માર્ગો દ્વારા અભિવ્યક્તિ કરવી હોય તો તો જ્ઞાનની તેને ઊંડી સમજ હોવી જોઈએ.

- વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક માહિતીમાં જુદા-જુદા સ્વરૂપોનું પરસ્પર રૂપાંતર કરે.
- વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક સંબંધો ઉપર આધારિત સાદી ગણતરીઓ કરે.
- વિદ્યાર્થીઓ ચાર્ટ્સ, આકૃતિઓ, આલેખ, માહિતી કોષ્ટક, પ્રાયોગિક ગોઠવણી વગેરેનું અર્થઘટન કરે.



- વિદ્યાર્થીઓ સિદ્ધાંતો, બનાવો વગેરેનાં ઉદાહરણો આપે.
- વિદ્યાર્થીઓ શક્ય હોય ત્યાં પ્રાયોગિક અને સૈદ્ધાંતિક સાબિતી આપે.
- વિદ્યાર્થીઓ કથનમાં, પ્રયોગ પદ્ધતિઓમાં, ઉદાહરણોમાં, આકૃતિમાં અને કાર્યકારણ સમજૂતીમાં ભૂલો હોય તો શોધે અને કારણો આપીને સુધારે.
- વિદ્યાર્થીઓ, પ્રક્રિયાઓ, ખ્યાલો વચ્ચેનો સૂક્ષ્મ તફાવત પારખે.
- વિદ્યાર્થીઓ વ્યાખ્યાઓ, પ્રક્રિયાઓ, ખ્યાલો વગેરેની તુલના કરે.
- વિદ્યાર્થીઓ હકીકતો (તથ્યો), પ્રક્રિયાઓ, સિદ્ધાંતો વગેરેના પરસ્પરના આંતરિક સંબંધો શોધે / તારવે.
- વિદ્યાર્થીઓ ખ્યાલો, સિદ્ધાંતો, વ્યાખ્યાઓ વગેરે પોતાની ભાષામાં રજૂ કરે.
- વિદ્યાર્થીઓ માહિતીને યોગ્ય ક્રમમાં ગોઠવે.
- વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક માહિતીનું વર્ગીકરણ કરે.
- વિદ્યાર્થીઓ પરિણામો, અસરો વગેરેનો અંદાજ કાઢે.
- વિદ્યાર્થીઓ જે તે બાબતોને બંને તેટલી સરળ રીતે સ્પષ્ટ ભાષામાં રજૂ કરે.

### 7.7.3 ઉપયોજનનાં સામાન્ય હેતુઓ અને તેનાં વિશિષ્ટ હેતુઓ :

કોઈ ચોક્કસ અને સચોટ પરિસ્થિતિમાં વિનિયોગ વર્તન એ ઉપયોજન છે. અહીં વિનિયોગ વર્તન કોઈ સામાન્ય વિચાર, સિદ્ધાંત, નિયમ કે સામાન્યીકૃત પદ્ધતિના સંદર્ભમાં હોય છે. સમજની કક્ષા કરતાં આ કક્ષા થોડી ઊંચી છે. સમજમાં શીખેલી બાબતમાં ઊંડું જ્ઞાન જોવા મળે છે, જ્યારે ઉપયોજનમાં મેળવેલા જ્ઞાનને તદ્દન ભિન્ન પરિસ્થિતિમાં પ્રયોજવામાં આવે છે.

- વિદ્યાર્થીઓ આપેલ - શીખેલ માહિતીનો અન્ય પરિસ્થિતિમાં ઉપયોગ કરે.
- વિદ્યાર્થીઓ કોઈ કૂટપ્રશ્નને અનુરૂપ માહિતી પસંદ કરે.
- વિદ્યાર્થીઓ હેતુના અનુસંધાનમાં માહિતીની યોગ્યતાને પૂરતાપણાની ચકાસણી કરે.
- વિદ્યાર્થીઓ માહિતીના આધારે બાંધેલ ઉત્કલ્પનાની ચકાસણી કરે.
- વિદ્યાર્થીઓ વિજ્ઞાનના પ્રયોગોમાં કાર્યકારણનો સંબંધ શોધે.
- વિદ્યાર્થીઓ અવલોકન કરેલી બાબતો ઉપરથી અનુમાન અને નિર્ણય બાંધે.
- વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક ઘટનાઓ અંગે આગાહી કરે.
- વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક કૂટપ્રશ્નો યોગ્ય રીતે ઉકેલે.

### 7.7.4 કૌશલ્યનાં સામાન્ય હેતુઓ અને તેનાં વિશિષ્ટ હેતુઓ :

વિજ્ઞાનશિક્ષણે કરવાનાં કાર્યો પૈકી કૌશલ્યોની ખીલવણીનું કાર્ય મહત્વનું છે. અવલોકન, સાધન-ઉપયોગ, આકૃતિ-આલેખન અને રચના-કૌશલ્ય જેવાં કૌશલ્યની ખીલવણી વિજ્ઞાનશિક્ષણ દ્વારા થઈ શકે.

- (1) વિદ્યાર્થીઓમાં અવલોકન શક્તિ ખીલે.
  - વિદ્યાર્થીઓ નિદર્શન પ્રયોગનું અવલોકન કરે.
  - વિદ્યાર્થીઓ ક્રિયા દર્શાવતી આકૃતિના વિવિધ ભાગો અને તેના સમન્વયથી થતું કાર્ય સમજે.
  - વિદ્યાર્થીઓ પ્રાકૃતિક ઘટના, વિજ્ઞાન-સાધન પાછળનું વૈજ્ઞાનિક દષ્ટિબિંદુ સમજે.
  - પ્રાપ્ત આકૃતિ-આલેખન-પ્લાન-નકશાની વિગતો વર્ણવી શકે.
- (2) વિદ્યાર્થીઓમાં સાધન-ઉપયોગ શક્તિ વિકસે.
  - વિદ્યાર્થીઓ સૂચિત પ્રયોગ જાતે કરે.

- વિદ્યાર્થીઓ યોગ્ય સાધન પસંદ કરે.
- વિદ્યાર્થીઓ સાધન ભૂલ-મર્યાદા દર્શાવે.
- (3) વિદ્યાર્થી આકૃતિ-આલેખન કરે.
- પ્રમાણિત સ્વચ્છ, સ્પષ્ટ આકૃતિ દોરે.
- પ્રમાણિત ધ્યાન-નકશા તૈયાર કરે.
- (4) વિદ્યાર્થીઓમાં રચના-કૌશલ્ય વિકસે.
- વિદ્યાર્થીઓ સૂચિત સાધન તૈયાર કરે.
- વિદ્યાર્થીઓ સાધનને ક્રિયાન્વિત કરે.
- (5) વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક કૌશલ્યલક્ષી ગુણલક્ષણો વિકસે.
- વિદ્યાર્થી ઝડપથી કાર્ય કરે.
- વિદ્યાર્થી કાર્યમાં ચોકસાઈ રાખે.

તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી ખાલી જગ્યામાં લખો.

1. જ્ઞાનમાં સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ લખો.

.....

.....

.....

.....

.....

.....

.....

2. સમજનાં સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ લખો.

.....

.....

.....

.....

.....

.....

.....

3. કૌશલ્યનાં સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ લખો.

.....

.....

.....

.....

.....

.....

.....

.....  
.....  
.....  
.....  
.....

---

### 7.8 સારાંશ :

આ એકમમાં આપણે વિજ્ઞાન શિક્ષણનાં ઉદ્દેશો અને હેતુઓ વિશેની વિગતે સમજ મેળવી. બેન્ઝામિન બ્લૂમનું હેતુઓનું વર્ગીકરણની સવિસ્તાર સમજ મેળવી તેમજ હેતુઓનાં પ્રકારો વિશે જાણકારી મેળવી દરેક હેતુઓની સંરચનામાં કેટલી બાબતો ધ્યાનમાં રાખવાની હોય તે વિગતે સમજ્યા. વિજ્ઞાન શિક્ષણમાં સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓની જરૂરી માહિતી મેળવી. હવે પછીનાં એકમમાં તાસ પાઠ અને તાસ પાઠ આયોજનની વિગતે સમજ મેળવીશું તેમજ એકમ પાઠનાં સોપાનો તેમજ પાઠ આયોજન વિશે જાણકારી મેળવીશું.



## તાસ પાઠ અને એકમ પાઠ આયોજન

: રૂપરેખા :

- 8.1 પ્રસ્તાવના
  - 8.2 ઉદ્દેશો
  - 8.3 પાઠ આયોજન
    - 8.3.1 પાઠ આયોજનનો અર્થ
    - 8.3.2 પાઠ આયોજનનાં ફાયદા
    - 8.3.3 પાઠ આયોજનની મર્યાદા
    - 8.3.4 વિષયવસ્તુની પસંદગી
    - 8.3.5 વિષયવસ્તુનું વિભાજન
  - 8.4 પાઠ આયોજનનાં સોપાનો / માળખું
  - 8.5 પાઠ આયોજનનો નમૂનો
  - 8.6 એકમ આયોજન
    - 8.6.1 એકમ આયોજનનો અર્થ
    - 8.6.2 એકમ આયોજનનાં ફાયદા
    - 8.6.3 સારા એકમ આયોજનનાં લક્ષણો
  - 8.7 એકમ આયોજનનું માળખું
  - 8.8 એકમ આયોજનનો નમૂનો
  - 8.9 પાઠ આયોજન અને એકમ આયોજનની તુલના
  - 8.10 સારાંશ
-

---

## 8.1 પ્રસ્તાવના :

કોઈ પણ વ્યક્તિની વિશિષ્ટ ક્ષેત્રમાં સિદ્ધિઓ માટે બે મુખ્ય કારણો જવાબદાર હોય છે. એક તો તેમણે પોતાના ક્ષેત્રની લીધેલી ધનિષ્ટ તાલીમ અને તેમણે તે અંગે કરેલી સાધના અને બીજું તેમણે પોતાના કાર્યને સારા આયોજનના પાયા પર આધારિત કર્યું હોય છે. જો તેઓ સારું આયોજન ન કરે તો પોતાના ક્ષેત્રમાં તલ્લીન થઈને કાર્ય ન કરી શકે અને તેથી ધારી સફળતા ન મેળવી શકે. આમ આયોજન ખૂબ જ મહત્વનું છે. શાળામાં શિક્ષકનું કાર્ય શિક્ષણ આપવાનું હોય છે આ શિક્ષણકાર્યની સફળતા પાછળનું રહસ્ય છે સફળ અને વ્યવસ્થિત આયોજન. શાળામાં કેટલાક શિક્ષકો પાઠ આયોજનના અભાવે પોતાના વર્ગ શિક્ષણકાર્ય દ્વારા તલ્લીનતાથી એકરૂપ થઈ ભણાવી શકતા નથી તેથી સારા શિક્ષણકાર્ય માટે માત્ર તાલીમ જ પર્યાપ્ત નથી. સારું આયોજન પણ જરૂરી છે. સારું પાઠ આયોજન એ અધ્યાપનકાર્યમાં સફળતા મેળવવાની ગુરુ ચાવી છે.

---

## 8.2 ઉદ્દેશો :

પ્રસ્તુત એકમનો અભ્યાસ કર્યા બાદ તમે...

- પાઠ આયોજનનો અર્થ, કાયદા અને મર્યાદાઓ જાણી શકશો.
- પાઠ આયોજન માટે વિષયવસ્તુની પસંદગી તેમજ તેનું વિભાજન કરી શકશો.
- પાઠ આયોજનનાં સોપાનોની સમજ મેળવી શકશો.
- વિજ્ઞાન વિષયવસ્તુનાં કોઈ પણ મુદ્દા માટે પાઠ આયોજન તૈયાર કરી શકશો.
- એકમ આયોજનનો અર્થ, ફાયદા અને લક્ષણો જાણી શકશો.
- એકમ આયોજનનું માળખું સમજી શકશો.
- વિજ્ઞાન વિષયવસ્તુના કોઈ પણ એકમ માટે એકમ આયોજન તૈયાર કરી શકશો.
- પાઠ આયોજન અને એકમ આયોજનની તુલના કરી શકશો.

---

## 8.3 પાઠ આયોજન :

અધ્યાપન-અધ્યયનની સામગ્રી પ્રક્રિયાની વિગતપૂર્ણ વિચારણા એટલે પાઠ આયોજન. આયોજન કરતી વખતે વ્યક્તિ પોતે ક્યાં છે અને તેણે ક્યાં પહોંચવું છે ? શી રીતે ત્યાં પહોંચી શકશે ? લક્ષ્યાંકો સુધી પહોંચવા કોની સહાય લેવી પડશે ? તેમાં ક્યા-ક્યા અવરોધો આવી શકે તેમ છે ? એ અવરોધો દૂર કરવા માટે શું કરીશું ? વગેરે બાબતોનો માનસિક વિચાર કરવો પડે છે, ચિંતન કરવું પડે છે, વિચારણા કરવી પડે છે. આ માનસિક વિચાર-ચિંતન-વિચારણા એટલે જ આયોજન.

### 8.3.1 પાઠ આયોજનનો અર્થ :

“વિજ્ઞાનના શિક્ષકની દૃષ્ટિએ પાઠ આયોજન એટલે શિક્ષક દ્વારા વર્ગખંડમાં થતા અધ્યાપનનું આયોજન કરવું તે.”

“પાઠ આયોજન એટલે વર્ગ શિક્ષણકાર્યમાં શીખવવાની વિષયવસ્તુ, શીખવવાની રીતભાત અને કા.પા. નોંધનું વિગતવાર તૈયાર કરેલું ચિત્ર.”

“પાઠ આયોજન એ અધ્યાપકની કાર્ય યોજના છે, જેમાં અધ્યાપકની કાર્યાન્વિત ફિલસૂફી, તેનું તાત્વિક જ્ઞાન, અધ્યેતાને સમજવા માટેની તેની સમજ-માહિતી, શૈક્ષણિક હેતુઓ અંગેની તેની સમજ, અધ્યેતાઓને જે કંઈ શીખવવાનું છે તેની સાધનસામગ્રીની માહિતી, પદ્ધતિઓનો અસરકારક ઉપયોગ કરવા માટેની તેની શક્તિ વગેરેનો સમાવેશ થાય છે.

પાઠ આયોજન એ પ્રભાવશાળી શિક્ષણનું કેન્દ્રબિંદુ છે તેમાં ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે, પરંતુ તેનાથી સશક્ત ફળ પણ અવશ્ય મળે છે. પાઠ આયોજનના અભાવમાં અધ્યાપક વર્ગમાં શિસ્ત જાળવવાના પ્રયાસ કરવામાં જ થાકી જાય છે અને તે વર્ગખંડની પોતાની અસફળતાઓને લીધે હતોત્સાહી બની જાય છે જ્યારે આયોજન કરીને વર્ગમાં ગયેલ અધ્યાપકને ક્યારેય મુશ્કેલી અનુભવવી

પડતી નથી, તે આત્મવિશ્વાસપૂર્વક સમગ્ર તાસ દરમિયાન કાર્ય કરી શકે છે. આયોજનને લીધે તે અસરકારક શિક્ષણ આપી શકે છે અને નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકે છે.

### 8.3.2 પાઠ આયોજનના ફાયદાઓ :

- પાઠ આયોજનથી અધ્યાપનકાર્ય સુઆયોજિત, નિયમિત તેમજ પદ્ધતિસરનું થાય છે.
- પાઠ આયોજન દ્વારા શિક્ષકમાં આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા અને આત્મત્માન પેદા થાય છે.
- પાઠ આયોજન શિક્ષકનાં શિક્ષણકાર્યને સરળ બનાવી તેમાં મદદરૂપ થાય છે.
- પાઠ આયોજન વિદ્યાર્થીઓમાં રસ અને રુચિ જાગૃત કરે છે.
- આયોજનને કારણે સમયની બચત થાય છે. કારણ કે વિદ્યાર્થીઓમાં ચોક્કસ સમયમાં સારી સમજ અને ઘણું બધું જ્ઞાન વિકસે છે.
- પાઠ આયોજનને કારણે શિક્ષણકાર્યમાં એકસૂત્રતા જળવાય છે.
- પાઠ આયોજન દ્વારા શિક્ષક વર્ગમાં ઉપસ્થિત થતા પ્રશ્નોનો ઉકેલ વિવિધ ઉદાહરણોથી કરી શકે છે.
- પાઠ આયોજન શિક્ષકને પૂરતી સ્વતંત્રતા આપે છે.
- પાઠ આયોજનથી શિક્ષકમાં આત્મસન્માન જાગૃત થાય છે.
- પાઠ આયોજનથી શિક્ષણકાર્ય અસરકારક બને છે અને તે વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ કરવામાં મદદરૂપ થાય છે.
- પાઠ આયોજનને લીધે શિક્ષક નિશ્ચિતપણે વર્ગમાં જઈ કુશળ અને સિદ્ધહસ્ત વ્યક્તિની જેમ વર્તી શકે છે.
- પાઠ આયોજનને લીધે શિક્ષણકાર્યમાં સાતત્ય જળવાય છે.
- પાઠ આયોજન શિક્ષકને શિક્ષણ કાર્ય માટે પૂર્વ તૈયારી માટેની તક આપે છે.
- વર્ગખંડમાં ઊભી થનારી કેટલીક આકસ્મિક મુશ્કેલીઓ અને સમસ્યાઓનો અધ્યાપક અગાઉથી વિચાર કરી લે છે અને તેમના ઉકેલો પણ અગાઉથી જ વિચારી લે છે જેથી તે નિર્વિઘ્ને શિક્ષણકાર્ય કરી શકે છે.
- શિક્ષણકાર્ય દરમિયાન કઈ-કઈ શૈક્ષણિક સાધનસામગ્રીનો કેવી રીતે ઉપયોગ કરશે તે અંગે તે અગાઉથી વિચારી લે છે.
- પાઠ આયોજન શિક્ષકમાં અભ્યાસ ટેવ વિકસાવે છે. રોજ નવો પાઠ, નવી વિચારણા, રોજ નવા પ્રયોગો અને નિતનવી પરિસ્થિતિમાંથી અધ્યાપકે પસાર થવું પડે છે. જેથી અધ્યાપક નિત્ય નવીન રહે છે.
- પાઠ આયોજનથી શિક્ષકનાં સમય, શક્તિ અને શ્રમ બચે છે, પરિણામે તે નિર્રથક શિક્ષણમાં અટવાઈ જતો નથી. વિષયાંતરથી પણ બચી જાય છે.

ટૂંકમાં પાઠ આયોજનથી અધ્યયન-અધ્યાપન સરળ, સમૃદ્ધ, સરસ, સફળ, કાર્યક્ષમ અને અસરકારક બને છે.

### 8.3.3 પાઠ આયોજનની મર્યાદાઓ :

- ઘૂટા પાઠ આયોજનથી શિક્ષણનાં દૂરવર્તી હેતુઓ સિદ્ધ થઈ શકતા નથી, કારણ કે તે 35 થી 40 મિનિટના સમયગાળા માટેનું જ આયોજન છે.
- ઘૂટા પાઠનું આયોજન શિક્ષણમાં બધા વિષયોના તેમજ બધા જ પ્રકારના પાઠો માટે અનુકૂળ નથી. ખાસ કરીને કૌશલ્ય, પ્રવૃત્તિ વગેરેને લગતા પાઠો માટે તે અનુકૂળ નથી.

- પાઠ આયોજનથી શિક્ષણ માહિતીપ્રધાન બની જાય છે. વિદ્યાર્થીઓ મોટે ભાગે નિષ્ક્રિય રહે છે તેમને રસ પડે તેવી પ્રવૃત્તિઓનો ઉપયોગ થઈ શકતો નથી.
- વિષયના છૂટા ટુકડા પડી જાય છે, પરિણામે જ્ઞાનની અખંડિતતા જળવાતી નથી.
- પાઠ આયોજનને લીધે શિક્ષણકાર્ય માત્ર કર્મકાંડની જેમ ઉપરછલ્લું જડ, યુસ્ત અને યાંત્રિક બની જાય છે.
- પાઠ આયોજનથી અભિગમ વિષયકેન્દ્રી બની જાય છે અને તે વિદ્યાર્થીકેન્દ્રી રહેતો નથી.
- પાઠ આયોજન યોજના વ્યાવહારિક બનતી નથી.

### 8.3.4 વિષયવસ્તુની પસંદગી :

વિષયવસ્તુની પસંદગી શિક્ષકના શિક્ષણની સફળતા, નિષ્ફળતાનો આધાર છે. તેથી વિષયવસ્તુની યોગ્ય પસંદગી જરૂરી બની રહે છે. વિષયવસ્તુ પસંદ કરતા શિક્ષકે શાળા શરૂ થવાનો સમય અને કક્ષા કા.પા. કાર્ય, સાધનસામગ્રી, ભૌતિક સુવિધાઓ અધ્યયન-અધ્યાપન પ્રવૃત્તિઓ, શિક્ષણના વર્તન ક્ષેત્રો, મૂલ્યો વગેરે બાબત ધ્યાનમાં રાખવાનાં હોય છે.

છેલ્લા પિરિયડોમાં બાળકોને અઘરા લાગતા વિષયો શીખવવામાં આવે તો કંટાળેલા બાળકો વધુ કંટાળે છે અને વિષયવસ્તુથી વિમુખ થાય છે. તેથી જરૂરી છે કે એ વિષયવસ્તુની પસંદગી કરવામાં આવે જેમાં વિદ્યાર્થીઓને વધુ મજા પડે.

વિષયવસ્તુ સમયને ધ્યાનમાં રાખીને પસંદ કરવાથી વિષયવસ્તુ માટે યોગ્ય સમય મળી રહે છે. વિષયવસ્તુની પસંદ કરતાં શિક્ષણના હેતુઓને પણ ધ્યાનમાં રાખવા જોઈએ હેતુવિહિન શિક્ષણ અયોગ્ય શિક્ષણ છે. શિક્ષણના અંતે જો શિક્ષણના હેતુઓ સિદ્ધ ન થાય તો શિક્ષણ નિરર્થક સાબિત થાય છે.

વિષયવસ્તુની પસંદગી સાથે જ વિષયવસ્તુની રજૂઆત માટેની પદ્ધતિઓ-પ્રયુક્તિઓનો પણ ખ્યાલ રાખવો જોઈએ જો યોગ્ય પદ્ધતિ-પ્રયુક્તિઓનો સમન્વય ન થાય તો વિષયવસ્તુનો ખ્યાલ વિદ્યાર્થીઓનો આવતો નથી.

વિષયવસ્તુની પસંદગીની સાથે કા.પા. કાર્ય, સાધન-સામગ્રી અને ભૌતિક સુવિધાઓની પણ એટલી જ જરૂર છે નહિતર વર્ગખંડમાં પર્યાવરણનું સંચાલન યોગ્ય રીતે કરી શકાતું નથી અને વર્ગમાં ગેરશિસ્તનું વાતાવરણ સર્જાય છે.

### 8.3.5 વિષયવસ્તુનું વિભાજન :

- વિષયવસ્તુની પસંદગી બાદ પસંદ થયેલ વિષયવસ્તુનું વિભાજન પેટા મુદ્દાઓમાં કરવું જોઈએ. વિજ્ઞાન વિષયવસ્તુમાં સંકલ્પના, અર્થ, વ્યાખ્યા, સૂત્રો, હકીકતો, તથ્યો, પ્રયોગો, દાખલા વગેરેનો સમાવેશ થાય છે. તેથી પસંદ કરેલ વિષયવસ્તુને તેમાં રહેલ પદ, સંકલ્પનાઓ, અર્થ, વ્યાખ્યા, સૂત્રો, હકીકતો પ્રમાણે તાર્કિક રીતે સાતત્ય જાળવી યોગ્ય રીતે વિભાજિત કરવું જોઈએ. જેથી વિષયવસ્તુને યોગ્ય ન્યાય આપી શકાય.

તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી ખાલી જગ્યામાં લખો.

#### 1. પાઠ આયોજનનો અર્થ જણાવો.

.....

.....

.....

.....

.....  
.....  
.....

2. પાઠ આયોજનનાં પાંચ ફાયદાઓ જણાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....

3. પાઠ આયોજનની પાંચ મર્યાદાઓ જણાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....

4. વિષયવસ્તુ પસંદગી અને વિષયવસ્તુ વિભાજન એટલે શું ?

.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....



.....  
.....  
.....  
.....

#### 8.4 પાઠ આયોજનનાં સોપાનો / માળખું :

પાઠ આયોજનની હર્બટ સ્પેન્સરની પંચપદી પદ્ધતિ પ્રચલિત છે. આ પંચપદીનાં મુખ્ય પાંચ સોપાનો નીચે મુજબ છે. જેની વિગતે ચર્ચા કરીશું.

- (1) પૂર્વ તૈયારી / વિષયાભિમુખ
- (2) હેતુ કથન
- (3) વિષય નિરૂપણ
- (4) મૂલ્યાંકન
- (5) સ્વાધ્યાય / ગૃહકાર્ય

##### (1) પૂર્વ તૈયારી / વિષયાભિમુખ :

પૂર્વતૈયારીને બીજા શબ્દોમાં વિષયપ્રવેશ કે પૂર્વજ્ઞાન ચકાસણી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વિષયવસ્તુ શિક્ષક શીખવવાનો છે તે અંગે વિદ્યાર્થી શું માને છે અને તે વિષયવસ્તુ અંગેના તેમના પૂર્વજ્ઞાનને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તે અંગે શિક્ષકે વિચારવું જોઈએ. જો પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરી વિષય પ્રવેશ કરવામાં આવે તો વિષયવસ્તુ પરિચિત હોવાથી વિદ્યાર્થી શિક્ષણ તરફ ઉત્તેજિત થઈ એ તરફ અભિમુખ થાય છે. આમ, પૂર્વજ્ઞાન ચકાસી, વિષયપ્રવેશ કરવો જોઈએ જેથી શિક્ષણકાર્ય સફળ અને સરળ બનાવી શકાય અને વિદ્યાર્થીઓ વિષયાભિમુખ થાય છે. પૂર્વતૈયારીના સોપાનમાં વિષયપ્રવેશ માટે ઉપયોગમાં લીધેલ પ્રયુક્તિની નોંધ કરવામાં આવે છે.

##### (2) હેતુ કથન :

વિષયાભિમુખ થયેલ વિદ્યાર્થીઓ સમક્ષ તેઓ શું શીખશે તે માટેની કુતૂહલવૃત્તિ હોય છે. વિદ્યાર્થીઓની આ કુતૂહલવૃત્તિને સંતોષવા શિક્ષક જે શીખવવાના છે તે સ્પષ્ટ શબ્દમાં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરે છે. આ વિધાનને હેતુકથન કહેવાય છે જેના દ્વારા વિદ્યાર્થીઓ આજે શું શીખવાના છે તેની માહિતી મેળવે છે.

##### (3) વિષયનિરૂપણ :

વિષયનિરૂપણ એ સમગ્ર પાઠનો આધાર અને પાઠ આયોજનનું હાર્દ છે. વિષયનિરૂપણ એટલે વિષયવસ્તુની રજૂઆત, જે વિષયવસ્તુ શીખવવાનું છે તેની ચર્ચા-વિચારણા, જે હેતુઓ સિદ્ધ કરવાના હોય તે અહીં નિશ્ચિત કરવામાં આવે છે. એ માટે શિક્ષક યોગ્ય પદ્ધતિ અને પ્રયુક્તિઓનો ઉપયોગ કરી, યોગ્ય અભિગમ દ્વારા વિષયવસ્તુની સચોટ રજૂઆત કરે છે અહીં આ અગાઉ કરેલ હેતુકથનના સંદર્ભમાં જ શિક્ષક વર્તન કરે છે. આ સોપાન શિક્ષક-વિદ્યાર્થી પ્રવૃત્તિઓનો સમગ્ર ખ્યાલ આપે છે.

આ સોપાનમાં વિષયવસ્તુનું પૃથક્કરણ કરવાથી વિષયવસ્તુ નાના-નાના વિભાગોમાં વહેંચાઈ જાય છે. જો વિષયવસ્તુને યોગ્ય અને તાર્કિક ક્રમમાં ન ગોઠવવામાં આવે તો નાની... કે નાના ભાગો તરીકે વહેંચાયેલ વિષયવસ્તુ સ્પષ્ટ સમજ આપતો નથી. વિદ્યાર્થી વિષયવસ્તુ સમજી શકતો નથી તેથી જરૂરી છે કે વિષયવસ્તુના પૃથક્કરણ પછી તેની તાર્કિક ક્રમમાં ગોઠવણી કરવામાં આવે.

##### (4) મૂલ્યાંકન :

શિક્ષક પાઠનું આયોજન વિષયવસ્તુનાં શૈક્ષણિક હેતુઓને આધારે કરે છે શિક્ષકે કરેલા આ હેતુકથન અને તેનાં સંદર્ભમાં વિષયવસ્તુ નિરૂપણ દ્વારા વિદ્યાર્થીઓ કેટલે અંશે વિષયવસ્તુ ગ્રહણ કરી શકે છે અને વિષયવસ્તુ કેટલે અંશે પચાવી શક્યો છે, હેતુઓની સિદ્ધિ કેટલે અંશે થઈ છે, શિક્ષકે

ઉપયોગમાં લીધેલી પદ્ધતિ અને પ્રયુક્તિઓ કેટલે અંશે સફળ છે. તેમજ શીખવાડેલ એકમની સમજ કેટલી મેળવી તે સમગ્ર પ્રશ્નોના જવાબ આ સોપાન દ્વારા મળે છે. અહીં શિક્ષકે કરેલ શિક્ષણનો ટૂંકા પ્રશ્નો અને હેતુલક્ષી પ્રશ્નો દ્વારા ચકાસણી કરી વિષયવસ્તુ પર વિદ્યાર્થીની પકડ, હેતુઓની સિદ્ધિ, શીખવાયેલ એકમ અંગેની સમજ વગેરેની માહિતી મેળવવામાં આવે છે.

#### (5) સ્વાધ્યાય/ગૃહકાર્ય :

ગુરુનો પણ ગુરુ એટલે સ્વાધ્યાય. શીખવાયેલ એકમ વધુ દૃઢ કરવા, મૂલ્યાંકન બાદ વિદ્યાર્થીઓને એકમમાંથી એકાદ-બે પ્રશ્નોના ઉત્તરો લખી લાવવાનું કહેવાય છે. અહીં પૂછાયેલ પ્રશ્ન જ્ઞાન, સમજ, ઉપયોગ કે કૌશલ્ય આધારિત હોઈ શકે છે. જેની નોંધ પાઠ આયોજનમાં સ્વાધ્યાયના સોપાનમાં કરવામાં આવે છે.

પાઠ આયોજનનાં ઉપરનાં સોપાનો સિવાય પણ નીચેનાં જેવા કેટલાક મુદ્દાઓ પાઠ આયોજનમાં તૈયાર કરવામાં આવે છે. જેની સમજ મેળવીએ.

#### સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ :

વિષયવસ્તુના પૃથક્કરણ અને વિભાજન બાદ શિક્ષણનાં સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ તૈયાર કરવામાં આવે છે જેની નોંધ પાઠ આયોજનમાં કરવામાં આવે છે.

#### અધ્યાપન પદ્ધતિઓ, અભિગમો અને પ્રયુક્તિઓ :

પાઠ આયોજનમાં નક્કી કરેલા હેતુઓ અને વિશિષ્ટ હેતુઓને સિદ્ધ કરવા માટે અગત્યનું સાધન કાર્યપદ્ધતિ અથવા અધ્યાપન પદ્ધતિઓ છે. યોગ્ય રીતે પસંદ કરીને યોગ્ય ક્રમમાં આપવામાં આવતા શૈક્ષણિક અનુભવોની શ્રેણીને શૈક્ષણિક પદ્ધતિ અથવા અધ્યાપન પદ્ધતિ કહેવામાં આવે છે. જુદા-જુદા હેતુઓ સિદ્ધ કરવા માટે જુદી-જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનાં જેવી અધ્યાપન પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે.

#### ● પદ્ધતિઓ :

- દાર્શનિક પદ્ધતિ
- પ્રયોગ પદ્ધતિ
- વ્યાખ્યાન પદ્ધતિ
- પ્રોજેક્ટ પદ્ધતિ
- સ્વાધ્યાય પદ્ધતિ

#### ● પ્રયુક્તિઓ અને અભિગમો :

- કથન પ્રયુક્તિ
- પ્રશ્ન પ્રયુક્તિ
- ઉદાહરણ પ્રયુક્તિ
- કા.પા. કાર્ય પ્રયુક્તિ
- શોધ અભિગમ
- પૂછપરછ તાલીમ મોડેલ
- સમસ્યા ઉકેલ અભિગમ
- આગમન અભિગમ
- નિગમન અભિગમ
- પૃથક્કરણ અને સંશ્લેષણ અભિગમ
- સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન

## સંદર્ભ સાહિત્ય :

શિક્ષકે અસરકારક શિક્ષણ માટે વિષયવસ્તુની તૈયારી કરવા વિશેષ સંદર્ભોનો ઉપયોગ કરવો જોઈએ તેણે એકમની માહિતી સરળ અને રસપ્રદ બનાવવા સંદર્ભગ્રંથોનો ઉપયોગ કરવો જોઈએ. અધ્યેતાઓની વય, કક્ષા અને રસ-અભિરુચિને ધ્યાનમાં લઈ આવા સાહિત્યનો ઉપયોગ કરી શકાય. આ રીતે પાઠની તૈયારી માટે ઉપયોગમાં લીધેલા સંદર્ભસાહિત્યનો પાઠ આયોજનમાં ઉલ્લેખ કરવામાં આવે છે.

## શૈક્ષણિક સાધનો અને શૈક્ષણિક સામગ્રી :

શૈક્ષણિક અનુભવોને અસરકારક બનાવવા માટે શિક્ષક જુદા-જુદા પ્રકારની શૈક્ષણિક સામગ્રી તેમજ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરે છે. શિક્ષણમાં વપરાતી અને વાપરી શકાય એવી શૈક્ષણિક સાધનસામગ્રીની યાદી નીચે મુજબ છે.

- આલેખ
- પુસ્તકો
- ચાર્ટ્સ
- આલ્બમ
- ચિત્રો
- નકશા
- ફોટોગ્રાફ્સ
- શૈક્ષણિક રમકડાં
- બુલેટીન બોર્ડ
- મોડેલ્સ
- રસાયણો
- લેબોરેટરીનાં સાધનો
- ફિલ્મ પ્રોજેક્ટર
- રેડિયો
- એપીડાયોસ્કોપ
- ફિલ્મ સ્ટ્રીપ
- ટેપ રેકોર્ડર
- રોલ અપ બોર્ડ

જે-તે વિષયવસ્તુનાં શિક્ષણ દરમિયાન પાઠનાં ઉપયોગી શૈક્ષણિક સાધનોની યાદી પાઠ આયોજન નોંધમાં નોંધવામાં આવે છે.

## વિષયવસ્તુના મુદ્દા :

પાઠ આયોજનમાં વિષયવસ્તુનાં શૈક્ષણિક મુદ્દાઓનું પેટા મુદ્દાઓમાં વિભાજન કરેલ હોય છે. આ શૈક્ષણિક મુદ્દાઓની નોંધ પાઠ આયોજનમાં કરવામાં આવે છે કે જેનાં આધારે શિક્ષકની પ્રવૃત્તિ અને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિની જાણકારી મેળવી શકાય છે.

## શૈક્ષણિક પ્રવૃત્તિઓ :

બે પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓને લક્ષમાં લેવામાં આવે છે.

(1) શિક્ષકની પ્રવૃત્તિઓ અને (2) વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ

### (1) શિક્ષકની પ્રવૃત્તિઓ :

વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવતી વખતે વિદ્યાર્થીઓમાં અપેક્ષિત વર્તન-પરિવર્તન લાવવા શિક્ષક કેટલીક પ્રવૃત્તિઓ કરે છે જેને પાઠ આયોજનમાં નોંધવામાં આવે છે. શૈક્ષણિક અનુભવો આપવા માટે શિક્ષક વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. વર્ગ અધ્યાપન દરમિયાન શિક્ષકે કરવાની કેટલીક પ્રવૃત્તિઓની યાદી નીચે મુજબ છે.

- પ્રશ્નો પૂછવા
- ચાર્ટ, નમૂના કે ચિત્રો રજૂ કરવા
- કથનો રજૂ કરવા

- ક્રિયા કે કાર્યની રજૂઆત કરવી.
- આકૃતિ દોરવી કે રજૂ કરવી.
- દાર્શનિક પ્રયોગો કરી બતાવવા.
- આલેખો દોરવા કે રજૂ કરવા.
- ચલચિત્ર રજૂ કરવા.
- ઉદાહરણો રજૂ કરવા.
- માહિતી આપવી.
- વર્ગીકરણ રજૂ કરવું.
- કા.પા. પર નોંધ કરવી.

## (2) વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ :

શિક્ષકની પ્રવૃત્તિઓને આધારે વિદ્યાર્થીઓએ પ્રવૃત્તિઓ કરવાની હોય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા યોગ્ય શૈક્ષણિક અનુભવો મેળવી વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે. જુદા-જુદા હેતુઓ માટે જુદી-જુદી પ્રવૃત્તિઓ હોઈ શકે છે. એક પાઠમાં એક કરતા વધુ હેતુઓ હોય છે. તેથી વિદ્યાર્થીઓને એક કરતાં વધુ પ્રવૃત્તિઓ આચરવાની હોય છે, આ પ્રવૃત્તિઓની નોંધ પાઠ આયોજનમાં કરવામાં આવે છે. જેની યાદી નીચે મુજબ છે.

- |                           |                          |
|---------------------------|--------------------------|
| ● વાંચવું                 | ● ચાર્ટ દોરવા            |
| ● લખવું                   | ● પ્રશ્નોનાં ઉત્તરો આપવા |
| ● નોંધ લેવી               | ● વર્ગીકરણ કરવું.        |
| ● ધ્યાનથી સાંભળવું        | ● ઉદાહરણો આપવા           |
| ● આકૃતિ દોરવી             | ● યાદ કરવું              |
| ● ચર્ચા કરવી              | ● અવલોકન કરવું           |
| ● શિક્ષકોને પ્રશ્નો પૂછવા | ● પ્રયોગ કરવો            |
| ● સરખામણી કરવી            | ● ચિંતન કરવું            |
| ● વિચાર કરવો              | ● તફાવત પારખવો           |
| ● પ્રવૃત્તિઓમાં ભાગ લેવો  | ● પ્રયોગના સાધનો ગોઠવવા  |

## કા.પા. નોંધ :

શિક્ષકનાં શિક્ષણ કાર્યનો અરીસો એટલે તેની કા.પા. નોંધ, શિક્ષક શિક્ષણકાર્ય દરમિયાન વિષયવસ્તુની રજૂઆત કરતા-કરતા કેટલાક મહત્વનાં મુદ્દાઓની નોંધ કાળા પાટિયામાં કરે છે. આ નોંધ ઘણી જ સુઘડ, સુયોજિત અને સુઆયોજિત, સંપૂર્ણ છતાં ટૂંકી હોવી જોઈએ. અહીં કા.પા. કૌશલ્યનાં સમગ્ર ઘટકોને ધ્યાનમાં રાખી આકર્ષક કા.પા. નોંધની આયોજનમાં નોંધ કરવામાં આવે છે.

## 8.5 પાઠ આયોજનનો નમૂનો :

તાલીમાર્થીનું નામ :	રોલ નંબર :
શાળા :	ધોરણ : 9 વર્ગ - બ
વિષય : વિજ્ઞાન	વિષયાંગ : લેસર પ્રકાશ
તારીખ : .....	તાસ : ..... સમય : .....

શૈક્ષણિક મુદ્દા	સામાન્ય હેતુઓ	પદ્ધતિ-પ્રયુક્તિઓ
<ul style="list-style-type: none"> <li>લેસરનો ઈતિહાસ</li> <li>લેસર શબ્દનો અર્થ</li> <li>લેસર કિરણ વિશેની માહિતી</li> <li>લેસરના પ્રકારો</li> <li>લેસરના ઉપયોગો</li> </ul>	<p><b>જ્ઞાન :</b> વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયક માહિતી મેળવે.</p> <p><b>સમજ :</b> વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયક સમજ મેળવે.</p> <p><b>ઉપયોજન :</b> વિદ્યાર્થીઓ મેળવેલ જ્ઞાનનો નવીન પરિસ્થિતિમાં ઉપયોગ કરે.</p> <p><b>કૌશલ્ય :</b> વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયક કૌશલ્યો મેળવે.</p> <p><b>વલણ :</b> વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયક વલણ કેળવે.</p>	<p><b>પદ્ધતિઓ :</b> કથન વ્યાખ્યાન, નિદર્શન</p> <p><b>પ્રયુક્તિઓ :</b> ચર્ચા, ઉદાહરણ, પ્રશ્નોત્તરી, આગમન-નિગમન સંયુક્ત અભિગમ શૈક્ષણિક સાધનો</p>

સહાયક સામગ્રી	પુસ્તકનું નામ	લેખક-સંપાદક	પૃષ્ઠ નંબર
પાઠ્યપુસ્તક			
સંદર્ભગ્રંથો	(1) મદુઈ કિરણ લેસર (2) 200 મિલેનિયમ ફ્લેશબેક (3) વિસ્મયકારક વિજ્ઞાન (4) સફારી	ડૉ. કે.ટી. મહેતા રજની વ્યાસ - નાગેન્દ્ર વિજય	132 22 12 18

શૈક્ષણિક સોપાનો/મુદ્દાઓ	વિશિષ્ટ હેતુઓ	શિક્ષકની પ્રવૃત્તિઓ	વિદ્યાર્થીની પ્રવૃત્તિઓ	સંદર્ભ / ઉદાહરણો
વિષયાભિમુખ	વિદ્યાર્થીઓ પૂર્વજ્ઞાન સાથે નવા જ્ઞાનનું સંકલન કરતાં શીખે	શિક્ષક વર્ગવ્યવસ્થા તપાસી જરૂરી સૂચનો આપશે, કથન કરશે અને નીચેના જેવા પૂર્વજ્ઞાન પર આધારિત પ્રશ્નો પૂછશે. (1) પ્રકાશ આપણને કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય છે. (2) પ્રકાશ સાથે સંકળાયેલ ઘટનાઓનાં નામ આપો. (3) શરીરનાં હાડકામાં કોઈ ઈજા થઈ હોય તો તે શેના દ્વારા જાણી શકાય ?	વિદ્યાર્થીઓ શ્રવણ કરશે. અને જવાબ આપશે. વિ : સૂર્ય, બલ્બ વગેરે વિ : અપેક્ષિત ઉત્તર વિ : એક્સ-રે દ્વારા	
હેતુકથન	વિદ્યાર્થીઓ વિષયાંગથી	હં... તો આપણે જોયું કે પ્રકાશનાં એવા સ્વરૂપની	વિદ્યાર્થીઓ ધ્યાનથી	

	પરિચિત થાય	શોધ થઈ જે આધુનિક ટેકનોલોજીને આભારી છે તે ઉપરાંત દાંત, આંખ વગેરેની પીડારહિત સારવારમાં પણ પ્રકાશ ઉપયોગી છે. તેવો પ્રકાશ એટલે લેસર પ્રકાશ. તો આજે આપણે લેસર કિરણો વિશે ભણીશું.	સાંભળશે અને વિષયાંગની નોંધ નોંધપોથીમાં કરશે.	
વિષયનિરૂપણ ● લેસરનો ઇતિહાસ ● લેસરનો અર્થ ● લેસર વિશે માહિતી લેસર પ્રકાશ છે. ● એકજ સરખી તરંગલંબાઈ હોય છે.	● વિદ્યાર્થીઓ લેસર વિશે જાણે ● વિદ્યાર્થીઓ લેસર વિશે સમજે ● વિદ્યાર્થીઓ લેસર શબ્દ વિશે જાણે ● વિદ્યાર્થીઓ લેસર શબ્દ વિશે સમજ કેળવે. વિદ્યાર્થીઓ લેસર વિશે જાણે ● વિદ્યાર્થીઓ લેસર વિશે સમજે ● નવીન પરિસ્થિતિમાં ઉપયોગ કરતાં થાય.	● શિક્ષક વિવિધ પૂર્વજ્ઞાન આધારિત પ્રશ્નોત્તરી દ્વારા વિષયવસ્તુની સમજ સ્પષ્ટ કરશે. (1) લેસર વિશેની સૌ પ્રથમ માહિતી કયા વૈજ્ઞાનિકે આપી ? (2) લેસર કિરણોની શોધ ક્યારે થઈ ? (3) લેસર કિરણનાં શોધકનું નામ જણાવો. (4) લેસર શબ્દ અંગ્રેજીના કયા પાંચ અક્ષરોનું બનેલું છે ? (5) લેસર કિરણોની તરંગલંબાઈ કેવી હોય છે ?	વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળશે અને ઉત્તરો આપશે વિ : આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિ : ઈ.સ. 1960 વિ : ડૉ. ટી. એચ. માઈમેન વિ. LASER વિ. એકસરખી	સંદર્ભ-1 કથન-1 આલ્બર્ટ આઈન્સ્ટાઈન નું ચિત્ર સંદર્ભ-2 થિઓડોર એચ. માઈમેનનું ચિત્ર કથન-2 લેસરનો અર્થ કથન-3 લેસરની માહિતી સંદર્ભ-3 સામાન્ય પ્રકાશ અને લેસરનો ચાર્ટ સંદર્ભ-4 લેસર ટોચનો પ્રયોગ બતાવવો.

<ul style="list-style-type: none"> <li>● લેસરના પ્રકારો</li> </ul> <p>ચાર</p> <p>(1) ઘન લેસર</p> <p>(2) પ્રવાહી લેસર</p> <p>(3) વાયુ લેસર</p> <p>(4) ડાયોડ લેસર</p>	<ul style="list-style-type: none"> <li>● વિદ્યાર્થીઓ લેસરના પ્રકાર વિશે જાણો</li> <li>● વિદ્યાર્થીઓ લેસરના પ્રકાશની સમજ મેળવે.</li> <li>● વિદ્યાર્થીઓ લેસરનો નવીન પરિસ્થિતિમાં ઉપયોગ કરતાં થાય.</li> </ul>	<p>(6) લેસરના મુખ્ય કેટલા પ્રકાર છે ?</p> <p>(7) લેસરના ચાર પ્રકાશના નામ જણાવો.</p>	<p>વિ : ચાર</p> <p>વિ : અપેક્ષિત ઉત્તર</p>	<p>કથન-4</p> <p>લેસરના પ્રકારો</p>
<ul style="list-style-type: none"> <li>● રૂબી લેસર</li> </ul>	<ul style="list-style-type: none"> <li>● વિદ્યાર્થીઓ રૂબી લેસર વિશે જાણો</li> <li>● વિદ્યાર્થીઓ રૂબી લેસર વિશે સમજે.</li> </ul>	<p>(8) ઈ.સ. 1960માં કયા લેસરની શોધ થઈ ?</p> <p>(9) રૂબી લેસરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ?</p>	<p>વિ:રૂબી લેસર</p> <p>વિ : ડૉ. થીઓડોર એચ. માઈમેન</p>	<p>રૂબી જે લાલ રંગનો છે.</p> <p>સંદર્ભ-5</p> <p>રૂબી લેસરનો ચાર્ટ</p>
<ul style="list-style-type: none"> <li>● હિલિયમ-નિયોન લેસર</li> </ul>	<ul style="list-style-type: none"> <li>● વિદ્યાર્થીઓ હિલિયમ-નિયોન લેસર વિશે જાણો.</li> <li>● વિદ્યાર્થીઓ હિલિયમ-નિયોન લેસર વિશે સમજે</li> </ul>	<p>(10) આ લેસરમાં હિલિયમ-નિયોનનું પ્રમાણ કેટલું રાખવામાં આવે છે ?</p>	<p>વિ : 10 : 1</p>	<p>સંદર્ભ-6</p> <p>હિલિયમ-નિયોન લેસરનો ચાર્ટ</p>
<ul style="list-style-type: none"> <li>● લેસરના ઉપયોગો</li> </ul>	<ul style="list-style-type: none"> <li>● વિદ્યાર્થીઓ કિરણોનો નવીન પરિસ્થિતિમાં ઉપયોગ કરતાં થાય.</li> </ul>	<p>(11) તબીબી ક્ષેત્રમાં લેસર કિરણોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે ?</p> <p>(12) લેસર પ્રિન્ટરનો ઉપયોગ જણાવો.</p> <p>(13) લેસરના બીજા જણાવો.</p>	<p>વિ : દાંત અને આંખની સારવાર માટે</p> <p>વિ : કમ્પ્યુ.માં કોપી કાઢવા</p> <p>વિ : અપેક્ષિત ઉત્તર</p>	<p>કથન-5</p> <p>લેસરના ઉપયોગ</p> <p>સંદર્ભ-7</p> <p>લેસર પ્રિન્ટરનો ચાર્ટ</p>
મૂલ્યાંકન	વિદ્યાર્થીઓએ	શિક્ષિકા મૂલ્યાંકન ચાર્ટ	વિદ્યાર્થીઓ	

	મેળવેલ જ્ઞાનની ચકાસણી	દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરશે.	અપેક્ષિત ઉત્તર આપશે.	
સ્વાધ્યાય	વિદ્યાર્થીઓએ મેળવેલ જ્ઞાન દૃઢ થાય.	શિક્ષિકા વિષયને અનુરૂપ સ્વાધ્યાય કાર્ય આપશે.	વિદ્યાર્થીઓ સ્વાધ્યાય કાર્યની નોંધ પોતાની નોંધપોથીમાં કરશે.	

મૂલ્યાંકન પ્રશ્નો	અપેક્ષિત ઉત્તરો
<p><b>પ્રશ્ન-1</b> નીચેની ખાલી જગ્યા પૂરો.</p> <p>(1) લેસરની શોધ..... નામના વૈજ્ઞાનિકે કરી હતી.</p> <p>(2) લાલ રંગના પ્રકાશનું ઉત્સર્જન ..... લેસર કરે છે.</p> <p>(3) લેસરના કુલ ..... પ્રકાર છે.</p> <p><b>પ્રશ્ન-2</b> નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.</p> <p>(1) લેસર કિરણો અસુસંબંધ પ્રકાશ છે.</p> <p>(2) હિલિયમ-નિયોન લેસરમાં હિલિયમ અને નિયોનનું પ્રમાણ 10:1 હોય છે.</p>	<p>વિ : ડૉ. ટી.એચ. માઈમેન</p> <p>વિ : રૂબી લેસર</p> <p>વિ : ચાર</p> <p>વિ : ખોટું</p> <p>વિ : ખરું</p>

**શ્યામ ફલક નોંધ**

વિષય : વિજ્ઞાન	ધોરણ-9 વર્ગ-બ
વિષયોગ : લેસર કિરણો	તારીખ :

<p><b>લેસરનો ઇતિહાસ</b></p> <ul style="list-style-type: none"> <li>આલ્બર્ટ આઈન્સ્ટાઈને ઇ.સ. 1911માં સર્વપ્રથમ માહિતી આપી.</li> <li>ઇ.સ.1960માં થિઓડોર એચ.માઈમેને લેસર કિરણની શોધ કરી.</li> </ul> <p><b>લેસર શબ્દનો અર્થ :</b></p> <p>LASER : Light Amplification Emission of Radiation એટલે કે વિકિરણના ઉદ્દીપ્ત ઉત્સર્જન દ્વારા પ્રકાશનું વિવર્ધન કરવું.</p> <p><b>લેસર કિરણો :</b></p> <ul style="list-style-type: none"> <li>લેસર એક પ્રકાશ છે.</li> <li>તે એક જ તરંગલંબાઈ ધરાવે છે.</li> </ul>	<p><b>(1) રૂબી લેસર</b></p> <ul style="list-style-type: none"> <li>1960માં ટી.એચ. માઈમેને શોધ કરી.</li> <li>લાલ રંગના પ્રકાશનું ઉત્સર્જન કરે છે.</li> <li>તેનો ઉત્સર્જન સમય 300 m Sec જેટલો હોય છે.</li> <li>5600 A° તરંગ લંબાઈ વાળા પ્રકાશનું ઉત્સર્જન કરે છે.</li> </ul> <p><b>(2) હિલિયમ-નિયોન લેસર :</b></p> <ul style="list-style-type: none"> <li>ઇ.સ. 1961માં અલી જવાને શોધ કરી.</li> <li>તેમાં હિલિયમ અને નિયોનનું પ્રમાણ 10 : 1 હોય છે.</li> </ul> <p><b>લેસરના ઉપયોગો :</b></p>
--	---



- એક જ દિશામાં પ્રસરણ પામે છે.
- તે સુસંબંધ હોય છે.

લેસરના પ્રકારો :

- ચાર પ્રકારો છે.
- (1) ઘન લેસર
- (2) પ્રવાહી લેસર
- (3) વાયુ લેસર
- (4) ડાયોડ લેસર

- તબીબી ક્ષેત્રમાં
- સંદેશા વ્યવહારમાં
- ફોટોગ્રાફી અને રસાયણશાસ્ત્રમાં
- હીરામાં અતિસૂક્ષ્મ છેદ પાડવા
- બારકોડ પ્રિન્ટરમાં
- સીડી બનાવવામાં
- લેસર પ્રિન્ટરમાં

### સ્વાધ્યાય

- લેસર કિરણનો અર્થ અને તેના વિશે સામાન્ય માહિતી આપો.
- લેસર કિરણનો વ્યવહારમાં ઉપયોગ જણાવો.

### નિરીક્ષક નોંધ

શિક્ષણકાર્યની વિશિષ્ટતાઓ	શિક્ષણકાર્ય અંગે સૂચનો
તારીખ :	અધ્યાપકની સહી .....

તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી ખાલી જગ્યામાં લખો.

1. પાઠ આયોજનનાં સોપાનોની માત્ર યાદી જણાવો.

.....

.....

.....

.....

.....

.....

.....

2. પાઠ આયોજનનું વિષયનિરૂપણ સોપાન સમજાવો.

.....

.....

.....

.....

.....

.....

.....

.....  
.....

3. પાઠ આયોજનનું મૂલ્યાંકનનું સોપાન સમજાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....

4. અધ્યાપન પદ્ધતિઓ અને પ્રયુક્તિઓની યાદી જણાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....

5. પાઠ આયોજનનાં સંદર્ભમાં શિક્ષક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થી પ્રવૃત્તિઓ જણાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....

.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....

## 8.6 એકમ આયોજન :

વર્ગ શિક્ષણ કાર્ય માટે પાઠ આયોજન વિશે આપણે શીખી ગયા. જેમાં કોઈ એકમ માત્ર એક જ શૈક્ષણિક મુદ્દા કે પેટા મુદ્દાનું આયોજન તૈયાર કર્યું. તાલીમાર્થી જ્યારે શાળાનો શિક્ષક બને છે ત્યારે તેને સમગ્ર એકમ કે સમગ્ર વિષયનું શિક્ષણ કાર્ય કરવાનું હોય છે. તેથી પાઠનું આયોજન તો કરવું જ પડે પણ સાથે-સાથે સમગ્ર એકમનું આયોજન પણ વિચારવું જોઈએ. મુખ્ય એકમ કે જે પાંચ છ તાસમાં પૂર્ણ થાય તેનાં પાંચ છ અલગ-અલગ પાઠ આયોજનને બદલે લઘુનોંધના રૂપમાં એક જ આયોજન કરવામાં આવે છે. તેને એકમ આયોજન કહે છે. જેમાં સમગ્ર એકમ શિક્ષણ વિશેની વિગતે નોંધ કરવામાં આવે છે.

### 8.6.1 એકમ આયોજનનો અર્થ :

“એકસરખી વિશિષ્ટતાઓ ધરાવતા અભ્યાસક્રમના મુદ્દાઓને ક્રમિકતાથી શીખવવા માટેના સાતત્યપૂર્ણ આયોજનને એકમ આયોજન કહેવામાં આવે છે.”

“એકમનું વસ્તુ સુગ્રથિત હોય, શિક્ષણપ્રદ હોય, સ્વયંસંપૂર્ણ હોય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ, અનુભવો અને અધ્યયનના પ્રકારોનું સંકલન કોઈ કેન્દ્રિય વિષય, સમસ્યા કે હેતુની આસપાસ થતું હોય. એકમ શબ્દના અર્થમાં આયોજન, આયોજનનો અમલ અને મૂલ્યાંકન વગેરે પણ સમાયેલા છે.”

એકમમાં વિષયવસ્તુની એકતા ખૂબ જ મહત્વની છે. વિજ્ઞાનના અભ્યાસક્રમની ઘણી બાબતો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. આવી બાબતોને યોગ્ય ક્રમમાં સંકલિત કરવામાં આવે તો શિક્ષણનો એક એકમ રચાય છે. આવો દરેક એકમ વિજ્ઞાન શિક્ષણનો એક સ્વયં પૂર્ણ ઘટક બની જાય છે. એકમમાં સમગ્રતા, એકતા અને સંપૂર્ણતા હોવી જરૂરી છે.

### 8.6.2 એકમ આયોજનનાં ફાયદા :

એકમ આયોજનનાં ફાયદાઓ નીચે મુજબ છે.

- એકમ આયોજનના પરિણામે સાતત્ય આવે છે અને અધ્યેતાઓ વિશાળ ભૂમિકા પર વિચાર કરતા થાય છે. જ્ઞાનની સળંગસૂત્રતા અને અખંડિતતાના મનોવૈજ્ઞાનિક ખ્યાલનો સમાવેશ થયેલો છે.
- એકમ આયોજનથી વિષયવસ્તુનું સળંગ અધ્યયન થઈ શકે છે.
- વિષયાંગનાં એકમનાં વિશિષ્ટ હેતુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.

- શિક્ષકની શક્તિનો બચાવ થાય છે. ઉપરાંત તેનાં શ્રમ અને સમયનો પણ બચાવ થાય છે.
- એકમ આયોજનમાં વિજ્ઞાનનાં અધ્યાપનનાં અધ્યાપન અનુભવો વિચારપૂર્વક આપવામાં આવતા હોવાથી તેમનું પુનરાવર્તન કરવાની જરૂર રહેતી નથી.
- શિક્ષક પોતાના અનુભવને આધારે પરિસ્થિતિ મુજબ વિજ્ઞાનના એકમ આયોજનમાં યોગ્ય ફેરફાર પણ કરી શકે છે.
- એકમ આયોજનથી વિદ્યાર્થીઓને વિજ્ઞાન શિક્ષણનાં સમૃદ્ધ, ઘનિષ્ઠ અને વ્યવસ્થિત અનુભવો આપી શકાય છે.
- એકમ આયોજનને લીધે વિજ્ઞાનના સાધન સામગ્રી તથા સંદર્ભ સાહિત્ય અંગે અગાઉથી જ સ્પષ્ટ થઈ જાય છે તેમજ તેની મર્યાદા અંગેનો પણ ખ્યાલ આવે છે.
- એકમ આયોજનને લીધે સમગ્ર એકમની શિક્ષણ મૂલ્યાંકન પદ્ધતિઓ, પ્રવિધિઓ તેમજ સ્વાધ્યાયનો અગાઉથી વિચાર થઈ શકે છે.
- એકમ આયોજનથી યોગ્ય રીતે પુનરાવર્તન અને દૃઢીકરણ થઈ શકે છે.
- એકમ આયોજન લવચિક છે. દરેક તાસમાં આયોજન પ્રમાણે જ બરાબર કટોકટ કાર્ય થાય, ન થાય, ઓછું થાય, વધુ થાય એ બાબતની ચિંતા કરવાની જરૂર નથી.
- વિજ્ઞાનના એક કરતા વધુ અધ્યાપકો સાથે મળીને એકમ આયોજન કરી શકે છે. આમ, સહકાર્યકર્તાઓના વિચારો અને અનુભવોનો લાભ મેળવી શકાય છે.
- વર્ગખંડમાંનાં અધ્યયન અનુભવો, અધ્યયન પ્રવૃત્તિઓ ઉપરાંત મુલાકાત, પ્રવાસ-પર્યટન વગેરે ચાર દીવાલોની બહારના અનુભવોને પણ એકમ આયોજનમાં સમાવી શકાય.
- છૂટા પાઠમાં અનુબંધની શક્યતાઓ પ્રમાણમાં ઓછી હોય છે. જ્યારે એકમ આયોજનમાં અન્ય મુદ્દાઓ અને અન્ય વિષયો સાથે અનુબંધની વિશાળ તક રહેલી હોય છે.

### 8.6.3 સારા એકમ આયોજનનાં લક્ષણો :

સારા એકમ આયોજનથી અધ્યાપનકાર્યમાં ઘણી ઊંચી સફળતા મળે છે. સારા એકમ આયોજન માટે કેટલાક માર્ગદર્શક નિયમો નક્કી કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે :

- સામાન્ય તેમજ વિશિષ્ટ હેતુઓ સ્પષ્ટ તેમજ સમજી શકાય તેવા હોવા જોઈએ.
- પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓની વય કક્ષા તેમજ શિક્ષણમાં રસ જાગૃત કરે તેવી હોવી જોઈએ.
- એકમ આયોજનનાં શૈક્ષણિક પરિણામોના ફલિતાર્થ મેળવવામાં મનોવૈજ્ઞાનિક આધાર હોવા જોઈએ.
- એકમ આયોજન દ્વારા અધ્યયનમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ બંને વિષયવસ્તુના શિક્ષણની પ્રક્રિયામાં સક્રિય ભાગ લેતા હોવા જોઈએ.
- એકમ આયોજનમાં જ્ઞાનના વિભાગો વચ્ચે એકસૂત્રતા કે સળંગસૂત્રતા હોવી જોઈએ.
- એકમ આયોજન અંતર્ગત જ્ઞાનના વિભાગો એવા હોવા જોઈએ કે વિદ્યાર્થીઓ તેનાં પર ચર્ચા કરે, સંદર્ભોનો ઉપયોગ કરે અને અન્ય સાથે વિચારણા કરે.
- એકમ આયોજન વિદ્યાર્થીઓને સ્વતંત્ર રીતે કામ કરવાની તક અને સગવડતા આપે તેવું હોવું જોઈએ.
- એકમ આયોજનમાં વૈજ્ઞાનિક મૂલ્યાંકન પદ્ધતિનો સવિવેક ઉપયોગ કરવામાં આવેલો હોવો જોઈએ.
- વિદ્યાર્થીઓમાં અપેક્ષિત કૌશલ્યો તેમજ માનસિક શક્તિઓનો વિકાસ થાય તેવું એકમ આયોજન હોવું જોઈએ.

- એકમ આયોજન વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરે એવું હોવું જોઈએ.
- એકમ આયોજનમાં યોગ્ય શૈક્ષણિક સાધનોનો નિર્દેશ કરવામાં આવેલો હોવો જોઈએ.
- વિજ્ઞાનના એકમ આયોજનમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અનુભવોનું પૂરતું આયોજન થવું જોઈએ.
- વિજ્ઞાન શિક્ષણના એકમ આયોજનની પ્રવૃત્તિ વર્ગઅધ્યાપનને વાસ્તવિક પરિસ્થિતિમાં લાવે તેવી હોવી જોઈએ.
- વિજ્ઞાન શિક્ષણનાં સારા એકમો વિજ્ઞાનની બીજી સમસ્યાઓના ઉકેલ તરફ દોરી જાય તેવા હોવા જોઈએ.
- સમગ્ર એકમ આયોજનમાં સૂચિત અધ્યયન-અનુભવો વચ્ચે તાર્કિક સંબંધ હોવો જોઈએ.
- એકમ આયોજન અંતર્ગત રહેલા જ્ઞાનના વિભાગો અધ્યેતાઓના જીવન અને વાતાવરણને સ્પર્શતા હોવા જોઈએ.

તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી ખાલી જગ્યામાં લખો.

1. એકમ આયોજનનો અર્થ જણાવો.

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

2. એકમ આયોજનનાં ફાયદાઓ લખો.

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

3. સારા એકમ આયોજનનાં પાંચ લક્ષણો જણાવો.

.....

.....

.....

.....  
.....  
.....  
.....  
.....

### 8.6 એકમ આયોજનનું માળખું :

એકમ આયોજનનાં સોપાનો નીચે આપેલી એકમ આયોજનની રૂપરેખામાં દર્શાવામાં આવેલ છે.

એકમ આયોજનની રૂપરેખા

#### (અ) સામાન્ય માહિતી :

તાલીમાર્થિનું નામ :	રોલ નં. :
શાળાનું નામ	ધોરણ અને વર્ગ :
તારીખ	તાસ : સમય :
વિષય :	વિષયાંગ :

#### (બ) સોપાનો :

##### ● મુખ્ય એકમ :

આ સોપાનમાં જે મુખ્ય એકમ હોય તે જણાવવો, જે એકમનું અધ્યાપન કાર્ય કરાવવાનું હોય તે એકમનું નામ આયોજનમાં દર્શાવવું.

##### ● પેટા એકમ :

ઉપર મુજબ પસંદ કરેલા મુખ્ય એકમનાં જેટલા પેટા એકમો સ્વાભાવિક રીતે પાડી શકાય એટલા પેટા એકમો પાડવા. મુખ્ય એકમ કેટલો લાંબો છે તેને આધારે તેનાં ત્રણ થી આઠ પેટા એકમોમાં વિભાજન કરવામાં આવે છે. આ પેટા એકમોનાં નામ સ્પષ્ટ રીતે એકમ આયોજનમાં દર્શાવવામાં આવે છે.

##### ● તાસવાર આયોજન :

ઉપયુક્ત પેટા એકમોને જેટલા તાસમાં વિભાજિત કરવા હોય એટલા તાસ અને સામે એકમ જણાવવા. છેલ્લે આખો તાસ મૂલ્યાંકન માટે રાખવો.

##### ● શૈક્ષણિક હેતુઓ :

કેટલાક શિક્ષણશાસ્ત્રીઓ એકમ આયોજનમાં માત્ર સામાન્ય હેતુઓ લખવા એમ જણાવે છે જ્યારે કેટલાકનો મત એવો છે કે સામાન્ય હેતુઓની સાથે સાથે વિશિષ્ટ હેતુઓ પણ લખવા જોઈએ.

##### ● વિષયવસ્તુનું પૃથક્કરણ :

વિષયવસ્તુની સમજ સ્પષ્ટ થાય તે માટે અહીં વિષયવસ્તુને ત્રણ વિભાગમાં વહેંચવું જોઈએ. એટલે કે ખ્યાલો, સમજ અને માહિતી.

- **ખ્યાલો :** એકમમાં આવતી હોય તે વિશિષ્ટ શબ્દ વ્યંજનાઓ ખ્યાલો કે શબ્દ સંકલ્પનાઓ રજૂ કરવી જોઈએ.
- **સમજ :** અધ્યાપન કાર્ય દરમિયાન સ્પષ્ટ કરી શકાય તે હેતુથી કોઈક વૈજ્ઞાનિક સિદ્ધાંત, નિયમ, ક્રિયા અને પ્રક્રિયામાં જે સમજ સમાયેલી હોય તેનો ઉલ્લેખ એકમ આયોજનમાં કરવો.
- **માહિતી :** અહીં ખ્યાલો, કાર્યકારણ, કૌશલ્યો અને સમજ સિવાયની વૈજ્ઞાનિક બાબતો કે જેને ફક્ત માહિતી ગણી શકાય તેનો નિર્દેશ કરવો.

● શૈક્ષણિક પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ :

સમગ્ર એકમ શિક્ષણ દરમિયાન તેનાં બધા તાસોમાં વિવિધ પેટા એકમો માટે જે શૈક્ષણિક પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો શિક્ષક ઉપયોગ કરવાનો હોય તેનો એકમ આયોજનમાં માત્ર નામ નિર્દેશ કરવો જોઈએ.

● શૈક્ષણિક સાધનો :

એકમ પાઠના બધા તાસો દરમિયાન જે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવાનું શિક્ષકે વિચાર્યું હોય તે બધાનો નામનિર્દેશ એકમ આયોજનમાં કરવામાં આવે છે.

● સંદર્ભ સાહિત્ય :

અહીં સમગ્ર એકમના શિક્ષણકાર્ય દરમિયાન પાઠ્યપુસ્તક સિવાય જે કોઈ સંદર્ભપુસ્તકો, સામયિકો કે એનસાઈક્લોપીડિયા વગેરેનો ઉપયોગ કરવાનાં હોય તેની યાદી નીચેનાં કોઠામાં દર્શાવવી જોઈએ.

ક્રમ	પુસ્તકનું નામ	લેખક/લેખકોનાં નામ	પ્રકાશક	પ્રકાશન સ્થળ અને પ્રકાશન વર્ષ	આવૃત્તિ	પૃષ્ઠ નંબર
1.						
2.						

● સમય પત્રક :

દરેક તાસમાં કયા-કયા પેટા મુદ્દાઓ શીખવવાના છે અને શિક્ષક અને વિદ્યાર્થીની ચીલાચાલુ નહીં, પરંતુ વિશિષ્ટ પ્રકારની અને મહત્વની કઈ-કઈ પ્રવૃત્તિઓ કરવાની ધારણા છે. તેનો માત્ર નામનિર્દેશ જ કરવો. જે નીચે મુજબ કોઠામાં દર્શાવવું.

તાસનો ક્રમ	વિષયવસ્તુના મુદ્દા	શિક્ષકની મહત્વની પ્રવૃત્તિઓ	વિદ્યાર્થીઓની મહત્વની પ્રવૃત્તિઓ	તાસવાર વાપરવા ધારેલી સાધન સામગ્રી
1.				
2.				
3.				
4.				
5.				

● મૂલ્યાંકન યોજના :

છૂટા પાઠની જેમ અહીં એકમ આયોજનના દરેક તાસ માટે મૂલ્યાંકન કસોટી બનાવવાની નથી પરંતુ આખા એકમના જે પાંચ-સાત તાસ લેવામાં આવે તે બધા તાસ માટેની ભેગી સમગ્ર મૂલ્યાંકન કસોટી બનાવવાની હોય છે, જેને એકમ મૂલ્યાંકન કસોટી કહેવામાં આવે છે. બ્લૂ પ્રિન્ટ આધારિત 25 ગુણ કે તેથી વધારે ગુણની એકમ કસોટી તૈયાર કરવાની હોય છે.

● સ્વાધ્યાય યોજના :

સમગ્ર એકમ પાઠ દરમિયાન આપવાના સ્વાધ્યાય તાસવાર જણાવવા.

આમ, એકમ આયોજન ખૂબ જ ઉપયોગી છે એ નિર્વિવાદ બાબત છે તેથી એકમ આયોજન પ્રમાણે વધારે પાઠો અપાય એવો આગ્રહ રાખવો જોઈએ.

**8.8 એકમ આયોજનનો નમૂનો / રૂપરેખા :**

તાલીમાર્થીનું નામ : રોલ નં. :  
 શાળા : ધોરણ / વર્ગ : 8  
 વિષય : વિજ્ઞાન વિષયાંગ : કાર્બન  
 તારીખ : સમય : તાસ : પાઠ ક્રમાંક :

**(1) મુખ્ય એકમ : કાર્બન**

**(2) પેટા એકમ :**

- તાસ-1 કાર્બનની પ્રાથમિક સમજ, કાર્બનના સ્વરૂપોની માહિતી, કાર્બનના સ્ફટિકમય સ્વરૂપો : હીરો, ગ્રેફાઈટ
- તાસ-2 કુલેરિન્સની સમજ, કાર્બનના અસ્ફટિકમય સ્વરૂપોની સમજ, કાર્બન ડાયોક્સાઈડ ચક્ર
- તાસ-3 CO<sub>2</sub> ના ભૌતિક - રાસાયણિક ગુણધર્મો, CO<sub>2</sub> ની બનાવટ, CO<sub>2</sub>ના ઉપયોગો
- તાસ-4 એકમ મૂલ્યાંકન કસોટી  
25 ગુણ અને 25 મિનિટ
- તાસ-5 ઉપચારાત્મક શિક્ષણ  
CO<sub>2</sub> નાં રાસાયણિક તથા ભૌતિક ગુણધર્મો CO<sub>2</sub> નાં ઉપયોગો

**(3) વિષયવસ્તુના મુદ્દા :**

તાસ-1	તાસ-2	તાસ-3
<ul style="list-style-type: none"> <li>કાર્બનની પ્રાથમિક સમજ</li> <li>કાર્બનના સ્વરૂપો વિશે માહિતી</li> <li>કાર્બનના સ્ફટિકમય સ્વરૂપો : - હીરો - ગ્રેફાઈટ</li> </ul>	<ul style="list-style-type: none"> <li>કુલેરિન્સની સમજ</li> <li>કાર્બનના અસ્ફટિકમય સ્વરૂપો - કોલસો - લેમ્પબ્લેક - કાર્બન બ્લેક</li> <li>કાર્બન ડાયોક્સાઈડ ચક્ર</li> </ul>	<ul style="list-style-type: none"> <li>CO<sub>2</sub> ના ભૌતિક ગુણધર્મ</li> <li>CO<sub>2</sub> ના રાસાયણિક ગુણધર્મ</li> <li>CO<sub>2</sub> ના ઉપયોગો</li> <li>CO<sub>2</sub> ની બનાવટ (પ્રયોગ શાળામાં)</li> </ul>

**(4) હેતુઓ :**

સામાન્ય હેતુઓ	વિશિષ્ટ હેતુઓ
<ul style="list-style-type: none"> <li><b>જ્ઞાન :</b> વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિશે માહિતી પ્રાપ્ત કરે.</li> <li><b>સમજ :</b> વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક સમજ કેળવે.</li> <li><b>ઉપયોગન :</b> વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયના જ્ઞાનનો ઉપયોગ અન્ય પરિસ્થિતિમાં કરે.</li> </ul>	<ul style="list-style-type: none"> <li>વિદ્યાર્થીઓ કાર્બન વિશે જાણે</li> <li>વિદ્યાર્થીઓ કાર્બનના સ્વરૂપો ઓળખે</li> <li>વિદ્યાર્થીઓ કાર્બનના સ્ફટિકમય સ્વરૂપો હીરો, ગ્રેફાઈટ તથા કુલેરિન્સ વગેરે વિશે માહિતી જાણે</li> <li>વિદ્યાર્થીઓ કાર્બનના અસ્ફટિકમય સ્વરૂપો વિશે જાણે.</li> </ul>



<ul style="list-style-type: none"> <li>● કૌશલ્ય : વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયક કૌશલ્ય કેળવે.</li> </ul>	<ul style="list-style-type: none"> <li>● વિદ્યાર્થીઓ CO<sub>2</sub> ના ચક્ર વિશે માહિતી મેળવે.</li> <li>● વિદ્યાર્થીઓ CO<sub>2</sub> ના ભૌતિક રાસાયણિક ગુણધર્મોથી પરિચિત થાય.</li> <li>● વિદ્યાર્થીઓ CO<sub>2</sub> ની બનાવટની માહિતી મેળવે.</li> <li>● વિદ્યાર્થીઓ CO<sub>2</sub> ના ઉપયોગ વિશે જાણે.</li> </ul>
--	---

(5) સંકલ્પનાઓ :

તાસ-1 : કાર્બન :

સજીવસૃષ્ટિમાં રહેલ દરેક કાર્બનિક પદાર્થો રેશમ, લાકડું, ફૂલ-ફળ વગેરેને ગરમ કરતાં તેનો રંગ બદલાવા લાગે છે. વધારે ગરમ કરતાં મળતો અંતમાં કાળો પદાર્થ કાર્બન છે.

તાસ-2 : અસ્ફટિકમય કાર્બન :

કોલસો, લેમ્પબ્લેક, કાર્બન બ્લેક વગેરે કાર્બનના અસ્ફટિકમય સ્વરૂપના ઉદાહરણ છે.

તાસ-3 : કાર્બન ડાયોક્સાઈડ વાયુ :

આ વાયુ રંગવિહીન, ગંધવિહીન, સ્વાદવિહીન છે, તે હવા કરતાં ભારે છે અને પાણીમાં દ્રાવ્ય છે.

(6) અધ્યયન અનુભવો :

વિદ્યાર્થીઓ કથન સાંભળશે, કા.પા. નોંધ લખશે, પ્રયોગ અને ચાર્ટનું નિદર્શન કરશે, પ્રશ્નોના જવાબ આપશે, મૂલ્યાંકન પ્રત ભરશે. રૂપકમાં ભાગ લેશે.

(7) પદ્ધતિ અને પ્રયુક્તિઓ :

પદ્ધતિ : વ્યાખ્યાન, નિદર્શન, પ્રયોગ, રૂપક

પ્રયુક્તિઓ : કથન, ચર્ચા, પ્રશ્નોત્તરી, ઉદાહરણ

(8) મૂલ્યાંકન :

શિક્ષણ બ્લૂ પ્રિન્ટ આધારિત 25 ગુણની 25 મિનિટની કસોટી દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરો.

(9) સ્વાધ્યાય :

તાસ-1 હીરો અને ગ્રેફાઈટના તફાવતના ચાર મુદ્દા લખો.

તાસ-2 CO<sub>2</sub> ચક્રની આકૃતિ દોરો.

તાસ-3 પછીના દિવસે મૂલ્યાંકન કસોટી હોવાથી શિક્ષિકા વિદ્યાર્થીઓને સમગ્ર લેશન વાંચીને આવવા કહેશે.

તાસ-4 એકમ કસોટી (મૂલ્યાંકન કસોટી)

25 ગુણની 25 મિનિટ

તાસ-5 ઉપચારાત્મક શિક્ષણ

- CO<sub>2</sub> ના રાસાયણિક ગુણધર્મ

- CO<sub>2</sub> ના ભૌતિક ગુણધર્મ

- CO<sub>2</sub> ના ઉપયોગો

(10) સંદર્ભ સાહિત્ય :

વિગત	પુસ્તકનું નામ	લેખક	પ્રકાશક	પાના નં.
પાઠ્યપુસ્તક	ધોરણ-8 વિજ્ઞાન અને ટેક્.	ગુ.રા.પા.પુ. મંડળ	ગુ.રા.શ.પા. પુ. મંડળ	77 + 82
સંદર્ભ પુસ્તકો				

(11) શૈક્ષણિક સાધનો :

1. યાંત્રિક :

2. બિન યાંત્રિક : કાગળ, દિવાસળીની પેટી, હીરાની રચનાનો ચાર્ટ, ગ્રેફાઈટની રચનાનો ચાર્ટ, પેન્સિલ, CO<sub>2</sub> ચક્રનો ચાર્ટ, CO<sub>2</sub> ની બનાવટનો ચાર્ટ

8.9 પાઠ આયોજન અને એકમ આયોજનની તુલના :

પાઠ આયોજન	એકમ આયોજન
<ul style="list-style-type: none"><li>● 30 થી 40 મિનિટનું આયોજન કરવામાં આવે છે.</li><li>● વિષય કે વિષયાંગનો છૂટોછવાયો મુદ્દો લક્ષમાં લેવામાં આવે છે.</li><li>● શિક્ષકે પ્રત્યેક તાસ માટે અલગ-અલગ તૈયારી કરવી પડે છે.</li><li>● વિષયાંગ અંગે સંપૂર્ણ ચર્ચા કરવા માટે મર્યાદિત સમય મળે છે.</li><li>● એકસૂત્રતાનો અભાવ વર્તાય છે.</li><li>● એકાંગી આયોજન કરવામાં આવે છે.</li><li>● ઓછા સમયને કારણે ઉપરછલ્લું શિક્ષણ થાય છે.</li><li>● ખંડિત અને આંશિક મૂલ્યાંકન થાય છે.</li><li>● મર્યાદિત અધ્યયન અનુભવો આપી શકાય છે.</li><li>● સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું સુસંકલિત આયોજન ઓછું શક્ય બને છે.</li><li>● શિક્ષકની મર્યાદિત પૂર્વતૈયારી ચાલે છે.</li><li>● શૈક્ષણિક સાધનોનો મર્યાદિત ઉપયોગ કરી શકાય છે.</li><li>● શિક્ષણકાર્ય દરમિયાન ભાગ્યે જ પ્રવૃત્તિ આપી શકાય છે.</li></ul>	<ul style="list-style-type: none"><li>● 3 થી 8 તાસ સુધીનું આયોજન કરવામાં આવે છે.</li><li>● વિષયાંગ સાથે સંબંધ ધરાવતા ઘણા મુદ્દા કે પાસાઓને લક્ષમાં લેવામાં આવે છે.</li><li>● શિક્ષક મહેનતપૂર્વક એક આયોજન તૈયાર કરે છે. પાંચ થી ત્રણ કે વધારે તાસ માટે અધ્યાપન કરી શકે છે.</li><li>● સર્વાંગી ચર્ચા કરવા માટે પૂરતો સમય મળી રહે છે.</li><li>● એકસૂત્રતા જળવાઈ રહે છે.</li><li>● તેમાં સર્વાંગી આયોજન કરવામાં આવે છે.</li><li>● વધુ સમય મળવાને કારણે સઘન શિક્ષણ થઈ શકે છે.</li><li>● સંપૂર્ણ અને સર્વાંગી મૂલ્યાંકન થઈ શકે છે.</li><li>● વૈવિધ્યસભર અધ્યયન અનુભવો આપી શકાય છે.</li><li>● સવિશેષ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું સંકલિત આયોજન અસરકારક રીતે કરી શકાય છે.</li><li>● શિક્ષકની પરિશ્રમયુક્ત પૂર્વતૈયારી જરૂરી છે.</li><li>● શૈક્ષણિક સાધનોનો બહોળો ઉપયોગ કરી શકાય છે.</li><li>● શિક્ષણકાર્ય દરમિયાન ભરપૂર પ્રવૃત્તિઓ આપી શકાય છે.</li></ul>





---

## સ્વાધ્યાય

---

1. માઈકોટીચિંગનો અર્થ જણાવી તેનાં લક્ષણો લખો.
2. માઈકોટીચિંગનાં સોપાનો સવિસ્તાર સમજાવો.
3. વિષયાભિમુખ કૌશલ્યની સમજ આપો.
4. પ્રશ્નપ્રવાહીનાં કૌશલ્યનાં માઈકોપાઠનું આયોજન કરો. (વિજ્ઞાનનાં કોઈ એક મુદ્દા માટે)
5. પ્રશ્ન પૂછતી વખતે કઈ-કઈ બાબતોની કાળજી લેશો ?
6. સુદૃઢીકરણ કૌશલ્યનો અર્થ જણાવી સુદૃઢીકરણ કૌશલ્યના ઘટકો સમજાવો.
7. સુદૃઢીકરણનાં માઈકોપાઠનું આયોજન તૈયાર કરો.
8. સારા ઉદાહરણનાં લક્ષણો જણાવો.
9. કા.પા. કૌશલ્યનાં ઘટકો સમજાવો.
10. કા.પા. કાર્ય કૌશલ્યનાં માઈકોપાઠનું આયોજન કરો.
11. સ્પષ્ટીકરણ કૌશલ્યનો અર્થ જણાવો.
12. સ્પષ્ટીકરણ કૌશલ્યનાં ઈચ્છનીય વર્તનોની ચર્ચા કરો.
13. સ્પષ્ટીકરણ કૌશલ્યના અનિચ્છનીય વર્તનોની ચર્ચા કરો.
14. સિમ્યુલેશનનો અર્થ જણાવી તેનું મહત્ત્વ લખો.
15. સિમ્યુલેશનનાં લાભ અને મર્યાદાઓ જણાવો.
16. માઈકોપાઠ અને સેતુપાઠ વચ્ચેનો તફાવત જણાવો.
17. વિજ્ઞાનનાં કોઈ એક મુદ્દા માટે સેતુપાઠનું આયોજન તૈયાર કરો.
18. હેતુઓનાં પ્રકારો જણાવી સામાન્ય હેતુઓની ચર્ચા કરો.
19. વિશિષ્ટ હેતુઓની ઉદાહરણ સાથે ચર્ચા કરો.
20. હેતુકથનની સંરચનામાં ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
21. પાઠ આયોજનનો અર્થ જણાવી તેના ફાયદાઓ લખો.
22. પાઠ આયોજનનાં સોપાનોની ચર્ચા કરો.
23. વિજ્ઞાનના કોઈ એક મુદ્દા માટે પાઠ આયોજન તૈયાર કરો.
24. એકમ આયોજનનો અર્થ જણાવી તેનાં સોપાનોની ચર્ચા કરો.
25. વિજ્ઞાનનાં કોઈ એક એકમ માટે એકમ આયોજનની રૂપરેખા તૈયાર કરો.
26. પાઠ આયોજન અને એકમ આયોજનની તુલના કરો.

---

## સંદર્ભસૂચિ

---

1. Brandwein, waston & Blackwood : A Book of Methods Teaching High School. Science : Harcourt, Brace & World Inc., New York, 1985
2. Chakrabarti, S.K., Audio-Visual Education in India, New Delhi, 1967
3. Das, R.C. : Science Teaching in Schools, Sterling Publishers Private Limited, New Delhi, 1985
4. Green T.L. : The Teaching of Biology in Tropical Secondary Schools, All Man & Sons Ltd., London.
5. Heiss & Others : Mordern Science Teaching : The Mac Millan Co., New York, 1961.
6. કોહલી, બી.કે. : વિજ્ઞાન કૈસે પઢાઈ : વિવેક પબ્લિશર્સ, અમ્બાલા શહર (હરિયાણા) ૧૯૮૬.
7. મહેશ્વરી, વી.કે. : 'વિજ્ઞાન શિક્ષણ', મોડર્ન પબ્લિશર્સ, મેરઠ, ૧૯૮૩
8. રાવત; ડી.એસ. : 'વિજ્ઞાનશિક્ષણ', વિનોદ પુસ્તક મંદિર, આગરા, ૧૯૭૨
9. દેસાઈ, દવે મહેતા : વિજ્ઞાનનું અભિનવ અધ્યાપન; એ.આર. શેઠની કંપની, મુંબઈ, 1972
10. ભાવસાર ડી.એમ. : વિજ્ઞાનનું અભિનવ અધ્યાપન, : ભારત પ્રકાશન, અમદાવાદ.
11. ભાવસાર, લવિંગિયા, ત્રિવેદી : વિજ્ઞાનશિક્ષણ પદ્ધતિ : અનડા બુક ડીપો, અમદાવાદ.
12. પટેલ મો.મ., જયેન્દ્ર, જોષી હ.ઓ., શાહ ભૂપેન્દ્ર, લિખિયા, શૈક્ષણિક ટેકનોલોજી મેસર્સ બી.એસ. શાહ પ્રકાશન, અમદાવાદ-1987-88
13. રાવલ નટુભાઈ વી. અને અન્ય, માર્કોટીચિંગ, નીરવ પ્રકાશન - અમદાવાદ, 2005
14. ગોહેલ કે.ડી. અને સોલંકી એચ.એમ. વિજ્ઞાન પદ્ધતિ-1, નીરવ પ્રકાશન, અમદાવાદ, 2016
15. રાવલ નટુભાઈ વી. અને અન્ય; શિક્ષણની વિસ્તરતી ક્ષિતિજો, નીરવ પ્રકાશન, અમદાવાદ-2014
16. ગોહેલ કેતન ડી. અને સોલંકી એચ.એન. વિજ્ઞાન પદ્ધતિ-2, નીરવ પ્રકાશન, અમદાવાદ, 2016



डॉ. बाबासाहेब आंबेडकर  
ओपन युनिवर्सिटी

ES-111

विज्ञाननुं अध्यापन  
(Teaching of Science)

विभाग

3

विज्ञान शिक्षणनी अध्यापन पद्धतिओ, अભिगमो अने प्रतिमानो

---

अेकम-9 विज्ञान शिक्षणनी अध्यापन पद्धतिओ-1

---

अेकम-10 विज्ञान शिक्षणनी अध्यापन पद्धतिओ-2

---

अेकम-11 विज्ञान शिक्षणना अध्यापन अભिगमो

---

अेकम-12 विज्ञान शिक्षणना अध्यापन प्रतिमानो

---

## ES-111, વિજ્ઞાનનું અધ્યાપન (વિભાગ-૩)

<b>લેખક</b>	
કુ. ઉમા ઠક્કર	વિજ્ઞાન કોલેજ ઓફ એજ્યુકેશન, અમદાવાદ.
<b>પરામર્શક (વિષય)</b>	
ડૉ. રાજેશ રાઠોડ	આઈ. આઈ. ટી. ઈ., ગાંધીનગર.
<b>પરામર્શક (ભાષા)</b>	
ડૉ. કેતન ગોહિલ	શ્રી સી. એચ. શાહ મૈત્રી વિદ્યાપીઠ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશન, સુરેન્દ્રનગર
<b>સંપાદન અને સંયોજન</b>	
પ્રો. (ડૉ.) અજીતસિંહ પી. રાણા	નિયામકશ્રી (શિક્ષણશાસ્ત્ર) ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. અમદાવાદ.
<b>સંયોજન સહાય</b>	
ડૉ. મીના આઈ. રાજપૂત	ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. અમદાવાદ.

પ્રકાશક : કુલસચિવ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ-382481

આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ-2020, નકલ : 600

દ્વિતીય આવૃત્તિ-2021, નકલ : 600

**ISBN : 978-93-5598-084-7**

Copyright © Registrar, Dr. Babasaheb Ambedkar Open University, Ahmedabad.  
December 2020

While all efforts have been made by editors to check accuracy of the content, the representation of facts, principles, descriptions and methods are that of the respective module writers. Views expressed in the publication are that of the authors, and do not necessarily reflect the views of Dr. Babasaheb Ambedkar Open University. All products and services mentioned are owned by their respective copyrights holders, and mere presentation in the publication does not mean endorsement by Dr. Babasaheb Ambedkar Open University. Every effort has been made to acknowledge and attribute all sources of information used in preparation of this Self Learning Material. Readers are requested to kindly notify missing attribution, if any.



---

## ES-III વિજ્ઞાનનું અધ્યાપન

---

### વિભાગ-1 વિજ્ઞાન શિક્ષણનું સ્વરૂપ, નુતન પ્રવાહો અને સહાયક પ્રવૃત્તિઓ

- એકમ-1 વિજ્ઞાન શિક્ષણ : ભૂમિકા
- એકમ-2 વિજ્ઞાન શિક્ષણમાં નુતન પ્રવાહો
- એકમ-3 વિજ્ઞાન શિક્ષણમાં સહાયક પ્રવૃત્તિઓ
- એકમ-4 વિજ્ઞાન શિક્ષણની પ્રયોગશાળા

### વિભાગ-2 વિજ્ઞાન શિક્ષણ અધ્યાપનનું આયોજન

- એકમ-5 માર્કેટીંગિંગ
- એકમ-6 સિમ્યુલેશન
- એકમ-7 ઉદ્દેશ્ય અને હેતુઓ
- એકમ-8 તાસ પાઠ / એકમ આયોજન

### વિભાગ-3 વિજ્ઞાન શિક્ષણની અધ્યાપન પદ્ધતિઓ, અભિગમો અને પ્રતિમાનો

- એકમ-9 વિજ્ઞાન શિક્ષણની અધ્યાપન પદ્ધતિઓ-1
- એકમ-10 વિજ્ઞાન શિક્ષણની અધ્યાપન પદ્ધતિઓ-2
- એકમ-11 વિજ્ઞાન શિક્ષણના અધ્યાપન અભિગમો
- એકમ-12 વિજ્ઞાન શિક્ષણના અધ્યાપન પ્રતિમાનો

### વિભાગ-4 વિજ્ઞાન શિક્ષણમાં મૂલ્યાંકન, અનુબંધ, નિદાન અને ઉપચાર, શૈક્ષણિક સાધનો અને ક્રિયાત્મક સંશોધન

- એકમ-13 વિજ્ઞાન શિક્ષણમાં મૂલ્યાંકન, પ્રશ્નપત્ર સંરચના અને અનુબંધ
- એકમ-14 વિજ્ઞાન શિક્ષણમાં નિદાનાત્મક મૂલ્યાંકન અને ઉપચારાત્મક શિક્ષણ
- એકમ-15 વિજ્ઞાન શિક્ષણના અધ્યાપન માટે શૈક્ષણિક સાધનો
- એકમ-16 વિજ્ઞાન શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધન

## દૂરવર્તી અધ્યયનમાં સ્વ-અધ્યયન અભ્યાસ-સામગ્રીની ભૂમિકા

દૂરવર્તી શિક્ષણ પ્રણાલીમાં અસરકારક સ્વ-અધ્યયન અભ્યાસ-સામગ્રી અનિવાર્ય છે. આ અભ્યાસ-સામગ્રીના લેખકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ એકબીજાથી ઘણાં દૂર અને ક્યારેક તો ક્યારેય ન મળી શકે તેવી સ્થિતિમાં હોવાથી આવી અધ્યયન સામગ્રી સુગમ અને અસરકારક હોવી જરૂરી છે. દૂરવર્તી શિક્ષણ માટેની અભ્યાસ-સામગ્રીમાં વિદ્યાર્થીના બૌદ્ધિક ચિંતનને ઉદ્દીપ્ત કરવાની ક્ષમતા તથા આવશ્યક તમામ અધ્યયન પ્રવૃત્તિઓ હોવી જોઈએ. આ સામગ્રી પાઠ્યક્રમના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓના અનુસંધાને વિદ્યાર્થીને પર્યાપ્ત માર્ગદર્શન આપવા સક્ષમ હોવી જોઈએ. સ્વ-અધ્યયન સામગ્રીમાં અભ્યાસક્રમમાં સૂચિત તમામ બાબતોનો સમાવેશ થાય તે જરૂરી છે.

અસરકારક અધ્યયન સિદ્ધ કરવા માટે અનેક પ્રકારના આયોજનનો ઉપયોગ કરવામાં આવે છે; જેનાથી વિદ્યાર્થી જ્ઞાનોપાર્જન કરી શકે. બૌદ્ધિક અને મનોશારીરિક કૌશલ્યો કેળવી શકે અને વર્તન તથા અભિગમમાં આવશ્યક પરિવર્તનો સાધી શકે. આથી જ વિદ્યાર્થીનું મૂલ્યાંકન પણ પાઠ્યસામગ્રીમાં આવરી લેવામાં આવ્યું છે.

દૂરવર્તી શિક્ષણની સ્વ-અધ્યયન અભ્યાસ સામગ્રીમાં ઉપયોગમાં લેવામાં આવેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સ્વરૂપ તે શિક્ષણના જ્ઞાનાત્મક, ભાવાત્મક કે મનોશારીરિક હેતુમાંથી કયા હેતુને સંલગ્ન છે? તેના પર આધારિત છે. આ હેતુઓ ભવિષ્યમાં અનુક્રમે જ્ઞાન, બૌદ્ધિક કૌશલ્યો અને મનોશારીરિક કૌશલ્યોની ઉપલબ્ધિમાં પરિણમે છે. વિદ્યાર્થીએ મેળવેલ જ્ઞાનની પ્રાપ્તિ, ઉપયોગ અને અભિવ્યક્તિ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય. વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનનો અને અનુભવોનો આધાર લઈને રચવામાં આવેલ શિક્ષણ સામગ્રી દ્વારા બૌદ્ધિક કૌશલ્યના હેતુને સિદ્ધ કરી શકાય છે અને તેના દ્વારા નવીન જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત થાય છે.

અભ્યાસ-સામગ્રીમાં સ્વાધ્યાય પ્રોજેક્ટ અને પ્રતિપૂષ્ટિ(Feedback)ના સ્વરૂપે અભ્યાસનું આયોજન જરૂરી છે. શારીરિક કૌશલ્ય સંબંધિત શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ચિત્રાત્મક રજૂઆત હોવી જોઈએ અને ત્યારબાદ ઊચિત અભ્યાસનું આયોજન હોવું જોઈએ. વર્તન અને અભિગમમાં પરિવર્તન માટે આયોજિત શિક્ષણ પ્રવૃત્તિઓ રસ જન્માવે તેવી તથા આ પરિવર્તન દ્વારા થતાં લાભ અને તેની જરૂરિયાતને પ્રતિબિંબિત કરે તેવી હોવી જોઈએ. ત્યાર પછી નવાં અભિગમોને અપનાવવાની અને તે સંબંધિત પ્રક્રિયાના યોગ્ય અભ્યાસનું ઊચિત આલેખન થવું જોઈએ.

## દૂરવર્તી શિક્ષણની ભૂમિકા.

પ્રત્યક્ષ અધ્યાપનમાં જોવા મળતી પ્રત્યાયનની વિશેષતાઓ; જેવી કે અંતરાલાપ, પૂર્વઅભિસંધાન, યોગ્ય સ્થાને વિરામ, આરોહ-અવરોહ, ભાવ-ભંગીમાં, સ્વરભાર વગેરે દૂરવર્તી અધ્યયનમાં ઉપલબ્ધ નથી. આ ઉણપ વિશેષતઃ મુદ્રિત સાહિત્યમાં (લેખિત સાહિત્યમાં) જોવા મળે છે. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના વ્યવહારની આ ખૂટતી કડીને જોડવા માટે જ દૂરવર્તી સ્વ-અધ્યયન સામગ્રીમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. માટે જ આવી પ્રવૃત્તિઓનું આયોજન વૈકલ્પિક નહીં; પરંતુ અનિવાર્ય છે.

સ્વ-અધ્યયન અભ્યાસ-સામગ્રીને નાના એકમોમાં વિભાજિત કરીને શિક્ષણના ઉત્તમ સાધન તરીકે વિકસાવવાની સંકલ્પના છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વૈવિધ્ય દ્વારા શિક્ષણના વિવિધ ક્ષેત્રના હેતુઓ સિદ્ધ થાય તેવો પ્રયત્ન કરવાનો છે.

દૂરવર્તી શિક્ષણની સ્વ-અધ્યયન સામગ્રીનું આયોજન પૂર્વનિશ્ચિત શૈક્ષણિક નીપજને ધ્યાનમાં લઈને કરવાનું હોવાથી તેના હેતુઓ અને ધ્યેયો નિશ્ચિત હોય છે. વળી અધ્યેતાઓ દૂરસ્થ હોવાથી આ સામગ્રી દ્વારા તેઓ નિશ્ચિત અધ્યયન પ્રવૃત્તિઓમાં સંલગ્ન રહે તેવું આયોજન કરવામાં આવે છે. જેથી અધ્યેતાઓ સંબંધિત સંકલ્પનાઓને બરાબર સમજી શકે. સ્વ-અધ્યયન સામગ્રીમાં સાથે સંકળાયેલ સ્વાધ્યાયો, પ્રાયોગિક કાર્યો, પ્રવૃત્તિઓ અને પ્રકલ્પોનો પણ આ જ હેતુ છે. આ સામગ્રી માટે ઊચિત શૈક્ષણિક પ્રવૃત્તિઓની ઉદાહરણરૂપ સૂચિ ઘણી મોટી હોઈ શકે. આ સંદર્ભે શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીને અભિપ્રેરિત કરે છે, માર્ગદર્શન આપે છે અને વિદ્યાર્થીની પ્રગતિ અને પ્રદર્શનનું સતત માપન-મૂલ્યાંકન પણ કરે છે.



: રૂપરેખા :

- 9.1 પ્રસ્તાવના
  - 9.2 ઉદ્દેશો
  - 9.3 અધ્યાપન પદ્ધતિ
    - 9.3.1 પ્રસ્તાવના
    - 9.3.2 અધ્યાપન પદ્ધતિની સંકલ્પના
    - 9.3.3 અધ્યાપન પદ્ધતિઓના પ્રકારો
    - 9.3.4 અધ્યાપન પદ્ધતિઓનું મહત્ત્વ
    - 9.3.5 અધ્યાપન પદ્ધતિઓની મર્યાદાઓ
  - 9.4 વ્યાખ્યાન (કથન) (પ્રવચન) પદ્ધતિ
    - 9.4.1 પ્રસ્તાવના
    - 9.4.2 વ્યાખ્યાન પદ્ધતિની લાક્ષણિકતાઓ
    - 9.4.3 વ્યાખ્યાન પદ્ધતિ ઉપયોગી બનાવવાના સૂચનો
    - 9.4.4 વ્યાખ્યાન પદ્ધતિના લાભ
    - 9.4.5 વ્યાખ્યાન પદ્ધતિની મર્યાદાઓ
  - 9.5 નિદર્શન (દાર્શનિક) પદ્ધતિ
    - 9.5.1 પ્રસ્તાવના
    - 9.5.2 સારા નિદર્શન માટે ધ્યાનમાં રાખવાની બાબતો
    - 9.5.3 નિદર્શન પદ્ધતિનાં લાભ
    - 9.5.4 નિદર્શન પદ્ધતિની મર્યાદાઓ
  - 9.6 પ્રયોગ પદ્ધતિ
    - 9.6.1 પ્રસ્તાવના
    - 9.6.2 પ્રયોગ પદ્ધતિનો પ્રકાર
    - 9.6.3 પ્રયોગ કાર્ય આપવાનું ધ્યેય
    - 9.6.4 પ્રયોગ પદ્ધતિનો અસરકારક ઉપયોગ
    - 9.6.5 પ્રયોગ પદ્ધતિના ફાયદા
    - 9.6.6 પ્રયોગ પદ્ધતિની મર્યાદાઓ
  - 9.7 સારાંશ
  - 9.8 સ્વાધ્યાય
-

---

## 9.1 પ્રસ્તાવના :

“Teaching is not everybody’s cup of tea” વિજ્ઞાન શિક્ષણની પદ્ધતિઓનો અભ્યાસ કરતા પહેલાંએ જાણવું જરૂરી છે કે શા માટે વિજ્ઞાનના અધ્યાપનની પદ્ધતિઓ ? કદાચ ખૂબ ઉંડું વિજ્ઞાનનું જ્ઞાન ધરાવતો શિક્ષક સારું ન પણ ભણાવી શકે કે ખૂબ સારો સંશોધક પણ એક અસરકારક શિક્ષક ન પણ પૂરવાર થઈ શકે. પરંતુ જો શિક્ષક વિજ્ઞાન અધ્યાપનની વિવિધ પદ્ધતિઓનો જાણકાર હોય તો તેના શિક્ષણકાર્યમાં તેની અસરકારકતા ચોક્કસ જોવા મળે. કેટલાક શિક્ષકો શરૂઆતથી જ સારું શિક્ષણકાર્ય કરી શકે છે. જ્યારે કેટલાક શિક્ષકોને મૂંઝવણનો અનુભવ થાય છે. ત્યારે આ મૂંઝવણ દૂર કરવા અને અસરકારક વિદ્યાર્થી કેન્દ્રી અધ્યાપન કાર્ય કરવા માટે શિક્ષકે વિજ્ઞાનના અધ્યાપનની વિવિધ શૈક્ષણિક પદ્ધતિઓથી પરિચિત થવું ખૂબ અનિવાર્ય છે. વિવિધ અધ્યાપન પદ્ધતિઓના ઉપયોગ દ્વારા શિક્ષક અધ્યાપનકાર્યને રસમય બનાવી શકે છે. માટે દરેક શિક્ષકે વિજ્ઞાન શિક્ષણની બધી પદ્ધતિઓનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરી તે દરેક પદ્ધતિઓના ફાયદાનો લાભ પોતાના અધ્યાપન કાર્યમાં વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અવશ્ય કરવો જોઈએ.

- અહીં અધ્યાપન પદ્ધતિની સંકલ્પના, પ્રકારો, મહત્વ, મર્યાદાઓ તેમજ વ્યાખ્યાન પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, અને પ્રયોગ પદ્ધતિની વિસદ્ધમાં ચર્ચા કરવામાં આવી છે.

---

## 9.2 ઉદ્દેશો :

આ એકમ પૂર્ણ કર્યા પછી પ્રશિક્ષણાર્થીઓ નીચેની બાબતોમાં સક્ષમ બની શકશે.

- અધ્યાપન પદ્ધતિની સંકલ્પનાનું વર્ણન કરી શકશે.
- અધ્યાપન પદ્ધતિઓના પ્રકારો જાણી શકશે.
- અધ્યાપન પદ્ધતિઓનું મહત્વ અને મર્યાદાઓ ઓળખી શકશે.
- વ્યાખ્યાન પદ્ધતિનું વર્ણન કરી શકશે.
- વ્યાખ્યાન પદ્ધતિ ઉપયોગી બનાવવાના સ્પષ્ટ સુચનો કરી શકશે.
- વ્યાખ્યાન પદ્ધતિના લાભ અને મર્યાદાઓનું વર્ણન કરી શકશે.
- અસરકારક નિદર્શન માટે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે માહિતગાર થશે.
- નિદર્શન પદ્ધતિના લાભ અને મર્યાદાઓ સમજી શકશે.
- પ્રયોગ પદ્ધતિના પ્રકાર વિશે માહિતગાર થશે.
- પ્રયોગ આપવાનું ધ્યેય અને પ્રયોગના અસરકારક ઉપયોગ વિશે સ્પષ્ટતા મેળવશે.
- પ્રયોગ પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ જાણી શકશે.

---

## 9.3 અધ્યાપન પદ્ધતિ :

### 9.3.1 પ્રસ્તાવના :

શિક્ષક-પ્રશિક્ષણમાં આપણે પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, અભિગમ, શિક્ષણ પ્રતિમાન જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. ક્યાંક તેનો ઉપયોગ એકમેકના પર્યાય તરીકે કરીએ છીએ. શિક્ષણ પદ્ધતિની વ્યાખ્યા આ મુજબ આપી શકાય. “શિક્ષણના ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા શિક્ષક દ્વારા વર્ગખંડમાં આપવામાં આવતા અનુભવોની હારમાળા એટલે શિક્ષણ પદ્ધતિ.” વધારે સ્પષ્ટતા કરીએ તો વિષયવસ્તુના નાના-નાના ભાગોને ક્રમાનુસાર વિવિધ સોપાનોમાં વિભાજિત કરી તેને અનુરૂપ શિક્ષણ; અનુભવો પૂરા પાડવાની પ્રક્રિયા. શિક્ષણ પદ્ધતિની પસંદગી ઘણા પરિબળો ઉપર આધારિત છે. તેમાં વિષય અને વિષયાંગ ઉપરાંત વિદ્યાર્થીઓની માનસિક ક્ષમતા, રસ, પૂર્વજ્ઞાન વગેરે મહત્વના છે. કેટલીક શિક્ષણ પદ્ધતિઓ સામાન્ય છે જે ઘણા વિષયો શીખવવા માટે ઉપયોગી છે જ્યારે કેટલીક પદ્ધતિઓ ચોક્કસ વિષય કે વિષયાંગ પૂરતી મર્યાદિત છે.

### 9.3.2 અધ્યાપન પદ્ધતિની સંકલ્પના :

કેળવણીની સમગ્ર પ્રક્રિયાના ત્રણ પાયાના પ્રશ્નો, શા માટે શીખવવું ? શું શીખવવું ? અને કઈ રીતે શીખવવું ? જેમાંથી 'કઈ રીતે શીખવવું ?' એ શિક્ષણ પદ્ધતિનો નિર્દેશ કરે છે. વર્ગખંડમાં શિક્ષણકાર્ય કરતો શિક્ષક તેના શિક્ષણકાર્ય અંગે ચોક્કસ પદ્ધતિ, ચોક્કસ હેતુ અંગે વિચારીને શિક્ષણકાર્ય કરે તો શિક્ષકની રજૂઆત અસરકારક બને છે.

શિક્ષણના હેતુઓ વિદ્યાર્થીઓમાં શિક્ષણને અંતે કેવું પરિવર્તન લાવવું છે. તે દર્શાવે છે. આ હેતુ સિદ્ધ કરવા માટે વિદ્યાર્થીઓને શિક્ષણની ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર કરવા પડે છે. માટે શિક્ષણની પ્રક્રિયામાંથી વિદ્યાર્થીને પસાર કરવા માટે જે વ્યવસ્થિત રીત અપનાવવામાં આવે તેને શિક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. વિદ્યાર્થીને શૈક્ષણિક પ્રક્રિયામાંથી વ્યવસ્થિત પસાર કરવાનું એક સાધન એ શિક્ષણ પદ્ધતિ છે. શિક્ષણકાર્યને અંતે જે હેતુ સિદ્ધ કરવાનો હોય તે પ્રકારની પ્રક્રિયામાંથી બાળકને પસાર કરવા યોગ્ય શિક્ષણ પદ્ધતિ અપનાવી પડે છે.

શિક્ષણ પદ્ધતિનો વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઈએ. વર્ગ, વિષયવસ્તુ, વર્ગનું વાતાવરણ, બાળકોની ક્ષમતા વગેરેને ધ્યાનમાં રાખી શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. શિક્ષણની પ્રક્રિયા ત્યારે જ થઈ શકે જ્યારે શીખનાર સક્રિય હોય.

દરેક શિક્ષકે બધી પદ્ધતિઓનો અભ્યાસ કરવો જોઈએ અને દરેક પદ્ધતિના ફાયદાઓનો લાભ ઉઠાવવો જોઈએ. આમ, વિજ્ઞાન વિષયમાં અધ્યાપન પદ્ધતિઓ અગત્યનો ભાગ ભજવે છે.

### 9.3.3 અધ્યાપન પદ્ધતિઓના પ્રકારો :

અધ્યાપન પદ્ધતિઓના ત્રણ પ્રકાર છે.

#### 1. અધ્યાપન કેન્દ્રી પદ્ધતિઓ :

આ પદ્ધતિમાં અધ્યાપકનું કાર્ય જ મહત્ત્વ ધરાવે છે. અધ્યાપક વધુ સક્રિય હોય છે. આવી બે પદ્ધતિ છે. (અ) પ્રવચન કે વ્યાખ્યાન પદ્ધતિ અને (બ) દાર્શનિક કે નિદર્શન પદ્ધતિ.

#### 2. અધ્યાપક-અધ્યેતાકેન્દ્રી પદ્ધતિઓ :

આ પદ્ધતિમાં અધ્યાપક અને અધ્યેતા બંને સક્રિય અને સહભાગી બને છે. માટે આ પદ્ધતિને અધ્યાપક-અધ્યેતાકેન્દ્રી પદ્ધતિ કહેવાય છે. તેમાં કથન-ચર્ચા પદ્ધતિનો સમાવેશ થાય છે.

#### 3. અધ્યેતાકેન્દ્રી પદ્ધતિઓ :

આ પદ્ધતિમાં કેન્દ્રસ્થાને અધ્યેતા હોય છે. અધ્યેતા વધુ સક્રિય હોય છે. તેમાં અધ્યેતાનું કાર્ય અને પ્રવૃત્તિઓ મુખ્ય હોય છે. અધ્યાપક માત્ર માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવે છે. માટે આ પદ્ધતિ અધ્યેતાકેન્દ્રી પદ્ધતિ છે. તેમાં આ પદ્ધતિનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, જૂથચર્ચા પદ્ધતિ, સ્વાધ્યાય પદ્ધતિ.

### 9.3.4 અધ્યાપન પદ્ધતિઓનું મહત્ત્વ :

- અધ્યાપન પદ્ધતિઓનું જ્ઞાન શિક્ષકમાં આત્મવિશ્વાસ વધારે છે.
- અધ્યાપન પદ્ધતિઓના જ્ઞાનથી શિક્ષકમાં અધ્યાપન કાર્યની કુશળતા આવે છે.
- અધ્યાપન પદ્ધતિઓનું જ્ઞાન નવા અધ્યાપકની વર્ગ અધ્યાપનની મૂંઝવણ દૂર કરે છે અધ્યાપન પદ્ધતિઓના જ્ઞાન દ્વારા અધ્યાપક પોતાના શિક્ષણકાર્યને રોચક અને રસદાયી બનાવી શકે છે.
- વિવિધ અધ્યાપન પદ્ધતિઓમાં શિક્ષકે ઘણીવાર શૈક્ષણિક સાધનસામગ્રીનો ઉપયોગ કરવો પડે છે. જેનાંથી અધ્યેતાને શિક્ષણમાં રસ ઉત્પન્ન થાય છે.
- વિવિધ અધ્યાપન પદ્ધતિઓ જાણનાર શિક્ષક, જો એક પદ્ધતિના ઉપયોગથી હેતુ સિદ્ધ ન થાય તો અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરી હેતુ સિદ્ધ કરી શકે છે.
- અધ્યાપનની વિવિધ પદ્ધતિઓના ઉપયોગ દ્વારા અધ્યેતામાં વિવિધ બાબતોનો વિકાસ થાય છે.

જેમ કે વિવિધ કૌશલ્યો કેળવવા, અવલોકન શક્તિ, નિર્ણય શક્તિ, તાર્કિક ચિંતન, તુલના કરવી, સામાન્યીકરણ કરવું વગેરે જેવા અનેક ગુણોનો વિકાસ કરી શકાય છે.

### 9.3.5 અધ્યાપન પદ્ધતિઓની મર્યાદાઓ :

- શિક્ષક વિષયાંગને સંલગ્ન યોગ્ય શિક્ષણ પદ્ધતિ ન વાપરે તો શિક્ષણકાર્ય પર તેની માઠી અસર પડે છે.
  - અધ્યેતાકેન્દ્રી પદ્ધતિઓમાં શિક્ષક યોગ્ય કાર્ય ન કરે તો શિક્ષણ અસરકારક થતું નથી. અધ્યેતાકેન્દ્રી પદ્ધતિમાં સમયનો વધુ વ્યય થાય છે.
  - અધ્યેતાકેન્દ્રી પદ્ધતિમાં અધ્યેતા સક્રિય ન હોય તો શિક્ષણ પદ્ધતિની અસરકારકતા ઘટે છે.
  - અધ્યાપન પદ્ધતિ ખૂબ લાંબી હોય તો તેનાથી કંટાળો ઉપજે છે. અને અસરકારકતા ઓછી થાય છે.
  - કોઈ વાર શિક્ષકને સંસ્થા દ્વારા યોગ્ય સહકાર ન મળે તો કેટલીક પદ્ધતિનો ઉપયોગ થઈ શકતો નથી.
  - કુશળ અને અનુભવી શિક્ષક જ વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી શિક્ષણકાર્ય કરાવી શકે છે.
  - જો કોઈ પદ્ધતિઓના ઉપયોગ માટે પૂર્વ તૈયારીની જરૂર હોય તો તેના માટે શિક્ષક યોગ્ય સમય ફાળવી શકતા નથી.
  - વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય માટે જણાવેલ અધ્યાપન પદ્ધતિઓ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું.
1. વ્યાખ્યાન (કથન) (પ્રવચન) પદ્ધતિ
  2. નિદર્શન (દાર્શનિક) પદ્ધતિ
  3. પ્રયોગ પદ્ધતિ
  4. પ્રોજેક્ટ (પ્રકલ્પ) (યોજના) પદ્ધતિ
  5. જૂથચર્ચા પદ્ધતિ
  6. સ્વાધ્યાય પદ્ધતિ

### 9.4 વ્યાખ્યાન (કથન) (પ્રવચન) પદ્ધતિ :

#### 9.4.1 પ્રસ્તાવના :

પ્રાચીન સમયમાં જ્યારે છાપવાનાં યંત્રો શોધ્યા ન હતા, હસ્તલિખિત પ્રતો ઘણી ઓછી જોવા મળતી ત્યારે વ્યાખ્યાન પદ્ધતિ ઉપયોગી હતી. વ્યાખ્યાન પદ્ધતિને કથન પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં શિક્ષક કોઈ મુદ્દા પર પોતાનું વ્યાખ્યાન આપે છે. જેમાં વિદ્યાર્થી નિષ્ક્રિય બનીને સાંભળે છે. માટે તેની તર્કશક્તિ, અવલોકન શક્તિ વગેરે જેવી બાબતોનો વિકાસ થતો નથી. તે મોટેભાગે કોલેજોમાં અને જ્યાં ઉચ્ચક્ષાત્રના વર્ગો હોય તેવી માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉપયોગી થઈ પડે છે. જેમાં વિષયવસ્તુના કોઈક મુદ્દા પર માહિતી આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ પોતાની જાતે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત થતાં નથી. તેઓ પ્રાપ્ત કરેલ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે પણ શક્તિમાન થતા નથી. આ પદ્ધતિ એકમાર્ગી છે. જેમાં શિક્ષક ફક્ત બોલે છે. અધ્યેતાઓ માત્ર સાંભળે છે અને થોડીવારમાં તેઓ થાકી જાય છે તેથી સમગ્ર તાસ દરમ્યાન તેમનું ધ્યાન કેન્દ્રિત રહેતું નથી અને તેઓ બે ધ્યાન બને છે. આવા વખતે તેઓ અધ્યાપકનું કેટલુંક કથન સાંભળવાનું ચૂકી જાય છે અને તેમની જ્ઞાન પ્રાપ્તિમાં કચાશ રહી જાય છે. વિદ્યાર્થીને સમજ પડે છે કે નહિ તે આ પદ્ધતિમાં જોવામાં આવતું નથી. માટે આ પદ્ધતિને માત્ર શિક્ષકકેન્દ્રી પદ્ધતિ પણ કહેવામાં આવે છે.

વિજ્ઞાન શિક્ષણમાં આ પદ્ધતિનો બહુ ઓછો ઉપયોગ થાય છે, પણ જીવવિજ્ઞાનમાં કેટલાક માહિતીલક્ષી



એકમો માટે વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ અનિવાર્ય છે. આ પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે શિક્ષક વચ્ચેવચ્ચે પ્રશ્નો પૂછે, ચિત્રો, નમૂનાઓ, ચાર્ટ્સ વગેરેનો ઉપયોગ કરે તો વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચી શકાય અને વિદ્યાર્થીને રસ પડે છે.

#### 9.4.2 વ્યાખ્યાન પદ્ધતિની લાક્ષણિકતાઓ :

- શિક્ષક માટે સરળ, સંક્ષિપ્ત અને આકર્ષક છે.
- આ પદ્ધતિ ઉપલા વર્ગો માટે ઉપયોગી છે.
- ઓછા સમયમાં વધારે માહિતી આપી શકાય છે.
- ઘણા વિદ્યાર્થીઓ સાંભળે છે અને નોંધ તૈયાર કરે છે.
- શિક્ષક પોતાના વિચારોનો પ્રવાહ જાળવી શકે છે.
- શિક્ષક ઘણી બધી નવી વસ્તુઓ અંગે કહી શકે છે.
- શિક્ષક માટે અનુકૂળ પદ્ધતિ છે.
- શિક્ષક હંમેશા જાગૃત રહે છે.
- એક જ સમયે ઘણા બધા વિદ્યાર્થીઓને શીખવી શકાય છે.

#### 9.4.3 વ્યાખ્યાન પદ્ધતિ ઉપયોગી બનાવવાના સૂચનો :

- જ્યાં અને જ્યારે જરૂર પડે ત્યારે કા.પા. કાર્યનો ઉપયોગ કરવો જોઈએ.
- વિષયાંગને અનુરૂપ શૈક્ષણિક સાધનોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
- સમયે સમયે પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓને સક્રિય રાખવા જોઈએ.
- આ પદ્ધતિના ઉપયોગ દરમ્યાન વિદ્યાર્થીઓને નોંધ તૈયાર કરવાની તાલીમ આપવી જોઈએ.
- વ્યાખ્યાનને અંતે વિદ્યાર્થીઓને થોડા પ્રશ્નો પૂછી, મેળવેલ ઉત્તરોને આધારે શિક્ષક નક્કી કરી શકે છે કે વિદ્યાર્થીઓને સમજ પ્રાપ્ત થઈ છે કે નહિ.
- પ્રવચન સ્પષ્ટ અવાજમાં બધા વિદ્યાર્થીઓ સમજી શકે તેવી રીતે હેતુપૂર્વક આપવું જોઈએ.
- ભારે અલંકારિત અથવા શબ્દોનો ઉપયોગ ટાળવો જોઈએ.

#### 9.4.4 વ્યાખ્યાન પદ્ધતિના લાભ :

- જ્યારે આપણે પાઠ્યક્રમ ઝડપથી પૂરો કરવાનો હોય, કેટલાક નવીન અને કઠિન એકમો શીખવવાના હોય, વિદ્યાર્થીઓને ફક્ત માહિતી આપવાની હોય, કેટલીક કઠિન સૈદ્ધાંતિક બાબતોની ચર્ચા કરવાની હોય કે જેનું નિદર્શન શક્ય ન હોય, પ્રાયોગિક કાર્ય થઈ ગયું હોય અથવા કરવાનું હોય તો તેની માહિતી આપવાની હોય, થઈ ગયેલા પાઠોનું પુનરાવર્તન કરવાનું હોય, કોઈ એકમની પૂર્વભૂમિકા તૈયાર કરવાની હોય, વૈજ્ઞાનિકના જીવન-ચરિત્રની રજૂઆત કરવાની હોય ત્યારે વ્યાખ્યાન પદ્ધતિ ઉપયોગી છે. શિક્ષક માટે વ્યાખ્યાન તૈયાર કરવું સરળ પડે છે.
- અસરકારક વ્યાખ્યાન તેજસ્વી અધ્યેતાઓને અભ્યાસમાં પ્રેરણાદાયી બને છે. વિવિધ કથનશૈલી દ્વારા શીખવવાના મુદ્દાને રસપ્રદ બનાવી શકાય છે. ઉપલા વર્ગોમાં અધ્યેતાઓ અધ્યાપકના વ્યાખ્યાનની સાથે સાથે જ ઝડપથી નોંધ કરવાનું કૌશલ્ય વિકસાવી શકે છે.
- આ પદ્ધતિમાં મુખ્યત્વે કથન હોય છે આથી સમયનો વ્યય થતો નથી. વ્યાખ્યાન સતત ચાલે છે. શિક્ષણકાર્ય ઝડપી બને છે. આ પદ્ધતિના ક્રમશઃ ઉપયોગ દ્વારા અધ્યાપક સારો વક્તા બની શકે છે.
- લાંબો અભ્યાસક્રમ નિર્ધારિત સમયમાં પૂરો કરી શકાય છે. માહિતી પ્રધાન એકમો માટે વ્યાખ્યાન પદ્ધતિ અતિ આવશ્યક છે. અધ્યેતાઓને ચિંતન-શ્રવણની યોગ્ય તાલીમ આપી શકાય છે.

- વિદ્યાર્થીઓ માનસિક રીતે અત્યંત સક્રિય રહે છે. અધ્યાપક સક્રિય રહી અસરકારક પ્રવચન કરે તો વર્ગ વ્યવસ્થા જળવાઈ રહે છે.
- એક જ તાસમાં વધુ માહિતી આપી શકાય છે. અધ્યાપક વિષયવસ્તુને ક્રમશઃ સંક્ષિપ્તમાં રજૂ કરી શકે છે. અધ્યાપક પ્રવચનમાં સાતત્યતા, સળંગસૂત્રતા જાળવી શકે છે.
- પ્રભાવી વ્યાખ્યાન અને હસ્તકૌશલ્યને આધારે અધ્યાપક અધ્યેતાઓને આકર્ષી શકે છે.

#### 9.4.5 વ્યાખ્યાન પદ્ધતિની મર્યાદાઓ :

- આ પદ્ધતિ શિક્ષકકેન્દ્રી હોવાને કારણે વિદ્યાર્થી શિક્ષક વચ્ચે આંતરક્રિયા સંભવિત નથી. જેથી વિદ્યાર્થીઓ નિષ્ક્રિય શ્રોતા બની રહે છે.
- શિક્ષકો મોટેભાગે વ્યાખ્યાન તૈયાર કરવા માટે અન્ય સંદર્ભ સાહિત્યનો ઉપયોગ નહિવત્ કરતા હોવાથી વિદ્યાર્થીઓને શિક્ષણની રજૂઆતમાં કશી નવીનતા લાગતી નથી.
- આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને તૈયાર વિષયવસ્તુ મળતું હોવાથી તેમને વિશિષ્ટ અનુભવો પ્રાપ્ત થતા નથી. જે જ્ઞાન આપવામાં આવે છે તે ક્ષણિક હોય છે.
- આ પદ્ધતિ યાદશક્તિ ઉપર વધારે ભાર મૂકતી હોવાથી વિદ્યાર્થીઓની વિષયવસ્તુને ગોખવાનીવૃત્તિ પ્રબળ બને છે.
- આ પદ્ધતિ નીચલા વર્ગો માટે બિનમનોવૈજ્ઞાનિક છે. નીચલા વર્ગોમાં શિક્ષકનું પ્રવચન જો તેમની કક્ષા પ્રમાણેનું હોય તો આ પદ્ધતિ નિષ્ફળ જાય છે.
- તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી જગ્યામાં જ લખો.

1. અધ્યાપન પદ્ધતિના કેટલા પ્રકાર છે ? ક્યાં ક્યાં ?

.....

.....

.....

.....

.....

.....

2. વ્યાખ્યાન પદ્ધતિ એટલે શું ?

.....

.....

.....

.....

.....

.....

3. વ્યાખ્યાન પદ્ધતિના કોઈ પણ બે લાભ જણાવો.

.....

.....

.....

.....

.....

.....

---

## 9.5 નિદર્શન (દાર્શનિક) પદ્ધતિ :

---

### 9.5.1 પ્રસ્તાવના :

નિદર્શન પદ્ધતિ અતિસ્વીકૃત અને સરળ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આંતરક્રિયા કરી શકાય છે. નીચલા વર્ગોમાં વિદ્યાર્થીની ઉંમર સાધનો વાપરવા જેટલી પરિપક્વ ના હોય અથવા બધા વિદ્યાર્થીઓને આપી શકાય એટલા પૂરતા સાધનો ના હોય અથવા ઉપલા વર્ગમાં પ્રયોગ જોખમકારક હોય ત્યારે શિક્ષક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરે છે.

નિદર્શન પદ્ધતિમાં વિદ્યાર્થીઓએ કાળજીપૂર્વકનું અવલોકન કરવાનું હોય છે. કારણ કે વિદ્યાર્થીઓને પ્રયોગના દરેક પગથિયાનું વર્ણન કરવું પડે છે અને તેના પરથી કેટલાક તારણો કાઢવા પડે છે. નિદર્શન પદ્ધતિમાં લીધેલ સમસ્યા પર વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેના પર વર્ગમાં કેટલાક અનુમાનો તારવવા પડે છે. નિદર્શન પદ્ધતિમાં વિદ્યાર્થી સક્રિય ભાગ લેનાર બને છે જેથી તેમની અવલોકનશક્તિ, નિર્ણયશક્તિ અને તર્કશક્તિનો યોગ્ય વિકાસ થાય છે.

આ પદ્ધતિમાં શિક્ષક પોતે પ્રયોગ કરે છે અને કાર્ય કરીને નિયમ તારવે છે, જેનો વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ અનુભવ કરે છે, અને પછી તેનો સ્વીકાર કરે છે, ત્યારે શિક્ષક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે એમ કહી શકાય. જો શિક્ષક પોતાના કથનને સ્પષ્ટ કરવા કોઈ સાધનનો આશ્રય લે ત્યારે તેને નિદર્શન ન કહી શકાય, પરંતુ જ્યારે નિદર્શનને કેન્દ્રમાં રાખી પ્રશ્નોત્તરી કરે, નમૂનો બતાવે ચાર્ટનો ઉપયોગ કરે, સાદુ કે ક્રિયાત્મક મોડેલ બતાવીને સમજાવે ત્યારે તો નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરે છે તેમ કહેવાય.

વ્યાખ્યાન પદ્ધતિમાં શિક્ષક બોલે છે અને વિદ્યાર્થીઓ મૂક શ્રોતા બની સાંભળે છે. માટે સારી પદ્ધતિ એ છે કે જેમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની શિક્ષણ પ્રક્રિયામાં બંને ભાગીદાર હોય. જેના દ્વારા એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે જેથી બાળકનો સારી રીતે વિકાસ થાય. આ પ્રકારની ઉત્તમ પરિસ્થિતિનું નિર્માણ દાર્શનિક - નિદર્શન પદ્ધતિમાં થાય છે. બીજી રીતે કહીએ તો આ પદ્ધતિમાં શિક્ષક ખરેખર અધ્યાપનનું કાર્યકર છે. વિજ્ઞાન શિક્ષણ માટે આ ખૂબ જ અગત્યની પદ્ધતિ છે. વિજ્ઞાન શિક્ષણમાં અધ્યાપન કાર્ય કરાવતી વખતે શિક્ષક વર્ગ સમક્ષ કોઈ પ્રયોગ કરી બતાવે, કોઈ મોડેલ, ચાર્ટ, ચિત્રો, ફોટોગ્રાફ, LCD પ્રોજેક્ટર દ્વારા PPT, વિડિયો, વગેરેના ઉપયોગ દ્વારા અધ્યાપન કાર્ય કરે, જોખમી પ્રયોગો તથા કિંમતી સાધનોનો ઉપયોગ થતો હોય એવા પ્રયોગો દર્શાવવામાં આ પદ્ધતિ ખૂબ અસરકારક છે. આમ, વિવિધ શૈક્ષણિક સાધન-સામગ્રી દર્શાવી નિદર્શન પદ્ધતિથી વિજ્ઞાન શિક્ષણ ખૂબ જ અસરકારક રીતે કરી શકાય છે.

### 9.5.2 સારા નિદર્શન માટે ધ્યાનમાં રાખવાની બાબતો :

- પ્રયોગના નિદર્શન દરમ્યાન વર્ગના બધા વિદ્યાર્થીઓ સ્પષ્ટ રીતે પ્રયોગ જોઈ શકે તે પ્રમાણે આયોજન કરવું જોઈએ.
- નાના વર્ગ માટે શિક્ષકે દાર્શનિક ટેબલ પર પ્રયોગ કરવો જેથી તેની આજુબાજુ વિદ્યાર્થીઓ ઊભા રહી પ્રયોગનું અવલોકન કરી શકે.
- શિક્ષકે પ્રયોગ શરૂ કરતા પહેલા પ્રયોગની યોગ્ય ભૂમિકા બાંધી પછી જ પ્રયોગ કરવો.
- પ્રયોગનું નિદર્શન જ્યાં કરવાનું છે તે દાર્શનિક ટેબલ પર સંપૂર્ણ પ્રકાશ રહે તેવી ગોઠવણી કરવી.
- નિદર્શન માટેના સાધનો સ્પષ્ટ રીતે અવલોકી શકાય તેવા મોટા હોવા જોઈએ.
- નિદર્શન શરૂ થાય તે પહેલાં પ્રયોગનાં બધાં સાધનો યોગ્ય ક્રમમાં વ્યવસ્થિત મૂકવા જોઈએ. ઉપયોગમાં લેવાના પ્રયોગનાં સાધનો ટેબલ પર ડાબી બાજુએ મૂકવા. તે જોઈ શકાય તે રીતે ક્રમમાં ગોઠવવા. સાધનોનો ઉપયોગ પૂરો થતાં તેને જમણી બાજુએ ટેબલ પર મૂકવા જોઈએ.

- જ્યારે ઘણી વસ્તુઓ બતાવવાની હોય ત્યારે તે બધી એક સાથે ટેબલ પર મૂકવી નહીં. જરૂર પ્રમાણે એક પછી એક લઈ બતાવવી. સામાન્યક્રમ અને સુઘડતા એ દાર્શનિક કાર્ય માટે ખાસ આવશ્યક બાબત છે. બિનજરૂરી પુસ્તકો કે સાધનો દાર્શનિક ટેબલ પર રાખવા નહીં.
- પ્રયોગ સફળ થાય તે માટે શિક્ષકે પૂરતી કાળજી લેવી. તે માટે પૂરતી તૈયારી કરવી. અગાઉ પ્રયોગ કરી તેની ચકાસણી કરી લેવી. સમયને પણ ધ્યાનમાં રાખવો. પ્રયોગ કરતા કદાચ કોઈ સાધન તૂટી જાય તો અગાઉથી વધારાના સાધનની વ્યવસ્થા રાખવી. પ્રયોગ નિષ્ફળ જાય તો કારણો શોધી, ફરીથી નિદર્શન કરવું.
- અપૂરતાં અને ખામીયુક્ત સાધનોની શિક્ષકે ફરિયાદ કરવી નહીં, પરંતુ તેમાં રહેલી ખામી સુધારી પોતાના કૌશલ્યની યોગ્યતા પૂરવાર કરવી.
- પ્રયોગ વખતે શિક્ષકે વારાફરતી વિદ્યાર્થીઓને બોલાવીને પ્રાયોગિક કાર્યમાં સહકાર મેળવવો.
- વર્ગના બધા વિદ્યાર્થીઓનું પ્રયોગ તરફ ધ્યાન રહે તે જરૂરી છે. તે માટે શિક્ષકે વર્ગમાં જિજ્ઞાસાયુક્ત વાતાવરણ ઊભું કરવું. જેથી બધા વિદ્યાર્થીઓ આતુરતાથી પ્રયોગના પરિણામને ઝંખે.
- શિક્ષકે સમય, વાતાવરણ અને ઋતુને ધ્યાનમાં રાખી નિદર્શન માટેના પ્રયોગનું આયોજન કરવું. કારણ કે કેટલાક પદાર્થો અને સાધનો પર ઋતુ અને હવામાનની પ્રતિકૂળ અસર પડે છે.
- પ્રયોગની સાથે સાથે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો, જેમ કે ચાર્ટ્સ, નમૂનાઓ, આકૃતિઓ વગેરે.
- દાર્શનિક ટેબલની પાછળ મોટું કા.પા. હોવું જરૂરી છે. જેથી પ્રયોગ દરમિયાન શિક્ષક તેનો ઉપયોગ કરી શકે. જરૂરી આકૃતિઓ દોરી શકે. અવલોકન કોઠો અને અવલોકનોની નોંધ કરી શકાય, તેના પરથી તારણો અને નિષ્કર્ષો નોંધી શકાય.
- વિદ્યાર્થીઓની વય-કક્ષા ધ્યાનમાં રાખી, ચોક્કસ હેતુ માટે જ નિદર્શન કરવું.
- નિદર્શન દરમિયાન વિદ્યાર્થીઓને ચર્ચાનો પૂરતો અવકાશ આપવો જોઈએ.
- દાર્શનિક કાર્યમાં કા.પા. કાર્ય ઘણું ઉપયોગી છે. જેમ કે પ્રયોગનો હેતુ, સાધનો-પદાર્થો, પ્રયોગની રીત, અવલોકન કોઠો, તારવણી, નિયમની તારવણી વગેરે નોંધવા અને પ્રયોગને લગતી આકૃતિઓ - ચિત્રો દોરવા.
- વિદ્યાર્થીઓ કા.પા. કાર્ય નોંધપોથીમાં લખે તેનું નિરીક્ષણ કરવું.
- દાર્શનિક ટેબલ શક્ય એટલું મોટું અને બધા અધ્યેતાઓ પ્રયોગ જોઈ શકે એટલું ઊંચું હોવું જોઈએ.
- અધ્યેતાઓ સમગ્ર પ્રયોગનો અહેવાલ જાતે જ પદ્ધતિસર પ્રયોગપોથીમાં લખે તેવો અધ્યાપકે આગ્રહ રાખવો.

### 9.5.3 નિદર્શન પદ્ધતિનાં લાભ :

- આ પદ્ધતિ શિક્ષક કેન્દ્રિત છે. છતાં વિદ્યાર્થીઓને અવલોકન, પ્રયોગની નોંધ કરવી, પ્રશ્નોના ઉત્તરો આપવા, આકૃતિ દોરવી અને કેટલીક વાર પ્રયોગો કરવામાં સહકાર લેવા જેવી પ્રવૃત્તિઓ આપી, સક્રિય રાખી શકાય છે.
- આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ વસ્તુઓનું અને જીવંત નમૂનાઓનું નિદર્શન કરવામાં આવે છે. તેથી કહી શકાય કે આ પદ્ધતિ મનોવૈજ્ઞાનિક છે. પરિણામે વિદ્યાર્થીઓ અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં સક્રિય ભાગ લે છે અને વિજ્ઞાન પ્રત્યે તેમનામાં એક પ્રકારની અભિરૂચિનું નિર્માણ થાય છે.
- જ્યારે સાધનો કીમતી હોય ત્યારે આ પદ્ધતિ વધુ ઉપયોગી છે.

- જોખમી કે ભયજનક પ્રયોગોમાં આ પદ્ધતિ મદદરૂપ થાય છે.
- જ્યારે બધાં વિદ્યાર્થીઓને વ્યક્તિગત પ્રયોગ આપવા શક્ય ન હોય ત્યારે શિક્ષક આ પદ્ધતિથી સમગ્ર વર્ગ સમક્ષ પ્રયોગો કરે છે અને ઘણા પ્રયોગો થોડા સમયમાં કરી શકાય છે.
- આ પદ્ધતિ કરકસરયુક્ત અને સમયનો સારો એવો બચાવ કરે તેવી પદ્ધતિ છે.
- આ પદ્ધતિથી વિદ્યાર્થીઓની અવલોકનશક્તિ, અર્થઘટનશક્તિ તથા નિર્ણયશક્તિ વિકસાવી શકાય છે.
- આ પદ્ધતિમાં અધ્યેતાઓ પ્રત્યક્ષ જ્ઞાન મેળવે છે. તેઓ અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં સક્રિય ભાગ લે છે. તેથી તેમનામાં વિજ્ઞાન વિષય પ્રત્યે રસ જાગૃત થાય છે.

#### 9.5.4 નિદર્શન પદ્ધતિની મર્યાદાઓ :

- આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ નિર્માણ થતું નથી. વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે કામ કરવાની તાલીમ મળતી નથી.
- આ પદ્ધતિ માત્ર શિક્ષકકેન્દ્રી છે. વિદ્યાર્થીઓને 'ક્રિયા દ્વારા શિક્ષણ'નો અવકાશ નથી. સમગ્ર પ્રયોગની સંપૂર્ણ જવાબદારી શિક્ષકની હોય છે. શિક્ષક સતત સક્રિય રહે છે. વિદ્યાર્થી તેના પ્રમાણમાં નિષ્ક્રિય બની જાય છે.
- આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં લેવામાં આવતા નથી. તેજસ્વી અને મંદ વિદ્યાર્થીઓને એક સાથે શીખવવાનો પ્રયત્ન થાય છે.
- વિદ્યાર્થીઓમાં ઈચ્છિત પ્રાયોગિક કૌશલ્યોનો વિકાસ થતો નથી.
- ખૂબ જ મોટા વર્ગમાં બધા અધ્યેતાઓ પ્રયોગ બરાબર જોઈ શકતા નથી.
- ઘણીવાર નિદર્શન પૂર્વે પ્રયોગના સાધનોની ચકાસણી ન કરી હોય તો પ્રયોગ નિષ્ફળ જવાની સંભાવના રહે છે.

#### ● તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી જગ્યામાં જ લખો.

#### 1. નિદર્શન પદ્ધતિ એટલે શું ?

.....

.....

.....

.....

.....

.....

.....

#### 2. સારા નિદર્શન માટે ધ્યાનમાં રાખવાની કોઈ પણ બે બાબત જણાવો.

.....

.....

.....

.....

.....

.....

#### 3. નિદર્શન પદ્ધતિની કોઈ પણ બે મર્યાદા જણાવો.

.....

.....  
.....  
.....  
.....  
.....

## 9.6 પ્રયોગ પદ્ધતિ :

### 9.6.1 પ્રસ્તાવના :

પ્રયોગ પદ્ધતિ એ તાર્કિક પદ્ધતિ છે. વિજ્ઞાન શિક્ષણની ઘણી અગત્યની જરૂરી પદ્ધતિ છે. સોન્ડર્સ જણાવે છે તેમ, “પ્રયોગની તાર્કિક જરૂરિયાત સ્વીકારીએ કે નહીં તો પણ એ હકીકત છે કે જે વસ્તુ હાથમાં રાખી વિદ્યાર્થીઓ જાતે પ્રયોગ કરે છે તેની તેમના માનસ પર દૂરથી બતાવેલ પ્રયોગ કરતાં ઘણી જ ગાઢ અસર હોય છે.” આમ, પ્રયોગ પદ્ધતિ વિદ્યાર્થીકેન્દ્રી પદ્ધતિ છે.

આ પદ્ધતિ વિજ્ઞાન-શિક્ષણની સાચી, વિદ્યાર્થીલક્ષી, વિજ્ઞાનના ઉત્તમ હેતુઓને સિદ્ધ કરનારી અને વિજ્ઞાનલક્ષી પદ્ધતિ છે. આ પદ્ધતિમાં ‘ક્રિયા દ્વારા શિક્ષણ’ સિદ્ધાંતનો અમલ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં અધ્યેતાઓ પ્રયોગ શાળામાં જાતે જ પ્રયોગો કરીને જ્ઞાન મેળવે છે તેથી તેને પ્રયોગ પદ્ધતિ કહેવામાં આવે છે.

આ પદ્ધતિના અગત્યના લક્ષણોમાં વિદ્યાર્થી જાતે પ્રયોગ કરે છે. શિક્ષક પૂર્વભૂમિકામાં સૈદ્ધાંતિક બાબતોની સમજ વર્ગખંડમાં આપે છે. પછી વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં લઈ જવામાં આવે છે. પ્રયોગશાળામાં જે-તે પ્રયોગને લગતા સાધનોમાં જેટલા સેટ હોય તેને ધ્યાનમાં રાખીને અને હાજરીપત્રકમાંથી વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને જૂથમાં વહેંચી પ્રયોગના સેટ આપવામાં આપે છે.

પ્રાયોગિક કાર્યો બે પ્રકારના હોય છે.

- (1) પ્રયોગશાળામાં કરવાના પ્રાયોગિક કાર્ય
- (2) પ્રયોગશાળાની બહાર કરવાના પ્રાયોગિક કાર્ય

પ્રયોગ શાળાની અંદર કરવાના પ્રાયોગિક કાર્યો માટે પ્રયોગ સાધનો, રસાયણો, અન્ય જરૂરી વસ્તુઓ વગેરે પ્રયોગશાળાની અંદર જ રાખવામાં આવે છે. જ્યારે વનસ્પતિશાસ્ત્રને લગતા પ્રયોગો, ખેતીકામ, બાગાયતને લગતા પ્રશ્નોને પ્રયોગ દ્વારા અભ્યાસ કરવા માટે પ્રયોગશાળાની બહાર જવું પડે છે. વનસ્પતિશાસ્ત્રને લગતા પ્રયોગો શાળાના કેમ્પસમાં વિકસાવેલા શાળા બાગમાં થઈ શકે છે.

પ્રયોગ પદ્ધતિમાં પ્રયોગના સાધનો પસંદ કરવા, સાધનો ગોઠવવાં, વિધિસર પ્રયોગ કરવો, પ્રયોગના પરિણામો અવલોકન કોઠામાં વ્યવસ્થિત નોંધવા, અવલોકન કરવું, નિર્ણય તારવવા, વગેરે દરેક કાર્યો અધ્યેતાઓએ પોતે જ કરવાના હોય છે. અધ્યાપક માત્ર માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. આ પદ્ધતિમાં અધ્યેતાને પ્રયોગના સાધનો વાપરવાની અને જાતે પ્રયોગ કરવાની તક મળે છે. પ્રયોગના સાધનો કેવી રીતે ગોઠવવા અને પ્રયોગ કેમ કરવો તેની પણ તેને સમજ પ્રાપ્ત થાય છે.

### 9.6.2 પ્રયોગ પદ્ધતિનો પ્રકાર :

પ્રયોગ પદ્ધતિનો પ્રકાર

- (i) નિયંત્રિત પ્રયોગ પદ્ધતિ
- (ii) અનિયંત્રિત પ્રયોગ પદ્ધતિ
- (i) નિયંત્રિત પ્રયોગ પદ્ધતિ :

સિદ્ધાંતોની ખાતરી કરવા માટે પ્રયોગો કરવામાં આવે છે જેને નિયંત્રિત પ્રયોગ પદ્ધતિ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓને પ્રયોગનો હેતુ, પ્રયોગ પદ્ધતિની માહિતી વગેરે અગાઉથી આપી દેવામાં આવે છે.

તેનાથી વિદ્યાર્થીઓમાં સાધનનો પરિચય, અવલોકનશક્તિનો વિકાસ, નોંધ કરવાની રીત વગેરેનો ખ્યાલ મળે છે. માધ્યમિક કક્ષાએ આ રીત ખૂબ ઉપયોગી છે.

### (ii) અનિયંત્રિત કે મુક્ત પ્રયોગ પદ્ધતિ :

પ્રયોગમાં પરિણામની નોંધ અને તારણ વિદ્યાર્થી નક્કી કરે છે. પરિણામો કેવા આવશે તે કોઈ અગાઉથી જાણતા હોતા નથી. તે પ્રયોગને અંતે નક્કી થાય છે અને તારણ નીકળે છે. માટે આ પ્રકારના પ્રયોગને મુક્ત અથવા અપરિણામગામી પ્રયોગ પદ્ધતિ કહેવામાં આવે છે.

આમ, વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે બંને પ્રકારના પ્રયોગો જરૂરી છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓ નિયંત્રિત પ્રયોગો કરે તે જરૂરી છે. નિયંત્રિત પ્રયોગો પરથી વિદ્યાર્થીઓમાં કેટલીક બાબતોનો વિકાસ થાય છે. ત્યાર પછી મુક્ત પ્રયોગો વિદ્યાર્થીઓ કરે તે જરૂરી છે. જેથી તેમનામાં પ્રયોગો માટેની કેટલીક સૂઝ અને વ્યવસ્થાશક્તિનું નિર્માણ થાય છે.

### 9.6.3 પ્રયોગ કાર્ય આપવાનું ધ્યેય :

- પ્રયોગ કાર્ય એટલા માટે આપવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીઓને કેટલાક હેતુલક્ષી ઘનિષ્ઠ સ્વાનુભાવો મળે અને તે દ્વારા યોગ્ય સમજણ કેળવે અને યોગ્ય રીતે વિચાર કરતા થાય.
- સિદ્ધાંતો અને નિયમોને વિદ્યાર્થીઓ જાતે પ્રયોગ કરીને સમજે તો તેઓ સમજપૂર્વક પ્રયોગોનો ઉપયોગ કરી શકશે.
- વિદ્યાર્થીઓને પ્રાયોગિક કાર્ય આપવાથી શિક્ષણનાં અન્ય ધ્યેયો પણ સિદ્ધ થાય છે. જેવા કે વિદ્યાર્થીઓ વિશેષ ઊંડાણથી અને સંબંધાત્મક રીતે વિચારતાં થાય, ચોક્કસાઈપૂર્વક આંક જોતા થાય અને નોંધ લેતા થાય.
- શક્ય હોય ત્યાં નવાં સાધનો બનાવે અને એકના સ્થાને બીજા સાધનોનો ઉપયોગ કરવાનું વિચારી શકે.
- નવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ વિજ્ઞાનના જ્ઞાનનો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરતાં થાય છે.
- વિજ્ઞાનમંડળમાં વિદ્યાર્થીઓ નવીન પ્રયોગો કરે અને તેના દ્વારા વિશેષ લાભ મેળવે. પ્રોજેક્ટ તૈયાર કરે, મોડેલ (પ્રતિકૃતિ) બનાવે. આ રીતે શિક્ષણના ધ્યેયોને સાધ્ય બનાવી શકાય.
- પ્રાયોગિક કાર્યથી વિદ્યાર્થીઓમાં વિવિધ શક્તિઓ જેવી કે સમસ્યારૂપ પ્રશ્નો શોધવાની શક્તિ, સમસ્યાનું પૃથક્કરણ કરવાની શક્તિ, પોતાના પૂર્વજ્ઞાનને આધારે સમસ્યારૂપ પ્રશ્નોને હલ કરવાની શક્તિ, પરિણામને આધારે ઉકેલ શોધવાની શક્તિ વગેરે ગુણોનો વિકાસ કરી શકાય છે.

### 9.6.4 પ્રયોગ પદ્ધતિનો અસરકારક ઉપયોગ :

- પ્રયોગ કરતા પૂર્વે પ્રયોગની સમગ્ર માહિતી વિદ્યાર્થીઓને આપવી જોઈએ.
- વિદ્યાર્થીઓએ કરવાના પ્રયોગો કાળજીપૂર્વક પસંદ થવા જોઈએ.
- અધ્યેતાઓ પ્રયોગ કરવાના હેતુથી સજાગ હોવા જોઈએ.
- પ્રયોગ માટેના સાધનો, પદાર્થો, રસાયણોની વ્યવસ્થા, પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ.
- પ્રયોગ માટેના બધા જ સાધનો કાર્યક્ષમ હોવા જોઈએ.
- દરેક ટેબલ પર વિદ્યાર્થીની સંખ્યા મુજબ પ્રયોગ માટેના પૂરતા સાધનો આપવા જોઈએ.
- શિક્ષકની સૂચનાની ભાષા સરળ, સાદી અને સમજાય તેવી હોવી જોઈએ.
- વિદ્યાર્થીઓ જાતે પ્રયોગ કાર્ય કરે, સાધનો ગોઠવે, અવલોકન લે અને તેની નોંધ કરવા જોઈએ.
- વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય તો પ્રશ્ન પૂછી સ્પષ્ટતા પ્રાપ્ત કરે.
- શિક્ષક ક્રમશઃ દરેક ટેબલ પર ફરતા રહે અને માર્ગદર્શન આપે.
- શિક્ષક વિદ્યાર્થીઓને પ્રયોગ પહેલા અને પ્રયોગ પછી પ્રશ્નો પૂછે અને જરૂરી સ્પષ્ટતા આપે.

- પ્રયોગ કાર્યની નોંધ વિદ્યાર્થીઓ વર્ગમાં જ કરે અને પ્રાપ્ત અવલોકન સાચાં સ્વરૂપમાં જ પોતાની નોટબુકમાં નોંધે તેવો શિક્ષકે આગ્રહ રાખવો અને ધ્યાન રાખવું.
- વિદ્યાર્થી દ્વારા પ્રયોગમાં થતી ભૂલો અંગે વિદ્યાર્થીઓનું ધ્યાન દોરવું.
- પ્રયોગ પૂર્ણ થાય એટલે વિદ્યાર્થીઓ સાધનો સાફ કરીને યોગ્ય સ્થળે મૂકે તેવો આગ્રહ રાખવો.
- પ્રાયોગિક કાર્ય માટે સળંગ બે તાસ ફાળવવા. જેથી સરળતાથી પ્રયોગ કરી શકાય.
- જોખમી અથવા કીમતી સાધનોના ઉપયોગવાળા પ્રયોગો ન આપવા.
- સાધનોની જાળવણીની સૂચના પહેલેથી આપી દેવી.
- અध्येતાઓ વિચાર કરતા થાય તેવી રીતે પ્રયોગનું આયોજન કરવું જોઈએ. વિદ્યાર્થીઓ વિચારે કે પ્રયોગ કરવા માટે ક્યાં ક્યાં સાધનો જોઈશે, સાધનો કેવી રીતે ગોઠવવાના, પ્રયોગની નોંધ કેવી રીતે લઈ શકાય વગેરે.
- પ્રયોગ પદ્ધતિ દ્વારા અध्येતાઓને એક નાના સંશોધનનો મહાવરો આપવાનો છે, અને એક નાના વૈજ્ઞાનિકની અદા તેમનામાં પ્રગટાવવાની છે.
- અध्येતાઓએ પ્રયોગશાળામાં રાખવાની સારસંભાળ અને શિસ્તભર્યા વર્તનનો અધ્યાપકે ખ્યાલ આપવો.
- પ્રયોગ કર્યા બાદ પણ અધ્યાપકે અध्येતાઓ સાથે વિચારવિમર્શ અને ચર્ચા કરવી જોઈએ. તેમ કરવાથી તેઓ વધુને વધુ રસ લેતા થશે. વળી આ ચર્ચા વિચારણાથી અધ્યાપકને પ્રયોગોના આયોજનમાં શું સુધારા-વધારા કરવા કે જેથી આ પદ્ધતિનો મહત્તમ ફાયદો મેળવી શકાય તેનો પણ ખ્યાલ આવશે.
- અध्येતાઓને પ્રયોગમાં રસ પડશે તો તેઓ વિજ્ઞાન મંડળમાં પણ રસ લેતા થશે. જો આમ થાય તો શાળાઓએ તેમને માટે વર્કશોપની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.
- વિજ્ઞાનના અભ્યાસક્રમમાં ન હોય એવા વિજ્ઞાનના સામયિકોમાં આવતા અવનવા પ્રયોગો નવીન પ્રકારનાં સાધનોની બનાવટ વગેરેને પણ પ્રાયોગિક કાર્યમાં ઘણાં વિદ્યાર્થીઓ તે કાર્ય કરતા થાય તેવી પ્રેરણા અધ્યાપકે તેમને આપવી.
- એક જૂથનાં પરિણામોને બીજા જૂથનાં પરિણામો સાથે સરખાવવા. જો પરિણામોમાં વધારે તફાવત હોય તો તે અંગેની વૈજ્ઞાનિક ચર્ચા પણ અધ્યાપકે તેમની સાથે ગોઠવવી. આ તફાવત માટે કારણભૂત એવી પ્રયોગ સાધનોની ખામી અથવા પ્રયોગ કરનારાઓની ભૂલ ક્યાં છે તેનો નિર્દેશ અધ્યાપકે સ્પષ્ટ રીતે કરવો.
- પ્રયોગશાળાની બહાર અને ઘેર થઈ શકે એવા પ્રયોગો પણ અધ્યાપકે અध्येતાઓને સ્વાધ્યાય તરીકે આપવા.
- વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવારના સાધનો અને તેનું જ્ઞાન આપવું.

### 9.6.5 પ્રયોગ પદ્ધતિના ફાયદા :

- વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક કાર્યના કૌશલ્યો વિકસે છે.
- વિદ્યાર્થીઓ પ્રયોગશાળામાં જાતે કામ કરતા થાય છે.
- વિદ્યાર્થીઓમાં માનસિકશક્તિઓનો વિકાસ થાય છે. જેવી કે અવલોકનશક્તિ, નિર્ણય કરવાની શક્તિ, અનુમાન કરવાની શક્તિ, તર્કશક્તિ, તુલના શક્તિ વગેરેનો વિકાસ થાય છે.
- વિદ્યાર્થીઓ પ્રયોગ સાથ-સહકારથી કરતાં હોવાથી સહકારની ભાવનાઓનો વિકાસ થાય છે. એકબીજાની વિશિષ્ટ શક્તિઓનો ઉપયોગ કરવાની તક મળે છે.
- વિદ્યાર્થીઓમાં પ્રયોગશાળા શિસ્ત અને સારી ટેવોનો વિકાસ થાય છે.
- પ્રયોગ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, ઉમંગ, અને સ્વતંત્ર કામ કરવાની ટેવનો વિકાસ થાય છે.
- વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક અને બાહ્ય સૂઝનો વિકાસ થાય છે. તથા પ્રાયોગિક કાર્ય કરવાની શક્તિ જાગૃત થાય છે.
- અध्येતાઓ પ્રાયોગિક ભૂમિકા પર સમસ્યાઓને હલ કરવાનું વિચારી શકે છે.
- અध्येતાઓમાં પ્રયોગના સાધનોની મદદથી ચોક્કસાઈથી માપ લેવાનું કૌશલ્ય આ પદ્ધતિથી



વિકસે છે. તેમજ માપ લેવામાં ક્યાં ક્યાં ભૂલો થવાની શક્યતા રહેલી છે તે જાણવાનું કૌશલ્ય પણ વિકસે છે.

- પ્રાયોગિક કાર્યને લગતી ગણતરીઓ કરવાનું કૌશલ્ય પણ આ પદ્ધતિથી અધ્યેતાઓમાં વિકસે છે.
- અધ્યેતાઓમાં પ્રયોગશાળાની શિસ્ત વિકસવાને લીધે પ્રયોગશાળાની સાધનસામગ્રીની તેમજ શાળામાં અન્ય સાધનસામગ્રીની સારસંભાળ લેવાની ટેવનો વિકાસ થાય છે.
- જાતે પ્રયોગો કરીને સફળતા મળવાથી અધ્યેતાઓમાં આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની ભાવનાનો વિકાસ થાય છે.

#### 9.6.6 પ્રયોગ પદ્ધતિની મર્યાદાઓ :

- કેટલીક શાળાઓમાં પ્રયોગશાળા કે પ્રયોગખંડ હોતા નથી. જો હોય તો ત્યાં તેનો ઉપયોગ વર્ગખંડ તરીકે થાય છે.
- માધ્યમિક શાળા પાસે વિદ્યાર્થીઓને પ્રયોગ કરવા માટે આપવાના સાધનોના સેટ પૂરતા પ્રમાણમાં હોતા નથી. સાધનોનો અભાવ હોય અથવા ઓછા સાધનો હોય.
- શિક્ષકને પ્રયોગ કરવા માટે મુક્ત તાસ મળતા નથી કે જેથી પ્રયોગની તૈયારી કરી શકે અને મદદનીશ પણ મળતા નથી.
- માધ્યમિક શાળાઓ કિંમતી સાધનો નિયંત્રિત પ્રયોગોમાં પણ આપવા માટે તૈયાર હોતી નથી.
- કેટલીક શાળાઓમાં પ્રયોગો કરાવ્યા સિવાય સીધા જ નોંધપોથીમાં લખાવી દેવાતા હોય છે.
- પ્રયોગ માટે ફર્નિચરની સગવડ ન હોય ત્યારે પણ અધ્યેતાઓને ખૂબ જ મુશ્કેલી પડે છે.
- અધ્યાપક સક્રિય ન હોય તો વર્ગમાં ઘોંઘાટ થાય છે. અને વર્ગ વ્યવસ્થા પર કોઈ જ નિયંત્રણ રહેતું નથી.
- અધ્યાપક વર્ગમાં પ્રયોગ દરમ્યાન કે પ્રયોગ પૂરો થઈ ગયા પછી કોઈ જ ચર્ચા-વિચારણા ન કરે તો અધ્યેતાઓની સમજમાં કચાશ રહી જાય છે.
- આ પદ્ધતિ સમય ખૂબ માંગે છે તેમજ મોંઘી પણ છે. કારણ કે એક વર્ગના વિદ્યાર્થીઓને વ્યક્તિગત કે જૂથમાં સાધન સામગ્રી આપવા તેને વસાવવી પડે છે.
- પ્રયોગને અંતે પ્રયોગના સાધનો સાફ કરીને યથાસ્થાને મૂકવાના હોય છે. ભયજનક રસાયણો પણ તેઓ સાવચેતીપૂર્વક કાળજીથી મૂકે તેવી તેમને સૂચના આપવાની હોય છે. આ સૂચનાઓ અધ્યાપક ચૂકી જાય તો અસ્વચ્છ સાધનોને લીધે જ્યારે બીજીવાર પ્રયોગ કરવાનો હોય ત્યારે તેની નિષ્ફળતાની સંભાવનાઓ વધી જાય છે. વળી ભયજનક રસાયણો ગમે તેમ જો મૂકાય તો તેનાથી અકસ્માત થવાની પણ સંભાવના રહે છે.
- હોંશિયાર અને તેજસ્વી અધ્યેતાઓ સારી રીતે સમજપૂર્વક વધારાના ઘણા પ્રયોગો કરવા માટે ઉત્સુક હોય છે. તેમનામાં અત્યંત જિજ્ઞાસાવૃત્તિ હોય છે. પરંતુ શાળાઓ તેમને વિશિષ્ટ સગવડો આપતી નથી હોતી જેથી તેમની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાતી નથી અને તેમને અસંતોષ રહે છે.

#### ● તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી જગ્યામાં જ લખો.

#### 1. પ્રયોગ પદ્ધતિના પ્રકાર કયા કયા છે ?

.....

.....

.....

.....

.....

.....

2. વિજ્ઞાન શિક્ષણના અધ્યાપન કાર્ય દરમ્યાન તમે પ્રયોગ પદ્ધતિનો અસરકારક ઉપયોગ કરવા કઈ કઈ બાબત ધ્યાનમાં રાખશો ?

.....  
.....  
.....  
.....  
.....  
.....

3. પ્રયોગ પદ્ધતિની મર્યાદા જણાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....

---

### 9.7 સારાંશ :

આ એકમમાં અધ્યાપન પદ્ધતિની સંકલ્પના તેના પ્રકારો, મહત્વ અને મર્યાદાઓની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી છે. ઉપરાંત વ્યાખ્યાન પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ અને પ્રયોગ પદ્ધતિ વિશે ઉડાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. વિજ્ઞાનના અધ્યાપન કાર્યને ધ્યાનમાં રાખી વિસ્તૃતમાં ઉપરોક્ત પદ્ધતિથી માહિતીગાર થયા. દરેક પદ્ધતિના કેટલાક ફાયદા અને મર્યાદાઓ છે. એક શિક્ષકે વિજ્ઞાનના અધ્યાપન માટે પદ્ધતિની પસંદગી ખૂબ સાવધાન રહી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી કરવી જોઈએ. વિવિધ અધ્યાપન પદ્ધતિઓનો પોતાના અધ્યાપન કાર્યમાં ક્યારે, કઈ રીતે, શેનો અને શા માટે ઉપયોગ કરવો તે વિશે ખૂબ સ્પષ્ટ થવું જોઈએ. આમ અધ્યાપનકાર્યના હેતુઓ, સંસાધનો અને અભ્યાસક્રમના મુદ્દાઓ ઉપરાંત વર્ગખંડની પરિસ્થિતિ દરેકને ધ્યાનમાં રાખી પ્રત્યેક પદ્ધતિનો યોગ્ય ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે.

---

### 9.8 સ્વાધ્યાય :

- (1) અધ્યાપન પદ્ધતિની સંકલ્પના સ્પષ્ટ કરો.
- (2) અધ્યાપન પદ્ધતિના પ્રકારો વર્ણવો.
- (3) અધ્યાપન પદ્ધતિનું મહત્વ જણાવો.
- (4) અધ્યાપન પદ્ધતિની મર્યાદાઓ વિસ્તૃતમાં જણાવો.
- (5) વ્યાખ્યાન પદ્ધતિ એટલે શું ? તેની સંકલ્પના સ્પષ્ટ કરો.
- (6) વ્યાખ્યાન પદ્ધતિની લાક્ષણિકતાઓ જણાવી તેને ઉપયોગી બનાવવાના સૂચનો વર્ણવો.
- (7) વ્યાખ્યાન પદ્ધતિના ફાયદા અને મર્યાદા વિસ્તૃતમાં જણાવો.
- (8) નિદર્શન પદ્ધતિ એટલે શું ? વિસ્તૃતમાં વર્ણવો.
- (9) સારા નિદર્શન માટે ધ્યાનમાં રાખવાની બાબતો સવિસ્તાર વર્ણવો.
- (10) નિદર્શન પદ્ધતિના લાભલાભ જણાવો.
- (11) પ્રયોગ પદ્ધતિ એટલે શું ? તેની સંકલ્પના સ્પષ્ટ કરી પ્રાયોગિક કાર્યના પ્રકાર વિશે જણાવો.
- (12) પ્રયોગ પદ્ધતિના પ્રકાર વિસ્તૃતમાં વર્ણવો.
- (13) પ્રયોગ આપવાનું ધ્યેય તમારા શબ્દોમાં વર્ણવો.
- (14) પ્રયોગ પદ્ધતિનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરી શકાય ? વિસ્તૃતમાં વર્ણવો.
- (15) પ્રયોગ પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ વિસ્તૃતમાં જણાવો.

: રૂપરેખા :

- 10.1 પ્રસ્તાવના
  - 10.2 ઉદ્દેશ્યો
  - 10.3 પ્રોજેક્ટ પદ્ધતિ (યોજના પદ્ધતિ / પ્રકલ્પ પદ્ધતિ)
    - 10.3.1 પ્રસ્તાવના
    - 10.3.2 પ્રોજેક્ટ પદ્ધતિની વ્યાખ્યા
    - 10.3.3 પ્રોજેક્ટ પદ્ધતિની લાક્ષણિકતાઓ
    - 10.3.4 પ્રોજેક્ટ પદ્ધતિની જરૂરીયાત
    - 10.3.5 પ્રોજેક્ટ પદ્ધતિના સિદ્ધાંતો
    - 10.3.6 પ્રોજેક્ટના પ્રકાર
    - 10.3.7 પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો
    - 10.3.8 પ્રોજેક્ટ પદ્ધતિના ફાયદા
    - 10.3.9 પ્રોજેક્ટ પદ્ધતિની મર્યાદાઓ
  - 10.4 જૂથ-ચર્ચા પદ્ધતિ
    - 10.4.1 પ્રસ્તાવના
    - 10.4.2 સંકલ્પના
    - 10.4.3 જૂથ ચર્ચા પદ્ધતિના સોપાનો
    - 10.4.4 જૂથચર્ચામાં શિક્ષકની ભૂમિકા
    - 10.4.5 જૂથચર્ચા પર અસર કરતાં પરિબળો
    - 10.4.6 જૂથચર્ચા પદ્ધતિના ફાયદા
    - 10.4.7 જૂથ ચર્ચા પદ્ધતિની મર્યાદાઓ
  - 10.5 સ્વાધ્યાય પદ્ધતિ
    - 10.5.1 પ્રસ્તાવના
    - 10.5.2 સંકલ્પના
    - 10.5.3 સારા સ્વાધ્યાયની લાક્ષણિકતાઓ
    - 10.5.4 સ્વાધ્યાય ક્યારે આપી શકાય ?
    - 10.5.5 સ્વાધ્યાય પદ્ધતિના ફાયદા
    - 10.5.6 સ્વાધ્યાય પદ્ધતિની મર્યાદાઓ
  - 10.6 સારાંશ
  - 10.7 સ્વાધ્યાય
-

---

### 10.1 પ્રસ્તાવના :

---

વિજ્ઞાનના અધ્યાપન કાર્ય દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણો, સર્જનાત્મકતા, તાર્કિક ચિંતન, જિજ્ઞાસાવૃત્તિ, સંશોધનાત્મકતા, પ્રશ્નો પૂછવાનું કૌશલ્ય વગેરેનો વિકાસ થાય છે. આ માટે વિજ્ઞાનનું અસરકારક અધ્યાપન કાર્ય ખૂબ અનિવાર્ય છે. પરંતુ આ અસરકારકતા એ વિજ્ઞાન વિષયનું અધ્યાપનકાર્ય કઈ રીતે, કેવી રીતે કરાવવામાં આવે છે. તેના પર નિર્ભર છે. વિજ્ઞાનના અસરકારક અધ્યાપન કાર્ય માટે શિક્ષકે વર્ગખંડનું સમગ્ર વાતાવરણ, સુવિધા અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી સભાન રહી વિવિધ બાબતોની પસંદગી અને યોગ્ય નિર્ણય દ્વારા વિષયવસ્તુના મુદ્દાને ધ્યાનમાં રાખી અધ્યાપન પદ્ધતિની પસંદગી કરવી જોઈએ. અધ્યાપન કાર્યના વિશિષ્ટ હેતુઓ અસરકારક રીતે વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન સુધી પહોંચાડવા માટે વિજ્ઞાન શિક્ષણની વિવિધ અધ્યાપન પદ્ધતિઓ મદદરૂપ થાય છે. તેના યોગ્ય ઉપયોગ દ્વારા શિક્ષક પોતાના અધ્યાપન કાર્યને સફળ અને અસરકારક બનાવી શકે છે.

આ એકમમાં પ્રોજેક્ટ પદ્ધતિ, જૂથચર્યા પદ્ધતિ અને સ્વાધ્યાય પદ્ધતિની વિજ્ઞાનના અધ્યાપન કાર્યને ધ્યાનમાં રાખી વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી છે.

---

### 10.2 ઉદ્દેશ્યો :

---

આ એકમ પૂર્ણ કર્યા પછી પ્રશિક્ષણાર્થીઓ નીચેની બાબતોમાં સક્ષમ બની શકશે.

- વિજ્ઞાન શિક્ષણની પ્રોજેક્ટ પદ્ધતિનું વર્ણન કરી શકે.
- પ્રોજેક્ટ પદ્ધતિની લાક્ષણિકતાઓ અને જરૂરીયાતોની રજૂઆત કરી શકે.
- પ્રોજેક્ટ પદ્ધતિના પ્રકાર અને સોપાનોથી માહિતગાર થશે.
- પ્રોજેક્ટ પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓની કાળજીપૂર્વક રજૂઆત કરી શકે.
- જૂથચર્યા પદ્ધતિના સોપાનોનું વર્ણન અને ઉપયોગ કરી શકે.
- જૂથચર્યા પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા જાણી શકે.
- જૂથચર્યા પર અસર કરતાં પરિબળો જાણી તેનું યોગ્ય આયોજન કરી શકે.
- જૂથચર્યા પદ્ધતિના વિજ્ઞાન શિક્ષણમાં ફાયદા અને મર્યાદાઓ વિગતવાર જાણી શકે.
- સ્વાધ્યાય પદ્ધતિની લાક્ષણિકતાઓનું વિસ્તૃતમાં વર્ણન કરી શકે.
- વિજ્ઞાનના અધ્યાયનમાં સ્વાધ્યાય ક્યારે આપી શકાય તે જાણી શકે.
- સ્વાધ્યાય પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓથી માહિતગાર થાય.

---

### 10.3 પ્રોજેક્ટ પદ્ધતિ (યોજના પદ્ધતિ / પ્રકલ્પ પદ્ધતિ) :

---

#### 10.3.1 પ્રસ્તાવના :

આ પદ્ધતિ વિજ્ઞાન શિક્ષણમાં અતિપ્રચલિત અને નાવીન્ય સભર પદ્ધતિ છે. પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરી શકાય છે. જે શિક્ષણના મુખ્ય ધ્યેયોમાંનો એક ધ્યેય છે. આ પદ્ધતિને પ્રકલ્પ કે યોજના પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિનો બધા જ વિષયોમાં ઉપયોગ થાય છે. પરંતુ વિજ્ઞાનમાં વિશિષ્ટ સ્થાન છે. કારણ કે વિજ્ઞાન એ પ્રયોગોનો વિષય છે, એટલું જ નહિ, પરંતુ સતત વિકસતો વિષય છે.

આ પદ્ધતિના પ્રણેતા ડૉ. કિલપેટ્રિક હતા. તેઓ જહોન ડ્યુઈના શિષ્ય હતા અને જહોન ડ્યુઈના ઉપયોગિતાવાદના સિદ્ધાંત પરથી તેમણે આ પદ્ધતિની રચના કરી હતી. પ્રોજેક્ટ એ એક એવી સુસંકલિત પ્રવૃત્તિ છે કે જે મહત્વના કૌશલ્ય કે પ્રક્રિયાના અધ્યયન તરફ દોરી જાય છે.

#### 10.3.2 પ્રોજેક્ટ પદ્ધતિની વ્યાખ્યા :

- (1) “A Project can be classified as exploration, Construction, Communication, Play and Skills.”

- Collings

“પ્રોજેક્ટને ખોજ, સર્જન, વિચારોનું આદાનપ્રદાન, ખેલ અને કૌશલ્યોમાં વર્ગીકૃત કરી શકાય.

(2) “A Project is a Problematic act carried to completion in its natural settings.”

- Stevenson

“પ્રોજેક્ટ એ કુદરતી પરિસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવતી સમસ્યા પ્રધાન પ્રક્રિયા છે.”

(3) “A Project is a whole hearted Purposeful activity proceeding in a social environment.”

- Kilpatrick

“સામાજિક પરિસ્થિતિમાં વિકસતી, હેતુસરની અને હૃદયપૂર્વક હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિને પ્રોજેક્ટ કહેવામાં આવે છે.”

(4) “પ્રોજેક્ટ એ ઉદ્દેશ્યપૂર્ણ કાર્ય છે, જેને સહકાર અને સદ્ભાવનાથી અધ્યેતા સ્વેચ્છાથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે.”

- રાયબર્ન

### 10.3.3 પ્રોજેક્ટ પદ્ધતિની લાક્ષણિકતાઓ :

- પ્રોજેક્ટ એ એક પ્રવૃત્તિ છે. બાળકોને લાંબા પ્રવચનો કરતાં પ્રવૃત્તિ કરવામાં વધુ રસ હોય છે. બાળકોને સાંભળવાનું, રમવાનું, કામ કરવાનું વગેરે જેવી વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ કરવી ગમે છે. જેથી અધ્યયન રસપ્રદ બને છે. પ્રોજેક્ટમાં એકબીજાના સહકારથી પ્રવૃત્તિ કરવાની હોવાથી વિદ્યાર્થીઓ એકબીજા સાથે અનુકૂલન કરતાં પણ શીખે છે.
- પ્રોજેક્ટ એ સમસ્યાજન્ય પ્રવૃત્તિ છે. જ્યાં સુધી સમસ્યાનો ઉદ્ભવ ના થાય ત્યાં સુધી પ્રોજેક્ટ હાથ પર લઈ શકાતો નથી. વિજ્ઞાન શિક્ષણનો પ્રારંભ સમસ્યાથી થાય છે. સમસ્યાને લીધે વિદ્યાર્થીઓમાં પ્રેરણા, જિજ્ઞાસા જાગૃત થાય છે. જેને લીધે બાળકો નવું શોધવાનું, નવું શીખવાનું, નવું વિચારવાનું, નવું કશુંક કરવાનું શરૂ કરે છે.
- પ્રોજેક્ટ એક સહજ પ્રવૃત્તિ છે. આ કાર્ય સાહજિકતાથી થવું જોઈએ. તેમાં પણ જો પ્રોજેક્ટ કુદરતી વાતાવરણમાં થાય તો સાહજિક બની જાય છે.
- પ્રોજેક્ટ પદ્ધતિ સમસ્યામાંથી સત્ય તારવવાની રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિ છે. પ્રોજેક્ટમાં બાળકો જાતે પ્રવૃત્તિ કરે છે, નિર્ણયો તારવે છે. અને સિદ્ધાંતો કે નિયમોનું સામાન્યીકરણ કરે છે. જેથી ગોખણપટ્ટી કરવાની જરૂર રહેતી નથી.
- પ્રોજેક્ટ હેતુલક્ષી હોવી જોઈએ. તેના ઉદ્દેશ્યથી અધ્યાપક સંપૂર્ણ માહિતગાર હોવો જોઈએ. અને તેણે અધ્યેતાઓને પણ હેતુઓથી અવગત કરવા જોઈએ.
- પ્રોજેક્ટ અધ્યેતાઓના રોજબરોજના જીવનમાં ઉપયોગી અને વ્યવહારું હોવો જોઈએ.
- પ્રોજેક્ટ દ્વારા અધ્યેતાઓને મળેલા અનુભવો ફલપ્રદ હોવા જોઈએ. તેમાં હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ દ્વારા તેમને જ્ઞાન મળે ઉપરાંત આ પ્રવૃત્તિઓ તેમને વધુ જ્ઞાન મેળવવા પાછળ પ્રવૃત્ત કરતી હોવી જોઈએ.
- પ્રોજેક્ટ દ્વારા તેમનામાં એકબીજાને મદદરૂપ થવાની અને સહકારની ભાવના કેળવાવી જોઈએ.
- પ્રોજેક્ટમાં અધ્યેતાઓને પ્રવૃત્તિઓની સાથે સાથે જવાબદારી પણ મળવી જોઈએ. જેમકે અધ્યેતાઓ પોતે વિચારે, સ્વતંત્ર આયોજન કરે, તેમનો અભિપ્રાય આપે, તેમના નિર્ણયો આપે અને તેમની મહત્તમ શક્તિ મુજબ કામ કરે તે અધ્યાપકે જોવું જોઈએ.
- પ્રોજેક્ટમાં અધ્યેતાઓ શારીરિક અને માનસિક બંને રીતે પ્રવૃત્ત થવા જોઈએ.
- પ્રોજેક્ટમાં અધ્યેતાઓને કામ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ. પ્રોજેક્ટ ક્યારેય અધ્યાપકે અધ્યેતાઓ પર લાદવો ન જોઈએ, પરંતુ તેમના રોજબરોજના જીવનમાંથી અને

જરૂરીયાતોમાંથી ઉદ્ભવતી હોય તેવો ઉપયોગી પ્રોજેક્ટ હૃદયપૂર્વક અધ્યતાઓએ જાતે જ પસંદ કરવો જોઈએ.

- પ્રોજેક્ટમાં સર્વે પ્રવૃત્તિઓ અને કાર્યો અધ્યતાઓ જાતે જ કરે. અધ્યાપક જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપે.
- પ્રોજેક્ટ કરકસરયુક્ત હોવો જોઈએ, એટલે કે તેમાં સમય અને નાણાંનો ઓછામાં ઓછો વ્યય થાય અને છતાં તેના હેતુઓ સિદ્ધ થાય.
- પ્રોજેક્ટની પસંદગી સમયલક્ષી હોવી જોઈએ. અર્થાત્ ઋતુઓને ધ્યાનમાં રાખી પ્રોજેક્ટ પસંદ કરવો જોઈએ.
- પ્રોજેક્ટ સમાજની જરૂરિયાતો અને રસને અનુરૂપ હોવી જોઈએ.
- પ્રોજેક્ટ અધ્યતાઓની વય, કક્ષા, રસ અને અભિરુચિને અનુરૂપ હોવો જોઈએ.
- પ્રોજેક્ટને રસપ્રદ અને સુગમ બનાવવા માટે તેમાં દૃશ્ય-શ્રાવ્ય સાધનો અને અન્ય શૈક્ષણિક સાધનોનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.
- પ્રોજેક્ટ ખૂબ સહેલો કે ખૂબ અઘરો ન હોવો જોઈએ પરંતુ પ્રોજેક્ટ પડકારયુક્ત હોવો જોઈએ.
- પ્રોજેક્ટ થઈ શકે તેવો શક્ય હોવો જોઈએ. તેને આપતા અગાઉ એ જોવું જોઈએ કે તેની માહિતી પ્રાપ્તિ તેમાં આવશ્યક ચીજવસ્તુઓ અને સાધનસામગ્રીની પ્રાપ્તિ હેતુઓની વ્યવહારુતા વગેરે શક્ય છે કે કેમ તેની અધ્યાપકે ખાતરી કરી લેવી જોઈએ.
- પ્રોજેક્ટમાં કરવામાં આવતી પ્રવૃત્તિઓ, તેમાંથી પ્રાપ્ત થતા અનુભવો અને નિર્ધારિત હેતુઓ વગેરેનું જીવન સાથે સંકલન કરવું જોઈએ.
- અધ્યતાને આનંદદાયક અને અર્થપૂર્ણ લાગે તે યોગ્ય પ્રોજેક્ટ ગણાય. તેમાં આપવામાં આવતી પ્રવૃત્તિઓ અને પ્રક્રિયાઓ વૈવિધ્યસભર અને અધ્યતાઓની વિવિધ શક્તિ અને રસને પોષે તેવી હોવી જોઈએ.
- પ્રોજેક્ટનું મૂલ્યાંકન કોઈ લેખિત કે મૌખિક કસોટીથી જ નહિ, પરંતુ પ્રોજેક્ટના અહેવાલ, અવલોકનો, પ્રોજેક્ટમાં તૈયાર થયેલી અધ્યતાઓની કૃતિઓ અને ચીજવસ્તુઓ, અધ્યતાઓની વધેલી વાચનની ટેવ અને તેમના વિજ્ઞાનમાં વધેલા રસ દ્વારા જ થવું જોઈએ.

### 10.3.4 પ્રોજેક્ટ પદ્ધતિની જરૂરીયાત :

- વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે સતત જ્ઞાનનો વિસ્ફોટ થતો રહે છે. વિજ્ઞાન સતત નવા જ્ઞાનનો ઉમેરો કરે છે. ત્યારે બાળક વર્ગખંડમાં કેટલું જ્ઞાન મેળવી શકે ? માટે શિક્ષકે જ્ઞાન આપવાં કરતાં બાળકને જ્ઞાન કેમ મેળવવું એ શીખવવું પડશે.
- પ્રોજેક્ટ પદ્ધતિ બાળકોને સ્વયં શિક્ષણ લેતા શીખવે તેવી પદ્ધતિ છે. સ્વ-અધ્યયનની તાલીમ મળવાથી બાળક માહિતીનો યોગ્ય ઉપયોગ કરી શકે છે.
- વર્ગમાં વિવિધ બૌદ્ધિક કક્ષાવાળા બાળકો હોય છે. કેટલીક વાર શિક્ષક બધા બાળકોને એક જ પદ્ધતિથી શિક્ષણ આપતા હોય છે. જેને લીધે વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતો ધ્યાનમાં લેવાતા નથી. પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે કામ કરે છે. શિક્ષણ મેળવે છે અને વિકાસ કરે છે.
- પ્રોજેક્ટ પદ્ધતિમાં લેખિત કે મૌખિક અહેવાલ તૈયાર કરવાનો હોવાથી લેખિત કે મૌખિક અભિવ્યક્તિને વિકસાવવાની તક મળે છે. સાથે સાથે જૂથમાં કાર્ય કરતા હોવાથી જૂથ પ્રવૃત્તિના લાભો પણ મળે છે.
- પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા બાળકોની સર્જનશક્તિનો વિકાસ થાય છે. જે આધુનિક શિક્ષણની માંગ છે. ચિત્રો તૈયાર કરવા, ચાર્ટ બનાવવા, નમૂના બનાવવા, પ્રદર્શનનું આયોજન કરવું, વિજ્ઞાન

મંડળ કે વિજ્ઞાનમેળાની પ્રવૃત્તિઓનું આયોજન કરવું વગેરે જેવા કૌશલ્યોનો વિકાસ થાય છે. સાથે સાથે ક્રિયાત્મક કૌશલ્યો પણ વિકસે છે.

### 10.3.5 પ્રોજેક્ટ પદ્ધતિના સિદ્ધાંતો :

#### [1] સહેતુકતાનો સિદ્ધાંત :

- જો અધ્યેતા હેતુપૂર્વક જ્ઞાત અને સભાન હોય તો તે રસપૂર્વક કાર્ય કરવા પ્રેરાય છે, હાથ ધરેલું કાર્ય સમયસર પૂરું કરે છે. આમ અધ્યયન પ્રક્રિયાને વેગીલી બનાવવા માટે અધ્યેતા જે કંઈ કરે છે તે, તે શા માટે કરે છે તેનો સ્પષ્ટ ખ્યાલ તેને હોવો જોઈએ. અધ્યેતા જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે હેતુપૂર્ણ, મહત્વની અને રૂચિકર પણ હોવી જોઈએ.

#### [2] ક્રિયાશીલતાનો સિદ્ધાંત :

- અધ્યેતાઓ સ્વયં ક્રિયાશીલ બનીને જ્ઞાનોપાર્જન કરે તેવી અપેક્ષા હોવાથી તેમને વધુમાં વધુ ક્રિયાઓ કરવાની તકો મળવી જોઈએ. વળી આ ક્રિયાઓ તેમની કક્ષાને અનુરૂપ હોવી જોઈએ કે જેથી તેમની તર્કશક્તિ વિકસે, તેમનો વ્યાવસાયિક વિકાસ થાય તેમજ તેમનો સર્વાંગીણ વિકાસ થાય.
- અધ્યેતા પોતે જ સ્વભાવથી ક્રિયાશીલ હોવાથી પ્રવૃત્તિ તેને ગમે છે. આથી અધ્યાપકે તેને મહત્તમ પ્રવૃત્તિ મળે એ રીતે અધ્યયન-અધ્યાપનનું આયોજન કરવું જોઈએ. પ્રોજેક્ટ પદ્ધતિ અધ્યેતાઓને સ્વયં સ્વતંત્ર વિચારણા કરવા અને આયોજન કરવા તથા પ્રોજેક્ટને અધ્યેતાઓના પારસ્પરિક સહકારથી પૂર્ણ કરવાનું જાણે છે.
- અધ્યેતાઓને જેમાં રુચિ હોય તેવી પ્રવૃત્તિઓ કરતાં કરતાં તેઓ જવાબદારી સ્વીકારતા થાય તેવી કેળવણી પ્રોજેક્ટમાંથી મળે છે. અધ્યેતા જે કંઈ શીખે તે પ્રવૃત્તિ દ્વારા શીખે અને તે પ્રવૃત્તિમાં પોતાની બુદ્ધિ, વિચારશક્તિ, તર્કશક્તિ વાપરે એ પ્રોજેક્ટ પદ્ધતિની વિશેષતા છે.

#### [3] વાસ્તવિકતાનો સિદ્ધાંત :

- અધ્યેતાને પ્રોજેક્ટમાં જે કાર્ય આપવામાં આવે તે વાસ્તવિક હોવું જોઈએ અને વાસ્તવિક પરિસ્થિતિમાં તે કાર્ય પૂર્ણ થવું જોઈએ. આ પદ્ધતિમાં કૃત્રિમતાને સ્થાન નથી.
- જીવન પોતે પણ એક વિશાળ પ્રોજેક્ટ છે. અધ્યેતાને વાસ્તવિક જીવનની દુનિયામાં રહેવાનું છે. શિક્ષણ એ જો જીવન જીવવાની તૈયારી માટે હોય તો અધ્યેતાએ તે ઉત્તમ રીતે જીવવું જોઈએ અને એમાંથી અનુભવો પ્રાપ્ત કરવા જોઈએ.
- પ્રોજેક્ટ પદ્ધતિ શાળામાં વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. વાસ્તવિક પરિસ્થિતિમાં જ અધ્યેતાઓ પોતાનું કામ કરે એવી તેમને તકો આપવામાં આવે છે. આથી શિક્ષણ વાસ્તવિક તેમજ રુચિ અને જરૂરિયાત સાથે સંબંધ ધરાવતું બને છે.

#### [4] ઉપયોગિતાનો સિદ્ધાંત :

- જે પ્રવૃત્તિ અધ્યેતાને ઉપયોગી લાગતી હોય તેની પોતાની જરૂરીયાતોને પોષતી હોય તથા તેના રોજિંદા જીવન સાથે યોગ્ય અનુબંધ ધરાવતી હોય તે કરવામાં તેને પ્રેરણા મળે છે, રસ પડે છે અને તેનામાં ઉત્સાહ પેદા થાય છે.
- વળી અધ્યેતા જે જ્ઞાન મેળવે છે તે વ્યાવહારિક હોવું જોઈએ. ઔપચારિક અને શાબ્દિક જ્ઞાનનું કંઈ મહત્વ નથી. પ્રોજેક્ટ પદ્ધતિથી મેળવેલું જ્ઞાન વ્યાવહારિક ઉપયોગિતા આપે છે. સાથે યોગ્ય પરિણામો મેળવી શકાય છે.

#### [5] સ્વતંત્રતાનો સિદ્ધાંત :

- પ્રોજેક્ટમાં અધ્યેતાઓને પોતાનું કાર્ય પસંદ કરવાની સ્વતંત્રતા હોય છે. કાર્ય કરવામાં તેમને કોઈપણ જાતનું બંધન હોતું નથી. તેઓ પોતે સ્વતંત્રતાપૂર્વક સમસ્યાને હલ કરવાની યોજના બનાવે છે.

- પોતાની રસ, રુચિ, આકાંક્ષા અનુસાર પ્રોજેક્ટનું કાર્ય પસંદ કર્યા પછી તેને પૂર્ણ કરવા માટે તેઓ મહેનત કરે છે, કાર્ય કરે છે.
- આ માટે તેમને શાળાનું સમયપત્રક બાધક બનતું નથી. શાળા સમય પહેલાં કે પછી તેઓ વધારાનો સમય મેળવીને પ્રોજેક્ટ પર કાર્ય કરે છે.
- પ્રબળ ઈચ્છાથી પ્રેરણા પામેલી પ્રવૃત્તિઓના પરિપાકરૂપે જ તેમાં સીધાં અને પ્રત્યક્ષ અનુભવો શક્ય બને છે. અધ્યેતાઓની પ્રોજેક્ટ પર કામ કરવાની ઈચ્છા સ્વયંસ્ફુરિત હોય છે અને તે અધ્યાપક તરફથી લાદવામાં આવતી નથી. અધ્યેતાની પોતાની જરૂરિયાતમાંથી જ તે ઊગે છે. કોઈ પણ બંધન કે અવરોધ નહિ. આવી પરિસ્થિતિમાં જ પ્રત્યક્ષ અનુભવો મળે. અધ્યેતાઓ જે કરે તે અને જે રીતે કરે તે સંપૂર્ણપણે એમના ઉપર જ છોડી દેવું જોઈએ.
- તેમની જરૂરિયાત, રુચિ અને શક્તિ પ્રમાણે પ્રવૃત્તિ કરવાની તેમને સ્વતંત્રતા હોવી જોઈએ. આ જ સિદ્ધાંતનો સાર છે.

#### [6] અનુભવનો સિદ્ધાંત :

- અનુભવ એ જ શિક્ષણ છે. અનુભવથી જ અધ્યેતાનું જ્ઞાન વિકસે છે. અનુભવ એ જ મોટો અધ્યાપક છે. અનુભવ એ પ્રવૃત્તિની નિષ્પત્તિ કે નીપજ છે.
- અધ્યેતા પ્રોજેક્ટ પદ્ધતિમાં સમૂહમાં કામ કરે છે. ચારિત્ર્યની કેળવણી મેળવે છે. વ્યાવહારિક લોકશાહીના પાઠો શીખે છે.
- અધ્યેતા જે જ્ઞાન મેળવે છે તે વાસ્તવિક હોય છે, જે પ્રવૃત્તિ હાથ ધરે છે તે ઉદ્દેશ્યપૂર્ણ હોય છે અને જે અનુભવો હાંસલ કરે છે તે વિવિધ દૃષ્ટિએ અતિશય મૂલ્યવાન હોય છે.

#### [7] સામાજિકતાનો સિદ્ધાંત :

- પ્રોજેક્ટની સામાજિક ભૂમિકા હોય છે. જે દ્વારા અધ્યેતાનો સામાજિક વિકાસ થાય છે.
- સમૂહમાં કાર્ય કરવા માટે, અન્ય સહકાર્યકર્તા અધ્યેતાઓની સહાય મેળવવા માટે, અન્યનો સંપર્ક સાધવા માટે તેમને પૂરતા અનુભવો મળે છે, પરિણામે અધ્યેતાઓ પોતાની જવાબદારીઓ સત્તાનતાપૂર્વક આ પદ્ધતિમાં અદા કરે છે.
- અધ્યેતાઓમાં સામૂહિક રીતે કાર્ય કરવાથી સહકારની ભાવના વિકસે છે. તેમનામાં સામાજિકતાનો વિકાસ થાય છે.

#### 10.3.6 પ્રોજેક્ટના પ્રકાર :

##### [1] સંશોધનાત્મક પ્રોજેક્ટ :

- જેમ વૈજ્ઞાનિક સંશોધન કાર્ય હાથ ધરે છે તેવી જ રીતે અધ્યાપક અને અધ્યેતાઓ પણ સંશોધનકાર્ય કરી શકે છે.
- સંશોધન માટે ઊંડું અવલોકન અને ચોક્કસ દૃષ્ટિકોણ કેળવવાની જરૂર છે. થોડાક પ્રયત્ને મહાવરાથી કેળવી શકાય છે.
- થોડીક મહેનતની વૃત્તિ, ધીરજ, ગળાડૂબ કાર્ય દ્વારા જે બાબતના પરિણામો આપણે કે અન્ય કોઈ જાણતા નથી તે શોધી કાઢવું તે એક સંશોધન છે.
- દા.ત., આથો આવવાની ક્રિયા, રોટલી ફૂલવાની ક્રિયા, રબરનો દંડો શા માટે વધુ ઉછળે છે ? વગેરે પ્રકારના સંશોધન પ્રોજેક્ટ લઈ તેના પર અસર કરતા પરિબળો વિશે વિચારી તેના વિશે પ્રયોગો કરી તારણો મેળવી શકાય.

##### [2] સર્જનાત્મક પ્રોજેક્ટ :

- જેમાં બે પ્રકારના પ્રોજેક્ટ હાથ ધરી શકાય.
  - (i) વસ્તુ બનાવવાના પ્રોજેક્ટ : જેમાં શાહી, વિક્સ, વેસેલીન, સાબુ, ફિનાઈલ, ડિટરજન્ટ વગેરે બનાવવાના પ્રોજેક્ટ હાથ ધરી શકાય.



(ii) સાધનો બનાવવાના પ્રોજેક્ટ : જેમાં પેરિસ્કોપ, કેલિડોસ્કોપ, દૂરબીન, એકવેરીયમ, મોડેલ વગેરે બનાવવાના પ્રોજેક્ટ હાથ ધરી શકાય.

[3] કૌશલ્ય ખીલવવાના પ્રોજેક્ટ :

- સાઈકલ, રેડિયો, ગેસ સ્ટવ, વગેરેનું રિપેરિંગ. ફ્યુઝ બાંધવો, માઈક એમ્પ્લિફાયર, LCD પ્રોજેક્ટર વગેરે શૈક્ષણિક સાધનો વાપરવાનું કૌશલ્ય કેળવવાના પ્રોજેક્ટ હાથ ધરી શકાય. સાદુ ઇલેક્ટ્રિક વાયરિંગ કરવું, એકવેરિયમની સારસંભાળ લેવી વગેરે પ્રોજેક્ટ હાથ ધરી શકાય.

[4] સંગ્રહો તૈયાર કરવાના પ્રોજેક્ટ :

- વિવિધ જાતના ખાતરો, રેતીના પ્રકારો, ખડકોના પ્રકારો, વૈજ્ઞાનિકોના ફોટા, વિજ્ઞાનસંબંધી લેખો, વિવિધ જાતના પર્ણના પ્રકાર, પક્ષીઓના પીંછા, મૂળ, પ્રકાંડ, બીજ, વૈજ્ઞાનિક સાધનોના ચિત્રો વગેરે સંગ્રહો તૈયાર કરવાના પ્રોજેક્ટ લઈ શકાય.

[5] અભ્યાસ પ્રોજેક્ટ :

- પેટ્રોલિયમનું વિભાગિય નિસ્સંદન, રોકેટની બનાવટ કાગળની બનાવટ, વિદ્યુતનો ઇતિહાસ, વૈજ્ઞાનિકોના જીવનચરિત્ર, કપાસમાંથી કાપડ, વિવિધ રોગોનો અભ્યાસ, ભારતમાં અણુ સંશોધનનો ઇતિહાસ, વગેરે પર જો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે તો તેને અભ્યાસ પ્રોજેક્ટ કહી શકાય.

[6] નિરીક્ષણ પ્રોજેક્ટ :

- ઋતુ પ્રમાણે કયા સ્થળે કેવી વનસ્પતિ થાય છે ? કેવા પક્ષીઓ, જંતુઓ, કીડા વગેરે કયા સ્થળે મળી આવે છે. બીજનું અંકુરણ અને છોડનું નિર્માણ થવાની પ્રક્રિયા વગેરે આ પ્રકારના પ્રોજેક્ટ છે.

[7] પ્રક્રિયા અભ્યાસ પ્રોજેક્ટ :

- આમાં ખાતરની છોડની વૃદ્ધિ પર થતી અસર, જમીનના પ્રકારની છોડની વૃદ્ધિ પર થતી અસર, હરબેરિયમ અને પ્રાણીઓના નમૂના લાંબા સમય સુધી કેવી રીતે સાચવી શકાય વગેરે પ્રોજેક્ટનો સમાવેશ કરી શકાય.

[8] સંરક્ષણાત્મક પ્રોજેક્ટ :

- શાળા બાગનું જતન અને સંરક્ષણ કરવું, પ્રયોગ શાળાના વનસ્પતિ અને પ્રાણીઓના નમૂનાઓનું જતન કરવું વગેરે આ પ્રકારના પ્રોજેક્ટ છે.

[9] સમસ્યાત્મક પ્રોજેક્ટ :

- આમાં સમસ્યા રજૂ કરી તેનો ઉકેલ શોધવાનો હોય છે. તેમાં અધ્યેતાઓ સમસ્યાનું નિરાકરણ કરે છે. અધ્યેતાઓ સમસ્યાઓ નોંધે છે, પ્રવૃત્તિ કરે છે, કાર્યકારણનો સંબંધ જુએ છે અને છેવટે સમસ્યાનો ઉકેલ મેળવે છે. દા.ત., સ્ટીમરનું પાણી પર તરવું, પાણી ભરેલા કાચના બીકરમાં લાકડીનું વાંકું દેખાવું, મેઘધનુષ્યની રચના વગેરે સમસ્યાત્મક પ્રોજેક્ટના ઉદાહરણ છે.

[10] વિશિષ્ટ શૈક્ષણિક પ્રોજેક્ટ :

- વિજ્ઞાન મેળામાં ભાગ લેવા માટેનો પ્રોજેક્ટ, વિદ્યુત પરિપથ, હૃદયની આંતરિક રચના, પાચનતંત્ર, આજિવ્ય રચના વગેરે જેવા મુદ્દાઓની સમજ સ્પષ્ટ કરવા માટે શાળામાં તેના જેવી જ લઘુ પ્રતિકૃતિ (મોડેલ) તૈયાર કરવામાં આવે છે. જેને વિશિષ્ટ શૈક્ષણિક પ્રોજેક્ટ કહેવામાં આવે છે.

### 10.3.7 પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો :

#### [1] પ્રોજેક્ટની પસંદગી :

- શિક્ષકે એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવું જોઈએ કે વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ લેવાના શરૂ કરે. પ્રોજેક્ટની પસંદગી વિદ્યાર્થીઓ દ્વારા થવી જોઈએ.
- શિક્ષકે અને વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટની સ્વતંત્ર રીતે ચર્ચા કરવી જોઈએ. શિક્ષકે તો ફક્ત જરૂરી સૂચનાઓ જ આપવાની છે.
- પ્રોજેક્ટનો વિષય નિશ્ચિત શૈક્ષણિક મૂલ્યોવાળો અને વાસ્તવિક પરિસ્થિતિમાંથી ઉદ્ભવેલો હોવો જોઈએ.

#### [2] પ્રોજેક્ટનું આયોજન :

- પ્રોજેક્ટની પસંદગી થઈ ગયા બાદ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટેનો કાર્યક્રમ તૈયાર કરવો પડે. વિદ્યાર્થીઓને અંદરોઅંદર પ્રોજેક્ટની ચર્ચા કરવાની પૂરી સ્વતંત્રતા આપવી જોઈએ. વિદ્યાર્થીઓની સક્રિય સામેલગીરી અને અનુમતિથી જ આયોજન કરવું.
- આયોજન તૈયાર થઈ ગયા બાદ તેમને તેમની કાબેલિયત પ્રમાણેની વિવિધ જવાબદારીઓ આપવામાં આવે છે અને આ બધાંની નોંધ રાખવી જોઈએ.
- આયોજન કરતી વખતે પ્રોજેક્ટના હેતુઓ, વિષયવસ્તુ, જૂથરચના, જૂથ કાર્ય અને શૈક્ષણિક સંદર્ભ અને સાધનસામગ્રીનો પણ વિચાર કરવો જોઈએ.

#### [3] કાર્યક્રમનો અમલ :

- કાર્યક્રમની રૂપરેખા તૈયાર થઈ ગયા બાદ, તે મુજબ કાર્યની શરૂઆત કરવી. વિદ્યાર્થીઓને જે જવાબદારી સોંપવામાં આવી છે. તેના ઉપર કામ કરવાનું શરૂ કરે છે.
- વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારનું જ્ઞાન મેળવવું પડે છે. જેથી કરીને તેઓ જવાબદારીઓ પૂરી કરી શકે. આવી રીતે મેળવેલું જ્ઞાન વધારે કાયમી બને છે.
- શિક્ષક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. તેમના કાર્યનું નિરીક્ષણ કરે છે અને જરૂર જણાય ત્યાં ફેરફાર કરે છે.

#### [4] મૂલ્યાંકન :

- પ્રોજેક્ટ પૂરો થયા પછી શિક્ષક અને વિદ્યાર્થીઓ ભેગાં મળીને તેની મુલવણી કરશે. પ્રોજેક્ટનાં ઉદ્દેશ્યો ઉપર આધારિત તેની સફળતા અને નિષ્ફળતાની ચર્ચા કરશે.
- વિદ્યાર્થીઓ પોતાના કાર્યની ચર્ચા કરશે અને પોતાની ભૂલો સુધારશે અને ઉપયોગી જ્ઞાન ફરીથી મેળવશે.

### 10.3.8 પ્રોજેક્ટ પદ્ધતિના ફાયદા :

- સમગ્ર પ્રોજેક્ટના અમલ દરમિયાન વિદ્યાર્થીઓ સક્રિય રહે છે.
- વિદ્યાર્થીઓ કાળજીપૂર્વક મનન, અભ્યાસ અને કાર્ય કરે છે.
- તેમણે માનસિક અને શારીરિક કાર્ય કરવાનું હોય છે. આમ તેઓ શ્રમનું મૂલ્ય વધારે છે.
- વિદ્યાર્થીઓ પોતાની જવાબદારી સમજી તેની યોગ્ય વહેંચણી કરે છે.
- પ્રોજેક્ટ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ દ્વારા, ક્રિયા દ્વારા અધ્યયન પ્રક્રિયામાં ભાગ લે છે, જેથી તેમનું અધ્યયન સમૃદ્ધ બને છે.
- શૈક્ષણિક અને સામાજિક અનુભવોનો સમન્વય થવાથી અધ્યયન અનુબંધવાળું બને છે. જ્ઞાનની સમગ્રતા જળવાય છે.

- વિદ્યાર્થીઓને પોતાની પસંદગીનું અને રસ-રુચિ મુજબનું કાર્ય હોવાથી જ્ઞાનનો ભાર લાગતો નથી. પ્રવૃત્તિમાં સક્રિય ભાગીદાર બની, કાર્ય ઝડપી કરે છે.
- આ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. શિક્ષણને વાસ્તવિક જીવન સાથે સાંકળી શકાય છે. વિદ્યાર્થી અનુભવ દ્વારા જ્ઞાન મેળવે છે. આ રીતે મળેલું જ્ઞાન સાહજિક અને ચિરંજીવ બને છે. વિદ્યાર્થીઓને ગોખણપટ્ટી કરવી પડતી નથી.
- દરેક વિદ્યાર્થીના વ્યક્તિગત તફાવતો સંતોષાય છે. કારણ કે તેમને પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે પ્રવૃત્તિ મળી રહે છે.
- આ પદ્ધતિ 'ક્રિયા દ્વારા શિક્ષણ' પર આધારિત છે.
- વિદ્યાર્થીઓની માનસિક શક્તિઓનો વિકાસ થાય છે. આંતરસૂઝ, નિર્ણયશક્તિ, તર્કશક્તિ, વિચારવાની શક્તિ, વગેરે જેવી શક્તિઓનો વિકાસ થાય છે. આ ઉપરાંત આત્મવિશ્વાસ ધીરજ, ખંત, સહકારની ભાવના વગેરે જેવા ગુણોનો પણ વિકાસ થાય છે.
- શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધો પણ ઉષ્માપૂર્ણ બને છે. શિક્ષણની પ્રક્રિયા રસપ્રદ બને છે.

### 10.3.9 પ્રોજેક્ટ પદ્ધતિની મર્યાદાઓ :

- આ પદ્ધતિ વધારે સમય લે છે.
- આ પદ્ધતિ દ્વારા અભ્યાસક્રમ પૂરો કરવો મુશ્કેલ છે.
- તે બિનઅનુભવી શિક્ષક માટે સમસ્યાઓ ઊભી કરે છે.
- કેટલાક પ્રોજેક્ટ ખર્ચાળ હોય છે.
- વિદ્યાર્થી અમૂર્ત ખ્યાલોના સ્તર સુધી પહોંચી શકતા નથી. કારણ કે પ્રત્યક્ષ અનુભવ દ્વારા પ્રાપ્ત જ્ઞાનથી ટેવાઈ જાય છે, મૂર્ત ખ્યાલોમાં જ રાચે છે. ધીમે ધીમે મૂર્ત પરથી અમૂર્ત તરફ જવું જોઈએ. જે ઉચ્ચ શિક્ષણ માટે ખૂબ અગત્યનું છે તે તરફ જઈ શકતા નથી.
- કેટલાક પ્રોજેક્ટ લાંબા હોય તો તેમાં સમયનો વ્યય પુષ્કળ થાય છે અને આવા લાંબા પ્રોજેક્ટમાં સમયના વ્યયની સામે મળતા જ્ઞાનની માત્રા ઓછી હોય છે.
- મોટી સંખ્યાવાળા વર્ગોમાં આ પદ્ધતિને સફળતા મળતી નથી. કારણ કે અધ્યાપક સતત સક્રિય રહીને પણ મોટા વર્ગના તેના કાર્યને પહોંચી ન વળી શકે.
- પ્રોજેક્ટ પદ્ધતિની સમસ્યાઓ ઘણીવાર નાની વયના અધ્યેતાઓની કક્ષા બહારની હોય છે.
- આ પદ્ધતિમાં અધ્યેતાઓ રસ હોય તેવા કાર્યો ઉત્સાહથી કરે છે. પરંતુ જેમાં રસ ન હોય તેવા કાર્યો જબરજસ્તી નિરસ બની કરે છે.
- જો પ્રોજેક્ટ ખૂબ લાંબો હોય તો અધ્યેતાઓ કંટાળે છે અને ઘણીવાર અધૂરા પ્રોજેક્ટ છોડી દેવા પડે છે.
- જો અધ્યાપકમાં વિશાળ વાચન, ઊંડું જ્ઞાન, વિવિધ કૌશલ્યો અને આવડતો અને અધ્યેતાઓ પાસેથી કામ લેવાની કુનેહ નહીં હોય તો, તેઓ યોગ્ય માર્ગદર્શન નહીં આપી શકે અને તેથી અધ્યેતાઓ પ્રોજેક્ટમાં ડગલેને પગલે મૂંઝવણ અનુભવશે.
- આ પદ્ધતિમાં અધ્યાપકને ભાગે પુષ્કળ કામ હોય છે. તેથી ઘણીવાર અધ્યાપક પોતે કંટાળી જાય છે.
- પાઠ્યક્રમના બધા જ મુદ્દાઓ પ્રોજેક્ટ પદ્ધતિથી શીખવી શકાતા નથી. અમુક મર્યાદિત મુદ્દાઓ માટે જ આ પદ્ધતિ અનુકૂળ છે.

તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી જગ્યામાં જ લખો.

1. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતાનું નામ જણાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....

2. પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો કયા કયા છે ?

.....  
.....  
.....  
.....  
.....  
.....

3. પ્રોજેક્ટ પદ્ધતિના ફાયદા જણાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....

---

#### 10.4 જૂથ-ચર્ચા પદ્ધતિ :

---

##### 10.4.1 પ્રસ્તાવના :

- આ પદ્ધતિ નૂતન અધ્યાપન-અધ્યયન પદ્ધતિ છે. આ પદ્ધતિ અધ્યેતાકેન્દ્રિ પદ્ધતિ છે.
- “કોઈ એક પ્રશ્ન, સમસ્યા કે મુદ્દાને વિવિધ બાજુએથી વિચારવો, તપાસવો, કે તેનું વિશ્લેષણ કરવું તે અંગેની ચર્ચા જ્યારે અધ્યેતાઓના એક અથવા એકથી વધારે જૂથો દ્વારા થાય ત્યારે તેને જૂથ ચર્ચા પદ્ધતિ કહેવામાં આવે છે.” - વેડસર.
- આ પદ્ધતિમાં શિક્ષકનું કાર્ય માર્ગદર્શકનું છે. આ પદ્ધતિમાં અનેક અધ્યયન લક્ષી પ્રવૃત્તિઓ સમાયેલી છે. શીખતા શીખવું તે જ સાચું અધ્યયન છે એ આ પદ્ધતિનું હાર્દ છે.

##### 10.4.2 સંકલ્પના :

- મેટા ભાગની પદ્ધતિઓ શિક્ષણલક્ષી-અધ્યયનલક્ષી છે. જ્યારે આ પદ્ધતિ વિદ્યાર્થીલક્ષી - વિદ્યાર્થીકેન્દ્રિ છે.

- આ પદ્ધતિમાં કથન-વ્યાખ્યાન નહિ પણ ચર્ચા, પ્રશ્નોત્તરી, યોજના, કાર્ય, અહેવાલ, અધ્યયન અનુભવો વગેરે હોય છે.
- આ પદ્ધતિમાં શિક્ષક આયોજક હોય છે પરંતુ અમલીકરણની જવાબદારી વિદ્યાર્થીઓની હોય છે.
- આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ સક્રિય હોય છે. આ પદ્ધતિમાં એક વિદ્યાર્થી નહિ પણ વિદ્યાર્થી - જૂથ પોતાના વિચારો રજૂ કરે છે તથા જૂથ ભેગું મળી ચર્ચાવિચારણા કરી અંતિમ નિર્ણયો તારવે છે.

#### 10.4.3 જૂથ ચર્ચા પદ્ધતિના સોપાનો :

જૂથચર્ચા પદ્ધતિ દ્વારા અસરકારક અધ્યાપન માટે કાળજીપૂર્વક આયોજન કરવું જરૂરી છે. આ પદ્ધતિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક પૃથક્કરણ શક્તિ, તર્કસંગત અર્થઘટન અને નિર્ણય શક્તિના વિકાસનો છે. વિદ્યાર્થી નિષ્ક્રિય શ્રોતા ન બની રહેતા સક્રિય રીતે સામેલ થાય તે જરૂરી છે. શિક્ષકના અસરકારક નેતૃત્વ દ્વારા જૂથચર્ચા પદ્ધતિના હેતુઓ સિદ્ધ કરી શકાય છે.

##### [1] સમસ્યાની રજૂઆત :

- જૂથચર્ચાને યોગ્ય દોરવણી આપી સમસ્યાના ઉકેલ સુધી લઈ જવી એ એક કળા છે. આ માટે શિક્ષકે અગાઉથી સમસ્યાનો ગહન અભ્યાસ કરવો જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થીઓને રસ પડે અને તેમનો ઉત્સાહ જળવાઈ રહે તે રીતે સમસ્યાની રજૂઆત કરવી જોઈએ.
- સમસ્યાની અસરકારક રજૂઆત માટે વિવિધ પ્રયુક્તિઓ ઉપયોગમાં લઈ શકાય. જેમકે કોઈ ઘટનાનું પ્રયોગ દ્વારા નિદર્શન કરી અંતે પ્રશ્ન રજૂ કરી શકાય. પાંચ-સાત મિનિટની ફિલ્મ દર્શાવી ત્યારબાદ તેના આધારે ચર્ચાનો વિષય મૂકી શકાય. કોઈ વાર્તા કે સામાજિક સમસ્યાની રજૂઆત કરીને જૂથચર્ચા માટેનો વિષય વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી શકાય.

##### [2] જૂથની રચના :

- સમસ્યાની રજૂઆત કર્યા બાદ વિદ્યાર્થીઓને 4-10નાં નાના નાના જૂથમાં વિભાજિત કરવા જોઈએ. જૂથની રચના હાજરીપત્રકના નંબર અનુસાર, બુદ્ધિક્ષા અનુસાર કે રસના ક્ષેત્ર અનુસાર કરી શકાય. પ્રત્યેક જૂથમાં એક જૂથ નેતા તથા એક અહેવાલ લેખકની નિમણૂક કરી દેવી જોઈએ.

##### [3] સંભવિત ઉકેલ અને ઉત્કલ્પનાની રચના માટે પ્રોત્સાહન :

- પ્રત્યેક જૂથની રચના બાદ જ સભ્યો સમસ્યાના સંભવિત ઉકેલ માટે ચર્ચા-વિચારણા કરે, ઉત્કલ્પનાની રચના કરે તે માટે શિક્ષકે પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ.

##### [4] સંભવિત પુરાવાઓની શોધ :

- વિદ્યાર્થીઓને તેમના અવલોકન તેમજ અન્ય સંદર્ભ સાહિત્યના અભ્યાસના આધારે સમસ્યાના સંભવિત ઉકેલ સંબંધિત પુરાવાઓ એકત્ર કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. જૂથના નેતા તથા અહેવાલ લેખક બધા જ સભ્યો સાથે સાથે ચર્ચા કરી તેમના જૂથનો એક અહેવાલ તૈયાર કરે છે.

##### [5] જૂથચર્ચા દ્વારા નિર્ણયની તારવણી :

- પ્રત્યેક જૂથના નેતા પોતપોતાના મંતવ્યો રજૂ કરે છે. અન્ય સભ્યો પણ પોતાનાં વિચારોની આપ-લે કરે છે. સમસ્યાના ઉકેલ માટે તંદુરસ્ત ચર્ચાનું વાતાવરણ રચાય છે. અને અંતિમ નિર્ણય સહમતિ દ્વારા લેવામાં આવે છે. અંતિમ અહેવાલમાં ખૂટતી બાબતોની શિક્ષક દ્વારા પૂર્તિ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા લોકશાહી ઢબે ચાલે છે.

#### 10.4.4 જૂથચર્યામાં શિક્ષકની ભૂમિકા :

- જૂથચર્યાના સફળ અમલીકરણ માટે સમયેસમયે ઉત્પન્ન થતી પરિસ્થિતિને શિક્ષકે કાળજીપૂર્વક સંભાળવી પડે છે. જૂથચર્યામાં શિક્ષક સૌ પ્રથમ વિષય નક્કી કરે. વિષય એકમ નક્કી કરી સમગ્ર કાર્યનું પૂરું આયોજન કરે.
- જૂથ ચર્યા માટે વાતાવરણ તૈયાર કરે. જૂથની યોગ્ય રચના કરે. જરૂરી સંદર્ભ સાહિત્ય અને માર્ગદર્શન આપે. જૂથના સંપર્કમાં રહે અને સમગ્ર કાર્યનું અવલોકન કરે.
- જૂથ ચર્યા યોગ્ય રીતે ચાલતી રહે તે જોવું. ચર્યા વિષયને અનુરૂપ જ થાય અને ગેરમાર્ગે ન દોરવાય તે જોવું.
- બધા જ વિદ્યાર્થીઓ ચર્યામાં જોડાય, સક્રિય રહે તે માટે પ્રયત્નો કરવા. અતિવાચાળ, નેતૃત્વ ઝડપી લેનાર વિદ્યાર્થીનું વર્ચસ્વ ન સ્થપાય તેની કાળજી લેવી.
- વિદ્યાર્થીઓને યોગ્ય જરૂરી પ્રોત્સાહન પૂરું પાડવું અનુચિત રજૂઆતોને સ્વીકારવી નહીં. સમયે-સમયે સારાંશ કાઢતા રહેવું. ઉચિત તારણો તરફ ચર્યાને દોરવી.
- વિદ્યાર્થીઓ રસ ગુમાવવા લાગે ત્યારે ચર્યાનો યોગ્ય અંત લાવવો. આમ આ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા ખૂબ મહત્વની, માર્ગદર્શક તરીકેની છે.

#### 10.4.5 જૂથચર્યા પર અસર કરતાં પરિબળો :

##### ● જૂથનું કદ :

જૂથના સભ્યોની સંખ્યા ઓછી હોય તેમ વિદ્યાર્થીઓની અર્થસભર સામેલગીરી વધે છે જે શૈક્ષણિક હેતુઓની સંતોષકારક સિદ્ધિનું પ્રમાણ વધારે છે.

##### ● જૂથ સંરચના :

જૂથનાં સભ્યો વય, માનસિક કક્ષા તથા સ્વભાવમાં સમરૂપ હોય તો તેઓની વચ્ચે આંતરક્રિયા વધુ અસરકારક બને છે.

##### ● જૂથના સભ્યો :

જૂથના સભ્યો અંદરોઅંદર એકબીજાને પસંદ કરતા હોય, સહકારયુક્ત વર્તન દાખવતા હોય તો તેમની વચ્ચેનું પ્રત્યાયન ફળદાયી બને છે અને સામેલગીરી વધે છે.

##### ● જૂથચર્યાનું વાતાવરણ :

જૂથચર્યાનું વાતાવરણ લોકશાહી અને વિકેન્દ્રિત હોય, સભ્યોને પોતાના વિચારોની અભિવ્યક્તિ મૂક્ત રીતે કરવાની છૂટ હોય ત્યાં તંદુરસ્ત ચર્યાનું વાતાવરણ રચાય છે.

##### ● શિક્ષકની નેતૃત્વ શક્તિ :

શિક્ષકની નેતૃત્વ શક્તિ જૂથ ચર્યા પર ખૂબ જ અસર કરે છે. શિક્ષકના સબળ નેતૃત્વના અભાવે જૂથચર્યા નિષ્ફળ જવાની સંભાવના રહે છે.

##### ● જૂથ ચર્યાના ધોરણો :

જૂથના સભ્યો દ્વારા કેટલાંક ઉચ્ચ ધોરણોનું પાલન કરવામાં આવે જેમ કે અન્યના વિચારોનો આદર કરવો, તર્કબદ્ધ કારણ સંગત રજૂઆત કરવી વગેરે દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી જૂથચર્યા યોજી શકાય.

#### 10.4.6 જૂથચર્યા પદ્ધતિના ફાયદા :

- આ પદ્ધતિમાં સમગ્ર વર્ગના વિદ્યાર્થીઓને જૂથોમાં વહેંચી નાખવામાં આવે છે. મોટા વર્ગ કરતા નાનાં જૂથોમાં અધ્યાપન કાર્ય વધુ સારું થઈ શકે છે. કારણ કે અહીં અધ્યયન પ્રક્રિયા વ્યક્તિગત બને છે. અધ્યાપક અધ્યેતાઓના સંપર્કમાં આવે છે. તેથી અધ્યેતાઓની વ્યક્તિગત જરૂરિયાતોને શિક્ષક સમજે છે.

- આ પદ્ધતિમાં અધ્યેતાઓ સમૂહમાં કાર્ય કરતા હોવાથી તેમનામાં સામાજિકીકરણની પ્રક્રિયા વેગવંતી બને છે. તેથી તેમનામાં સમૂહજીવનની ભાવના વિકસે છે. અધ્યેતાઓને સામાજિક અનુભવ આપવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે.
- આ પદ્ધતિમાં દરેક જૂથમાં અધ્યેતાઓ એકબીજાની નજીક આવે છે. અધ્યેતાઓ અધ્યાપક કરતાં પોતાના સમવયસ્ક સાથીદાર વિદ્યાર્થીઓ પાસેથી વધુ સરળ રીતે શીખી શકે છે. તેમનામાં સહકારની ભાવના વિકસે છે. આંતરવ્યવહાર ગાઢ અને સરળ બને છે.
- આ પદ્ધતિ દ્વારા થતું અધ્યયન અસરકારક અને વ્યવહારું બને છે.
- જૂથચર્યા પદ્ધતિમાં સામૂહિક વિકાસની સાથેસાથે અધ્યેતાનો વ્યક્તિગત વિકાસ પણ થાય છે.
- જૂથમાં વ્યક્તિગત સંપર્ક સાધવાથી અધ્યેતાઓમાં પોતાના વિચારો નીડરતાથી રજૂ કરવાની હિંમત આવે છે. વળી જૂથના અન્ય સભ્યોના વિચારો પોતાનાથી જુદા પડતા હોય તો તે પણ સાંભળવાની સહિષ્ણુતા તેમનામાં ઉત્પન્ન થાય છે. પરિણામે અધ્યેતાનો આત્મવિકાસ થાય છે.
- જૂથ નેતાઓમાં નેતૃત્વનો ગુણ વિકસે છે, તેમજ જૂથના બધા અધ્યેતાઓને લોકશાહીની તાલીમ મળે છે. અને તેમનામાં ઉત્તમ નાગરિક બનવાના ગુણો વિકસે છે.
- જૂથ ચર્યા પદ્ધતિમાં અધ્યેતા વિવિધ પુસ્તકો, સામયિકો, અખબારો વગેરેનું વાંચન કરતા થાય છે પરિણામે વિદ્યાર્થીમાં સ્વઅધ્યયનની ટેવ વિકસે છે.
- સમસ્યાઓ અને પ્રશ્નોનો ઉકેલ આ પદ્ધતિમાં સમૂહ-જૂથમાં થાય છે. જેથી પરસ્પરના વિચારો અને ચિંતનની આપલે થતાં અધ્યેતાઓનો બૌદ્ધિક વિકાસ થાય છે.
- સ્વપ્રયત્ને કાર્ય કરવાનું હોવાથી અધ્યેતા હંમેશા સક્રિય, સજાગ અને સ્વાવલંબી રહે છે.
- અધ્યેતાઓમાં આત્મવિશ્વાસ વધે છે. તેથી તેમની વિચાર કરવાની આવડતમાં વધારો થાય છે.
- અધ્યેતાઓની વ્યક્તિગત મૂંઝવણ, અસ્પષ્ટતા અને અસ્વસ્થતા દૂર થાય છે. અધ્યેતા મોટા વર્ગમાં પોતાની મૂંઝવણ રજૂ કરી શકતો નથી અને ઘણીવાર સંકોચ અનુભવે છે, પરંતુ નાના જૂથમાં તે પોતાની રજૂઆત કરી શકે છે અને તેથી તેની મૂંઝવણ કે મૂશ્કેલી દૂર કરી શકે છે.
- અધ્યેતામાં વૈજ્ઞાનિક દષ્ટિકોણ પ્રગટ થાય છે અને તેથી પૂર્વગ્રહો દૂર થાય છે.
- આ પદ્ધતિમાં અધ્યેતા વિષયના મુદ્દાની ભિન્ન ભિન્ન બાજુએથી સર્વાંગી માહિતી મેળવી શકે છે.
- અધ્યેતાઓ જે-તે વિષય મુદ્દાની સહકારી ચિંતન અને ચર્યા દ્વારા સ્પષ્ટ સમજ વિકસાવી શકે છે.
- અધ્યેતાઓ ભિન્ન ભિન્ન વિચારોને સંકલિત કરવાનું કૌશલ્ય પ્રાપ્ત કરી શકે છે. અને પોતાના વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરવાનું કૌશલ્ય કેળવે છે.

#### 10.4.7 જૂથ ચર્યા પદ્ધતિની મર્યાદાઓ :

- આ પદ્ધતિની સૌથી મોટી મર્યાદા એ છે કે તેના દ્વારા અભ્યાસક્રમના બધા જ મુદ્દાઓ ન શીખવી શકાય.
- આ પદ્ધતિમાં સંચાલનનું યોગ્ય નિયંત્રણ ન હોય તો વિષયાંતર થવાની શક્યતાઓ વધારે રહે છે.
- આ પદ્ધતિમાં બધા જ અધ્યેતાઓ સક્રિય બનતા નથી. જે નિષ્ક્રિય છે તે વ્યક્તિગત શિક્ષણના અભાવે વધુ નિષ્ક્રિય બને છે.
- પરીક્ષાલક્ષી શિક્ષણને કારણે આ પદ્ધતિની સફળતાની શક્યતાઓ ઓછી છે.
- ફર્નીચરનો અભાવ, ચીલાચાલુ વર્ગખંડને કારણે આ પદ્ધતિને તે બાધક બને છે.
- નાની વયના અધ્યેતાઓ માટે આ પદ્ધતિ ઉપયોગી નથી.
- આ પદ્ધતિમાં વ્યવસ્થા અને આયોજન પાછળ વધુ સમય અને શક્તિ ખર્ચાય છે.

- આ પદ્ધતિમાં જો યોગ્ય આયોજન ન થયું હોય તો તે નિષ્ફળ જાય છે.
- આ પદ્ધતિમાં વિષય નાનાનાના મુદ્દાઓમાં વિભાજિત થવાથી જ્ઞાનની અખંડિતતા જળવાતી નથી.
- ક્યારેક ઘણા અધ્યેતાઓમાં આ પદ્ધતિ મુજબ કામ કરવાનો આત્મવિશ્વાસ અને કૌશલ્ય હોતાં નથી.

● તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી જગ્યામાં જ લખો.

1. જૂથ ચર્ચા પદ્ધતિની સંકલ્પના સ્પષ્ટ કરો.

.....

.....

.....

.....

.....

.....

2. જૂથ ચર્ચા પદ્ધતિના સોપાનો જણાવો.

.....

.....

.....

.....

.....

.....

3. જૂથચર્ચા પર અસર કરતાં પરિબળો કયા કયા છે ?

.....

.....

.....

.....

.....

.....

.....

.....

---

## 10.5 સ્વાધ્યાય પદ્ધતિ :

---

### 10.5.1 પ્રસ્તાવના :

- સ્વાધ્યાય એટલે સ્વ અધ્યાય- જાતે કરેલો અભ્યાસ. સંસ્કૃતમાં એક ઉક્તિ છે, “ગુરુણામ્ ગુરુઃ સ્વાધ્યાયઃ ।” અર્થાત્ સ્વાધ્યાય એ ગુરૂનો પણ ગુરૂ છે. તેથી સ્વાધ્યાય સર્વશ્રેષ્ઠ ગુરૂ છે. જ્યાં સુધી શિક્ષણના અનુભવો અધ્યેતાના પોતાના ન બને ત્યાં સુધી તેને જ્ઞાન ન મળે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં અધ્યાપક, માર્ગદર્શન અને પ્રયોગોની જરૂર પડે છે છતાં ઘણા માહિતી



પ્રધાન એકમો છે જે સ્વાધ્યાય પદ્ધતિથી શીખવી શકાય. “સ્વાધ્યાય એ અધ્યેતાઓને વર્ગમાં કે વર્ગ બહાર આપવામાં આવતું કાર્ય છે.”

### 10.5.2 સંકલ્પના :

- સ્વાધ્યાય એ સ્વઅધ્યયનની પ્રવૃત્તિ છે. સ્વાધ્યાય એ ગૃહકાર્ય નથી. ગૃહકાર્ય એ માત્ર ઘરે, વર્ગની બહાર કરવાનું હોય છે. જ્યારે સ્વાધ્યાય તો વર્ગખંડમાં, શાળાના અન્ય કોઈ ખંડોમાં અથવા શાળા બહાર પણ થઈ શકે છે. તેથી ગૃહકાર્યને સ્વાધ્યાયનું એક અંગ કહી શકાય.
- સ્વાધ્યાયના હેતુઓ સ્પષ્ટ હોય છે. સ્વાધ્યાય લાંબી કે ટૂંકી મુદતના હોઈ શકે. સ્વાધ્યાયમાં સોંપેલ કાર્ય પ્રવૃત્તિ માટેની ચોક્કસ પ્રક્રિયા છે. સ્વાધ્યાયની રચના પ્રશ્નો કે પ્રવૃત્તિઓની રચના કુશળતાપૂર્વક કરવામાં આવેલી હોવી જોઈએ.
- સ્વાધ્યાય વ્યક્તિગત અને જૂથમાં બંને રીતે આપી શકાય. સ્વાધ્યાય પદ્ધતિ દ્વારા અભ્યાસના હેતુઓ સિદ્ધ થઈ શકે છે. સ્વાધ્યાય પદ્ધતિ દ્વારા અધ્યેતાને શીખવા માટે પ્રોત્સાહિત અને અભિપ્રેરિત કરે છે.
- સ્વાધ્યાય દ્વારા અધ્યેતાઓ અભ્યાસ કૌશલ્યો વિકસાવી શકે છે, સંબંધો પ્રસ્થાપિત કરી શકે, વ્યક્તિગત વિકાસ સાધી શકે, અભ્યાસનું વિષયવસ્તુ શોધી તેને ઉપયોગમાં લેવાની શક્તિ વિકસાવે છે.
- સ્વાધ્યાય પદ્ધતિ દ્વારા અધ્યેતાઓ સંદર્ભ સાહિત્યનો મહત્તમ ઉપયોગ કરે છે. સ્વાધ્યાય પદ્ધતિથી અધ્યેતાની માનસિક શક્તિનો વિકાસ થાય છે.
- સ્વાધ્યાય પ્રશ્નોમાં વૈવિધ્ય હોવું જરૂરી છે. જવાબો શક્ય તેટલા ટૂંકા આવે તેવા પ્રશ્નો સ્વાધ્યાયમાં હોવા જોઈએ. તે માટે નિબંધ પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને અનાત્મલક્ષી પ્રશ્નો હોવા જોઈએ.
- સ્વાધ્યાય પ્રશ્નોના જવાબો હંમેશા લેખિત સ્વરૂપમાં ન પણ હોય કોઈ વાર ચિત્ર કે આકૃતિ દોરવી, અવલોકન કરવું, પ્રયોગ કરવો વગેરે જેવા વૈવિધ્યસભર હોવા જરૂરી છે.
- સીધા શબ્દશઃ ઉત્તરોને બદલે સમજણ ચકાસે તેવા ઉત્તરો તથા કોઈ સિદ્ધાંતને આધારે ઉત્તરો આપવા પડે તેવા પ્રશ્નો હોવા જોઈએ.
- સ્વાધ્યાય કોઈ એક મુખ્ય એકમ કે પેટા એકમને આવરી લે તેવો સાતત્યપૂર્ણ હોવો જોઈએ.
- સ્વાધ્યાયના ઉત્તરો તપાસવાની, સુધારવાની અને મૂલ્યાંકન કરવાની પદ્ધતિ બને એટલી સરળ હોવી જોઈએ.
- સ્વાધ્યાય પદ્ધતિ કાયમી અધ્યયન વર્તનો વિકસાવે છે. તેનું લક્ષ્યાંક વિદ્યાર્થીઓને ચિંતન કરતો કરવાનો છે.
- આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ પુસ્તકાલયો અને પ્રયોગશાળામાં જ્યાં જરૂર હોય ત્યાં કામ કરે છે. શિક્ષક નિરીક્ષણ કરે છે અને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે. વિદ્યાર્થીઓ પોતે કરેલા કાર્યની નોંધ કરે છે. સ્વાધ્યાયમાં શિક્ષકનું માર્ગદર્શન ઓછામાં ઓછું હોય છે.
- પરંતુ ઘણી વખત શિક્ષક સારા સ્વાધ્યાયના ગુણોથી પરિચિત ન હોવાથી સારા સ્વાધ્યાય રચી શકાતા નથી. સારા સ્વાધ્યાયના ગુણો નીચે મુજબ છે.

### 10.5.3 સારા સ્વાધ્યાયની લાક્ષણિકતાઓ :

- અભ્યાસક્રમ સાથે સંબંધિત.
- પોતાના કાર્યમાં વિશિષ્ટ.
- ઉદ્દેશ્યો સાથે સુસંગત.
- વિદ્યાર્થીઓની જરૂરિયાત ઉપર આધારિત.

- વિદ્યાર્થી વિચારતો થાય તેવું સ્વાધ્યાય આપવું.
- રસપ્રદ, પડકારરૂપ, વિદ્યાર્થીઓની કક્ષા, શક્તિ, વગેરેને યોગ્ય હોવું જોઈએ.
- પાઠ-આયોજનના વિશિષ્ટ હેતુઓને સિદ્ધ કરે તેવો હોય.
- શિક્ષકના ઓછામાં ઓછા માર્ગદર્શનની જરૂર પડે તેવો હોય.

#### 10.5.4 સ્વાધ્યાય ક્યારે આપી શકાય ? :

- એકમ માટેની પૂર્વતૈયારી રૂપે પાઠની શરૂઆતમાં.
- પાઠ દરમિયાન ઉપસ્થિત થતી વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે આપી શકાય.

#### 10.5.5 સ્વાધ્યાય પદ્ધતિના ફાયદા :

- આ પદ્ધતિ દ્વારા અध्येતામાં વાંચન, અર્થગ્રહણ, સર્જન, નોંધ કરવી વગેરે જેવાં વિવિધ કૌશલ્યો વિકસાવી શકાય છે.
- અध्येતા સ્વપ્રયત્ને નિયત વિષયવસ્તુની માહિતી પ્રાપ્ત કરે છે.
- અध्येતા વિવિધ સાધનસામગ્રી અને સંદર્ભસાહિત્યના ઉપયોગ દ્વારા માહિતીની તારવણી અને નોંધ કરતાં શીખે છે.
- અભ્યાસક્રમના વિસ્તૃત મુદ્દાઓને સ્વાધ્યાય દ્વારા એક સાથે આવરી લઈ શકાય છે.
- અध्येતાઓને ફુરસદના સમયનો યોગ્ય ઉપયોગ કરવાની ટેવ પડે છે.
- અध्येતાઓમાં આત્મવિશ્વાસ, સાહસ, સંશોધનવૃત્તિ, સ્વાવલંબનની ટેવો વિકસે છે. શિસ્તના પ્રશ્નો ઉદ્ભવતા નથી.
- આ પદ્ધતિ ક્રિયા દ્વારા શિક્ષણના સિદ્ધાંત પર આધારિત છે.
- અધ્યાપક નબળા અध्येતાઓને તેમની અભ્યાસ ઝડપ વધારવામાં અને તેજસ્વી અध्येતાઓને વધારાના વાંચન અને વધારાના પ્રયોગ કાર્ય અંગે માર્ગદર્શન આપી તેમની પ્રગતિને વધુ ઝડપી બનાવી શકે છે.

#### 10.5.6 સ્વાધ્યાય પદ્ધતિની મર્યાદાઓ :

- જો જૂથ સ્વાધ્યાય આપવામાં આવે તો વિષયવસ્તુ નાના નાના ભાગોમાં વિભાજિત થઈ જાય છે. એક જૂથ જે સ્વાધ્યાય કરે છે તે અન્ય જૂથ કરતું નથી.
- નાના વર્ગોના અध्येતાઓ માટે આ પદ્ધતિની સફળતાની શક્યતાઓ ઓછી છે.
- જો શાળામાં સમૃદ્ધ પુસ્તકાલય ન હોય ત્યાં આ પદ્ધતિ સફળ બનતી નથી.
- આ પદ્ધતિ અધ્યાપક અને અध्येતા બંને પક્ષે પુષ્કળ તૈયારી માંગી લે છે.
- જૂથ સ્વાધ્યાયમાં કેટલાક સભ્યો સક્રિય હોય છે જ્યારે કેટલાક સભ્યો નિષ્ક્રિય હોય છે.
- ઘણીવાર સ્વાધ્યાય માત્ર પુસ્તકિયા બની જાય છે.
- અध्येતાના ગૃહ સ્વાધ્યાયમાં મદદ કરે તેવી સાધનસામગ્રી, અન્ય વાચન કે કુટુંબનું વાતાવરણ તેની પાસે હોતું નથી.
- આ પદ્ધતિ માટે ઘણીવાર સ્વાધ્યાય આયોજન, માર્ગદર્શન અને મૂલ્યાંકન માટેની અધ્યાપકની કાં તો તૈયારી જ હોતી નથી અથવા તેની પાસે સમય જ હોતો નથી.
- આ પદ્ધતિ દ્વારા પ્રયોગ કરાવવો મુશ્કેલ છે. માટે પ્રાયોગિક કૌશલ્યો કેળવવા શક્ય નથી.
- અध्येતાઓ જાતે કાર્ય ન કરે પણ અન્યમાંથી નકલ કરે તેવો આ પદ્ધતિમાં પૂરો સંભવ છે. નકલ કરનાર અध्येતાને કોઈ જ લાભ થતો નથી.

- આ પદ્ધતિમાં સમય વધારે થતો હોવાથી અને અભ્યાસક્રમ લાંબો હોવાથી આ પદ્ધતિ દ્વારા પાઠ્યક્રમ નિયત સમયમાં પૂર્ણ થઈ શકતો નથી.

- તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી જગ્યામાં જ લખો.

1. સ્વાધ્યાય પદ્ધતિની લાક્ષણિકતાઓ જણાવો.

.....

.....

.....

.....

.....

.....

2. સ્વાધ્યાય ક્યારે આપી શકાય ?

.....

.....

.....

.....

.....

.....

3. સ્વાધ્યાય પદ્ધતિની મર્યાદાઓ જણાવો.

.....

.....

.....

.....

.....

.....

## 10.6 સારાંશ :

આ એકમમાં તમે વિજ્ઞાનના અધ્યાપનકાર્યને અસરકારક બનાવવા માટેની પદ્ધતિઓ વિશે શીખ્યા, પ્રોજેક્ટ પદ્ધતિની વ્યાખ્યા, લાક્ષણિકતાઓ ઉપરાંત વિજ્ઞાન શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિની જરૂરીયાત, પ્રોજેક્ટ પદ્ધતિના સિદ્ધાંતો, પ્રોજેક્ટના વિવિધ પ્રકારો, પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો તેમજ પ્રોજેક્ટ પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી. ત્યારબાદ જૂથચર્ચા પર અસર કરતા પરિબળો અને જૂથચર્ચા પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓની વિગતે જાણકારી મેળવી. તેમજ સ્વાધ્યાય પદ્ધતિ વિશે પણ વિગતે અભ્યાસ કર્યો. સ્વાધ્યાય પદ્ધતિની લાક્ષણિકતાઓ.

સ્વાધ્યાય ક્યારે આપવું? અને તેના ફાયદા અને મર્યાદાઓનો અભ્યાસ કર્યો. વિજ્ઞાનના અસરકારક અધ્યાપનકાર્ય માટે શિક્ષકે વિજ્ઞાન શિક્ષણની વિવિધ અધ્યાપન પદ્ધતિઓથી માહિતગાર થવું ખૂબ અનિવાર્ય છે. અભ્યાસના હેતુઓ, વિદ્યાર્થીઓની ક્ષમતા, જરૂરીયાત, વિષયવસ્તુના મુદ્દા, ઉપલબ્ધ શૈક્ષણિક સાધન સામગ્રી, સુવિધા વગેરે બાબતો ધ્યાનમાં રાખી સભાન રહી યોગ્ય અધ્યાપન પદ્ધતિની પસંદગી કરી તેના અમલ દ્વારા અસરકારક અધ્યાપન કાર્ય કરાવી શકાય છે.

---

### 10.7 સ્વાધ્યાય :

---

- (1) પ્રોજેક્ટ પદ્ધતિની વ્યાખ્યા આપો.
- (2) પ્રોજેક્ટ પદ્ધતિ એટલે શું ? તેની લાક્ષણિકતાઓની વિસ્તૃતમાં ચર્ચા કરો.
- (3) વિજ્ઞાન શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિની જરૂરીયાત વર્ણવો.
- (4) પ્રોજેક્ટ પદ્ધતિના સિદ્ધાંતોની વિસ્તૃતમાં ચર્ચા કરો.
- (5) પ્રોજેક્ટ પદ્ધતિના પ્રકારો સવિસ્તૃત વર્ણવો.
- (6) પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનોનું વિસ્તૃતમાં વર્ણન કરો.
- (7) પ્રોજેક્ટ પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ જણાવો.
- (8) જૂથચર્ચા પદ્ધતિ એટલે શું ? તેની સંકલ્પના સ્પષ્ટ કરો.
- (9) જૂથચર્ચા પદ્ધતિના સોપાનોનું વિસ્તૃતમાં વર્ણન કરો.
- (10) જૂથચર્ચા પદ્ધતિમાં વિજ્ઞાન શિક્ષકની ભૂમિકા જણાવો.
- (11) જૂથચર્ચા પદ્ધતિ પર અસર કરતા પરિબળોનું વિસ્તૃતમાં વર્ણન કરો.
- (12) જૂથચર્ચા પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ જણાવો.
- (13) સ્વાધ્યાય પદ્ધતિ એટલે શું ? તેની સંકલ્પના સ્પષ્ટ કરો.
- (14) સારા સ્વાધ્યાયની લાક્ષણિકતાઓ જણાવી, સ્વાધ્યાય ક્યારે આપી શકાય ?
- (15) સ્વાધ્યાય પદ્ધતિના ફાયદા કયા કયા છે ?
- (16) સ્વાધ્યાય પદ્ધતિની મર્યાદાઓ જણાવો.

: રૂપરેખા :

- 11.1 પ્રસ્તાવના
- 11.2 ઉદ્દેશો
- 11.3 અધ્યાપન અભિગમ
- 11.4 અભિગમોનું મહત્ત્વ
- 11.5 આગમન-નિગમન અભિગમ
  - 11.5.1 પ્રસ્તાવના
  - 11.5.2 આગમન અભિગમ
  - 11.5.3 આગમન અભિગમનાં લાભ
  - 11.5.4 આગમન અભિગમની મર્યાદાઓ
  - 11.5.5 નિગમન અભિગમ
  - 11.5.6 નિગમન અભિગમના લાભ
  - 11.5.7 નિગમન અભિગમની મર્યાદાઓ
  - 11.5.8 આગમન-નિગમન અભિગમની તુલના
- 11.6 સમસ્યા ઉકેલ અભિગમ
  - 11.6.1 પ્રસ્તાવના
  - 11.6.2 સમસ્યા ઉકેલ અભિગમના સોપાનો
  - 11.6.3 સમસ્યા ઉકેલ અભિગમના લાભ
  - 11.6.4 સમસ્યા ઉકેલ અભિગમની મર્યાદાઓ
- 11.7 સંરચનાવાદી અભિગમ
  - 11.7.1 પ્રસ્તાવના
  - 11.7.2 સંરચનાવાદી અભિગમ : અર્થ અને સંકલ્પના
  - 11.7.3 સંરચનાવાદી અભિગમના લક્ષણો
  - 11.7.4 સંરચનાવાદી અભિગમમાં શિક્ષકની ભૂમિકા
  - 11.7.5 સંરચનાવાદી વર્ગખંડ માટેની શૈક્ષણિક પરિસ્થિતિઓ
  - 11.7.6 વિજ્ઞાનના અધ્યાપનમાં સંરચનાવાદી અભિગમનો અમલ
  - 11.7.7 સંરચનાવાદી અભિગમના લાભ
  - 11.7.8 સંરચનાવાદી અભિગમની મર્યાદાઓ
- 11.8 મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત આધારિત અભિગમ અથવા અધ્યાપનનાં સૂત્રો
  - 11.8.1 પ્રસ્તાવના
  - 11.8.2 જ્ઞાતથી અજ્ઞાત તરફ
  - 11.8.3 સરળથી કઠિન (સંકુલ) તરફ

- 11.8.4 મૂર્ત પરથી અમૂર્ત તરફ
- 11.8.5 સંપૂર્ણથી વિભાગ (અંશ) તરફ
- 11.8.6 વિભાગ પરથી સંપૂર્ણ તરફ
- 11.8.7 વિશ્લેષણ પરથી સંયોજન તરફ

## 11.9 સારાંશ

## 11.10 સ્વાધ્યાય

### 11.1 પ્રસ્તાવના :

વિજ્ઞાનના બે મૂળભૂત ઘટકો વિષયવસ્તુ અને પ્રક્રિયા છે. વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં વિષયવસ્તુ જેમાં નિયમો, વાદો, સિદ્ધાંતો, સમીકરણો અને સંકલ્પનાઓને વર્ગીકૃત કરી શકાય છે. કોઈ ચોક્કસ વિષયવસ્તુ અંતે પ્રક્રિયાઓનું શિક્ષણ જેમાં વિજ્ઞાનનું સ્વરૂપ અને વિજ્ઞાન શિક્ષણના હેતુઓ ઉપરાંત બાળકોની જ્ઞાનાત્મક કક્ષા અને વર્ગખંડમાં ઉત્પન્ન થનાર પરિસ્થિતિના અધ્યાયન માટે વિવિધ અભિગમોનો ઉપયોગ કરવામાં આવે છે. તમે અભિગમ અને પદ્ધતિ શબ્દથી પરિચિત હશો જ. ઘણા આ બંને શબ્દોનો એકબીજાના વિકલ્પમાં ઉપયોગ કરતા હોય છે. પરંતુ અભિગમ અને પદ્ધતિ શબ્દો પરસ્પર સંબંધિત હોવા છતાં તેમની વચ્ચે પાતળી ભેદરેખા પણ છે. જે તેમને એકબીજાથી અલગ પાડે છે. અભિગમ કોઈ ચોક્કસ સમસ્યા સાથે સંબંધિત તમામ પાસાઓને સાંકળનાર એક સર્વાંગી માર્ગ છે. તે કાર્ય માટે એક સામાન્ય યોજના છે. જેના આધારે વિવિધ પ્રતિમાનો કે પદ્ધતિઓનો ઉદ્ભવ થાય છે તેમ છતાં ચોક્કસ અભિગમ ઉપર આધારિત વિચારોની ક્રમિક અને તાર્કિક ગોઠવણી એ પદ્ધતિ છે. વિજ્ઞાન શિક્ષણ માટે ઘણા બધા અભિગમો છે. આ એકમમાં નીચે મૂજબના અભિગમોની ચર્ચા કરવામાં આવી છે.

- આગમન નિગમન અભિગમ
- સમસ્યા ઉકેલ અભિગમ
- સંરચનાવાદી અભિગમ
- મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત આધારિત અભિગમ (અધ્યાપન સૂત્રો)

### 11.2 ઉદ્દેશો :

- આ એકમ પૂર્ણ કર્યા પછી પ્રશિક્ષણાર્થી નીચેના બાબતોમાં સક્ષમ બની શકશે.
- વિજ્ઞાન શિક્ષણના અભિગમ અને તેના મહત્વનું વર્ણન કરી શકે.
- પ્રત્યેક અભિગમના લાભ, મર્યાદાઓ, સોપાનો, લક્ષણોની વિગતવાર અને ચોક્કસ રીતે રજૂઆત કરી શકે.
- વિવિધ અભિગમ વચ્ચેનો તફાવત જાણી શકે.
- વિજ્ઞાનના અધ્યાપન કાર્ય દરમિયાન વિષયવસ્તુના મુદ્દા અને વર્ગખંડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યોગ્ય અભિગમનો ઉપયોગ કરી અસરકારક અધ્યાપન કરી શકશે.

### 11.3 અધ્યાપન અભિગમ :

અભિગમનો અર્થ થાય છે પહોંચવાનો માર્ગ. શિક્ષણના ધ્યેયો સિદ્ધ કરવાનો આપણો માર્ગ એટલે અભિગમ. અભિગમ એ ઘોરી માર્ગ છે. વર્ગખંડ શિક્ષણના બે અભિગમ છે. વિદ્યાર્થી કેન્દ્રી અભિગમ અને શિક્ષકકેન્દ્રી અભિગમ. બંને અભિગમ સ્પષ્ટ રીતે ભિન્ન છે. એકમાં વર્ગખંડની સમગ્ર પ્રક્રિયામાં વિદ્યાર્થી કેન્દ્ર સ્થાને છે, સક્રિય છે. શિક્ષક માત્ર માર્ગદર્શક છે. શિક્ષક કેન્દ્રી અભિગમમાં શિક્ષક કેન્દ્ર સ્થાને છે જ્યારે વિદ્યાર્થી ગૌણ છે. આ બંને અભિગમથી વિશેષ ત્રીજો અભિગમ શિક્ષક-વિદ્યાર્થી કેન્દ્રી અભિગમ છે. અભિગમ એ ચોક્કસ રીતે ધ્યેય સિદ્ધ તરફ ઘોરી જતો મુખ્ય માર્ગ છે.

અધ્યાપનના અભિગમો અથવા અધ્યાપનસૂત્રોની રચના મનોવૈજ્ઞાનિક છે. તેથી વિજ્ઞાન અધ્યાપનમાં તેનો ઉપયોગ કરવાથી વિજ્ઞાન શિક્ષણની પ્રક્રિયા સહેતુક બને છે. અભિગમનો ઉપયોગ બાળકને શીખવા માટે માનસિક રીતે તત્પર કરે છે. નવું નવું જાણવા માટે જિજ્ઞાસાવૃત્તિ જગાડે છે અને આ રીતે બાળક જે કંઈ શીખે છે તે લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. તેની સ્મૃતિ કેળવાય છે. આ રીતે મેળવેલા વિશાળ અનુભવોને આધારે, પરિપક્વ બનતાં તે સુક્ષ્મ બાબતોને સરળતાથી સમજવા માટે શક્તિમાન બને છે.

વિજ્ઞાનના નિયમો, વ્યાખ્યાઓ વગેરેની સમજૂતી, તે અંગેના સ્પષ્ટ ખ્યાલો મેળવવા માટે શૈક્ષણિક અભિગમો ખ્યાલમાં રાખી અધ્યાપન કરાવાય તો બાળક શીખેલી બાબતોનો વ્યવહારમાં ઉપયોગ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે અને આગળ વધતાં વિજ્ઞાનનાં અટપટા નિયમો તે સમજી શકે છે અને સમસ્યાઓ ઉકેલે છે તથા મૌલિક પ્રાયોગિક કાર્ય કરવા પ્રેરાય છે.

અધ્યાપનનાં અભિગમો કે અધ્યાપન સૂત્રો પ્રાયોગિક રીતે શોધાયેલા નથી. પણ વિશાળ અનુભવોને આધારે તથા ખૂબ લાંબી વિચારણા બાદ તારવવામાં આવેલા આ સત્યો છે, તથ્યો છે, સામાન્યીકરણો છે. જેના ઉપયોગથી શિક્ષણકાર્ય અસરકારક, સરળ અને સફળ બને છે. તેના પાયામાં અનુભવ, વિચાર અને નિરીક્ષણ છે. તેથી આ સૂત્રો-અભિગમો વ્યાવહારિક અને અધ્યાપન કરતી વખતે અપનાવી શકાય તેવા છે. શિક્ષકને અભ્યાસક્રમનો જે એકમ શીખવવાનો હોય તેની વિગતો પસંદ કરવામાં, વિગતોને શૈક્ષણિક રીતે યોગ્ય ક્રમમાં ગોઠવવામાં અને વિગતોની રજૂઆતમાં એટલે કે શીખવવામાં અધ્યાપનના અભિગમો અને અધ્યાપન સૂત્રો ઉપયોગી અને મદદગાર બને છે.

#### 11.4 અભિગમોનું મહત્ત્વ :

- અધ્યાપન અભિગમોને કારણે બાળક શિક્ષણકાર્યમાં પોતાનો ફાળો આપે છે. વર્ગમાં શિક્ષકના પ્રશ્નોના ઉત્તરો આપે છે, ચર્ચા કરે છે, પ્રાયોગિક કાર્ય કરે છે, પોતાના અનુભવોને યાદ કરી નવી બાબતો સાથે જોડે છે અને શિક્ષણ મેળવે છે.
- શિક્ષણના વિવિધ વિષયવસ્તુના અધ્યાપન અને તેના અમલમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આ સૂત્રો અને અભિગમો મદદરૂપ છે.
- તર્કશક્તિના વિકાસમાં અને બૌદ્ધિક સ્તર વધારવામાં તેમજ વિચાર વિકાસમાં આ અભિગમોનો મહત્ત્વનો ફાળો છે.
- અભ્યાસક્રમની વિગત પસંદ કરવામાં પણ અભિગમો ઉપયોગમાં આવે છે. વિદ્યાર્થીઓની માનસિક વય ધ્યાનમાં રાખી અભ્યાસક્રમનું આયોજન કરવામાં આવે છે. અભ્યાસક્રમમાં ક્રમિકતા બક્ષવામાં ઉપયોગી છે.
- વિષયવસ્તુની પસંદગી, ક્રમિકતા, રજૂઆત માટે અભિગમો માર્ગદર્શક બને છે.
- પ્રત્યક્ષ શિક્ષણકાર્ય સરળ, સફળ અને અસરકારક બનાવવામાં સૂત્રો સહાયક બને છે.

વિજ્ઞાન શિક્ષણના અધ્યાપન માટે નીચે જણાવેલ અભિગમો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું.

- (1) આગમન-નિગમન અભિગમ
- (2) સમસ્યા ઉકેલ અભિગમ
- (3) સંરચનાવાદી અભિગમ
- (4) મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત આધારિત અભિગમ (અધ્યાપન સૂત્રો અથવા શિક્ષણના સૂત્રો)

#### 11.5 આગમન-નિગમન અભિગમ :

##### 11.5.1 પ્રસ્તાવના :

વિજ્ઞાન શિક્ષણમાં આ અભિગમ ઉપયોગી છે. વિજ્ઞાન શિક્ષક જાણ્યે-અજાણ્યે પોતાના શિક્ષણકાર્યમાં આ અભિગમોનો ઉપયોગ કરે છે. આ અભિગમો આગમન અને નિગમન અભિગમ એમ બે અલગ

સ્વરૂપોમાં વહેંચાયેલા છે. ખરેખર તો તેઓ એક સાથે જ ઉપયોગમાં લઈ શકાય તેવા બે અભિગમો છે. એક છે આગમન અભિગમ અને બીજો છે નિગમન અભિગમ.

### 11.5.2 આગમન અભિગમ :

આ અભિગમમાં 'વિશિષ્ટ પરથી સામાન્ય' શિક્ષણ સૂત્રનો ઉપયોગ થાય છે. આ અભિગમમાં વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ તારવવામાં આવે છે. આગમન અભિગમમાં કોઈ સિદ્ધાંત, નિયમ કે સૂત્ર શીખવવા માટે વિદ્યાર્થીઓ સમક્ષ કેટલાક વિશિષ્ટ ઉદાહરણો રજૂ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ રજૂ કરેલા ઉદાહરણોમાં સરખાપણું કે સામાન્યપણું જોઈ તેની તારવણી કરે છે. ત્યારબાદ આ સામાન્યપણું એવા જ અન્ય ઉદાહરણોમાં છે કે નહિ તે ચકાસે છે. અંતે કોઈ એક સામાન્ય નિયમ, સિદ્ધાંત કે નિર્ણય તારવે છે. આ અભિગમ દ્વારા વિદ્યાર્થીઓ સ્વયંસૂઝ અને સમજશક્તિ દ્વારા યોગ્ય વિચાર કે તર્ક દ્વારા નિર્ણય સુધી પહોંચે છે.

આગમન અભિગમમાં ઉદાહરણો રજૂ કરતી વખતે શિક્ષકે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે, વિદ્યાર્થીઓના વાસ્તવિક જીવન સાથે સંબંધિત ઉદાહરણો હોવા જોઈએ. ઉદાહરણો પર્યાપ્ત માત્રામાં હોવા જોઈએ, જેમાંથી કોઈ સામાન્ય નિયમ તારવી શકાય. ઉદાહરણોની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે જેથી બધા જ વિદ્યાર્થીઓ સમજી શકે તેના દ્વારા મળતા નિયમને બાળકો સરળતાથી યાદ રાખી શકે, ગ્રહણ કરી શકે.

ઉદાહરણો :

- (1) ઓક્સિજન નિયમ
- (2) પ્રકાશના વક્રીભવનનો નિયમ
- (3) પરાવર્તનનો નિયમ
- (4) ગુરુત્વાકર્ષણ બળનો નિયમ
- (5) ન્યૂટનનાં ગતિનાં નિયમો

### 11.5.3 આગમન અભિગમનાં લાભ :

- આ અભિગમ અવલોકન અને ચિંતન પર આધારિત છે. તેમાં ગોખણપટ્ટીને અવકાશ નથી.
- આ અભિગમ દ્વારા વિદ્યાર્થીને ખ્યાલ આવે છે કે નિયમ કેવી રીતે તારવી શકાય છે.
- આ અભિગમમાં વિદ્યાર્થીઓ જાતે નિર્ણય તારવે છે તેથી સ્વયંસ્ફૂરણાથી સિદ્ધાંત કે નિયમ તારવવાથી વિદ્યાર્થીઓને આનંદ પ્રાપ્ત થાય છે.
- વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. પ્રાપ્ત કરેલું જ્ઞાન ચિરંજીવી બને છે.
- વિદ્યાર્થી નિયમ ભુલી જાય તો પણ આ અભિગમથી સ્વયં નિયમ તારવી શકે છે.
- વિદ્યાર્થીઓમાં કેટલીક માનસિક શક્તિઓ જેવી કે પારસ્પરિક સંબંધ તપાસવો, નિર્ણય તારવવો, ચોક્કસાઈપૂર્વક માહિતી મેળવવી, તાળો મેળવવો વગેરેનો વિકાસ થાય છે. વિદ્યાર્થીઓ અંત સુધી સક્રિય રહે છે.

### 11.5.4 આગમન અભિગમની મર્યાદાઓ :

- જો અપૂરતા ઉદાહરણોના ઉપયોગથી નિયમની તારવણી થાય તો અયોગ્ય તારણ પર જવાની સંભાવના છે.
- આ અભિગમ પ્રમાણમાં વધુ સમય અને મહેનત માંગી લે તેવો લાંબો છે.
- પ્રાથમિક તથા માધ્યમિક કક્ષા માટે વધુ ઉપયોગી છે, પરંતુ ઉચ્ચ કક્ષાના વર્ગો માટે તે નિરસ અને કંટાળાજનક લાગે છે.
- એક વાર સિદ્ધાંત કે નિયમ પ્રાપ્ત થયા બાદ તેનાં ઉપયોગનો અહીં સમાવેશ થતો નથી જે આ અભિગમની મર્યાદા છે.



- પ્રાપ્ત જ્ઞાનને દૃઢ કરવાનું સોપાન આ અભિગમમાં નથી. આ મર્યાદા અભિગમની ઉણપ સૂચવે છે.

### 11.5.5 II. નિગમન અભિગમ :

નિગમન અભિગમ આગમન અભિગમનો પૂરક અભિગમ છે. નિગમન અભિગમનું કાર્ય સ્વરૂપ આગમન અભિગમના કાર્ય સ્વરૂપ કરતાં ઊલટું છે. આગમન અભિગમમાં સામાન્ય સૂત્ર, નિયમ કે સિદ્ધાંત તારવવામાં આવે છે, જ્યારે નિગમન અભિગમમાં શિક્ષકે તારવેલ નિયમ, સૂત્ર કે સિદ્ધાંત સીધો બતાવી દેવામાં આવે છે જેનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરે છે.

નિગમન અભિગમમાં વિદ્યાર્થીઓ 'સામાન્ય નિયમ પરથી વિશિષ્ટ સત્ય' તરફ તથા 'અમૂર્તથી મૂર્ત' તરફ ગતિ કરે છે. વિદ્યાર્થીઓ સૂચિત સૂત્ર, નિયમ કે સિદ્ધાંતને સનાતન સત્ય તરીકે સ્વીકારી તેનો ઉપયોગ કરે છે.

#### ઉદાહરણો :

- ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જણાવી તેના આધારે આ નિયમનું પાલન કરતાં અન્ય ઉદાહરણ રજૂ કરવા.
- ઘનતાનો નિયમ આપી તેના ઉદાહરણ રજૂ કરવા.
- ઉષ્ણતાવહનનો નિયમ આપી તેના અન્ય ઉદાહરણો રજૂ કરવા.

### 11.5.6 નિગમન અભિગમના લાભ :

- આ અભિગમમાં નિયમ કે સૂત્રનો સીધો ઉપયોગ કરવાનો હોય છે.
- આ અભિગમમાં વિદ્યાર્થીઓ થોડા સમયમાં વધુ કામ કરી શકે છે જેથી સમય અને શક્તિનો વ્યય ઓછો થાય છે.
- આ અભિગમથી અભ્યાસક્રમ ઝડપી પૂરો કરી શકાય છે.
- વિદ્યાર્થીઓએ સૂત્રો, સિદ્ધાંતો, નિયમો યાદ રાખવા પડે છે. જેથી યાદશક્તિનો વિકાસ થાય છે.
- આગમન અભિગમથી મેળવેલ જ્ઞાનને નિગમન અભિગમ વડે દૃઢ કરી શકાય છે.
- ઉચ્ચ કક્ષાનાં વિદ્યાર્થીઓ માટે આ અભિગમ વધુ અનુકૂળ છે.
- સમસ્યાનો ઝડપી અને કુશળતાપૂર્વક ઉકેલ આ અભિગમ દ્વારા લાવી શકાય છે.

### 11.5.7 નિગમન અભિગમની મર્યાદાઓ :

- આ અભિગમમાં અધ્યાપક સૂત્ર કે નિયમ આપી દે છે. જેથી વિદ્યાર્થીઓને પક્ષે સમજ, ચિંતન, તર્ક, સંશોધન વગેરેને સ્થાન ઓછું મળે છે. વિદ્યાર્થીને પક્ષે પ્રવૃત્તિને ઓછું સ્થાન રહેતું હોવાથી તેઓને સઘન અને રૂચિપૂર્ણ શિક્ષણ આપી શકાતું નથી.
- નીચલા ધોરણના વિદ્યાર્થીઓ સૂત્રનું કે નિયમનું અમૂર્ત સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજી શકતા નથી.
- આ અભિગમમાં સૂત્રો કે નિયમો સીધા ગોખવા પડે છે. જેથી સ્મૃતિ પરનું ભારણ વધે છે. તથા સૂત્રો કે નિયમો ભૂલી જવાની સંભાવના રહે છે અને તેને પુનઃસાબિત કરવા કે તારવી શકાતા નથી.
- આ અભિગમમાં નિયમ, સિદ્ધાંત કે સૂત્ર કેવી રીતે પ્રાપ્ત થયા તે બાબતને અધ્યાપનમાં સ્થાન નથી. તેથી વિદ્યાર્થીઓ સૂત્રો, નિયમો કે સિદ્ધાંતો વિશે સંશયશીલ અને અસ્પષ્ટ રહે છે.
- સૂત્ર કે નિયમના એકધારા ઉપયોગથી વિદ્યાર્થીઓને કંટાળો આવે છે.
- આ અભિગમ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ઓછો અસરકારક છે.

આ અભિગમના લાભ મેળવવા, આ અભિગમનો આગમન-નિગમનના પૂરક અભિગમ તરીકે ઉપયોગ કરવો જોઈએ. આગમન અભિગમ અને નિગમન અભિગમ એકબીજાનાં પૂરક અભિગમ છે.

અસરકારક વિજ્ઞાન શિક્ષણ માટે વિજ્ઞાન શિક્ષકે સૌ પ્રથમ આગમન અભિગમના ઉપયોગ દ્વારા સૂત્ર, સિદ્ધાંત કે નિયમની તારવણી કરાવવી જોઈએ ત્યારબાદ નિગમન અભિગમના ઉપયોગ દ્વારા આ જ્ઞાનને દૃઢ કરાવવું જોઈએ. આમ કરવાથી બંને અભિગમના લાભ મેળવી શકાય છે અને મર્યાદાઓ ટાળી શકાય છે અને વિદ્યાર્થીઓ સમજપૂર્વકનું જ્ઞાન દૃઢીભૂત કરી શકે છે. ગોખણપટ્ટીની જરૂર પડતી નથી.

### 11.5.8 આગમન-નિગમન અભિગમની તુલના :

આગમન અભિગમ	નિગમન અભિગમ
<ul style="list-style-type: none"> <li>● આ અભિગમમાં વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમની તારવણી કરવામાં આવે છે.</li> <li>● આ અભિગમમાં મૂર્ત બાબતો પરથી અમૂર્ત સત્ય તારવાય છે.</li> <li>● આ અભિગમમાં તર્ક, ચિંતન અને સંશોધનને વધુ સ્થાન છે.</li> <li>● આ અભિગમમાં સામાન્ય સિદ્ધાંત, નિયમ કે સૂત્ર તારવવામાં આવે છે.</li> <li>● આ અભિગમ ધીમો અને પ્રમાણમાં વધુ સમય માંગી લે તેવો છે.</li> <li>● આ અભિગમમાં શિક્ષક અને વિદ્યાર્થી એકબીજાના વધુ સંપર્કમાં રહે છે.</li> <li>● આ અભિગમના ઉપયોગથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.</li> <li>● આ અભિગમનો ઉપયોગ નિગમન અભિગમના પહેલા કરવામાં આવે છે.</li> <li>● આ અભિગમ પ્રાથમિક તથા માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે વધુ તાર્કિક છે.</li> <li>● આ અભિગમ તાર્કિક છે.</li> </ul>	<ul style="list-style-type: none"> <li>● આ અભિગમમાં સામાન્ય નિયમ પરથી વિશિષ્ટ ઉદાહરણો તરફ જવાનું હોય છે.</li> <li>● આ અભિગમમાં અમૂર્ત સત્ય પરથી મૂર્ત બાબતો તરફ જવાય છે.</li> <li>● આ અભિગમમાં તર્ક, ચિંતન અને સંશોધનને ઓછો અવકાશ છે.</li> <li>● આ અભિગમમાં અગાઉ તારવેલા નિયમ, સિદ્ધાંત કે સૂત્રનો સીધો ઉપયોગ થાય છે.</li> <li>● આ અભિગમ ઝડપી અને પ્રમાણમાં ઓછો સમય માંગી લે તેવો છે.</li> <li>● આ અભિગમમાં શિક્ષક અને વિદ્યાર્થી એકબીજાના ઓછા સંપર્કમાં રહે છે.</li> <li>● આ અભિગમના ઉપયોગથી યાંત્રિકતા સર્જાય છે.</li> <li>● આ અભિગમનો ઉપયોગ આગમન અભિગમ પછી કરવામાં આવે છે.</li> <li>● આ અભિગમ ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે વધુ ઉપયોગી છે.</li> <li>● આ અભિગમ સ્મૃતિને ઉત્તેજન આપનારો છે.</li> </ul>

#### ● તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી જગ્યામાં જ લખો.

#### 1. આગમન અભિગમ એટલે શું ?

.....

.....

.....

.....

.....

.....

.....

2. નિગમન અભિગમ એટલે શું ?

.....  
.....  
.....  
.....  
.....  
.....

3. નિગમન અભિગમની મર્યાદાઓ જણાવો.

.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....

---

**11.6 સમસ્યા ઉકેલ અભિગમ :**

---

**11.6.1 પ્રસ્તાવના :**

વિજ્ઞાન શિક્ષણનો અગત્યનો હેતુ પ્રાપ્ત જ્ઞાનનો નવીન પરિસ્થિતિમાં ઉપયોગ અને વૈજ્ઞાનિક વલણ વિકસાવવાનો છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે વિદ્યાર્થીઓ સમક્ષ સમસ્યા ઊભી કરી, તેનો ઉકેલ તેમની પાસેથી જ મેળવવામાં આવે. આનો અર્થ સમસ્યા ઉકેલ અભિગમ વિદ્યાર્થીઓને વિચારતા કરવાનો અભિગમ છે. જેને લીધે વિદ્યાર્થીઓની અનુમાનશક્તિ, નિર્ણયશક્તિ, તર્કશક્તિનો વિકાસ થાય છે.

અધ્યાપનમાં ‘સમસ્યા ઉકેલ કાર્ય’ કે જે નિર્ણયો કરે છે અથવા અધ્યેતા જે બાબતો બનાવવા અથવા કરવા માંગે છે તેના સ્વરૂપને તે સમજી શકે છે. પણ તે સમયે તેની પાસે તે અંગેનો ઉકેલ હોતો નથી તે બતાવે છે. તે જરૂરીયાતનું પરિણામ છે. સમસ્યા સંબંધિત એકમ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પોતાના રસ અને શક્તિ અથવા કાબેલિયત અનુસાર ઉકેલ શોધવાની શરૂઆત કરે છે. વિદ્યાર્થીઓ સમક્ષ સમસ્યા સ્પષ્ટ શબ્દોમાં મૂકવી જોઈએ. વિદ્યાર્થીઓ શિક્ષકની મદદથી સમસ્યાનું સંશ્લેષણ, વિશ્લેષણ કરે છે અને ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે છે.

વિજ્ઞાનમાં સંશોધન દ્વારા સિદ્ધ થયેલી બાબતોનો સ્વીકાર થાય છે. સિદ્ધ થયેલી બાબતોમાંથી ઘણીવાર વિદ્યાર્થીઓમાં મૂંઝવણ કે સમસ્યા પેદા થતી હોય છે. આમ વિદ્યાર્થીના મનમાં ઊભી થતી મૂંઝવણ કે સમસ્યાઓને કેવી રીતે ઉકેલવો ? તે ઉકેલવા માટેનો એક ચોક્કસ અભિગમ છે. જેને સમસ્યા ઉકેલ અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. આ સમસ્યાના નિરાકરણ કે ઉકેલ માટે શિક્ષકે વિદ્યાર્થીઓને સાથે રાખીને માનસિક કે બૌદ્ધિક શ્રમ કરવો પડે છે.

સમસ્યા ઉકેલ અભિગમ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયાનો ઉદ્ભવ કોઈ એક મુદ્દા કે વિષય અંગેની ગૂંચવણ, શંકા કે મનની સમસ્યાનું સમાધાન ન થાય ત્યારે થાય છે. જેમ કે મેઘધનુષ્ય શા માટે થાય છે ? ઉલ્કા શા માટે પડે છે ? વગેરે. આ મુદ્દાઓ કે વિષયવસ્તુથી વિદ્યાર્થીઓના મનમાં સમસ્યા ઉદ્ભવે છે. સામાન્ય રીતે સમસ્યા વિદ્યાર્થીઓના મનમાં ઉદ્ભવે તે વધુ યોગ્ય છે. વર્ગ સમક્ષ વિજ્ઞાનને લગતી સમસ્યા રજૂ થાય. સમસ્યા વિશે વિદ્યાર્થીઓ વચ્ચે વિચારોની આપ-લે થાય. આ આપ-લે દરમિયાન

જે માહિતી ભેગી થાય, તે માહિતી કે વિચારોની ચકાસણી થતી જાય, તેનું અર્થઘટન થતું જાય. આમ, ધીમે ધીમે સમસ્યાનો ઉકેલ શોધાય.

### 11.6.2 સમસ્યા ઉકેલ અભિગમના સોપાનો :

વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયક માહિતી આપી દેવાથી તેમનામાં આવશ્યક સમસ્યા ઉકેલનું કૌશલ્ય વિકસાવી શકાતું નથી. આવું કૌશલ્ય વિકસાવવા માટે સમસ્યા ઉકેલ અભિગમ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું જોઈએ. સમસ્યા ઉકેલ અભિગમના સોપાનો નીચે મુજબ છે.

#### [1] સમસ્યાની ઓળખ અને સ્પષ્ટીકરણ :

- શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ કોઈ પ્રશ્ન, સમસ્યા કે મૂંઝવણ ભરી પરિસ્થિતિ રજૂ કરવામાં આવે છે, જેનો ઉકેલ શોધવાની જરૂર હોય. આવી સમસ્યા અભ્યાસક્રમ સાથે સંબંધિત, વિદ્યાર્થીની માનસિક કક્ષાને અનુરૂપ તથા વ્યવહારિક જીવન સાથે સંકળાયેલી હોઈ શકે. વિદ્યાર્થીઓને સમસ્યા શું છે? તેનો સ્પષ્ટ ખ્યાલ આપવો જોઈએ. તે અંગે કોઈ ગેરસમજ ના રહેવી જોઈએ. શિક્ષક દ્વારા સમસ્યાનું સ્પષ્ટ પારિભાષીકરણ થવું જોઈએ.

#### [2] ઉત્કલ્પનાની રચના :

- સમસ્યા સાથે સંબંધિત પરિબળો અંગે વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ પસંદ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે એ સમજવું જરૂરી છે કે કયા હેતુસર આ સમસ્યા પસંદ કરવામાં આવી છે. તેમજ સમસ્યા પર અસર કરતાં બે કે વધારે પરિબળો, કારણો તથા પ્રક્રિયાઓ વચ્ચેનો સંબંધ તેમણે સમજવો જરૂરી બને છે. આ માટે સમસ્યા સાથે સંબંધિત સાહિત્ય તથા સંશોધનો અંગે અભ્યાસ કરવો પડે છે. અભ્યાસ દ્વારા સમસ્યા પર અસર કરતાં કારણો અને પરિબળોનો નિર્દેશ કરે છે. તેના આધારે વિદ્યાર્થીઓ ઉત્કલ્પનાઓની રચના કરે છે.

#### [3] ઉત્કલ્પનાની ચકાસણી :

- વિદ્યાર્થીઓ ઉત્કલ્પનાની ચકાસણી કરવા માટે માહિતી એકત્ર કરે છે. આ માટે જરૂર જણાય તો પ્રયોગો હાથ ધરવામાં આવે છે, અવલોકનો નોંધવામાં આવે છે. સાહિત્યના અભ્યાસ દ્વારા અન્ય માહિતી એકત્ર કરવામાં આવે છે. પ્રયોગ કાર્ય દરમિયાન વિજ્ઞાન શિક્ષક દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે.

#### [4] માહિતીનું અર્થઘટન :

- વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત થયેલ માહિતીનું ચાર્ટ, ગ્રાફ, કોષ્ટક સ્વરૂપે રૂપાંતર કરી તેનું અંકશાસ્ત્રીય પૃથક્કરણ અને અર્થઘટન કરવામાં આવે છે.

#### [5] નિર્ણય તારવવો :

- પ્રાપ્ત માહિતીનાં અર્થઘટન પરથી નિર્ણય તારવવામાં આવે છે. આ તારણોને ઉપયોગી અને યથાર્થ ગણવામાં આવે છે. આ સમગ્ર કાર્યની વ્યવસ્થિત નોંધ કરવામાં આવે છે.

### 11.6.3 સમસ્યા ઉકેલ અભિગમના લાભ :

- સમસ્યા ઉકેલ અભિગમ વિષયના મુદ્દાની સમજને સ્પષ્ટ કરે છે.
- આ અભિગમમાં તર્કબદ્ધતા કેન્દ્રસ્થાને હોવાથી તે અધ્યેતાઓની તર્કશક્તિ વિકસાવે છે.
- વિજ્ઞાનના વિષયમાં વિવિધ ઉદાહરણો દ્વારા સામાન્યીકરણને શક્ય બનાવે છે.
- આ અભિગમથી સમગ્ર શિક્ષણની પ્રક્રિયા, અધ્યાપક અને અધ્યેતાને સક્રિય બનાવી શકાય છે.
- યાદશક્તિ કે સ્મૃતિ કક્ષાના શિક્ષણને સ્થાને ચર્ચાત્મક કક્ષાના શિક્ષણને શક્ય બનાવે છે.
- વિજ્ઞાન વિષયની સંકલ્પનાઓ અને વિષયના મુદ્દાઓની વ્યાખ્યાઓને સરળતાપૂર્વક સમજી શકાય છે.

- વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ કેળવાય છે.
- સમસ્યા ઉકેલ અભિગમ દ્વારા વિદ્યાર્થીઓને તાર્કિક, પદ્ધતિસર વિચારતા શીખવી શકાય છે.
- વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ કેળવાય છે.
- વિદ્યાર્થીઓ સ્વયં સક્રિય રહીને, સ્વપ્રયાસે, વ્યક્તિગત તફાવતોને અનુલક્ષીને અધ્યયન કરે છે.
- વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક ચિંતન શક્તિનો વિકાસ થાય છે.
- વિદ્યાર્થીઓ વાસ્તવિક જીવનમાં અને આસપાસ બનતી ઘટનાઓમાં ઊભી થતી સમસ્યાઓનો ઉકેલ મેળવવા સક્ષમ બને છે.
- વિદ્યાર્થીઓમાં સંદર્ભ સાહિત્યના અભ્યાસની ટેવ વિકસે છે.

#### 11.6.4 સમસ્યા ઉકેલ અભિગમની મર્યાદાઓ :

- વિજ્ઞાન વિષયના બધા જ મુદ્દાઓ સમસ્યા ઉકેલ અભિગમથી શીખવવા શક્ય નથી.
- બધા જ વિજ્ઞાન શિક્ષકો આ અભિગમ દ્વારા શીખવવા માટે તાલીમબદ્ધ હોતા નથી. આવડત ધરાવતા હોતા નથી.
- બધા જ વિદ્યાર્થીઓને સમસ્યા ઉકેલ અભિગમ દ્વારા મેળવતા શિક્ષણમાં રસ પડતો નથી.
- નબળા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નથી.
- ઘણીવાર જરૂરી પ્રયોગ માટેના સાધનો કે સંદર્ભ સાહિત્ય પૂરતા પ્રાપ્ત હોતા નથી.
- સમય અને શક્તિ વધુ ખર્ચાય છે.

#### ● તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી જગ્યામાં જ લખો.

#### 1. સમસ્યા ઉકેલ અભિગમ એટલે શું ?

.....

.....

.....

.....

.....

.....

#### 2. સમસ્યા ઉકેલ અભિગમના સોપાનો જણાવો.

.....

.....

.....

.....

.....

.....

#### 3. સમસ્યા ઉકેલ અભિગમના ફાયદા જણાવો.

.....

.....

.....

---

---

---

## 11.7 સંરચનાવાદી અભિગમ :

---

### 11.7.1 પ્રસ્તાવના :

અધ્યેતા સક્રિય છે. તે પોતે પોતાના જ્ઞાનની સંરચના કરવા સક્ષમ છે. અધ્યયન સ્વ-નિયમનયુક્ત છે. અધ્યયન અંગેના આ વિચારોને સ્વીકારીને સંરચનાવાદીઓએ વર્તનવાદીઓ અને જ્ઞાનાત્મવાદીઓના અધ્યાપન અંગેના અભિગમથી તદ્દન અલગ અભિગમ અપનાવ્યો. અધ્યાપન યોજનાનું કોઈ રૂઢિગત માળખું આપવાને બદલે અધ્યયન અંગેના સંરચનાવાદી વિચારોનો અમલ થઈ શકે તેવા માર્ગદર્શક સિદ્ધાંતો શિક્ષક સામે મૂકે છે. તેઓએ સંરચનાવાદી શિક્ષક વર્ગમાં શી રીતે વર્તે તેનું આબેહુબ ચિત્ર ઉપસાવ્યું છે.

સંરચનાવાદીઓ જણાવે છે કે, ‘અધ્યાપન-યોજના’ શબ્દમાં અધ્યાપન કેન્દ્રમાં છે. આથી આપોઆપ શિક્ષક કેન્દ્રમાં આવી જાય છે. આથી તેઓએ અધ્યાપન-યોજના તૈયાર કરવાને બદલે અધ્યયન-પર્યાવરણ તૈયાર કરવાની ભલામણ કરી છે.

સંરચનાવાદી અભિગમ વિદ્યાર્થીઓને પોતાની અધ્યયન-નીપજોની સામાજિક અને બૌદ્ધિક સંદર્ભમાં અગત્ય અને અર્થ શીખવા અને તેના પર ચિંતન કરવામાં પ્રોત્સાહિત કરે છે. અધ્યેતાઓ પોતાના વિચારો મૌખિક, લેખિત, ગ્રાફિક કે દૃશ્ય પૈકી યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી વ્યક્ત કરવા સક્ષમ બનાવે છે.

### 11.7.2 સંરચનાવાદી અભિગમ : અર્થ અને સંકલ્પના :

- પ્રમાણમાં નવા લાગતા આ અભિગમના મૂળ સોક્રેટીસની પ્રશ્નપ્રતિપ્રશ્નરૂપી સંવાદ પદ્ધતિ જેટલા પ્રાચીન ગણી શકાય. આ ઉપરાંત, જિનપિયાજે, ડેવિડ આસુબેલ, બ્રુનર અને લેવ વાયગોત્સ્કી જેવા મનોવૈજ્ઞાનિકોએ સંરચનાવાદના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો એમ કહી શકાય.
- જિન પિયાજેને વ્યક્તિગત સંરચનાવાદના પ્રણેતા ગણવામાં આવે છે. તેઓ દંઢપણે માનતા હતા કે અધ્યયન પર વ્યક્તિના વિકાસાત્મક તબક્કાની અસર થાય છે.
- અન્ય વિચારકોનું માનવું છે કે જ્ઞાન સામાજિક આંતરક્રિયાઓ દ્વારા હસ્તગત થાય છે. શીખનાર વ્યક્તિ શારીરિક, માનસિક, સાંવેગિક અને સામાજિક વિકાસના ચોક્કસ ક્રમિક તબક્કાઓમાંથી પસાર થાય છે. આ પ્રત્યેક તબક્કાઓ સાથે ચોક્કસ પ્રકારના અધ્યયન અનુભવો જોડાયેલા હોય છે. આ તબક્કાઓ જ નક્કી કરે છે કે શીખનાર વ્યક્તિ તેને મળતા અનુભવોમાંથી શું અને કેટલી માત્રામાં શીખી શકશે.
- જ્યારે જહોન ડ્યૂઈ અને વાયગોત્સ્કી જેવા વિચારકોના મતે શિક્ષણનો સામાજિક સંદર્ભ હોય છે. જેમ કે વિદ્યાર્થીઓ સહપાઠીઓ સાથે, શિક્ષકો સાથેની આંતરક્રિયા. આ આંતરક્રિયા દરમિયાન શીખનાર વ્યક્તિને પોતાના જ્ઞાન અને સમજની તપાસ, પુનઃ રચના કે જૂથના અન્ય વ્યક્તિના જ્ઞાન અને સમજની સાથેની તુલના કરવાની તક પૂરી પાડે છે. સંરચનાવાદી અભિગમની આ બાબતો જ વિદ્યાર્થીને એક સક્રિય સહભાગી તરીકે જુએ છે.
- આજે સમગ્ર વિશ્વ અધ્યયન-અધ્યાપનમાં સંરચનાવાદી અભિગમની મહત્તા સ્વીકારે છે. શૈક્ષણિક વર્તુળમાં હાલમાં સૌથી વધુ ધ્યાનાકર્ષક શબ્દ હોય તો તે છે સંરચનાવાદ. બધી જ કક્ષાના શાલેય શિક્ષણમાં સંરચનાવાદી અભિગમ આવકાર્ય છે કારણ કે, તે માત્ર પરીક્ષાલક્ષી જવાબો તૈયાર કરવાને બદલે પ્રશ્નોની તપાસ પર ભાર મૂકે છે.

- વિજ્ઞાનના અધ્યાપનમાં પણ તેનું મહત્ત્વ છે એટલે જ NCF-2005માં વિજ્ઞાન શિક્ષણના હેતુઓની સિદ્ધિ માટે સંરચનાવાદી અભિગમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
- વિજ્ઞાન વિષયના પ્રણાલિગત વર્ગખંડોમાં શિક્ષક વિજ્ઞાનના તથ્યો, નિયમો, સિદ્ધાંતો વગેરે વિદ્યાર્થીઓ પોતાની સ્મૃતિમાં રાખી શકે. તેના માટે પ્રવૃત્તિઓ કરતા હોય છે.
- જ્યારે સંરચનાવાદી અભિગમથી કાર્યરત વર્ગખંડમાં વિદ્યાર્થીઓની અંતઃસ્ફૂરણાં દ્વારા થતા અધ્યયન, સમસ્યા ઉકેલ અને ચિંતનાત્મક વિચાર કરવાનું કૌશલ્ય વધે તેવી પ્રવૃત્તિઓ હાથ ધરાતી હોય છે.
- સંરચનાવાદ, વિદ્યાર્થી પોતાને પ્રાપ્ત અનુભવોમાંથી કેવી રીતે જ્ઞાનની રચના કરે છે તે સમજાવતો અભિગમ છે. અહીં પ્રત્યેક વિદ્યાર્થીઓ દ્વારા રચાતું જ્ઞાન તેમનું વ્યક્તિગત અને આગવું હોય છે. સંરચનાવાદ અનુસાર જ્ઞાન શીખનારના મનમાં હોય છે જે તેમણે જાતે રચેલું હોય છે. વિદ્યાર્થી પોતાને મળતા અનુભવો દરમિયાન નવા જ્ઞાનને પૂર્વજ્ઞાન સાથે સક્રિયતાથી સંયોજીને મનમાં જાતે જ્ઞાનની સતત રચના કરતા હોય છે.
- આ મુજબ વિષયવસ્તુનું જ્ઞાન વિદ્યાર્થીઓના મનમાં હોય છે. એટલે કે જ્ઞાનનું સ્વરૂપ માનસિક કે આંતરિક હોય છે. આ જ્ઞાનના રચયિતા વિદ્યાર્થીઓ પોતે હોય છે.
- કોઈ શિક્ષકે આપેલું અને વિદ્યાર્થીએ એમનું એમ જ સ્વીકારેલું નથી. પરંતુ વિદ્યાર્થીએ પોતે રચેલું, સર્જેલું જ્ઞાન છે. અર્થાત્ સૌ કોઈ પોતાની પાસે રહેલા જ્ઞાનના રચયિતા પોતે જ છે.
- આ અર્થમાં જ્ઞાનનું સ્વરૂપ રચના છે, પ્રાપ્તિ નહિ. સંરચનાવાદ અનુસાર જ્ઞાનની રચના અનુભવ દરમિયાન પૂર્વજ્ઞાન સાથે નવા જ્ઞાનના સમન્વયથી થતી હોય છે. એટલે કે વિદ્યાર્થીઓ અનુભવ દરમિયાન પૂર્વજ્ઞાન સાથે નવા જ્ઞાનને જોડીને શીખે છે.
- આ અર્થમાં શીખવાની પ્રક્રિયામાં વિદ્યાર્થી તેમના અનુભવ, પૂર્વજ્ઞાન, નવું જ્ઞાન, વિદ્યાર્થી અનુભવ દરમિયાન પૂર્વજ્ઞાન સાથે નવા જ્ઞાનને જોડવાની પ્રક્રિયામાં સક્રિયતા અને સાતત્ય મહત્ત્વના છે.

### 11.7.3 સંરચનાવાદી અભિગમના લક્ષણો :

- આ અભિગમમાં અધ્યયનનાં ધ્યેયો વિદ્યાર્થીઓ વડે અથવા શિક્ષકો સાથે ચર્ચા કરીને નક્કી કરવામાં આવે છે.
- સંકલ્પનાઓ અને વિષયવસ્તુઓના બહુવિધ સંદર્ભો અને રજૂઆતોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
- શિક્ષક માર્ગદર્શક, મદદકર્તા તરીકે કાર્ય કરે છે.
- સ્વ-પૃથક્કરણ, સ્વ-નિયંત્રણ, સ્વ-ચિંતન અને સ્વ-જાગૃતિ માટે પ્રવૃત્તિઓ, તકો, ઉપકરણો અને પર્યાવરણો પૂરા પાડવામાં આવે છે.
- અધ્યયન-પરિસ્થિતિઓ, પર્યાવરણો, કૌશલ્યો, વિષયવસ્તુ અને કાર્યો સુસંગત, પ્રમાણભૂત અને વાસ્તવિક જગતની સ્વાભાવિક સંકુલતાને રજૂ કરે છે.
- પ્રમાણભૂતતા અને વાસ્તવિક જગતની સંકુલતાની ખાતરી માટે પ્રાથમિક સંદર્ભોનો ઉપયોગ કરવામાં આવે છે.
- જ્ઞાનની નીપજને બદલે જ્ઞાનની રચના પર ભાર આપવામાં આવે છે. આ સંરચના વૈયક્તિક સંદર્ભમાં અને સામાજિક વાટાઘાટ, સહકાર અને અનુભવ મારફત કરવામાં આવે છે.
- જ્ઞાન-સંરચનાની પ્રક્રિયામાં અધ્યેતાનાં પૂર્વજ્ઞાન, માન્યતાઓ અને વલણોને ધ્યાનમાં લેવામાં આવે છે.
- સમસ્યા-ઉકેલ, ઉચ્ચકક્ષાનાં વિચાર-કૌશલ્યો અને ઊંડી સમજને પ્રોત્સાહન આપવામાં આવે છે.

- અધ્યતાઓને સ્વતંત્ર રીતે જ્ઞાન મેળવવા અને પોતાનાં ધ્યેયો પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાં પ્રોત્સાહન મળે તે માટે શોધ-અભિગમને સ્વીકારવામાં આવે છે.
- અધ્યતાઓને તાલીમ દ્વારા અધ્યયનની તક આપવામાં આવે છે, જેમાં વધુ સંકુલ કાર્યો, કૌશલ્યો અને જ્ઞાનપ્રાપ્તિની તક મળે છે.
- વૈકલ્પિક દષ્ટિબિંદુઓનો ખ્યાલ આપવા માટે અધ્યતાઓને સહકારયુક્ત અધ્યયન પૂરું પાડવામાં આવે છે.
- મૂલ્યાંકન પ્રમાણભૂત અને અધ્યાપન સાથે જોડાયેલું હોય છે.

#### 11.7.4 સંરચનાવાદી અભિગમમાં શિક્ષકની ભૂમિકા :

- સંરચનાવાદી અભિગમ એ પૂર્વધારણા પર રચાયેલો છે કે, વિદ્યાર્થીઓ પર્યાવરણ સાથેની આંતરક્રિયાના આધારે પોતાના જ્ઞાનની રચના પોતે જાતે કરે છે. આથી સંરચનાવાદી અભિગમ અનુસાર વિજ્ઞાન શિક્ષકો અને વિજ્ઞાનનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની ભૂમિકા પ્રણાલિગત વર્ગખંડોમાં જોવા મળતી ભૂમિકા કરતા ભિન્ન થઈ જાય છે.
- સામાન્ય વર્ગખંડમાં વિજ્ઞાન શિક્ષક અને જ્ઞાન હેતુલક્ષી છે, સંપૂર્ણ અને સાર્વત્રિક છે, શિક્ષકના મસ્તિષ્કમાંથી વિદ્યાર્થીઓના મસ્તિષ્કમાં સરળતાથી પહોંચાડી દઈ શકાય છે. વગેરે જેવી પૂર્વધારણાઓ સાથે પ્રણાલિગત અધ્યાપન પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે.
- જ્યારે સંરચનાવાદી અભિગમ અનુસાર શિક્ષક માત્ર જ્ઞાનનો પહોંચાડનાર ન રહેતા જ્ઞાન રચનાની પ્રક્રિયામાં સરળતા પ્રદાન કરનારની ભૂમિકામાં આવી જાય છે. એ જ રીતે વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરનારાઓ ન બની રહેતા જ્ઞાન રચનારાઓ બને છે.
- પ્રણાલિકાગત વર્ગખંડમાં શિક્ષકની એક્યકીય સત્તા હોય છે, તેને વિષયવસ્તુના તજજ્ઞ તરીકે સ્વીકારી લેવામાં આવે છે. અને જેની ફરજ ખાલી પાત્રોમાં વસ્તુ ભરવામાં આવે તેમ નિષ્ક્રિય વિદ્યાર્થીઓમાં જ્ઞાન ભરવાનું હોય છે.
- સંરચનાવાદ અનુસાર જ્યારે વર્ગખંડનું વાતાવરણ લોકશાહીવાળું હશે, જ્યાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નો, વિચારો અને પૂર્વજ્ઞાનને આદરપૂર્વક સાંભળવામાં આવતા હોય છે. એથી વિશેષ શિક્ષક વિદ્યાર્થીઓને મુક્તપણે પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરવા ચર્ચા કરવાની, પોતાના પ્રયોગો કરી સમસ્યા ઉકેલવાની, અન્યના જ્ઞાન અને સમજની ચકાસણી કરવાની તકો પૂરી પાડે છે.
- નેશનલ કરિક્યુલમ ફેમવર્ક-2005માં પણ સૂચવવામાં આવ્યું છે કે અભ્યાસક્રમ એવો હોવો જોઈએ કે જે વિદ્યાર્થીઓને જ્ઞાનના રચયિતા બનવામાં મદદરૂપ હોય.
- આ ઉપરાંત વ્યવસ્થિત રીતે પસંદ કરેલી પ્રવૃત્તિ અને પ્રશ્નોને આધારે વિદ્યાર્થીઓને અધ્યયન પ્રક્રિયામાં સક્રિય બનાવી જ્ઞાનની રચના કરી શકે તે માટે શિક્ષકની સક્રિય ભૂમિકા ભજવવા પર પણ ભાર આપવામાં આવ્યો છે.
- આ માટે સંરચનાવાદી વર્ગખંડમાં શિક્ષક વિદ્યાર્થીઓમાં રહેલ જ્ઞાનનું સ્વરૂપ અને માત્રા જાણી લઈ તેમાં સુધારી કે નવીનતા લાવવાના હેતુથી નવી માહિતી આપે, વિરોધાભાસી વિધાન રજૂ કરે, પ્રશ્ન પૂછે, સંશોધનને પ્રોત્સાહન આપે, પ્રવર્તમાન સમયે રહેલી સંકલ્પનાને પડકાર મળે તેવી તપાસ યોજના વગેરે આપે છે.
- આમ, સંરચનાવાદી વર્ગખંડમાં શિક્ષક વર્ગખંડનાં ઋષિમુનિ બનવાને બદલે વિદ્યાર્થીઓના માર્ગદર્શક કે સલાહકાર બને છે. જે નિષ્ક્રિય વિદ્યાર્થીઓને સૂચનાઓ આપી અધ્યાપન કરવાને બદલે વિજ્ઞાન વિષયના સક્રિય વિદ્યાર્થીઓ માટે અધ્યયન પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે.



### 11.7.5 સંરચનાવાદી વર્ગખંડ માટેની શૈક્ષણિક પરિસ્થિતિઓ :

વિજ્ઞાન શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડમાં સંરચનાવાદી અભિગમ પ્રયોજવા માટે ટ્રિસ્કોલે સૂચવેલ આ મૂજબની પાંચ પરિસ્થિતિઓનું નિર્માણ પોતાના વર્ગખંડમાં કરવું જોઈએ.

- (1) વિદ્યાર્થીઓએ જે વાતાવરણમાં જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે તે વાતાવરણમાં જ્ઞાન મળવું જોઈએ. વાસ્તવિક દુનિયામાં અનેક જટીલ પ્રશ્નો વિદ્યાર્થીઓએ ઉકેલવાના હોવાથી વિદ્યાર્થીઓને પ્રમાણભૂત, સાચી, વાસ્તવિક અને વ્યાવહારિક પ્રવૃત્તિઓને સમાવતું જટિલ અધ્યયન વાતાવરણ પૂરું પાડવું.
- (2) અધ્યયન એ સામાજિક પ્રવૃત્તિ છે. માટે વિદ્યાર્થીઓ સામાજિક સંપર્ક, સંવાદ અને આંતરક્રિયા કરે તેવી તક ઊભી કરો.
- (3) વિદ્યાર્થીઓ અનુભવ દરમિયાન જ્ઞાનની રચના કરતા હોવાથી વિષયવસ્તુની રજૂઆતની રીતમાં શક્ય તેટલી વધુ વિવિધતા લાવો.
- (4) જ્ઞાનની રચના કરવાની પ્રક્રિયામાં પોતાની ભૂમિકા અંગે જાગૃત રહેવાની વ્યક્તિની શક્તિને સ્વ-વાચકતા કહે છે. સંરચનાવાદ અનુસાર વિદ્યાર્થી જેટલો સક્રિય હશે તેટલું વધુ જ્ઞાન રચશે માટે વિદ્યાર્થીઓની સ્વ-વાચકતાને પોષો.
- (5) વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણ અપનાવો.

### 11.7.6 વિજ્ઞાનના અધ્યાપનમાં સંરચનાવાદી અભિગમનો અમલ :

- ખરેખર તો સંરચનાવાદ કોઈ એક ચોક્કસ સિદ્ધાંત નથી, પરંતુ ઓછામાં ઓછા છ પેટા સિદ્ધાંતોનો સમૂહ છે. આ પેટા સિદ્ધાંતો વચ્ચે શિક્ષણના કેટલાક પાસાઓને લઈને મતમતાંતરો રહેલા છે. દરેક પ્રકાર અનુસાર કેટલાંક અભ્યાસુઓએ અધ્યાપનમાં પ્રયોજવા માટેના મોડેલ આપ્યા હોય છે.
- જેમ કે બ્રુનરે શોધ અધ્યયનનો સિદ્ધાંત આપ્યો તો આસુબેલે એડવાન્સ ઓર્ગેનાઈઝરનું મોડેલ આપ્યું.
- વર્ષો પહેલા રોબર્ટ કારપ્લસે પિયાજેના સિદ્ધાંત આધારિત વિજ્ઞાનનું અધ્યયન-અધ્યાપન કરવા માટે મોડેલ રજૂ કર્યું.
- માર્ટિન અને તેના સાથીઓએ રચનાવાદી વિજ્ઞાન શિક્ષણની પદ્ધતિ માટેના પોતાના પુસ્તક ‘ટીચિંગ સાયન્સ ફોર ઓલ ચિલ્ડ્રન’માં 4E (Explore, Explain, Expand, Evaluate) નું મોડેલ આપ્યું.
- તો રોજર બાયબીએ વિજ્ઞાનના અધ્યાપનમાં રચનાવાદી અભિગમ પ્રયોજવા 5E (Engage, Explore, Explain, Elaborate, Evaluate)નું મોડેલ આપ્યું. બાયબીએ પોતાના મોડેલમાં રહેલ 5E ના તબક્કાઓને આ રીતે સમજાવ્યા છે.

#### [1] Engage (સક્રિય ભાગીદારી) :

- આ તબક્કે વિદ્યાર્થીઓના પૂર્વાનુભવો અને વર્તમાન અધ્યયન અનુભવો વચ્ચેના અનુસંધાનનું સર્જન થવું જોઈએ. વર્તમાન પ્રવૃત્તિના અધ્યયન પરિણામો પ્રત્યે વિદ્યાર્થીઓનાં વિચારો કેન્દ્રિત થાય તેવી પ્રવૃત્તિ અગાઉથી તૈયાર કરી રાખવી જોઈએ.
- વિદ્યાર્થીઓ શીખવાની સંકલ્પના, પ્રક્રિયા કે કૌશલ્ય માટે માનસિક રીતે સક્રિય ભાગીદાર બનવા જોઈએ. આ તબક્કામાં વિજ્ઞાન શિક્ષકે શૈક્ષણિક કાર્યોની ઓળખ કરીને પરિસ્થિતિને રજૂ કરવી જોઈએ.

**[2] Explore (શોધ કે તપાસ) :**

- વિદ્યાર્થીઓ સંકલ્પના, પ્રક્રિયા કે કૌશલ્યોની રચના કરી શકે તે માટે તેમને કેટલાંક સામાન્ય અને નક્કર અનુભવો પૂરાં પાડતી અધ્યયન પ્રવૃત્તિઓનું આયોજન આ તબક્કે શિક્ષક દ્વારા કરવામાં આવે છે.
- આ પ્રકારની પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારી થવાથી તેમને જે તે સંકલ્પના કે પ્રક્રિયા સંબંધિત પોતાના મનમાં રહેલા ખ્યાલો અંગે અસમતુલા સર્જાય છે. શોધ કે તપાસ પુનઃ સમતુલા સ્થાપે છે.
- આ તબક્કાનો મૂળ હેતુ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સંકલ્પના, પ્રક્રિયા કે કૌશલ્ય અંગે પછીથી કરવાની થતી ઔપચારિક ચર્ચા માટે જરૂરી અનુભવોનું સર્જન કરવું તે છે.

**[3] Explain (સ્પષ્ટ કરવું) :**

- અગાઉના તબક્કે વિદ્યાર્થીઓએ જેની શોધ કે તપાસ કરી છે તેનું સ્પષ્ટીકરણ તેમના દ્વારા આ તબક્કે થાય છે. આ તબક્કે શિક્ષક શોધ અનુભવોના ચોક્કસ ઘટકો પર વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત થાય તે માટેના પ્રયત્નો કરે છે.
- આ તબક્કાની ચાવીરૂપ બાબત તરીકે સંકલ્પના, પ્રક્રિયા કે કૌશલ્યનું ટૂંકમાં વર્ણન, સમજૂતી કે સ્પષ્ટતા ગણી શકાય. ટૂંકમાં સમજૂતી બાદ આગળના તબક્કામાં જવાનું કહે છે.

**[4] Elaborate (વિગતવાર વર્ણવવું) :**

- આ તબક્કે વિદ્યાર્થીઓ રચેલા જ્ઞાનની સંકલ્પનાત્મક સમજને વિસ્તારે છે. શિક્ષક વિદ્યાર્થીઓને રચેલા જ્ઞાનનો ઉપયોગ કરવાની છૂટ આપે છે કે તક આપે છે.

**[5] Evaluate (મૂલ્યાંકન) :**

- આ તબક્કો અંતિમ તબક્કો છે. જેમાં શિક્ષક વિદ્યાર્થીઓને પોતાનું મૂલ્યાંકન કરી પોતાનામાં રહેલી ક્ષમતાઓ જાણવા માટે પ્રોત્સાહિત કરે છે. આ સાથે જ શિક્ષકો વિદ્યાર્થીઓની અગત્યના મુદ્દાઓમાં મેળવેલ સમજ અને હસ્તગત કરેલ કૌશલ્યોનું મૂલ્યાંકન કરે છે.

**11.7.7 સંરચનાવાદી અભિગમના લાભ :**

- વિદ્યાર્થીઓની અધ્યયન પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી વધે છે.
- વિદ્યાર્થીઓને વાસ્તવિક પરિસ્થિતિમાં જ્ઞાન મળે.
- વિદ્યાર્થીઓને પોતાના વિચારો રજૂ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે.
- વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે.
- વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન વર્તન આધારિત કરવાને બદલે તેઓમાં જ્ઞાનની રચના કેવા પ્રકારે અને કેટલી માત્રામાં થાય છે તે આધારિત થવા લાગ્યું.
- વિદ્યાર્થીઓ પોતે જ જ્ઞાનના સર્જક છે માટે તેમણે પ્રાપ્ત કરેલ જ્ઞાનને ગોખવાની જરૂર હોતી નથી.
- સહપાઠીઓ દ્વારા શિક્ષણ અને મૂલ્યાંકનનો આધાર પ્રાપ્ત થયો.
- શાળા શિક્ષણની તમામ કક્ષાઓમાં આ અભિગમથી કાર્ય કરી શકાય છે.

**11.7.8 સંરચનાવાદી અભિગમની મર્યાદાઓ :**

- સંરચનાવાદના ઘણા પેટા સિદ્ધાંતો છે. માટે સંરચનાવાદને સમજવામાં શિક્ષકોને મુશ્કેલી અનુભવાય છે.
- તે માનસિક પ્રક્રિયા પર ભાર મૂકે છે. જ્યારે માનસિક પ્રક્રિયાઓની ચકાસણી કરવી કઠિન છે.
- આ અભિગમ આધારિત પદ્ધતિઓ વધુ સમય માંગી લે તેવી છે.

- આ અભિગમ અનુસાર પ્રત્યેક વિદ્યાર્થી આગવી રીતે પોતાના જ્ઞાનનો સર્જક છે. માટે પ્રત્યેક વિદ્યાર્થી માટે અલાયદી અધ્યયન પરિસ્થિતિનું નિર્માણ કરવું શક્ય જણાતું નથી.
- વિદ્યાર્થી પોતે જ પોતાના જ્ઞાનની રચના કરનાર છે તો શક્ય છે કે તે અધકચરું કે ખામી ભરેલું જ્ઞાન રચે.
- તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી જગ્યામાં જ લખો.

1. સંરચનાવાદી અભિગમના લક્ષણો જણાવો.

.....

.....

.....

.....

.....

.....

2. સંરચનાવાદી અભિગમમાં શિક્ષકની ભૂમિકા શી છે ?

.....

.....

.....

.....

.....

.....

3. સંરચનાવાદી અભિગમના લાભ જણાવો.

.....

.....

.....

.....

.....

.....

---

## 11.8 મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત આધારિત અભિગમ અથવા અધ્યાપનનાં સૂત્રો :

---

### 11.8.1 પ્રસ્તાવના :

એક આદર્શ શિક્ષક હંમેશા પોતાના જ્ઞાન અને અનુભવને વિષયવસ્તુ સ્વરૂપે અને વર્તન સ્વરૂપે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં સફળ થાય છે. શિક્ષકનું મુખ્યકામ વિદ્યાર્થીઓને શીખતા કરવાનું છે. શિક્ષક વિદ્યાર્થીઓની વય, કક્ષા, બુદ્ધિકક્ષા, પૂર્વજ્ઞાન અને આવડતોને ધ્યાનમાં રાખીને તેમની સમક્ષ વિષયવસ્તુની રજૂઆત કરે છે. એક સફળ શિક્ષક વિદ્યાર્થીઓ સામે એવું વાતવરણ ઊભું કરે છે કે જેમાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ અધ્યયન અનુભવો મેળવી શકે.

- અધ્યાપન અધ્યયનના મનોવૈજ્ઞાનિક આધારો લઈને જે શિક્ષક કાર્ય કરે છે તેના આ કાર્યમાં વધુ સફળતા મળે છે. વિદ્યાર્થીઓની અધ્યયન ક્ષમતા અને અધ્યયન પ્રવેગ વધારી શકે તેવી

અધ્યાપન અધ્યયન પ્રક્રિયાની શોધ માટે ઘણા મનોવૈજ્ઞાનિકો, શિક્ષણશાસ્ત્રીઓ અને શિક્ષકોએ અનેક પ્રયોગો કર્યા છે.

- તેના આધારે અધ્યાપન, અધ્યયન અને અધ્યાપન અધ્યયન પ્રક્રિયા માટેના અનેક નિયમો, અધિનિયમો, સિદ્ધાંતો અને સૂત્રોની રચના થઈ છે.
- આમાંથી અધ્યાપનના સૂત્રો (Maxims of Teaching) અધ્યાપનની લગભગ તમામ પરિસ્થિતિમાં ઉપયોગી સિદ્ધ થાય છે. આ સૂત્રો સાર્વત્રિક રીતે સ્વીકૃત અને વિશ્વસનીય માનવામાં આવે છે. આ સૂત્રો અહીં જણાવ્યા મૂજબ છે.

### 11.8.2 જ્ઞાતથી અજ્ઞાત તરફ :

- આ સૂત્ર મુજબ વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનની સાથે નવા જ્ઞાનને સાંકળવામાં આવે છે. વિદ્યાર્થીઓને એકદમ નવું જ્ઞાન આપવાને બદલે તેમની પાસે જ જ્ઞાન હોય તે તાજું કરાવવું જોઈએ. તેમના આ જ્ઞાન સાથે ધીમે ધીમે નવા જ્ઞાન સાથે સાંકળવું જોઈએ. આમ કરવાથી વિદ્યાર્થીઓમાં નવી બાબતો શીખવાનો આત્મવિશ્વાસ વધે છે.
- બાળક વાતાવરણમાંથી, ઘરમાંથી, શાળામાંથી, સમાજમાંથી કે મિત્રોના સંપર્કથી વિવિધ અનુભવો મેળવે છે. આ અનુભવોમાંથી જ્ઞાન મળે છે.
- શિક્ષક બાળકો પાસેના અનુભવોનો શિક્ષણ આપતી વખતે ઉપયોગ કરે તો બાળક સહજ રીતે નવું શિક્ષણ મેળવી શકે છે.
- બાળક પાસે જે જ્ઞાન છે તે નવા શિક્ષણ સાથે જોડી દેવાનું કાર્ય સહજ રીતે થાય તો બાળક અજ્ઞાત વસ્તુ ઝડપથી શીખી લે છે. બાળકનું મન શીખવા માટે માનસિક રીતે તૈયાર થાય છે.
- શિક્ષકે પૂર્વજ્ઞાનના પાયા પર જ નવા જ્ઞાનની ઈમારત રચવાની છે. પૂર્વજ્ઞાન પાયો છે તો નવું જ્ઞાન ઈમારત છે. બાળકને આપણે જે એકમ શીખવવા માંગીએ છીએ તે અંગેનું વ્યવસ્થિત રૂપમાં જ્ઞાન તેની પાસે હોતું નથી. પરંતુ એ એકમને અનુરૂપ ઘણા અનુભવો તેના મનમાં સંઘરાયેલા હોય છે.
- તેથી શિક્ષકે પ્રશ્નોત્તરી અને ચર્ચા દ્વારા આ જ્ઞાન અનુભવોને યાદ કરાવી અજ્ઞાત તરફ લઈ જવા જોઈએ. આમ, શિક્ષકે પૂર્વજ્ઞાન અને નવા-જ્ઞાન વચ્ચે સાંકળ સાધવાની છે. જ્ઞાત બાબતોના પાયા પર જ શિક્ષક શીખવવાના નવા એકમને જો સહજ રીતે જોડે અને નવી બાબતો શીખવે તો બાળકો તે બાબત રસપૂર્વક શીખે છે અને શિક્ષણ રસદાયક બની રહે.
- જ્ઞાત પરથી અજ્ઞાત તરફ સૂત્ર મુજબ બાળક જે વાત જાણતો હોય તે વાત રજૂ કરવાથી તે તેને સરળ લાગે છે. ઉત્સાહ વધે છે અને શીખવા માટે તે વધુ ઉત્સુક બને છે.
- શિક્ષક જ્યારે ‘જ્ઞાત પરથી અજ્ઞાત’ તરફ બાળકને લઈ જાય છે, ત્યારે જ્ઞાત વસ્તુ બાળકને વધુ અસરકારક, અર્થસભર, રસપ્રદ અને સ્પષ્ટ લાગે છે.
- આ સૂત્ર મુજબ અધ્યાપન કાર્ય કરાવવાથી બાળક શીખવા માટે માનસિક રીતે તત્પર બને છે. પાઠ આયોજનમાં પ્રારંભ અથવા પૂર્વ તૈયારી પ્રથમ પગથિયું છે. જેમાં બાળકોનું પૂર્વજ્ઞાન ચકાસી જ્ઞાત પરથી અજ્ઞાત તરફ લઈ જવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલે કે નવું શિક્ષણકાર્ય કરતાં બાળકો જે શીખી ગયા હોય કે જેનાથી જ્ઞાત હોય તેના પર પ્રશ્નો પૂછી, વાતચીત કરી, ચર્ચા કરીને નિશ્ચિત એકમ તરફ લઈ જવામાં આવે છે.
- આમ, પ્રારંભ દ્વારા બાળકો શીખવા માટે વધુ તત્પર બને છે. કારણ કે જે વાત બાળક જાણતું હોય તે વાત રજૂ કરવાથી તે તેને સરળ લાગે છે જેથી તેનો ઉત્સાહ વધે છે અને શીખવા માટે વધુ ઉત્સુક બને છે.

### 11.8.3 સરળથી કઠિન (સંકુલ) તરફ :

- વિદ્યાર્થીઓ સામે શિક્ષકે સૌથી પહેલાં સરળ મુદ્દાઓ રજૂ કરવા જોઈએ. શિક્ષકે અધ્યાપન કાર્યનું આયોજન કરતી વખતે આ બાબતની ખાસ કાળજી લેવી જોઈએ. એકવાર સરળ મુદ્દાઓની રજૂઆત થઈ જાય પછી ધીમે ધીમે સંકુલ અને કઠિન મુદ્દાઓ રજૂ કરવા જોઈએ.
- પહેલા સરળ મુદ્દાઓની રજૂઆત થવાને કારણે વિદ્યાર્થીઓ, તેમની સામે રજૂ કરવામાં આવતાં મુદ્દાઓ ઝડપથી સમજી શકે છે. જેના કારણે તેમના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. તેઓ વધુ સંકુલ અને કઠિન મુદ્દાઓ શીખવા માટે તૈયાર થાય છે. સંકુલ અને કઠિન મુદ્દાઓ ઝડપથી સમજી અને શીખી જાય છે.
- આ અધ્યાપન સૂત્રમાં બાળકોને જે બાબત શીખવવાની હોય તે ઘટકને એવી રીતે વિભાજિત કરવો જોઈએ કે બાળકને સરળ વસ્તુનો સૌ પ્રથમ પરિચય થાય અને પછી ક્રમશઃ અઘરી કે સંકુલ વસ્તુઓને રજૂ કરવામાં આવે.
- આ અધ્યાપન સૂત્ર અભ્યાસક્રમની ગોઠવણી માટે ઉપયોગી છે. અભ્યાસક્રમની બાબતોને બાળકોની દૃષ્ટિએ વિચારી, તેની વિગતો ક્રમમાં લેવી જોઈએ.
- આ અધ્યાપન સૂત્ર 'જ્ઞાત પરથી અજ્ઞાત'ને મળતું સૂત્ર છે. શિક્ષકે બાળકને માટે કઈ વસ્તુ સરળ કે કઈ વસ્તુ અઘરી લાગશે એ બાળકના દૃષ્ટિકોણથી વિચાર કરવો જોઈએ. સામાન્ય લાગતી બાબત બાળક માટે ક્યારેક ઘણી કઠિન હોય છે.
- બાળકની વય અને માનસિક કક્ષાને ધ્યાનમાં લઈ અભ્યાસક્રમના મુદ્દા સરળ કે કઠિન પડશે તેનો વિચાર કરી શકાય. બાળકોના મર્યાદિત અનુભવોના સંદર્ભમાં પણ વિષયવસ્તુની સરળતા કે કઠિનતાનો વિચાર કરી શકાય.
- જો શિક્ષણમાં આ સૂત્રની અવગણના કરવામાં આવે તો બાળક કઠિન બાબતો સમજી શકતો નથી. ક્યારેક સરળ બાબતો પણ કઠિન લાગે એવી પરિસ્થિતિ ઊભી થાય અને છેવટે એ વિષય પ્રત્યે અણગમો ઊભો થાય તેવી ગ્રંથિ અથવા પૂર્વગ્રહ બંધાઈ જાય છે.
- આ અધ્યાપન સૂત્ર દ્વારા શરૂઆતમાં સરળ બાબતોનું જ્ઞાન આપવાથી શિક્ષણમાં બાળકોની રુચિ વધે છે. શીખવા માટે બાળક તત્પર બને છે. સ્વપ્રયત્ને વિષયને સમજવાની કોશિશ કરે છે.
- જો અધ્યાપન કાર્ય કરતી વખતે અથવા પાઠ્યપુસ્તકમાં સરળ વિગતને પહેલા શીખવવામાં આવે તો બાળક આનંદથી ગ્રહણ કરવા માટે તત્પર બને છે. ધીરે ધીરે કઠિન વિગત રજૂ થાય તો તે પણ ગ્રહણ કરી શકે છે. સરળ વસ્તુ સમજતા, ખ્યાલ સ્પષ્ટ થતા જ કઠિન બાબતો સમજવા લાગે છે.
- પાઠ્યક્રમની ગોઠવણી એવી રીતે કરવાની કે બાળક શીખવાનો આરંભ શરૂઆતથી કરે અને ક્રમિક વિકાસ કરતા કરતા કઠિન એટલે કે જટિલ-સંકુલ વિગત તરફ આગળ વધે. જો આ રીતે શીખવવામાં આવે તો જ્ઞાન સરળ, રોચક અને અર્થપૂર્ણ બને, નવું જ્ઞાન સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે.

### 11.8.4 મૂર્ત પરથી અમૂર્ત તરફ :

- મૂર્ત એટલે પ્રત્યક્ષ અને અમૂર્ત એટલે પરોક્ષ. જે આપણે જોયું હોય અથવા જોઈ શકતા હોઈએ તે બધું જ મૂર્ત કહેવાય, પરંતુ આપણે જે ન જોયું હોય એ આપણા માટે અમૂર્ત.
- બાળકો જેને પોતે જોઈને અનુભવી શકે તેવી બાબતો ઝડપથી શીખે છે. જે બાબતો જોઈ શકાય તેને મૂર્ત બાબતો કહે છે.
- મૂર્ત તથ્યો સરળ, અનાત્મલક્ષી અને બુદ્ધિગમ્ય હોય છે. બાળક મૂર્ત બાબતો સરળતાથી સમજી શકે છે.

- અમૂર્ત તથો કાલ્પનિક, સંકુલ, ભ્રામક અને કઠિન હોય છે. આવી બાબતો સમજવા માટે બાળકે ઊચ્ચ કક્ષાની માનસિક પ્રક્રિયા કરવી પડે છે. તેથી તેમને પહેલાં મૂર્ત બાબતો શીખવવી જોઈએ. ત્યાર બાદ જ તેમને અમૂર્ત બાબતો શીખવવી જોઈએ. અમૂર્ત બાબતો શીખવવા માટે પણ મૂર્ત વસ્તુઓનો સહારો લેવો જોઈએ.
- બાળક પાસે જે અનુભવો છે, તે પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવો છે. કોઈ પણ અપ્રત્યક્ષ ભાવ-અમૂર્ત ભાવ બાળક સમજી શકતો નથી. તે તેની કલ્પના બહારની બાબત છે. શિક્ષણ આપવામાં આ બાબતનો ખ્યાલ રાખવામાં આવે તો તેના પ્રત્યક્ષ અનુભવોના આધારે અમૂર્ત અનુભવો આપી શકાય. શરૂઆતમાં અમૂર્ત ખ્યાલ દૃઢ થાય ત્યાં સુધી પ્રત્યક્ષ અનુભવો આપવા પડે છે. ત્યારબાદ પ્રત્યક્ષ અનુભવોની જરૂર રહેતી નથી. ‘પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ. - સ્પેન્સર.
- આ બાબત સૂચવે છે કે શરૂઆતમાં અમૂર્ત ખ્યાલો દૃઢ કરવા પ્રત્યક્ષ અનુભવો આપવા જોઈએ. પરંતુ મહાવરા બાદ બાળક પ્રત્યક્ષ અનુભવો વગર અમૂર્ત બાબતો અંગે સમજી શકે તેવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. દા.ત., શરૂઆતમાં બાળકને મણકાઘોડી દ્વારા આંક શીખવીએ છીએ. બાળકો મણકાઘોડીમાં આવેલા મણકાઓનું અસ્તિત્વ જોઈ અને સમજી શકે છે. પરંતુ તેમના માટે એક, બે, ત્રણ... વર્ગો આંકો એ કાલ્પનિક બાબત છે. આમ મૂર્ત બાબતો રજૂ કરીને તેમને અમૂર્ત બાબતો શીખવીએ છીએ.
- પાઠમાં ચિત્રો, નકશા, મોડેલ વગેરેનો ઉપયોગ કરી પ્રત્યક્ષ અનુભવો આપી, અમૂર્ત ખ્યાલો સ્પષ્ટ કરવામાં આવે છે. જરૂર જણાય ત્યાં પ્રયોગ પણ બતાવી શકાય. જેમ વધુ ઈન્દ્રિયો ઉપયોગમાં લેવાય, તેમ જ્ઞાન વધુ મૂર્ત અને પ્રત્યક્ષ બને. પ્રત્યક્ષ જ્ઞાન સમૃદ્ધ થતાં અમૂર્તની કલ્પના સરળ બને.
- મૂર્ત પરથી અમૂર્ત તરફ અધ્યાપન સૂત્ર આગમન અભિગમમાં જોવા મળે છે. પૂરતા પ્રમાણમાં દૃષ્ટાંતો લઈ તેની મદદથી નિયમની તારવણી કરવામાં આવે છે. કોઈ સૂત્રની તારવણી પણ આ રીતે કરી શકાય. પ્રત્યક્ષ પદાર્થની રજૂઆત દ્વારા સમજ વિકસે છે. સિદ્ધાંત, નિયમ કે સંકલ્પનાની તારવણી તાર્કિક બને છે.
- આ અભિગમ તર્કસંગત હોવાથી વિજ્ઞાનના શિક્ષણ માટે ખૂબ અનુકૂળ છે. આ અભિગમમાં ગોખણપટ્ટીને પ્રોત્સાહન મળતું નથી. વિદ્યાર્થી સૂત્ર ભૂલી જાય કે નિયમ ભૂલી જાય તો પ્રયોગ દ્વારા સાબિત કરી શકે છે.
- પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વિજ્ઞાન શીખવવામાં ખૂબ અનુકૂળ છે. વિજ્ઞાન શિક્ષણ વાસ્તવિક સાધનો, નમૂના, પ્રયોગો દ્વારા કરવું જોઈએ. જ્યાં સુધી વિદ્યાર્થીનું પ્રત્યક્ષ જ્ઞાન સમૃદ્ધ ન હોય ત્યાં સુધી તેની પાસે અમૂર્તની કલ્પના કરાવવાનું સરળ નથી.

### 11.8.5 સંપૂર્ણથી વિભાગ (અંશ) તરફ :

- આ સૂત્ર જણાવે છે કે અમુક બાબતો શીખવતી વખતે બાળકને પહેલાં સમગ્રનો એક ખ્યાલ આપવો જોઈએ. ત્યારબાદ તેના વિવિધ ભાગો વિશે સ્પષ્ટ ખ્યાલ અને સમજ આપવી જોઈએ.
- જે બાબત, વસ્તુ કે ઘટના બાળક સરળતાથી જોઈ શકે અને તેનું એક સમગ્ર તરીકે પ્રત્યક્ષીકરણ સરળતાથી કરી શકે તેને આપણે સંપૂર્ણ તરીકે ઓળખીશું.
- આ સૂત્ર પાછળ માનવશાસ્ત્રીય કારણ છે. આ સૂત્ર સમષ્ટિ (ગેસ્ટાલ્ટ) વિચારસરણીને અનુસરે છે. બાળકને કાંઈ પણ શીખવવું હોય તો પહેલાં પૂર્ણરૂપથી શીખવવું જોઈએ, ત્યારબાદ તેના વિભિન્ન અંગોનું શિક્ષણ આપવું જોઈએ.
- ગેસ્ટાલ્ટવાદી મનોવૈજ્ઞાનિકો માને છે કે બાળકના મન પર હંમેશા વસ્તુની સંપૂર્ણ છાપ રહે છે. બાળક હંમેશા સંપૂર્ણ વસ્તુ જ જુએ છે. વસ્તુના જુદા જુદા ભાગ પર તેનું ધ્યાન બહુ પાછળથી જાય છે.

- બાળકોનું પ્રત્યક્ષીકરણ પ્રથમ અભિલાઈભર્યું છે. ત્યારબાદ તેના ભાગો કે અંશો તરફ. સંપૂર્ણ તરફથી વિભાગ તરફનો અભિગમ વધુ ઉપયોગી છે. કારણ કે સંપૂર્ણ વસ્તુ અર્થપૂર્ણ હોય છે. બાળક સંપૂર્ણ વસ્તુનાં બધાં જ અંગો વચ્ચેનો પારસ્પરિક સંબંધ જોઈ શકે છે.
- દા.ત., સંપૂર્ણ વૃક્ષની સંકલ્પના સ્પષ્ટ કર્યા પછી આપણે તેના મૂળ, પ્રકાંડ, શાખા, પર્ણ, ફૂલ, ફળ વગેરેનો પરિચય આપીએ છીએ. ત્યારબાદ પર્ણોમાં થતી પ્રકાશસંશ્લેષણની ક્રિયા અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે. પહેલા વનસ્પતિનો સમગ્ર ખ્યાલ આપવામાં આવે છે. ત્યારબાદ જુદા જુદા પ્રકારની વનસ્પતિઓનો ખ્યાલ આપવો જોઈએ. આમ કરવાથી બાળક સંપૂર્ણના અંશને સંપૂર્ણના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરે છે. આ સમજ તેના સમગ્રના ખ્યાલને વધુ સારી રીતે સ્પષ્ટ કરે છે.
- સંપૂર્ણ પરથી વિભાગ તરફ સૂત્રનો ઉપયોગ કરતી વખતે એક બાબત ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. બાળકની દૃષ્ટિએ સંપૂર્ણ શું તેનો શિક્ષકે ખ્યાલ રાખવો જોઈએ. બાળકને કઠિન અથવા અઘરી લાગતી બાબત ‘સંપૂર્ણ / સમગ્ર’ના અર્થમાં પ્રથમથી જ ના શીખવી શકાય.
- એ જ રીતે મંદ ગતિ ધરાવતા અધ્યેતા માટે ‘સંપૂર્ણ’નો અનુભવ ઝડપી અધ્યેતાના અનુભવ કરતાં જુદો હોઈ શકે. માટે બાળકની શક્તિ અથવા માનસિક કક્ષા મુજબ શિક્ષકે ‘સંપૂર્ણ’ અથવા ‘સમગ્ર’નો પરિચય આપવો જોઈએ.
- દા.ત., વિદ્યાર્થી સમક્ષ માર્કોસ્કોપ સમગ્ર રીતે રજૂ કરાય અને પછી તેના વિવિધ ભાગોની ઓળખ અને કાર્ય, સિદ્ધાંતની સમજ આપવામાં આવે છે.
- ટૂંકમાં, સંપૂર્ણ બાબતોનું શિક્ષણ આપ્યા પછી જ તેના જુદા જુદા વિભાગોનું શિક્ષણ થવું જોઈએ. જેથી સંપૂર્ણનો પરિચય મેળવી બાળકો વિવિધ વિભાગો વચ્ચેનો પારસ્પરિક સંબંધ જુએ છે. સંબંધો જોતી વખતે તુલનાત્મક અભ્યાસ કરવાની ટેવ પડે છે. જેનાથી યાદશક્તિ વિકસે છે અને સિદ્ધાંતોની તારવણી સરળ બને છે.

#### 11.8.6 વિભાગ પરથી સંપૂર્ણ તરફ :

- વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ઘણા ખ્યાલો સંકુલ અથવા જટિલ હોય છે. કેટલાક યંત્રોની રચના, સાધનોની રચના અને તેના સિદ્ધાંત જટિલ હોય છે. આવા સંકુલ અને જટિલ બાબતની વાત એક જ સમયે, એક જ વારમાં સંપૂર્ણ સમજાવી શકાતી નથી. તેના એક પછી એક વિભાગોની વારાફરતી સમજ આપવામાં આવે છે અને ત્યાર પછી તેના સંપૂર્ણ સ્વરૂપનું ચિત્ર ઉપસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
- દા.ત., વિજ્ઞાનમાં માનવની શરીરરચના વિદ્યાર્થીઓને શીખવવી હોય તો તેને માટે તેનાં જુદા જુદા તંત્રો જેવા કે રુધિરાભિસરણતંત્ર, શ્વસનતંત્ર, પાચનતંત્ર, ઉત્સર્ગતંત્ર, અસ્થિતંત્રનો અભ્યાસ વારાફરતી કરાવી. પછી સમગ્ર શરીરરચનાની વાત કરવામાં આવે છે. જેથી બાળક સરળતાથી શરીરરચનાની વાત કરવામાં આવે છે. જેથી બાળક સરળતાથી શરીરરચનાને શીખી શકે છે.
- આમ એક પછી એક તંત્રો, ક્રિયાઓ, ઘટનાઓ, રચના વગેરે શીખવ્યા બાદ જ સંપૂર્ણની વાત કરવી એટલે જ વિભાગથી સંપૂર્ણ તરફ જવું.

#### 11.8.7 વિશ્લેષણ પરથી સંયોજન તરફ :

- જ્યારે કોઈ સમસ્યાનો ઉકેલ મેળવવાનો હોય ત્યારે તે સમસ્યા સાથે સંકળાયેલા જેટલાં પણ (Data) પ્રદત્ત આપણી પાસે હોય તેને સમગ્રથી જુદા કરીને તેના વિશે તાર્કિક વિચાર કરવો જોઈએ. આ ક્રિયાને વિશ્લેષણ કહે છે.
- ત્યારબાદ આ બધાં પ્રદત્ત (Data) વચ્ચે આંતરસંબંધ સ્થાપિત કરવો જોઈએ અને શક્ય હોય તો આવા જુદા પાડેલાં તત્ત્વો વચ્ચે કાર્યકારણનો સંબંધ સ્થાપિત કરવો જોઈએ. એટલે કે તેમને

તાર્કિક ક્રમમાં ગોઠવવા જોઈએ. જેથી સમસ્યાના ઉકેલ સુધી પહોંચવાનો માર્ગ મળે. આ ક્રિયાને સંશ્લેષણ (સંયોજન) તરીકે ઓળખવામાં આવે છે.

- જ્યારે બાળકને સમસ્યાનો ઉકેલ મેળવવાનું શીખવવાનું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ જણાવો પ્રકારના પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ આ સૂત્ર મુજબ પ્રક્રિયા કરવી પડે છે.
- શરૂઆતમાં બાળકનું જ્ઞાન અચોક્કસ, અસ્પષ્ટ અને અનિશ્ચિત હોય છે. શિક્ષક વિશ્લેષણ (પૃથક્કરણ) દ્વારા તેને સમજાવવા પ્રયત્ન કરે છે. અને પછી સંશ્લેષણ (સંયોગીકરણ) તરફ દોરે છે. આ રીતે કેટલાક ખ્યાલો સંકલ્પનાઓ દઢ કરી શકાય છે. આથી બાળકો દરેક સમજ તર્કબદ્ધ રીતે મેળવે છે, પરિણામે તેની તર્કશક્તિ વિકસે છે.
- આમાં બાળકને પ્રથમ પૂર્ણમાં ખ્યાલ આપવો જોઈએ, પછી તેના વિભિન્ન અંગોનો ખ્યાલ વિશ્લેષણ કરીને મેળવવો અથવા આપવો જોઈએ અને ફરીથી સંપૂર્ણનો ખ્યાલ આપવા સંયોગીકરણ કરવું જોઈએ.
- વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓને રાસાયણિક સમીકરણ સંતુલિત કરતાં શીખવતી વખતે પહેલા પદાર્થમાં આપેલા દરેક અણુમાં સમાવિષ્ટ પરમાણુને છૂટા પાડી, જમણી બાજુ અને ડાબી બાજુના પરમાણુની સંખ્યા ગુણાકાર કરીને સરખી કરી; ફરીથી સંયોજન કરી અણુ બનાવીને શીખવીએ તો વિદ્યાર્થીઓને રાસાયણિક સમીકરણ સંતુલિત કરવામાં જે મુશ્કેલી અનુભવે તે દૂર કરી શકાય અને સમજવામાં સરળતા પડે.

● તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી જગ્યામાં જ લખો.

1. 'જ્ઞાતથી અજ્ઞાત તરફ' અધ્યાપન સૂત્રનો ઉપયોગ વિજ્ઞાન શિક્ષણમાં જણાવો.

.....

.....

.....

.....

.....

.....

2. 'મૂર્ત પરથી અમૂર્ત તરફ' અધ્યાપન સૂત્રનો અર્થ જણાવો.

.....

.....

.....

.....

.....

.....

3. 'સંપૂર્ણથી વિભાગ (અંશ) તરફ' અધ્યાપન સૂત્રનું વિજ્ઞાન શિક્ષણને ધ્યાનમાં રાખી ઉદા. આપો.

.....

.....



.....  
.....  
.....  
.....

### 11.9 સારાંશ :

આ એકમમાં અધ્યાપન અભિગમ, તેના મહત્વ અને ત્યારબાદ આગમન-નિગમન અભિગમ, સમસ્યા ઉકેલ અભિગમ, સંરચનાવાદી અભિગમ અને અધ્યાપન સૂત્રો (મનોવૈજ્ઞાનિક અભિગમનો) વિસ્તૃતમાં અભ્યાસ કર્યો. દરેક અભિગમના કેટલાક ફાયદા અને ગેરફાયદા છે. માટે વિજ્ઞાનના અધ્યાપન માટે અભિગમની પસંદગી ખૂબ ધ્યાન રાખીને કરવી પડતી હોય છે. વિવિધ અભિગમનો ક્યારે, કઈ રીતે અને શા માટે ઉપયોગ કરવો તેના વિશે શિક્ષકે ચોક્કસ રહેવાનું હોય છે. અભ્યાસના હેતુઓ, વર્ગખંડની પરિસ્થિતિ, અભ્યાસના મુદ્દા, સાધન-સામગ્રી વગેરે દરેક બાબતને ધ્યાનમાં રાખી અધ્યાપન અભિગમની ચોક્કસ પસંદગી કરવી જોઈએ. માટે શિક્ષકે શક્ય હોય ત્યાં સુધી દરેક અભિગમનો યોગ્ય મહાવરો અવશ્ય કરી ત્યારબાદ જ તેનું અમલીકરણ કરવું વધુ હિતાવહ છે.

### 11.10 સ્વાધ્યાય :

- (1) અધ્યાપન અભિગમ એટલે શું ? તેની સંકલ્પના સ્પષ્ટ કરો.
- (2) અધ્યાપન અભિગમનું મહત્વ જણાવો.
- (3) આગમન અભિગમ એટલે શું ? તેની સંકલ્પના સ્પષ્ટ કરી વિસ્તૃતમાં વર્ણન કરો.
- (4) આગમન અભિગમના લાભ અને મર્યાદાઓ જણાવો.
- (5) નિગમન અભિગમ એટલે શું ? ઉદાહરણ દ્વારા વિસ્તૃતમાં સમજૂતી આપો.
- (6) નિગમન અભિગમના લાભ અને મર્યાદાઓ જણાવો.
- (7) આગમન અભિગમ અને નિગમન અભિગમ વચ્ચેનો તફાવત જણાવો.
- (8) સમસ્યા ઉકેલ અભિગમ એટલે શું ? તેની સંકલ્પના સ્પષ્ટ કરો.
- (9) સમસ્યા ઉકેલ અભિગમની વિસ્તૃતમાં ચર્ચા કરો.
- (10) સમસ્યા ઉકેલ અભિગમના લાભ અને મર્યાદાઓ જણાવો.
- (11) સંરચનાવાદી અભિગમનો અર્થ જણાવી તેની સંકલ્પના સ્પષ્ટ કરો.
- (12) સંરચનાવાદી અભિગમ એટલે શું ? તેની લાક્ષણિકતાઓનું વિસ્તૃતમાં વર્ણન કરો.
- (13) સંરચનાવાદી અભિગમમાં શિક્ષકની ભૂમિકાનું વર્ણન કરો.
- (14) સંરચનાવાદી વર્ગખંડ માટેની શૈક્ષણિક પરિસ્થિતિઓ કેવી હોવી જોઈએ.
- (15) વિજ્ઞાનના અધ્યાપનમાં સંરચનાવાદી અભિગમના અમલ માટેના તબક્કાઓનું વિસ્તૃતમાં વર્ણન કરો.
- (16) સંરચનાવાદી અભિગમના લાભ અને મર્યાદાઓ જણાવો.
- (17) 'જ્ઞાતથી અજ્ઞાત તરફ' અધ્યાપન સૂત્રની વિસ્તૃતમાં સમજૂતી આપો.
- (18) 'સરળથી કઠિન તરફ' અધ્યાપન સૂત્રની વિસ્તૃતમાં સમજ આપો.
- (19) 'મૂર્ત પરથી અમૂર્ત તરફ' અધ્યાપન સૂત્રનું વિસ્તૃતમાં વર્ણન કરો.
- (20) 'સંપૂર્ણથી વિભાગ તરફ' અધ્યાપન સૂત્રની વિસ્તૃતમાં સમજ આપો.
- (21) 'વિભાગથી સંપૂર્ણ તરફ' અધ્યાપન સૂત્ર એટલે શું ?
- (22) 'વિશ્લેષણ પરથી સંયોજન તરફ' અધ્યાપન સૂત્રની વિસ્તૃતમાં સમજ ઉદાહરણ દ્વારા આપો.

12.1 પ્રસ્તાવના

12.2 ઉદ્દેશો

12.3 અધ્યાપન પ્રતિમાન

12.3.1 પ્રસ્તાવના :

12.3.2 અધ્યાપન પ્રતિમાનની વ્યાખ્યા

12.3.3 અધ્યાપન પ્રતિમાનનો અર્થ

12.3.4 અધ્યાપન પ્રતિમાનના લક્ષણો

12.3.5 પરંપરાગત અધ્યાપન પદ્ધતિ અને અધ્યાપન પ્રતિમાન વચ્ચે તફાવત

12.3.6 અધ્યાપન પ્રતિમાનનું વર્ગીકરણ

12.4 સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન અથવા ખ્યાલ-પ્રાપ્તિ પ્રતિમાન

12.4.1 પ્રસ્તાવના

12.4.2 સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનની વ્યાખ્યા

12.4.3 સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનનો અર્થ

12.4.4 સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનની સંકલ્પના

12.4.5 સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનના સોપાનો

12.5 પૂછપરછ તાલીમ પ્રતિમાન

12.5.1 પ્રસ્તાવના

12.5.2 પૂછપરછ તાલીમ પ્રતિમાનની લાક્ષણિકતાઓ

12.5.3 પૂછપરછ તાલીમ પ્રતિમાનનાં હેતુઓ

12.5.4 પૂછપરછ તાલીમ પ્રતિમાનના સોપાનો

12.6 સારાંશ

12.7 સ્વાધ્યાય

12.8 સૂચિત સંદર્ભવાચન

12.1 પ્રસ્તાવના :

વિજ્ઞાનના અધ્યાપનમાં ઘણી પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, અધ્યાપન સૂત્રો તેમજ વિવિધ કૌશલ્યોના ઉપયોગની હિમાયત કરવામાં આવી છે. શૈક્ષણિક ટેકોલોજીના વિકાસની સાથે શિક્ષણમાં નવી નવી તકનિકોનો ઝડપથી ઉપયોગ થવા લાગ્યો છે. અધ્યાપનકાર્યમાં અને મૂલ્યાંકનમાં કમ્પ્યુટર અને ઈન્ટરેન્ટનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. શિક્ષણમાં ઘણા પરિવર્તન જોવા મળે છે. છતાં એવા શિક્ષણ સિદ્ધાંતોની રચના નથી થઈ શકે કે જે સંપૂર્ણ હોય એટલે કે જેમાં કોઈ મર્યાદાઓના રહી ગઈ હોય. શિક્ષણશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકો મનોવૈજ્ઞાનિકો સિદ્ધાંતોનો આધાર લઈ વધુમાં વધુ અસરકારક અધ્યાપન સિદ્ધાંતો અને પ્રતિમાનોની રચના કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આમ અધ્યાપન પ્રતિમાન એ બીજું કંઈ નહીં પરંતુ અધ્યાપન માટેની વૈજ્ઞાનિક પ્રક્રિયા દર્શાવતી રૂપરેખા છે. અધ્યાપન

પ્રતિમાન એ અધ્યાપનના સિદ્ધાંતોની પૂર્વ અવસ્થા છે. તો અધ્યાપનના સિદ્ધાંતો ઘડવા માટેનો આધાર પૂરો પાડે છે. શિક્ષક તરીકે અધ્યાપન પ્રતિમાનનો તલસ્પર્શી અભ્યાસ કરવા માટે તેના માળખાથી પરિચિત થવું ખૂબ જ જરૂરી છે. આ એકમમાં અધ્યાપન પ્રતિમાનનો અર્થ, વ્યાખ્યા, લક્ષણો, સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન અને પૂછપરછ તાલીમ પ્રતિમાનની વિગતે ચર્ચા કરવામાં આવી છે.

## 12.2 ઉદ્દેશો :

- આ એકમ પૂર્ણ કર્યા પછી પ્રશિક્ષણાર્થી નીચેની બાબતોમાં સક્ષમ બની શકશે.
- અધ્યાપન પ્રતિમાનનું તમારા શબ્દોમાં વર્ણન કરી શકશે.
- અધ્યાપન પ્રતિમાનના લક્ષણોથી માહિતીગાર થશે.
- અધ્યાપન પદ્ધતિ અને અધ્યાપન પ્રતિમાન વચ્ચેનો તફાવત જાણી શકશે.
- સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનનો અર્થ જાણી શકાશે.
- સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનના સોપાનોનું વર્ણન કરી શકશે.
- પૂછપરછ તાલીમ પ્રતિમાનથી માહિતગાર થશે.
- પૂછપરછ તાલીમ પ્રતિમાનના હેતુઓ અને સોપાનોનું સ્પષ્ટ વર્ણન કરી શકશે.

## 12.3 અધ્યાપન પ્રતિમાન

### 12.3.1 પ્રસ્તાવના :

શિક્ષણ પ્રતિમાન એ શિક્ષણમાં સ્વીકાર પામેલો એક નવો વિચાર છે. પ્રતિમાન એ અધ્યાપન માટેની વૈજ્ઞાનિક પ્રક્રિયા દર્શાવતી રૂપરેખા છે. અધ્યાપન પ્રતિમાન એ અધ્યાપનના સિદ્ધાંતોની પૂર્વ અવસ્થા છે. તે અધ્યાપનના સિદ્ધાંતો ઘડવા માટેનો આધાર પૂરો પાડે છે. પ્રતિમાન વિશાળ અર્થમાં આયોજન કે અનુકરણીય નમૂનો છે. જેનો ઉપયોગ અભ્યાસક્રમની રચના કે વર્ગખંડ શિક્ષણકાર્યમાં માર્ગદર્શક બને છે. પ્રતિમાન ચોક્કસ પ્રારૂપ (Design) છે. જે કોઈ આદર્શ અનુસાર વિદ્યાર્થીના વર્તનને અને ક્રિયાને સરળ બનાવે છે. કોઈ એક પ્રતિમાન એક કરતાં વધારે પદ્ધતિઓ સાથે સંકળાય છે. અધ્યાપન પ્રતિમાન એ હેતુલક્ષી છે, તે વિદ્યાર્થીકેન્દ્રી છે, તે ચોક્કસ વાતાવરણના નિર્માણની હિમાયત કરે છે. તે અભ્યાસક્રમ સામગ્રીની રચના માટેનું માર્ગદર્શન આપે છે, તે અધ્યાપનનો એક જુદો અભિગમ છે, તે અધ્યાપનની એક જુદા પ્રકારની વ્યૂહરચના છે.

શિક્ષકે પોતાના શિક્ષણને અસરકારક બનાવવા અને જુદા જુદા શૈક્ષણિક ઉદ્દેશો પાર પાડવા જે તે ઉદ્દેશને અનુરૂપ અધ્યાપન પદ્ધતિ પસંદ કરવી જોઈએ. અધ્યાપનની કોઈ એક જ રીત ઉત્તમ છે તેમ કહી શકાય નહિ. અધ્યાપન પ્રતિમાન એ વિશિષ્ટ ઉદ્દેશોને સિદ્ધ કરવા માટેની નિર્દેશિત વ્યૂહરચનાઓ છે. અધ્યાપનનો ઉદ્દેશ સંકલ્પનાઓની સ્પષ્ટતાનો હોય તો શિક્ષકે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન પસંદ કરવો જોઈએ. તેજ રીતે જો શૈક્ષણિક ઉદ્દેશ પૂછપરછ કૌશલ્ય વિકસાવવાનો હોય તો પૂછપરછ કૌશલ્ય-પ્રાપ્તિ પ્રતિમાનની પસંદગી કરી તેનું આયોજન કરવું જોઈએ.

### 12.3.2 અધ્યાપન પ્રતિમાનની વ્યાખ્યા :

“અધ્યાપન પ્રતિમાન એ વિસ્તૃત રીતે વર્ણવેલ એક આયોજન છે. જેમાં સિદ્ધાંતો પર આધારિત ક્રમિક અને પુનરાવર્તન થઈ શકે તેવા સોપાનો જણાવેલા હોય છે જેનો ઉપયોગ કરીને શિક્ષક અધ્યેતા પર ચોક્કસ અધ્યાપન અસરો પાડી શકે છે.”

- સનસનવાલ અને સિંહ

“કોઈ રૂપરેખા અથવા ઉદ્દેશ અનુસાર વ્યવહારને ઢાળવાની પ્રક્રિયાને પ્રતિમાન કહેવાય છે.”

- એમ.સી. વિલ્ડન

“અધ્યાપન-પ્રતિમાન એ માત્ર અધ્યાપનની રૂપરેખા છે. જેની અંતર્ગત વિશિષ્ટ ઉદ્દેશોની પ્રાપ્તિ માટે વિશિષ્ટ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થી અને શિક્ષકની આંતરક્રિયા એ પ્રકારે હોય છે કે જેથી વિદ્યાર્થીઓમાં અપેક્ષિત વર્તન ફેરફારો લાવી શકાય.”

- બ્રુસ જોયસ

### 12.3.3 અધ્યાપન પ્રતિમાનનો અર્થ :

- અધ્યાપન પ્રતિમાન એ અધ્યાપન અધ્યયન માટેની વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી પ્રક્રિયાની રૂપરેખા છે જે ચોક્કસ સામાજિક વાતાવરણનું સર્જન એ રીતે કરે છે કે જેમાં વિદ્યાર્થીઓ સક્રિય રહીને આંતરક્રિયા કરે છે. જેના પરિણામે તેમના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન આવે છે. તે ઉપરાંત અધ્યાપન પ્રતિમાન અભ્યાસક્રમ રચના અને મૂલ્યાંકન માટેના માર્ગદર્શક સિદ્ધાંત પૂરા પાડે છે.
- અધ્યાપન પ્રતિમાન એ અધ્યાપનની વૈજ્ઞાનિક પદ્ધતિ કે વ્યૂહરચના છે જે ચોક્કસ અને ક્રમિક સોપાનો ધરાવે છે. જેનો ઉપયોગ કરવા માટે વિશિષ્ટ વાતાવરણ ઊભું કરવું પડે છે. તે એક સામાજિક પ્રણાલી છે. તે વિદ્યાર્થીઓના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવા માટે અધ્યાપન અધ્યયન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સંપૂર્ણ ભાગીદારિતાને અનિવાર્ય બાબત તરીકે સ્વીકારે છે.

### 12.3.4 અધ્યાપન પ્રતિમાનના લક્ષણો :

- તે અધ્યાપન અધ્યયન માટેની એક સામાજિક પ્રણાલીનો નિર્દેશ કરે છે.
- તે એક પ્રકારની વિદ્યાર્થીકેન્દ્રી અનુદેશક રૂપરેખા છે.
- તેમાં વિદ્યાર્થીઓને સતત સક્રિય રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
- તે ચોક્કસ અને ક્રમિક સોપાનો ધરાવતા હોય છે.
- તે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વાતાવરણનું નિર્માણ કરવા માટેની એક રૂપરેખા છે.
- તે અધ્યાપન સૂત્રોનો ઉપયોગ કરે છે.
- તેમાં વિદ્યાર્થીઓના વર્તન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.
- તે શિક્ષક અને વિદ્યાર્થીઓને યોગ્ય અનુભવો પૂરા પાડે છે.
- તેના દ્વારા શિક્ષક-વિદ્યાર્થી વ્યવહાર સંબંધી બધા જ મૂળભૂત પ્રશ્નોના ઉત્તર મળી જાય છે.
- તેમાં વિદ્યાર્થીની રુચિનો ઉપયોગ કરવામાં આવે છે.
- તે તાત્વિક સિદ્ધાંતો અને મનોવૈજ્ઞાનિક નિયમો પર આધારિત છે.
- તે શિક્ષણનું વ્યાવહારિક સ્વરૂપ છે કે જે શિક્ષકના વ્યક્તિત્વને વિકસાવે છે.
- તેમાં શિક્ષકના વ્યક્તિત્વની ગુણાત્મક ઉન્નતિ થાય છે.
- તેમાં શિક્ષણને એક કલા સ્વરૂપે વિકસાવી શકાય છે.

### 12.3.5 પરંપરાગત અધ્યાપન પદ્ધતિ અને અધ્યાપન પ્રતિમાન વચ્ચે તફાવત :

અધ્યાપન પ્રતિમાન	પરંપરાગત અધ્યાપન પદ્ધતિ
● દરેક અધ્યાપન પ્રતિમાન એ કોઈ ચોક્કસ સિદ્ધાંત પર આધારિત હોય છે.	● પરંપરાગત અધ્યાપન પદ્ધતિ કોઈ ચોક્કસ સિદ્ધાંત પર આધારિત હોતી નથી.
● અધ્યાપન પ્રતિમાનની ઉચ્ચકક્ષાની સંરચના (Syntax) હોય છે.	● પરંપરાગત અધ્યાપન પદ્ધતિની કોઈ સંરચના હોતી નથી.
● અધ્યાપન પ્રતિમાનના કેન્દ્રમાં અધ્યાપનના હેતુઓ હોય છે.	● પરંપરાગત અધ્યાપન પદ્ધતિના કેન્દ્રમાં વિષયવસ્તુ હોય છે.
● અધ્યાપન પ્રતિમાન વિદ્યાર્થીઓને સતત સક્રિય રાખે છે.	● દરેક પરંપરાગત અધ્યાપન પદ્ધતિ વિદ્યાર્થીઓને સતત સક્રિય રાખતી નથી.
● અધ્યાપન પ્રતિમાનના ચોક્કસ નિયમો હોય છે.	● પરંપરાગત અધ્યાપન પદ્ધતિના ચોક્કસ નિયમો હોતા નથી.
● કોઈ પણ અધ્યાપન પ્રતિમાનનું અનેક શિક્ષકો દ્વારા જુદા જુદા વર્ગખંડમાં એક જ રીતે ઉપયોગ કરી શકાય છે.	● એક જ શિક્ષક પણ પરંપરાગત અધ્યાપન પદ્ધતિનો જુદા જુદા વર્ગખંડમાં એક જ રીતે ઉપયોગ કરી શકતો નથી.
● અધ્યાપન પ્રતિમાનના ચોક્કસ સોપાનો હોય છે.	● પરંપરાગત અધ્યાપન પદ્ધતિના ચોક્કસ સોપાનો હોતા નથી.
● અધ્યાપન પ્રતિમાન શિક્ષકો અને વિદ્યાર્થીઓની ચોક્કસ જવાબદારીઓ નક્કી કરે છે.	● પરંપરાગત અધ્યાપન પદ્ધતિ શિક્ષકો અને વિદ્યાર્થીઓની ચોક્કસ જવાબદારી નક્કી કરતી નથી.
● દરેક અધ્યાપન પ્રતિમાન માટે ચોક્કસ વાતાવરણનું વૈજ્ઞાનિક ઢબે નિર્માણ કરવું પડે છે.	● પરંપરાગત અધ્યાપન પદ્ધતિ માટે ચોક્કસ વાતાવરણનું વૈજ્ઞાનિક ઢબે નિર્માણ કરવું પડતું નથી.
● દરેક અધ્યાપન પ્રતિમાનની ચોક્કસ મૂલ્યાંકન પ્રણાલી હોય છે.	● પરંપરાગત અધ્યાપન પદ્ધતિની ચોક્કસ મૂલ્યાંકન પ્રણાલી હોતી નથી.
● દરેક અધ્યાપન પ્રતિમાન એ વિશિષ્ટ અનુદેશન સામગ્રીની રચના માટેની ભૂમિકા પૂરી પાડે છે.	● પરંપરાગત અધ્યાપન પદ્ધતિમાં પ્રવર્તમાન વિષયવસ્તુની ચર્ચા કરવા માટે અનુદેશન સામગ્રીની રચના કરવાની જરૂર રહેતી નથી.

### 12.3.6 અધ્યાપન પ્રતિમાનનું વર્ગીકરણ :

અધ્યાપન પ્રતિમાનનું અંતિમ અને ચોક્કસ વર્ગીકરણ કરવાનું કામ મુશ્કેલ છે. કારણ કે જુદા જુદા વિદ્વાનોએ જુદી જુદી રીતે અધ્યાપન પ્રતિમાનોનું વર્ગીકરણ કર્યું છે અને સમયાંતરે નવા પ્રતિમાનોની રચના થતી રહે છે. અધ્યાપન પ્રતિમાનના મુખ્ય પ્રકારો નીચે મુજબ જણાવી શકાય.

- (1) ઐતિહાસિક અધ્યાપન પ્રતિમાન
- (2) દાર્શનિક અધ્યાપન પ્રતિમાન
- (3) મનોવૈજ્ઞાનિક અધ્યાપન પ્રતિમાન
- (4) અધ્યાપક શિક્ષણ (શિક્ષક-પ્રશિક્ષણ) અધ્યાપન પ્રતિમાન
- (5) આધુનિક અધ્યાપન પ્રતિમાન

આ પૈકી આધુનિક અધ્યાપન પ્રતિમાનને નીચેના વિભાગોમાં વર્ગીકૃત કરેલ છે.

- (1) સામાજિક આંતરક્રિયા અધ્યાપન પ્રતિમાન
- (2) માહિતી પ્રક્રિયા અધ્યાપન પ્રતિમાન
- (3) વૈયક્તિક અધ્યાપન પ્રતિમાન
- (4) વર્તન સુધાર અધ્યાપન પ્રતિમાન.

આ ચાર વિભાગો પૈકી માહિતી પ્રક્રિયા અધ્યાપન પ્રતિમાનનાં આઠ પ્રકાર નીચે મુજબ છે.

- (1) સંકલ્પના પ્રાપ્તિ અધ્યાપન પ્રતિમાન
- (2) પૂછપરછ પ્રશિક્ષણ અધ્યાપન પ્રતિમાન
- (3) આગમનિક ચિંતન અધ્યાપન પ્રતિમાન
- (4) જીવવૈજ્ઞાનિક પૂછપરછ અધ્યાપન પ્રતિમાન
- (5) જ્ઞાનાત્મક વૃદ્ધિ અધ્યાપન પ્રતિમાન
- (6) અગ્રિમ સંગઠક અધ્યાપન પ્રતિમાન
- (7) વિકાસાત્મક અધ્યાપન પ્રતિમાન
- (8) સ્મૃતિ અધ્યાપન પ્રતિમાન.

આ આઠ પૈકી પ્રથમ બે પ્રતિમાનની સમજ મેળવીશું.

#### 12.4 સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન અથવા ખ્યાલ-પ્રાપ્તિ પ્રતિમાન :

##### 12.4.1 પ્રસ્તાવના :

- સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન જેરોમી બ્રુનર એ ઈ.સ. 1967માં પ્રસ્તુત કર્યું હતું. શાળામાં શિક્ષક અને વિદ્યાર્થી શિક્ષણનાં પરિબલો છે. શિક્ષકની નવીનીકરણ પ્રત્યેની જાગૃતિ અને જ્ઞાનવિસ્ફોટને આત્મસાત કરવાની તેની તીવ્ર ઇચ્છાનો અંદાજ તેના વર્ગના વિદ્યાર્થીઓની સિદ્ધિઓ તેમજ પ્રાપ્ત પરિણામોને આધારે મળી રહે છે.
- વર્તમાન યુગમાં શિક્ષણની ગતિશીલતા અને જીવંતતાને માપવાના બે માપદંડો છે. (અ) નવીનીકરણ અને (બ) પરિવર્તન.
- વિશ્વની અને સમાજની ઝડપથી બદલાતી પરિસ્થિતિને પહોંચી વળવા તથા તેની સાથે તાલ મિલાવવા શિક્ષણમાં નવા નવા પ્રયોગો, સંશોધનો તેમજ ઉપકરણોનો આશ્રય શિક્ષક માટે જરૂરી થઈ પડ્યો છે.
- અધ્યાપક અધ્યેતાકેન્દ્રી શિક્ષણ પદ્ધતિનો આશ્રય લે તે વધુ અસરકારક અને યોગ્ય ગણાશે. વિદ્યાર્થી વર્ગમાં વધુ સક્રિય બને તેવી શિક્ષણપ્રણાલીનો ઉપયોગ જો શિક્ષક કરે તો વિદ્યાર્થીઓ વધુ રસ લેતા થાય ને સક્રિય બને. પરિણામે શિક્ષણ જીવંત અને રસપ્રદ બની રહેશે. પરિણામે વિદ્યાર્થીઓની જ્ઞાનપ્રાપ્તિ સવિશેષ, સબળ, સમૃદ્ધિ અને સુસ્થિર થશે.
- સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનની સંકલ્પના રજૂ થયેલ જ્ઞાન કે માહિતીને આત્મસાત્ કરવા માટે સંકલ્પનાઓ સ્પષ્ટ હોવી જોઈએ. માહિતીની સમજૂતીનો આધાર સંકલ્પનાઓનું સ્પષ્ટીકરણ કરવું તે છે.

##### 12.4.2 સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનની વ્યાખ્યા :

“પદાર્થો કે ઘટનાઓનાં અનિવાર્ય લક્ષણો વિશેની વ્યવસ્થિત માહિતીના આધારે પદાર્થો કે ઘટનાઓને પરસ્પર સંબંધવાની અને વિભેદવાની ક્ષમતા એટલે સંકલ્પના.”

- હર્બર્ટ જે. ક્લોજમેર, એલીઝાબેથ એસ. ઘાટલા અને ડોરોથી એ ફેયર

“એવો શબ્દ અથવા સંકેત કે જેના દ્વારા આખા સમૂહનું પ્રતિનિધિત્વ થાય.” - સનસનવાલ

“વસ્તુ કે ઘટનાઓની સમાન વિશેષતાઓનું પ્રતિનિધિત્વ કરતી પ્રક્રિયા સંકલ્પના છે.”

- મોર્ગન

“સંકલ્પના એ પ્રક્રિયા છે, જે જુદી જુદી વસ્તુઓ, સ્થિતિઓ કે ઘટનાઓમાં ઉપસ્થિત સરખાપણાનું પ્રતિનિધિત્વ કરે છે.”

- મન

“સંકલ્પના એ સમાન તત્ત્વો કે ગુણોના વિચારોનું પ્રતિનિધિત્વ કરતી પ્રક્રિયા સંકલ્પના કહેવાય છે.”

- ગુડ

#### 12.4.3 સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનનો અર્થ :

- અત્રે ઉપરોક્ત વ્યાખ્યાઓને આધારે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન એટલે વિવિધ વિષયની કેટલીક સંકલ્પનાઓના અભિગમને વ્યવહારુ રીતે વર્ગીકૃત્તમાં ઉપયોગમાં લેવા માટેની કાર્યપદ્ધતિ.
- સંકલ્પનાનો સરળ અર્થ એવો લઈ શકાય કે સંકલ્પના કોઈ વસ્તુ કે ઘટનાની પાછળ રહેલી માનસિક પ્રતિમા છે કે, જે માનવીના મનમાં ઇવાયેલી રહે છે.
- સૌ પ્રથમ વિદ્યાર્થીઓને વિવિધ વિષયોની કેટલીક સંકલ્પનાઓ વિશેની સમજ આપવામાં આવે છે. આ સંકલ્પના સ્પષ્ટ કરવા માટે તેને અનુરૂપ જીવંત અને વ્યવહારુ ઉદાહરણની રજૂઆત કરવામાં આવે છે. ત્યારબાદ ચોક્કસ સંકલ્પના તારવવામાં આવે છે. પછી વિદ્યાર્થીઓ સંકલ્પના સ્પષ્ટપણે સમજ્યા છે કે નહિ તે ચકાસવા પ્રશ્નો પૂછવામાં આવે છે. જરૂર પડ્યે ગૃહકાર્ય પણ અપાય છે. મૂલ્યાંકનને અંતે જરૂરિયાત પ્રમાણે કેટલીક સંકલ્પનાઓનું પુનરાવર્તન કરવામાં આવે છે જે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનની વિશેષતા કહી શકાય.

#### 12.4.4 સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનની સંકલ્પના :

- સંકલ્પના-પ્રાપ્તિના જુદા જુદા સ્તરો હોય છે. જેરોમી એસ. બ્રુનરે જ્ઞાનાત્મક વિકાસ અને શિક્ષણ વિષે અભ્યાસો કર્યા તેના પરિણામ સ્વરૂપે અધ્યયનને વધુ સરળ બનાવવા માટે અધ્યયનની પ્રક્રિયાનું માત્ર પૃથક્કરણ કરીને અટકી જવાને બદલે શિક્ષકે વર્ગમાં પોતાનું અધ્યાપનકાર્ય કઈ રીતે ગોઠવવું તે માટે અધ્યયન સિદ્ધાંત પર આધારિત અધ્યયન સિદ્ધાંત રજૂ કર્યો છે.
- બ્રુનરે સંકલ્પનાના શિક્ષણ પર વિશેષ ભાર આપ્યો છે. આપણે વિશ્વ વિશે જે કંઈ જાણીએ છીએ તેમાં મોટાભાગનું જ્ઞાન એ સંકલ્પનાઓ અને તેમની વચ્ચેના સંબંધો હોય છે. સંકલ્પનાઓ વિચારો, વસ્તુઓ, લોકો કે અનુભવોનો એક સામાન્ય વર્ગ છે. કે જેના સભ્યો ચોક્કસ લક્ષણો ધરાવે છે.
- ઉદાહરણ તરીકે, ‘વિદ્યાર્થી’ એક સંકલ્પના છે. તે કોઈ એક ચોક્કસ સમાનતા ધરાવતા લોકોનો વર્ગ છે. તેઓ બધા અભ્યાસ કરે છે. આ બધા લોકો નાની ઉંમરના કે મોટી ઉંમરના હોય, શાળામાં કે શાળા બહાર અભ્યાસ કરતા હોય, તેઓ ગણિત શીખતા હોય કે ક્રિકેટ, પરંતુ તે બધા એક જ વર્ગ - ‘વિદ્યાર્થી’માં આવે.
- દરેક સંકલ્પનાનાં ઉદાહરણો હોય અને અનુદાહરણો હોય. ઉદાહરણ તરીકે ‘વિશેષણ’ સંકલ્પના છે. ‘દુઃખી’ તેનું ઉદાહરણ છે. ‘દુઃખ’ તેનું અનુદાહરણ છે.
- દરેક સંકલ્પનાના અનિવાર્ય લક્ષણો હોય છે, જેના આધારે તે સંકલ્પના નક્કી થઈ શકે. અનિવાર્ય લક્ષણોની મદદથી ઉદાહરણોને અનુદાહરણોથી જુદાં પાડી શકાય છે.
- દરેક સંકલ્પના તેનાં આવશ્યક લક્ષણોને નિશ્ચિત કરતા નિયમ વડે રજૂ કરી શકાય છે.
- આમ, કોઈ પણ સંકલ્પનાના ચાર ઘટકો છે. (1) નામ, (2) ઉદાહરણો, (3) આવશ્યક લક્ષણો, અને (4) નિયમ.
- સંકલ્પનાઓના શિક્ષણ માટે બ્રુનરે આપેલ સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનના ધ્યેયો, ધારણાઓ અને સોપાનો નીચે મુજબ છે.

● ધ્યેયો :

1. વિદ્યાર્થીઓને સંકલ્પનાનું શિક્ષણ આપવું.
2. વિદ્યાર્થીઓમાં આગમનાત્મક તર્કશક્તિ વિકસાવવી.
3. વિદ્યાર્થીઓમાં સંકલ્પનાની સમજમાં ઊંડાણ લાવવું.

● ધારણાઓ :

1. વર્ગીકરણ કરવું એ પાયાની વિચાર પ્રક્રિયા છે.
2. વર્ગીકરણ કરવાથી પર્યાવરણની સંકુલતા ઘટે છે.

**12.4.5 સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનના સોપાનો :**

સંકલ્પના - પ્રાપ્તિ પ્રતિમાન (મોડલ)નાં સંકલ્પનાના શિક્ષણ માટે અનુસરવાનાં ત્રણ સોપાનો નીચે મુજબ છે.

● સોપાન-1 : માહિતીની રજૂઆત અને સંકલ્પનાની ઓળખ :

● અહીં શિક્ષકે જે સંકલ્પના શીખવવાની છે તેનાં કેટલાંક ઉદાહરણો અને અનુદાહરણો રજૂ કરે છે. આ તમામ ઉદાહરણો ચોક્કસ ક્રમમાં ગોઠવેલા હોય છે. અને તે દરેક ઉદાહરણ છે કે અનુદાહરણ તે દર્શાવવા દરેક સામે અનુક્રમે, ‘હા’ અથવા ‘ના’ લખેલ હોય છે અથવા દરેકને ‘ઉદાહરણ’ અને ‘અનુદાહરણ’ શીર્ષકની નીચે સ્તંભમાં લખવામાં આવે છે. વિદ્યાર્થીઓને ઉદાહરણ અને અનુદાહરણની પ્રત્યેક જોડીને તેના લક્ષણોને આધારે સરખાવવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ સંકલ્પનાનું નામ આપવાનું કહેવામાં આવે છે. જરૂર જણાય તો વધુ ઉદાહરણો - અનુદાહરણોની જોડ આપવામાં આવે છે. અંતમાં આવશ્યક લક્ષણોના આધારે સંકલ્પનાની વ્યાખ્યા આપવાનું કહેવામાં આવે છે.

● પ્રથમ સોપાનમાં શિક્ષક-વિદ્યાર્થીઓએ કરવાની આ સમગ્ર પ્રક્રિયા એક ઉદાહરણ દ્વારા સમજાવે. એક પાંચમાં ધોરણના વર્ગમાં એક શિક્ષક વિદ્યાર્થીઓ સામે એક ટેબલ પર બે સાઈનબોર્ડ મૂકે છે : (1) ઉદાહરણ અને (2) અનુદાહરણ. વર્ગના બધા વિદ્યાર્થીઓ આ બંને સાઈનબોર્ડ વાંચી શકે છે. ત્યારબાદ શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે : “મારા મનમાં એક વિચાર - સંકલ્પના છે. તમારે તે કહી બતાવવાની છે.” આમ કહીને તે ‘ઉદાહરણ’ના બોર્ડ સામે સફરજન અને ‘અનુદાહરણ’ના બોર્ડ સામે પથ્થરનો ટુકડો મૂકે છે. વિદ્યાર્થીઓને કહે છે - “આ બંને કઈ રીતે સમાન છે અને કઈ રીતે ભિન્ન છે તે નક્કી કરો. સફરજન એ મારા મનમાં જે વિચાર છે તેના લક્ષણો ધરાવે છે.” અને પૂછે છે : “મારા મનમાં શો વિચાર છે તે નક્કી કરી શકો છો?” વિદ્યાર્થીઓ જણાવે છે, : “ખાવાની વસ્તુ, સજીવ વસ્તુ.” શિક્ષકે ‘ઉત્કલ્પના’ શીર્ષક નીચે વિદ્યાર્થીઓના જવાબ લખ્યા.

● ત્યારબાદ શિક્ષક ઉદાહરણ તરીકે ‘ચેરી’ અને અનુદાહરણ તરીકે ‘મૂળો’ મૂક્યાં. વિદ્યાર્થીઓએ ઉત્કલ્પના બદલીને કહ્યું ‘લાલ વસ્તુ’ ત્યારબાદ શિક્ષકે ઉદાહરણ તરીકે નારંગી, દાડમ, પપૈયું અને અનુદાહરણ તરીકે કોબીજ, બટેટું, ફલાવર મૂક્યાં. વિદ્યાર્થીઓએ ઉત્કલ્પનાને વધુ ચોક્કસ બનાવી : “બીજવાળી ખાવાની વસ્તુ.” વધુ કેટલાક ઉદાહરણો અને અનુદાહરણો બાદ વિદ્યાર્થીઓએ ‘ફળો’ એવી સંકલ્પના નક્કી કરી. ત્યારબાદ શિક્ષકે વિદ્યાર્થીઓને વ્યાખ્યા આપવા જણાવ્યું. ચર્ચાને અંતે વિદ્યાર્થીઓ તારવી શક્યા કે “ફળ એટલે છોડ કે વૃક્ષ પર ફૂલમાંથી વિકાસ પામેલો ખાઈ શકાય તેવો ભાગ.”

● સોપાન-2 : સંકલ્પના-પ્રાપ્તિની ચકાસણી :

● વિદ્યાર્થીઓની સંકલ્પનાની પ્રાપ્તિની ચકાસણી માટે તેઓને ઉદાહરણો કે અનુદાહરણો પહેલેથી જણાવ્યા વગર આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને તે ઉદાહરણ છે કે અનુદાહરણ છે તે નક્કી કરવાનું કહેવામાં આવે છે. ઉપરાંત વિદ્યાર્થીઓને તેઓના અનુભવોમાંથી તે સંકલ્પનાનાં ઉદાહરણો અને અનુદાહરણો આપવાનું કહેવામાં આવે છે. શિક્ષક ઉત્કલ્પનાને માન્ય કરે છે, સંકલ્પનાનું નામ આપે છે અને આવશ્યક લક્ષણોના આધારે સંકલ્પનાની અંતિમ વ્યાખ્યા નોંધે છે.



● સોપાન-૩ : વિદ્યાર્થીઓની વિચાર - યોજનાઓનું પૃથક્કરણ :

● અહીં વિદ્યાર્થીઓ તેઓએ સંકલ્પના મેળવવા કઈ વિચાર - યોજનાઓનો ઉપયોગ કર્યો તેના પર વિચાર કરે છે. અહીં વિદ્યાર્થીઓ તેઓની વિચાર-તરેહ જણાવી શકે છે. તેઓએ વિચારવાની શરૂઆત ખ્યાલથી કરી કે આવશ્યક લક્ષણોથી ? તેમની ઉત્કલ્પનાનો સ્વીકાર ન થયો ત્યારે શું કર્યું ? તેમણે વિચાર યોજના બદલી ? આ રીતે વિચારવાથી સંકલ્પના-પ્રાપ્તિ માટે અસરકારક વિચાર યોજના પર પ્રભુત્વ મેળવી શકે.

● શિક્ષકની ભૂમિકા :

● શિક્ષકે કાર્યની શરૂઆત ઉદાહરણો અને અનુદાહરણો રજૂ કરીને કરવાની છે. આ માહિતી તેણે ખૂબ જ સુઆયોજિત કરવી જોઈએ. ત્યારબાદ તે વધારાની માહિતી આપે છે. આમ, શિક્ષકની ભૂમિકા માહિતી નોંધવાની અને વિદ્યાર્થીઓના જવાબોનું સુપરવિઝન કરવાની છે, જેથી વિદ્યાર્થીઓના મનમાં સંકલ્પના સ્પષ્ટ થાય.

● સામાજિક તંત્ર :

● આ મોડલમાં શિક્ષક માહિતીની રજૂઆતના ક્રમનું નિયંત્રણ કરે છે, પરંતુ અંતભાગમાં વિદ્યાર્થીઓ - શિક્ષક વચ્ચે ચર્ચા થાય છે. વિદ્યાર્થીઓની આંતરક્રિયાને પ્રોત્સાહન આપવામાં આવે છે. આમ, અહીં વર્ગનું પર્યાવરણ પ્રમાણમાં માળખાગત છે, પરંતુ વિદ્યાર્થીઓને આગમનાત્મક પ્રક્રિયા માટે વધુ તક મળે છે.

● પ્રતિચાર - નિયમો :

● શિક્ષકે વિદ્યાર્થીઓના પ્રતિચારોનો જવાબ આપવામાં નીચેના નિયમો અનુસરવાના છે :

- (1) ઉત્કલ્પનાને ચકાસતી ચર્ચા પર ભાર આપો. માત્ર તેના જવાબને ટેકો આપવાનું જ કામ ન કરશો.
- (2) વિદ્યાર્થીઓ એકથી વધુ ઉત્કલ્પનાઓ રજૂ કરે ત્યારે સંતુલિત કરવામાં મદદ કરો.
- (3) ઉદાહરણોનાં ખાસ લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરાવો.
- (4) વિદ્યાર્થીઓને તેઓની વિચાર-યોજનાઓની ચર્ચા કરવામાં અને મૂલવવામાં મદદ કરો.

● આધારતંત્ર :

આ પ્રતિમાનનો અમલ કરવા માટે શિક્ષક પાસે આટલું જરૂરી છે.

સંકલ્પનાને અનુરૂપ કાળજીપૂર્વક પસંદ કરેલ અને યોગ્ય ક્રમમાં ગોઠવેલ ઉદાહરણો અને અનુદાહરણો.

● તમારી પ્રગતિ ચકાસો :

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી જગ્યામાં જ લખો.

1. અધ્યાપન પ્રતિમાનની વ્યાખ્યા જણાવો.

.....

.....

.....

.....

.....

.....

.....

2. સંકલ્પના પ્રાપ્તિ અધ્યાપન પ્રતિમાન એટલે શું ?

.....

.....

.....  
.....  
.....  
.....

### 3. સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનના સોપાનો જણાવો.

.....  
.....  
.....  
.....  
.....

## 12.5 પૂછપરછ તાલીમ પ્રતિમાન :

### 12.5.1 પ્રસ્તાવના :

આ પ્રતિમાનના પ્રણેતા રિચર્ડ સચમેન (1962) છે. આ પ્રતિમાનમાં વિદ્યાર્થીઓ સામે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે કે જેમાં તેઓ વિદ્વતાપૂર્ણ રીતે પૂછપરછ કરવાનું પ્રશિક્ષણ મેળવી શકે. તે માટે એવું સંપૂર્ણ વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે પ્રશ્નો પૂછીને પૂછપરછ કરવા માટે પ્રેરિત થાય.

આ પ્રતિમાન એવી ધારણા પર આધારિત છે કે બાળકો જિજ્ઞાસુ હોય છે અને તેઓ નવી નવી બાબતો વિશે વિશેષ માહિતી મેળવવાનો કુદરતી સ્વભાવ ધરાવતા હોય છે. તેથી જ તેઓ આપણી સામે અમુક બાબતો વિશે ખૂબ જ પ્રશ્નો પૂછતા હોય છે. જો તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવે તો તેમના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. અને તેઓ વધુ પ્રશ્નો પૂછવા માટે પ્રેરિત થાય છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને જ તેમને પદ્ધતિસર અને શિસ્તબદ્ધ રીતે પ્રશ્નો પૂછવાની તાલીમ આપવા માટે આ પ્રતિમાનનો વિકાસ કરવામાં આવ્યો છે. આ પ્રતિમાનની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.

### 12.5.2 પૂછપરછ તાલીમ પ્રતિમાનની લાક્ષણિકતાઓ :

- તે વિદ્યાર્થીઓના માનસિક કૌશલ્યોનો વિકાસ કરે છે.
- તે કોઈપણ બાબતનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે.
- તે વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો પૂછવાની પ્રવૃત્તિનું નિર્માણ કરે છે.
- તે વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિને પોષે છે, જાગૃત કરે છે અને સંતોષે છે.
- આ પ્રતિમાનનો ઉપયોગ ગમે તે ધોરણના વિદ્યાર્થીઓ માટે કરી શકાય છે.

### 12.5.3 પૂછપરછ તાલીમ પ્રતિમાનનાં હેતુઓ :

- વિદ્યાર્થીઓમાં સ્વતંત્ર રીતે તાર્કિક અને ક્રમબદ્ધ પ્રશ્નો પૂછવાનું કૌશલ્ય કેળવવું.
- વિદ્યાર્થીઓ સમસ્યા સાથે સંબંધિત જરૂરી માહિતી એકત્ર કરી તેનું પૃથક્કરણ કરી શકે તેવી ક્ષમતા વિકસાવવી.
- કોઈ પણ બાબત કે ઘટનામાં રહેલો કાર્યકારણનો સંબંધ શોધવા માટે જરૂરી બૌદ્ધિક વ્યૂહ રચના વિકસાવવી.
- વિદ્યાર્થીઓમાં વિવિધ ચલો વચ્ચે રહેલા સંબંધો શોધી તે દ્વારા ઉત્કલ્પના બાંધી શકે તેવી ક્ષમતાઓ વિકસાવવી.

#### 12.5.4 પૂછપરછ તાલીમ પ્રતિમાનના સોપાનો :

આ પ્રતિમાનના મુખ્ય તત્ત્વો (1) કેન્દ્રબિંદુ (2) સંરચના (3) સામાજિક પ્રણાલી અને (4) મૂલ્યાંકન છે.

##### (1) કેન્દ્રબિંદુ :

- આ પ્રતિમાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષીને તેમને કોઈ પણ ઘટના, ખ્યાલ કે વસ્તુ વિશે વિશેષ સમજ મેળવવા માટે પ્રેરિત કરવાનો છે. આ ઘટના, ખ્યાલ કે વસ્તુ તેમના માટે સમસ્યાત્મક હોઈ શકે છે. આવી સ્પષ્ટ સમજ મેળવવા માટે તેમણે માનસિક પ્રક્રિયાઓ કરવી પડે છે. જે તેમના માનસિક કૌશલ્યોનો વિકાસ કરે છે.
- આમ, આ પ્રતિમાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના જ્ઞાનાત્મક પાસાંઓનો વિકાસ કરવાનો છે. તેમાં પણ તેમના પ્રશ્ન પૂછવાના કૌશલ્યોનો વિકાસ કરવા પર આ પ્રતિમાન વિશેષ ભાર મૂકે છે. આ પ્રતિમાન વિદ્યાર્થીઓને સત્ય શોધક બનાવે છે. આ પ્રતિમાન વિદ્યાર્થીઓને કોઈપણ ઘટના, વસ્તુ કે ખ્યાલ સાથે સંકળાયેલાં વિવિધ ઘટકો વિશે પ્રશ્નો પૂછીને આ દરેક ઘટકોની વચ્ચેનો આંતરસંબંધ શોધવા માટેની તાલીમ આપે છે.
- આમ કરવાથી તેઓ તે ખ્યાલ, વસ્તુ કે ઘટનાનું સંપૂર્ણ વિશ્લેષણ કરી શકે છે. આ રીતે વિદ્યાર્થીઓ જે તે ઘટના, ખ્યાલ કે વસ્તુ વિશે તેમને નહીં સમજાયેલી અથવા ખૂટતી વિગતો શોધી કાઢવાનો પ્રયત્ન કરે છે.

##### (2) સંરચના :

પૂછપરછ તાલીમ પ્રતિમાનની સંરચનામાં નીચે જણાવેલ સોપાનોનો સમાવેશ થાય છે.

- (a) સમસ્યાની રજૂઆત કરવી
- (b) પ્રાયોગિક કાર્ય
- (c) કાર્યકારણ સંબંધની સ્થાપના
- (d) માહિતીનું સંગઠન
- (e) પૂછપરછ પ્રક્રિયાનું વિશ્લેષણ

##### [a] સમસ્યાની રજૂઆત કરવી :

સર્વપ્રથમ વિદ્યાર્થીઓ પોતે અથવા શિક્ષકની મદદથી સમસ્યાની પસંદગી કરે છે. અમુક સંજોગોમાં શિક્ષક પણ તેમની સામે સમસ્યાની રજૂઆત કરીને તેમને તેનો ઉકેલ લાવવા માટે પ્રેરિત કરી શકે છે.

##### [b] પ્રાયોગિક કાર્ય :

- વિદ્યાર્થીઓ તેમની સામે રજૂ કરવામાં આવેલી સમસ્યાનાં સંદર્ભમાં શિક્ષકને પ્રશ્નો પૂછે છે. વિદ્યાર્થીઓને મુક્તમને પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવે છે. શિક્ષક તેમના પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપવાનો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થીઓ એક બીજા સાથે પણ ચર્ચા કરી શકે છે. વિદ્યાર્થીઓ આ રીતે ચર્ચા કરીને ઉકેલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે.
- અહીં તેઓ શિસ્તબદ્ધ રીતે વર્તે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. શિક્ષક વિદ્યાર્થીઓને ઉકેલ બતાવતા નથી પરંતુ ઉકેલ સુધી પહોંચવા માટે જે બાબતની સ્પષ્ટતા જરૂરી હોય તેના સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નોના જ જવાબો આપે છે. શિક્ષક મોટાભાગે એવા પ્રશ્નોના જવાબ આપે છે જેમના જવાબ ‘હા’ અથવા ‘ના’માં આવી શકે.

##### [c] કાર્યકારણ સંબંધની સ્થાપના :

વિદ્યાર્થીઓ તેમની સામે રજૂ કરવામાં આવેલી સમસ્યાનાં સંદર્ભમાં શિક્ષકને જે પ્રશ્નો પૂછે છે અથવા એકબીજા સાથે જે ચર્ચા કરે છે તેના આધારે તે ઉકેલ સુધી પહોંચવા માટે સમસ્યા સાથે સંકળાયેલાં વિવિધ ઘટકો વિશે પ્રદત્ત ભેગા કરે છે. આ રીતે મળતાં પ્રદત્તને (Data) આધારે વિવિધ ઘટકો વચ્ચે કાર્ય કારણનો સંબંધ સ્થાપિત કરે છે. તે માટે તેઓ માનસિક રીતે ઉત્કલ્પનાઓની રચના કરે છે. એટલે કે તે ‘જો’... ‘તો’ જેવા તાર્કિક વિચારો કરીને જુદા જુદા ઘટકો વચ્ચે સંબંધ સ્થાપિત કરે છે.

**[d] માહિતીનું સંગઠન :**

સમસ્યાનાં જુદાં જુદાં ઘટકો વિશે પ્રદત્ત (Data) ભેગા કરીને અને તેના આધારે તાર્કિક રીતે વિચારો કરીને વિદ્યાર્થીઓ જુદા જુદા ઘટકો વિશે તથ્યો તારવે છે. આ તથ્યોને માહિતી કહે છે. હવે તેઓ આ રીતે મળેલી તમામ માહિતીને સુવ્યવસ્થિત અને ક્રમિક રીતે ગોઠવીને ઉકેલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. શિક્ષક તેમને આ કાર્યમાં મદદરૂપ માર્ગદર્શન આપે છે.

**[e] પૂછપરછ પ્રક્રિયાનું વિશ્લેષણ :**

છેલ્લે વિદ્યાર્થીઓને તેમણે કરેલી પૂછપરછ પ્રક્રિયાનું વિશ્લેષણ કરવાનું કહેવામાં આવે છે. તેમને જોઈતી બધી માહિતી તેમને મળી ગઈ છે કે નહીં તેની તપાસ કરવાનું તેમને કહેવામાં આવે છે. શિક્ષક પણ આ દરમિયાન સંપૂર્ણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરે છે.

**(3) સામાજિક પ્રણાલી :**

શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે ખુલ્લાં અને સહકારયુક્ત વાતાવરણનું નિર્માણ કરવામાં આવે છે. શિક્ષક વિદ્યાર્થીઓને નેતૃત્વ પૂરું પાડે છે. તે વિદ્યાર્થીઓને પૂછપરછ માટે પ્રેરિત કરે છે.

**(4) મૂલ્યાંકન :**

વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પ્રાયોગિક કસોટી દ્વારા થાય છે. આ કસોટી દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યા ઉકેલ માટેની માહિતી એકઠી કરવા માટેની ક્ષમતા અને સમસ્યા ઉકેલ માટેની ક્ષમતાની ચકાસણી કરવામાં આવે છે.

● **તમારી પ્રગતિ ચકાસો :**

નોંધ : તમારા ઉત્તરો નીચે આપેલી જગ્યામાં જ લખો.

**1. પૂછપરછ તાલીમ પ્રતિમાનની લાક્ષણિકતાઓ જણાવો.**

.....  
.....  
.....  
.....  
.....  
.....

**2. પૂછપરછ તાલીમ પ્રતિમાનના હેતુઓ કયા કયા છે ?**

.....  
.....  
.....  
.....  
.....

**3. પૂછપરછ તાલીમ પ્રતિમાનના સોપાનો જણાવો.**

.....  
.....  
.....  
.....  
.....

---

## 12.6 સારાંશ :

---

આ એકમમાં તમે વિજ્ઞાન વિષયના સંદર્ભમાં અધ્યાપન પ્રતિમાનનો અર્થ, વ્યાખ્યા, લક્ષણો, અધ્યાપન પદ્ધતિ અને અધ્યાપન પ્રતિમાન વચ્ચેનો તફાવત વિશે માહિતી મેળવી છે. તેમજ સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન અને પૂછપરછ તાલીમ પ્રતિમાન વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી છે. અધ્યાપન પ્રતિમાનનો શા માટે, ક્યારે, કઈ રીતે ઉપયોગ કરવો તેના માટે તમારે ચોક્કસ થવું જોઈએ. અધ્યાપનના હેતુઓ, સંસાધનો, અભ્યાસક્રમના વિષયવસ્તુના મુદ્દા અને વર્ગખંડની પરિસ્થિતિ દરેક બાબતને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય દ્વારા અધ્યાપન પ્રતિમાનની પસંદગી કરવી વધુ હિતાવહ છે. અધ્યાપન પ્રતિમાનનો ઉપયોગ કરતા પહેલા એક શિક્ષકે તેનો યોગ્ય મહાવરો કરી લેવો વધુ સલાહભર્યું છે. જેથી વિજ્ઞાનનું અસરકારક અને રસપ્રદ અધ્યાપનકાર્ય કરાવી શકાય અને તેના દ્વારા વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓની વિકાસ થાય અને વિવિધ ગુર્ણ-કૌશલ્યોનો પણ વિકાસ થાય.

---

## 12.7 સ્વાધ્યાય :

---

- (1) અધ્યાપન પ્રતિમાન એટલે શું ? તેની સંકલ્પના સ્પષ્ટ કરો.
  - (2) અધ્યાપન પ્રતિમાનની વ્યાખ્યા આપો.
  - (3) અધ્યાપન પ્રતિમાનનો અર્થ જણાવી તેની લાક્ષણિકતાઓની વિસ્તૃતમાં ચર્ચા કરો.
  - (4) પરંપરાગત અધ્યાપન પદ્ધતિ અને અધ્યાપન પ્રતિમાન વચ્ચેનો તફાવત જણાવો.
  - (5) અધ્યાપન પ્રતિમાનનું વર્ગીકરણ વર્ણવો.
  - (6) સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન એટલે શું ? તેની વ્યાખ્યા જણાવો.
  - (7) સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનનો અર્થ જણાવી તેની સંકલ્પના સ્પષ્ટ કરો.
  - (8) સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનના ધ્યેયો અને ધારણાઓ જણાવો.
  - (9) સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનની સોપાનોની વિસ્તૃતમાં ચર્ચા કરો.
  - (10) પૂછપરછ તાલીમ પ્રતિમાન એટલે શું ? તેની સંકલ્પના સ્પષ્ટ કરો.
  - (11) પૂછપરછ તાલીમ પ્રતિમાનની લાક્ષણિકતાઓ જણાવો.
  - (12) પૂછપરછ તાલીમ પ્રતિમાનના હેતુઓ કયા કયા છે ?
  - (13) પૂછપરછ તાલીમ પ્રતિમાનનાં સોપાનોની વિસ્તૃતમાં ચર્ચા કરો.
- 

## 12.8 સૂચિત સંદર્ભવાચન (Suggested Reading) :

---

- જોષી, હ.ઓ. અને અન્ય (2007-08). વિજ્ઞાન - અધ્યાપનનું પરિશીલન, અમદાવાદ : મેસર્સ બી.એસ. શાહ પ્રકાશન.
- રાવલ, એન.વી. અને અન્ય (2005). વિજ્ઞાનનું અભિનવ અધ્યાપન, અમદાવાદ : નીરવ પ્રકાશન.
- તલાટી, જે.કે. અને અન્ય (2011). વિજ્ઞાન અને ટેકનોલોજીનું અધ્યાપન, અમદાવાદ : અમોલ પ્રકાશન - વારિષેષ પ્રકાશન.
- રાવલ, એન.વી. અને અન્ય (2007). સિમ્યુલેશન : આદર્શ પાઠ આયોજન, અમદાવાદ : નીરવ પ્રકાશન.
- જાદવ, વી.બી. (2014-15). વિજ્ઞાન અને ટેકનોલોજીનું અધ્યાપન, આગરા : અગ્રવાલ પબ્લીકેશન્સ.
- શુક્લા, એસ.એસ. (2012-13). અધ્યાપન અને અધ્યયનના અધિનિયમો અને પ્રયુક્તિઓ, આગરા : અગ્રવાલ પબ્લીકેશન્સ.
- દોંગા, એન.એસ. (2012). અધ્યાપન મનોવિજ્ઞાનમાં નવી દિશાઓ : વિકાસ, શિક્ષણ પ્રક્રિયા અને માહિતી ટેકનોલોજી, રાજકોટ : નિજિજન સાયકો સેન્ટર.



डॉ. बाबासाहेब आंबेडकर  
ओपन युनिवर्सिटी

ES-111

विज्ञाननुं अध्यापन  
(Teaching of Science)

विभाग

4

विज्ञान शिक्षणमां मूल्यांकन, अनुबंध, निदान अने उपचार, शैक्षणिक  
साधनो अने क्रियात्मक संशोधन

---

अेकम-13 विज्ञान शिक्षणमां मूल्यांकन, प्रश्नपत्र संरचना अने अनुबंध

---

अेकम-14 विज्ञान शिक्षणमां निदानात्मक शिक्षण अने उपचारात्मक शिक्षण

---

अेकम-15 विज्ञान शिक्षणना अध्यापन माटे शैक्षणिक साधनो

---

अेकम-16 विज्ञान शिक्षणमां क्रियात्मक संशोधन

## ES-111, વિજ્ઞાનનું અધ્યાપન (વિભાગ-4)

<b>લેખક</b>	
ડૉ. રાજેશ રાઠોડ	આઈ. આઈ. ટી. ઈ., ગાંધીનગર.
<b>પરામર્શક (વિષય)</b>	
ડૉ. કેતન ગોહિલ	શ્રી સી. એચ. શાહ મૈત્રી વિદ્યાપીઠ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશન, સુરેન્દ્રનગર
<b>પરામર્શક (ભાષા)</b>	
કુ. ઉમા ઠક્કર	વિઝન કોલેજ ઓફ એજ્યુકેશન, અમદાવાદ.
<b>સંપાદન અને સંયોજન</b>	
પ્રો. (ડૉ.) અજીતસિંહ પી. રાણા	નિયામકશ્રી (શિક્ષણશાસ્ત્ર) ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. અમદાવાદ.
<b>સંયોજન સહાય</b>	
ડૉ. મીના આઈ. રાજપૂત	ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. અમદાવાદ.

પ્રકાશક : કુલસચિવ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ-382481

આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ-2020, નકલ : 600

દ્વિતીય આવૃત્તિ-2021, નકલ : 600

**ISBN : 978-93-5598-089-2**

Copyright © Registrar, Dr. Babasaheb Ambedkar Open University, Ahmedabad.  
December 2020

While all efforts have been made by editors to check accuracy of the content, the representation of facts, principles, descriptions and methods are that of the respective module writers. Views expressed in the publication are that of the authors, and do not necessarily reflect the views of Dr. Babasaheb Ambedkar Open University. All products and services mentioned are owned by their respective copyrights holders, and mere presentation in the publication does not mean endorsement by Dr. Babasaheb Ambedkar Open University. Every effort has been made to acknowledge and attribute all sources of information used in preparation of this Self Learning Material. Readers are requested to kindly notify missing attribution, if any.

---

## ES-III વિજ્ઞાનનું અધ્યાપન

---

### વિભાગ-1 વિજ્ઞાન શિક્ષણનું સ્વરૂપ, નુતન પ્રવાહો અને સહાયક પ્રવૃત્તિઓ

- એકમ-1 વિજ્ઞાન શિક્ષણ : ભૂમિકા
- એકમ-2 વિજ્ઞાન શિક્ષણમાં નુતન પ્રવાહો
- એકમ-3 વિજ્ઞાન શિક્ષણમાં સહાયક પ્રવૃત્તિઓ
- એકમ-4 વિજ્ઞાન શિક્ષણની પ્રયોગશાળા

### વિભાગ-2 વિજ્ઞાન શિક્ષણ અધ્યાપનનું આયોજન

- એકમ-5 માર્કેટીંગિંગ
- એકમ-6 સિમ્યુલેશન
- એકમ-7 ઉદ્દેશ્ય અને હેતુઓ
- એકમ-8 તાસ પાઠ / એકમ આયોજન

### વિભાગ-3 વિજ્ઞાન શિક્ષણની અધ્યાપન પદ્ધતિઓ, અભિગમો અને પ્રતિમાનો

- એકમ-9 વિજ્ઞાન શિક્ષણની અધ્યાપન પદ્ધતિઓ-1
- એકમ-10 વિજ્ઞાન શિક્ષણની અધ્યાપન પદ્ધતિઓ-2
- એકમ-11 વિજ્ઞાન શિક્ષણના અધ્યાપન અભિગમો
- એકમ-12 વિજ્ઞાન શિક્ષણના અધ્યાપન પ્રતિમાનો

### વિભાગ-4 વિજ્ઞાન શિક્ષણમાં મૂલ્યાંકન, અનુબંધ, નિદાન અને ઉપચાર, શૈક્ષણિક સાધનો અને ક્રિયાત્મક સંશોધન

- એકમ-13 વિજ્ઞાન શિક્ષણમાં મૂલ્યાંકન, પ્રશ્નપત્ર સંરચના અને અનુબંધ
- એકમ-14 વિજ્ઞાન શિક્ષણમાં નિદાનાત્મક મૂલ્યાંકન અને ઉપચારાત્મક શિક્ષણ
- એકમ-15 વિજ્ઞાન શિક્ષણના અધ્યાપન માટે શૈક્ષણિક સાધનો
- એકમ-16 વિજ્ઞાન શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધન



## દૂરવર્તી અધ્યયનમાં સ્વ-અધ્યયન અભ્યાસ-સામગ્રીની ભૂમિકા

દૂરવર્તી શિક્ષણ પ્રણાલીમાં અસરકારક સ્વ-અધ્યયન અભ્યાસ-સામગ્રી અનિવાર્ય છે. આ અભ્યાસ-સામગ્રીના લેખકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ એકબીજાથી ઘણાં દૂર અને ક્યારેક તો ક્યારેય ન મળી શકે તેવી સ્થિતિમાં હોવાથી આવી અધ્યયન સામગ્રી સુગમ અને અસરકારક હોવી જરૂરી છે. દૂરવર્તી શિક્ષણ માટેની અભ્યાસ-સામગ્રીમાં વિદ્યાર્થીના બૌદ્ધિક ચિંતનને ઉદ્દીપ્ત કરવાની ક્ષમતા તથા આવશ્યક તમામ અધ્યયન પ્રવૃત્તિઓ હોવી જોઈએ. આ સામગ્રી પાઠ્યક્રમના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓના અનુસંધાને વિદ્યાર્થીને પર્યાપ્ત માર્ગદર્શન આપવા સક્ષમ હોવી જોઈએ. સ્વ-અધ્યયન સામગ્રીમાં અભ્યાસક્રમમાં સૂચિત તમામ બાબતોનો સમાવેશ થાય તે જરૂરી છે.

અસરકારક અધ્યયન સિદ્ધ કરવા માટે અનેક પ્રકારના આયોજનનો ઉપયોગ કરવામાં આવે છે; જેનાથી વિદ્યાર્થી જ્ઞાનોપાર્જન કરી શકે. બૌદ્ધિક અને મનોશારીરિક કૌશલ્યો કેળવી શકે અને વર્તન તથા અભિગમમાં આવશ્યક પરિવર્તનો સાધી શકે. આથી જ વિદ્યાર્થીનું મૂલ્યાંકન પણ પાઠ્યસામગ્રીમાં આવરી લેવામાં આવ્યું છે.

દૂરવર્તી શિક્ષણની સ્વ-અધ્યયન અભ્યાસ સામગ્રીમાં ઉપયોગમાં લેવામાં આવેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સ્વરૂપ તે શિક્ષણના જ્ઞાનાત્મક, ભાવાત્મક કે મનોશારીરિક હેતુમાંથી કયા હેતુને સંલગ્ન છે? તેના પર આધારિત છે. આ હેતુઓ ભવિષ્યમાં અનુક્રમે જ્ઞાન, બૌદ્ધિક કૌશલ્યો અને મનોશારીરિક કૌશલ્યોની ઉપલબ્ધિમાં પરિણમે છે. વિદ્યાર્થીએ મેળવેલ જ્ઞાનની પ્રાપ્તિ, ઉપયોગ અને અભિવ્યક્તિ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય. વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનનો અને અનુભવોનો આધાર લઈને રચવામાં આવેલ શિક્ષણ સામગ્રી દ્વારા બૌદ્ધિક કૌશલ્યના હેતુને સિદ્ધ કરી શકાય છે અને તેના દ્વારા નવીન જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત થાય છે.

અભ્યાસ-સામગ્રીમાં સ્વાધ્યાય પ્રોજેક્ટ અને પ્રતિપૂષ્ટિ(Feedback)ના સ્વરૂપે અભ્યાસનું આયોજન જરૂરી છે. શારીરિક કૌશલ્ય સંબંધિત શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ચિત્રાત્મક રજૂઆત હોવી જોઈએ અને ત્યારબાદ ઉચિત અભ્યાસનું આયોજન હોવું જોઈએ. વર્તન અને અભિગમમાં પરિવર્તન માટે આયોજિત શિક્ષણ પ્રવૃત્તિઓ રસ જન્માવે તેવી તથા આ પરિવર્તન દ્વારા થતાં લાભ અને તેની જરૂરિયાતને પ્રતિબિંબિત કરે તેવી હોવી જોઈએ. ત્યાર પછી નવાં અભિગમોને અપનાવવાની અને તે સંબંધિત પ્રક્રિયાના યોગ્ય અભ્યાસનું ઉચિત આલેખન થવું જોઈએ.

## દૂરવર્તી શિક્ષણની ભૂમિકા.

પ્રત્યક્ષ અધ્યાપનમાં જોવા મળતી પ્રત્યાયનની વિશેષતાઓ; જેવી કે અંતરાલાપ, પૂર્વઅભિસંધાન, યોગ્ય સ્થાને વિરામ, આરોહ-અવરોહ, ભાવ-ભંગીમા, સ્વરભાર વગેરે દૂરવર્તી અધ્યયનમાં ઉપલબ્ધ નથી. આ ઉણપ વિશેષતઃ મુદ્રિત સાહિત્યમાં (લેખિત સાહિત્યમાં) જોવા મળે છે. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના વ્યવહારની આ ખૂટતી કડીને જોડવા માટે જ દૂરવર્તી સ્વ-અધ્યયન સામગ્રીમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. માટે જ આવી પ્રવૃત્તિઓનું આયોજન વૈકલ્પિક નહીં; પરંતુ અનિવાર્ય છે.

સ્વ-અધ્યયન અભ્યાસ-સામગ્રીને નાના એકમોમાં વિભાજિત કરીને શિક્ષણના ઉત્તમ સાધન તરીકે વિકસાવવાની સંકલ્પના છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વૈવિધ્ય દ્વારા શિક્ષણના વિવિધ ક્ષેત્રના હેતુઓ સિદ્ધ થાય તેવો પ્રયત્ન કરવાનો છે.

દૂરવર્તી શિક્ષણની સ્વ-અધ્યયન સામગ્રીનું આયોજન પૂર્વનિશ્ચિત, શૈક્ષણિક નીપજને ધ્યાનમાં લઈને કરવાનું હોવાથી તેના હેતુઓ અને ધ્યેયો નિશ્ચિત હોય છે. વળી અધ્યેતાઓ દૂરસ્થ હોવાથી આ સામગ્રી દ્વારા તેઓ નિશ્ચિત અધ્યયન પ્રવૃત્તિઓમાં સંલગ્ન રહે તેવું આયોજન કરવામાં આવે છે. જેથી અધ્યેતાઓ સંબંધિત સંકલ્પનાઓને બરાબર સમજી શકે. સ્વ-અધ્યયન સામગ્રીમાં સાથે સંકળાયેલ સ્વાધ્યાયો, પ્રાયોગિક કાર્યો, પ્રવૃત્તિઓ અને પ્રકલ્પોનો પણ આ જ હેતુ છે. આ સામગ્રી માટે ઉચિત શૈક્ષણિક પ્રવૃત્તિઓની ઉદાહરણરૂપ સૂચિ ઘણી મોટી હોઈ શકે. આ સંદર્ભે શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીને અભિપ્રેરિત કરે છે, માર્ગદર્શન આપે છે અને વિદ્યાર્થીની પ્રગતિ અને પ્રદર્શનનું સતત માપન-મૂલ્યાંકન પણ કરે છે.



: રૂપરેખા :

13.0 પ્રસ્તાવના

13.1 વિજ્ઞાન શિક્ષણમાં મૂલ્યાંકનનો અર્થ

13.2 વિજ્ઞાન શિક્ષણમાં મૂલ્યાંકનના પ્રકાર

13.3 વિજ્ઞાન શિક્ષણમાં મૂલ્યાંકનના પ્રશ્નના પ્રકાર અને ઉદાહરણ

13.4 ત્રિપરિમાણદર્શક સારણીના આધારે પ્રશ્નપત્ર

13.5 વિજ્ઞાન શિક્ષણનો અન્ય વિષય સાથે અનુબંધ

13.6 ઉપસંહાર

13.0 પ્રસ્તાવના :

શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. શૈક્ષણિક પ્રક્રિયામાં વિદ્યાર્થી અને શિક્ષકનો સંબંધ જેટલો મજબૂત બને તેટલું જ શિક્ષણ અસરકારક બની શકે.

21 મી સદીમાં નવા જ્ઞાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આ જ્ઞાન પ્રાથમિક તબક્કે માહિતીની વિસ્ફોટ સ્વરૂપે જોવા મળે છે. આધુનિક યુગમાં જ્ઞાનયુક્ત સમાજનો આર્વિભાવ થયો છે. વીજળી વેગે વધતા અને વારંવાર બદલાતા જતાં જ્ઞાન-વિજ્ઞાનમાંથી નવી સંકલ્પનાઓ, શબ્દાવલિનો, નવા ઉપકરણો, નવી વિચારસરણીઓ, નવી ડિઝાઈનો વગેરે ઉત્પન્ન થાય છે.

આપણાં વર્ગખંડમાં રહેલા બધાં બાળકો એકસરખા નથી હોતા વિચારવાની બાબતમાં, સમજવાની શક્તિમાં અને તર્ક કરવાની તેઓની ક્ષમતામાં ભિન્નતા જોવા મળે છે. આ દરેક લક્ષણોના કારણે જ તેમનો વિકાસ શક્ય બને છે. વિકાસને કદી ભિન્ન કે વિભાજિત કરી શકાતો નથી. પરંતુ વિકાસ સમગ્ર અને સતત થાય છે.

ઉપરોક્ત દરેક બાબતમાં સૌથી અગત્યની બાબત એ છે કે શૈક્ષણિક પ્રક્રિયાની અસરકારકતા નક્કી કેવી રીતે થાય ? તેના માટે ફક્ત એક જ મહત્વ પાસું છે મૂલ્યાંકન (Evaluation). પ્રવર્તમાન સમયની જરૂરિયાત પ્રમાણે વિદ્યાર્થીઓને સર્વગ્રાહી શિક્ષણ આપવું આવશ્યક બનતું જાય છે. અને આ શિક્ષણનું મૂલ્યાંકન પણ સર્વપક્ષીય થાય એ ઈચ્છનીય છે.

આમ, શિક્ષણ પ્રક્રિયાના મુખ્ય આધારસ્તંભોમાં મૂલ્યાંકન પણ એક અગત્યનો આધારસ્તંભ છે. જેની વિગતવાર ચર્ચા આપણે અહીં કરીશું.

13.1 વિજ્ઞાન શિક્ષણમાં મૂલ્યાંકનનો અર્થ :

સામાન્ય અર્થમાં મૂલ્યાંકન એટલે કોઈપણ વસ્તુના મૂલ્યનું માપન કરવું. પરંતુ શૈક્ષણિક મૂલ્યાંકનની વાત આવે છે ત્યારે વિદ્યાર્થીના સમગ્ર પાસાઓ જેવા કે બૌદ્ધિક વિકાસ, શારીરિક વિકાસ, સામાજિક વિકાસ, સાંવેગિક વિકાસ અને મૂલ્યોનું સિંચન થાય છે. આ પણ ખૂબ જ અગત્યનું છે.

મૂલ્યાંકન એ વિદ્યાર્થીની કેળવણી વિષયક પ્રગતિના પુરાવા પ્રાપ્ત કરવાની તથા તેની વિશ્લેષણ તેમજ અર્થઘટન કરવાની પ્રક્રિયા છે. મૂલ્યાંકનને આધારે ઘણાં બધા મહત્વના નિર્ણયો લેવાય છે જેવા કે વિદ્યાર્થીઓને યથાર્થ માર્ગદર્શન આપવું. વિષય-સંદર્ભે વિદ્યાર્થીઓની ક્યાશ દૂર કરવી, શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન આપવું, ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ આપવો વગેરે.

મૂલ્યાંકન એ શિક્ષણના સામાન્ય ઉદ્દેશોની સિદ્ધિ માટે કરવામાં આવે છે. મૂલ્યાંકનમાં વિદ્યાર્થીના વર્ગબદ્ધતીના ઉદ્દેશની સાથે સાથે વિદ્યાર્થીની શીખવાની ગતિ, સંકલ્પનાઓની સમજ, જ્ઞાનવૃદ્ધિ, કૌશલ્ય વિકાસ, વ્યવહાર કુશળતા વગેરે જેવી બાબતો સમાવિષ્ટ છે.

મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે. જેમાં વિદ્યાર્થીના વિકાસ સાથે સંકળાયેલ તમામ પાસાનો અભ્યાસ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની વિવિધ પ્રવૃત્તિઓમાં રસની બાબતથી શરૂ કરીને વર્ગમાં થતી અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં વિદ્યાર્થીની સહભાગીતા સુધીની દરેક બાબતનો મૂલ્યાંકનમાં સમાવેશ કરવો જરૂરી છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (1986) માં દર્શાવ્યા પ્રમાણે, “મૂલ્યાંકન એ સતત અને સર્વગ્રાહી પ્રક્રિયા છે. મૂલ્યાંકન એ વિદ્યાર્થીની સફળતા કે નિષ્ફળતા માટેનું પ્રમાણપત્ર નથી પણ તેની આવડત કે કૌશલ્યને યોગ્ય દિશામાં આગળ ધપાવવા માટે છે.”

અત્યાર સુધી મૂલ્યાંકન માત્ર ઔપચારિક લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવતું હતું પણ હવે મૂલ્યાંકન સાધનો તરીકે વિવિધ લેખિત, મૌખિક અને ક્રિયાત્મક કસોટીઓ, અવલોકન, નોંધપોથી, ઓળખયાદી, ક્રમમાપદંડો. તેમજ સ્થાનિક સંદર્ભનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

ટૂંકમાં મૂલ્યાંકન એ ....

- કેળવણી સંદર્ભે વિશ્લેષણ અને અર્થઘટન કરવાની પ્રક્રિયા છે.
- વિદ્યાર્થીઓને મહત્તમ પ્રગતિ કરતા રહેવા માટેની પ્રેરણા આપે છે.
- શિક્ષણ પ્રવિધિઓ, પદ્ધતિઓ, અભ્યાસક્રમો અને પાઠ્યપુસ્તકો સુધારણા માટેનો અંગુલિનિર્દેશ કરે છે.
- બહુઆયામી પ્રક્રિયા છે.
- સમયાંતરે નિયમિત રીતે થતી શૈક્ષણિક તપાસની પ્રક્રિયા છે.
- અધ્યયન - અધ્યાપન સુધાર અને ગુણવત્તા વૃદ્ધિ અર્થે હાથ ધરાતી તાર્કિક પ્રક્રિયા છે.
- વિવિધ કૌશલ્યોના વિકાસનું માપ આંકવા માટેની પ્રક્રિયા છે.
- બાળકના વ્યક્તિત્વના સમગ્ર પાસાઓની જાણકારી મેળવવા માટેની સચોટ પ્રક્રિયા છે.
- શિક્ષક દ્વારા અધ્યયન - અધ્યાપનમાં નાવીન્ય અને સર્જનાત્મકતા લાવવા માટેની પ્રક્રિયા છે.
- બાળકના વિકાસ સંદર્ભે વધુ સાતત્યપૂર્ણ અને સમગ્રતાલક્ષી પ્રક્રિયા છે.
- શિક્ષક માટે સ્વ-વિકાસને ઉત્તેજન આવતી પ્રક્રિયા છે.

### 13.2 વિજ્ઞાન શિક્ષણમાં મૂલ્યાંકનના પ્રકાર :

મૂલ્યાંકન એ બહુઆયામી અને સતત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણના હેતુઓને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકનના વિવિધ પ્રકાર પાડવામાં આવે છે. જે નીચે મુજબ છે.

(1) સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન સમયાવધિને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકનના પ્રકાર

- (1) રચનાત્મક મૂલ્યાંકન (Formative Evaluation)
- (2) મધ્ય ગાળાનું મૂલ્યાંકન (Mid - term Evaluation)
- (3) સંક્ષિપ્ત / અંતિમ મૂલ્યાંકન (Summative Evaluation)
- (4) અમલ - બાદનું મૂલ્યાંકન (Ex post Evaluation)
- (5) સમીક્ષા મૂલ્યાંકન (Meta Review Evaluation)

ઉપરોક્ત પાંચેય પ્રકારના મૂલ્યાંકનની ટૂંકી સમજ નીચે મુજબ આપી શકાય છે.

#### (1) રચનાત્મક મૂલ્યાંકન (Formative Evaluation)

અહીં અભ્યાસ કરાવતા વિષયોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમાં શરૂઆતની સ્થિતિએ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન હાથ ધરી જે તે વિષયવસ્તુના સંદર્ભમાં માહિતી મેળવવામાં આવે છે. આ મૂલ્યાંકનને વિધાયક (આંતરિક) મૂલ્યાંકન તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં શીખનાર વિદ્યાર્થીઓની કુશળતા અને જ્ઞાનનો પ્રાથમિક અંદાજ મેળવવામાં આવે છે.

## (2) મધ્યગાળાનું મૂલ્યાંકન (Mid term Evaluation)

સામાન્ય રીતે વર્ષની મધ્યમાં કે અધ્યાપન દરમિયાન કરવામાં આવતું મૂલ્યાંકન છે. તેને મધ્યકાલીન મૂલ્યાંકન પણ કહેવામાં આવે છે. માસિક પરિક્ષાઓ કે ત્રિ-માસિક પરીક્ષાઓ આ પ્રકારના મૂલ્યાંકનનું ઉદાહરણ છે.

## (3) સંક્ષિપ્ત / અંતિમ મૂલ્યાંકન (Summative Evaluation)

શિક્ષક દ્વારા અભ્યાસક્રમ પૂર્ણ થવાને સમયે કરવામાં આવતું મૂલ્યાંકન છે. જેમાં વાર્ષિક પરીક્ષાનો સમાવેશ થાય છે. પ્રવર્તમાન પદ્ધતિ પ્રમાણે સત્રને અંતે લેવાતી સત્રાંત પરીક્ષાઓ એ સંક્ષિપ્ત મૂલ્યાંકનનું ઉદાહરણ છે.

## (4) અમલ-બાદનું મૂલ્યાંકન (Ex-post Evaluation)

આ મૂલ્યાંકનને સારાંશ મૂલ્યાંકન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મૂલ્યાંકનને અમલીકરણ બાદ થતું મૂલ્યાંકન પણ કહેવાય છે. વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રોજેક્ટના અંતે હાથ ધરવામાં આવતું મૂલ્યાંકન છે.

## (5) સમીક્ષા મૂલ્યાંકન (Meta - Review Evaluation)

સામાન્ય રીતે વિવિધ સંસ્થાઓ દ્વારા આ પ્રકારનું સમીક્ષાત્મક મૂલ્યાંકન કરાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ તેમજ શાળાકીય બાબતોનું મૂલ્યાંકન કરી સમીક્ષાત્મક પરિણામ રજૂ કરવામાં આવે છે. ઘણી વખત બાહ્ય મૂલ્યાંકનકારની ટીમ દ્વારા આ પ્રકારનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે.

(2) SCE (School Based Comprehensive Evaluation) દ્વારા સૂચવાયેલ મૂલ્યાંકનના પ્રકાર શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન બે પ્રકારે થઈ શકે છે.


(1) શૈક્ષણિક મૂલ્યાંકન (Educational Evaluation)

(2) સહ-શૈક્ષણિક મૂલ્યાંકન (Co - Educational Evaluation)

## (1) શૈક્ષણિક મૂલ્યાંકન (Educational Evaluation)

શાળા કક્ષાએ વિવિધ ધોરણોમાં ભણાવવામાં આવતાં વિષયોની અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcome) કેટલે અંશે સિદ્ધ થઈ છે તે જાણવાની પ્રક્રિયા એટલે શૈક્ષણિક મૂલ્યાંકન

શૈક્ષણિક મૂલ્યાંકનમાં પ્રોજેક્ટવર્ક, પ્રાયોગિક કાર્ય, મૌખિક કાર્ય, સ્વઅધ્યયન કાર્ય વગેરે દ્વારા મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે જે ત્રણ પેટા પ્રકારે હાથ ધરવામાં આવે છે.



(સંદર્ભ : GCERT દ્વારા રચાયેલ SCE મોડ્યુલ, પૃ.ક. 1 અને 2)

## (2) સહ-શૈક્ષણિક મૂલ્યાંકન (Co-Educational Evaluation)

બાળકના માનસિક વિકાસ ઉપરાંત શારીરિક, સામાજિક, ભાવાત્મક ક્ષેત્રોમાં થયેલા વિકાસને સહ-શૈક્ષણિક મૂલ્યાંકનમાં સમાવિષ્ટ કરાયો છે. નીચેના ચાર ક્ષેત્રોમાં સહ-શૈક્ષણિક મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે.

ક્ષેત્ર - 1 વ્યક્તિગત અને સામાજિક ગુણો

ક્ષેત્ર - 2 વિદ્યાર્થીઓના વલણો

ક્ષેત્ર - 3 વિદ્યાર્થીના રસના ક્ષેત્રો



(4) નિબંધ પ્રકારના / લાંબા પ્રશ્નો (EQ / LQ)

- ચર્ચા કરો. - કૂટ પ્રશ્નો
- મુદ્દાસર જવાબ લખો. - નિયમ સાબિત કરો.
- ટૂંકનોંધ લખો. - કાર્યપદ્ધતિ વર્ણવો
- પ્રયોગ વર્ણવો. - સિદ્ધાંતનું રૂપાંતર સમજાવો.
- નિયમ સમજાવો.
- તુલના કરો.
- નામનિર્દેશનવાળીએ આકૃતિ વિશે લખો.
- આકૃતિનું વર્ણન કરો.

આમ, વિવિધ પ્રકારના પ્રશ્નોની મદદથી મૂલ્યાંકન કસોટીની રચના દ્વારા અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાનું સંયોગ મૂલ્યાંકન હાથ ધરી શકાય છે. જેની મદદથી વિદ્યાર્થીઓની સિદ્ધિનું માપન શક્ય બને છે.

શાળામાં શીખવવામાં આવતા વિષયો અનુસંધાને વિદ્યાર્થીમાં જ્ઞાન, સમજ, ઉપયોગ અને કૌશલ્યનો વિકાસ થાય, તર્કશક્તિનો વિકાસ થાય, વિશ્લેષણાત્મક શક્તિ, સર્જનાત્મક શક્તિ ખીલે, અભિવ્યક્તિ કેળવાય અને દરેક બાબતની ચકાસણી થઈ શકે એવા પ્રશ્નોનો મૂલ્યાંકનમાં સમાવેશ કરવો આવશ્યક છે.

(બ) વિજ્ઞાન શિક્ષણમાં મૂલ્યાંકન પ્રશ્નોના ઉદાહરણો :

વિવિધ પ્રશ્ન પ્રકારના ઉદાહરણો નીચે મુજબ આપી શકાય.

(1) બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો (MCQ)

- એક જ શબ્દમાં જવાબ આપો.

(1) વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો વાયુ કયો છે ?

જ. નાઈટ્રોજન

સંજ્ઞા ઓળખો

(1) સોડિયમની સંજ્ઞા ઓળખો.

જ. Na

ચિહ્ન ઓળખો :

(1) વિજ્ઞાનમાં રાસાયણિક પ્રક્રિયામાં ગરમી દર્શાવવા કયું ચિહ્ન વપરાય છે ?

જ.  $\Delta$

જોડકાં જોડો :

- |                       |           |
|-----------------------|-----------|
| (અ)                   | (બ)       |
| (1) નાઈટ્રોજન         | (a) 21%   |
| (2) ઓક્સિજન           | (b) 75%   |
| (3) કાર્બન ડાયોક્સાઈડ | (c) 0.01% |
|                       | (d) 1%    |

જ. (1-b) , (2-a), (3-c)



(2) અતિટૂંક જવાબી પ્રશ્નો (VSQ)

ખાલી જગ્યા પૂરો.

(1) પૃથ્વી પણ પાણીના જથ્થો આશરે 97% છે.

વાક્યપૂર્તિ કરો.

(1) કેલ્શિયમ કાર્બોનેટને પાણી સાથે મિશ્ર કરતા....

જ. કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે.

ખરાં ખોટાં જણાવો.

(1) પૃથ્વી પર વરસાદ પડવા માટે બાષ્પીભવન ક્રિયા અગત્યની છે.

જ. ખરું અથવા ✓

મને ઓળખો.

(1) મારો વિદ્યુતભાર ઋણ છે.

જ. ઈલેક્ટ્રોન

(3) ટૂંક જવાબી પ્રશ્નો (SQ)

એક- બે વાક્યમાં ઉત્તર આપો.

પ્રશ્ન : સાદા ઉચ્ચાલનના ઉદાહરણો આપો.

વ્યાખ્યા આપો.

પ્રશ્ન : મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આપો.

તફાવત સમજાવો / લખો.

પ્રશ્ન : સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

વર્ગીકરણ કરો.

પ્રશ્ન : કુદરતી પદાર્થો અને કૃત્રિમ પદાર્થોમાં વર્ગીકરણ કરો.

ઉપયોગ લખો.

પ્રશ્ન : પવનચક્કી

સિદ્ધાંત જણાવો.

પ્રશ્ન : વિદ્યુત ચુંબકીય પ્રેરણાનો સિદ્ધાંત જણાવો.

(4) નિબંધ પ્રકારના / લાંબા પ્રશ્નો (EQ / LQ)

મુદાસર જવાબ લખો.

પ્રશ્ન : જલાવરણ વિશે મુદાસર નોંધ લખો.

પ્રયોગ વર્ણવો.

પ્રશ્ન : મીણબત્તીના દહનનો પ્રયોગ વર્ણવો.

- આકૃતિનું વર્ણન કરો.

પ્રશ્ન : માનવ હૃદયની નામનિર્દેશનવાળી આકૃતિનું વર્ણન કરો.

- કાર્યપદ્ધતિ વર્ણવો.

પ્રશ્ન : વિદ્યુત ઘંટડી કથા સિદ્ધાંત પર કાર્ય કરે છે તે સમજાવો.

- કૂટ પ્રશ્નો :

પ્રશ્ન : એક ગા.ડી 20 કિમી / કલાક અને બીજી ગાડી 40 કિમી / કલાકની ઝડપે ગતિ કરે છે તો બંને ગાડીને 100 કિમી અંતર કાપતા કેટલો સમય લાગશે ?

- નિયમ સમજાવો.

પ્રશ્ન : ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ ઉદાહરણ સહિત સમજાવો.

### 13.4 ત્રિપરિમાણદર્શક સારણીના આધારે પ્રશ્નપત્ર સંરચના :

વિજ્ઞાન શિક્ષણમાં મૂલ્યાંકન કરવા માટે વિષયવસ્તુ આધારિત કસોટીની રચના કરવી આવશ્યક છે. સામાન્ય રીતે મૂલ્યાંકન માટે બે પ્રકારની કસોટીઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમાં શિક્ષક રચિત કસોટી અને પ્રમાણિત કે મનોવૈજ્ઞાનિક કસોટીઓનો સમાવેશ કરવામાં આવે છે.

શિક્ષક વર્ગખંડ અધ્યાપન દરમિયાન વિદ્યાર્થીઓની પ્રગતિ જાણવા માટે સામાન્ય રીતે શિક્ષક રચિત કસોટીનો ઉપયોગ કરતો હોય છે. આ કસોટીને લક્ષ્ય કસોટી કે સિદ્ધિ કસોટી જેવા વિવિધ નામોથી પણ ઓળખવામાં આવે છે. આ કસોટીની રચના પૂર્વે તેની રચના માટે વિવિધ બાબતોની જાણકારી અનિવાર્ય છે. જેમાં કસોટી રચના માટે ત્રિપરિમાણદર્શક કોષ્ટક (Blue Print) ની રચના કરવી અનિવાર્ય છે. આ કોષ્ટકની રચના સામાન્ય રીતે ત્રણ તબક્કામાં કરવામાં આવે છે જે નીચે મુજબ છે.

- (1) હેતુઓ આધારિત ગુણભાર નક્કી કરવો
- (2) વિષયવસ્તુ આધારિત ગુણભાર નક્કી કરવો.
- (3) પ્રશ્નપ્રકાર આધારિત ગુણભાર નક્કી કરવો.
- (4) ત્રિપરિમાણદર્શકની કોષ્ટકની રચના કરવી.

અહીં આપણે એક ઉદાહરણ દ્વારા ત્રિપરિમાણદર્શક કોષ્ટકની રચના તબક્કાવાર કરીશું. જેમાં “પરમાણું બંધારણ અને આવર્તકોષ્ટક” એકમને ધ્યાને રાખી 60 ગુણની સિદ્ધિ કસોટીની રચના કરીશું.

#### (1) હેતુઓ આધારિત ગુણભાર નક્કી કરવો.

શિક્ષક દ્વારા શીખવાયેલ વિષયવસ્તુનું મૂળભૂત હેતુઓ અનુસાર વર્ગીકરણ કરી ગુણભાર નક્કી કરવામાં આવે છે. જેમાં જ્ઞાન, સમજ, ઉપયોગ અને કૌશલ્યના આધારે ગુણભાર નક્કી કરવામાં આવે છે. જેની વિગત નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે.

#### સારણી - 1

#### હેતુ આધારિત ગુણભાર

ક્રમ	હેતુ	ગુણ
1	જ્ઞાન	35
2	સમજ	15
3	ઉપયોગ	10
4	કૌશલ્ય	-
કુલ	-	60

#### (2) વિષયવસ્તુ આધારિત ગુણભાર નક્કી કરવો.

શિક્ષકે નક્કી કરેલ વિષયવસ્તુનું વર્ગીકરણ કરી મુદ્દાસર વર્ગીકરમ દ્વારા આ પ્રકારનો ગુણભાર નક્કી કરવામાં આવે છે જે નીચે મુજબ દર્શાવી શકાય.

સારણી - 2

વિષયવસ્તુ આધારિત ગુણભાર

ક્રમ	વિષયવસ્તુ	ગુણ
1	પરમાણુ બંધારણ	08
2	આવર્તકોષ્ટકની સમજ	07
3	s - વિભાગના તત્વો	13
4	p - વિભાગના તત્વો	14
5	d - વિભાગના તત્વો	10
6	f - વિભાગના તત્વો	08
કુલ		60

(3) પ્રશ્નપ્રકાર આધારિત ગુણભાર નક્કી કરવો.

ત્રીજા તબક્કામાં હેતુ અને વિષયવસ્તુ નિર્ધારણ પછી શિક્ષકે કયા પ્રકારના પ્રશ્નો પૂછે તે વિદ્યાર્થીઓની વયકક્ષા અનુસાર નક્કી કરવાનું હોય છે. જેમાં વિષયવસ્તુના મુદ્દાને અનુરૂપ જરૂરિયાત પ્રમાણે વિવિધ પ્રકારના પ્રશ્નોની પસંદગી કરવાની હોય છે. પ્રશ્ન પ્રકારની પસંદગી કર્યા બાદ તેનો ગુણભાર નક્કી કરવામાં આવે છે અહીં પ્રશ્ન પ્રકારને મુખ્યત્વે ત્રણ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જેમાં વસ્તુલક્ષી પ્રશ્નો (Objective), ટૂંકજવાબી પ્રશ્નો (Short Question) અને નિબંધ પ્રકારના પ્રશ્નો (Eassy Type Question) સમાવિષ્ટ છે.)

સારણી - 3

પ્રશ્નપ્રકાર આધારિત ગુણભાર

ક્રમ	પ્રશ્નપ્રકાર	ગુણ
1	વિકલ્પ આધારિત પ્રશ્નો	10
2	ખાલી જગ્યા પૂરો	10
3	એક શબ્દમાં જવાબ	08
4	જોડકાં જોડો	08
5	ઇલેક્ટ્રોનની સંખ્યા લખો	08
6	ઇલેક્ટ્રોન રચના જણાવો.	08
7	જોડકા બનાવો	08
કુલ		60

ત્રિપરિમાણદર્શક કોષ્ટકની રચના કરવી :

ઉપરોક્ત ત્રણેય સારણીને આધારે સમગ્ર ત્રિપરિમાણદર્શક કોષ્ટકની રચના કરવામાં આવે છે. આ કોષ્ટકમાં ત્રણ પ્રકારની સારણીઓને સંમિશ્રિત કરી ત્રિપરિમાણદર્શક કોષ્ટક તૈયાર કરવામાં આવે છે. જેમાં એક જ સાથે દરેક બાબતનો નિર્દેશ સાથે જ કરેલો હોય છે. આ ત્રિપરિમાણદર્શક કોષ્ટક નીચે મુજબ દર્શાવી શકાય. જે સારણી - 4 માં દર્શાવેલ છે.

સારણી - 4

ત્રિપરિમાણદર્શક કોષ્ટક

વિગત/હેતુઓ વિષયવસ્તુ	જ્ઞાન			સમજ			ઉપયોગ			કૌશલ્ય			કુલ			સમગ્ર	
	E	S	O	E	S	O	E	S	O	E	S	O	E	S	O	કુલ	
પરમાણુ બંધારણ	-	-	7 (7)	-	-	1 (1)	-	-	-	-	-	-	-	-	-	8 (8)	8(8)
આવર્ત કોષ્ટકની સમજ	-	-	5 (5)	-	-	2 (2)	-	-	-	-	-	-	-	-	-	7 (7)	7(7)
S - વિભાગના તત્વો	-	-	7 (7)	-	-	4 (4)	-	-	2 (2)	-	-	-	-	-	-	13 (13)	13(13)
p - વિભાગના તત્વો	-	-	9 (9)	-	-	3 (3)	-	-	2 (2)	-	-	-	-	-	-	14 (14)	14(14)
d - વિભાગના તત્વો	-	-	6 (6)	-	-	2 (2)	-	-	2 (2)	-	-	-	-	-	-	10 (10)	10(10)
f - વિભાગના તત્વો	-	-	6 (6)	-	-	2 (2)	-	-	8 (8)	-	-	-	-	-	-	8 (8)	8(8)
કુલ	-	-	40 (40)	-	-	12 (12)	-	-	8 (8)	-	-	-	-	-	-	60 (60)	60 (60)
સમગ્ર કુલ	40(40)			12(12)			8(8)			00/00			60(60)			60(60)	

નોંધ : કૌંસમાં દર્શાવેલ આંકડાઓ પ્રશ્નની સંખ્યા દર્શાવે છે.

E - નિબંધ પ્રકારના પ્રશ્નો, S - ટૂંકા પ્રશ્નો

O - વસ્તુલક્ષી પ્રશ્નો

### 13.5 વિજ્ઞાન શિક્ષણનો અન્ય વિષય સાથે અનુબંધ

તત્વજ્ઞાન એ સર્વ વિદ્યાશાખાઓની જનની છે મૂળભૂત રીતે જોઈએ તો કોઈ પણ વિદ્યાશાખા કે વિષય અન્ય વિષય કે વિદ્યાશાખાથી સ્વતંત્ર સંભવી શકે નહિ. આ કારણે દરેક વિષય અન્ય વિષય સાથે નિશ્ચિત પ્રકારનો સંબંધ ધરાવે છે. આથી એક વિષય ઊંડાણપૂર્વક શીખવા માટે અન્ય વિષયના પૂર્વજ્ઞાનની, સ્પષ્ટતાની અને સમજની અતિઆવશ્યકતા છે. વિષયોનો એકબીજા સાથેનો સહસંબંધ કે અનુબંધ સીધો અથવા તો અવલંબિત પણ હોય શકે છે.

જ્ઞાન એ અવિભાજ્ય અને અખંડ છે. શિક્ષણની પ્રક્રિયાને સરળ બનાવી શકાય એવા શુભ આશયથી અલગ અલગ વિષયો કે શાખાઓને વર્ગીકૃત કરવામાં આવી છે. આ શાખાઓ એકબીજા સાથે સંકળાયેલી જ છે. વિવિધ શાખાઓની પેટાશાખાઓ બનાવીને જ્ઞાનનું કૃત્રિમ રીતે વિભાજન કરવામાં આવ્યું છે.

શિક્ષણ એ સંકલનની પ્રક્રિયા છે જેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણની વિવિધ શાખાઓમાં અસ્તિત્વમાં રહેલા જ્ઞાનનું એકત્રીકરણ કરવાનો છે. શિક્ષણની આ ભિન્ન શાખાઓમાં અસ્તિત્વ ધરાવતા જ્ઞાનનું સુદૃઢીકરણ કરવા માટે દરેક વિષયોના શિક્ષકો વચ્ચે સહકાર અનિવાર્ય છે. તમામ વિષયના શિક્ષકોએ પોતાના વિષયના જ્ઞાનનો અન્ય વિષય સાથેનો સહસંબંધ કે અનુબંધ પ્રસ્થાપિત કરવા માટે ઈરાદાપૂર્વકના પ્રયાસો હાથ ધરવા જોઈએ, જેથી જે તે વિષયના શિક્ષણને ચિરસ્થાયી બનાવી શકાય. અહીં અનુબંધિત શિક્ષણની મદદથી વિદ્યાર્થીઓ એ પ્રાપ્ત કરેલ જ્ઞાન જીવનપર્યંત યાદ રાખી શકે અને તે જ્ઞાનનો ઉપયોગ વિદ્યાર્થીઓ પોતાની વ્યક્તિગત સમસ્યાઓ ઉકેલવા કરી શકે એ હેતુ ગર્ભિત છે.

વિજ્ઞાન વિષયને અલગતામાં શીખવી શકાય છે તેમ નથી. આથી, વિજ્ઞાનના અસરકારક શિક્ષણ માટે તેનો અન્ય વિષય સાથે તેમજ વિવિધ વિજ્ઞાનનો સ્વ સાથે અનુબંધ અતિ આવશ્યક છે. વિજ્ઞાનની તમામ શાખાઓ એકબીજા પર પરસ્પરાવલંબન ધરાવે છે. વિજ્ઞાનના વિવિધ તથ્યો, સિદ્ધાંતો અન્ય વિજ્ઞાનના વિષયો તેમજ અન્ય વિષયો માટે સર્વસામાન્ય છે. પરિણામે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર જેવા વિષયોને સંકલિત કરી જીઓ ફિઝિક્સ, ઈલેક્ટ્રોકેમિસ્ટ્રી, બાયોફિઝિક્સ, બાયોકેમિસ્ટ્રી જેવા અનુબંધિત વિષયો શીખવવામાં આવે છે. ભૌતિક વિજ્ઞાન અન્ય તમામ વિજ્ઞાનના વિષયો ... માટેના સાધનો પૂરા પાડે છે. રસાયણશાસ્ત્ર દરેક વિજ્ઞાન વિષયોની રાસાયણિક પ્રક્રિયાની સમજ પૂરી પાડે છે, જ્યારે જીવશાસ્ત્ર એ પાયાની બાબતોનું જ્ઞાન પૂરું પાડે છે. આમ, વિજ્ઞાનનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અનુબંધિત શિક્ષણ એ સરળ અને ઉત્કૃષ્ટ વિકલ્પ છે.

#### અનુબંધનો અર્થ :

અનુબંધ એટલે બે વિષયોને અભ્યાસક્રમ કોઈ કોઈ બાબતોમાં સામાન્ય હોય અને એકબીજાનો કાર્યપ્રદેશ થોડે ઘણે અંશે આવરી લેતો હોય. દરેક શિક્ષકે પોતાના વિષયના શિક્ષણમાં જ્યારે જે સમયે અન્ય વિષયની સહાયની જરૂર પડે ત્યારે તે અવશ્ય લેવી જોઈએ અને એજ રીતે પોતાના વિષયને પણ અન્ય વિષયો માટે ઉપયોગી બનાવવો જોઈએ. દરેક વિષયો સાથેનો અનુબંધ કુદરતી, સહજ, સરળ અને સાહજિક હોવો જોઈએ.

અનુબંધિત શિક્ષણ એટલે અભ્યાસક્રમમાં સમાવિષ્ટ વિષયવસ્તુનું શિક્ષણ વિવિધ વિષય કે ઉપશાખાઓ સાથે સંબંધિત કરી અખંડિત, સંકલિત અને સમન્વિત રીતે આપવામાં આવે વિષય શિક્ષણને અસરકારક બનાવવા વિષયવસ્તુને અન્ય વિષય કે પછી તે વિષયની શાખાઓ સથે જોડવાની ક્રિયાને અનુબંધ કહેવાય છે.

#### અનુબંધિત શિક્ષણના ફાયદાઓ :

- અનુબંધ દ્વારા શિક્ષણની મદદથી વિદ્યાર્થીઓ સર્વપક્ષીય વિકાસ કરી શકાય છે અને સાર્વત્રિક જ્ઞાન આપી શકાય છે.
- વિદ્યાર્થીઓ વિવિધ બાબતોનું વિશ્લેષણાત્મક પૃથક્કરણ કરવા માટે સક્ષમ બને છે.
- સામાન્યતઃ વિજ્ઞાનના દરેક વિષયો એકબીજાના પૂરક હોવાને કારણે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વકનું, સમજણપૂર્વકનું જ્ઞાન આપી વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકાય છે.
- વિજ્ઞાન વલણમાં વૃદ્ધિ કરી શકાય છે.
- વિજ્ઞાન ખૂબ જ જટિલ અને વિશાળ વ્યાપ ધરાવતો વિષય હોવાને લીધે વિદ્યાર્થીઓને આંતરિક અનુબંધની સમજ ઝડપથી આપી શકાય છે.
- વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક તથ્યો, સિદ્ધાંતો અને નિયમોથી વાકેફ કરાવી શકાય.
- એક વિષયનું જ્ઞાન આપતી વખતે શિક્ષક અનુબંધ દ્વારા તેના વિચારો, અને વાતચીતમાં અન્ય વિષયની વિભાવનાઓ અને ઉદાહરણો આવરી લઈને વિજ્ઞાન જેવા જટિલ વિષયનું શિક્ષણ સરળ બનાવી શકે છે.
- અનુબંધથી બાળકને વિષયપ્રત્યે રસ જાગે છે અને તેને વિષયના અભ્યાસ માટે પ્રેરિત કરી શકાય છે.
- જ્ઞાન ટૂંકડે ટૂંકડે મેળવાને બદલે સમગ્રતાપૂર્વક અખંડ અનુભવ મળે છે તેથી સમગ્ર ખ્યાલ સ્પષ્ટ કરી શિક્ષણમાં પ્રવાહિતા લાવી શકાય છે.
- અનુબંધથી બાળક વિષયના વાડામાંથી મુક્ત થઈ સમગ્રતા તરફ ગતિ કરે છે.
- અનુબંધની મદદથી શિક્ષણના સંક્રમણની તક વધે છે, ગોખણપટ્ટીની અસર દૂર કરી વિદ્યાર્થીઓને મુદ્દાની સંપૂર્ણ સમજ આપી શકાય છે.

#### વિજ્ઞાનનો અન્ય વિષયો સાથેનો અનુબંધ :

વિદ્યાર્થીઓ સરળતાથી વર્ગખંડ શિક્ષણ પ્રક્રિયામાં પ્રવૃત્ત થાય એ હેતુથી દરેક વિષયના શિક્ષકે અનુબંધ દ્વારા અધ્યયન-અધ્યાપન કરાવવું જોઈએ. વિજ્ઞાનનો અન્ય વિષયો સાથેનો અનુબંધ નીચે મુજબ વર્ણવી શકાય.

**(ક) વિજ્ઞાન વિષયનો ભાષા સાથે અનુબંધ :**

વિજ્ઞાન એક પ્રાયોગિક વિષય છે પરંતુ તે ખૂબ જ મહત્વનું છે કે વિજ્ઞાન શીખનારા મિત્રો તેમના શબ્દો અને વિચારોને સ્પષ્ટ અને સચોટ રીતે વ્યક્ત કરી શકે. આ હેતુ સિદ્ધિ અર્થે દરેક વિદ્યાર્થીઓને પૂરતું ભાષાજ્ઞાન હોય એ અનિવાર્ય છે.

સમૃદ્ધ ભાષા ભંગોળના કારણે વિદ્યાર્થીઓ વિજ્ઞાનના વિવિધ નિયમો, સિદ્ધાંતો સમજીને યોગ્ય રીતે રજૂ કરી શકે છે, વિવિધ વૈજ્ઞાનિક પ્રશ્નોના જવાબો આપી શકે છે.

**શિક્ષકની ભૂમિકા :**

આ બંને વિષયોના અનુબંધ માટે ભાષા શિક્ષક વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં વૈજ્ઞાનિક બનાવો વિશે, વૈજ્ઞાનિક કથાઓ વિશે લખવાનું કાર્ય આપી શકે. જ્યારે વિજ્ઞાન શિક્ષક વિદ્યાર્થીઓને નિબંધલેખન કાર્ય, વ્યાકરણ ભૂલોની નોંધ કરી તેમની ભાષા સુધારણા માટે કાર્ય કરી શકે. આમ, આ બંને વિષયો એકબીજા સાથે અનુબંધ દ્વારા ખૂબ જ અસરકારક રીતે શીખવી શકાય.

**(ખ) વિજ્ઞાન વિષયનો ગણિત સાથે અનુબંધ :**

આ બંને એકબીજાના પૂરક વિષયો છે જેનું સ્વતંત્ર અસ્તિત્વ મુશ્કેલ છે. મોટા ભાગના વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને નિયમો ગણિતીક સમીકરણોના સ્વરૂપમાં જ રજૂ કરી શકાય છે.

“ગણિતીક અભિવ્યક્તિઓ (Mathematics Expressions) અને નિયમોનો ઉપયોગ કર્યા વિના કોઈ પણ શિક્ષક અસરકારક રીતે વિજ્ઞાન શિક્ષણ આપી શકતો નથી.”

ગણિતની મદદથી વૈજ્ઞાનિક નિયમો અને સિદ્ધાંતોને સારી દિશા મળી છે, વધુ દૃઢ થયા છે. વિજ્ઞાનનો કોઈ પણ વિષય શરૂ કરતાં પહેલા જે - તે વિદ્યાર્થીઓનો ગણિતીક પાયો મજબૂત કરવો ખૂબ જ આવશ્યક છે. ગણિતને વિજ્ઞાન વિષયની એકમાત્ર ભાષા ગણવામાં આવે છે કારણકે ગણિત વિષયના પર્યાપ્ત જ્ઞાન વગર વિજ્ઞાનની વાસ્તવિક અને વ્યવહારૂ સમજ અશક્ય છે. ઘણાં ગણિતીક સાધનોની મદદથી વિજ્ઞાન શિક્ષણને અસરકારક બનાવી શકાય છે.

જ્યોતિષવિદ્યા વિજ્ઞાનની અદ્યતન શાખા છે. જેમાં વિવિધ ગણિતીક તર્કના આધારે ભવિષ્યવાણી કે આગાહી કરવામાં આવે છે. જેમાં ગ્રહોની ગતિ અને સ્થિતિ વિશેની સમજ આવી ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવામાં આવે છે.

**શિક્ષકનો ફાળો :**

વિજ્ઞાન શિક્ષકે ગણિતના વિવિધ ઉદાહરણોનો ઉપયોગ કરીને વિવિધ વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને વિભાવનાઓ સમજાવવી જોઈએ. જ્યારે ગણિત શિક્ષકે વિવિધ વૈજ્ઞાનિક નિયમોમાં ગણિતના વિશિષ્ટ ઉપયોગની માહિતી વિદ્યાર્થીઓને આપવી જોઈએ.

બંને વિષયના શિક્ષકોના ઈરાદાપૂર્વકના સહયોગ પ્રયત્નથી વિજ્ઞાન અને ગણિત વિષય વચ્ચેનો અનુબંધ પ્રસ્થાપિત કરી શકાય.

**(ગ) વિજ્ઞાન વિષયનો ઈતિહાસ સાથે અનુબંધ :**

વિજ્ઞાન અને ઈતિહાસ વચ્ચે અનુબંધ હોવો સર્વસામાન્ય બાબત છે કારણકે પહેલાના વિષયોનું સ્વરૂપ પ્રાકૃતિક છે. જ્યારે હવેના વિષયોનું સ્વરૂપ સૈદ્ધાંતિક છે. આથી, આ વિષયોને એકબીજા સાથે સાંકળવા શક્ય છે.

માનવ ઈતિહાસના જુદાં જુદાં સમયાનુસાર અનુભવોનું અધ્યયન કરાવવા માટે જીવિત પ્રમાણભૂત લોકોના ઉલ્લેખ કરીને ઈતિહાસ સાથે વિજ્ઞાનને અનુબંધિત કરી શકાય છે. આ જ્ઞાન સાથે

તેઓ ઈતિહાસની ઘટનાઓ દ્વારા વૈજ્ઞાનિક ખ્યાલોથી પરિચિત બનશે.

#### શિક્ષકનો ફાળો :

શિક્ષક વિશ્વના ઈતિહાસની મુખ્ય ઘટનાઓને વૈજ્ઞાનિક શોધો સાથે સાંકળી વિજ્ઞાનની સ્થિતિ વિશે અધ્યયન કરાવી શકે છે. શિક્ષક વિજ્ઞાનના ખ્યાલોની સમજ આપતી વખતે તે ખ્યાલ કે સિદ્ધાંતના પ્રસ્થાપન સમયને તેની સાથે સંકળાયેલ ઈતિહાસની વિસ્તૃત ચર્ચા કરી અનુબંધિત શિક્ષણ પૂરી પાડી શકાય છે.

#### (ઘ) વિજ્ઞાન વિષયનો ભૂગોળ સાથે અનુબંધ :

ભૂગોળમાં પૃથ્વીના વિવિધ ખ્યાલોની સમજ આપવામાં આવે છે. બ્રહ્માંડના વિવિધ ગ્રહો પર, પૃથ્વી પર કયા પ્રકારની જમીન છે, ખડકો જોવા મળે છે. કયા પ્રકારની જમીનમાં કયા પ્રકારના પાકનું વાવેતર કરી શકાય છે. આ દરેક બાબતો ભૂગોળ વિષયમાં આવરી લેવામાં આવે છે.

વિજ્ઞાનમાં ઉપરોક્ત બાબતો સાથે વાતાવરણ, જીવંત પ્રાણીઓના અસ્તિત્વની ચર્ચા કરવામાં આવે છે. વિવિધ પ્રદેશની આબોહવાની મનુષ્ય અને પૃથ્વી પર થતી અસરો તેમજ આગાહી વિજ્ઞાન દ્વારા કરી અર્થઘટન કરવામાં આવે છે. ભૌગોલિક વિજ્ઞાન જેવી એક અલાયદી શાખા પણ અસ્તિત્વમાં છે.

#### શિક્ષકનો ફાળો :

વિજ્ઞાન શિક્ષક ભૂગોળ સાથે વિવિધ મુદ્દાઓ સાંકળી તેની વિસ્તૃત ચર્ચા કરે તો બાળકોમાં ભૂગોળવિદ્યા તેમજ વિજ્ઞાન સંબંધિત સંકલ્પનાઓ શીખવાની પ્રેરણા પૂરી પાડી શકાય. બંને વિષયો એકબીજાને સહાયક હોવાથી વિજ્ઞાનને ભૂગોળ સાથે અનુબંધિત કરી શીખવવામાં આવે તો સમસ્યા નડશે નહિ.

#### (ચ) વિજ્ઞાન વિષયોનો સામાજિક વિજ્ઞાન સાથે અનુબંધ :

વિજ્ઞાન શિક્ષણની અસરથી વિદ્યાર્થીઓ અને લોકોના દૃષ્ટિકોણ અને તેમના પરિપ્રેક્ષ્યમાં વૈજ્ઞાનિકતા આવશે. પરિણામે જીવનમાં વિવિધ પ્રકારના પરિવર્તનો જોવા મળશે. વૈજ્ઞાનિક વિચારસરણી દ્વારા મનુષ્યોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો લાવી શકાય છે, વિદ્યાર્થીઓનો અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓની પકડમાંથી મુક્ત કરી શકાય છે.

વિદ્યાર્થીઓને જ્ઞાન થાય કે મનુષ્ય હોવાને નાતે તેમને ચોક્કસ અધિકારો છે. અને જો તેમના અધિકારો પર કોઈ તરાપ મારે તો તેમના વિરોધ દ્વારા આપણે પોતાના અધિકારો પ્રાપ્ત કરવાના છે. આપણા દેશમાં મોટાભાગની માનવશક્તિ કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલી છે. જે હવે અત્યંત વિકસિત ઉદ્યોગો સાથે આગળ વધી રહી છે. જેના કારણે વૈશ્વિક કક્ષાએ થનારી સ્પર્ધામાં ભાગ લેવા માટે આપણે બાળકોને તૈયાર કરી શકીએ છીએ.

#### શિક્ષકનો ફાળો :

વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ભલે બે ભિન્ન વિષયો હોય પણ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, અનુબંધિત છે. બંને શિક્ષક વિષયને સુસંગત પ્રસંગોના યોગ્ય અનુબંધ દ્વારા સામાજિક વિજ્ઞાન સાથે વિજ્ઞાનને સરળતાથી સાંકળીને અધ્યયન-અધ્યાપન કરાવી શકે છે.

#### (છ) વિજ્ઞાનનો કલા સાથે અનુબંધ :

વિજ્ઞાન અને કલા બંને વિષયો એકબીજાને સમૃદ્ધ બનાવવા મહત્વનો ફાળો આપી શકે છે. વૈજ્ઞાનિક વિકાસના કારણે તમામ પ્રકારની કલાઓ વિકસીને સમૃદ્ધ થઈ છે. કલા પરના સંપૂર્ણ નિયંત્રણ વિના, વિવિધ વૈજ્ઞાનિક તથ્યો અને સિદ્ધાંતોની માહિતી આપવી શક્ય નથી.

વિજ્ઞાન વ્યવહારૂ વિષય હોવાને કારણે વિજ્ઞાન શિક્ષકને વિષય ભણાવવા માટે વિવિધ ચાર્ટ્સ, મોડેલો, આકૃતિઓ અને ચિત્રોની જરૂરી હોવાથી કલાત્મક કુશળતા અતિ આવશ્યક છે.

વિજ્ઞાન શિક્ષક વિવિધ હસ્તકલાના પ્રયોગ દ્વારા પોતાના માર્ગદર્શનથી કે અન્ય તજજ્ઞના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરી કરાવી સ્વ-અધ્યયન કરાવી શકે છે.

વિદ્યાર્થીઓ સ્વયં વિવિધ ભાગોમાં મોડલોની ડીઝાઇન બનાવી તેને જોડી વૈજ્ઞાનિક ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રકલ્પો શાળા કક્ષાએ પૂર્ણ કરી શકે છે અને તેને લગતી વધુ માહિતી મેળવવા પ્રેરિત કરી શકાય છે.

### શિક્ષકોનો ફાળો :

એક કલા શિક્ષકને વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું સંપૂર્ણ જ્ઞાન હોવું અનિવાર્ય છે. એક કલાકારને પ્રકાશ અને છાયા, વસ્તુઓ અને પૃષ્ઠભૂમિને રંગીન કે આકર્ષક રાખવા માટે વિવિધ સિદ્ધાંતો જાણવા જરૂરી છે. આમ, વિજ્ઞાન અને કલાના વિષયોમાં કેટલાક સર્વ સામાન્ય લક્ષણો જોવા મળે છે જેનાથી તેઓ એકબીજા સાથે અસરકારક રીતે સહભાગી થઈ શકે છે.

### (ઝ) વિજ્ઞાન વિષયનો નાગરિક શાસ્ત્ર સાથે અનુબંધ :

વિજ્ઞાન અને નાગરિકશાસ્ત્રના અનુબંધિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્ર માટે કર્તવ્યનિષ્ઠા, પ્રામાણિક અને મૂલ્યવાન નાગરિકો બનાવવાનો છે. વિજ્ઞાનના અધ્યયન દ્વારા વિદ્યાર્થીઓ તેમના જીવનમાં વૈજ્ઞાનિક શોધોની ઉપયોગિતા સમજી શકે જેથી તેઓ વધુ સભાન અને જવાબદાર નાગરિક બને. વિદ્યાર્થીઓ સભાનતા અને જવાબદારીના ખ્યાલની સાથે રાષ્ટ્ર વિકસામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એ આવકાર્ય છે.

વૈજ્ઞાનિક તથ્યો દ્વારા વિદ્યાર્થીઓ પર્યાવરણ વિકાસ, સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ, પ્રદુષણ સંબંધિત બાબતો, ટ્રાફિક સમસ્યાઓ સંબંધિત બાબતો વિશે જાણતા થાય અને જાગૃત બની જવાબદાર નાગરિકો બને એ અપેક્ષિત છે.

### શિક્ષકોનો ફાળો :

વિજ્ઞાન શિક્ષક નાગરિકશાસ્ત્રના અનુબંધ દ્વારા સમગ્ર સમાજમાં અને રાષ્ટ્રમાં આદર્શ નાગરિક, જવાબદાર અને કર્તવ્યપરાયણ નાગરિકના સર્જનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એમ છે.

### 13.6 ઉપસંહાર :

આજ રીતે વિજ્ઞાનનો તેની આંતરિક શાખાઓ સાથેનો પણ અનુબંધ જરૂરી છે. જેમાં રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો એકબીજા સાથે અનુબંધ અતિ મહત્ત્વનો છે.

બધાં જ વિષયો બાળકોને જીવનોપયોગી જ્ઞાન પૂરું પાડવા માટે શીખવવામાં આવે છે. અનુબંધ દ્વારા વિવિધ વિષયો અને પેટા વિષયો વચ્ચે સેતુ પ્રસ્થાપિત કરી વિષયોનું અધ્યયન - અધ્યાપન કરાવવામાં આવે છે. અનુબંધિત શિક્ષણની મદદથી વિદ્યાર્થીઓની સમજ, યાદશક્તિ અને રૂચિને પ્રોત્સાહિત કરી શકાય છે. અનુબંધ દ્વારા વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ, તાર્કિક શક્તિ અને વિશ્લેષણાત્મક શક્તિનો વિકાસ કરી વિષય પ્રત્યેની અભિરૂચી વધારી શકાય છે અને જ્ઞાનને દીર્ઘાયુષ્ય બક્ષી શકાય છે.

આમ, જો વિજ્ઞાન શિક્ષક પોતાના અધ્યાપનકાર્ય દરમિયાન અભ્યાસક્રમના અન્ય વિષયો સાથે વિજ્ઞાનને અનુબંધિત કરશે અને શિક્ષણ આપશે તો તે વિજ્ઞાન વિષયને ન્યાયપૂર્ણ અને સંતોષકારક રીતે શીખવી વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિમાં ચોક્કસ વધારો કરી શકશે.



14.0 પ્રસ્તાવના

14.1 વિજ્ઞાન શિક્ષણમાં નિદાનાત્મક મૂલ્યાંકન

14.1.1 નિદાનાત્મક મૂલ્યાંકનનો અર્થ

14.1.2 નિદાનાત્મક મૂલ્યાંકનના લક્ષણો

14.1.3 નિદાનાત્મક મૂલ્યાંકનનું મહત્વ

14.2 વિજ્ઞાન શિક્ષણમાં ઉપચારાત્મક શિક્ષણ

14.2.1 ઉપચારાત્મક શિક્ષણનો અર્થ

14.2.2 ઉપચારાત્મક શિક્ષણનો લક્ષણો

14.2.3 ઉપચારાત્મક શિક્ષણનું મહત્વ

14.3 ઉપસંહાર

14.0 પ્રસ્તાવના :

શિક્ષણ એ દ્વિ-ધ્રુવી પ્રક્રિયા છે. જેમાં શિક્ષક અને વિદ્યાર્થી એમ બંને સમાન રીતે કાર્ય કરે છે ત્યારે જ શિક્ષણનો હેતુ ફળીભૂત થાય. આ પ્રક્રિયાની ફલશ્રુતિ માટે વિદ્યાર્થીઓ વ્યક્તિ અનુસાર અભ્યાસક્રમની રચના કરવી અનિવાર્ય છે. તજજ્ઞો દ્વારા, શિક્ષકો દ્વારા નિર્ધારિત કરવામાં આવતો અભ્યાસક્રમ, પાઠ્યક્રમ શિક્ષક અને વિદ્યાર્થીને જોડી રાખતું માધ્યમ છે. આ અભ્યાસક્રમ શિક્ષક દ્વારા નિર્ધારિત સમયમાં વિદ્યાર્થીઓને શીખવવામાં આવ્યો કે કેમ તે બાબત શિક્ષણ પ્રક્રિયાનું ખૂબ જ અગત્યનું પાસું છે. આ વિષયવસ્તુ બાળકો સમજણપૂર્વક શીખ્યા કે કેમ ? તેની સમજ સ્પષ્ટ છે કે કેમ ? આ વિષયવસ્તુ તેઓ લાંબા સમય સુધી યાદ રાખી શકશે કે કેમ ? તેની ચકાસણી કરવી, તેનું મૂલ્યાંકન કરવું એ ખૂબ જ અગત્યની બાબત છે. શિક્ષણ પ્રક્રિયાની ફલશ્રુતિના ભાગરૂપે બાળકોએ કેટલું અધ્યયન કર્યું તેની તપાસ એ નિદાનાત્મક શિક્ષણનો મૂળભૂત હેતુ છે. જેની નીચે મુજબ વિગતવાર ચર્ચા કરી શકાય.

14.1 વિજ્ઞાન શિક્ષણમાં નિદાનાત્મક મૂલ્યાંકન :

વિદ્યાર્થીઓને શીખવવામાં, પીરસવામાં આવેલ વિષયવસ્તુ તેઓ સમજપૂર્વક કેટલું ગ્રહણ કરી શક્યા ? કોઈ મુદ્દામાં ક્યાશ રહી ગઈ છે કે કેમ ? શું તેઓને તે મુદ્દાઓમાં વધુ મહેનતની જરૂર છે કે કેમ ? વગેરે જેવા પ્રશ્નોના ઉત્તર રૂપે નિદાનાત્મક મૂલ્યાંકન અનિવાર્ય છે. જે આપણે નીચે મુજબ વિગતવાર શીખીશું.

14.1.2 નિદાનાત્મક મૂલ્યાંકનનો અર્થ :

મૂળભૂત રીતે ‘નિદાન (Diagnosis)’ શબ્દ તબીબી વિજ્ઞાનમાંથી ઉદ્ભવેલ શબ્દ છે. નિદાન દરમિયાન શિક્ષક માટે દરેક વિદ્યાર્થી સમાન છે. જેવી રીતે એક તબીબ પરીક્ષણ દરમિયાન જે તે રોગની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરે છે. તેવી જ રીતે એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓની અધ્યયન - અધ્યાપન સંદર્ભની ઊણપો, ક્યાશો શોધવાનો પ્રયત્ન કરે છે. નિદાનાત્મક મૂલ્યાંકન સતત શીખવાની પ્રક્રિયા સાથે સંબંધિત છે. નિદાનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શીખવાની સમસ્યાઓના કારણો નક્કી કરવા અને ઉપચારાત્મક ક્રિયા માટે એક સુદૃઢ યોજના ઘડવાનું છે.

બ્લૂમ અને અન્યના જણાવ્યા અનુસાર

“નિદાનાત્મક મૂલ્યાંકનમાં વિદ્યાર્થીની વર્તણૂકોના કેટલાક પાસાઓના મૂલ્યાંકન, નિર્ધારણ,

વર્ણન અને વર્ગીકરણનો સમાવેશ થાય છે. જેમાં વિદ્યાર્થીને યોગ્ય રીતે દિશાસૂચન કરવું અને વિદ્યાર્થીઓની શીખવાની ખામીઓ અંતર્ગત કારણો શોધવા માટે મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે.”

વિદ્યાર્થીઓના નિદાનાત્મક મૂલ્યાંકન કરવા માટે નિદાન કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે જે વિદ્યાર્થીઓનું વિવિધ સ્તરીય નિદાન કરવા માટે રચવામાં આવે છે જેની સમજ નીચે મુજબ આપી શકાય છે.

નિદાનાત્મક કસોટીની વ્યાખ્યાઓ :

‘A test that is sharply focused on some specific aspect of a skill or some specific cause of difficulty in acquiring a skill, and that is useful in suggesting specific remedial actions that might help to improve mastery of that skill is diagnostic test.’ - Thondike

અર્થાત્, “એક કસોટી કે જે કુશળતાના ચોક્કસ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અથવા કૌશલ્ય કેળવવા માટે ઉપચારાત્મક ક્રિયા સૂચવવા માટે ઉપયોગી છે કે જે ચોક્કસ કૌશલ્યમાં નિપુણતા મેળવવા મદદરૂપ થાય છે તે માટેનું નિદાન છે.”

“Diagnostic test are primarily concerned with the skills or abilities that the subject matter experts believe are essential in learning a particular subject.” - Mehrens

અર્થાત્, “નિદાનાત્મક મૂલ્યાંકન મુખ્યત્વે કુશળતા અથવા ક્ષમતાઓ સાથે સંકળાયેલા છે જે ચોક્કસ વિષયો શીખવા માટે ખૂબ જરૂરી છે.”

“The Diagnostic test is developed to identify specific strengths and weakness in basic skills such as reading and arithmetic.”

અર્થાત્, “નિદાનાત્મક કસોટીઓ મૂળભૂત કૌશલ્યો જેમ કે વાંચન અને અંકગણિતમાં વિશિષ્ટ શક્તિઓ અને નબળાઈઓને ઓળખવા માટે વિકસાવવામાં આવી છે.”

“A diagnostic test undertake to provide a picture of strengths and weaknesses.”

- Payne

અર્થાત્ “નિદાનાત્મક કસોટીઓ મજબૂતાઈ અને નબળાઈઓનું ચિત્ર પૂરું પાડવાનું કામ કરે છે.”

આમ, નિદાનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ શિક્ષણ પ્રક્રિયાની ગુણવત્તામાં સુધારો લાવવા માટે અતિઉપયોગી સાબિત થાય એમ છે.

ટૂંકમાં, નિદાનાત્મક મૂલ્યાંકન વિદ્યાર્થીઓ માટે .....

- વાંચન, લેખન, ગણનામાં રહેલ ક્યાશ જાણવા અતિ ઉપયોગી છે.
- મજબૂત પાસાઓ અને નબળા પાસાઓનું ચિત્ર સ્પષ્ટ કરે છે.
- ચોક્કસ વિષયોની ક્યાશનો ખ્યાલ રજૂ કરી ઉપચાર માટે દિશાસૂચન કરે છે.
- કૌશલ્ય કેળવવામાં નડતી સમસ્યાઓના કારણે શોધે છે.
- વિશિષ્ટ પાસાઓ પર ધ્યાનકેન્દ્રિત કરે છે.
- ભૂલોમાં નિપુણતા મેળવવા મદદરૂપ થાય છે.
- ઉપચાર માટેની સચોટ યોજના ઘડવાનું મૂળભૂત સાધન છે.
- શિક્ષણપ્રક્રિયાના સંદર્ભમાં વધુ વ્યાપક અને વિગતવાર છે.
- ચોક્કસ મુશ્કેલીઓ ઉજાગર કરવા સાથે સંબંધિત છે જેનાથી શિક્ષણ સુધારણા હાથ ધરી શકાય.

#### 14.1.2 નિદાનાત્મક મૂલ્યાંકનના લક્ષણો :

એક સારા નિદાનાત્મક મૂલ્યાંકન માટે નીચેની બાબતો અનિવાર્ય છે.

1. નિદાનાત્મક મૂલ્યાંકન વિસ્તૃત અને વિવિધ સ્તરીય પાસાઓને આવરી લે છે.
2. દરેક વિષયવસ્તુમાંથી મુદ્દાઓ સમાવિષ્ટ હોવાને લીધે વિદ્યાર્થીઓના જ્ઞાન અને સમજની ચકાસણી શક્ય છે.
3. કોઈપણ સમયમર્યાદા ન હોવાને કારણે ક્ષમતા અને નબળાઈઓનું સંચોટ મૂલ્યાંકન શક્ય છે.
4. નિદાનાત્મક પરીક્ષણમાં કસોટીઓનો સમૂહ અથવા જરૂર મુજબ એક - બે કસોટીઓ પણ સમાવિષ્ટ હોય છે.
5. નિદાન કસોટી દ્વારા વિદ્યાર્થીઓની ક્યાશનું ચિત્ર સ્પષ્ટ કરી તેમની ખામીઓના વિશ્લેષણ દ્વારા નક્કર ઉપચારકાર્ય હાથ ધરી શકાય છે.
6. નિદાનકસોટીમાં તપાસકર્તા દરેક પાસાની ચકાસણી અને વિશ્લેષણ કરી શકે છે.
7. નિદાનાત્મક મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીઓની અભિરૂચી, આવડત, કૌશલ્યો વગેરેની તાપસ ઝીણવટપૂર્વક શક્ય બને છે.
8. સામાન્ય લાગતી બાબતો કે લક્ષણોનું નિદાન સચોટ રીતે અને સરળતાથી કરી શકાય છે.
9. આમ, વૈયક્તિક ભિન્નતાઓ ઓળખી શકાય છે. નિદાનાત્મક મૂલ્યાંકનની મદદથી શિક્ષક પોતાના વર્ગખંડનો ક્યાશ કાઢી શકે છે અને શિક્ષણપ્રક્રિયા પ્રયોજવા પહેલા ક્યાંથી શરૂઆત કરવી? ક્યા વિદ્યાર્થીઓનું સ્તર ક્યાં છે? જેથી બાબતોની જાણકારી મેળવી શકાય છે.

#### 14.1.3 નિદાનાત્મક મૂલ્યાંકનનું મહત્ત્વ :

વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન દરમિયાન કઈ બાબતોમાં ક્ષતિ રહી જવા પામી છે તેની સંપૂર્ણ જાણકારી નિદાન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આથી નિદાનાત્મક મૂલ્યાંકન વર્ગખંડ શિક્ષક માટે આશીર્વાદ સમાન છે. જેનું મહત્ત્વ નીચે મુજબ વર્ણવી શકાય.

1. વિદ્યાર્થીઓનું માનસિક સ્તર જાણી શકાય જેથી વર્ગખંડમાં શિક્ષણ પ્રશિક્ષણમાં પ્રક્રિયા સરળતાથી થઈ શકે.
2. વિદ્યાર્થીઓની વિષય પરત્વેની ભૂલો જાણી તેના માટે ચોક્કસ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી શકાય.
3. વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ પૂર્વ આયોજન કરી વિવિધ શૈક્ષણિક સાધનો પ્રયોજી શકાય.
4. નબળા વિદ્યાર્થીઓની ક્ષતિઓ જાણી તેમના કૌશલ્યોનો વિકાસ કરી શકાય.
5. વિદ્યાર્થીઓના વિવિધ જૂથો બનાવી યોગ્ય શિક્ષણ પદ્ધતિની પસંદગી કરી શકાય.
6. વિદ્યાર્થીઓને તેમની કુશળતા અનુસાર વિવિધ વર્ગોમાં વિભાજિત કરી શકાય.
7. શિક્ષણપ્રક્રિયા દરમિયાન પેટામુદ્દાઓ સમજવામાં પડતી મુશ્કેલીઓની પ્રત્યક્ષ માહિતી મેળવી શકાય.
8. ચોક્કસ નિદાનના આધારે ઉપચાર પૂરો પાડી વિદ્યાર્થીઓની સિદ્ધિમાં વધારો કરી શકાય.
9. વિદ્યાર્થીઓને, વાલીઓને આચાર્યશ્રીઓને વિદ્યાર્થીઓની નબળાઈઓથી વાકેફ કરી ચોક્કસ પદ્ધતિઓ અને પ્રવિધિઓ પ્રયોજવા માર્ગદર્શન પૂરું પાડી શકાય.
10. વિદ્યાર્થીઓના સારાં અને નબળા પાસાંઓ ઓળખી હકારાત્મક અભિગમનો વિકાસ કરી શકાય અને બાળકોને સુધારણા માટે એક તક પ્રદાન કરી શકાય.

આમ, નિદાનાત્મક મૂલ્યાંકનની મદદથી સમગ્ર શિક્ષણ પ્રક્રિયાની ગુણવત્તા સુધારણા દ્વારા શિક્ષણના સ્તરને ઉપર લાવી શકાય છે.

#### 14.2 વિજ્ઞાન શિક્ષણમાં ઉપચારાત્મક શિક્ષણ

નિદાનાત્મક મૂલ્યાંકનના અંતે પ્રાપ્ત થયેલ ક્ષતિઓ, ભૂલોને આધારે વિદ્યાર્થીઓની આ ક્ષતિઓના નિવારવા માટે ઉપચારાત્મક શિક્ષણ પ્રયોજવું અનિવાર્ય છે. આ સિવાય નિદાન-ઉપચારકાર્ય

અધૂરું છે. આમ ઉપચારાત્મક શિક્ષણ એટલે શું? તેની અગત્યતા શી છે? વગેરેની ચર્ચા નીચે મુજબ હાથ ધરી શકાય.

#### 14.2.1 ઉપચારાત્મક શિક્ષણનો અર્થ :

નિદાનાત્મક મૂલ્યાંકનને આધારે ઓળખાયેલી ક્ષતિઓમાં કુશળતા પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓને ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને પોતાની સિદ્ધિમાં વધારો કરવા માટે અતિ ઉપયોગી છે.

કાર્ટરના મત મુજબ, “ઉપચારાત્મક શિક્ષણ એટલે વિદ્યાર્થીઓમાં રહેલ વિશિષ્ટ ક્ષતિને દૂર કરવા માટે તેઓની તે ક્ષમતાનો વિકાસ કરવામાં આપવામાં આવતું શિક્ષણ.” ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓની વાંચન ક્ષમતામાં જોવા મળતી ક્ષતિને નિવારવા માટે વારંવાર તેઓને વાંચન મહાવરો કરાવીને તેમની ક્ષતિને નિવારવા માટે વારંવાર તેઓને વાંચન મહાવરો કરાવીને તેમની વાંચન ક્ષમતામાં સુધારો વધારો કરી શકાય છે.

યોકમના મત મુજબ, “ઉચારાત્મક શિક્ષણ એ વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં કરેલી ભૂલોને જાણીને તેને સુધારવા માટેની ચોક્કસ પ્રક્રિયા છે જેની મદદથી તેઓ ભવિષ્યમાં સમાન પ્રકારે થતી ભૂલોને અટકાવી શકે છે.”

ઉપચારાત્મક શિક્ષણ શૈક્ષણિક રીતે નબળા બાળકોને શૈક્ષણિક સિદ્ધિમાં વધારો કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે. તે વિદ્યાર્થીઓની ત્રુટીઓનું નિદાન કરવા પર આધારિત છે અને તેનું મુખ્ય લક્ષ્ય નબળાઈઓ સુધારવાનું છે.

#### 14.2.2 ઉપચારાત્મક શિક્ષણના લક્ષણો

1. ઉપચારાત્મક શિક્ષણ સંપૂર્ણતઃ નિદાનાત્મક મૂલ્યાંકન પર આધારિત છે.
2. ઉપચારાત્મક શિક્ષણ નિદાનાત્મક કસોટીની ગતિશીલ બાજુ છે.
3. ઉપચારાત્મક શિક્ષણનો મુખ્ય હેતુ શીખવવાની અને કુશળતા પ્રાપ્ત કરવાની મુશ્કેલીને દૂર કરવાનો છે.
4. ઉપચારાત્મક શિક્ષણ દ્વારા નિવારક પગલાં લઈ ખામીઓ દૂર થઈ શકે છે.
5. જે તે વિષયવસ્તુ અનુરૂપ ટૂંકાગાળાની સારવાર છે.
6. ઉપચારાત્મક શિક્ષણ સામાન્ય સિદ્ધિ સ્તર ધરાવતા વિદ્યાર્થીઓ માટે વધુ અનુકૂળ છે.
7. વિદ્યાર્થીઓની ભાવિ ભૂલોની અટકાવવાની શૈક્ષણિક પ્રક્રિયા છે.
8. વિદ્યાર્થીઓની વિદ્યાકીય સિદ્ધિની ન્યૂનતાઓ નિશ્ચિત કરી શકાય છે.
9. વિદ્યાર્થીઓમાં જોવા મળતી ક્ષતિઓનું સ્વરૂપ સમજી શકાય છે.

#### 14.2.3 ઉપચારાત્મક શિક્ષણનું મહત્ત્વ :

ચોક્કસ નિદાનાત્મક મૂલ્યાંકનના આધારે પ્રાપ્ત નબળા કૌશલ્યોના સુધાર માટે ઉપચાર કાર્ય અનિવાર્ય છે. ઉપચારકાર્ય વગર શૈક્ષણિક પ્રક્રિયા અધૂરી ગણાય છે. આથી શિક્ષણપ્રક્રિયાની પૂર્ણતા માટે ઉપચારકાર્ય પ્રદાન કરવું યથાસ્થાને છે. ઉપચારકાર્યનું શિક્ષણમાં અનેરું મહત્ત્વ છે. જે નીચે મુજબ છે.

1. વિદ્યાર્થીઓના વિશિષ્ટ કૌશલ્યોનો વિકાસ કરી શકાય છે.
2. જે તે વિષયના અનુસંધાને નબળાઈઓ જાણી તેમાં રહેલી ગેરસમજણ દૂર કરી વિદ્યાર્થીઓની સિદ્ધિ વધારી શકાય છે.
3. ઉપચારાત્મક શિક્ષણની સરળતાને આધારે વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ વધારી શકાય છે. જેથી વિદ્યાર્થીઓને આગળના વિષયવસ્તુ શીખવા માટે હકારાત્મક પાયો પૂરો પાડી શકાય.
4. વિદ્યાર્થીઓની આવશ્યકતા અનુસાર વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડી શકાય છે.
5. વિદ્યાર્થીઓની ક્ષમતા પ્રમાણે શિક્ષણનું પ્રયોજન થઈ શકે છે.

6. વર્ગમાં પાછળ રહી જતાં હોય તેવા બાળકો પ્રત્યે સવિશેષ ધ્યાન આપી શકાય છે. જેથી તેમની આવડતોનો વિકાસ કરી શકાય.
7. વિદ્યાર્થીઓની સમગ્ર સિદ્ધિનો ખ્યાલ મેળવી શકાય છે.

---

### 14.3 ઉપસંહાર :

---

આમ, નિદાનાત્મક મૂલ્યાંકન અને ઉપચારાત્મક શિક્ષણ એ ઉત્કૃષ્ટ શિક્ષણ પ્રયોજવા માટેના મુખ્ય બે આધારસ્તંભો છે કે જેની ગેરહાજરીમાં શિક્ષણ પ્રક્રિયા નિર્ણવ લાગે છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક નિદાનને આધારે ઉપચારકાર્ય પૂરું પાડી નબળા અને મધ્યમ બાળકોની સિદ્ધિક્ષામાં નોંધપાત્ર વધારો કરવો સંભવ છે. સરવાળે નિદાન અને ઉપચાર કાર્ય વગર શિક્ષણપ્રક્રિયાનું સચોટ મૂલ્યાંકન સફળ બની શકે નહિ. તેથી દરેક વર્ગશિક્ષકે પોતાના વિષયમાં અઘરા લાગતા હોય તેવા મુદ્દાઓ ને કેન્દ્રસ્થાને રાખી નિદાન દ્વારા શીખવાની સમસ્યાઓ કારણો જાણી તેને આધારે ઉપચારકાર્ય કરવું જ સમગ્ર શિક્ષણ જગત માટે અત્યંત ફળદાયી નીવડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.

: રૂપરેખા :

15.0 પ્રસ્તાવના

15.1 શૈક્ષણિક સાધનોનો અર્થ

15.2 શૈક્ષણિક સાધનોનું મહત્વ

15.3 શૈક્ષણિક સાધનોના પ્રકાર

15.3.1 દૃશ્ય સાધનો

15.3.2 શ્રાવ્ય સાધનો

15.3.3 દૃશ્ય-શ્રાવ્ય સાધનો

15.3.4 પ્રક્ષેપણ સાધનો

15.4 શૈક્ષણિક સાધનોના વિષયવસ્તુ આધારિત ઉદાહરણો

15.5 ઉપસંહાર

15.0 પ્રસ્તાવના :

વિજ્ઞાન શિક્ષણનો આધાર મૂળભૂત સંશોધનો પર રહેલો છે. એ મૂળભૂત / પાયાના સંશોધનોમાં નિયમો, સિદ્ધાંતો, વિવરણો અને વિવિધ સંકલ્પનાઓ સ્પષ્ટતા થયેલી જોવા મળે છે. આ મૂળભૂત સંશોધનોને વ્યવહારુ ઉપયોગ થાય તો જ તે શોધ સમાજ માટે ઉપયોગી સાબિત થાય છે.

વિજ્ઞાનનું જ્ઞાન સાર્થક બનાવવા માટે તેનો માનવકલ્યાણ માટે ઉપયોગ થાય એ અંતિમ આવશ્યક છે. વિજ્ઞાનની અદ્ભૂત શોધોને કારણે માનવી ચંદ્ર કે મંગળ ગ્રહ પર રહેવાની કલ્પના સેવતો થયો છે. આધુનિક સાધનોનો ઉપયોગ અત્યંત અનિવાર્ય બન્યો છે.

પ્રાથમિક શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક વલણ વિકસાવવું અને દૃઢ કરતું શિક્ષણ આપવામાં આવે તો વૈજ્ઞાનિકતા, ક્રમિકતા, તાર્કિકતા અને ચોકસાઈનો વિકાસ કરી શકાય છે. વર્ગખંડમાં શિક્ષણ પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે ત્રિવિધ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ જરૂરી બન્યો છે.

અમેરિકાના ‘નેશનલ - એજ્યુકેશનલ એસોસિએન’ના રિવ્યુ પ્રમાણે અધ્યયન પ્રક્રિયાને અસરકારક, આનંદદાયક, કાયમી અને વ્યાપક બનાવવામાં દૃશ્ય - શ્રાવ્ય સાધનો વિવિધ પ્રકારની ક્રિયાઓ દ્વારા અધ્યયન કરે છે. જેમાં સાંભળીને શીખવું, કાર્ય કરીને શીખવું, જોઈને શીખવું, સ્વયં અનુભવ દ્વારા શીખવું જેવી ક્રિયાઓ સમાવિષ્ટ છે.

આધુનિક સમયમાં નવી ટેકનોલોજીના વિકાસની સાથે અનેક પ્રકારની દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી ઉપલબ્ધ છે, ત્યારે શૈક્ષણિક હેતુની સિદ્ધિ અર્થે યોગ્ય સાધન સામગ્રીની પસંદગી અને ઉપયોગ આવશ્યક છે. વિદ્યાર્થીઓ સ્વઅનુભવ દ્વારા પ્રત્યક્ષ રીતે વાસ્તવિક રીતે જ્ઞાન મેળવે તે ખૂબ જરૂરી છે. વર્ગખંડ શિક્ષણને ચિત્ર, ચાર્ટ, મોડેલ, આકૃતિઓ કે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અસરકારક બનાવી શકાય છે. વિજ્ઞાનના વિવિધ ખ્યાલો કે સંકલ્પનાને તાદૃશરૂપ આપીને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી સરળ સમજ આપવા માટે દૃશ્ય-શ્રાવ્ય સાધનો અતિ ઉપયોગી છે.

15.1 શૈક્ષણિક સાધનોનો અર્થ (Meaning of Teaching Aid)

સામાન્ય અર્થમાં કહીએ તો વર્ગખંડ શિક્ષણને અસરકારક બનાવતા વિવિધ ઉપકરણો એટલે શૈક્ષણિક સાધનો.

વેબસ્ટર ડિક્શનરી મુજબ, “ An, object or device used by teacher to enhance or

enliven classroom instruction.”

અર્થાત્ વર્ગખંડ પ્રક્રિયાને જીવંત કે અસરકારક બનાવવા માટે શિક્ષક દ્વારા વપરાતા ઉપકરણો કે સાધનો એટલે શૈક્ષણિક સાધનો.”

www. dictionary. com. અનુસાર ,

“Material used by a teacher to suppliment classroom Instruction or to stimulate the interst of students.”

અર્થાત્ શિક્ષક દ્વારા વપરાતા સાધનો કે જે વર્ગખંડ શિક્ષણ પ્રક્રિયાને પૂરક હોય અથવા વિદ્યાર્થીઓના રસને ઉત્તેજિત કરતા હોય

ટૂંકમાં શૈક્ષણિક સાધનો એ .....

- વર્ગખંડ શિક્ષણને અસરકારક અને ચિરસ્થાયી બનાવતા ઉપકરણો છે.
- શિક્ષકને અભ્યાસક્રમ સરળતાથી શીખવવા માટેના સહાયકો છે.
- વિદ્યાર્થીઓના રસને જાળવી રાખતા વિવિધ શૈક્ષણિક ઉપકરણો છે.
- અધ્યયન - અધ્યાપનને ફળીભૂત કરતાં, જીવંત કરતાં શૈક્ષણિક સાધનો છે.

### 15.2 શૈક્ષણિક સાધનોનું મહત્ત્વ :

સમગ્ર અધ્યયન - અધ્યાપન પ્રક્રિયાને વર્ગખંડ સમક્ષ નિરૂપણ કરવા માટે તાદૃશ રીતે રજૂ કરવા માટે શૈક્ષણિક સાધનોનું મહત્ત્વ નીચે મુજબ દર્શાવી શકાય.

1. વિજ્ઞાનની હકીકતો કે ઘટનાઓ જે વિદ્યાર્થીઓને તાદૃશ કે જીવંત ન દર્શાવી શકાય તે શૈક્ષણિક સાધનોની મદદથી વર્ગખંડનાં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી શકાય.
2. જટિલ વૈજ્ઞાનિક સાધનોની રચના સમજાવી શકાય.
3. જટિલ પ્રક્રિયાઓ કે સૂક્ષ્મ રચનાઓને ક્રમિક રીતે ગોઠવી વિદ્યાર્થીઓને સમજાવી શકાય.
4. વૈજ્ઞાનિકોની ઓળખ, તેઓની શોધો, તેમણે કરેલા પ્રયોગો વગેરેનું વર્ણન કે રજૂઆત, દૃશ્ય-શ્રાવ્ય સાધનોની મદદથી અસરકારક રીતે કરી શકાય.
5. વિશ્વમાં થતી વિવિધ શોધો, નવીન પ્રયોગોને ઈન્ટરનેટ કે ટેલિવિઝનની મદદથી વર્ગખંડમાં દર્શાવી શકાય.
6. મોડેલ, પ્રતિકૃતિઓ, ચાર્ટ, ફિલ્મસ્ટ્રીપ, પ્રોજેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને રસપ્રદ અને અસરકારક અધ્યયન કરાવી શકાય.
7. વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અને વાસ્તવિક અનુભવો પૂરા પાડી તેમની વિચારશક્તિ, કલ્પનાશક્તિ અને અવલોકનશક્તિ વિકસાવી શકાય.
8. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણનો વિકાસ કરી અંધશ્રદ્ધા દૂર કરી શકાય.
9. વિવિધ પ્રતિકૃતિઓ દ્વારા લગભગ વાસ્તવિક વસ્તુઓ જેવા જ અનુભવો પૂરા પાડી શકાય.
10. અધ્યાપક કે શિક્ષકની ગેરહાજરીમાં પણ વિવિધ વિજ્ઞાન કે કાર્યક્રમો (Electronic Programme) દ્વારા શિક્ષણ આપી શકાય.
11. નરી આંખ ન જોઈ શકાતી, ઝડપથી થતી ક્રિયાનું નિયંત્રણ કરી વિદ્યાર્થીઓને તેમની ગતિની સમજ આપી શકાય છે.
12. અપ્રાપ્ય વસ્તુઓ, દુર્લભ બનાવો, ઘટનાઓ કે પ્રક્રિયાઓ LCD પ્રોજેક્ટરની મદદથી Internet ના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી શકાય.
13. વિદ્યાર્થીઓને વાસ્તવિક અનુભવો પૂરા પાડી વિષયશિક્ષણને રસપ્રદ, આનંદદાયક બનાવી સાર્થક અને અસરકારક બનાવી શકાય.
14. દૂર અંતરિક્ષમાં ઘટતી ઘટનાઓ કે બનાવોને ફિલ્મ કે ફોટોગ્રાફ સ્વરૂપે રૂપાંતરિત કરી વર્ગમાં

વિદ્યાર્થીઓને તેની ઊંડાણપૂર્વકની સમજ આપી શકાય.

15. સૂક્ષ્મ વસ્તુઓની આંતરિક રચના, સૂક્ષ્મધ્વનિ વગેરેની સીડી બનાવી ફિલ્માંકન કરી, લાંબા સમય સુધી સાચવી વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકાય.
16. જ્ઞાનનું ઊંડાણ વધારી વૈવિધ્ય લાવી શકાય.
17. વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતો સંતોષી જરૂરિયાત મુજબ, વિદ્યાર્થીઓની ક્ષમતા પ્રમાણે શિક્ષણકાર્ય પ્રયોજી શકાય.

### 15.3 શૈક્ષણિક સાધનોના પ્રકાર (Types of Teaching Aids) :

પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજીના વ્યાપને ધ્યાનમાં રાખી દૃશ્ય-શ્રાવ્ય સાધનો / શૈક્ષણિક સાધનોનાં નીચે મુજબ ચાર પ્રકાર પાડી શકાય છે.

- (1) દૃશ્ય સાધનો (Visual Aids) (i) આલેખિત દૃશ્ય સાધનો (Graphics) (ii) ત્રિપરિમાણવાળા દૃશ્ય સાધનો (Three Dimensional Visual Aids)
- (2) શ્રાવ્ય સાધનો (Audio Aids)
- (3) દૃશ્ય-શ્રાવ્ય સાધનો (Audio - Visual Aids)
- (4) પ્રક્ષેપણ સાધનો (Projected Aids)

ઉપરોક્ત પ્રકાર અનુસાર શૈક્ષણિક સાધનોની વિગતે ચર્ચા નીચે મુજબ કરી શકાય.

#### 15.3.1 દૃશ્ય સાધનો (Visual Aids) :

આ પ્રકારના સાધનો વિદ્યાર્થીઓને ફક્ત દૃશ્ય (Visual) અનુભવો પૂરા પાડે છે. સર્વસામાન્ય જ્ઞાનમાં વધારો કરે છે. શિક્ષક દૃશ્ય - સાધનોની મદદથી પોતાના વર્ગકાર્યને અસરકારક અને રસપ્રદ બનાવી શકે છે. વિદ્યાર્થીઓને વાસ્તવદર્શી માહિતી પૂરી પાડી શકાય છે. દૃશ્ય સાધનોને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે.

##### (1) આલેખિત દૃશ્ય સાધનો (Graphics) :

આ પ્રકારના શૈક્ષણિક સાધનોમાં ચાર્ટ, ચિત્રો, નકશાઓ, પોસ્ટર, સ્કેચ, ફ્લેનલ બોર્ડ, પ્રદર્શન પાટીયું, નમૂના ચિત્રો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ સાધનોની મદદથી વિદ્યાર્થીઓને ક્રમિક રજૂઆત દ્વારા અસરકારક રીતે અધ્યયન કરાવી શકાય છે.

##### (2) ત્રિપરિમાણવાળા દૃશ્ય સાધનો (Three dimensional visual aids) :

આ પ્રકારના સાધનોમાં પ્રતિકૃતિઓ અને નમૂનાઓનો સમાવેશ કરવામાં આવે છે. વિજ્ઞાનના ઘણાં બધાં એકમોને મોડેલ દ્વારા સરળતાથી સમજાવી શકાય છે. કોઈપણ વસ્તુની આંતરિક રચના જેમાં આંખ, કાન, હૃદય, ફેફસાં તેમજ મૂત્રપિંડ, પાચનક્રિયા વગેરેની સમજૂતી આ પ્રકારના શૈક્ષણિક સાધનોની મદદથી આપી શકાય છે. સામાન્ય રીતે મોડેલ લાકડામાંથી, મીણમાંથી, પૂઠામાંથી, માટીમાંથી અને થર્મોકોલમાંથી બનાવવામાં આવે છે.

#### 15.3.2 શ્રાવ્ય સાધનો (Audio Aids) :

આ પ્રકારના સાધનોમાં રેડિયો, ટેપરેકોર્ડરનો સમાવેશ કરવામાં આવે છે. રેડિયોની મદદથી આકાશવાણી પરથી પ્રસારિત થતાં કાર્યક્રમો સરળતાથી શ્રવણ કરી શકાય છે. વિદ્યાર્થીઓને નાવીન્યસભર જ્ઞાન પીરસી શકાય છે. શરૂઆતના સમયમાં શિક્ષણમાં ગ્રામોફોનનો ઉપયોગ કરવામાં આવતો હતો. રેડિયો પર પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમોને ટેપરેકોર્ડર દ્વારા ધ્વનિ મુદ્રિત કરી હંમેશા માટે સાચવવી જરૂર પડે ત્યારે વિદ્યાર્થીઓ સમક્ષ વિષયવસ્તુના મુદ્દાની છણાવટ કરી શકાય છે. જે હાલમાં પ્રમાણમાં ઓછા ઉપયોગી છે.

#### 15.3.2 દૃશ્ય-શ્રાવ્ય સાધનો (Audio - Visual Aids) :

ટેલિવિઝન, કમ્પ્યુટર, ઈન્ટરનેટ સાથેના ઈન્ટર એક્ટિવ બોર્ડ એ આ પ્રકારના સાધનો છે. જેમાં ચલચિત્ર સ્વરૂપે વિષયવસ્તુના મુદ્દાઓ જોઈને તે અનુરૂપ વર્ણન સાંભળી અધ્યયન થઈ શકે છે.



જેમાં GCERT, SAQ, NCERT અને BAOU જેવી સંસ્થાઓ આ પ્રકારના દ્વિ-માર્ગીય કાર્યક્રમો દ્વારા શિક્ષણ પૂરું પાડે છે.

કમ્પ્યુટરની શોધ બાદ CAL (Computer Assisted Learning), CAI (Computer Aided Learning), CBL (Computer Based Learning) CMI (Computer Managed Instruction) જેવા અનેક કાર્યક્રમોનું નિર્માણ કરી વિદ્યાર્થીઓને આનંદદાયક અધ્યયન કરાવી શકાય છે. બજારમાં આ પ્રકારની દ્વિપરિમાણીય તેમજ એનીમેટેડ સીડીઓ પણ ઉપલબ્ધ છે જે પ્રવર્તમાન સમયની જરૂરિયાત છે.

#### 15.3.4 પ્રક્ષેપણ સાધનો (Projected Aids) :

આ પ્રકારના સાધનો દૃશ્ય, શ્રાવ્ય કે દૃશ્ય-શ્રાવ્ય એમ કોઈ પણ પ્રકારના હોઈ શકે છે. જેમાં સ્લાઈડ પ્રોજેક્ટર, ફિલ્મસ્ટ્રીપ પ્રોજેક્ટર, એપિડાયોસ્કોપ, OHP (ઓવરહેડ પ્રોજેક્ટર), LCD (લિક્વીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ) પ્રોજેક્ટર વગેરેનો સમાવેશ થાય છે. જે પૈકી CPU સાથે LCD જોડીને સ્પીકરની મદદથી ધ્વનિમુદ્રત કાર્યક્રમ આપી વિદ્યાર્થીઓને નાવીન્યસભર શિક્ષણ કાર્ય કરાવી શકાય.

રૂધિરાભિષરણ તંત્રની કાર્યવિધિ, પાચનક્રિયા, વરાળયંત્રનું કાર્ય, છોડનો વૃદ્ધિ અને વિકાસ, રોકેટનું પ્રક્ષેપણ, ધરતીકંપ, વાવાઝોડું, દરિયામાં ભરતી-ઓટ જેવા અનેક મુદ્દાઓ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં તાદૃશ જીવંત કરી શીખવી શકાય છે.

#### 15.4 શૈક્ષણિક સાધનોના વિષયવસ્તુ આધારિત ઉદાહરણો :

વિજ્ઞાન વિષયના વિવિધ મુદ્દાઓને વિવિધ પ્રકારના દૃશ્ય-શ્રાવ્ય સાધનોની મદદથી સરળતાથી વિદ્યાર્થીઓને શીખવી શકાય છે જે નીચે મુજબ છે.

- ઉદા.1 પરમાણુની આંતરિક રચના, આંખની આંતરિક રચના, કાનની આંતરિક રચના, તરંગની ગતિ વગેરે જેવા મુદ્દાઓ મોડલનો ઉપયોગ કરી વધુ સરળતાથી સમજાવી શકાય.
- ઉદા.2 વિવિધ જૈવિક ક્રિયાઓ જેવી કે શ્વસન, પોષણ, પરિવહન, ઉત્સર્જન, વૃદ્ધિ, પ્રજનન, પોષણકડી અને સહનિયમન જેવી વિવિધ પ્રક્રિયાઓ ચાર્ટ્સ અને ફોટોગ્રાફની મદદથી ઉપરાંત જીવંત મોડલ દ્વારા પણ સરળતાથી શીખવી શકાય છે.
- ઉદા.3 વિવિધ કુદરતી ઘટનાઓ જેવી કે જ્વાળામુખી ફાટ્યો, ધરતીકંપ થવો, ઉલ્કાપાત થવો, ધૂમકેતુનું ભ્રમણ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ વગેરે જેવી ઘટનાઓ વિડિયોગ્રાફીની મદદથી કે ફિલ્મની મદદથી વર્ગ સમક્ષ જીવંત કરાવી શકાય.
- ઉદા.4 સંગ્રહ ન થઈ શકે તેવી નાશપ્રાય: વસ્તુઓ જેવી કે ડાયનોસોરનું કંકાલ, વ્હેલનું કંકાલ, વિનાશને આરે આવેલી વિવિધ જીવસૃષ્ટિ વગેરેના મોડેલ કે ચિત્રો દ્વારા વર્ગખંડમાં તેની માહિતી આપી અધ્યયન કરાવી શકાય.
- ઉદા.5 સુરક્ષાની દૃષ્ટિએ અગત્યના સ્થળો કે જેવા કે અણુમથકો, આર્મી બેઝ કેમ્પ, જંગલો ઔદ્યોગિક સંકુલોના ચિત્રો, ફિલ્મો, વિડિયોની વિડિયોગ્રાફી કરી તેને વર્ગ સમક્ષ રજૂ કરી શકાય.
- ઉદા.6 ધીમી પ્રક્રિયાઓ જેવી કે છોડની વૃદ્ધિ, વિકાસ પર હવા, પાણીની, વાતાવરણની અસરને ચલચિત્રોની “Fast motion photography” ની મદદથી ઝડપથી શીખવી, દર્શાવી શકાય છે.
- ઉદા.7 ઝડપી પ્રક્રિયાઓ જેવી કે રોકેટ છોડવાની પ્રક્રિયા, માખી કે મચ્છરની પાંખોની ગતિને “Slow motion photography” ની મદદથી વિદ્યાર્થીઓને શીખવી શકાય છે.

#### 15.5 ઉપસંહાર

આમ, દૃશ્ય-શ્રાવ્ય શૈક્ષણિક સાધનોની વિશેષતાઓ અને મહત્વના મુદ્દાઓની ચર્ચા સમજી તેનો વર્ગખંડમાં યથાર્થ અને આવશ્યક ઉપયોગ કરવો અત્યંત અનિવાર્ય છે. શિક્ષક પોતાની જરૂરિયાત મુજબ પણ પોતાની સૂઝ અને વિવેકબુદ્ધિની મદદથી સાધન બનાવી પોતાનું શિક્ષણકાર્યને અસરકારક બનાવી શકે છે અને પોતાની અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને જીવંત અને સાર્થક બનાવી શકે છે.

: રૂપરેખા :

16.0 પ્રસ્તાવના

16.1 ક્રિયાત્મક સંશોધનનો અર્થ

16.2 ક્રિયાત્મક સંશોધનનું મહત્વ

16.3 ક્રિયાત્મક સંશોધનનાં લક્ષણો

16.4 ક્રિયાત્મક સંશોધનના સોપાનો

16.5 ક્રિયાત્મક સંશોધનના ઉદાહરણ

16.6 ઉપસંહાર

16.0 પ્રસ્તાવના :

માનવજીવનની પ્રગતિમાં સંશોધનના મૂળ રહેલા છે. માનવ જેમ જેમ પ્રગતિ કરતો ગયો તેમ તેમ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આસપાસના વિશ્વને જાણતો ગયો, ઓળખતો ગયો અને અનુભવતો ગયો. માનવીએ શરૂઆતમાં વિશ્વને સમજવાની કોશિશ કરી. વિશ્વમાં ઠેરઠેર પડેલી સંવાદિતા માનવીની નજરે આવી. શરૂઆતમાં કોઈ પ્રસંગ કે બનાવની તપાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી થતી, નવા તથ્યો, રહસ્યો, હકીકતો, વિચારો અને પ્રણાલિઓ કે પરંપરાઓની શોધ કરવામાં મદદરૂપ થવા ઉપરાંત સંશોધનો રાષ્ટ્રના ઝડપી વિકાસ માટે ઉપયોગી બને છે. માનવીને ઈચ્છિત પ્રગતિ અર્પણ કરીને સુખદાયી જીવન પ્રદાન કરવામાં સંશોધનની ભૂમિકા અગત્યની છે.

સંશોધન માનવજીવનને પ્રગતિ તરફ લઈ જવામાં અગત્યનો ભાગ ભજવી રહ્યું છે. સંશોધન એટલે કોઈ પદ્ધતિસરની પ્રક્રિયાને અનુસરતી પ્રવૃત્તિ છે જેને દ્વારા જ્ઞાન ઉપાર્જન થાય છે. વળી, શિક્ષણના ક્ષેત્રેને વધારે પુષ્ટ અને પ્રગતિશીલ બનાવવામાં પણ સંશોધન અગત્યનો ભાગ ભજવે છે.

સંશોધન એટલે શું ?

સંશોધન (Re-Search) નો શાબ્દિક અર્થ પુનઃ શોધ કે ફરીથી શોધવું એવો થાય છે. વૈજ્ઞાનિક અભ્યાસ કે સંશોધનની દૃષ્ટિએ આ અર્થ ઘણો સૂચક છે. હંમેશા સંશોધનની શરૂઆત કોઈ વ્યવહારુ પ્રશ્ન કે સમસ્યાથી થાય છે.

“Research is a careful inquiry.” અર્થાત્, “સંશોધન એ કાળજીપૂર્વકની તપાસ છે.”

ટૂંકમાં કહીએ તો સંશોધન એ વ્યવસ્થિત તાર્કિક પદ્ધતિ છે. એક સંભાળપૂર્વકની પૂછપરછ છે, વૈજ્ઞાનિક પદ્ધતિનો પદ્ધતિસરનો અને શુંબલાબદ્ધ વિનિયોગ છે. સંશોધકને ઉદ્ભવ પામેલ પ્રશ્ન કે સમસ્યાના પરિપ્રેક્ષ્યમાં તેનો ઉકેલ માટેની પ્રામાણિક, અવિરત અને બુદ્ધિપૂર્વકની ખોજ છે.

સંશોધનના મુખ્ય ત્રણ પ્રકાર પાડવામાં આવે છે.

- (1) પાયાનું કે મૂલગત સંશોધન (Basic Research)
- (2) વ્યાવહારિક સંશોધન (Applied Research)
- (3) ક્રિયાત્મક સંશોધન (Action Research)

જ્ઞાન ખાતર જ્ઞાન મેળવવાની સંશોધકની જિજ્ઞાસાવૃત્તિમાંથી ઉદ્ભવેલું સનાતન સત્યો અને પાયાની પ્રક્રિયાઓની ખોજ કરતું શુદ્ધસંશોધન એટલે મૂલગત (Basic) સંશોધન છે જ્યારે આ જ્ઞાનનો ઉપયોગ વ્યાવહારિક સમસ્યાઓ ઉકેલવામાં કે નિર્ણયો લેવા માટે વૈજ્ઞાનિક રીતે નવું જ્ઞાન મેળવવા માટેનું સંશોધન એ વ્યાવહારિક સંશોધન છે.

કોઈ શૈક્ષણિક સંસ્થા, શાળા, આચાર્ય કે શિક્ષકની સ્થાનિક તેમજ વિશિષ્ટ સમસ્યાનો વૈજ્ઞાનિક રીતે ઉકેલ લાવવા સંસ્થાના લોકો દ્વારા, આચાર્ય દ્વારા કે શિક્ષક દ્વારા થતું સંશોધન એ ક્રિયાત્મક સંશોધન છે. જેની વિગતવાર ચર્ચા નીચે મુજબ કરી શકાય.

### 16.1 ક્રિયાત્મક સંશોધનનો અર્થ :

સૌ પ્રથમ ક્રિયાત્મક સંશોધનની સંકલ્પના 19મી સદીના અંતમાં, 1940માં કર્ટ લેવિને સ્પષ્ટ કરી. તેમના મુજબ વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલ દ્વારા જ્ઞાનનું સર્જન થવું જોઈએ. ત્યારબાદ સ્ટીફન કોરે નામના શિક્ષણશાસ્ત્રીએ 1949થી 1954 સુધીમાં ક્રિયાત્મક સંશોધનનો વ્યાપ વધાર્યો અહીં આપણે ક્રિયાત્મક સંશોધનો અર્થ કેટલીક વ્યાખ્યાઓની મદદથી સમજવાનો પ્રયત્ન કરીશું.

“વૈયક્તિક સુધારણા અને વ્યાવહારિક ઉપયોગ માટે સંબંધિત સંશોધક દ્વારા હાથ ધરવામાં આવતું સંશોધન એટલે ક્રિયાત્મક સંશોધન.” - *હિલ્ડ્રેય મેકઆશાન*

“ક્રિયાત્મક સંશોધનનો હેતુ શાળા અને શૈક્ષણિક પ્રક્રિયાઓમાં સુધારણાનો છે અને જેઓ આ સુધારણા કરવા માંગે છે તેઓને પણ સુધારવાનો છે.” - *જહોન ડબલ્યુ બેરેટ*

“શૈક્ષણિક વ્યવસાયીઓ દ્વારા હાથ ધરાતું સંશોધન કે જેને કારણે તેઓ વધુ સારા નિર્ણયો કરી શકે છે અને વધુ સારા કાર્યોમાં ગુંથાઈ શકે છે તેને ક્રિયાત્મક સંશોધન કહે છે.” - *સ્ટીફન એમ. કોરે*.

ટૂંકમાં કહીએ તો ક્રિયાત્મક સંશોધન શિક્ષણ સાથે સંકળાયેલી વ્યક્તિઓ જેવી કે શિક્ષકો, આચાર્યો, સુપરવાઈઝરશ્રીઓ, વહીવટદારો કે શિક્ષણશાસ્ત્રીઓ દ્વારા શાળા પ્રક્રિયામાં ગુણવત્તા સુધારણા માટેની સમસ્યા ઉકેલવા માટે હાથ ધરાતું સંશોધન છે.

આ સંશોધનમાં શિક્ષક પોતાના કાર્યમાં, વર્ગખંડ શિક્ષણમાં વણઉકલ્યા પ્રશ્નોના ઉત્તરો મેળવવાનો પ્રયત્ન કરે છે. જેમાં પોતાના કાર્યને સુધારવા વ્યક્તિ કે જૂથ પોતાના કાર્યનો પદ્ધતિસર અભ્યાસ કરે છે. શિક્ષક માટે, શિક્ષક દ્વારા અને શિક્ષક વડે હાથ ધરાતું સંશોધન એ ક્રિયાત્મક સંશોધન છે.

આ સંશોધન સમસ્યાનું નિદાન કરી માહિતી એકત્ર કરી ગુણવત્તા સુધારણા કે વર્ગખંડ અધ્યયન પ્રક્રિયા સુધારવા માટે વૈજ્ઞાનિક ઢબે પ્રયોજિત કરવામાં આવે છે.

ટૂંકમાં ક્રિયાત્મક સંશોધન એ ....

- વૈયક્તિક સુધારણા અર્થે હાથ ધરાતું સંશોધન છે.
- શાળાકીય શૈક્ષણિક પ્રક્રિયા સુધારણા માટે અત્યંત ઉપયોગી સંશોધન છે.
- વિશિષ્ટ સ્થાનિક સમસ્યા દ્વારા પ્રેરિત છે.
- શિક્ષણ પ્રક્રિયામાં હસ્તક્ષેપનું ઝીણવટ ભર્યું પરીક્ષણ છે.
- મૂલ્યાંકનના હેતુસર સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરે છે.
- શિક્ષકને અધ્યાપનકાર્ય સુધારણા માટે ઉપયોગી છે.
- વિશિષ્ટ પરિસ્થિતિમાં શાળાની સમસ્યાઓ ઉકેલવા સક્ષમ સંશોધન છે.

### 16.2 ક્રિયાત્મક સંશોધનનું મહત્વ :

વર્ગખંડમાં શિક્ષણ પ્રક્રિયાને અસરકારક બનાવીએ શિક્ષકનું પ્રથમ કર્તવ્ય છે અને શિક્ષણ પ્રક્રિયા ત્યારે જ અસરકારક બને જ્યારે વર્ગખંડમાં ઉદ્ભવતી સમસ્યાઓનો વ્યવહાર અને સર્વ સામાન્ય ઉકેલ મેળવી શકાય. શિક્ષણ પ્રક્રિયાની ફલશ્રુતિ સ્વરૂપે હકારાત્મક પરિણામો મેળવવા ક્રિયાત્મક સંશોધન શિક્ષક માટે આશીર્વાદ સમાન છે. આ સંદર્ભે ક્રિયાત્મક સંશોધનનું મહત્વ નીચે મુજબ સ્પષ્ટ કરી શકાય છે.

- આ સંશોધનની મદદથી શિક્ષકમાં હકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.
- શિક્ષણ પ્રક્રિયાની સમસ્યાઓ જાણી તેને અસરકારક અને ફળદાયી બનાવી શકાય છે.
- શિક્ષકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ કરી શકાય છે.

- વર્ગખંડની, શાળાની અને સંસ્થાની સ્થાનિક અને રોજબરોજની ઉદ્ભવતી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવી શકાય એમ છે.
- શિક્ષકોમાં સંશોધન પ્રત્યેનો હકારાત્મક અભિગમ વિકસાવી ભવિષ્યમાં તેઓને મોટા સંશોધનો હાથ ધરવા માટે પ્રેરિત કરી શકાય છે.
- વિદ્યાર્થીનું નિદાન કરી ઉપચારાત્મક શિક્ષણને સ્થાન આપી શિક્ષણનું સ્તર સુધારી ગુણવત્તા લાવવા માટે મદદ મળી શકે છે.
- શિક્ષકોમાં સંશોધન સજ્જતા વધારી અનાત્મલક્ષી પણાનો વિકાસ કરી શકાય છે.
- શિક્ષકો સ્વયં પોતાની સમસ્યા ઉકેલતા થાય તો દરેક તબક્કે સમસ્યા ઉકેલ અભિગમને દાખલ કરી શકાય.
- શિક્ષકો તેમનવા અન્ય મિત્રો સાથે એકબીજાના પૂરક બની સંશોધન અભિગમનો, ચિંતનાત્મક અભિગમનો અને સમૂહભાવનાનો વિકાસ કરી શકે.
- સમગ્ર શિક્ષણ પ્રક્રિયામાં નાવીન્ય લાવી શકાય છે.

### 16.3 ક્રિયાત્મક સંશોધનનાં લક્ષણો :

- ક્રિયાત્મક સંશોધનની લાક્ષણિકતાઓ નીચે મુજબ વર્ણવી શકાય.
- શિક્ષકો, આચાર્યો, નિરીક્ષકશ્રીઓના રોજિંદા કાર્યમાં ઉદ્ભવતી વ્યક્તિગત સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે હાથ ધરાય છે.
- તે વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાય છે.
- આ સંશોધનો મુખ્ય હેતુ શૈક્ષણિક કાર્યોમાં સુધારણા કરવાનો છે.
- આ સંશોધન વાસ્તવિક સમસ્યાઓના પાયામાંથી ઉદ્ભવે છે.
- આ સંશોધન પરિસ્થિતિને અનુરૂપ છે.
- અહીં 'જો ... તો' પ્રકારની ઉત્કલ્પના રચવામાં આવે છે.
- આ સંશોધનમાં યોજનાનું લચીલાપણું ખૂબ જોવા મળે છે.
- સંશોધનમાં યોજનાનું સામાન્યીકરણ મોટા વ્યાપ પર શક્ય નથી.
- ઉપચારાત્મક કાર્યના ભાગ સ્વરૂપે હાથ ધરાતું વ્યક્તિગત સંશોધન છે.
- સ્થાનિક અને વર્ગખંડની સમસ્યાઓના વ્યવહારુ ઉકેલો મેળવી શકાય છે.
- તેના પરિણામોના આધારે સામાન્ય સિદ્ધાંતો કે નિયમો પ્રસ્થાપિત થઈ શકતા નથી.
- આ સંશોધન સમય, શક્તિ અને નાણાંની દૃષ્ટિએ ઓછું ખર્ચાળ છે.
- આ સંશોધન નિષ્ણાંતોની સલાહ વગર પણ હાથ ધરી શકાય છે.
- ક્રિયાત્મક સંશોધન એ નિદાનાત્મક સંશોધન તરીકે પણ ઓળખાય છે.
- આ સંશોધનમાં પાત્રોનું સળંગ મૂલ્યાંકન કરી શકાય છે જેથી વ્યવહારમાં સુધારણા શક્ય બને છે.
- આ સંશોધનના પરિણામો અનૌપચારિક રીતે રજૂ કરવામાં આવે છે.
- ઘણી વખત પરિણામોની જાણ મૌખિક રીતે પણ કરવામાં આવે છે.

### 16.4 ક્રિયાત્મક સંશોધનના સોપાનો :

કોઈપણ કાર્ય કે સંશોધનને વૈજ્ઞાનિક સ્વરૂપ આપવા માટે તેને વિવિધ ક્રમાનુસાર તબક્કાઓ કે સોપાનોમાંથી જ આગળ વધારવું જોઈએ. ક્રિયાત્મક સંશોધન વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાતું હોવાને પરિણામે ચોક્કસ સોપાનોને અનુસરે છે જે નીચે મુજબ દર્શાવી શકાય છે.

(1) સમસ્યા પસંદગી (Selection of Problem)

- (2) સમસ્યા ક્ષેત્ર (Area of Problem)
  - (3) સમસ્યાના સંભવિત કારણો (Probable Reasons of Problems)
  - (4) જરૂરી માહિતીનું એકત્રીકરણ (Data Collection)
  - (5) ઉત્કલ્પનાઓની રચના (Formation of Hypothesis)
  - (6) પ્રયોગની રૂપરેખા (Planning for Experiment / Programme)
  - (7) માહિતીનું પૃથક્કરણ અને અર્થઘટન (Analysis & Interpretation of data)
  - (8) તારણો અને અનુકાર્ય (Conclusions & Followup Work)
- હવે આપણે ક્રિયાત્મક સંશોધનના સોપાનોની વિગતવાર સમજ મેળવીશું.

**(1) સમસ્યા પસંદગી (Selection of Problem) :**

આ સોપાનમાં શિક્ષક દ્વારા સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. અહીં, શિક્ષકને નડતી સમસ્યાઓ પૈકી જે સમસ્યા વધુ બાળકોને નડતી હોય અથવા તો જે બાબત વર્ગખંડ કાર્યમાં અવરોધરૂપ હોય તે સંશોધનની સમસ્યા તરીકે શિક્ષક દ્વારા પસંદ કરવામાં આવશે. ઉદા. વિદ્યાર્થીઓ મૂળાક્ષરો લખવામાં ભૂલ કરે છે. વિદ્યાર્થીઓ જોડણી ખોટી લખે છે, વિદ્યાર્થીઓ વાંચનમાં તકલીફ પડે છે, વિદ્યાર્થીઓ વિજ્ઞાનના અમૂર્ત ખ્યાલો સમજી શકતા નથી. વગેરે.

**(2) સમસ્યા ક્ષેત્ર (Area of Problem) :**

શાળામાં દરેક ધોરણમાં વયકક્ષા અનુસાર વિદ્યાર્થીઓ જોવા મળે છે. એક શિક્ષકને નડતી સમસ્યા બીજા શિક્ષકને ન પણ નડતી હોય એવું બની શકે.

આથી જે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવે છે તે કઈ શ્રેણીના, કઈ વયકક્ષાના, કયા વિષયમાં સમસ્યા અનુભવાય છે તેનો ઉલ્લેખ કે સ્પષ્ટીકરણ જ્યારે વિધાન કે કથન સ્વરૂપે કરવામાં આવે છે ત્યારે સમસ્યાક્ષેત્ર સ્પષ્ટ થાય છે. ઉદા. સુરત શહેરની નગરપાલિકા સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ જોડાક્ષર વાચનમાં ભૂલો કરે છે.

**(3) સમસ્યાના સંભવિત કારણો (Probable Reasons of Problems) :**

શિક્ષક દ્વારા પસંદ થયેલ કે સ્પષ્ટ થયેલ સમસ્યા પાછળ સંભવિત કયા કારણો જવાબદાર હોઈ શકે તેની સ્પષ્ટતા અહીં કરવામાં આવે છે. આવા કારણોની યાદી તૈયાર કરી પછી શિક્ષક તેને સંબંધિત પૃષ્ઠિ મેળવવાનો પ્રયત્ન હાથ ધરે છે. ઉદા. ઉપરોક્ત સોપાનમાં દર્શાવેલ સમસ્યાના સંભવિત કારણો નીચે મુજબ હોઈ શકે.

- બાળકને જોડાક્ષરો ઓળખતા ન આવડતા હોય.
- બાળકને જોડાક્ષરો શીખવવામાં જ ન આવ્યા હોય.
- બાળકને પૂરતા પ્રમાણમાં જોડાક્ષરો વાચવાની પ્રેક્ટિસ ન કરાવવામાં આવી હોય.
- બાળકને વાચનને મહત્વ ન આપતા હોય.
- બાળકો પહેલેથી જ જોડાક્ષરો પ્રત્યે ગંભીરતા ન દાખવતા હોય.

**(4) જરૂરી માહિતીનું એકત્રીકરણ (Data Collection) :**

આ સોપાનમાં શિક્ષક પાસે ઉપલબ્ધ દરેક સ્ત્રોતોનો ઉપયોગ કરી કેટલીક પાયાની માહિતી એકત્રિત કરવી પડે છે. શિક્ષક દ્વારા વિચારાયેલા તમામ સંભવિત કારણોના સંદર્ભમાં પૃષ્ઠિકરણ કરવા માહિતી એકત્રિત કરવામાં આવે છે. જેની પૂર્તતા કરવા માટે આ સમસ્યા સાથે સંબંધિત દરેક વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવી સમસ્યાની ચર્ચા કરવામાં આવે છે. જરૂર પડે છે તે પૂર્વક વિદ્યાર્થીઓનું અવલોકન કરીને પણ માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે. ક્યારેક દસ્તાવેજો દ્વારા પણ માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે છે. ઉદા. ઉપરોક્ત ઉદાહરણના સંદર્ભમાં વિદ્યાર્થીઓને વ્યક્તિગત બોલાવી તેઓને કયા

જોડાક્ષરોમાં સમસ્યા અનુભવાય છે તેની જાણકારી રૂબરૂમાં મેળવવીએ માહિતી એકત્રીકરણનું સોપાન બનશે.

**(5) ઉત્કલ્પનાઓની રચના (Formation of Hypothesis) :**

ઉત્કલ્પનાઓની રચના દ્વારા સમસ્યા માટે જવાબદાર કારણના નિવારણ કે તેના સંભવિત ઉકેલ માટે પરિણામની આગાહી કરવામાં આવે છે. અહીં ઉત્કલ્પના રજૂ કરતું વિધાન “જો... તો...” સ્વરૂપે હોય છે.

ઉદા. જો વિદ્યાર્થીઓ જોડાક્ષરોની અગત્યતા સમજે તો જોડાક્ષર વાંચનમાં થતી ભૂલો અટકાવી શકાય.

**(6) પ્રયોગની રૂપરેખા (Planning for Experiment / Programme) :**

સંપૂર્ણ સંશોધનની પ્રક્રિયા દરમિયાન આ ખૂબ જ અગત્યનું સોપાન છે. સમસ્યાના નિવારણ / ઉકેલ માટે રચાયેલ ઉત્કલ્પનાની ચકાસણી કરવીએ ખૂબ આવશ્યક છે. આથી સમસ્યાના અનુસંધાને તેના નિવારણ માટે પ્રયોગની રૂપરેખા નક્કી કરવામાં આવે છે જેમાં નીચેની બાબતોની કાળજી લેવી જરૂરી બને છે.

- (1) પ્રયોગનો સમયગાળો
- (2) વિષયવસ્તુ અનુસાર શૈક્ષણિક પ્રવૃત્તિઓની પસંદગી
- (3) વિદ્યાર્થીઓની વયકક્ષ અનુસાર પ્રવૃત્તિઓની પસંદગી
- (4) પ્રવૃત્તિઓનું સુચારું અમલીકરણ
- (5) નિર્ધારિત પ્રવૃત્તિઓ માટેના સ્ત્રોત
- (6) મૂલ્યાંકન

**(7) માહિતીનું પૃથક્કરણ અને અર્થઘટન (Analysis & Interpretation of data) :**

બાળકોને પ્રવૃત્તિઓ દ્વારા શીખવાયેલ વિષયવસ્તુ સીધી રીતે દૃશ્યમાન હોતુ નથી. આથી મૂલ્યાંકન પ્રવિધિ દ્વારા બાળકોએ પ્રવૃત્તિઓ દ્વારા કેટલા પ્રમાણમાં વિષયવસ્તુ આત્મસાત કર્યું તેની ચકાસણી આવશ્યક બને છે. આ માટે વિદ્યાર્થીઓનું લેખિત મૂલ્યાંકન, અવલોકન દ્વારા મૂલ્યાંકન, વિવિધ પ્રકારની કસોટીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓમાં જોવા મળતી સમસ્યા કેટલા અંશે ઓછી થઈ તેની સચોટ માહિતી મેળવી શકાય અને તેનું અર્થઘટન કરી શકાય. ઉપરોક્ત ઉદાહરણના અનુસંધાને બાળકોને ફકરાનું વાંચન કરાવીને જોડાક્ષર વાચનમાં થતી ભૂલોનું મૂલ્યાંકન કરી શકાય છે.

**(8) તારણો અને અનુકાર્ય (Conclusions & Followup Work) :**

આ સોપાનની સ્પષ્ટતા વગર ક્રિયાત્મક સંશોધનની અસરકારકતા ચકાસી શકાતી નથી સમગ્ર પ્રયોગના અંતે શિક્ષકને, સંશોધકને કેટલી સફળતા મળી તેનું મૂલ્યાંકનના આધારે તારણ કાઢી શકાય છે. આ તારણને ધ્યાને રાખી હવે પછી શિક્ષણ પ્રક્રિયામાં કયા પ્રકારના સુધારા અનિવાર્ય છે તેની જાણકારી પ્રાપ્ત થાય છે. અનુકાર્ય એ ક્રિયાત્મક સંશોધનનું હાર્દ છે અનુકાર્ય વગર કોઈ પણ પ્રયોગની અસરને સામાન્ય સ્વરૂપ આપી શકાતું નથી. અનુકાર્યની મદદથી પ્રયોગની અસરને કાયમી બનાવી શકાય છે.

આમ શિક્ષક ઉપરોક્ત સોપાનો અનુસાર પોતાને નડતી સમસ્યાઓ વૈજ્ઞાનિક ઢબે અનાત્મલક્ષી રીતે કોઈપણ પ્રકારની તરફેણ કે પક્ષપાત કે પૂર્વગ્રહ વગર નક્કર પ્રયત્નો દ્વારા સમસ્યા ઉકેલ લાવી વર્ગખંડ શિક્ષણ પ્રક્રિયામાં સુધાર લાવી શકશે.

---

**16.5 ક્રિયાત્મક સંશોધનના ઉદાહરણ :**

ઉપરોક્ત સોપાનો સાથે શક્યતઃ એક એક ઉદાહરણો દ્વારા સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત એવા કેટલાક ઉદાહરણો છે જે શિક્ષકને સામાન્ય રીતે શિક્ષણ પ્રક્રિયામાં નડતરરૂપ હોય છે. જે નીચે મુજબ છે.

- (1) ધોરણ - 4ના વિદ્યાર્થીઓ જોડાક્ષરો લખવામાં ભૂલ કરે છે.
- (2) ધોરણ - 5ના વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાન વિષયનાં નકશાપૂર્તિ કરવામાં ભૂલો કરે છે.
- (3) નિશ્ચિત ધોરણના વિદ્યાર્થીઓ અઠવાડિયાના ચોક્કસ દિવસે શાળાએ નિયમિત રીતે સમયસર આવતા નથી.
- (4) પટેલનગરની શાળાના વિદ્યાર્થીઓ શનિવારે શાળાએ આવતા નથી.
- (5) ધોરણ - 2 ના વિદ્યાર્થીઓ નાના વાક્યોનું વાચન કરી શકતા નથી.
- (6) ચોક્કસ વિદ્યાર્થીઓનું જૂથ ક્યારેય શાળામાં ગૃહકાર્ય લાવતું નથી.
- (7) ચોક્કસ વિસ્તારમાંથી આવતા બાળકો શાળામાં અપશબ્દો બોલે છે.
- (8) ધોરણ - 7ના વિદ્યાર્થીઓ ને ત્રણ રકમના ગુણાકારના દાખલા ગણવામાં ખૂબ જ ભૂલો પડે છે.
- (9) વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં આકૃતિઓ ગદોરી શકતા નથી.
- (10) ધોરણ - 8ના વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં ભૂમિતિ એકમમાં ખૂબ જ ક્યાશ ધરાવે છે.
- (11) વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક સંકલ્પનાઓ સમજવામાં સમસ્યા નડે છે.
- (12) વિદ્યાર્થીઓ સામાન્ય સમીકરણનો સંતુલિત કરી શકતા નથી.
- (13) વિદ્યાર્થીઓ તત્વોની સંજ્ઞા લખવામાં ભૂલો કરે છે.
- (14) વિદ્યાર્થીઓ વિજ્ઞાનના સામાન્ય નિયમો સમજી શકતા નથી.
- (15) વિદ્યાર્થીઓ દળ, કદ, વેગ, પ્રવેગ જેવી શાબ્દિક સંકલ્પનાઓની સમજૂતી આપી શકતા નથી.

---

#### 16.6 ઉપસંહાર :

---

આમ, દરેક શિક્ષક તેનાં વર્ગખંડમાં વિશ્લેષણાત્મક રીતે અવલોકન કરે તો તેને અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળશે જે તેમના વર્ગખંડ કાર્યમાં વિવિધ પ્રકારે અવરોધરૂપ સાબિત થશે. આથી સંશોધક તરીકે વર્ગખંડકાર્ય સુધારક તરીકે શિક્ષકે ક્રિયાત્મક સંશોધનનો સહારો લેવો અતિઆવશ્યક છે.

## સંદર્ભ સાહિત્ય

### ગુજરાતી સંદર્ભો :

- ઉચાટ, ડી. એ. (2012). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર (સંવર્ધિત દ્વિતીય આવૃત્તિ) રાજકોટ : પારસ પ્રકાશન
- કોરડીયા, એમ. આર. અને વોરા, આઈ.ડી (2014), શાળાકીય સર્વગ્રહી મૂલ્યાંકન (શિક્ષક માર્ગદર્શિત) ગાંધીનગર : જીસીઈઆરટી.
- મહેતા, એ. જે., ભટ્ટ, જે એસ અને અન્ય (2012) પેડગોજી (મોડ્યુલ) ગાંધીનગર જી.સી.ઈ.આર.ટી.
- રાઠોડ, આર. આર. (2012). વિજ્ઞાન અને ટેકનોલોજી (પદ્ધતિ અને વિષયવસ્તુ) અમદાવાદ, અક્ષર પ્રકાશન
- શાહ, ડી.બી. (2006). શૈક્ષણિક સંશોધન. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.

### અંગ્રેજી સંદર્ભો :

- Bala, R. (2007). Educationakl Research, New Delhi Alfa Publication.
- Best , J. W. Aud Kahn, J. V. (2006), Research in Education (10th Edition) New Delhi Prentice - Hall of India Pvt. Ltd.
- Good, C.V. (2006) How to do Research in Education. New Delhi Cosmo Publication.
- Mangal, S. K. (1995) Teaching of Physical & Life Science, New Delhi : Avg Book Depot.
- Prabha, S., Khirwadkar, A. and others (2013)  
Pedagogy of Science Text book for B. Ed. (Part - II) New Delhi : NCERT
- Sharma, R.C. (1995), Modern Science Learning New Delhi \_ Dhanpat Rai & Sons.
- Uppal, S. and Sutar, B. (2006) National Focus Group on Teaching of Science. New Delhi : NCERT

### Websites :

[http://www.cdc.gov/std/program/ ProgEvaluation pdf](http://www.cdc.gov/std/program/ProgEvaluation.pdf)  
[www.socialresearchmethods.net/kb/variables. php](http://www.socialresearchmethods.net/kb/variables.php)